



॥ શ્રીસ્વામિનારાયણો વિજયતેતરામ ॥

મહુર્ણી વેદવ્યાસ પ્રણીત

## શ્રીમદ્ ભાગવત મહાપુરાણ - : દર્શામ રક્ષણ :-

પ.પૂ.ધ.ધુ. આચાર્ય શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી  
મહારાજની આજ્ઞાથી છપાવી

- : પ્રસિદ્ધ કરનાર :-

મહંત પુરાણી સ્વામી શ્રીધર્મનંદનદાસજી  
શ્રીસ્વામિનારાયણ મંદિર, ભુજ-કરણ.

- : સંશોધક :-

શાસ્ત્રી સ્વામી સિદ્ધેશ્વરદાસજી  
પુરાણી સ્વામી ઈશ્વરસ્વરૂપદાસજી

કીમત - રૂ. - ૧૦૦

સંવત् ૨૦૬૩  
જન્માષ્ટમી

પ્રથમ આવૃત્તિ  
પ્રત. ૩૦૦૦

તા. ૪-૬-૦૭  
મંગળવાર

- : પુસ્તક કયાંથી મેળવશો ? :-

શ્રીસ્વામિનારાયણ મંદિર, શ્રીનરનારાયણદેવ કોઠાર.  
શ્રીસ્વામિનારાયણ રોડ, સીટી પોલીસ સ્ટેશન સામે  
ભુજ - કરણ, પીન. ૩૭૦૦૦૧

મહંત શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી, મહંત પુરાણી સ્વામી  
હિન્દુસ્વરૂપદાસજી, સ.ગુ. સ્વામી ધર્મકિશોરદાસજી, સ.ગુ. પુરાણી  
સ્વામી ધનશ્યામજીવનદાસજી, સ.ગુ. સ્વામી માધવપ્રિયદાસજી,  
સ.ગુ. કોઠારી પાર્શ્વ સામજી ભગત આદિ ભુજ મંદિરના વડીલ  
સંતોની પ્રસક્તિાર્થી તથા તેઓના સ્મરણાર્થી.

અ.નિ. કલ્યાણભાઈ નારણ કેરાદની પૂણ્ય સ્મૃતિમાં આ  
ગ્રંથ છપાવવાની સેવા કરનાર દાતાશ્રીઓ.

ગામ બળદીયાના પ.ભ. પિતાશ્રી મનજીભાઈ આણાં  
કેરાદ અ.નિ. માતુશ્રી ધનબાઈ મનજીના મોક્ષાર્થી, હસ્તે નારણભાઈ  
મનજી કેરાદ ધ.પ. વાલબાઈ તથા અ.નિ. ધ.પ. વાલબાઈ સુપુત્ર  
અ.નિ. કલ્યાણભાઈ નારણ ધ.પ. ગં.સ્વ. કાન્તાબેન પોત્ર ઉમેષ  
તથા નરેન્દ્ર, સુપુત્ર કાન્તિભાઈ નારણ ધ.પ. નિતાબેન પોત્ર કૌશિક  
તથા દેવેન આદિ સર્વેના ફુટંબીજનોના આત્માંતિક મોક્ષાર્થી આ  
પુસ્તક છપાવવામાં સેવા કરેલ છે.

- : કંપોઝ તથા ટાઇપ સેટીંગ :-

પુરાણી સ્વામી બળદેવપ્રસાદદાસજી  
શ્રીનરનારાયણદેવ કોમ્પ્યુટર  
શ્રીસ્વામિનારાયણ મંદિર, ભુજ-કરણ.

મુદ્રક :- શ્રીનરનારાયણ પ્રિન્ટિંગ પ્રેસ  
શ્રીસ્વામિનારાયણ મંદિર, ભુજ

## -: પ્રસ્તાવના :-

સર્વાવતારી સકળ મંગલગુણિધાન અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રીસ્વામિનારાયણ ભગવાન અનંત જ્ઞાત્માઓનાં કલ્યાણ કરવા માટે આ ભૂમંડળમાં ભારતમાં ઉત્તર કૌશલ દેશમાં સરયૂકીનારે અયોધ્યા પાસે છપૈયા ગામને અક્ષરધામરૂપ કરીને સરવરીયા બ્રાહ્મણ કુળમાં શ્રીધર્મ-ભક્તિને ભવન વિ. સં. ૧૮૩૭ ના ચૈત્રસુદિ ૮ તા. ૨-૪-૧૭૮૧ ને સોમવારે રાત્રે દશ વાગ્યે પ્રગટ થયા. માત-પિતાના મનોરથ પૂર્ણ કરવા હુલામણું નામ ઘનશ્યામ ધારીને અનેક બાળચેષ્ટાઓ કરીને માત-પિતા તથા બાળમિત્રોને અલોકિક સુખો આપ્યાં, અયોધ્યામાં પણ અનેક લીલાઓ કરીને માત-પિતાને પોતાની અખંડ ચરણકમળની સેવા આપી વર્ણવિષ ધારણ કરીને વનવિચરણ કરવા પદ્ધાર્યા. ત્યાં અનેક તીર્થોને તેથિતવપું આપીને આ ભૂમિને પાવન કરી, સાત વર્ષ પછી ગુજરાત સૌરાષ્ટ્રમાં માંગરોળ બંદર પાસે લોજ ગામે પદ્ધાર્યા.

ત્યારપછી ઉદ્વાવતાર જગદ્ગુરુ શ્રીરામાનંદ સ્વામી પાસે દિક્ષા લઈને શિષ્ય તરીકે સેવા કરી. ગુરુ રામાનંદ સ્વામીએ સ્થાપેલ ઉધ્વચ સંપ્રદાયની ધુરા સર્વાવતારી શ્રીહરિને સૌંપી ત્યારપછી શ્રીહરિએ ગુરુજીએ સ્થાપેલ સંપ્રદાય શ્રીરામાનુજ્ઞાયાર્થનો જે વિશિષ્ટાદ્વિતમતના સિધ્યાંતાનુસાર પ્રમાણરૂપ સ્વીકાર્ય રાખ્યો. તેમજ પોતાને પ્રિય એવાં આઠ સચ્છાસ્ત્ર શિક્ષાપત્રી શ્લોક ૮૭-૮૫ તથા વચનામૃત વડતાલના ૧૮ માં જણાવ્યાં છે.

આપણા ઈષ્ટદેવને ઈષ્ટ એવાં સચ્છાસ્ત્ર આપણને પણ ઈષ્ટ હોય જ. તો આ આઠેય શાસ્ત્ર આપણી પાસે વસાવવાને જોઈએ. તેમાં કેટલાંક અપ્રાપ્ય હોવાથી છપાવીને પ્રસિધ્ધ થાય તો સત્સંગી ભક્તજનોને પ્રામ થઈ શકે. આ આઠશાસ્ત્ર મધ્યે શ્રીજીમહારાજને અતિ પ્રિય શાસ્ત્ર શ્રીમદ્ ભાગવતનો દશમસંક્ષિપ્ત હતો. મહારાજે ગ.મ. ૨૮ માં કહ્યું છે કે શ્રીમદ્ ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી. વળી શિક્ષાપત્રીના શ્લોક ૮૮ માં લખ્યું કે દશમસંક્ષિપ્ત તે અમારું ભક્તિશાસ્ત્ર છે. કારણ કે એમાં ભગવાનના ભક્તને ગોપીઓના જેવી પ્રેમલક્ષ્ણા ભક્તિ કરીને ભગવાનને વશ કરવા એવી ભક્તિ કહી છે. તેમજ આખા ભાગવતરૂપી શરીરનું હૃદય દશમસંક્ષિપ્ત કહેલું છે. માટે દશમસંક્ષિપ્ત અતિ શ્રેષ્ઠ છે. વળી મહારાજે શિક્ષાપત્રી શ્લોક ૧૧૭ માં આજા આપી છે કે શ્રીમદ્ ભાગવતનો દશમસંક્ષિપ્ત જેતે નિત્ય પ્રત્યે આદર થકી વર્ષોવર્ષ એકવાર તો અવશ્ય સાંભળવો અને ભાણેલા હોય તેમણે નિત્ય પ્રત્યે વાંચવો અથવા વર્ષમાં એકવાર વાંચવો.

આવી શ્રીજીમહારાજની આજાનું પાલન થાય ને મહારાજ રાજ થાય તેનું અનુસંધાન રાખીને આવાં શાસ્ત્રનો દરેક ભક્તનોને વાંચવા સાંભળવાનો લાભ મળે, તેમજ વાચી વિચારીને ગોપીઓના જેવી મહારાજને વિષે પ્રેમલક્ષ્ણા ભક્તિ ઉદ્ય થાય આવા શુભ હેતુથી આપણા શ્રીનરનારાયણાદેવ કોઠાર ભુજ તરફથી પ્રથમ વખત આ દશમસંક્ષિપ્તના જેમ શ્લોક છે તેમ જ તેના અર્થો કરીને છાપીને પ્રસિધ્ધ કરીએ છીએ.

## શ્રીમદ્બાગવતપુરાણમ्

ધણા સમયથી વારંવાર ભક્તજનોની માગણી થતી હતી કે, શ્રીજીમહારાજને ઈષ્ટ આઠ શાસ્ત્રો આપણાં મંદિરમાંથી મળે તો અમારે વાંચવાનો અને વસાવવાનો લાભ મળે. અમારાં ધરમાં જો આ આઠશાસ્ત્રો કબાટમાં સાંચાવી રાખ્યા હોય તો અમને એવો અમલ હોય કે અમારી આ સાચી મૂડી છે. શિક્ષાપત્રી, વચનામૃત, સત્સંગિજીવન, વાસુદેવ માહાત્મ્ય તો હોય જ પણ આ શાસ્ત્રો ઓછાં મળતાં હોવાથી તમે છપાવો આવી ભક્તોની માગણીને સંતોષવા અમો આ શ્રીમદ્ ભાગવતના દશમસંક્ષિપ્તની પ્રથમ આવૃત્તિ બાહાર પાડીએ છીએ. ચાતુર્માસના નિયમોમાં આ શાસ્ત્રની પારાયણ કરવાના નિયમવાળા ભક્તોને આ શાસ્ત્ર સુગમ થશે. આ શાસ્ત્રનો સહુ સત્સંગીઓ લાભ લે એવી આશા રાખીએ છીએ.

લી. મહંત પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી  
શ્રીસ્વામિનારાયણ મંદિર, ભુજ - કર્ણ.

## પુરોવચન

આપણા ઈષ્ટદેવ શ્રીસ્વામિનારાયણ ભગવાને પોતાના જીવનકાળ દરમ્યાન કઠોર તપશ્ચર્યા સાથે વેદ, ઉપનિષદ્, શ્રુતિ, સ્મૃતિ જેવા ગણ ગંભીર ધર્મગ્રંથોનું વાંચન, મનન અને દોહન કરી સામાન્ય માનવી પણ સમજ સ્વીકારી અમલ કરી શકે તેવી સરળ શહેલીમાં સંક્ષિપ્ત અને સર્વશ્રેષ્ઠ “શિક્ષાપત્રી” જેવા અદ્ભુત ગ્રંથની સર્વજીવોના કલ્યાણ અર્થે રચના કરી જેમાં આ લોકમાં અને પરલોકમાં સુખીયા થવાનો રાહ ચીંધ્યો છે.

આ અતિ પાવિત્ર ગ્રંથ “શિક્ષાપત્રી” માં જીવન, કવન અને મોક્ષ માટે શ્રીજીમહારાજે બતાવેલ માર્ગ પૈકી શ્લોક ૮૭-૮૪ માં આઠ સચ્છાસ્ત્રને ઈષ્ટ તરીકે માન્ય કર્યા છે. ૮૮ માં શ્લોકમાં વાંચન શ્રવણથી ઈષ્ટદેવનું મહાત્મ્ય અને ભક્તિની દંડતાનો માર્ગ ચીંધ્યો છે. અને તેના માટે આઠ સચ્છાસ્ત્ર પૈકી શ્રીમદ્ ભાગવત પુરાણના દશમ અને પંચમ સંક્ષિપ્તને સર્વથી અધિક ગણ્યા છે. શ્લોક ૧૧૭ માં ભક્તિની દંડતા માટે દશમ સંક્ષિપ્તનો સર્વાધિક તરીકે સ્વીકાર કરી નિત્ય પ્રત્યે વાંચવાનો આગ્રહ રાખ્યો છે. અને ઓછામાં ઓછો વર્ષમાં એકવાર વાંચવો જ એવી આજા કરી છે. પ્રત્યેક સત્સંગીઓને ચાતુર્માસમાં લેવાના વિશેષ નિયમોરૂપે દશમ સંક્ષિપ્ત વાંચવાની ઈષ્ટથા થાય છે પણ એલાયદુ દશમ સંક્ષિપ્તનું પુસ્તક ઉપલબ્ધ નથી.

દશમ સંક્ષિપ્તનું પુસ્તક પ્રકાશિત કરવા મંદિર પાસે ધણા લાભા સમયથી સત્સંગીઓ દ્વારા માંગણીઓ આવ્યા કરતી હતી પણ શક્ય બન્યું ન હોતું હમણા ગામ બળદીયાના પ.ભ. નારણભાઈ કેરાઈએ પોતાના તરફથી ૩૦૦૦ પુસ્તકો છાપવા વિનંતિ કરતાં શ્રીજીમહારાજની દયા અને પ્રેરણાથી જેની સત્સંગીઓમાં લાંબા સમયની માંગ હતી તેનું પ્રકાશન કરતાં ખૂબ આનંદ થાય છે.

## શ્રીમદ્ગાગવતપુરાણમ्

૬

૫

### - : વિષયાનુક્રમણિકા :-

અધ્યાય

૧ કંસે દેવકીના છ પુભોનો કરેલો નાશ.	૫૪
૨ દેવકીના ગર્ભમાં રહેલા શ્રીકૃષ્ણ ભગવાનની દેવતાઓએ કરેલી સ્તુતિ.	૬
૩ શ્રીકૃષ્ણનો જન્મ અને તેમનું ગોકુળમાં પદ્ધારવું.	૧૮
૪ કંસે બાળકોની કરાવવા માંડેલી હિંસા.	૨૫
૫ શ્રીકૃષ્ણના જન્મથી નંદજીએ કરેલો મહોટ્સવ.	૩૪
૬ શ્રીકૃષ્ણો કરેલો પુતનાનો વધ.	૪૦
૭ શ્રીકૃષ્ણો ગાડું ઊંઘું પાડચું તથા તૃણાવર્તનો નાશ કર્યો.	૪૪
૮ શ્રીકૃષ્ણ અને બળદેવનાં ગગાંચાર્ય નામ પાડચાં તથા માટી ખાતાં માતાને વિશ્વરૂપ દેખાકચું.	૪૮
૯ ગોળી ફોડવાથી યશોદાએ શ્રીકૃષ્ણને દામણાંથી બાંદ્યા.	૬૨
૧૦ શ્રીકૃષ્ણ ભગવાને યમલાજૂનનો કરેલો મોક્ષ.	૬૫
૧૧ શ્રીકૃષ્ણ ભગવાને વલ્સાસુર તથા બકાસુરનો મોક્ષ કર્યો.	૭૧
૧૨ શ્રીકૃષ્ણ ભગવાને અધાસુરનો કરેલો વધ.	૭૮
૧૩ બ્રહ્માએ વાઇડાં તથા બાળકોનું હરણ કરવાથી ભગવાન તે સર્વરૂપ થયા.	૮૪
૧૪ બ્રહ્માએ શ્રીકૃષ્ણની કરેલી સ્તુતિ.	૮૩
૧૫ ભગવાન શ્રીકૃષ્ણો તાડવનમાં કરેલો ધેનુકાસુરનો વધ.	૧૦૫
૧૬ ભગવાને કરેલું કાલીનાગનું દમન.	૧૧૨
૧૭ દાવાનથનું પાન કરતા ભગવાન.	૧૨૨
૧૮ બલરામ દ્વારા કરાયેલો પ્રલંબાસુરનો વધ.	૧૨૫
૧૯ દાવાનથનું પાન કરીને ગોપો તથા ગાયોની રક્ષા કરતા ભગવાન.	૧૨૮
૨૦ વર્ષાંત્રતુ તથા શરદાંત્રતુનું પ્રાકૃતિક વર્ણન.	૧૩૧
૨૧ ગોપીઓ દ્વારા થયેલું શ્રીકૃષ્ણના વેણુનાદનું વર્ણન.	૧૩૮
૨૨ વરસ્ત્ર હરણની લીલા કરતા ભગવાન.	૧૪૨
૨૩ વિપ્રલીઓ ઉપર અનુગ્રહ કરવા માટે ભગવાને યઝમાં કરેલ અશ્વની યાચના.	૧૪૭
૨૪ શ્રીકૃષ્ણ ભગવાને કરાવેલો ગોવર્ધન મહોટ્સવ.	૧૫૫
૨૫ ગોકુળની રક્ષા માટે ગોવર્ધન પર્વતને ઉપાડતા ભગવાન.	૧૫૮
૨૬ ભગવાનનાં અદ્ભુત કર્માંથી વિસ્મય પામેલા ગોવાળો પ્રત્યે ગગાંચાર્યની ઉંકિતનું વર્ણન કરતા નંદરાય.	૧૬૨
૨૭ કામદેનું અને દાન્દે શ્રીકૃષ્ણ ભગવાનનો અભિષેક કર્યો.	૧૬૫
૨૮ શ્રીકૃષ્ણ ભગવાન વરણ લોકમાંથી નંદરાયને પાછા લાવ્યા અને ગોવાળોને વૈકુંઠ દેખાકચું.	૧૬૮

૨૯ રાસલીલાના સમારંભમાં શ્રીકૃષ્ણાભગવાનનું અંતર્ધારન થવું.	૧૭૧
૩૦ વિરછથી તપેલી ગોપીઓ ભગવાનને વનમાં શોદે છે.	૧૮૦
૩૧ ભગવાનના અંતર્ધારનથી નિરાશ થયેલી અને કેવળ ભગવાનનાજ ગુણોનું ૧૮૬ ગાયન કરતી ગોપીઓ. (ગોપી ગીત)	
૩૨ ગોપીઓના વિરછથી પીગલોલા શ્રીકૃષ્ણ ભગવાને પ્રગટ થઈ, માન આપી, ૧૯૦ ગોપીઓને શાંત કરી.	
૩૩ ગોપીઓની સાથે રાસલીલા તથા જળલીલા કરતા ભગવાન.	૧૯૪
૩૪ અજગરનો મોક્ષ તથા શંખયુડનો વધ કરતા શ્રીકૃષ્ણ ભગવાન.	૨૦૧
૩૫ ભગવાન વનમાં જતાં યુગાલગીત ગાયને દૃઃખ્યાદિવસો પસાર કરતી ગોપીઓ. ૨૦૫	
૩૬ અરિષ્ટાસુરનો વધ તથા શ્રીકૃષ્ણ અને બળદેવજુને વસુદેવના પુત્ર જાણી ૨૦૮ મથુરા લાવવા માટે કંસે કરેલી અકૂરને આણા.	
૩૭ કેશી તથા વ્યોમાસુર દૈત્યને મારતા શ્રીકૃષ્ણ ભગવાન.	૨૧૪
૩૮ ગોકુળમાં જધને શ્રીકૃષ્ણ તથા બળદેવજુ દ્વારા સંકારને પામતા અકૂરજી. ૨૧૬	
૩૯ કૃષ્ણ મથુરા જવાથી ગોપીઓનો વિલાપ તથા અકૂરજીને યમુનાના જળમાં ૨૨૫ દિવ્ય દર્શન.	
૪૦ અકૂરજીનો ભગવાનની સ્તુતિ કરી.	૨૩૩
૪૧ ભગવાને મથુરામાં પ્રવેશીને ધોખીને માર્યો તથા સુદામા માણી અને દરજી ૨૩૭ ઉપર પ્રસંગ થયા.	
૪૨ શ્રીકૃષ્ણ ભગવાનો કુલજાનો ઉદ્ધાર તથા ધનુષનો ભંગ કર્યો.	૨૪૩
૪૩ અખાડાના દ્વારમાં કુવત્યાપીડ હાથીને મારીને, મલ્લના અખાડામાં પ્રવેશ ૨૪૮ કરતા શ્રીકૃષ્ણ ભગવાન તથા બળદેવજી.	
૪૪ શ્રીકૃષ્ણ ભગવાને મલ્લોનો તથા કંસનો નાશ કરી માતા પિતાને કેદમાંથી ૨૪૩ મુક્ત કર્યા.	
૪૫ માતાપિતાને મધુર વચનોથી સાંત્વના આપી, ઉગ્રણેનો રાજ્યાભિષેક કરી, ૨૪૬ ગુરાને ઘેર ભણવા જતા શ્રીકૃષ્ણ ભગવાન.	
૪૬ શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવજી દ્વારા સંદેશો મોકલાવીને નંદયશોદાનો શોક દૂર ૨૬૫ કર્યો.	૨૭૧
૪૭ ઉદ્ધવજી ગોપીઓને સંદેશો આપીને પાછા મથુરામાં પદ્ધાર્યા.	૨૮૧
૪૮ શ્રીકૃષ્ણ ભગવાન કુલજાની સાથે વિલાર કર્યો અને અકૂરજીને હસ્તિનાપુર ૨૮૬ મોકચ્યા.	
૪૯ ધૂતરાષ્ટ્રનો પોતાના પુત્રો તથા પાંડવો પ્રત્યેનો ભેદભાવ જાણીને મથુરામાં ૨૯૧ આવતા અકૂરજી.	

## શ્રીમદ્બાગવતપુરાણમ्

૭

૮

:- ઉત્તરાદ્ય :-	
૫૦ શ્રીકૃષ્ણો જરાસંધથી ડરીને પોતાના સંબંધીઓને દ્વારકા મોકલ્યાં.	૨૮૮
૫૧ મુચુકુંદ રાજાની દટ્ઠિ દ્વારા કાળથવનનો નાશ કરાવતા તથા સ્તુતિ કરતા મુચુકુંદરાજા ઉપર કૃપા કરતા શ્રીકૃષ્ણા ભગવાન.	૩૦૬
૫૨ શ્રીકૃષ્ણા મથુરાથી દ્વારિકા જઇને રહ્યા અને લક્ષ્મીશુનો સંદેશો સ્વીકાર્યો.	૩૧૨
૫૩ શ્રીકૃષ્ણા ભગવાને બળાત્કારે રાક્ષિણીનું હરણ કર્યું.	૩૧૬
૫૪ શ્રીકૃષ્ણા ભગવાને રાક્ષિણીનું પાણિગ્રહણ કર્યું.	૩૨૬
૫૫ શંખરાસુરે કરેલું પ્રધુભાનું હરણ અને શંખરાસુરનો વધ કરી, રતિની સાથે દ્વારિકા આવતા પ્રધુભાન.	૩૩૦
૫૬ કલંકરૂપ મહિને લાવી આપતા તથા જંબવતી અને સત્યભામાને પરણતા શ્રીકૃષ્ણા ભગવાન.	૩૩૬
૫૭ શતધન્વાને મારવાથી ફરી મહિં ચોરવાનો આરોપ આવતાં ભગવાને અકૂર પાસેથી મહિં મંગાવીને આરોપ દૂર કર્યો.	૩૪૧
૫૮ શ્રીકૃષ્ણા ભગવાન પાંચ દ્વારિઓ સાથે પરણ્યા.	૩૪૭
૫૯ કૃષ્ણા ભગવાને કરેલો નરકાસુરનો વધ અને પાદિજાતનું હરણ.	૩૪૪
૬૦ શ્રીકૃષ્ણા ભગવાને રાક્ષિણીનું કરેલું હાસ્ય તથા સાન્દુન.	૩૬૪
૬૧ શ્રીકૃષ્ણા ભગવાનના પુર પોંઅાદિકની કથા તથા બળભદ્રે કરેલો રાક્ષિણો નાશ.	૩૬૬
૬૨ ઉષા સાથે રમણ કરવાથી અનિરૂધને બાણાસુરે કેદ કર્યો.	૩૭૪
૬૩ શ્રીકૃષ્ણા ભગવાને બાણાસુરના હાથ કાપી નાખ્યા.	૩૮૧
૬૪ શ્રીકૃષ્ણા ભગવાને વૃગરાજાને શાપથી મુકાવ્યો.	૩૮૬
૬૫ બળદેવજુએ ગ્રજમાં જઇને યમુનાઝુને ખેંચ્યાં.	૩૮૦
૬૬ શ્રીકૃષ્ણા ભગવાને પોંડક સહિત તેના મિત્રનો કરેલો નાશ.	૩૮૫
૬૭ બળદેવજુએ રૈવતાચળ પર્વત ઉપર દ્વિલિંગ નામના વાનરને માર્યો.	૩૮૮
૬૮ બળદેવજુએ સાંબને છોડાવીને હસ્તિનાપુર ખેંચ્યું.	૪૦૪
૬૯ દરેક રાણીના ઘરમાં ભગવાનને જોઈને નારદજુ આશ્વાર્ય પાય્યા.	૪૧૦
૭૦ ભગવાનનું આલિકે અને દૂતનો સંદેશો.	૪૧૭
૭૧ ઉદ્ધવુણી સલાહથી શ્રીકૃષ્ણાનું ઇંદ્રપ્રથમાં પદારથું.	૪૨૩
૭૨ રાજસૂય યઙ્ગ પ્રસંગે ભગવાને ભીમસેન દ્વારા જરાસંધનો વધ કરાવ્યો.	૪૨૬
૭૩ જરાસંધે કેદ કરેલા રાજાઓને, શ્રીકૃષ્ણા ભગવાને છોડાવી, તેઓને પોતાનાં રાજ્ય પાછાં સોષ્યાં.	૪૩૪

૭૪ યુદ્ધિષ્ઠિરના રાજસૂય યઙ્ગમાં અગ્ર પૂજના પ્રસંગે શ્રીકૃષ્ણો શિશુપાળનો વધ ર૪૦ કર્યો.	ર૪૦
૭૫ દુર્યોધનનું થયેલું માનબંગા.	ર૪૫
૭૬ યાદવોનું શાલ્વ સાથે યુધ્ય થતાં પ્રધુભાને દાયાલ કરતો શાલ્વનો બળવાન ર૪૮ મંત્રી ધૂમાન.	ર૪૮
૭૭ માયાવી શાલ્વનો તથા તેના વિમાનનો શ્રીકૃષ્ણો નાશ કર્યો.	ર૪૮
૭૮ શ્રીકૃષ્ણો દંતવક્ર તથા વિદૂરથને માર્યા અને બળદેવજુએ રોમહર્ષણને ર૪૮ માર્યો.	ર૪૮
૭૯ બળદેવજુએ બલ્વલને માર્યી નાખીને બ્રહ્મહલ્યાને દૂર કરવા તીર્થયાા ર૪૨ કરી.	ર૪૨
૮૦ દ્વારકા પદાર્ચેલા બાળમિત્ર સુદામાને હર્ષવકે પૂર્વની કથા પૂછતા ભગવાન ર૪૭ શ્રીકૃષ્ણા.	ર૪૭
૮૧ શ્રીકૃષ્ણા ભગવાને સુદામાના પૌંવા જમીને ઇન્દ્રથી અધિક રાજલક્ષ્મી આપી.	ર૪૭
૮૨ સૂર્યગ્રહણ પ્રસંગે કુરાક્ષેત્રમાં નંદ યશોદા અને ગોપીઓને આપેલું મળવાનું ર૪૮ વચન સત્ય કરતા શ્રીકૃષ્ણા ભગવાન.	ર૪૮
૮૩ શ્રીકૃષ્ણા ભગવાન જે રીતે રાત્રીઓને પરણ્યા એ વિષે પોતપોતાના વિવાહની ર૪૫ દ્રૌપદીની પાસે વાતો કહેતી અષ્ટ પટરાણીઓ.	ર૪૫
૮૪ કુરાક્ષેત્રમાં વસુદેવજુએ કરેલો યણા.	ર૪૮
૮૫ વસુદેવને બ્રહ્મજાનનો ઉપદેશ આપતા તથા દેવકીને પોતાના ઇ પુત્રો લાવી ર૪૨ આપતા શ્રીકૃષ્ણા ભગવાન.	ર૪૨
૮૬ સુભદ્રાનું હરણ કરતા અર્જુન તથા ભિથિલા નગરીમાં જઇને જનકરાજા ર૪૮ અને શુતદેવ વિપ્રને આનંદ આપતા શ્રીકૃષ્ણા ભગવાન.	ર૪૮
૮૭ વેદોએ કરેલી નિર્ગુણ બ્રહ્માની સ્તુતિ.	ર૪૫
૮૮ વિષ્ણુના ભક્તને મોક્ષ પ્રાપ્તિનું વર્ણન તથા બીજા દેવોના ભક્તને ઔષ્ણર્ય પ્રાપ્તિનું વર્ણન.	ર૪૦
૮૯ પ્રણ દેવની પરીક્ષા કરીને વિષ્ણુની મહિતા વર્ણવતા ભૃગુઆધિ, તથા મૃત બ્રાહ્મણના પુત્રને પાછા લાવી આપતા શ્રીકૃષ્ણા ભગવાન.	ર૪૮
૯૦ શ્રીકૃષ્ણો કરેલી લીલાઓનું સંક્ષિપ્ત વર્ણન.	૮૦

- : શ્રીમદ્બાગવત દશમ સ્કંદ સમાપ્ત :-



श्रीस्वामिनारायणो विजयतेराम्  
श्रीकृष्णाय नमो नमः

## श्रीमद् भागवतमहापुराण श्रीव्यासभूनि विरचित गुर्जरानुवात सहित दशम स्कंधा

### पूर्वार्ध

अथ प्रथमोऽध्यायः (१)

॥ राजोवाच ॥

कथितो वंशविस्तारो भवता सोमसूर्ययोः । राजां चोभयवंशयानां चरितं परमाद्भूतम् ॥१  
यदोश्च धर्मशीलस्य नितरां मुनिसत्तम ! । तत्रांशेनावतीर्णस्य विष्णोर्वीर्याणि शंस नः ॥२  
अवतीर्ण यदोर्वेशं भगवान् भूतभावनः । कृतवान् यानि विश्वात्मा तानि नो वद विस्तरात् ॥३

अध्याय १

कंसे देवकीना छ पुत्रोनो करेलो नाश.

परीक्षित राजा कहे छे आपे चंद्रवंश तथा सूर्यवंशनो विस्तार कह्यो अने ते  
बन्ने वंशमां उत्पन्न थयेला राजाओनुं परम अद्भुत चरित्र पश कहुं.<sup>१</sup> हे मुनिवर ! स्वधर्म पाणनारा यदुराजानो वंश तो धणा विस्तारथी कह्यो. हवे ए वंशमां  
बलरामनी साथे अवतरेला विष्णुनां पराक्मो अमने कहो.<sup>२</sup> जगतनुं पालन  
करनार विश्वात्मा भगवाने यदुना वंशमां अवतरीने जे पराक्मो कर्या छे ते  
विस्तारथी अमोने कहो.<sup>३</sup> मुक्त, मुमुक्षु अने विषयी एम त्रष्ण प्रकारना लोको  
आ जगतमां छे, तेथोमांथी कोईने पश भगवाननी कथामां तृप्ति थती नथी. केम  
के तृष्णा वगरना मुक्त पुरुषो तेने गाया करे छे. ए कथा संसारना औषध रूप

निवृत्ततर्थैरुपगीयमानाद् भवौषधाच्छ्रोत्रमनोऽभिरामात् ।  
क उत्तमश्लोकगुणानुवादात् पुमान् विरज्येत विना पशुनात् ॥४॥  
पितामहा मे समरेऽमरञ्जयैर्देवताद्यातिरथैस्तिमिङ्गलैः ।  
दुरत्ययं कौरवसैन्यसागरं कृत्वातरन् वत्सपदं स्म यत्प्लवाः ॥५॥  
द्रौणयस्त्रविष्णुष्मिदं मदङ्गं संतानबीजं कुरुपाण्डवानाम् ।  
जुगोप कुक्षिं गत आत्तचक्रो मातुश्च मे यः शरणं गतायाः ॥६॥  
वीर्याणि तस्याखिलदेहभाजामन्तर्बहिः पूरुषकालस्त्रैः ।  
प्रयच्छतो मृत्युमुतामृतं च मायामनुष्टस्य वदस्व विद्वन् ! ॥७॥  
रोहिण्यास्तनयः प्रोक्तो रामः सङ्कर्षणस्त्वया । देवक्या गर्भसम्बन्धः कुतो देहान्तरं विना ॥८  
कस्मान्मुकुन्दो भगवान् पितुर्गेहाद् ब्रजं गतः । क्रवासं ज्ञातिभिः सार्थं कृतवान् सात्वतांपतिः ॥९

छे, तेथी मुमुक्षु लोकोने पश उपाय छे. कान अने  
मनने प्रिय लागनार छोवाथी विषयी पुरुषोने पश सर्वोत्तम विषय ए जे छे.  
माटे पशुनी समान वृत्तिवाणा केवण मूर्खं पुरुष विना बीजो कयो पुरुष  
भगवाननी कथामांथी विराम पामे ? न जे पामे.<sup>४</sup> अमारे तो भगवाननी कथा  
निरंतर सांभणी जे जोईये; केम के अमारा कुणाना देवतरूप तो श्रीकृष्ण जे  
हता. युद्धमां देवताओने पश श्वी लेनारा भीष्मदेवज्ञ आदि अतिरथीओरुपी  
मोटा मत्स्योने लीधे जेने कोईनाथी पश तरी शकाय नहि एवा कौरवोना सैन्यरुपी  
महासागरने मारा दादा पांडवो, भगवानरुपी वहाणना आश्रयथी वाइडाना  
पगना खाबोयिया जेवो गणी तरी गया हता.<sup>५</sup> भगवाने केवण पांडवोनी रक्षा  
करी हती एम नथी, पश आ मारा शरीरनी पश एमाणे जे रक्षा करी छे. कौरवो  
अने पांडवोना वंशना बीजरूप आ मारुं शरीर, के जे अथथामाना प्रक्षमाख्यथी  
बणी जतुं हतुं, तेने पश भगवाने पोताने शरणे आवेली मारी माताना उदरमां  
प्रवेशीने सुदर्शन चक्रद्वारा रक्षण कर्यु छे.<sup>६</sup> हे विद्वन् ! समग्र प्राणीओनी अंदर  
पुरुषरूपे स्थित कार्यने करनारा, अने बहार कणरूपे विनाशने करनारा, अने  
पोताना संकल्पथीज मनुष्यभावनुं अनुकरण करनारा एवा श्रीकृष्णनां पराक्म  
कहो.<sup>७</sup> शेषनागना अवताररूप बलरामने एकवार आपे रोहिणीना पुत्र कह्या  
अने बीजवार देवकीना पुत्र कह्या तो बीजा देह विना तेमने देवकीना गर्भनो  
संबंध शाथी थयो ?<sup>८</sup> भगवानने कंसनी बीक लागवी तो संभवे जे नहीं, छतां ते  
पोताना पितानुं घर छोडीने व्रजमां शा माटे पधार्या ? भक्तोना रक्षक भगवाने

व्रजे वसन् किमकरोन्मधुपुर्या च केशवः । भ्रातरं चावधीत् कंसं मातुरद्वातदर्हणम् ॥१०  
देहं मानुषमाश्रित्य कति वर्षाणि वृष्णिभिः । यदुपुर्या सहावास्तीत् पत्न्यः कत्यभवन् प्रभोः ॥११  
एतदन्यच्च सर्वं मे मुने ! कृष्णविचेष्टितम् । वक्तुर्महसि सर्वज्ञ ! श्रद्धानाय विस्तृतम् ॥१२  
नैषातिदुःसहा क्षुन्मां त्यक्तोदमपि बाधते । पिबन्तं त्वमुखाभ्योजच्युतं हरिकथामृतम् ॥१३

### सूत उवाच

एवं निशम्य भृगुनन्दन ! साधुवादं वैयासकिः स भगवानथ विष्णुरातम् ।  
प्रत्यच्चर्च कृष्णचरितं कलिकल्पष्ठं व्याहर्तुमारभत भागवतप्रधानः ॥१४

### श्रीशुक उवाच

सम्पर्ववसिता बुद्धिस्तव राज्ञिसत्तम ! । वासुदेवकथायां ते यज्जाता नैषिकी रतिः ॥१५  
वासुदेवकथाप्रश्नः पुरुषांस्त्रीन् पुनाति हि । वक्तारं पृच्छकं श्रोतृस्तत्पादसलिलं यथा ॥१६  
भूर्मिद्वसनृपव्याजदैत्यानीकशतायुतैः । आक्रान्ता भूरिभारेण ब्रह्माणं शरणं ययौ ॥१७

पोतानी श्रातिओनी साथे क्या स्थणमां निवास कर्यो हतो ?<sup>९</sup> भगवाने व्रजमां  
रहीने तथा भथुरामां रहीने शी शी लीला करी ? अने पोतानी मानो भाई कंस, के  
जेने भारवो न जोईअे छतां तेने पोताने हाथे शा माटे भार्यो ?<sup>१०</sup> मनुष्यनो देह  
धरीने यादवोनी साथे भथुरामां केटलां वर्ष सुधी रह्या हता, अने ते भगवानने  
केटली स्त्रीओ हती ?<sup>११</sup> हे सर्वज्ञ मुनि ! आ अने आ उपरांत पष्ण जे कोई  
भगवाननु चरित्र होय ते सधाणु भने कहेवा माटे योऽय छो; केमके एविषयमां  
भने श्रद्धा छे.<sup>१२</sup> में जो के अन्न अने जण छोडी दीधेलां छे, तो पष्ण तमारा  
मुखारविंधमांथी नीकणतुं भगवाननी कथारूपी अमृतनुं पान करुं छुं, तेथी  
बीजाओथी सहन न करी शकाय ऐवां भूख अने तरस भने बाध पमाडी शकतां  
नथी.<sup>१३</sup>

सूत शौनकने कहे छे हे शौनक मुनि ! वैष्णवोमां मुख्य शुक्टेवज्ज आ प्रमाणे  
उत्तम प्रश्न सांभणी, परीक्षित राज्ञी प्रशंसा करीने कणियुगना दोषोने दूर  
करनारुं भगवाननुं चरित्र कहेवा लाग्या.<sup>१४</sup> शुक्टेवज्ज कहे छे- हे उत्तम राज्ञि  
! तमारो निश्चय बहु ज सारो छे, के जेथी भगवाननी कथामां तमारी बुद्धिने  
निष्ठा थई छे.<sup>१५</sup> गंगाजण जेम त्राणे लोकने पवित्र करे छे तेम भगवाननी कथा  
संबंधी प्रश्न पष्ण कहेनार, पूछिनार अने सांभणनार ए त्राणोने पवित्र करे छे.<sup>१६</sup>  
गर्ववाणा राज्ञाओ के जेओ वास्तविक रीते हैत्यो ज हता, तेथोनां घणां घणां  
सैन्योना मोटा भारथी द्वारेली पृथ्वी गायनुं रुप धरीने ब्रह्माने शरणे गाई.

गौर्भूत्वा श्रुमुखी खिन्ना क्रन्दन्ती करुणं विभोः । उपस्थितान्तिके तस्मै व्यसनं स्वमोचेत  
ब्रह्मा तदुपथार्याथ सह देवैस्तया सह । जगाम सत्रिनयनस्तीरं क्षीरपयेनिधेः ॥१९  
तत्र गत्वा जगन्नाथं देवदेवं वृषाकपिम् । पुरुषं पुरुषसूक्तेन उपतस्थे समाहितः ॥२०  
गिरं समाधौ गग्ने समीरितां निशम्य वेधास्त्रिदशानुवाच ह ।

गां पौरुषी मे शृणुतामरा: पुनर्विधीयतामाशु तथैव मा चिरम् ॥२१॥  
पुरैव पुंसावधृतो धराज्वरो भवद्विरंशैर्यदृष्टपजन्यताम् ।  
स यावदुव्या भरमीश्वरेश्वरः स्वकालशक्त्या क्षपयंश्वरेद् भुवि ॥२२॥

वसुदेवगृहे साक्षाद् भगवान् पुरुषः परः । जनिष्यते तत्प्रियार्थं सम्भवनु सुरस्त्रियः ॥२३  
वासुदेवकलानन्तः सहस्रवदनः स्वराट् । अग्रतो भविता देवो हरे: प्रियचिकीर्षया ॥२४  
विष्णोर्माया भगवती यया सम्मोहितं जगत् । आदिष्ठ प्रभुणांशेन कार्यार्थं सम्भविष्यति २५  
श्रीशुक उवाच

इत्यादिश्यामरगणान् प्रजापतिपतिर्विभुः । आशास्य महीं च गीर्भिः स्वधाम परमं ययौ २६

भेद पामेली, दया उपजे एवी रीते यीसो नाभती अने आंभनां आंसु जेना  
मोढामां भरायां हतां, एवी पृथ्वीये ब्रह्मानी पासे उभी रहीने तेमनी पासे  
पोतानां दुःभनु निवेदन कर्यु.<sup>१७-१८</sup> ब्रह्मा पृथ्वीनुं दुःभ सांभणीने पृथ्वी, देवताओ  
अने महादेवने साथे लई क्षीरसागरने कांठे गया.<sup>१९</sup> त्यां जैर्ने समाधि करीने  
जगतना नाथ, देवना देव अने मनोरथोने परिपूर्णं करनार विष्णुनी  
पुरुषसूक्तना भंत्रोथी स्तुति करतां समाधिमां ज भगवाने जे आकाशवाणी कही,  
ते सांभणीने ब्रह्माये देवताओने कह्युं के- हे देवताओ ! मारी पासेथी भगवाननां  
वयन सांभणो अने पैषी ते प्रमाणेज करो. विलंब करशो नहीं.<sup>२०-२१</sup> आपणी  
विज्ञमिथी पहेलां ज भगवाने पृथ्वीना दुःभने ध्यानमां लीधुं छे, माटे ईश्वरोना  
पष्ण ईश्वर एवा भगवान पोतानी कणशक्तिथी पृथ्वीनो भार उतारवा पृथ्वीमां  
अवतार धरशे, तेटलामां तमो पष्ण पोतपोताना अंशोथी यादवोमां अवतार  
ग्रहण करो.<sup>२२</sup> साक्षात् पूर्णपुरुषोत्तम भगवान वसुदेवना धरमां अवतरशे,  
तेमने प्रसन्न करवा सारु देवोनी पत्निओ पष्ण अवतार ग्रहण करो.<sup>२३</sup> सहस्र  
मुखवाणा, स्वयंप्रकाश, अनंत अने भगवानना अंशरूप शेषनाग, भगवाननुं  
प्रिय करवा सारु प्रथम अवतार धरशे.<sup>२४</sup> विष्णुनी माया के जेणो सधणा जगतने  
मोह उपजावेलो छे, ते पष्ण प्रभुनी आशाथी देवकीना गर्भने रोहिणीना उदरमां  
स्थापन करवारूप कार्यने माटे भगवाने आपेला औश्यर्थी युक्त थईने पशोदाथकी

શૂરસેનો યદુપતિર્મથુરામાવસન્ પુરીમ् । માથુરાઝ્ઘરસેનાંશ્ વિષયાન્ બુભુજે પુરા ॥૨૭  
રાજધાની તતઃ સાભૂત સર્વયાદવભૂભુજામ્ । મથુરા ભગવાન્ યત્ર નિત્યં સંનિહિતો હરિઃ ॥૨૮  
તસ્યાં તુ કર્હચિચ્છૈરવસુદેવઃ કૃતોદ્રુદ્ધઃ । દેવક્યા સૂર્યયા સાર્થ પ્રયાણે રથમારુહત् ॥૨૯  
ઉગ્રસેનસુઃ કંસઃ સ્વસુ: પ્રિયચિકીર્ષયા । રશમીન્ હ્યાનાં જગ્રાહ રૌક્મૈ રથશતૈર્વત્: ॥૩૦  
ચતુઃ શતં પારિર્બહ ગજાનાં હેમમાલિનામ્ । અશ્વાનામયુતં સાર્થ રથાનાં ચ ત્રિષ્ટશતમ् ॥૩૧  
દાસીનાં સુકુમારીણાં દ્વે શતે સમલંકૃતે । દુહિત્રે દેવક: પ્રાદાદ્ યાને દુહિતૃવત્સલઃ ॥૩૨  
શદ્ભુત્યૂર્મદ્ભઙ્ગાશ્ નેદુર્દુભ્યઃ સમમ् । પ્રયાણપ્રક્રમે તાવદ્ વરવધ્વો: સુમઙ્ગલમ् ॥૩૩  
પથિ પ્રગ્રહિણ કંસમાભાદ્યાહાઽશરીરવાક્ । અસ્યાસ્ત્વામષ્ટમો ગર્ભો હન્તા યાં વહસેઽબુધ્ ॥૩૪  
ઇત્યુક્તઃ સ ખલ: પાપો ભોજાનાં કુલપાંસનઃ । ભગિનીઃ હન્તુમારબ્ધ: ખડ્ગપાણિઃ કચેઽગ્રહીત  
તં જુગુપ્સિતકર્માણં નૃંશંસં નિરપત્રપમ् । વસુદેવો મહાભાગ ઉવાચ પરિસાન્ત્વયન् ॥૩૬

જન્મ ધારણ કરશે. ૩૫

શુકુદેવજી કહે છે પ્રજાપતિઓના પતિ બ્રહ્મા આ પ્રમાણે દેવતાઓને આશા  
કરી અને વચનથી પૃથ્વીને આશ્વાસન આપી, પોતાના સર્વોત્તમ બ્રહ્મલોકમાં  
ગયા. ૩૬ પૂર્વ યાદવોના અધિપતિ શૂરસેન રાજા મથુરા નગરીમાં રહીને મથુરા  
અને શૂરસેન નામના દેશને ભોગવતા હતા, ત્યાંથી માંડી મથુરા નગરી સથળા  
યાદવવંશી રાજાઓની રાજધાની થઈ હતી, કે જે મથુરામાં ભગવાન નિરંતર  
રહેલા છે. ૩૭-૩૮ શૂરના પુત્ર વસુદેવ એક દિવસે એનગરીમાં પરણોલી  
સ્ત્રી દેવકીની સાથે પોતાને ઘેર જવાને સારુ રથમાં બેઠા, તે સમયે ઉગ્રસેન રાજાના  
પુત્ર કંસે પોતાની બહેન દેવકીને રાજુ કરવા સારુ ઘોડાની રાશ જાલી હતી,  
(હંકવા બેઠો હતો.) અને તેની સાથે બીજા સેંકડો સોનાના રથ હતા. ૩૯-૪૦ દીકરી  
પર પ્રીતિ રાખનાર ઉગ્રસેનના મોટાભાઈ દેવકે પોતાની દીકરી દેવકીને તેના  
પ્રયાણ સમયમાં સોનાની માળાવાળા ચારસો હાથી, પંદરસો ઘોડા, અઢારસો  
રથ અને સુંદર શાણગારેલી બસો દાસીઓ આપી હતી. ૪૧-૪૨ વરવહુના પ્રયાણ  
સમયમાં અતિ મંગળ રૂપ શંખ, તુર્ય, મુદ્ગ અને હુંદુભિઓ એક સાથે વાગતાં  
હતાં. ૪૩ માર્ગમાં રથને હંક્યા જતા કંસને “હે કંસ !” એમ બોલાવીને  
આકાશવાણીએ કહ્યું કે “હે મૂર્ખ ! જે દેવકીને તું ઘેર વળાવવા જાય છે તેનો  
આઠમો ગર્ભ તને મારશે” ૪૪ એ વાણી સાંભળી તે ખળ, પાપી અને ભોજના  
કુણને લાંછનરૂપ એવા કંસે, બહેનને મારી નાખવા સારુ તલવાર લઈને ચોટલો  
પકડ્યો. ૪૫ આવું ભૂંદું કામ કરવા તૈયાર થયેલા કૂર અને નિર્બજજ કંસને શાંત

વસુદેવ ઉવાચ

શ્લાઘનીયગુણઃ શૂરૈર્ભવાન્ ભોજયશસ્કરઃ । સ કથં ભગિની હન્યાત્ સ્ત્રીયમુદ્રાહપર્વતિ ૩૭  
મૃત્યુર્જન્મવતાં વીર દેહેન સહ જાયતે । અદ્ય વાબ્દશતાને વા મૃત્યુવૈ પ્રાણિનાં ધૂવઃ ॥૩૮  
દેહે પશ્ચત્વમાપત્રે દેહી કર્માનુગોઽવશઃ । દેહાન્તરમનુપ્રાપ્ય પ્રાક્તનં ત્વજતે વપુઃ ॥૩૯  
વ્રંતસિષ્ઠન્ પદૈકેન યથૈવૈકેન ગચ્છતિ । યથા તૃણજલ્લકૈવં દેહી કર્મગતિં ગતઃ ॥૪૦  
સ્વજે યથા પશ્યતિ દેહમીદૃશં મનોરથેનાભિનિવિષ્ટચેતનઃ ।  
દૃષ્ટશ્રુતાભ્યાં મનસાનુચિન્તયન્ પ્રપદ્યતે તત્ કિમપિ હ્યાપસ્મૃતિઃ ॥૪૧॥

પાડવા સારુ સ્તુતિથી, યુક્તિઓથી અને દયા ઉપજે એવી રીતે ભાગ્યશાળી  
વસુદેવ કહેવા લાગ્યા. ૩૬

વસુદેવ કહે છે હે કંસ ! શૂર પુરુષોએ વખાણવા યોગ્ય ગુણવાળો અને  
ભોજ કુણની કીર્તિ વધારનારો તું ઊઠીને વિવાહના ઉત્સવમાં આ સ્ત્રી જાતિ અને  
વળી બહેનને મારી નાખવા શા માટે વિચારે છે ? ૩૭ મરણની બીકથી મારતો હોય  
તો મરણ કોઈનું ટાળ્યું ટળતું નથી; કેમકે પ્રાણીઓનું મરણ દેહની સાથે સરજાઈ  
ચૂક્યું છે. અને વધારે સમય જીવવા સારુ એટલે પોતાના મરણમાં વિલંબ પાડવા  
સારુ મારતો હોય તો મરણ તો આજ અથવા સો વર્ષે પ્રાણીઓને અવશ્ય થનાર  
જ છે, તેમાં માત્ર વિલંબ નાખવા સારુ પાપ કરવું યોગ્ય નથી. ૩૮ આ દેહ ભોગ  
અને પ્રેમ વગેરેનું સ્થાનક છે તે પદી ગયા પદી જો બીજો દેહ ન આવતો હોય તો  
પાપ કરીને પણ દેહનું રક્ષણ કરવું ઘટે, પરંતુ તેમ નથી, કેમકે પરવશ પ્રાણી  
મરણ સમયે વગર યન્તે જ પ્રથમથી બીજા દેહને પામી, પદીથી પૂર્વદેહનો ત્યાગ  
કરે છે. ૩૯ જેમ ચાલ્યો જતો માણસ ધરતી ઉપર પ્રથમ મૂકેલા એક પગથી દેહને  
ટેકાવીને પદીથી બીજો પગ ઉપાડે છે, અને જેમ ખડમાંકડી બીજા ખડને પકડીને  
પદી પ્રથમનું ખડ છોડી દે છે, તેમ કર્મ માર્ગમાં ચાલ્યો જતો જીવ પણ બીજા  
દેહને પામ્યા પદી પહેલા દેહને છોડી દે છે. ૪૦ દેખેલા (રાજાદિક) અને સાંભળેલા  
(ઈન્દ્રાદિક) દેહના જેમાં સંસ્કાર લાગેલા છે એવા મનથી તે જ રાજાદિકના દેહનું  
ચિંતવન કરતો પુરુષ, સ્વપ્રમાં તેવા જ પ્રકારના દેહને દેખે છે, પદી થોડીવારમાં  
એ જ રાજાદિકના દેહને “હું છું” કરી માને છે અને પદી જાગ્રતના દેહની સ્મૃતિ  
ભૂલી જાય છે, અને એવી જ રીતના મનથી તેવા જ દેહના મનોરથ કરતો પુરુષ,  
જાગ્રતમાં પણ એ જ કોઈ પ્રકારના દેહને દેખે છે, પદી થોડીવારમાં એ જ દેહને  
“હું છું” કરી માને છે અને પદી પોતાના દેહની સ્મૃતિ ભૂલી જાય છે, તે જ પ્રમાણે

यतो यतो धावति दैवचोदितं मनो विकारात्मकमाप पञ्चसु ।  
गुणेषु मायारचितेषु देहसौ प्रपद्यमानः सह तेन जायते ॥४२॥  
ज्योतिर्थर्थैवोदकपर्थिवेष्वदः समीरवेगानुगतं विभाव्यते ।  
एवं स्वमायारचितेष्वसौ पुमान् गुणेषु रागानुगतो विमुह्यति ॥४३॥

तस्मान्न कस्यचिद् द्रोहमाचरेत् स तथाविधः । आत्मनः क्षेममन्विच्छन् द्वाग्धुर्वै परतो भयम् ४४  
एषा तवानुजा बाला कृपणा पुत्रिकोपमा । हन्तुं नार्हसि कल्याणीमिमां त्वं दीनवत्सलः ॥४५

## श्रीशुक उवाच

एवं स सामभिर्भैर्दैर्बैध्यमानोऽपि दारुणः । न न्यवर्तत कौरव्य ! पुरुषादाननुव्रतः ॥४६  
निर्बन्धं तस्य तं ज्ञात्वा विचिन्त्यानकदुन्भिः । प्रासं कालं प्रतिव्योद्दुमिदं तत्रान्वपद्यतः ॥४७

मृत्यु समये पश्च कर्मने लीघे भीजा देहने पामीने पूर्व देहनो त्याग करे छे.<sup>४१</sup> मृत्यु समये अंतर्यामी परमात्मा द्वारा कर्मात्मक वासनाने अनुसारे प्रेरायेलुं मन, पंचभूतात्मक देव, मनुष्य, पशु, पक्षी आदिक देहोने मध्ये जे जे देहोनुं स्मरण करे छे, अने स्मरण करतां जे जे देहने पामे छे, ते ते देहने विषे वासनात्मक मननी साथे ज्ञव पश्च जाय छे. आ रीते वासनात्मक मननी साथे जे ज्ञवुं ए ज ज्ञवनी उत्पत्ति छे.<sup>४२</sup> जेम जग्नने विषे तथा तेल, धी आदिक पदार्थने विषे सूर्य तथा चंद्रना बिंबो, प्रतिबिंब रुपे देखाय छे. ए प्रतिबिंब कंपनथी रहित होय छे, छतां वायुना कंपनने लीघे कंपायमान जश्शाय छे. ए ज रीते ज्ञव स्वभावसिद्ध देव, मनुष्य तथा राजादिकनी उपाधिथी रहित छे, छतां ए ज्ञव वासनाने लीघे हुं देव हुं, मनुष्य हुं, अने राजा हुं, आवा विविध प्रकारना मोहने पामे छे. वास्तविकताए देह थकी आत्मा पृथक्क छे. मृत्यु तो देहनुं ज थाय छे, परंतु आत्मानुं मृत्यु थतुं नथी, आत्मा तो अभर छे. आवी वस्तुस्थिति होवाथी आत्मतत्त्वने जाणानारा पुरुषे, जो पोताना कल्याणनी ईश्छा होय तो कोईनो पश्च द्रोह न करवो जोईअ. केमके द्रोह करनारने ज सामा प्राणीथी अने यमथी पश्च भय उत्पन्न थाय छे.<sup>४३-४४</sup> आ बिचारी तारी नानी बेन, बाणक अने भली देवकी जे लाकडानी पूतणीनी पेठे परतंत्र छे तेने तारे मारवी जोईअ नहि.<sup>४५</sup>

शुकदेवज्ञ कहे छे हे राजा ! आ प्रमाणे वसुदेवे सामथी अने भेदथी कंसने समज्जववा मांड्यो, तोपश्च राक्षसोने अनुसरेलो कूर कंस देवकीने मारवाथी अटक्यो नहीं.<sup>४६</sup> देवकीने मारी नाखवानो कंसनो आग्रह जाणी, विचार करीने वसुदेवे भोतने अटकाववा सारु पोताना मनमां आ प्रमाणे निश्चय कर्यो.<sup>४७</sup>

मृत्युर्बुद्धिमताऽपोह्नो यावद्बुद्धिबलोदयम् । यद्यसौ न निवर्तेत नापराधोऽस्ति देहिनः ॥४८  
प्रदाय मृत्यवे पुत्रान् मोचये कृपणामिमाम् । सुता मे यदि जायेरन् मृत्युर्वा न मियेत चेत् ४९  
विषययो वा किं न स्याद् गतिर्धार्तुर्दत्यया । उपस्थितो निवर्तेत निवृत्तः पुनरापतेत् ॥५०

अग्नेर्था दारुवियोगयोगयोरदृष्टोऽन्यन्न निमित्तमस्ति ।

एवं हि जन्तोरपि दुर्विभाव्यः शरीरसंयोगवियोगहेतुः ॥५१॥

एवं विमृश्य तं पापं यावदात्मनिर्दर्शनम् । पूजयामास वै शौरिर्बहुमानपुरःसरम् ॥५२  
प्रसन्नवदनाभ्योजो नृशंसं निरपत्रपम् । मनसा दूयमानेन विहसन्निदमब्रवीत् ॥५३

## बसुदेव उवाच

नहास्यास्ते भयं सौम्य ! यद् वागाहाऽशरीरिणी । पुत्रान् समर्पयिष्येऽस्या यतस्ते भयमुत्थितम्  
भुद्धिमान माणसे भुद्धि पहोंचे त्यां सुधी भोतने अटकाववुं जोईअ, अने एम करतां न अटके तो तेमां माणसनो अपराध कहेवातो नथी.<sup>४८</sup> एटला माटे देवकीने जे दीकरा आवे ते कंसने आपवानो ठराव करीने अत्यारे तो आ रांक स्त्रीने छोडावुं. देवकीने दीकरा आव्या पछी जे भावी हशे ते थशे, पश्च हाल तुरत तो आने ज्ञवती राखवी जोईअ. अने तेटला समयमां जो कंस ज मरी जाय तो पछी कशी पीडा नथी.<sup>४९</sup> समय पर दीकरा आवे अने कंस न मर्यो होय तो मारा पुत्रो तेने आपी दृष्टि, अने कदाय मारा पुत्रथी ज कंसनुं मरण थाय एम विपरीत पश्च शा माटे न बने ? केमके आनो आठमो गर्भ तेने मारशे, एम कहेनारा ईश्वरनी वाणी जाणवी मुश्केल छे, कारण के घाणी वभत सभीपे आवेलुं मृत्यु पश्च दूर चाल्युं जाय छे. अने दूर चाल्युं गयेलुं मृत्यु पश्च सभीपमां आवी जाय छे. जेम वनमां वृक्षोने अने गाममां धरोने बाणतो अग्नि, सभीपमां होय तेओने छोडी दृष्टि देव ए समय पर दूर होय तेओने पश्च बाणी नाखे छे. एमां भगवाननी ईश्छा सिवाय भीजुं कोई पश्च कारण नथी, तेम प्राणीओना मृत्युमां पश्च ईश्वरनी ईश्छा ए ज कारण छे. अने ईश्वरनी ईश्छा शुं होई शके, ए आपणी भुद्धिथी कणवुं कठीन छे.<sup>५०-५१</sup> आ प्रमाणे पोतानी भुद्धि पहोंची त्यां सुधी विचार करीने वसुदेवे घणा मानथी ते पापी कंसनो सत्कार कर्यो.<sup>५२</sup> पछी मनमां खेद पामवा छतां कंसने विश्वास बेसाडवा सारु वसुदेवे पोतानुं मुख प्रकुल्तित राखीने हसतां हसतां ए निर्लज्ज अने कूर कंसने आ प्रमाणे कह्युं.<sup>५३</sup> वसुदेव कहे छे- हे भला कंस ! जे भीक आकाशवाणीये देखाई छे ते भीक तारे राखवी ज नहीं; केमके आ देवकीना जे पुत्रो थकी तेने भय उत्पन्न थयेलो छे ते पुत्रो हुं तेने अर्पण करी

## શ્રીશુક ઉવાચ

સ્વસુર્વધાત્રીવવૃતે કંસસત્ત્વાક્યસારવિત् । વસુદેવોપિ તં પ્રીતઃ પ્રશસ્ય પ્રાવિશદ્ગૃહમ् ॥૫૫  
અથ કાલ ઉપાવૃત્તે દેવકી સર્વદેવતા । પુત્રાન् પ્રસુષુવે ચાણ્ણૈ કન્યાં ચૈવાનુવત્તસરમ् ॥૫૬  
કીર્તિમન્ત પ્રથમજં કંસાયાનકદુન્દુભિઃ । અપર્યામાસ કૃચ્છેણ સોઽનૃતાદત્તવિહ્લાઃ ॥૫૭  
કિં દુઃસહંનુસાધ્યાં વિદુષાં કિમપેક્ષિતમ् । કિમકાર્ય કદર્યાણાં દુસ્ત્યં કિં ધૃતાત્મનામ ॥૫૮  
દૃષ્ટા સમત્વં તચ્છૌરે: સત્યે ચૈવ વ્યવસ્થિતિમ् । કંસસુષ્ટમના રાજન् પ્રહસન્નિદમબ્રવીત् ॥૫૯  
પ્રતિયાતુ કુમારોઽયં ન હ્યાસ્માદસિ મે ભયમ् । અષ્માદ્યુવ્યર્ગર્ભાન્મત્યુર્મે વિહિતઃ કિલ ૬૦  
તથેતિ સુતમાદાય યયાવાનકદુન્દુભિઃ । નાભ્યનન્તત તદ્વાક્યમસતોઽવિજિતાત્મનઃ ॥૬૧  
નન્દાયા યે બ્રજે ગોપા યાશ્નામીષાં ચ યોષિતઃ । વૃષ્ણયો વસુદેવાદ્યા દેવક્યાદ્યા યદુસ્ત્રિય: ૬૨  
દ્રોશ ॥ ૫૪

શુકુદેવજી કહે છે- વસુદેવના વચનનો સાર જાણીને કંસ બહેનને મારવાથી અટક્યો, અને વસુદેવ પણ રાજુ થઈ કંસના વખાણ કરી પોતાને ઘેર ગયા ॥૫૫  
પછી પ્રસવનો સમય આવતાં ભગવાનની ભક્તિ કરનારી દેવકીએ આઠ દીકરા અને એક દીકરીને એક એક વર્ષને અંતરે જન્મ આપ્યાં ॥૫૬ પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવા ઈચ્છાતા વસુદેવે પ્રથમ ઉત્પત્ત થયેલા કીર્તિમાન નામના દીકરાને મનમાં બેદ પામવા છતાં પણ કંસને આપ્યો ॥૫૭ પોતાનું વચન પાળનારા પુરુષોથી સહન ન કરી શકાય એવું કાંઈ પણ હોતું નથી. તેથી વસુદેવે પુત્રને મૃત્યુના હાથમાં સોંપ્યો. એક ભગવાન વિના બીજું કાંઈ સાચું નથી, એમ જાણનારાઓને કશી વાતની અપેક્ષા રહેતી નથી, તેથી વસુદેવે પુત્રને રમાડવાના સુખની અપેક્ષા છોડી દીધી. હું પોતે દીકરાને લઈ જઈશ તો કંસ છોડી દેશે એવું વસુદેવના મનમાં હતું જ નહીં; કેમકે નીચ પુરુષોથી ન થઈ શકે એવું કશું પણ હોતું નથી. જેઓએ પોતાનું ચિત્ત ભગવાનમાં રાખ્યું હોય તેઓ જેને ન છોડી શકે એવું પણ કશું હોતું નથી, તેથી દેવકીએ પણ પુત્રને મૂકી દીધો ॥૫૮ હે રાજી ! વસુદેવની એ સમતા અને સત્યમાં સ્થિતિ જોઈને રાજુ થયેલો કંસ હસીને બોલ્યો કે- ‘આ છોકરાને પાછો લઈ જાઓ; કેમકે આના થકી મને બીક નથી. તમારા આઠમા ગર્ભથી જ મારું મૃત્યુ ઠેલા છે, માટે આઠમો પુત્ર આવે ત્યારે તે મને સોંપવો ॥૫૯-૬૦ વસુદેવ ‘ઠીક’ એમ કહી દીકરાને લઈને પાછો પોતાને ઘેર ગયા, પણ કંસનાં તેવાં વચનનો તે વસુદેવે સત્કાર કર્યો નહીં; કેમકે કંસ દુષ્ટ છે અને તેનું મન તેના પોતાના હાથમાં નથી ॥૬૧ આ પ્રમાણે કંસની શાંતિ દેવતાઓના કાર્યને અનુકૂળ નથી એમ જાણી,

સર્વે વૈ દેવતાપ્રાયા ઉભ્યોરપિ ભારત ! । જાતયો બન્ધુસુહૃદો યે ચ કંસમનુવ્રતાઃ ॥૬૩  
એતત્ કંસાય ભગવાજ્ઞણસાભ્યેત્ય નારદઃ । ભૂમેર્ભારાયમાણાં દૈત્યાનાં ચ વધોદ્યમમ् ॥૬૪  
ક્રષ્ણેવિનિર્ગમે કંસો યદૂનું મત્વા સુરાનિતિ । દેવક્યા ગર્ભસમ્ભૂતં વિષ્ણું ચ સ્વવધં પ્રતિ ॥૬૫  
દેવકીને વસુદેવ ચ નિગૃહ્ય નિગડૈર્ગૃહ્ય । જાતાં જાતમહન् પુત્ર તયોરજનશક્ષયા ॥૬૬  
માતરં પિતરં ભ્રાતૂનું સર્વાશ્રી સુહ્બસ્તથા । જન્મનિ હ્યાસુત્પો લુબ્ધા રાજાનઃ પ્રાયશો ભુવિ ॥૬૭  
આત્માનમિહ સજ્જાતાં જાનન્ પ્રાગ્ વિષ્ણુના હતમ્ । મહાસુરં કાલનેમિ યદુભિઃ સ વ્યરુધ્યત ॥૬૮  
ઉગ્રસેનં ચ પિતરં યદુભોજાધ્યકાધિપમ् । સ્વયં નિગૃહ્ય બુભુજે શૂરસેનાન્મહાબલઃ ॥૬૯

ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વાં  
શ્રીકૃષ્ણાવતારોપક્રમે પ્રથમોઽદ્યાય: ॥૧૧॥

નારદજીએ આવીને કંસને કહું કે “ગોપકુળમાં વ્રજવાસી નંદાદિક ગોવાળિયા અને તેઓની સ્ત્રીઓ તથા યદુકુળમાં વસુદેવ આદિ યાદવો, તેઓની દેવકી આદિ સ્ત્રીઓ, શાતીઓ, સ્નેહી થઈને તને અનુસરી રહ્યા છે, એ બધા પણ દેવતારૂપ છે અને દેવતાઓએ પૃથ્વીને ભારતુપ લાગતા દેત્યોનો નાશ કરવાને ઉદ્ઘમ કર્યો છે. ૬૨-૬૪ એટલું કહીને નારદજી ચાલ્યા ગયા. પછી યાદવોને દેવતારૂપ માની અને પોતાને મારવા સારુ દેવકીના ગર્ભમાંથી વિષ્ણુ જન્મશે એમ ધારી, કંસે દેવકી અને વસુદેવના પગમાં બેડી નાખી અને વિષ્ણુની શંકાથી દેવકીના જેટલા પુત્રો જન્મ્યા, એ બધા પુત્રોને મારી નાખ્યા. ૬૫-૬૬ પૃથ્વીમાં પોતાની ઈંડિયોને તૃમ કરનારા લોભી રાજીઓ ઘણું કરીને મા, બાપ, ભાઈઓ અને સધળાં સંબંધીઓને પણ મારી નાખે છે. ૬૭ હું પૂર્વ જન્મમાં કાળનેમિ નામે મોટો દેત્ય હતો અને તે જન્મમાં વિષ્ણુએ મારી નાખવાથી પાછો અહીં જન્મ્યો છું” એમ કંસ જાણતો હતો, તેથી તેણે યાદવોની સાથે વિરોધ કર્યો. ૬૮ યદુ, ભોજ અને અંધક કુળના અધિપતિ પોતાના પિતા ઉગ્રસેનને કેદ કરી, મોટા બળવાળો કંસ પોતે શૂરસેન દેશનું રાજ્ય કરવા લાગ્યો. ૬૯

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંદ્ધાનો પહેલો અદ્યાય સંપૂર્ણ.

## अथ द्वितीयोऽध्यायः (२)

श्रीशुक उवाच

प्रलम्बबकचाणूरतृणावर्तमहाशनैः । मुष्टिकारिष्टद्विविद्पूतनाकेशिधेनुकैः ॥१  
 अन्यैश्वासुरभूपालैर्बाणभौमादिभिर्युतः । यदूनां कदनं चक्रे बली मागधसंश्रयः ॥२  
 ते पौडिता निविशुः कुरुपञ्चालकेक्यान् । शाल्वान् विदर्भान् निषधान् विदेहान् कोसलानपि  
 एके तमनुरुद्धाना ज्ञातयः पर्युपासते । हतेषु षट्सु बालेषु देवक्या औग्यसेनिना ॥४  
 सप्तमो वैष्णवं धाम यमनन्तं प्रचक्षते । गर्भो बभूव देवक्या हर्षशोकविवर्धनः ॥५  
 भगवानपि विश्वात्मा विदित्वा कंसजं भयम् । यदूनां निजनाथानां योगमायां समादिशत् ६  
 गच्छ देवि! व्रजं भद्रे ! गोपगोभिरलंकृतम् । रोहिणी वसुदेवस्य भार्याऽऽस्ते नन्दगोकुले ।

अन्याश्व कंससंविग्ना विवरेषु वसन्ति हि ॥७  
 देवक्या जठरे गर्भं शेषाख्यं धाम मामकम् । तत् संनिकृष्टं रोहिण्या उदरे संनिवेशय ॥८

## अध्याय २

देवकीना गर्भमां रहेला श्रीकृष्ण भगवाननी देवताओं एतेवती  
 स्तुति.

शुकदेवज्ञ कहे छे प्रलंभासुर, बकासुर, याषूरमल्ल, तृष्णावर्तहेत्य,  
 अधासुर, मुष्टिकमल्ल, अरिष्टासुर, द्विविद्वानर, पूतना, केशिहेत्य, धेनुकासुर  
 अने वीजा पशु भाषासुर अने नरकासुर आहिहेत्योना राजाओनी सहायताथी  
 बणवान कंस यादवोनुनिकंदन करवा लाग्यो. ए कंसने जरासंधनो मोटो आश्रय  
 हतो.<sup>१-२</sup> कंसथी पीडाअेला यादवो कुरु, पांचाल, केंक्य, शाल्व, विदर्भ, निषध,  
 विदेह अने कोशल देशमां जता रह्या, अने केटलाक यादवो कंसने ज अनुसरीने  
 तेनी सेवा करवा लाग्या. कंसे देवकीना ध बाणक मारी नाख्या पाडी विष्णुना  
 अंशरुप शेषनाग के जेने अनंत कहे छे, ते देवकीना सातमा गर्भमां आव्या. ए  
 गर्भथी देवकीने हर्ष अने शोक बन्ने वृद्धि पाख्यां.<sup>३-४</sup> विश्वात्मा भगवाने पशु  
 पोतानो आश्रय करीने रहेला यादवोने कंसथी उत्पत्त थयेलुं हुः ख जाणीने  
 योगमायाने आज्ञा करी के ‘हे देवि! तमो गोवाणिया अने गायोथी शोभी रहेला  
 व्रजमां जाव. वसुदेवनी स्त्री रोहिणी नंदना गोकुणमां छे, अने वीज्ञ वसुदेवनी  
 स्त्रीओ पशु कंसना उद्देगथी गुम स्थानकोमां रहे छे.<sup>५-७</sup> हमणां देवकीना उदरमां  
 मारा अंशरुप शेषनाग पधार्या छे, तेमने त्यांथी खेंचीने रोहिणीना उदरमां स्थापन

अथाहमंशभागेन देवक्या: पुत्रां शुभे! । ग्राप्यामि त्वं यशोदायां नन्दपत्न्यां भविष्यसि ९  
 अर्चिष्यन्ति मनुष्यास्त्वां सर्वकामवरेश्वरीम् । धूपोपहारबलिभिः सर्वकामवरप्रदाम् ॥१०  
 नामधेयानि कुर्वन्ति स्थानानि च नरा भुवि । दुर्गेति भद्रकालीति विजया वैष्णवीति च ११  
 कुमुदा चण्डिका कृष्णा माधवी कन्यकेति च । माया नारायणीशानी शारदेत्यम्बिकेति च १२  
 गर्भसंकर्षणात् तं वै प्राहुः संकर्षणं भुवि । रामेति लोकरमणाद् बलं बलवदुच्छ्रयात् १३  
 सन्दिष्टैवं भगवता तथेत्येमिति तद्वचः । प्रतिगृह्य परिक्रम्य गां गता तत् तथा करोत् १४  
 गर्भं प्रणीते देवक्या रोहिणीं योगनिद्रया । अहो विस्मासितो गर्भं इति पौरा विचुक्रुशुः ॥१५  
 भगवानपि विश्वात्मा भक्तानामभयङ्करः । आविवेशांशभागेन मन आनकदुद्दुभेः ॥१६  
 स बिभ्रत् पौरुषं धाम भ्राजमानो यथा रविः । दुरासदोऽतिरुद्धर्षो भूतानां सम्बभूव ह ॥१७

ततो जगन्मङ्गलमच्युतांशं समाहितं शूरसुतेन देवी ।

दधार सर्वात्मकमात्मभूतं काषा यथाऽनन्दकरं मनस्तः ॥१८॥

करो.<sup>८</sup> पाडी हुं परिपूर्ण रूपथी देवकीनो पुत्र थृष्णश, अने तमो नंदनी स्त्री यशोदाना  
 उदरथी जन्म लेजो.<sup>९</sup> सकाम पुरुषोने ऐश्वर्य अने समग्र ईश्चित फणोने  
 आपनारां तमोने पृथ्वी पर भनुष्यो धूप, उपहार अने बलिदानथी पूजशे.<sup>१०</sup>  
 पृथ्वीमां भनुष्यो तमारां स्थानक करशे. अने हुर्गा, भद्रकाणी, विज्या, वैष्णवी,  
 कुमुदा, यंडिका, कृष्णा, माधवी, कन्यका, माया, नारायणी, ईशानी, शारदा अने  
 अंबिका एवां नामो पाइशे.<sup>११-१२</sup> तमो देवकीना उदरथी गर्भनुं आकर्षण करशे.  
 तेथी पृथ्वीमां ते पुत्रनुं ‘संकर्षण’ ऐवुं नाम कहेवाशे. जगतने राज्ञ करशे तेथी  
 राम अने अत्यंत बणवान होवाथी ‘बल’ ऐवुं पशु नाम कहेवाशे.<sup>१३</sup> आ प्रमाणे  
 भगवाने आज्ञा करतां मोटा आदरथी तेमनां वयनानो स्वीकार करी अने  
 भगवानने प्रदक्षिणा करी मायाए पृथ्वीमां जैर्ने ते प्रमाणे ज कर्यु.<sup>१४</sup>  
 योगमायाए देवकीनो गर्भ रोहिणीमां स्थापन करतां, ‘अहो! देवकीनो गर्भ  
 पडी गयो’ ऐम लोको कहेवा लाग्या.<sup>१५</sup> भक्तोने अभय आपनारा विश्वात्मा  
 भगवान पशु परिपूर्ण रूपथी वसुदेवना मनमां पधार्या.<sup>१६</sup> भगवाननी श्रीभूतिने  
 धारण करता वसुदेव सूर्यनी पेठे अति प्रकाशवा लाग्या तेथी कोई वीजा प्राणीओ  
 वसुदेवनी सभीपे पशु जैर्ने शक्ता न हता.<sup>१७</sup> पाडी वसुदेवे धारण करेला जगतने  
 मंगणकारी, सर्वना आत्मा अने परिपूर्ण शक्तिवाणा भगवान वसुदेव थकी  
 देवकीना उदरमां पधार्या, अने जेम पूर्वदिशा आनंदकारी यंद्रने धारण करे तेम  
 देवकीए पशु ते भगवानने पोताना उदरमां धारण करी लीधा.<sup>१८</sup> ते देवकी,

सा देवकी सर्वजगन्निवासनिवासभूता नितरां न रेजे ।  
 भोजेन्द्रगेहेऽग्निशिखेव रुद्धा सरस्वती ज्ञानखले यथा सती ॥१९॥  
 तां वीक्ष्य कंसः प्रभयाजितान्तरां विरोचयन्ती भवनं शुचिस्मिताम् ।  
 आहैष मे प्राणहरो हरिगुहां ध्रुवं श्रितो यन्न पुरेयमीदृशी ॥२०॥  
 किमद्य तस्मिन् करणीयमाशु मे यदर्थतन्मो न विहन्ति विक्रमम् ।  
 स्त्रियाः स्वसुर्गुरुमत्या वधोऽयं यशः श्रियं हन्त्यनुकालमायुः ॥२१॥  
 स एष जीवन् खलु सम्परेतो वर्तेत योऽत्यन्तनृशांसितेन ।  
 देहे मृते तं मनुजाः शपन्ति गन्ता तमोऽन्यं तनुमानिनो ध्रुवम् ॥२२॥  
 इति घोरतमाद् भावात् सन्निवृत्तः स्वयं प्रभुः । आस्ते प्रतीक्षंस्तज्जन्म हरेवैरानुबन्धकृत् २३  
 आसीनः संविशंस्तिष्ठन् भुज्जानः पर्यटन् महीम् । चिन्तयानो हृषीकेशमपश्यत् तन्मयं जगत् २४  
 ब्रह्मा भवश्च तत्रैत्य मुनिभिर्नारदादिभिः । देवैः सानुचरैः साकं गीर्भिर्वृष्णमैडयन् ॥२५

जेमां सर्व जगतनो निवास छे अेवा भगवानना निवासरूप थयां, तोपश कंसना कारागृहमां रुधायेलां होवाथी, धडामां रोकाअेला दीवानी पेठे अने विद्याने छुपावनारा खण पुरुषमां रुधायेली सद्विद्यानी पेठे, बीजा लोकोने आनंद आपी शक्यां नहीं.<sup>१५</sup> उद्दरमां भगवान पधारवाने लीधे कांतिथी धरने शोभावतां अने सुंदर मंदहास्य करतां, ते देवकीने ज्ञोईने कंसे विचार कर्यो के “मारा प्राणने लेनारो विष्णु आना उद्दरमां अवश्य आवी यूक्यो छे; केमके पहेलां आ देवकी आवां तेजस्वी न हतां.”<sup>१०</sup> हवे हमणां तुरत माराथी विष्णुने शुं थर्द शके? आ देवकी थकी उत्पन्न थर्दने ए विष्णु मारा वधरूप पोतानुं पराकम करशे ज, अने वणी आ स्त्रीज्ञातिने मारी नाखुं तो मारा पराकमनो मेंज नाश कर्यो कहेवाय, एक तो स्त्रीज्ञाति, तेमां वणी बेन अने तेमां वणी गर्भिष्ठीनो वध करु तो ते वध हमणां ज मारी कीर्ति, लक्ष्मी अने आयुष्यनो नाश करी नाखे.<sup>११</sup> जे पुरुष बहुज झूरताथी पोताना प्राणोने धारण करे छे ते पुरुष छ्वतो ज मरेलो गणाय छे. अेवा पुरुष विषे लोको विक्कारथी भोले छे के आ देहाभिमानी पुरुष मर्या पछी अवश्य नरकमां पडशे.<sup>१२</sup> भगवाननी साथे वैरानुबन्ध राखनारो कंस आवो विचार करीने, पोते देवकीने मारी नाखवाने समर्थ हतो छतां पश भारवाथी अटकीने भगवाननो जन्म थवानी राह जोवा लाय्यो.<sup>१३</sup> बेसतां, सूतां, उठतां, जमतां अने पृथ्वी पर झरतां भगवाननुं ज चिंतवन कर्या करतो ए कंस सधणा जगतने भगवानमय देखवा लाय्यो.<sup>१४</sup> ब्रह्मा, सदाशिव, नारदादिक मुनिओ

सत्यव्रतं सत्यपरं त्रिसत्यं सत्यस्य योनि निहितं च सत्ये ।  
 सत्यस्य सत्यमृतसत्यनेत्रं सत्यात्मकं त्वां शरणं प्रपन्नाः ॥२६॥  
 एकायनोऽसौ द्विफलस्त्रिमूलश्वतूरसः पञ्चविधः षडात्मा ।  
 सप्तत्वगृष्णविटपो नवाक्षो दशच्छदी द्विखगो ह्यादिवृक्षः ॥२७॥  
 त्वमेक एवास्य सतः प्रसूतिसत्वं सन्त्रिधानं त्वमनुग्रहश्च ।  
 त्वम्नायया संवृतचेतसस्त्वां पश्यन्ति नाना न विपश्चितो ये ॥२८॥  
 बिर्भिं रूपाणयबोध आत्मा क्षेमाय लोकस्य चराचरस्य ।  
 सत्त्वोपपन्नानि सुखावहानि सतामभद्राणि मुहुः खलानाम् ॥२९॥  
 त्वय्यम्बुजाक्षाखिलसत्त्वधाम्नि समाधिनाऽवेशितचेतसैके ।  
 त्वत्पादपोतेन महत्कृतेन कुर्वन्ति गोवत्सपदं भवाब्धिम् ॥३०॥

अने अनुचर सहित देवताओ त्यां आवीने, मनोरथ पूरनारा भगवाननी सुंदर वाक्योथी आगण कहेवाशे ए प्रमाणे स्तुति करवा लाय्या.<sup>२५</sup>

देवताओ स्तुति करे छे आप सत्यसंकल्पवाणा छो, सत्यथी प्राम थनार छो, त्रणे काणमां सत्य छो, समग्र जगतनी उत्पत्तिना कारणरूप छो, सत्यमृत अेवा चिटाकाशमां रहेला छो, सत्यना पश तत्व छो, सूर्य चंद्रना पश प्रवर्तक छो. आवी रीते सर्वप्रकारे सत्य स्वरूप अेवा तमारे शरणे अमो आवेला छीओ.<sup>२६</sup> आ ब्रह्मांडरूपी आदि वृक्ष के जेमां एक (प्रकृति) आश्रय छे, बे (सुख अने दुःख) फण छे, त्रण (गुण) भूण छे, चार (धर्म, अर्थ, काम अने मोक्ष) रस छे, पांच (ईन्द्रियो) ज्ञानवाना प्रकार छे, छ (जन्म, मरण, शोक, क्षुधा, पिपासा अने मोह) स्वभाव छे, सात (धातु) धाल छे, आठ (पंचभूत, मन, बुद्धि अने अहंकार) शाखा छे, नव (द्वार) छिद्र छे, दश (प्राण) पांदडां छे अने बे (ज्ञव तथा ईश्वर) पक्षीओ छे, आ ब्रह्मांडरूपी वृक्षनी उत्पत्ति तमाराथी थर्द छे, लय तमारामां थाय छे, अने स्थिति पश तमारामां ज छे. माटे सधणुं ब्रह्मांड तमारुं ज शरीर होवाथी तमाराथी भिन्न नथी. अर्थात् शरीर अने शरीरीनुं अभिन्नपणुं कहेलुं छे, तमारी मायाथी जे ओनुं ज्ञान ढंकाई गयुं छे, तेओ जगतने तमाराथी भिन्न देखे छे, पश विद्वानो तेम देखता नथी.<sup>२७-२८</sup> ज्ञान स्वरूप अने सर्वना आत्मा तमो ज स्थावर जंगम लोकना पालनने माटे शुद्ध सत्वमय, धार्मिकोने सुखदायी अने अधार्मिकोने दुःखदायी अेवा उपोने वारंवार धरो छो.<sup>२९</sup> हे कमण सरभा नेत्रवाणा! शुद्धसत्वमय शरीरथी युक्त अेवा तमारे विषे प्रवेश करावेलुं

स्वयं समुत्तीर्य सुदुस्तरं द्युमन्भवार्णवं भीममदभ्रसौहृदाः ।  
भवत्पदाभ्योरुहनावमत्र ते निधाय याताः सदनुग्रहो भवान् ॥३१॥  
येऽन्येरविन्दाक्ष ! विमुक्तमानिनस्त्वव्यस्तभावादविशुद्धबुद्धयः ।  
आरुह्य कृच्छ्रेण परं पदं ततः पतन्त्यधोऽनादृतयुष्मदद्वयः ॥३२॥  
तथा न ते माधव तावकाः ऋचिद् भ्रश्यन्ति मार्गात्त्वयि बद्धसौहृदाः ।  
त्वयाभिगुप्ता विचरन्ति निर्भया विनायकानीकपमूर्धसु प्रभो ! ॥३३॥  
सत्त्वं विशुद्धं श्रयते भवान् स्थितौ शरीरिणां श्रेय उपायनं वपुः ।  
वेदक्रियायोगतपःसमाधिभिस्तवार्हणं येन जनः समीहते ॥३४॥  
सत्त्वं न चेद्वातरिदं निजं भवेद् विज्ञानमज्ञानभिदापमार्जनम् ।  
गुणप्रकाशैरनुमीयते भवान् प्रकाशते यस्य च येन वा गुणः ॥३५॥

ऐ चित जे मणे, ऐवा केटलाक ज्ञानीओ तमारा यरणानी उपासनारूपी नावनो आश्रय करीने संसाररूपी समुद्रने सुखपूर्वक तरी जाय ।<sup>३०</sup> हे स्वयंप्रकाश ! हे महाद्याणु ! तमारा यरणानी उपासना करनारा महात्मा पुरुषो आ भयंकर अने दुस्तर भवसागरने आपना यरणारविंदनी उपासनारूपी वहाशथी उतरीने ते यरणारविंदनी उपासनारूपी वहाशने आ पृथ्वी उपर भूमीने चात्या गया । अर्थात् आ पृथ्वी उपर तमारा यरणारविंदनी उपासनाने प्रवर्तावीने चात्या गया । आवा आप भक्तो उपर अनुग्रह करनार ।<sup>३१</sup> हे कमण सरभा नेत्रवाणा ! जे बीजा लोको ‘अमे मुक्त ज धीअे’ ऐम मानीने तमारी भक्ति नहीं करवाथी अशुद्ध बुद्धिवाणा अने तमारा यरणानो अनादर करनारा ऐ ते तेओ धणा जन्मना तपने लीघे सारु कुण पश, नीय योनिमां जन्म पामे ।<sup>३२</sup> हे माधव ! जे लोको तमारामां ज स्नेह बांधी रहेला अने तमारा ज ऐ ते लोको भक्तिथी रहित पुरुषोनी जेम पोताना मार्गभांथी कटी भ्रष्ट थता नथी, पश तमे करेला रक्षणे लीघे निर्भय थईने भोटां मोटां अनेक विघ्नोने माथे पग भूमीने फरे ।<sup>३३</sup> तमे जगतनी स्थितिने माटे, प्राणीओने कल्याणानी प्राप्तिने माटे आश्रय करवा योग्य ऐवा शुद्ध सत्वगुणमय शरीरने धारणा करो ।<sup>३४</sup> के जे शरीर धरवाने लीघे ब्रह्मचारीओ वेदना अध्ययनथी, गृहस्थो कर्मयोगथी, वानप्रस्थो तपथी अने संन्यासीओ समाधिथी तमारुं पूजन करे ।<sup>३५</sup> तमे अवतार न धरो तो पूजन नहि थई शक्वाने लीघे कल्याणानी प्राप्ति थाय नहीं. हे प्रभु ! आ सत्वगुणमय आपनुं शरीर न अवतरे तो अज्ञानने तोडनार प्रत्यक्ष ज्ञान थाय

न नामरूपे गुणजन्मकर्मभिर्निरूपितव्ये तव तस्य साक्षिणः ।  
मनोवचोभ्यामनुमेयवर्त्मनो देव ! क्रियायां प्रतियन्त्यथापि हि ॥३६॥  
शृणवन् गृणन् संस्मरयंश्च चिन्तयन् नामानि रूपाणि च मङ्गलानि ते ।  
क्रियासु यस्त्वच्चरणारविन्दयोराविष्टचेता न भवाय कल्पते ॥३७॥  
दिष्टग्या हरेऽस्या भवतः पदो भुवो भारोऽपनीतस्तव जन्मनेशितुः ।  
दिष्टग्याङ्कितां त्वत्पदकैः सुशोभनैर्द्रक्ष्याम गां द्यां च तवानुकम्पिताम् ॥३८॥  
न तेऽभवस्ये भवस्य कारणं विना विनोदं बत तर्कयामहे ।  
भवो निरोधः स्थितिरप्यविद्या कृता यतस्त्वव्यभयाश्रयात्मनि ॥३९॥  
मत्स्याश्वकच्छपनृसिंहवराहंसराजन्यविप्रविबुधेषु कृतावतारः ।  
त्वं पासि नस्त्रिभुवनं च यथाधुनेश भारं भुवो हर यदूत्तम् ! वन्दनं ते ॥४०॥  
दिष्टग्याम्ब ते कुक्षिगतः परः पुमानंशेन साक्षाद् भगवान् भवाय नः ।  
मा भूद् भयं भोजपतेर्मुमूर्खोर्गोम्सा यदुनां भविता तवात्मजः ॥४१॥

ज नहीं; केम के ‘जे ना संबन्धथी बुद्धि आदि पदार्थो प्रकाशे ऐ ते बुद्धि आदि पदार्थोना साक्षी कोई भगवान डोवा जोईअे, आम प्रकाश उपरथी आपनुं केवण अनुमान थर्थ शके ऐ पश आपनुं स्वरूप आ नेत्रथी प्रत्यक्ष जोई शकातुं नथी.<sup>३५</sup> वेद वयनोना अनुसारे मन वडे केवण अनुमान करवा योग्य, सर्वना साक्षी ऐवा तमो, ते तमारा गुणा, जन्म, कर्म, नाम अने रूप निरूपण करी शकातुं नथी. इतां पशा हे देव ! उपासक लोको यज्ञादिक क्रियामां अग्नि, ईन्द्रादिकना नाम रूप द्वारा तमोने ज आराध्य माने । ऐ वात प्रसिद्ध ऐ.<sup>३६</sup> तमारा महामंगण नाम अने रूपोने सांभणतो, बोलतो, संभारतो अने चित्तवतो जे पुरुष देवार्थनादिक क्रियाओमां तमारा यरणारविंदमां ज चित राखे तेने पुनः जन्म धरवो पडतो नथी.<sup>३७</sup> हे विष्णु ! बहु सारु थयुं, वामनरूपे त्रश पगलांथी मापेली पृथ्वीनो भार तमारा जन्मथी ज मटी गयो. आपनां सुंदर पगलांओथी चिह्नवाणी थयेली पृथ्वीने अने आपे दया करेला स्वर्गने अमे देखीशुं ए धयुं सारुं थयुं.<sup>३८</sup> हे नित्यमुक्त परमेश्वर ! आप अजन्मा ।<sup>३९</sup> आपने जन्म धरवानुं कारण मात्र कीडा विना बीजुं कशुं अमे धारता नथी. केमके अविद्यारूपी प्रकृतिद्वारा करायेली जगतनी उत्पत्ति, स्थिति अने प्रलय, आ त्राणे विकारो तमने ज आधीन ।<sup>४०</sup> हे यदुकुणमां उत्तम ! मत्स्य, हयशीव, नृसिंह, कर्त्तुप, वराह, हंस, राजा, प्रात्मण अने देवताओमां अवतार धरीने आपे बीजा समयमां जेवुं अमारुं अने त्रैलोक्यनुं

इत्यभिष्ट्य पुरुषं यद्ग्रामनिं यथा । ब्रह्मेशानौ पुरोधाय देवाःप्रतियुर्दिवम् ॥४२  
 इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्थे  
 गर्भगतविष्णोर्ब्रह्मादिकृतस्तुतिर्नाम द्वितीयोऽध्यायः ॥२॥

### अथ तृतीयोऽध्यायः (३)

श्रीशुकउवाच

अथ सर्वगुणोपेतः कालः परमशोभनः । यर्हेवाऽजनजन्मक्ष्यं शांतर्क्ष्यग्रहतारकम् ॥१  
 दिशः प्रसेदुर्गगनं निर्मलोद्गुणोदयम् । मही मङ्गलभूयिष्ठपुरग्रामव्रजाकरा ॥२  
 नद्यः प्रसन्नसलिला हृदा जलरुहश्रियः । द्विजालिकुलसंनादस्तबका वनराजयः ॥३  
 रक्षाण कर्युं छे, ते प्रमाणे हमाणां पाणे करो अने पृथ्वीनो भार उतारो. हे ईश्वर !  
 अमे आपने प्रणाम करीये छीये.<sup>४०</sup> (देवकीने कहे छे) हे माता ! अमारुं कल्याण  
 करवा सारुं तमारा उद्दरमां पोताना संकल्पथी परम पुरुष भगवान पधार्या छे  
 ए बहु ज सारुं थयुं छे. हवे कंसनुं मोत आवी यूक्युं छे, माटे ते कंसथी तमो हवे  
 भय पामशो नहि. तमारा पुत्र भगवान यादवोनुं रक्षाण करशे.<sup>४१</sup> शुकदेवज्ञ कहे  
 छे आ प्रमाणे जे रीते देवताओये भगवाननुं स्वरूप जाणेलुं हतुं ए रीते पोतानी  
 बुद्धिने अनुसारे यथायोग्य स्तुति करीने देवताओ ब्रह्मा तथा सदाशिवने आगण  
 करी (अमने छेतरीने आ बे देव अहीं रहेशे अम मानवाथी तेओने साथे लई)  
 पाइ। स्वर्गमां गया.<sup>४२</sup>

इति श्रीमद् महापुराणा भागवतना उशम टक्कंदनो लीजो अद्याय टंपूर्णः।

### अद्याय ३

श्रीकृष्णनो जन्म अने तेमनुं गोकुणमां पद्धारवुं.

शुकदेवज्ञ कहे छे पछी ज्यारे सधणा शुभगुणोवाणो अने अत्यंत सुंदर  
 समय आय्यो, यंद्रमा रोहिणी नक्षत्रमां आय्यो, नक्षत्र, ग्रह अने ताराओ अनुकूण  
 हता, दिशाओ स्वयच्छ थई, आकाश निर्मण थयुं, नक्षत्रो निर्मण रीते उग्यां,  
 पृथ्वीमां राजधानीओ, गामडां, व्रज अने खाण्योमां मंगण वरती रह्युं, नदीओनां  
 जण स्वयच्छ थई गयां, जणाशयोमां कमण भीलवानी शोभा थई, वनराजिओना  
 पुण्यना गुरुणोमां पक्षीओ अने भमराओ नाई करवा लाग्या, शीत, मंद अने

वर्वौ वायुः सुखस्पर्शः पुण्यगन्धवहः शुचिः । अग्नयश्च द्विजातीनां शान्तास्तत्र समिन्धित ४  
 मनांस्यासन् प्रसन्नानि साधूनामसुरद्रुहाम् । जायमानेऽजने तस्मिन् नेदुर्दुन्दुभयो दिवि ॥५  
 जगुः किन्नरगन्धर्वास्तुष्टुवुः सिद्धचारणाः । विद्याधर्यश्च ननृतुरप्सरोभिः समं तदा ॥६  
 मुमुचुर्मुनयो देवाः सुमनांसि मुदान्विताः । मन्दं मन्दं जलधरा जगर्जुरनुसागरम् ॥७  
 निशीथे तमउद्धूते जायमाने जनार्दने । देवक्यां देवरूपिण्यां विष्णुः सर्वगुहाशयः ।

आविरासीद् यथा प्राच्यां दिशीन्दुरिव पुष्कलः ॥८

तमद्धुतं बालकमम्बुजेक्षणं चतुर्भुजं शङ्खगदार्युदायुधम् ।

श्रीवत्सलक्ष्मं गलशोभिकौसुभं पीताम्बरं सान्द्रपयोदसौभगम् ॥९॥

महार्हवैदूर्यकिरीटकुण्डलत्विषा परिष्वक्तसहस्रकुन्तलम् ।

उद्दामकाञ्च्यङ्गदकङ्गणादिभिर्विरोचमानं वसुदेव ऐक्षत ॥१०॥

स विस्मयोत्फल्लिलोचनो हरि सुतं विलोक्यानकदुन्दुभिस्तदा ।

कृष्णावतारोत्सवसम्भ्रमोऽस्पृशन् मुदा द्विजेभ्योऽयुतमालुतो गवाम् ॥११॥

अथैनमस्तौदवधार्यं पूरुषं परं नताङ्गः कृतधीः कृताङ्गलिः ।

स्वरोचिषा भारत ! सूतिकागृहं विरोचयन्तं गतभीः प्रभाववित् ॥१२॥

सुगंधी पवन वावा लाग्यो, द्विज लोकोना अग्निओ शांत भरेला हता ते सारी  
 रीते प्रदीप थया, कंसाटिक विना भीजां सधणां प्राणीओ अने देवताओनां मन  
 प्रसन्न थयां, स्वर्गमां ईश्वरना अवतारने सूचवनारां हुंदुभि वाग्वा लाग्यां,  
 किन्तर अने गांधर्वो गावा लाग्या, सिद्ध अने चारणो स्तुति करवा लाग्या,  
 विद्याधरनी स्त्रीओ अने अप्सराओ नाचवा लागी, मुनिओ अने देवताओ  
 आनंदथी पुण्यवृष्टि करवा लाग्या, समुद्रनी पृथ्वाडे मेघ मंदमंद गर्जना करवा  
 लाग्यो अने धाटा अंधारावाणा मधरातना समयमां माणसोनी हरफर बंध पडी  
 गई, त्यारे पूर्वदिशाथी जेम संपूर्ण यंद्रमा प्रकट थाय तेम देवतारुपी देवकीथी  
 सर्वना अंतर्यामी भगवान मनुष्यरुपे प्रकट थया.<sup>४३</sup> ए अद्भुत बाणकने वसुदेवे  
 दीठा. ए बाणकनां कमणनी समान नेत्रो हतां, भुजा चार हती, शंभ, चक, गदा  
 अने पद्मरुपी आयुधो धर्या हतां, श्रीवत्सनुं चिह्न देखातुं हतुं कौस्तुभमणि शोभतो  
 हतो, पीणां वस्त्र धर्या हतां, धाटा मेघना सरभी कांति हती, अमूल्य वेदूर्यमणिथी  
 जडेला मुगट अने कुंडणोनी कांतिथी अनेक केश झणकी रह्या हता अने अति  
 उत्तम कटिमेखणा, बाजुबंध अने कंकणाटिक शोभी रह्यां हतां.<sup>४४५</sup> पोताना  
 पुत्ररुपे अवतरेला भगवानने जोई तेमना अवतारना उत्सवना संभ्रममां पडेला  
 अने विसमयथी जेनां नेत्र प्रकुलित थई गयां छे, एवा वसुदेवे ते समयमां

## वसुदेव उवाच -

विदितोऽसि भवान् साक्षात् पुरुषः प्रकृते: परः । केवलानुभवानन्दस्वरूपः सर्वबुद्धिदृढ़् ॥१३  
स एव स्वप्रकृत्येदं सृष्टाग्रे त्रिगुणात्मकम् । तदनु त्वं ह्यप्रविष्टः प्रविष्ट इव भाव्यसे ॥१४  
यथेमेऽविकृता भावास्तथा ते विकृतैः सह । नानावीर्याः पृथग्भूता विराजं जनयन्ति हि ॥१५

स्नान करीने दश हजार गायोनुं दान करवानो संकल्प कर्यो ॥<sup>११</sup> हे राजा ! पोताना पुत्रनी कांतिथी सुवावडनुं घर सधयुं शोभी रह्युं हतुं, पोताना पुत्रने परम पुरुष विष्णु जाणीने तेमना प्रभावने जाणता अने शुद्ध बुद्धिवाणा वसुदेवे पोतानुं शरीर नमावी तथा हाथ ज्ञेत्री निर्भय थैने तेमनी आ प्रमाणे स्तुति करी ॥<sup>१२</sup> वसुदेव स्तुति करे छे केवण अनुभव अने आनंद जेनुं स्वरूप छे ऐवा, सर्व बुद्धिओना साक्षी अने प्रकृतिथी पर पुरुषाकृति ऐवा जे परमात्मा वेदोमां वर्णवेला छे, ते साक्षात् तमो ज छो अम हुं जाणुं छुं ॥<sup>१३</sup> सर्वनी बुद्धिना साक्षी ऐवा तमो ज सृष्टि समये देव, मनुष्य, पशु, पक्षी ऐ आटिक आ संपूर्ण विश्वने सर्जने तेना कर्म प्रमाणे न्यूनाधिक इण आपवा माटे तमो तमारी अंतर्यामी शक्तिथी ज अनुप्रवेशीने रहेला छो, पशु मूर्तरूपे प्रवेशीने रहेला नथी. मूर्तरूपे तो तमारा ब्रह्मपुर धाममां रह्या छो. आ प्रमाणे अमो तमोने जाणीऐ छीअे ॥<sup>१४</sup> जेवी रीते महतात्वथी आरंभीने पृथ्वी पर्यंतना सर्व विकारी तत्वो पोतपोताना स्वरूपे करीने पृथक् रह्यां थकां ज मनुष्यादि सर्वना देहोने विषे पोतपोताना अंशथी प्रवेश करीने रहेलां छे. ऐज रीते परमात्मा ऐवा तमो पशु स्वस्वरूपे करीने तो तमारा धाममां रह्या थका ज तमारी अंतर्यामी शक्तिथी जगतमां प्रवेश करीने रहेला छो, अम अमो जाणीऐ छीअे. अने वणी जेम बिन्न बिन्न जेनी शक्तिओ छे, ऐवां महतात्व, अहंकार अने पंचतन्मात्राओरूपी प्रकृतिनां सात विकारात्मक तत्वो ज्यां सुधी पृथक्भूत होय त्यां सुधी कोई पशु कार्य करी शकतां नथी. तेथी ऐ सात तत्वो ज्यारे स्थूल पंचभूतो अने अगियार ईन्द्रियोरूपी सोण विकारोनी साथे मणे छे त्यारे ज ब्रह्मांडरूपी वैराजपुरुषना शरीरने उत्पत्ति करी शके छे. अने ब्रह्मांडरूपी वैराजपुरुषना शरीरने उत्पत्ति करीने ऐ सर्व तत्वो ब्रह्मांडमां प्रवेश करीने रहेलां होय अम जाणाय छे, छतां अे तत्वो प्रवेश करीने रहेलां नथी. कारण के कार्यनी उत्पत्तिथी पहेलां पशु तत्वो सर्वत्र विद्यमान हतां, तेथी तत्वोनो जेम ब्रह्मांडमां प्रवेश घटी शकतो नथी. तेम हे प्रभु ! तमो पशु

सन्निपत्त्य समुत्पाद्य दृश्यन्तेऽनुगता इव । प्रागेव विद्यमानत्वान्न तेषामिह सम्भवः ॥१६  
एवं भवान् बुद्ध्यनुमेयलक्षणैर्ग्राहौर्गुणैः सन्नपि तद्दुणाग्रहः ।  
अनावृतत्वाद् बहिरन्तरं न ते सर्वस्य सर्वात्मन आत्मवस्तुनः ॥१७॥  
य आत्मनो दृश्यगुणेषु सन्निति व्यवस्थते स्वव्यतिरेकतोऽबुधः ।  
विनानुवादं न च तन्मनीषितं सम्यग् यतस्त्यक्तमुपाददत् पुमान् ॥१८॥

अंतर्यामी शक्तिथी सर्वत्र विद्यमान होवाथी आ देवकीना उदरमां तमारो प्रवेश घटतो नथी.

अने वणी जेम उत्पत्ति थयेलां कार्योमां आ तत्वो उत्पत्ति थतां नथी. कारण के कार्यनी उत्पत्तिथी पहेलां ज तत्वो विद्यमान हतां. जे वस्तु विद्यमान न होय अने विद्यमान बने तेने उत्पत्ति थयेली कहेवामां आवे छे. पशु तत्वो तो पूर्वथी ज विद्यमान होवाथी जेम तत्वोनी उत्पत्ति घटी शके नहि. तेम हे प्रभु ! देवकी थकी तमारी उत्पत्ति घटी शके नहि, कारण के तमो सर्वदा स्वतंत्र विद्यमान ज छो ॥<sup>१५</sup>  
अने वणी जे रूप रसादिकने ग्रहण करे तेने कहेवाय ईन्द्रियो. आ प्रमाणे बुद्धिथी अनुमान करवा योग्य छे स्वरूप जेमनुं, ऐवी ईन्द्रियो द्वारा ग्रहण करवा योग्य देव मनुष्यादिक पदार्थोनी साथे तमारुं ग्रहण करी शकातुं नथी.

जेम के अत्यारे तमो ईन्द्रियोथी ग्रहण करवा योग्य मनुष्यरूपे रहेला छो छतां पशु “आ साक्षात् पुरुषोत्तम भगवान् छे” आ प्रमाणे अज्ञानी मनुष्यो पोतानी ईन्द्रियो वडे तमोने ग्रहण करी शकता नथी. ते ज रीते तमो देव मनुष्यादिक सर्व वस्तुओमां अंतर्यामीरूपे व्याम होवा छतां पशु पुरुषोनी ईन्द्रियो द्वारा ग्रहण कराती देवमनुष्यादिक वस्तुओनी साथे तमारुं ग्रहण थै शकतुं नथी. अने वणी समग्र येतन अने अयेतनथी विशिष्ट ऐवा जे तमो, सर्वप्रकारे प्रकृतिना आवरणथी रहित होवाथी तमारे विषे बहार अने अंदरपशानो भेद घटी शके ज नहि. जे प्रथम प्रकृतिनी बहार होय अने पछी जे अंदर प्रवेशे तो ज अंदरपशानो भेद घटी शके. अथवा तो प्रथम जे अंदर होय अने जो बहार नीकणे तो ज बाह्यपशानो भेद घटी शके. पशु हे प्रभु ! तमो तो सर्वदा सर्वत्र व्यापक होवा छतां पशु तेना आवरणथी रहित छो. तेथी देवकीना उदरमां प्रवेशवुं अने बहार नीकणवुं आवो बाह्य अने आभ्यन्तरपशानो भेद तमारी अंदर घटी शके नहि. <sup>१९</sup> हे प्रभु ! काण, माया, पुरुष अने महादादिक आ सर्व देश

ત्वत्तोऽस्य जन्मस्थितिसंयमान् विभो ! वदन्त्यनीहादगुणादविक्रियात् ।  
त्वयीश्वरे ब्रह्मणि नो विरुद्ध्यते त्वदाश्रयत्वादुपचर्यते गुणैः ॥१९॥  
सत्वं त्रिलोकस्थितये स्वमायाया बिर्भविष्य शुक्लं खलु वर्णमात्मनः ।  
सर्गाय रक्तं रजसोपबृंहितं कृष्णं च वर्णं तमसा जनात्यये ॥२०॥

तत्वो तमारा अनुप्रवेश विना केवण स्वतंत्रपणे आ जगतनी सुष्ठि आदिकमां समर्थ छे. આ प्रમाणे જे पुरुषो निश्चय करे छे, તे पुरुषो मूर्ख छे. અने तेना निश्चयो अने विचारो કेवण अनुवाद मात्र होय छे, पण तेमां કोઈ तथ्य होतु नथी. અने वणી ભગવानना અनुप्रवेश विना केवण स्वतंत्र पणे કाण, મाया, પुરुष અने મહादाइક तत्वोऽपी આ સर्वे दृश्यपदार्थो जगतनी सुष्ठि आदिकને કરવामां સમર्थ છે, આવા વિચारોને નારદાઇક મહર્ષિઓએ ત્યજી દીધેલા છે. તેને જે પુરुષો ગ્રહણ કરે તે પુરुષો તો મહામૂર્ખ જ કહેવાય છે.<sup>१८</sup> અને હે પ્રભુ ! તમો અક્રિય છો. અર्थात् સંકલ્પ સિવાય તમામ વ્યાપારોથી રહિત છો. સત્ત્વાદિક પ્રાકૃત ગુણોથી રહિત છો, કામકોધાદિક વિકારોથી રહિત છો, છતાં પણ તમારા થડી જ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે. આ પ્રમાણે વેદો પ્રતિપાદન કરે છે. જો કે તમો પ્રાકૃતગુણોથી રહિત નિર્ગુણ છો છતાં, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, બૃહત્વ ઈત્યાદિક અનેક કલ્યાણકારી ગુણોથી યુક્ત છો, સર્વના નિયામક છો. તેથી જગતનું ઉપાદાન કારણપણું, નિમિત્તકારણપણું એ આદિક ધર્મો તમારે વિષે વિરોધને પામતા નથી. (શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે હું તો પરમદયાળું છું, તેથી મારે વિષે સુષ્ઠિપ્રલયાદિક ઘોર કર્મ કેવી રીતે સંભવી શકે ?) તેના ઉત્તરમાં કહે છે કે- જેમ કોઈ રાજાના ચાકરે કરેલા કાર્યનો રાજામાં આરોપ કરવામાં આવે છે. તેમ ગુણાભિમાની બ્રહ્માદિક દેવતાઓ તમારો આશ્રય રાખીને જ તમારી આપેલી શક્તિથી સુષ્ઠિ આદિક કાર્યને કરે છે. તેથી તમારે વિષે કર્તાપણનો આરોપ કરવામાં આવે છે. પણ હે પ્રભુ ! તમો તો સંકલ્પ સિવાય તમામ વ્યાપારોથી રહિત છો, તેથી અક્રિય છો અને તમારો સંકલ્પ પણ જીવોના કર્માનુસારે હોય છે. તેથી વિષમપણું આદિક ઘોર કર્મનો તમોને લેપ લાગતો નથી.<sup>१९</sup> અને વળી હે પ્રભુ ! તમો તમારી ઈચ્છા શક્તિથી ત્રિલોકીની સ્થિતિને માટે સત્ત્વગુણપ્રધાન પ્રદ્યુમનસ્વરૂપને ધારણ કરો છો અને ત્રિલોકીની ઉત્પત્તિને માટે રજોગુણપ્રધાન અનિરૂદ્ધસ્વરૂપને ધારણ કરો છો અને ત્રિલોકીના નાશને માટે તમોગુણપ્રધાન

त्वमस्य लोकस्य विभो ! रिरक्षिषुगृहीज्वतीर्णोऽसि ममाखिलेश्वर ! ।  
राजन्यसंज्ञાસુરकोटियूथपैર्निर्वृह्मामाना નिहनिष्यसे चमूः ॥२१॥  
अयं त्वस्यस्तव जन्म नौ गृहे श्रुत्वाग्रजांस्ते न्यवधीत् સુરेश्वર ! ।  
स तेऽवતारं पुરुषैः સમर्पितं શ્રुत्वाधુनैवाभिसરत्युदायुधः ॥२२॥

શ્રીશુક ઉવાચ -

अथैनમात्मजं वीक्ष्य महापुરुषलक्षणम् । દેવકी તમुપाधावत् કंસाद् ભीતા શુચિસ્મિતા ૨૩  
दેવકુવ્યવાચ -

રु યં યત् તત् પ્રાહુરવ્યક્તમાદ્યં બ્રહ્મ જ્યોતિનિર્ગુણ નિર્વિકારમ् ।  
સત્તામાત્રં નિર્વિશેષં નિરીહં સ ત્વં સાક્ષાદ् વિષ્ણુરુધ્યાત્મદીપઃ ॥૨૪॥  
નષ્ટે લોકે દ્વિપરાર્થાવસાને મહાભૂતેષ્વાદિભૂતં ગતેષુ ।  
વ્યક્તેऽવ્યક્તં કાલવેગેન યાતે ભવાનેકઃ શિષ્યતે શેષસંજઃ ॥૨૫॥  
યોऽયં કાલસ્તસ્ય તેઽવ્યક્તકબન્ધો ! ચોષ્ણમાહુશ્વેષ્ટતે યેન વિશ્વમ् ।  
નિમેષાદિર્વત્તસરાન્તો મહીયાંસ્તં ત્વેશાનં ક્ષેમધામ પ્રપદ્યે ॥૨૬॥

સંકર્ષણસ્વરૂપને ધારણ કરો છો.<sup>૨૦</sup> હે સર્વેશ્વર ! તે આપ આ જગતની રક્ષા કરવાની ઈચ્છાથી મારા ધરમાં અવતર્યા છો, તેથી ‘રાજા’ એવું નામ ધરાવનાર કરોડો દૈત્યોના યુથપતિઓએ ચલાવાતી સેનાઓને મારશો.<sup>૨૧</sup> હે દેવતાઓના ઈશ્વર ! આ દુષ્ટ કંસે અમારા ધરમાં તમારો જન્મ થવાનું ભવિષ્ય સાંભળીને તમારા મોટા ભાઈઓને મારી નાખ્યા છે અને તે હમણાં જ પોતાના માણસોના કહેવાથી આપનો અવતાર થયેલો સાંભળી હથિયાર ઉપાડીને આવતો હશે.<sup>૨૨</sup> શુકેવજી કહે છે પછી મહાપુરુષના લક્ષણવાળા એ પુત્રને જોઈને કંસથી ભય પામેલાં દેવકીજીએ ભગવાની સ્તુતિ કરી.<sup>૨૩</sup> હે પ્રભુ ! પ્રકૃતિપુરુષથી વિલક્ષણ એવું જે તમારું સ્વરૂપ છે તેને વેદાન્તો અવ્યક્ત કહે છે આદિકારણ કહે છે, બ્રહ્મ કહે છે, સ્વયંપ્રકાશ કહે છે, નિર્ગુણ કહે છે, સત્તામાત્ર કહે છે, નિર્વિકાર કહે છે, નિર્વિશેષ કહે છે, નિરીહ કહે છે, (અર્થાત् પુણ્યપાપરૂપ વ્યાપારથી રહિત કહે છે.) અને અક્ષરપુરુષાદિ સમગ્ર યેતનોને વિષે દીવાની સમાન પ્રકાશક કહે છે, આવા જે વિષ્ણુ છે, તે સાક્ષાત् તમો જ છો.<sup>૨૪</sup> હે પ્રભુ ! બ્રહ્માની દ્વિપરાર્થની આયુષ્યને અંતે જીવારે આ બ્રહ્માંડનો નાશ થાય છે, ત્યારે પૃથ્વી આદિક પંચ મહાભૂતો, આદિ કારણ એવા અહંકારને વિષે લય પામે છે. અને અહંકાર જીવારે મહત્તત્વને વિષે લય પામે છે. અને મહત્તત્વ જીવારે પ્રકૃતિને વિષે લય પામે છે.

मत्येऽमृत्युव्यालभीतः पलायन् लोकान् सर्वान्निर्भयं नाध्यगच्छत् ।  
त्वत्पादाब्जं प्राप्य यदृच्छयाद्य स्वस्थः शेते मृत्युरस्मादपैति ॥२७॥  
स त्वं घोरादुग्गसेनात्मजान्नस्त्राहि त्रस्तान् भृत्यवित्रासहाऽसि ।  
रूपं चेदं पौरुषं ध्यानधिष्ठयं मा प्रत्यक्षं मांसदूशां कृषीष्टाः ॥२८॥  
जन्म ते मध्यसौ पापो मा विद्यान्मधुसूदन ! समुद्दिजे भवद्वेतोः कंसादहमधीरथीः ॥२९  
उपसंहर विश्वात्मन्दो रूपमलौकिकम् । शङ्खचक्रगदापद्मश्रिया जुष्टं चतुर्भुजम् ॥३०  
विश्वं यदेतत् स्वतनौ निशान्ते यथावकाशं पुरुषः परो भवान् ।  
बिभर्ति सोऽयं मम गर्भगोऽभूदहो नृलोकस्य विडम्बनं हि तत् ॥३१॥

अने प्रकृति ज्यारे पुरुषने विषे लय पामे छे. त्यारे तमो एक ज रहेला हो छो, तेथी तमोने शेष आवा नाभथी कहे छे.<sup>२५</sup> हे प्रकृतिने प्रवत्तविनार ! आ भोटो काण के जेना आहिमां निमेष छे अने अंतमां वर्ष छे तथा जेनी आवृत्तिथी जगतनी आवृत्तिओ थाय छे ते काण तो आपनी लीलारूप कहेवाय छे, माटे अभयना स्थानकरूप आपने हुं शरणे आवी छुं.<sup>२६</sup> हे आहिपुरुष ! जन्ममरणरूपी संसृतिने भोगवनारो पुरुष मृत्युरूपी महासर्पना भयने पामीने, ए भयना निवारणने माटे सर्वत्र दोडे छे, अर्थात् सर्वे उपायोने करे छे. कोईपाण जग्याए ज्यारे भय निवृत्ति पामतो नथी. त्यारे कोई भाव्यवशात् तमारा चरणकमणनो आश्रय करे छे, त्यारे ज मृत्युरूपी महासर्पना भयथी रहित थाय छे. अने ब्रह्मपदने पामे छे.<sup>२७</sup> हे प्रभु ! आ प्रमाणे तमो सर्वप्रकारे कल्याणना स्थानरूप छो. माटे घोर ऐवा कंस थकी भयने पामेला ऐवा जे अमो, ते अमारुं रक्षण करो. कारण के तमो शरणे आवेलाना भयने हरण करनारा छो. अने वणी हे प्रभु ! परमपुरुषपणाने सूचवनारुं, योगीओने ध्यानना स्थानरूप ऐवुं आ तमारुं दिव्यस्वरूप अमारा जेवा यर्भयक्षुवाणाओनी आगण प्रगट करशो नहि.<sup>२८</sup> हे विष्णु ! ए पापी कंस मारा शरीरथी आपनो जन्म थयानुं न जाणो, केमके अधीर यितवाणी हुं आपना लीधे ज कंसथी उद्देग पामुंछु.<sup>२९</sup> हे जगदात्मा ! शंख, चक्र, गदा तथा पद्मनी शोभावाणुं अने चार भुजावाणुं आ अलौकिक रूप शमावो.<sup>३०</sup> हे जगदात्मा ! आ संपूर्ण जगतने प्रलयकाणने अंते अर्थात् सृष्टिकाणमां नाभिकमणने विषे धारण करो छो. छतां पुष्कण अवकाश रहे छे. आवा महान तमो ज मारा गर्भरूपे थया छो. ए तो सर्वे जनोने माटे महान आश्रयरूप छे. अर्थात् लोको हांसी करे एम छे. माटे आ तमारा दिव्यस्वरूपने

श्रीभगवानुवाच -  
त्वमेव पूर्वसर्गेऽभूः पृश्नः स्वायम्भुवे सति ! । तदाऽयं सुतपा नाम प्रजापतिरकल्पयः ॥३२  
युवां वै ब्रह्माणाऽदिष्टौ प्रजासर्गं यदा ततः । सन्त्रियव्येन्द्रियग्रामं तेपाथे परमं तपः ॥३३  
वर्षवातातपहिमधर्मकालगुणाननु । सहमानौ श्वासरोधविनिर्धूतमनोमलौ ॥३४  
शीर्णपणानिलाहारावुपशान्तेन चेतसा । मत्तः कामानभीप्सन्तौ मदाराधनमीहतुः ॥३५  
एवं वां तप्यतोस्तीव्रं तपः परमदुष्करम् । दिव्यवर्षसहस्राणि द्वादशेयुर्मदात्मनोः ॥३६  
तदा वां परितुष्टेऽहममुना वपुषानये । तपसा श्रद्धया नित्यं भक्त्या च हृदि भावितः ॥३७  
प्रादुरासं वरदराङ् युवयोः कामदित्यया । व्रियतां वर इत्युक्ते मादृशो वां वृतः सुतः ॥३८  
अजुष्टाम्यविषयावनपत्यौ च दम्पती । न वन्नाथेऽपवर्गं मे मोहितौ मम मायया ॥३९  
गते मयि युवां लब्ध्वा वरं मत्सदूशं सुतम् । ग्राम्यान् भोगानभुज्जाथां युवां प्राप्तमनोरथौ ४०  
अदृष्टवायतमं लोके शीलोदार्यगुणौः समम् । अहं सुतो वामभवं पृश्निगर्भं इति श्रुतः ॥४१

तमो संकेली व्यो.<sup>३१</sup>

श्रीभगवान कहे छे- हे सती ! तमेज पूर्वजन्ममां स्वायंभुव मन्वंतरमां पृश्नि नामे हतां अने त्यारे आ वसुदेव सुतपा नामे निर्दोष प्रजापति हता.<sup>३२</sup>  
प्रजानी सृष्टि करवा सारुं भ्रह्माए ज्यारे तमने आज्ञा करी, त्यारे तमे भन्ने ईन्द्रियोने नियममां राखीने मोहुं तप करवा लाग्यां हतां.<sup>३३</sup> वरसाद, वायु, तडको अने गरभीरूपी काणना गुणोने सहन करतां हतां. प्राणायाम करवाथी मनना भेलने धोई नाख्या हता.<sup>३४</sup> खरी पडेलां पांदडां अने पवननो आहार करी रहेलां हतां अने मारी पासेथी वर भेणववानी ईच्छाने लीधे शांत चित्तथी मारुं आराधन करतां हतां.<sup>३५</sup> आ प्रमाणे मारामां चित्त राखी, तीव्र अने अत्यंत दुष्कर तप करतां तमो भन्ने देवताओना बारहजार वर्ष वीती गयां.<sup>३६</sup> ते समये तप, श्रद्धा अने निरंतर भक्तिथी हृदयमां ध्यान करायेलो अने वरदेनाराओनो अधिपति एवो हुं प्रसन्न थैने वर देवा सारु आ शरीरथी ज तमारी पासे प्रकट थयो हतो. में “वर भांगो” एम कहेतां तमोए मारा जेवो पुत्र मांग्यो.<sup>३७-३८</sup>  
तमोए संसारनां विषयसुभ भोगव्यां न हतां अने संतान पण थयुं न हतुं, तेथी मायाना मोहने लीधे तमोए मारी पासेथी मोक्ष मांग्यो नहीं.<sup>३९</sup> मारा जेवो पुत्र थवानुं वरदान आपीने हुं अंतर्धान थयो अने पाई अपूर्ण मनोरथवाणा तमो भन्ने संसारसंबंधी सुभ भोगववा लाग्यां.<sup>४०</sup> शील, उदारता आहिगुणोथी मारा जेवो बीजो कोई ज्ञेवामां नहीं आवतां ‘पृश्निगर्भ’ एवे नामे हुं ज तमारो पुत्र

तयोर्वा पुनरेवाहमदित्यामास कश्यपात् । उपेन्द्र इति विख्यातो वामनत्वाच्च वामनः ॥४२  
तृतीयेऽस्मिन् भवेऽहं वै तेनैव वपुषाथ वाम् । जातो भूयस्तयेरेव सत्यं मे व्याहृतं सति! ॥४३  
एतद् वां दर्शितं रूपं प्राग्जन्मस्मरणाय मे । नान्यथा मद्भवं ज्ञानं मर्त्यलिङ्गेन जायते ॥४४  
युवां मां पुत्रभावेन ब्रह्मभावेन चासकृत् । चिन्तयन्तौ कृतस्नेहौ यास्येथे मद्रतिं पराम् ॥४५  
यदि कंसाद् बिभेषि त्वं तर्हि मां गोकुलं नय । मन्मायामानयाशु त्वं यशोदागर्भसंभवाम् ॥४६

### श्रीशुक उवाच -

इत्युक्त्वाऽऽसीद्धरिस्तूष्णीं भगवानात्ममायया । पित्रोः सम्पश्यतोः सद्यो बभूव प्राकृतः शिशुः ।  
ततश्च शौरिर्भगवत्प्रचोदितः सुतं समादाय स सूतिकागृहात् ।  
यदा बर्हिंगन्तुमियेष तर्हजा या योगमायाऽजनि नन्दजायया ॥४७॥  
तया हृतप्रत्ययसर्ववृत्तिषु द्वाःस्थेषु पौरेष्वपि शायितेष्वथ ।  
द्वारस्तु सर्वाः पिहिता दुरत्यया बृहत्कपाटायसकीलशृङ्खलैः ॥४९॥

थयो हतोऽपाइं तमे भीजा अवतारमां कश्यप अने अदिति थयां हतां, त्यां पशु 'उपेन्द्र' ऐवा नामथी हुं तमारे त्यां अवतर्यो हतो. ए अवतारमां हुं ठींगणो हतो, तेथी मारुं "वामन" ऐवुं नाम कहेवातुं हतुं.<sup>४२</sup> आ भारा त्रीजा अवतारमां पशु एज शरीरथी इरीवार तमारे त्यां अवतर्यो हुं. हे सति! आ वात में पथार्थ कही छे.<sup>४३</sup> भारा पूर्वजन्मना स्मरणाने माटे आ यतुर्भुजउप में तमने देखाइयुं छे; केमके जो हुं मारुं दिव्य यतुर्भुज इप न देखाउत तो तमने मारुं शान थात नहीं.<sup>४४</sup> तमे पुत्र भावथी अने ब्रह्मभावथी पशु मारुं वारंवार चिंतन करशो अने स्नेह राखशो, तेथी हुवे तमने मोक्षनी प्राप्ति थशे.<sup>४५</sup> जो तमे कंसथी भीतां हो तो भने गोकुणमां लई जाओ अने यशोदानी कन्या के जे मारी भायाउप छे, तेने अहीं लावो.<sup>४६</sup>

शुक्टेवज्जु कहे छे एटलुं कहीने भगवान भौन रह्या, अने माता पिताना देखतां ज तुरंत पोतानी मायाथी प्राकृत भाणक थई गया.<sup>४७</sup> पछी वसुदेवे सुवावडना घरमांथी पुत्रने लई ज्यारे बहार जवानी ईच्छा करी, ते ज समये नंदनी स्त्री यशोदाए योगमायाने जन्म आप्यो.<sup>४८</sup> ए योगमायाए शानमां कारणउप एवी ईन्द्रियोनी वृत्तिओने हरी लईने द्वारपाणो तथा नगरवासीओने ज्यारे सुवाडी दीधा हता त्यारे वसुदेव पोताना हाथमां भगवानने पधरावीने चाल्या. ते समये लोढांना भीलावाणी सांकणोथी भीडेलां अने बहु ज मज्जूत एवां मथुरानां मोटां मोटां सर्वे द्वारो पशु सूर्यथी जे भ संधारुं ऊधी ज्य तेम

ताः कृष्णावाहे वसुदेव आगते स्वयं व्यवर्यन्त यथा तमो रवे: ।  
वर्ष पर्जन्य उपांशुर्गार्जितः शेषोऽन्वगाद् वारि निवारयन् फणैः ॥५०॥  
मधोनि वर्षत्यसकृद् यमानुजा गम्भीरतोयौघजवर्मिफेनिला ।  
भयानकावर्तशताकुला नदी मार्ग ददौ सिंधुरिव श्रियः पते: ॥५१॥  
नन्दन्रजं शौरिरुपेत्य तत्र तान् गोपान् प्रसुमानुपलभ्य निद्रया ।  
सुतं यशोदाशयने निधाय तत्सुतामुपादाय पुनर्गृहानगात् ॥५२॥  
देवक्याः शयने न्यस्य वसुदेवोऽथ दारिकाम् । प्रतिमुच्य पदोलोहमास्ते पूर्ववदावृतः ॥५३  
यशोदा नन्दपती च जातं परमबुध्यत । न तल्लिङ्गं परिश्रान्ता निद्रयापगतस्मृतिः ॥५४  
इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्द्धे  
श्रीकृष्णजन्मनि तृतीयोऽध्यायः ॥३॥

श्रीकृष्णने वहन करनार वसुदेवना आवतांनी साथे ज पोतानी भेणे ज ऊधी गयां. ते समये गर्जनाने करतो भेद मंदमंद वरसी रह्यो हतो. अने भाणक ऐवा श्रीकृष्ण भगवान उपर वरसता पाणीने शेषनाग पोतानी ईशाथी निवारी रह्या हता.<sup>४८-५०</sup> ए समयमां वारंवार भेद वरसवाने लीधे यमुनाञ्चामां गंभीर जणना प्रवाहना वेगने लीधे मोजां ऊधणवाथी भारे ईशा तेमां चञ्चां हतां. अने जणमां सेंकडो भयंकर यक्कीओ पडती हती, तोपश ते नदीओ रामचंद्रज्ञने जे भ समुद्रे मार्ग आप्यो हतो तेम वसुदेवने मार्ग आप्यो.<sup>५१</sup> वसुदेवे नंदना प्रजमां आवी अने सधणा गोवाणियाओने मायाथी सूतेला जोई यशोदानी दीकरीने लईने पाइ पोताने घेर आव्या.<sup>५२</sup> ए दीकरीने देवकीना शयनमां मूकी, पाइ पोताना पगमां बेडीओ पहेरीने वसुदेव प्रथमनी पेठेज त्यां रह्या.<sup>५३</sup> नंदनी स्त्री यशोदाने पोताने कांઈक भाणक अवतर्यु छे एटलुं आशवामां आवतुं हतुं पशु थाकथी अने योगमायाए स्मृति हरी लेवाथी "ते पुत्र छे के कन्या छे" ऐवुं शान थयुं न हतुं.<sup>५४</sup>

इति श्रीमद् महापुराण भागवतना दशम स्कन्धनो त्रीजो अद्याय संपूर्णः.

## अथ चतुर्थोऽध्यायः (४)

श्रीशुक उवाच

बहिरन्तःपुरद्वारः सर्वाः पूर्ववदावृताः । ततो बालधर्मं श्रुत्वा गृहपालाः समुत्थिताः ॥१  
ते तु तूर्णमुपवर्ज्य देवक्या गर्भजन्म तत् । आचख्युभौर्जराजाय यदुद्विग्नः प्रतीक्षते ॥२  
स तल्पात् तूर्णमुत्थाय कालोऽयमिति विह्वलः । सूतीगृहमगात् तूर्ण प्रस्वलन् मुक्तमूर्धजः ३  
तमाह भ्रातरं देवी कृपणा करुणं सती । स्नुषेयं तव कल्याणं! स्त्रियं मा हन्तुमर्हसि ॥४  
बहवो हिंसिता भ्रातः! शिशवः पावकोपमाः । त्वया दैवनिसृष्टेन पुत्रैकैका प्रदीयताम् ॥५  
नन्वहं ते ह्यवरजा दीना हतसुता प्रभो! । दातुर्मर्हसि मन्दाया अङ्गेमां चरमां प्रजाम् ॥६

श्रीशुक उवाच -

उपगुह्यात्मजामेवं रुदत्या दीनदीनवत् । याचितस्तां विनिर्भर्त्स्य हस्तादाचिच्छिदे खलः ॥७  
तां गृहीत्वा चरणयोर्जितमात्रां स्वसुः सुताम् । अपोथयच्छिलापृष्ठे स्वार्थोन्मूलितसौहृदः ॥८  
सा तद्वस्तात् समुत्पत्य सद्यो देव्यम्बरं गता । अदृश्यतानुजा विष्णोः सायुधाष्टमहाभुजा ॥९

## अध्याय ४

कुंसे बाणकोनी कराववा भांडेली हिंसा.

शुकदेवज्ञ कुहे छे भहारना अने अंतःपुरनां द्वार पूर्वनी पेठे ज बंध थर्ठ गयां. पछी बाणको शब्द सांभणीने द्वारपाणो तुरत जागी गया अने तरत ज कुंसनी सभीपे जर्हने देवकीने प्रसव थयानी वात कही के जेनी कुंस उद्वेगने लीघे राह जोई रह्यो हतो.<sup>१-२</sup> “आतो मृत्यु” ऐम विक्षण थयेलो कुंस तुरत पथारीमांथी उठीने भाथाना वाणने सरभा कर्या विना ठेशो खातो खातो सूवावडना घरमां आव्यो.<sup>३</sup> सती एवी रांक देवकीअ दयामणी रीते ते भाईने कह्युं के “हे भला भाई! आ तारी भाषेज्ज दीकरी छे माटे आने तारे भारवी न जोईअे.<sup>४</sup> हे भाई ! तमोअ देवनी प्रेरणाथी भारा अग्नि जेवा तेजस्वी धणा पुत्रोने भारी नाख्या, पण आ एक दीकरी भने आपो.<sup>५</sup> हुं तमारी नानी बहेन रांक अने मंद भाग्यवाणी अने जेना पुत्रो मरी गया छे एवी छुं, तो हे भाई ! आ छेल्ली प्रजा भने आपवी जोईअे.”<sup>६</sup>

शुकदेवज्ञ कुहे छे- आ प्रमाणे दीकरीने छाती साथे दबावीने खडु ज रांकनी पेठे रुदन करती देवकीअ प्रार्थना करी, तोपण दुष्ट कुंसे तेने तरछोडीने तेना हाथमांथी ते कन्याने आंयकी लीधी.<sup>७</sup> स्वार्थथी स्नेहने तोडी नाखनार कुंसे ए बहेननी दीकरी के जे भात्र जन्मेली ज हती, तेना पग पकडीने पथर उपर

दिव्यस्वराम्बरालेपरताभरणभूषिता । धनुःशूलेषु चर्मासिशङ्खचक्रगदाधरा ॥१०  
सिद्धचारणगन्धवैरप्सरः किन्नरोरगैः । उपाह्वतोरुबलिभिः स्तूयमानेदमब्रवीत् ॥११  
किं मया हतया मन्द ! जातः खलु तवान्तकृत् । यत्र क्रवा पूर्वशत्रुमा हिंसीः कृपणान् वृथा ॥१२  
इति प्रभाष्य तं देवी माया भगवती भुवि । बहुनामनिकेतेषु बहुनामा बभूव ह ॥१३  
तयाभिहितमाकर्ण्य कंसः परमविस्मितः । देवकी वसुदेवं च विमुच्य प्रश्रितोऽब्रवीत् ॥१४  
अहो भगिन्यहो भाम ! मया वां बत पाप्मना । पुरुषाद इवापत्यं बहवो हिंसिताः सुताः ॥१५  
स त्वं ह त्यक्तकारुण्यस्त्यक्तज्ञातिसुहृत् खलः । काँल्लोकान् वै गमिष्यामि ब्रह्महेव मृतः श्वसन्  
दैवमध्यनृतं वक्ति न मर्त्या एव केवलम् । यद्विश्राम्भादहं पापः स्वसुनिर्हतवाऽऽशून् ॥१७  
मा शोचतं महाभागावात्मजान् स्वकृतम्भुजः । जन्तवो न सदैकत्र दैवाधीनास्तदासते ॥१८  
भुवि भौमानि भूतानि यथा यान्त्यपयान्ति च । नायमात्मा तथैतेषु विपर्येति यथैव भूः ॥१९  
पष्टाडी.<sup>८</sup> विष्णुनी नानी बेन ए साधारण कन्या न हती. ते कुंसना हाथमांथी उठीने तुरत आकाशमां गर्छ. त्यां साक्षात् योगमाया रुपे ज्ञेवामां आवी. दिव्य माणा, वस्त्र, लेप तथा रत्ना अलंकारथी शोभती हती. मोटी आठ भुजाओमां धनुष, त्रिशूण, बाण, ढाल, तरवार, शंभ, यक अने गदा ए आठ आयुधो धारण कर्या हतां.<sup>९-१०</sup> सिद्ध, चारण, गंधर्व, अप्सरा, किन्नर अने सर्पो धणां धणां बलिदान आपीने तेनी स्तुति करता हता, ए देवीअे कुंसने कह्युं के-“हे मंद ! मने मारवाथी तारुं शुं वणवानुं छे ? तारो पूर्वनो शत्रु, के जे तारा प्राण लेनार छे ते तो बीजा कोई स्थानकमां उत्पत्त थर्ठ यूक्यो छे. माटे निर्दोष बाणकोने तुं वृथा मार मा.”<sup>११-१२</sup> भगवती योगमाया ते कुंसने आ प्रमाणे कही पृथ्वीमां धणां धणां नामवाणां स्थानकोमां धणां धणां नामथी रही.<sup>१३</sup> ए देवीनुं वयन सांभणी बहु ज विस्मय पामेला कुंसे देवकी अने वसुदेवने छोडीने नम्रताथी कह्युं के “हे बेन ! हे बनेवी ! अहो !!! बहु ज भूं थयुं. राक्षस जेम पोतानां छोकरांने ज मारी नाखे तेम, में पापीअे तमारा धणा पुत्रोने भारी नाख्या.<sup>१४-१५</sup> खरेखर हुं निर्दय हुं. में शातिज्ञो अने सगासंबंधीओनो त्याग कर्यो छे. माटे खण एवो हुं ब्रह्महत्यारानी पेठे ज्ञवतां ज मरेलो हुं. अने मर्यां पछी कुया लोकने पामीश ?<sup>१६</sup> केवण माणसो ज खोटुं खोले छे एम नथी, परंतु देवताओ पाण खोटुं खोले छे के जेओना विश्वासथी में पापीअे बहेनना बाणकोने भारी नाख्यां.<sup>१७</sup> हे महाभाग्यशाणी ! जे तमारा पुत्रोअे पोतानां प्रारब्ध भोगव्यां तेओनो शोक करो मा, केमके दैवाधीन प्राणीओ निरंतर एक ठेकाणे साथे रहेतां ज नथी.<sup>१८</sup>

यथानेवंविदो भेदो यत आत्मविपर्ययः । देहयोगवियोगौ च संसृतिर्न निवर्तते ॥२०  
तस्माद् भद्रे ! स्वतनयान् मया व्यापादितानपि । मानुशोच यतः सर्वं स्वकृतं विन्दतेऽवशः ॥२१  
यावद्भद्रोऽस्मि हन्तास्मीत्यात्मानं मन्यतेऽस्वदूक् । तावत्तदभिमान्यज्ञो बाध्यबाधकतामियात्  
क्षमध्वं मम दौरात्म्यं साधवो दीनवत्सलाः । इत्युक्त्वाऽश्रुमुखः पादैश्यालः स्वस्नोरथाग्रहीत् ॥२३  
मोचयामास निगडाद् विश्रब्धः कन्यकागिरा । देवकीं वसुदेवं च दर्शयन्नात्मसौहृदम् ॥२४  
भ्रातुः समनुतमस्य क्षान्त्वा रोषं च देवकी । व्यसृजद् वसुदेवश्च प्रहस्य तमुवाच ह ॥२५  
एवमेतन्महाभाग ! यथा वदसि देहिनाम् । अज्ञानप्रभवाहंथीः स्वपरेति भिदा यतः ॥२६  
शोकहर्षभयद्वेषलोभमोहमदान्विताः । मिथो घन्तं न पश्यन्ति भावैर्भावं पृथगदृशः ॥२७

## श्रीशुक उवाच -

कंस एवं प्रसन्नाभ्यां विशुद्धं प्रतिभाषितः । देवकीवसुदेवाभ्यामनुज्ञातोऽविशद् गृहम् ॥२८

जेम पृथ्वीमां पृथ्वीना विकारऽरुप धटादिकं पदार्थो थाय छे अने पाइं झूटी जाय  
छे, तेमां पृथ्वी कांઈ पश फेरफार नहीं पामतां ऐवीने ऐवी ज रहे छे, तेम देह  
जन्मे छे अने भरी जाय छे, तेमां आत्मा कांઈ पश फेरफार नहीं पामतां एकरुप  
ज रहे छे.<sup>१८</sup> आ प्रमाणे जे माणस यथार्थ भेदने समजतो नथी तेने देहमां  
आत्मभुद्धि थाय छे, अने ज्यां सुधी देहमां आत्मभुद्धि होय त्यां सुधी देहनो  
योग तथा वियोग अने तेना थकी सुख हुः ख चाल्या करे छे.<sup>१९</sup> एटला माटे हे  
भली बहेन ! तारा पुत्रोने में मारी नाख्या तोपश तेओनो तुं शोक राखीश मा;  
केमके सर्व प्राणीओने परतंत्रपणाथी पोतानुं करेलुं भोगवतुं पडे छे.<sup>२०</sup> ज्यां  
सुधी पोताना स्वरुपने नहीं जाणीने ‘हुं मरनारो हुं अथवा मारनारो हुं’ एम  
माने छे, त्यां सुधी ए देहाभिमानी अज्ञानी माणस वध्यवधक भावने पामे छे.  
अर्थात् पोते हणाय छे अने बीजाने हणो छे.<sup>२१</sup> दीन उपर दया करनारा साधु  
लोको मारा अपराधनी क्षमा करजो.” एम कही रही पडीने कंसे देवकी तथा  
वसुदेवना पग पकड्या, अने योगमायाना वयन उपर विश्वास राखी पोतानो  
स्नेह देखाइवा वसुदेव देवकीने बंधनमांथी छोड्यां.<sup>२३-२४</sup> ए पस्ताएला भाई  
उपर देवकीऐ क्षमा करी. अने वसुदेवे पश वैर मूँझी, हसीने तेने कह्युं के “हे  
महात्मा कंस ! जेम तुं कहे छे तेम ज छे. प्राणीओने देहाभिमान अज्ञानथी ज  
थयेल छे के जेथी आ पोतानो अने आ पारको ऐवी भेदभुद्धि थाय छे.<sup>२५-२६</sup>  
शोक, हर्ष, भय, द्वेष, लोभ, मोह अने मदवाणा देहाभिमानी लोको ‘ईश्वर ज  
पदार्थोनो परस्पर नाश करे छे’ ए वातने जाणता नथी, अने पोताने ज हणनार

तस्यां रात्र्यां व्यतीतायां कंस आहूय मन्त्रिणः । तेभ्य आचृष्टतत् सर्वं यदुक्तं योगनिद्रया ॥२९  
आकर्ण्य भर्तुर्गादितं तमूचुर्देवशत्रवः । देवान् प्रति कृतामर्षा दैतेया नातिकोविदाः ॥३०  
एवं चेत्तर्हि भोजेन्द्र पुरग्रामव्रजादिषु । अनिर्दशान् निर्दशांश्च हनिष्यामोऽद्य वै शिशून् ॥३१  
किमुद्यमैः करिष्यन्ति देवाः समरभीरवः । नित्यमुद्विग्नमनसो ज्याधोर्वैर्धनुषस्तव ॥३२  
अस्यतस्ते शरवातैर्हन्यमानाः समन्ततः । जिजीविषव उत्सृज्य पलायनपरा ययुः ॥३३

केचित् प्राज्ञलयो दीना न्यस्तशस्त्रा दिवौकसः ।

मुक्तकच्छशिखाः केचिद् भीताः स्म इति वादिनः ॥३४॥

न त्वं विस्मृतशस्त्रास्त्रान् विरथान् भयसंवृतान् । हंस्यन्यासक्तविमुखान् भग्नचापानयुध्यतः ॥

किं क्षेमशूरैर्विबुधैरसंयुगविकथनैः । रहोजुषा किं हरिणा शम्भुना वा वनौकसा ।

किमिन्द्रेणाल्पवीर्येण ब्रह्मणा वा तपस्यता ॥३६

अने हणायेलो माने छे.<sup>२७</sup> आ प्रमाणे प्रसन्न थयेलां देवकी अने वसुदेव द्वारा  
शुद्ध अंतःकरणाथी बोलावेलो कंस तेओनी आज्ञा लઈने पोताना धरमां गयो.<sup>२८</sup>

ऐ रात्री वीती गया पाई कंसे मंत्रीओने बोलावीने तेओने योगमायाए करेली  
सधणी वात कही संभणावी.<sup>२९</sup> पोताना स्वामी कंसनुं बोलतुं सांभणीने तेना  
मंत्री हैत्यो देवताओना शत्रु, देवताओ उपर को॒ष करनारा अने लांबा विचार  
वगरना हता तेथी तेओने कंसने कह्युं के हे यादवोना ईन्द्र ! जो एम होय तो  
पुर, गामडां अने प्रजादिकमां दश दिवसनी अंदरनां अने दश दिवस उपरांतनां  
जे जे बाणको जन्मेलां हशे तेओने आज ज अमे मारी नाखीशुं.<sup>३०-३१</sup> जे देवताओ  
युद्धमां बीकण अने तमारा धनुषनी दोरीना शब्दथी निरंतर उद्देग पाम्या करे

छे, तेओ उद्यमथी आपणने शुं करी शकवाना छे ? कांઈ पश करी शकवाना नथी.<sup>३२</sup>

तमे बाण फेंको छो त्यारे तमारं बाणथी चारे तरफ मार्या जता देवताओ ज्ञवानी  
ईच्छाथी युद्ध भूकीने भागी जाय छे.<sup>३३</sup> केटलाएक देवताओ हथियार भूकी दैर्यने  
रांकपणाथी हाथ जोडी उभा रहे छे, अने केटलाएक तो पोतानी काछीओ अने  
वाणने खुल्लां भूकीने तमारे शरणे आवे छे. अने अमो भयभीत छीअे, एम  
बोलवा लागे छे.<sup>३४</sup> जे ओ शख अस्त्रने भूली गया होय, रथ वगरना होय,  
भयथी घेराएला होय, बीजाओनी साथे युद्ध करता होय तथा जेओनां धनुष  
भांगी पड्यां होय अने युद्ध न करता होय तेओने तमे मारता नथी.<sup>३५</sup> निर्भय  
स्थानकमां शूरवीर अने युद्ध न होय त्यां बडाई हांकनारा देवताओथी, गुम  
रहेनार विष्णुथी, वनवासी शिवथी, अल्प पराक्रमवाणा ईन्द्रथी के तप कर्या

तथापि देवाः सापल्यान्नोपेक्ष्या इति मन्महे । ततस्तमूलखनने नियुद्धक्वास्माननुव्रतान् ॥३७  
यथाऽऽमयोऽङ्गे समुपेक्षितो नृभिर्न शक्यते रूढपदश्चिकित्सितुम् ।

यथेन्द्रियग्राम उपेक्षितस्तथा रिपुर्महान् बद्धबलो न चाल्यते ॥३८॥  
मूलं हि विष्णुर्देवानां यत्र धर्मः सनातनः । तस्य च ब्रह्मगोविप्रास्तपो यज्ञाः सदक्षिणाः ॥३९  
तस्मात् सर्वात्मना राजन् ! ब्राह्मणान् ब्रह्मावादिनः । तपस्विनो यज्ञशीलान् गाश्च हम्मो हर्विदुघाः  
विप्रा गावश्च वेदाश्च तपः सत्यं दमः शमः । श्रद्धा दया तितिक्षा च ऋतवश्च हरेस्तनूः ॥४१  
स हि सर्वसुराध्यक्षो ह्यसुरद्विद् गृहाशयः । तन्मूला देवताः सर्वाः सेश्वराः सचतुर्मुखाः ।

अयं वै तद्वधोपायो यदृषीणां विहिसनम् ॥४२  
श्रीशुक उवाच -

एवं दुर्मन्त्रिभिः कंसः सह सम्मन्य दुर्मतिः । ब्रह्महिंसां हितं मेने कालपाशावृतोऽसुरः ॥४३  
सन्दिश्य साधुलोकस्य कदने कदनप्रियान् । कामरूपधरान् दिक्षु दानवान् गृहमाविशत् ॥४४

करता ब्रह्माथी आपशाने शुं थवानुं छे ? तो पश अमे धारीअे छीअे के शत्रुपशाने  
लीधे देवताओनी उपेक्षा नहीं करवी जोईअे. ऐटला माटे जे अमो तमारा सेवक  
छीअे तेथी अमोने देवताओनुं भूण खोदी नाखवानी आज्ञा करो ॥४५-४६ जेम  
शरीरमां थयेला रोगनी उपेक्षा करतां ते जामी जाय तो पठी मनुष्योथी तेमनो  
उपाय थई शक्तो नथी अने जेम योगीओअे ईन्द्रियोनी उपेक्षा करी होय अर्थात्  
छूटी भूकी दीधी होय तो पठी तेनो निग्रह थई शक्तो नथी, तेम शत्रु पश बणवान  
थई जाय तो पठी तेने यत्यायमान करी शक्तो नथी ॥४७ देवताओनुं भूण विष्णु  
छे अने विष्णु, ज्यां सनातन धर्म होय त्यां रहे छे. अने ए धर्मनुं भूण वेद,  
गाय, ब्राह्मणो, तप, यज्ञ अने दक्षिणाओ छे ॥४८ माटे हे राजा ! सधणा उपायो  
करीने वेहिया, तपस्वी अने यज्ञ करनारा ब्राह्मणोने तथा यज्ञमां उपयोगी थाय  
अवां धी, दूध आटि आपनारी गायोने अमे मारी नाखीशु ॥४९ ब्राह्मण, गायो,  
वेद, तप, सत्य, ईन्द्रियोनो निग्रह, मननी शांति, श्रद्धा, दया, तितिक्षा अने  
यज्ञो विष्णुना शरीररूप छे ॥५० ए विष्णु ज सधणा देवताओनो स्वामी, हैत्योनो  
शत्रु अने गुम रहेनार छे. ब्रह्म अने सदाशिव सहित सर्व देवताओनुं भूण पश  
ए ज छे. माटे ब्राह्मण ऋषिओने मारवा ए ज विष्णुना वधनो उपाय छे ॥५१  
शुकुदेवज्ञ कुहे छे- पुत्रनो जन्म थवाथी आनन्द पामेला उदार मनना  
नंदराये तो स्नान करी, पवित्र थई, शशगार धरी, भविष्यवेता ब्राह्मणोने  
बोलावी पुत्रनुं स्वस्तिवायन करावीने ज्ञातकर्म संस्कार कराव्यो, अने पितृ तथा  
देवताओनुं पूजन कराव्यु ॥५२ ब्राह्मणोने शशगारेली बे लाख गायो अने रन  
समूह तथा सोनेरी वस्त्रोथी वीटेला सात तिलपर्वतो आप्या ॥५३ “पृथ्वी आटि  
पदार्थ काणथी पवित्र थाय छे, देहादिक स्नानथी, बीज्जु केटलीक वस्तु केवण  
धोवाथी पवित्र थाय छे, गर्भादिक संस्कारोथी पवित्र थाय छे. ईद्रियादिक तपथी,  
ब्राह्मणादिक यज्ञन करवाथी, धन दानथी, मन संतोषथी अने आत्मा ब्रह्मविद्याथी

ते वै रजःप्रकृतयस्तमसा मूढचेतेसः । सतां विद्वेषमाचेरुरारादागतमृत्यवः ॥४५  
आयुः श्रीयं यशो धर्मं लोकानाशिष एव च । हन्ति श्रेयांसि सर्वाणि पुंसो महदतिक्रमः ॥४६  
इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्दे पूर्वार्थ  
चतुर्थोऽद्यायः ॥४

अथ पञ्चमोऽद्यायः (५)

श्रीशुकउवाच -

नंदस्त्वात्मज उत्पन्ने जाताहादो महामनाः । आहूय विप्रान्वेदज्ञान् स्नातः शुचिरलंकृतः ॥१  
वाचयित्वा स्वस्त्ययनं जातकर्मात्मजस्य वै । कारयामास विधिवत् पितृदेवार्चनं तथा ॥२  
धेनूनां नियुते प्रादाद् विप्रेभ्यः समलंकृते । तिलाद्रीन् सप्त रत्नौधशातकौष्ठाप्तरावृतान् ॥३  
कालेन स्नानशौचाभ्यां संस्कारैस्तपसेज्यया । शुद्ध्यन्ति दानैः सन्तुष्ट्या द्रव्याण्यात्माऽऽस्त्विद्यया  
सौमज्जल्यगिरो विप्राः सूतमागधवन्दिनः । गायकाश्च जगर्नेदुर्भेद्यो दुन्दुभयो मुहुः ॥४५  
हतो एवा हैत्योने सर्व दिशाओमां साधुलोकोनो नाश करी नाखवानी आज्ञा करीने  
कंस पोताना धरमां गयो ॥४३-४४ २ ज्ञेगुणी स्वभाववाणा, तमोगुणाथी भूष  
भुद्धिवाणा अने जेओनुं भोत सभीपमां आव्युं हतुं एवा हैत्यो सत्पुरुषोनो देष  
करवा लाग्या ॥४५ महात्मा लोकोनो अपराध करवाथी पुरुषनां आयुष्य, लक्ष्मी,  
यश, धर्म, शुभलोक, सुख अने सर्व प्रकारना कल्याणनो नाश थाय छे ॥४६  
इति श्रीमद् महापुराण भागवतना दशम स्कन्दनो योथो अद्याय संपूर्णः

अद्याय ५

श्रीकृष्णाना जन्मथी नंदशुज्ञे करेलो भहोत्सव.

शुकुदेवज्ञ कुहे छे- पुत्रनो जन्म थवाथी आनन्द पामेला उदार मनना  
नंदराये तो स्नान करी, पवित्र थई, शशगार धरी, भविष्यवेता ब्राह्मणोने  
बोलावी पुत्रनुं स्वस्तिवायन करावीने ज्ञातकर्म संस्कार कराव्यो, अने पितृ तथा  
देवताओनुं पूजन कराव्यु ॥५२ ब्राह्मणोने शशगारेली बे लाख गायो अने रन  
समूह तथा सोनेरी वस्त्रोथी वीटेला सात तिलपर्वतो आप्या ॥५३ “पृथ्वी आटि  
पदार्थ काणथी पवित्र थाय छे, देहादिक स्नानथी, बीज्जु केटलीक वस्तु केवण  
धोवाथी पवित्र थाय छे, गर्भादिक संस्कारोथी पवित्र थाय छे. ईद्रियादिक तपथी,  
ब्राह्मणादिक यज्ञन करवाथी, धन दानथी, मन संतोषथी अने आत्मा ब्रह्मविद्याथी

व्रजः सम्मृष्टसंसिक्तद्वाराजिरगृहान्तरः । चित्रध्वजपताकास्वक्षेलपलवतोरणैः ॥६  
गावो वृषा वत्सतरा हरिद्रातैलस्त्रिता: । विचित्रधातुबर्हस्त्रवस्त्रकाञ्छनमालिनः ॥७  
महार्हवस्त्राभरणकञ्जुकोष्णीषभूषिता: । गोपाः समायू राजन् ! नानोपायनपाणयः ॥८  
गोप्यश्वाकर्ण्य मुदिता यशोदायाः सुतोद्भवम् । आत्मानं भूषयाञ्छ्रुवंस्त्राकल्पाज्जनादिभिः  
नवकुङ्कुमपकिञ्जलकुमुखपङ्कजभूतयः । बलिभिस्त्वरितं जग्मः पृथुश्रोणयश्वलत्कुचाः ॥९  
गोप्यः सुमृष्टमणिकुण्डलनिष्ककण्ठ्यश्विनाम्बराः पथि शिखाच्युतमाल्यवर्षाः ।  
नन्दालयं सवलया व्रजतीर्विरे जुव्यालोलकुण्डलपयोधरहारशोभाः ॥११  
ता अशिषः प्रयुज्जानाश्विरं पाहीति बालके । हरिद्राचूर्णतैलाद्विः सिञ्चन्त्यो जनमुज्जगुः ॥१२  
अवाद्यान्त विचित्राणि वादित्राणि महोत्पवे । कृष्णे विश्वेश्वरेऽनन्ते नन्दस्य व्रजमागते ॥१३  
गोपाः परस्परं हृष्ण दधिक्षीरघृताम्बुभिः । आसिञ्चन्तो विलिम्पन्तो नवनीतैश्च चिक्षिषुः ॥१४

पवित्र थाय छे.”<sup>४</sup> ब्राह्मणो, सूत, मागध अने बंदिजनो आशीर्वादनां वयन  
बोलवा लाग्या.<sup>५</sup> व्रजमां द्वार, आंगणां अने घरोना अंदरना भागो स्वर्यु  
करवामां आव्या अने जण छांटी दीधां. विचित्र धजा अने पताकाओनी हारो  
लगाववामां आवी. वस्त्रो अने पांडांनां तोरणोनी शोभा अतिशय वधारवामां  
आवी.<sup>६</sup> गायो, बणदो तथा नानां वाढरां अने तेल उणदर योपरी जुदा जुदा  
प्रकारना धातु, पुष्पनी माणा, वस्त्र तथा सुवर्णना अलंकारोथी शाशगारेला हता.<sup>७</sup>  
धशा मूल्यवाणां वस्त्र, आभूषण, कंचुक तथा पाघडीओथी शोभता गोवाणिया  
तरेह तरेहनी भेट लईने नंदरायने घेर आव्या.<sup>८</sup> यशोदाने पुत्र आव्यो सांभणी  
राज्ञ थयेली गोपीओ वस्त्र, आभूषण अने अंजन आदिथी पोतानां शरीरने  
शाशगारवा लागी.<sup>९</sup> नवीन केशर लागवाथी शोभतां भुजवाणी, मोटा  
नितंभवाणी अने हालता स्तनवाणी गोपीओ भेटो लईने उतावणथी नंदरायने  
घेर ज्वा लागी.<sup>१०</sup> जे गोपीओ ए कानमां स्वर्यु रत्न जीत कुङ्ण पहेर्याहतां,  
कंठमां हार धारण कर्या हता, हाथमां कंकण पहेर्याहतां, शरीरमां विचित्र वस्त्र  
पहेर्याहतां अने जे ओना योटलामांथी मार्गमां फूलपांखडीओनी वृष्टि थती हती,  
तेओ नंदरायने घेर जती समये हालतां कुङ्ण अने स्तन अने हारनी शोभाथी  
बहु ज दीपती हती.<sup>११</sup> “धशा काण सुधी रक्षा करो” ऐम बाणक्ने आशीर्वाद  
आपती अने उणदरनां चूर्ण तथा तेलवाणां पाणीथी लोकोने भींजावती ते गोपीओ  
गीत गाती हती.<sup>१२</sup> जगतना नाथ श्रीकृष्ण भगवान व्रजमां पधारतां ए  
महोत्सवमां विचित्र वाङ्मां वागतां हतां.<sup>१३</sup> राज्ञ थयेला अने एक बीजा उपर

नन्दो महामनास्तेभ्यो वासोऽलङ्कारगोधनम् । सूतमागधवद्विभ्यो येऽये विद्योपजीविनः ॥१५  
तैस्तैः कामैरदीनात्मा यथोचितमपूजयत् । विष्णोराराधनार्थाय स्वपुत्रस्योदयाय च ॥१६  
रोहिणी च महाभागा नन्दगोपाभिनन्दिता । व्यचरद् दिव्यवासः स्वक्षण्ठाभरणभूषिता ॥१७  
तत आरभ्य नन्दस्य व्रजः सर्वसमृद्धिमान् । हरेर्निवासात्मगुणै रमाक्रीडमभूत्रृप! ॥१८  
गोपान् गोकुलरक्षायां निरूप्य मथुरां गतः । नन्दः कंसस्य वार्षिक्यं करं दातुं कुरुद्वह ॥१९  
वसुदेव उपश्रुत्य भ्रातरं नन्दमागतम् । ज्ञात्वा दत्तकरं राजे ययौ तदवमोचनम् ॥२०  
तं दृष्ट्वा सहसोत्थाय देहः प्राणमिवागतम् । प्रीतः प्रियतमं दोर्भ्या सस्वजे प्रेमविह्वलः ॥२१  
पूजितः सुखमासीनः पृष्ट्वानामयमादृतः । प्रसक्तधीः स्वात्मजयोरिदमाहविशाम्यते! ॥२२  
दिष्ट्या भ्रातः प्रवयस इदानीमप्रजस्य ते । प्रजाशाया निवृत्तस्य प्रजा यत् समपद्यत ॥२३  
दिष्ट्या संसारचक्रेऽस्मिन् वर्तमानः पुनर्भवः । उपलब्धो भवानद्य दुर्लभं प्रियदर्शनम् ॥२४

धी दृध अने जण रेडता तथा माखणनुं लेपन करता गोवाणियाओ एक बीजा  
उपर दही नाखवा लाग्या.<sup>१५</sup> उदार मनना नंदराये सूत, मागध, बंदिजनो अने  
बीजा पण जे ओ विद्योपज्ञवी हता तेओने वस्त्र, अलंकार, गायो अने धन  
आप्यां.<sup>१६</sup> मोटा मनवाणा नंदराये विष्णुनी आराधनाने माटे अने पोताना  
कल्याण सारु यथायोग्य रीते धशा धशा पदार्थोथी सौनी पूजा करी.<sup>१७</sup> नंदराये  
मान आपेलां महाभाग्यशाणी रोहिणी दिव्यवस्त्र, माणा अने कंठना आभूषणोथी  
अलंकृत थृष्णने ए महोत्सवमां फृतां हतां.<sup>१८</sup> भगवानना जन्मथी आरंभीने  
नंदज्ञनो व्रज सर्वसमृद्धिओथी युक्त थयो हतो अने ए व्रज भगवानना निवासथी  
थयेला सर्वने प्रिय लागवुं, ए आदिक असाधारण गुणोथी लक्ष्मीज्ञने क्रीडा  
करवाना स्थणुरुप थयो हतो.<sup>१९</sup> पृष्ठी हे परीक्षित राजा! गोकुणनी रक्षा करवानी  
गोवाणियाओने भलामण आपी, नंदराय कंसने वार्षिक कर देवा सारु मथुरामां  
गया.<sup>२०</sup> कंसने आपेलो हे वार्षिक कर जे भाषो एवा पोताना परमभित्र नंदरायने  
आवेला जाणीने वसुदेव नंदज्ञना उतारे गया.<sup>२१</sup> प्राण आवतानी साथे जे भ देह  
उभो थाय, तेभ वसुदेवने आव्या जाणी तरत उभा थृष्णने प्रेमथी विष्णु थयेला  
नंदराये घ्यारा भित्र वसुदेवनुं आविंगन कर्य.<sup>२२</sup> पूजेला अने सारी रीते बेठेला  
अने जेनुं मन पोताना पुत्रोमां लागी रह्युं हतुं, एवा वसुदेवे आदरभावथी  
आरोग्य पूष्टी आ प्रमाणे कह्युं के हे भाई! वृद्ध, प्रजा रहित अने प्रजानी आशा  
पण छोडी दीधी हती एवा तमने हमणां पुत्र आव्यो ए धणुं सारु थयुं.<sup>२२-२३</sup>  
वणी ए पण बहु आनंदनी वात हे के आ संसारउपी यकमां रहेला तमे आज

नैकत्र प्रियसंवासः सुहृदं चित्रकर्मणाम् । ओघेन व्यूहामानानां प्लवानां स्नोतसो यथा ॥२५  
ब्रचित् पशव्यं निरुजं भूर्यम्बुतृणवीरुधम् । बृहद्वनं तदधुना यत्रासे त्वं सुहृद्वतः ॥२६  
भ्रातर्म सुतः कच्चन्मात्रा सह भवद्वजे । तातं भवन्तं मन्वानो भवद्भ्यामुपलालितः २७  
पुंसस्त्रिवर्गो विहितः सुहृदो ह्यनुभावितः । न तेषु क्लिश्यमानेषु त्रिवर्गोऽर्थाय कल्पते ॥२८  
अहो ते देवकी पुत्राः कंसेन बहवो हताः । एकावशिष्टावरजा कन्या सापि दिवं गता ॥२९  
नूनं हृष्टृष्टिष्ठोऽयमदृष्टपरमो जनः । अदृष्टमात्मनस्तत्त्वं यो वेद न स मुह्यति ॥३०

## वसुदेव उवाच

करो वै वार्षिको दत्तो राजे दृष्टा वर्यं च वः । नेह स्थेयं बहुतिथं सन्त्युत्याताश्च गोकुले ॥३१

## श्रीशुक उवाच -

इति नन्दादयो गोपाः प्रोक्तास्ते शौरिणा ययुः । अनोभिरनडुद्युक्तैस्तमनुजाप्य गोकुलम् ३२  
इति श्रीमद्वागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वर्धे  
नन्दवसुदेवसङ्गमो नाम पञ्चमो इद्यायः ॥५॥

इतीवार जन्मेला पुत्र जेवा ज्ञेवामां आव्या, खरेखर प्रियनुं दर्शनं हुर्लभं छे.<sup>२४</sup>  
पाणीना प्रवाहथी तथातां खड अने काष्ठ आदिनी स्थिति जेम एक ठेकाणे रहेती  
नथी, तेम विचित्र प्रारब्धवाणां संबंधीओनो प्रिय सहवास पाणे एक ठेकाणे  
रहेतो नथी.<sup>२५</sup> ज्यां तमे हमणां संबंधीओथी वीटाईने रह्या छो, ते खोटुं वन  
पशुओने हितकारी, रोग रहित अने जण, खड तथा लताओनी घणी संपत्तिवाणुं  
छे.<sup>२६</sup> हे भाई ! जे मारो पुत्र तेनी मानी साथे तमारा व्रजमां रह्यो छे अने तमने  
ज पिता करी माने छे तेने तमोमे सारी पेठे राख्यो छे ने ?<sup>२७</sup> पुरुषना धर्म, अर्थ  
अने काम जो पोताना संबंधीओने उपयोगी थाय तो ते सझण कहेवाय अने जो  
संबंधीओ कलेश पामतां होय तो ते धर्मादिक कशा उपयोगना नथी.<sup>२८</sup> नन्दराय  
कहे छे- अहो ! ! ! देवकीथी उत्पन्न थयेला तमारा घणा पुत्रो कंसे मारी नाख्या  
अने एक सौथी नानी दीकरी रही हती ते पाणे स्वर्गं गई !<sup>२९</sup> माशसोनी निष्ठा  
अवश्य भाग्य उपर ज छे. तेथी पोताना सुख हुः खनुं कारण भाग्य ज छे. एम  
जे समजे ते कोई रीते मुंजाय नहीं.<sup>३०</sup>

वसुदेव कहे छे- तमे प्रतिवर्ष आपवानो कर राज्ञे आपी दीधो अने अमोने  
पाणे मणी चूक्या छो. माटे हवे तमारे अहीं वधारे रहेवुं योग्य नथी, केमके  
गोकुणमां उत्पात थता हशे एम मानुं छुं.<sup>३१</sup> शुकुदेवजु कहे छे- आ प्रमाणे

## अथ षष्ठोऽध्यायः (६)

## श्रीशुक उवाच -

नंदः पथि वचः शौरेन्मृषेति विचिन्तयन् । हरिं जगाम शरणमुत्पातागमशङ्कितः ॥१  
कंसेन प्रहिता घोरा पूतना बालघातिनी । शिंशुश्चार निघन्ती पुरग्रामव्रजादिषु ॥२  
न यत्र श्रवणादीनि रक्षोच्चानि स्वकर्मसु । कुर्वन्ति सात्वतां भर्तुर्यातुधान्यश्च तत्र हि ॥३  
सा खेचर्येकदोपेत्य पूतना नन्दगोकुलम् । योषित्वा माययाऽत्मानं प्राविशत् कामचारिणी ४  
तां केशबन्धव्यतिष्ठकमळिकां बृहन्नितम्बस्तनकृच्छ्रमध्यमाम् ॥

सुवाससं कम्पितकर्णभूषणत्विषोळसत्कुन्तलमण्डिताननाम् ॥५॥

वल्लुस्मितापाङ्गविसर्गवीक्षितैर्मनो हरन्ती वनितां व्रजौकसाम् ।

अमंसताभ्योजकरेण रू पिणीं गोप्यं श्रियः द्रष्टुमिवागतां पतिम् ॥६॥

बालग्रहस्तत्र विचिन्वती शिशून् यदृच्छ्या नन्दगृहेऽसदन्तकम् ।

बालं प्रतिच्छन्निन्नोरुतेजसं ददर्श तत्पेऽग्निमिवाहितं भसि ॥७॥

वसुदेवनुं वयन सांभणी नंदादिक गोवाणो खण्डगाडां ज्ञेडी वसुदेवनी आज्ञा  
लई गोकुणमां गया.<sup>३२</sup>

इति श्रीमद्वागवतना दशम ऋक्यनो पांचमो अद्याय संपूर्ण.

## अध्याय ६

## श्रीकृष्णो डरेलो पुतनानो वध.

वसुदेवनुं वयन खोटुं न होय एम मार्गमां विचार करता अने उत्पात  
थवानी शंका राखता नंदराय भगवाननुं ध्यान करवा लाग्या.<sup>१</sup> कंसे भोक्लेली  
अने बाणकोने मारनारी पूतना, पुर, गामडां अने व्रजादिकमां बाणकोने मारती  
मारती फरती हती.<sup>२</sup> भगवद्गुणना श्रवण मननादिक ज्यां न होय ते स्थणमां राक्षसीओ पोतानुं  
काम करी शके छे.<sup>३</sup> आकाशमां फरनारी अने यथेष्ट रीते यालनारी पूतना एक  
दिवस नंदरायना व्रजमां आवीने मायाथी पोताना शरीरनो कोई उत्तम स्त्री  
जेवो वेष बनावी अंदर पेढी.<sup>४</sup> ऐना योटलामां भलिकानां कूल गूंथेलां हतां.  
मोटा नितंब अने स्तनना भारथी केड लयकी जती हती. उत्तम वस्त्र पहेर्य हतां,  
हालतां कुंडलनी कंतिने लीधे जणकता केशोथी मोहुं शोभी रह्युं हतुं.<sup>५</sup> सुंदर मंद  
हास्यथी युक्त अने नेत्रकटाक्षथी गोवाणोनां मन हराई गयां हतां, तेथी कोई

विवृद्ध्य तां बालकमारिकाग्रहं चराचरात्माऽऽस निमीलितेक्षणः ।  
अनन्तमारोपयदङ्गमन्तकं यथोरगं सुसमबुद्धिरज्जुधीः ॥८॥  
तां तीक्ष्णचित्तामितिवामचेष्टिं वीक्ष्यन्तरा कोशापरिच्छदासिवत् ।  
वरस्त्रियं तत्प्रभया च धर्षिते निरीक्षमाणे जननी ह्यतिष्ठताम् ॥९॥  
तस्मिन् स्तनं दुर्जरवीर्यमुल्बणं घोराङ्गमादाय शिशोर्ददावथ ।  
गाढं कराभ्यां भगवान् प्रपीड्य तत् प्राणौः समं रोषसमन्वितोऽपिबत् ॥१०॥  
सा मुञ्च मुञ्चालमिति प्रभाषिणी निष्पीड्यमानाखिलजीवमर्मणि ।  
विवृत्य नेत्रे चरणौ भुजौ मुहुः प्रस्विन्नगात्रा क्षिपती रुरोद ह ॥११॥  
तस्याः स्वनेनातिगमीररंहसा साक्रिमही द्यौश्च चचाल सग्रहा ।  
रसा दिशश्च प्रतिनेदिरे जनाः पेतुः क्षितौ वज्रनिपातशङ्क्या ॥१२॥

गोवाणो अे तेने अटकावी नहीं, अने हाथमां कमण छोवाथी ते भगवाननां दर्शन सारु देह धरीने आवेली लक्ष्मी जेवी लागती हती, तेथी गोपीओ पण चूप थई गई.<sup>६</sup> बाणकोने शोधती आवती बाणग्रहरूप पूतनाअे, यदेह्याथी नंदरायना धरमां स्वाभाविक मोटा तेजथी ढंकायेल छोवाथी राखथी ढंकायेला अग्निनी उपमा धरावनार अने दुष्ट प्राणीओना काणरूप ऐवा ते बाणकोने जोया.<sup>७</sup> स्थावर जंगमोना आत्मारूप श्रीकृष्ण भगवान, तेने बाणकोने मारनारी पूतना जाणीने नेत्र भींची गया, पछी मूर्ख माणस जेम दोरडी समज्जने सूतेला सर्पने लई ले, तेम ते पूतनाअे पोताना काणरूप भगवानने पोताना खोणामां लीधा.<sup>८</sup> भ्यानमां ढंकेली तलवारनी पेठे उपरथी कोमण अने अंदर बहु ज तीक्ष्ण अने भूंडां काम करनारी पूतनाने धरनी अंदर आवेली जोई तथा तेने उत्तम स्त्री जाणीने रोहिणी अने यशोदा पण तेनी कांतिथी मोह पाभी गयां हतां, तेओ डेवण ऊभां रही जोया करतां हतां.<sup>९</sup> ते स्थणमां दुष्ट पूतनाअे बाणक श्रीकृष्ण भगवानने खोणामां लई, तेमना मोढामां भयंकर अने न पये ऐवा झेरथी भरेलुं पोतानुं स्तन दीधुं. कोधवाणा भगवान अे स्तनने बे हाथवडे बहु ज दबावीने ते पूतनाना प्राणनी साथे पीवा लाग्या.<sup>१०</sup> सर्व अंगोमां पीडाती पूतना “मूकी दे मूकी दे” ऐम बोलवा लागी, आंखो फाटी गई, शरीरमां पसीनो वणी गयो, वारंवार हाथ अने पग पछाडती रोवा लागी.<sup>११</sup> अत्यंत गंभीर वेगवाणा ते पूतनाना शब्दथी पर्वत सहित पृथ्वी अने ग्रहो सहित आकाश यत्वायमान थई गयां. पाताण अने दिशाओमांथी पड्या पड्या अने वज्र पडवानी शंकाथी मनुष्यो धरती उपर पडी

निशाचरीत्थं व्यथितस्तना व्यसुव्यादाय केशांश्वरणौ भुजावपि ।  
प्रसार्य गोष्ठे निजरूपमास्थिता वज्राहतो वृत्र इवापतन्त्रप! ॥१३॥  
पतमानोऽपि तदेहस्त्रिगव्यूत्यन्तरद्वामान् । चूर्णयामास राजेन्द्र! महदासीतद्वृत्तम् ॥१४  
ईषामात्रोग्रदंष्ट्रास्यं गिरिकन्दरनासिकम् । गण्डशैलस्तनं रौद्रं प्रकीर्णारुणमूर्धजम् ॥१५  
अन्धकूपगभीराक्षं पुलिनारोहभीषणम् । बद्धसेतुभुजोवद्विश्च शून्यतोयह्वोदरम् ॥१६  
सन्तत्रसुः स्म तद् वीक्ष्य गोपा गोप्यः कलेवरम् । पूर्वं तु तन्निःस्वनितभिन्नहृत्कर्णमस्तकाः ॥७  
बालं च तस्या उरसि त्रीडन्तमकुतोभयम् । गोप्यस्तूर्ण समभ्येत्य जगृहृजातसम्भ्रमाः ॥१८  
यशोदारोहिणीभ्यां ताः समं बालस्य सर्वतः । रक्षां विदधिरे सम्यगोपुच्छभ्रमणादिभिः ॥९  
गोमूरेण स्नापयित्वा पुनर्गोरजसार्थकम् । रक्षां चक्रुश्च शकृता द्वादशाङ्गेषु नामभिः ॥२०  
गोप्यः संस्पृष्टमलिला अङ्गेषु करयोः पृथक् । न्यस्यात्मन्यथ बालस्य बीजन्यासमकुर्वत ॥२१  
अव्यादजोऽङ्गिष्ठिमणिमांस्तव जान्वथोरु यज्ञोऽच्युतः कटितटं जठरं हयास्यः ।  
हृत् केशवस्त्वदुर इश इनस्तु कण्ठं विष्णुर्भुजं मुखमुरुक्रम ईश्वरः कम् ॥२२॥

गयां.<sup>१२</sup> आ प्रमाणे स्तनमां व्यथा थतां भरण समये पोतानुं प्रथमनुं रूप धरीने ए राक्षसी वज्री भरण पामेला वृत्रासुरनी पेठे प्रज्ञमां पडी. भरण पामेली ए राक्षसीनुं मोहुं फाटी गयुं हतुं. केश धूटी गया अने पग तथा हाथ लांबा थई गया हता.<sup>१३</sup> हे परीक्षित राजा! ए पूतनानो देह पडतां पडतां छ गाउनी अंदरनां वृक्षोनो भूको करी नाघ्यो, आवुं एक मोहुं आश्र्य थयुं.<sup>१४</sup> ए भयंकर पूतनाना मोढामां हणना जेवी लांबी अने उत्र दाढो हती, नाक पर्वतनी गुफा जेवुं हतुं, स्तन पर्वतमांथी पडेला मोटा पथरा जेवडा हता, केश वीभरायेला अने राता हता.<sup>१५</sup> आंघो अंधारा कूवा जेवी उंडी हती, नितं भ नदीना कांठा जेवा भयंकर हता, हाथ, साथण अने पग जाणे सडक आंधी होय ऐवा हता, पेट पाणी वगरना धरा जेवुं हतुं.<sup>१६</sup> गोवाणिया अने गोपीओनां हृदय, कान अने माथां प्रथम ज पूतनाना शब्दथी जाणे फाटी गयां होय तेवां थई गयां हतां ऐवी पूतनाना शरीरने जोई त्रास पाभ्या.<sup>१७</sup> गोपीओ ए घणा संभमथी तुरत आवीने पूतनानी छाती उपर निर्भय रीते रमता बाणक ऐवा भगवानने तेडी लीधा.<sup>१८</sup> यशोदा अने रोहिणीनी साथे ते सधणी गोपीओ ए ते बाणक उपर गायनां पूँछ फेरवा आटि कियाओथी सारी रीते रक्षा करी.<sup>१९</sup> बाणकने गोमूत्रथी, गायनी रज्ञी अने गायनां छाणथी नवरावी, तेनां बार अंगोमां भगवाननां नामोथी रक्षा करी.<sup>२०</sup> पछी कांडक धारणा भणतां गोपीओ ए आयमन लई ने पोताना शरीरमां

चक्रग्रहतः सहगदो हरिरस्तु पश्चात् त्वत्याश्वयोर्धनुरसी मधुहाजनश्च ।  
कोणेषु शङ्खे उरुगाय उपर्युपेन्द्रस्ताक्षर्यः क्षितौ हलधरः पुरुषः समन्तात् ॥२३॥  
इन्द्रियाणि हृषीकेशः प्राणान् नारायणोऽवतु । श्वेतद्वीपपतिश्चित्तं मनो योगेश्वरोऽवतु ॥२४  
पृथिनगर्भस्तु ते बुद्धिमात्मानं भगवान् परः । क्रीडन्तं पातु गोविन्दः शयानं पातु माधवः २५  
ब्रजन्तमव्याद् वैकुण्ठ आसीनं त्वां श्रियः पतिः । भुज्जानं यज्ञभुक् पातु सर्वग्रहभयङ्कः २६  
डाकिन्यो यातुधान्यश्च कूष्माण्डा येऽर्भकग्रहाः । भूतप्रेतपिशाचाश्च यक्षरक्षेविनायकाः २७  
कोटरा रेवती ज्येष्ठा पूतना मातृकादयः । उन्मादा ये ह्यप्रस्मारा देहप्राणेन्द्रियद्रुहः ॥२८  
स्वजनदृष्टा महोत्पाता वृद्धबालग्रहाश्च ये । सर्वे नश्यन्तु ते विष्णोर्नामग्रहणभीरवः ॥२९  
श्रीशुक उवाच -

इति प्रणयबद्धाभिर्गोपीभिः कृतरक्षणम् । पाययित्वा स्तनं माता संन्यवेशयदात्मजम् ॥३०

प्रथम अंगन्यास तथा करन्यास पृथक् पृथक् करीने पैषी बाणकना अंगमां पशा  
बीजन्यास कर्योः.<sup>२१</sup> अज भगवान तारा पगनी, मणिमान् तारा गोठणी,  
यज्ञनारायण तारा साथणी, अच्युत कटिनी, हयथीव पेटनी, केशव हृदयनी,  
ईश तारा वक्षस्थणी, ईन्द्र कंठनी, विष्णु भुज्ञाओनी, उरुकम भुखनी अने  
ईश्वर मस्तकनी रक्षा करज्जो.<sup>२२</sup> यक्ष धरनारा भगवान तारी आगण रहेज्जो,  
गदा धरनारा भगवान तारी पाइण रहेज्जो, धनुष धरनारा मधुष भगवान  
अने खड्ग धरनारा अजन भगवान तारां बे पडभामां रहेज्जो, शंभ धरनारा  
उरुगाय भगवान तारा यारे खूणामां रहेज्जो, उपेन्द्र भगवान उपर रहेज्जो,  
ताक्षर्य भगवान नीये रहेज्जो, हणधर भगवान सधणी कोर रहेज्जो.<sup>२३</sup> ऋषिकेश  
भगवान ईन्द्रियोनी रक्षा करज्जो, नारायण प्राणानी रक्षा करज्जो, श्वेतद्वीपपति  
भगवान चितानुं रक्षण करज्जो, योगेश्वर भगवान मनानुं रक्षण करज्जो.<sup>२४</sup>  
पृथिनगर्भ भगवान तारी बुद्धिनी अने पर भगवान तारा अहंकारनी रक्षा  
करज्जो, रमनां गोविंद भगवान, सूतां माधव भगवान, चालतां वैकुण्ठ भगवान,  
बेसतां लक्ष्मीना पति, अने जमतां यशभोक्ता भगवान तारी रक्षा करज्जो, के जे  
सर्व ग्रहोने त्रास उपजावे एवा छे.<sup>२५-२६</sup> डाकणो, राक्षसीओ, कुष्मांड, बाणग्रह,  
भूत, प्रेत, पिशाच, यक्ष, राक्षस, विनायक, कोटरा, रेवती, ज्येष्ठा, पूतना,  
मातृकादिक, उन्माद, अपस्मार अने बीजा पशा जे ओ देह, प्राण तथा ईन्द्रियोनो  
द्रोह करनारा छे तेओ सधणा नाश पामज्जो. स्वप्रमां देखेला मोटा उत्पात अने  
वृद्ध तथा बाणकना ग्रहो, के जे ओ विष्णुनुं नाम लेवाथी भी अे छे, तेओ सधणा

तावन्नन्दादयो गोपा मथुराया व्रजं गताः । विलोक्य पूतनादेहं बभूवुरतिविस्मिताः ॥३१  
नूनं बर्तर्षिः संजातो योगेशो वा समास सः । स एव दृष्टे हृत्पातो यदाहानकदुन्दुभिः ॥३२  
कलेवरं परशुभिश्चित्त्वा तत्ते व्रजौकसः । दूरे क्षिप्त्वावयवशो न्यदहन् काष्ठधिष्ठितम् ॥३३  
दह्यमानस्य देहस्य धूमश्चागुरुसौरभः । उत्थितः कृष्णनिर्भुक्तसपद्याहतपाप्ननः ॥३४  
पूतना लोकबालघी राक्षसी रुधिराशना । जिघांसयापि हरये स्तनं दत्त्वाऽप्य सद्गतिम् ३५  
किं पुनः श्रद्धया भक्त्या कृष्णाय परमात्मने । यच्छ्न् प्रियतमं किं नु रक्तास्तन्मातरो यथा ३६  
पद्भ्यां भक्तहृदिस्थाभ्यां वन्द्याभ्यां लोकवन्दितैः । अङ्गं यस्याः समाक्रम्य भगवानपिबत् स्तनम्  
यातुधान्यपि सा स्वर्वमवाप जननीगतिम् । कृष्णभुक्तस्तनक्षीराः किमु गावो नु मातरः ३८  
पर्यांसि यासामपिबत् पुत्रस्नेहस्तुतान्यलम् । भगवान् देवकीपुत्रः कैवल्याद्यखिलप्रदः ॥३९  
तासामविरतं कृष्णे कुर्वतीनां सुतेक्षणम् । न पुनः कल्पते राजन् संसारोऽज्ञानसम्भवः ॥४०

तारी पासेथी जता रहेज्जो. <sup>२७-२८</sup> आ प्रमाणे स्नेहथी बंधाअेली गोपीओ अे जेनी  
रक्षा करी, अेवा पुत्रने यशोदाअे स्तनपान करावीने सुवाइया. <sup>२९</sup> तेटलामां  
मथुराथी व्रजमां आवेला नंदादिक गोवाणियाओ पूतनाना शबने ज्ञेईने बहु ज  
विस्मय पाभ्या अने कहेवा लाग्या के वसुदेव तो अवश्य ऋषि के योगेश्वर जन्मेल  
छे. तेमके, तेमणे जेवुं कहुं हतुं तेवो ज उत्पात जेवामां आय्यो. <sup>३१-३२</sup> पैषी ते  
गोवाणो अे पूतनाना शरीरने कुहाडाओथी कापी, सधणा अवयवोने दूर इंकी,  
बाकीना भागने लाकडांओमां नाभीने बाणी नाख्यो. <sup>३३</sup> भगवाने उपभोग कर्यो  
होवाथी जेनां पाप तुरत नाश पामी गयां, एवो अे पूतनानो देह बणतां तेमांथी  
अगरुना जेवो सुगंधी धुमाडो नीकण्यो. <sup>३४</sup> बाणकोने हाशनारी अने रुधिरनुं भक्षण  
करनारी पूतना मारी नाखवानी ईर्ष्याथी पशा भगवानने धवरावीने मुक्तिपामी  
गर्छ, तो पैषी श्रद्धाथी अने भक्तिथी श्रीकृष्ण भगवानने प्रिय वस्तुनुं अर्पण  
करनारो माणस मोक्ष पामे तेमां तो कहेवुं ज शुं? जे गायो वन्साहरणानी लीलामां  
भगवाननी माताओ थैह उत्ती तेओ पशा मुक्तिपामी छे. <sup>३५-३६</sup> भक्तोना हृदयमां  
रहेनार अने लोकवन्दित देवताओ अे पशा वंदन करवा योऽय, एवां यरणाथी जे  
पूतनाना अंगने दबावीने भगवाने स्तनपान कर्यु, ते राक्षसी पूतना पशा तेमनी  
माने लायक गतिने पामी गर्छ, त्यारे गायो अने गोपीओ के जे ओना दूधने  
भगवान पीता हता तेओ ने सद्गतिनी प्राप्ति थाय तेमां शुं कहेवुं? <sup>३७-३८</sup> पुत्रना  
स्नेहने लीये पानो आववाथी बहु ज झरतां जे माताओना दूधने देवकीना पुत्र  
अने मोक्षादिक सर्व पुरुषार्थ आपनारा भगवाने पीधां, ते माताओ के जे ओ

कटधूमस्य सौरभ्यमवद्याय व्रजौकसः । किमिदं कुत एवेति वदन्तो व्रजमाययुः ॥४१  
ते त्र वर्णितं गोपैः पूतनागमनादिकम् । श्रुत्वा तत्रिधनं स्वस्ति शिशोश्चासन् सुविस्मिताः ॥  
नन्दः स्वपुत्रमादाय प्रेत्यागतमुदारधीः । मूर्ध्युपाद्याय परमां मुदं लेभे कुरुद्वह! ॥४३  
य एतत् पूतनामोक्षं कृष्णस्यार्थकमद्वत्तम् । शृणुयाच्छ्वद्या मत्त्वो गोविन्दे लभते रतिम् ॥४४  
इति श्रीमद्बागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्दे पूर्वर्थं  
षष्ठेऽध्यायः ॥६॥

### अथ सप्तमोऽध्यायः (७)

#### राजोवाच

येन येनावतरेण भगवान् हरिगीश्वरः । करोति कर्णग्रस्याणि मनोज्ञानि च नः प्रभो! ॥१  
यच्छृणवतोऽपैत्यरतिर्वितृष्णा सत्वं च शुद्ध्यत्यच्चिरेण पुंसः ।  
भक्तिर्हरौ तत्पुरुषे च सख्यं तदेव हारं वद मन्यसे चेत् ॥२॥

निरंतर भगवानमां पुत्र दृष्टि राखती हती, ते माताओने अज्ञानथी थतो संसारनो  
इरो बीज्ञवार थवो न ४ संभवे.<sup>३५-४०</sup> जे व्रजवासीओ पूतनाना आव्या पहेलां  
गायो चारवा नीकणीगया हता, ते व्रजवासीओ शबना धुमाडाना सुंगंधने सुंधी  
‘आ शुं अने शाथी थयुं?’ ऐम बोलता व्रजमां आव्या.<sup>४१</sup> ते ओ व्रजमां गोवाणोना  
कहेवाथी पूतनानुं आववुं अने तेनुं मरण अने तेथी बाणकनुं कुशण रहेवुं,  
सांभणीने बहु ४ विस्मय पाभ्या.<sup>४२</sup> हे राजा! उदार बुद्धिवाणा नंदराय, जाणे  
मरी जैने पाणा आवेल होय ऐवा पोताना पुत्रने तेडी, तेनुं माथुं सुंधी, परम  
आनंद पाभ्या.<sup>४३</sup> जे माणस पूतनाने भोक्ष आपवारुप आ श्रीकृष्णनां अद्भुत  
बाणयरित्रने श्रद्धाथी सांभणशी तेने भगवानमां प्रीति प्राप्त थशे.<sup>४४</sup>  
इति श्रीमद् महापुराणा भागवतना दशम स्कन्दनो छह्ये अद्यायाय संपूर्णा.

#### अद्याय ७

श्रीकृष्णो गाङ्गुं ऊंधुं पाडच्युं तथा तृक्तावर्तनो नाश कर्यों।

परीक्षित राजा कहे छे हे महाराज! जो के भगवान जे जे अवतारथी जे जे  
यरित्र करे छे ते सधणां अमारा कानने अने मनने गमे छे, तो पष्ण यरित्रोने  
सांभणवाथी पुरुषने मननी ग्वानि तथा अनेक प्रकारनी तृष्णा मटी जाय अने  
थोडा काणमां अंतःकरण शुद्ध थाय, भगवानमां प्रीति थाय अने वैष्णवज्ञन साथे

अथान्यदपि कृष्णस्य तोकाचरितमद्वत्तम् । मानुषं लोकमासाद्य तज्जातिमनुरूप्तः ॥३  
श्रीशुक उवाच -

कदाचिदौत्थानिककौतुकाप्लवे जन्मक्षयोगे समवेतयोषिताम् ।  
वादित्रिगीतद्विजमन्त्रवाचकैश्कार सूनोरभिषेचनं सती ॥४॥  
नन्दस्य पत्नी कृतमज्जनादिकं विप्रैः कृतस्वस्त्ययनं सुपूजितैः ।  
अन्नाद्यवासःस्वगभीष्टधेनुभिः संजातनिद्राक्षमशीशयच्छनैः ॥५॥  
औत्थानिकौत्सुक्यमना मनस्विनी समागतान् पूजयती व्रजौकसः ।  
नैवाशृणोद् वै रुदितं सुतस्य सा रुदन् स्तनार्थी चरणावुदक्षिपत् ॥६॥  
अथः शयानस्य शिशोरेनोऽल्पकप्रवालमृद्विग्रहतं व्यवर्तत ।  
विध्वस्तनानारसकुप्यभाजनं व्यत्यस्तचक्राक्षविभिन्नकूबरम् ॥७॥  
दृष्ट्वा यशोदाप्रमुखा व्रजस्त्रिय औत्थानिके कर्मणि या: समागताः ।  
नन्दादयश्चाद्वतदर्शनाकुलाः कथं स्वयं वै शकटं विपर्यगात् ॥  
इति ब्रुवन्तोऽतिविवादमोहिता जनाः समन्तात् परिवव्रात्वत् ॥८॥

मैत्री थाय. आवुं मनोहर यरित्रने कहेवुं, जो तमे ईष्ट मानता हो तो कहो.<sup>१-२</sup>  
अने मनुष्य देह धरीने मनुष्य जातिने अनुसरनारा श्रीकृष्ण भगवाननुं बीजुं  
पष्ण अद्भुत बाण यरित्र कहो.<sup>३</sup>

शुकदेवज्ञ कहे छे ऐक दिवसे भगवान पदभुं फेरववा शीघ्र्या तेना उत्सवनो  
अभिषेक करवानो हतो, अने ते ४ दिवसे भगवानना जन्म नक्षत्रनो पश योग  
हतो, तेथी ऐ भोटा समारंभमां भणेली स्त्रीओनी वयमां यशोदाए वाज्ञं, गीत  
अने ब्राह्मणोना मंत्र सहित स्वस्तिवाचनथी पोताना पुत्रनो अभिषेक कर्यो.<sup>४</sup>  
भगवानने नवराव्या अने अन्न, वस्त्र, माणाओ, प्रिय वस्तु तथा गायो आपीने  
पूजेला ब्राह्मणो पासे स्वस्तिवाचन कराव्युं. पष्ठी भगवाननी आंघोमां निद्रा  
आवती जाणीने तेमने यशोदाए धीरेथी ऐक गाडानी नीये जोणीमां पोढाइया.<sup>५</sup>  
उत्सव संबंधी उत्साहमां ४ यशोदानुं मन लागी रह्युं हतुं, अने ते आ उत्सवमां  
आवेला व्रजवासीओनुं सन्मान करतां हतां तेथी यशोदाज्ञाए पुत्रनुं रुदन सांभण्युं  
नहीं अने भगवाने धाववानी ईच्छाथी रोतां रोतां पोताना पग उंचा कर्या.<sup>६</sup>  
नीये सूतेला बाणकना नाना अने झूपणियां सरभा कूणा पग वागवाथी गाङ्गुं  
ऊंधुं वणी गयुं. अनेक प्रकारना रसोथी भरेलां कांसा आदि धातुओनां पात्रों, के  
जे ओ गाडा उपर हतां ते भांगी पडयां अने पैडां धरी तथा धोंसरुं पष्ण वीभाई  
गयां अने उंधां पडयां.<sup>७</sup> पदभुं फेरववाना उत्सवमां भणेली यशोदा आदि स्त्रीओ

ऊचुरव्यवसितमतीन् गोपान् गोपीश्च बालकः । रुदतानेन पादेन क्षिप्रमेतत्र संशयः ॥९  
 न ते श्रद्धधिरे गोपा बालभाषितमित्युत । अप्रमेयं बलं तस्य बालकस्य न ते विदुः ॥१०  
 रुदन्तं सुतमादाय यशोदा ग्रहणश्चित्ता । कृतस्वस्त्ययनं विप्रैः सूक्तैः स्तनमपाययत् ॥११  
 पूर्ववत् स्थापितं गोपैर्बलिभिः सपरिच्छदम् । विप्रा हुत्वाऽर्चयाञ्चकुर्दध्यक्षतकुशाम्बुभिः ॥१२  
 येऽसूयानृतदध्मेष्याहिंसामानविर्जिताः । न तेषां सत्यशीलानामाशिषो विफलाः कृताः ॥१३  
 इति बालकमादाय सामर्ग्यजुरुपाकृतैः । जलैः पवित्रौषधिभिरभिषिद्य द्विजोत्तमैः ॥१४  
 वाचयित्वा स्वस्त्ययनं नन्दगोपः समाहितः । हुत्वा चारिन्द्रिजातिभ्यः प्रादादन्नं महागुणम् ।  
 गावः सर्वगुणोपेता वासः स्वगुकममालिनीः । आत्मजाऽभ्युदयार्थाय प्रादाते चान्वयुज्जत ॥१५  
 विप्रा मन्त्रविदो युक्तास्तर्याः प्रोक्तास्तथाऽशिषः । ता निष्कला भविष्यन्ति न कदाचिदपि स्फुटम्  
 एकदाऽरोहमारुढं लालयन्ती सुतं सती । गरिमाणं शिशोर्वोहुं न सेहे गिरिकूटवत् ॥१६

अने नंदादिक गोवाणो अद्भुत बनाव जोઈने व्याकुण थई गया अने कहेवा  
 लाया के 'गाँडुं पोतानी मेणे केम उंधुं वध्युं ? अेम कहेता अने विवादथी मोह  
 पामेला सधणा गाडांने योमेर टोणुं वणीने उभा.'<sup>१</sup> जेओने निश्चय थयो नहीं  
 एवा गोवणिया अने गोपीओने छोकराओअे कहुं के आ बाणके रोतां रोतां  
 पोताना पगथी गाँडुं उंधुं नाख्युं छे, अेमां कशो संशय नथी.<sup>२</sup> परंतु गोवणिया  
 ओअे छोकरांवादमां गणीने तेओनी वात साची मानी नहीं; केमके ए बाणकना  
 अपार बणनुं तेओने शान न हतुं.<sup>३</sup> यशोदाए दुष्ट ग्रहोनी शंकाथी ए रुदन  
 करता पुत्रने तेडी लईने ब्राह्मणो पासे वेदमंत्रथी स्वस्तिवाचन कराव्युं अने पछी  
 स्तनपान कराव्युं.<sup>४</sup> बणवान गोवाणोए सरसामान सहित ए गाडाने पाइं  
 सवणुं कर्युं. अने ब्राह्मणोए ग्रहादिकना होम करीने दहीं तथा जणथी पूजन  
 कर्युं.<sup>५</sup> जेओ असूया, (गुणमां दोष प्रकट करवा) खोटुं भाषण, दंभ, ईर्ष्या,  
 हिंसा अने अभिमानथी रहित तथा सत्य स्वभाववाणा होय छे, तेओअे आपेला  
 आशीर्वाद वर्थ थाय ज नहीं.<sup>६</sup> अेम धारी सावधान मनवाणा नंदराये उत्तम  
 ब्राह्मणोनी पासे सामवेद, ऋवेद तथा यजुर्वेदना मंत्रोथी संस्कार पमाडेला अने  
 पवित्र औषधिवाणा जणथी पुत्रनो अभिषेक तथा स्वस्तिवाचन कराव्यां.<sup>७</sup> पछी  
 अग्निमां होम करावीने नंदराये उत्तम गुणवाणुं अन्न ब्राह्मणोने जमाइयुं.<sup>८</sup>  
 सधणा गुणवाणी अने वस्त्र, पुण्यनी माणा तथा सोनानी माणवाणी गायो पुत्रना  
 कल्याणने अर्थे ब्राह्मणोने आपी. अने ब्राह्मणोए आशीर्वाद दीधा.<sup>९</sup> मंत्र  
 जागनारा योऽय ब्राह्मणोए जे आशीर्वाद आप्या होय ते ते प्रमाणे ज थाय, कटी

भूमौ निधाय तं गोपी विस्मिता भारपीडिता । महापुरुषमादध्यौ जगतामास कर्मसु ॥१९  
 दैत्यो नामा तृणावर्तः कंसभृत्यः प्रणोदितः । चक्रवातस्वरूपेण जहारासीनमर्भकम् ॥२०  
 गोकुलं सर्वमावृण्वन् मुष्णंश्वक्षूषिं रेणुभिः । ईर्यन् सुमहाघोरशब्देन प्रदिशो दिशः ॥२१  
 मुहूर्तमभवद् गोष्ठं रजसा तमसाऽवृतम् । सुतं यशोदा नापश्यत्तस्मिन् न्यस्तवती यथः ॥२२  
 नापश्यत् कश्चनात्मानं परं चापि विमोहितः । तृणावर्तनिसृष्टिभिः शर्कराभिरुपद्रुतः ॥२३

इति खरपवनचक्रपांसुवर्षे सुतपदवीमबलाऽविलक्ष्य माता ।

अतिकरुणमनुस्मरन्त्यशोचद् भुवि पतिता मृतवत्सका यथा गौः ॥२४॥

रुदितमनुनिश्च्य तत्र गोप्यो भृशमनुतसधियोऽश्रुपूर्णमुख्यः ।

रुरुदुरनुपलभ्य नन्दसूनुं पवन उपारतपांसुवर्षवेगे ॥२५॥

तृणावर्तः शान्तरयो वात्यास्तपथरो हरन् । कृष्णं नभोगतो गन्तुं नाशक्नोद् भूरिभारभृत् २६  
 तमशमानं मन्यमान आत्मनो गुरुमत्तया । गले गृहीत उत्त्रष्ठुं नाशक्नोदद्रुतार्भकम् ॥२७

पश वर्थ थाय ज नहीं.<sup>१०</sup> एक द्विवस खोणामां लईने पुत्रने रमाडतां यशोदा,

पुत्रनो पर्वतना शिखर सरभो भार लायो तेने सहन करी शक्यां नहीं.<sup>११</sup>

श्रीकृष्णमां रहेला ब्रह्मांडना भारथी पीडाएलां अने विस्मय पामेलां यशोदा पुत्रने

पृथ्वी उपर भूमी दृष्टे, परमेश्वरनुं ध्यान करतां व्यवहारना काममां लागी

गयां.<sup>१२</sup> कंसनो चाकर अने कंसे मोकलेलो तृष्णावर्तनामनो देत्य वंटोणिया वायुना

स्वरूपथी आवीने पृथ्वी उपर बेठेला बाणक भगवानने हरी गयो.<sup>१३</sup> ए

वंटोणियाथी सधणुं गोकुण धेराई गयुं, धूणथी सर्वनां नेत्रो आंधणां जेवां थई

गयां, भयंकर शज्जनी दिशा अने खूणाओ गाजवा लाया.<sup>१४</sup> ऐ घडीवार सुधी

सधणुं गोकुण धूणथी अने अंधाराथी धेरायेलुं रह्युं. यशोदा आवीने जुआ छे तो

ज्यां पुत्रने भूक्या हता त्यां दीठा नहीं.<sup>१५</sup> तृष्णावर्ते उडाडेली धूणथी उपद्रव अने

मोह थवाने लीघे कोई माणस पोताना शरीरने के भीज्ञने जोઈ पश शक्तो न

हतो.<sup>१६</sup> आ प्रमाणे कठोर वंटोणियाथी धूणनो वरसाद थतां पुत्रनो पतो नहीं

मणवाथी पृथ्वी पर पडी गयेलां अने पुत्रने संभारतां अभणा यशोदामाता जेनो

वाइडो मरी गयो होय, एवी गायनी पेडे दयामणी रीते शोक करवा लायां.<sup>१७</sup>

पवनथी थयेली धूणनी वृष्टिनो वेग बंध पडया पछी, यशोदानुं रोवुं सांभणीने

भडु ज संताप पामेली अने आंसुथी जेओनां मोढां भराई २ह्यां छे, एवी गोपीओ

ते ज्यांये भगवानने नहीं देखीने रोवा लागी.<sup>१८</sup> आ बाजू वंटोणियानुं रुप

धरनार तृष्णावर्त देत्य भगवानने हरीने आकाशमां जतां धणो भार लागवाथी

गलग्रहणनिश्चेष्टे दैत्यो निर्गतलोचनः । अव्यक्तरावो न्यपतत् सहबालो व्यसुर्वजे ॥२८  
 तमन्तरिक्षात् पतितं शिलायां विशीर्णसर्वावयवं करालम् ।  
 पुरं यथा रुद्रशरेण विद्धं स्त्रियो रुदत्यो ददृशुः समेताः ॥२९॥  
 प्रादाय मात्रे प्रतिहृत्य विस्मिताः कृष्णं च तस्योरसि लम्बमानम् ।  
 तं स्वस्तिमन्तं पुरुषादनीतं विहायसा मृत्युमुखात् प्रमुक्तम् ।  
 गोप्यश्च गोपाः किल नन्दमुख्या लब्ध्वा पुनः प्रापुरतीव मोदम् ॥३०॥  
 अहो बतात्यद्भुतमेष रक्षसा बालो निवृत्तिं गमितोऽभ्यगात् पुनः ।  
 हिंसः स्वपापेन विहिंसितः खलः साधुः समत्वेन भयाद् विमुच्यते ॥३१॥  
 किं नस्तपशीर्णमधोक्षजार्चनं पूर्तेष्टदत्तमुत भूतसौहृदम् ।  
 यत्संपरेतः पुनरेव बालको दिष्ट्या स्वबन्धून् प्रणयन्नुपस्थितः ॥३२॥  
 दृष्ट्वाऽद्भुतानि बहुशो नन्दगोपो बृहद्वन्ने । वसुदेववचो भूयो मानयामास विस्मितः ॥३३

तेनो वेग शांत थृष्ट गयो अने पोते उंचो जृष्ट शक्यो नहीं.<sup>२६</sup> पोताने भार लागवाथी तृष्णावर्ते अम मान्युं के हुं आ कोई पथराने उपाडी आव्यो छुं, तेथी ते अद्भुत बाणकने ते भूकी देवा लाग्यो, पण भगवान तेने गणे बाझी रह्या, तेथी भूकी शक्यो नहीं.<sup>२७</sup> गणुं पकडायाथी येद्या रहित थयेलो अने पूरी यीस पण नहीं नाखी शक्तो ते दैत्य, अंभो नीकणी पडतां भरणा पामीने ब्रजमां पड्यो.<sup>२८</sup> अंतरिक्षमांथी शिला उपर पडेलो ते विकराण दैत्य, के जेना सधणा अवयवो रुद्रना भाषाथी वींधाअेला त्राण पुरनी पेठे वींभाई गया हता, आवा दैत्यने, रोती अने भेणी थयेली स्त्रीओओ दीठो.<sup>२९</sup> राक्षस आकाश मार्गमां लृष्ट गयो तोपण मृत्युना मुख्यी धूटेला, कुशण अने ते राक्षसनी छाती उपर लटकता, श्रीकृष्णने तेढी लृष्ट यशोदाने आपी सधणी गोपीओ विस्मय पामी गृष्ट.<sup>३०</sup> जेओना भनोरथ पूर्णथया एवा नंदादिक गोवाणो अने गोपीओ बहु ज आनंद पाम्यां अने परस्पर बोलवा लाग्या के राक्षसे मारी नाखेलो आ बाणक पाण्यो आव्यो, ऐ भारे अद्भुत थयुं. हिंसा करनारो खणपुरुष पोताना पापथी मार्यो जाय छे, अने साधुपुरुषो पोतानी समताने लीघे भयमांथी धूटे छे.<sup>३१</sup> आपणे तप, ईश्वरनुं पूजन, जग्नाशयादिकनुं निर्माण, यज्ञ, दान के प्राणीओ उपर शुं प्रेम करेल हशे ? के जेना प्रभावथी आ बाणक जे भरी गयो हतो ते, पोताना बंधुओने राज्ञ करतो पाण्यो आव्यो; आ बहु ज सारुं थयुं.<sup>३२</sup> गोकुणमां आवी रीतनां धणां धणां आश्चर्यो जोईने विस्मय पामेला नंदरायने वसुदेवनां वयन

एकदार्भकमादाय स्वाङ्कमारोप्य भामिनी । प्रस्तुतं पाययामास स्तनं स्नेहपरिप्लुता ॥३४  
 पीतप्रायस्य जननी सा तस्य रुचिरस्मितम् । मुखं लालयती राजज्वृम्भतो ददृशे इदम् ॥३५  
 खं रोदसी ज्योतिरनीकमाशा: सूर्येन्दुवह्निश्वसनाम्बुर्धींश्च ।  
 द्वीपान् नगांस्तद्वृहित्वर्नानि भूतानि यानि स्थिरजङ्घमानि ॥३६॥  
 सा वीक्ष्य विश्वं सहस्रा राजन्! सञ्जातवेष्थुः । सम्मील्य मृगशावाक्षी नेत्रे आसीत् सुविस्मिता  
 इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्दे  
 पूर्वार्थं तृणावर्तमोक्षो नाम सप्तमो दृश्यायः ॥३७॥

## अथ अष्टमोऽध्यायः (८)

श्रीशुक उवाच -

गर्गः पुरोहितो राजन्! यद्वूनां सुमहातपाः । व्रजं जगाम नन्दस्य वसुदेवप्रचोदितः ॥१  
 तं दृष्ट्वा परमप्रीतः प्रत्युत्थाय कृताज्जलिः । आनर्चाधोक्षजधिया प्रणिपातपुरःसरम् ॥२

उपर बहु ज विश्वास बेठो.<sup>३३</sup> एक दिवसे स्नेहथी व्याम थयेलां यशोदा बाणकने लृष्ट, खोणामां बेसाडी, तेने पोतानुं दृधपान करावतां हतां.<sup>३४</sup> धावी रह्या पछी ते बाणकना सुंदर मंदहास्यवाणा मुखने यशोदा लाड लडावतां हतां, त्यां ते बाणकने बगासुं आवतां तेना मुखमां अंतरिक्ष, स्वर्ग, पृथ्वी, तारामंडण, दिशाओ, सूर्य, चंद्रमा, अग्नि, वायु, समुद्रो, द्वीप, पर्वतो, नदीओ, वन अने सधणां स्थावर जंगम प्राणीओने दीठां.<sup>३५-३६</sup> हे परीक्षित राजा ! सधणा ब्रह्मांडने जोईने तुरत जेने कंप उत्पन्न थयो, अने विस्मय प्राम थयो एवां मृगनेत्री यशोदा पोतानां नेत्र मींची गयां.<sup>३७</sup>

इति श्रीमद् महापुराणा भागवतना दशम स्कंदनो सातमो अद्याय संपूर्णः.

## अद्याय ८

श्रीकृष्ण अने बणदेवनां गग्नाचार्ये नाम पाडचां तथा भाटी खाताने विश्वङ्गप देखाऽच्युं.

शुकदेवज्ञ कहे छे- हे राजा ! महा तपस्वी अने यादवोना गोर गग्नाचार्य वसुदेवनी प्रेरणाथी नंदरायना ब्रजमां आव्या.<sup>१</sup> तेमने जोई बहु ज राज्ञ थयेला नंदराये सामा उभा थृष्ट हाथ जोडीने तथा तेमने परमेश्वरउप जाणीने

सूपविष्टं कृतातिथ्यं गिरा सूनृतया मुनिम् । नन्दयित्वाऽब्रवीद् ब्रह्मन्! पूर्णस्य करवाम किम् ३  
महद्विचलनं नृणां गृहिणां दीनचेतसाम् । निःश्रेयसाय भगवन्! कल्पते नान्यथा व्रचित् ॥४  
ज्योतिषामयनं साक्षाद् यत्तज्ज्ञानमतीन्द्रियम् । प्रणीतं भवता येन पुमान् वेद परावरम् ॥५  
त्वं हि ब्रह्मविदां श्रेष्ठः संस्कारान् कर्तुमर्हसि । बालयोरनयोर्नृणां जन्मना ब्राह्मणो गुरुः ॥६

गर्ग उवाच -

यदूनामहमाचार्यः ख्यातश्च भुवि सर्वतः । सुतं मया संस्कृतं ते मन्यते देवकीसुतम् ॥७  
कंसः पापमति: सख्यं तव चानकुद्धुभेः । देवक्या अष्टुर्मो गर्भो न स्त्री भवितुर्महति ॥८  
इति सञ्ज्ञनयज्ञुत्वा देवक्या दारिकावचः । अपि हन्ताऽऽगताशङ्कस्तर्हि तत्रोऽनयो भवेत् ॥

नद उवाच -

अलक्षितोऽस्मिन् रहसि मामकैरपि गोद्रजे । कुरु द्विजातिसंस्कारं स्वस्तिवाचनपूर्वकम् ॥१०

श्रीशुक उवाच -

एवं सम्प्रार्थितो विप्रः स्वचिकीर्षितमेव तत् । चकार नामकरणं गूढो रहसि बालयोः ॥११

नमस्कारपूर्वकं पूजा करी.<sup>१</sup> पूजा कर्या पद्धी सारी रीते बेडेला ते मुनिने नंदराये  
सुंदर वाणीथी कह्युं के हे महाराज ! जे आप परिपूर्ण छो. आपनुं शुं काम करीऐ  
?<sup>२</sup> महात्मा पुरुषोनुं आववुं, थोडीवार पश धरने नहीं छोडी शक्ता गृहस्थोनुं  
कल्याश करवा सारु ज होय छे. कटीपश तेओना पोताना स्वार्थने माटे होतुं  
नथी.<sup>३</sup> जे शानने ईन्द्रियो नज पहोंची शके, ऐवा शानने आपनार ज्योतिषशास्त्र  
आपे कर्यु छे, के जेथी पुरुषने पूर्व तथा वर्तमान जन्मना भूत अने भाविष्यनुं  
शान थाय छे.<sup>४</sup> आप ज्योतिषशास्त्रना कर्ता अने वेद ज्ञानाराओमां पश श्रेष्ठ  
छो, तेथी आ बे बाणकोना संस्कार करो. ब्राह्मण जन्मथी ज मनुष्योना गुरु  
कहेवाय छे.<sup>५</sup>

गर्गाचार्य कहे छे- हुं यादवोनो आचार्य छुं अने पृथ्वीमां सर्वदा प्रभ्यात  
छुं, तेथी जो हुं तमारा पुत्रना संस्कार करुं, तो पाप बुद्धिवाणो कंस तमारा पुत्रने  
देवकीनो पुत्र माने अने वणी वसुदेवनी साथे तमारे मैत्री छे ते पश कंस जाणे छे,  
अने देवकीनी दीकरी योगमायानुं वयन सांभणी 'देवकीनो आठमो गर्भ स्त्री न  
ज थवो ज्ञेई' ऐम पश विचार कर्या करे छे. माटे आठमा गर्भनी शंकाथी ते  
जो तमारा पुत्रने मारे तो तेमां अमारुं बहु ज भूं थाय.<sup>६-८</sup> नंदराय कहे छे- आ  
प्रजमां मारा लोकोना पश जाणवामां न आवे, ऐवा एकांत स्थणमां स्वस्तिवाचन  
करीने आ पुत्रोना संस्कार करो, के जे संस्कार ब्राह्मण, क्षत्रिय अने वैश्यने अवश्य

गर्ग उवाच -

अयं हिरोहिणीपुत्रो रमयन् सुहृदो गुणैः । आख्यास्यते राम इति बलाधिक्याद्वलं विदुः ।

यदूनामपृथग्भावात् सङ्कर्षणमुशन्त्युत ॥१२

आसन् वर्णास्त्रयो ह्यस्य गृहतोऽनुयुगं तनूः । शुक्लो रक्तस्तथा पीत इदानीं कृष्णातां गतः ॥  
प्रागयं वसुदेवस्य व्रचिज्जातस्तवात्मजः । वासुदेव इति श्रीमानभिज्ञाः सम्प्रचक्षते ॥१४  
ब्रह्मनि सन्ति नामानि रूपाणि च सुतस्य ते । गुणकर्मानुरूपाणि तान्यहं वेद नो जनाः ॥१५  
एष वः श्रेय आधास्यद् गोपगोकुलनन्दनः । अनेन सर्वदुर्गाणि यूयमज्जस्तरिष्यथ ॥१६  
पुरानेन व्रजपते! साधवो दस्युपीडिताः । अराजके रक्ष्यमाणा जिग्युर्दस्यून् समेधिताः ॥१७  
य एतस्मिन् महाभागाः प्रीति कुर्वन्ति मानवाः । नारयोऽभिवन्येतान् विष्णुपक्षानिवासुराः ॥  
तस्मान्नदात्मजोऽयं ते नारायणसमो गुणैः । श्रिया कीर्त्यानुभावेन गोपायस्व समाहितः ॥

थवा ज्ञेईऐ.<sup>१०</sup> शुकुदेवज्ञ कहे छे- आ प्रभाषे नंदराये प्रार्थना करतां गर्गाचार्ये  
ऐकांतमां गुम रीते ते बे बाणकोनां नाम पड्यां, के जे करवानी ईच्छाथी ज पोते  
आव्या हता.<sup>११</sup> गर्गाचार्य कहे छे- आ रोहिणीनो पुत्र पोताना गुणोथी संबंधीओने  
रमाडे छे, माटे 'राम' कहेवाशे. अधिक बण होवाथी बलभद्र कहेवाशे, अने  
कोई पश कारणाथी विवाद करीने विभूटा पडेला धादवोने एकठा करशे, तेथी  
संकर्षणा पश कहेवाशे.<sup>१२</sup> आ जे तमारो पुत्र छे ते प्रत्येक युगमां अवतार धरे छे  
अने अनो श्वेत, रक्त, तथा पीत वर्णहतो, हमणां कृष्ण वर्ण छे तेथी तेनुं "कृष्ण"  
ऐवुं नाम कहेवाशे.<sup>१३</sup> पूर्वे कोई समये आ तमारो पुत्र वसुदेवनो पुत्र थयेल  
हतो. तेथी ज्ञानी लोको आनुं 'वासुदेव' ऐवुं नाम पश कहेशे.<sup>१४</sup> गुण अने कर्मने  
अनुसारे तमारा पुत्रनां नाम अने रुप धणां छे के जे सधगाने हुं जाणतो नथी  
अने लोको पश जाणता नथी.<sup>१५</sup> गोवाणिया अने गायोने राज्ञ करनार आ तमारो  
पुत्र तमारुं कल्याश करशे अने तेना प्रभावथी तमे सधगां कष्टोने अनायासथी  
तरी जशो.<sup>१६</sup> हे प्रजना पति ! पूर्वे कोई राजा न हतो ते समयमां योर लोकोये  
पीडेला सज्जनोनी, आ तमारा पुत्रे रक्षा अने वृद्धि करी हती, तेथी तमोये  
योरलोकोने ज्ञत्या हता.<sup>१७</sup> जे भाग्यशाणी माणसो आ तमारा पुत्रमां प्रीति  
राखशे तेओने दैत्यो जेम विष्णुना पक्षवाणाओनो पराभव करी शक्ता नथी,  
तेम शत्रुओ पराभव करी शक्तशे नहिः.<sup>१८</sup> हे नंद ! आ तमारो पुत्र गुण, कीर्ति,  
लक्ष्मी अने प्रभावथी नारायण समान छे माटे सावधान रहीने आनी रक्षा  
करजो.<sup>१९</sup>

ઇત्यात्मानं समादिश्य गर्गे च स्वगृहं गते । नन्दः प्रमुदितो मेने आत्मानं पूर्णमाशिषाम् ॥२०  
कालेन व्रजताल्पेन गोकुले रामकेशवौ । जानुभ्यां सह पाणिभ्यां रिङ्गमाणौ विजह्रतुः ॥२१  
तावद्घ्रियुग्मनुकृष्ट्य सरीसृपत्तौ घोषप्रधोषरुचिरं व्रजकर्दमेषु ।  
तन्नादहृष्टमनसावनुसृत्य लोकं मुग्धप्रभीतवदुपेयतुरन्ति मात्रोः ॥२२॥  
तन्मातरौ निजसुतौ धृणया स्नुवन्त्यै पङ्कजङ्गरागरुचिरावुपगुह्या दोभ्याम् ।  
दत्त्वा स्तनं प्रपिबतोः स्म मुखं निरीक्ष्य मुग्धस्मितात्पदशनं ययतुः प्रमोदम् २३  
यर्हाङ्गनादर्शनीयकुमारलीलावन्तर्वर्जे तदबलाः प्रगृहीतपुच्छे ।  
वस्तैरितस्तत उभावनुकृष्ट्यमाणौ प्रेक्षन्य उज्ज्ञातगृहा जहवुर्हसन्त्यः ॥२४॥  
शृङ्गग्निदंष्ट्रसिजलद्विजकण्ठकेभ्यः क्रीडापरावितचलौ स्वसुतौ निषेद्धम् ।  
गृह्णाणि कर्तुमपि यत्र न तज्जनन्यौ शेकात आपत्तुरलं मनसोऽनवस्थाम् ॥२५॥  
कालेनाल्पेन राजर्णे! रामः कृष्णश्च गोकुले । अघृष्टजानुभिः पद्भिर्विचक्रमतुरञ्जसा ॥२६

शुकदेवज्ञ कહे छे- आ प्रमाणे आशा करी गर्गाचार्य पोताने धेर गया अने  
राज्ञ थयेला नंदराये पोताना सधणा भनोरथो पूर्ण थया मान्या.<sup>२०</sup> थोડो समय  
ज्ञातं भणभद्र अने श्रीकृष्ण गोकुणमां गोठाण अने हाथवते जमीन पर सरकी  
भांभोडिये चालवानी लीला करवा लाग्या.<sup>२१</sup> ए भन्ने भाईओ धरेणांनी  
धुधरीओना शब्दथी सुंदर लागे ऐवी रीते पोताना पगने ढसडी ढसडीने व्रजनां  
कादवोमां भहु ज चालवा लाग्या, धुधरीओना शब्दथी राज्ञ थवा लाग्या अने  
वणी कोई जता आवता माणसनी पछवाडे त्रष्ण चार पगलां जईने अणसमजु  
अने भय पामेलानी पेटे पोतानी माताओनी पासे जता हता.<sup>२२</sup> दयाथी जेओने  
पानो आवतो हतो, ऐवी तेओनी माताओ कादवथी अने यंदनना लेपनथी सुंदर  
लागता पोताना पुत्रने हाथवते आलिंगन करी धवरावती हती. ते समये मंदहास्य  
अने थोડा दांतवाणा भणदेव तथा कृष्णनु मुख जोઈने राज्ञ थती हती.<sup>२३</sup> ज्यारे  
ए बाणकनी कुमार अवस्थानी लीला स्त्रीओने जेवा जेवी थई त्यारे अर्थात्  
भन्ने बाणको मोटा थया त्यारे, व्रजमां वाइरडांओनां पूछडां पकडता अने  
वाइरडांओ द्वारा आम तेम चारे बाजु खेंची जवाता ए बाणकोने जोઈ, गोपीओ  
पोतानां कामने भूली जई हसती हती अने हर्ष पामती हती.<sup>२४</sup> क्रीडामां लागेला  
अने अत्यंत चपળ पोताना पुत्रोने शींगडांवाणां पशु, दाढवाणा प्राणी, अग्नि,  
जण, पक्षी अने कांटाओथी अटकाववाने अने धरनां काम करवाने ज्यारे रोहिणी  
अने यशोदानी शक्ति रही नहीं, त्यारे ते भन्ने माताओ मननी भहु ज आकुणताने

ततसु भगवान् कृष्णो वयस्यैर्वज्जबालकैः । सहरामो व्रजस्त्रीणां चिक्रीडे जनयन् मुदम् २७  
कृष्णस्य गोप्यो रुचिरं वीक्ष्य कौमारचापलम् । शृणवत्याः किल तन्मातुरिति होचुः समागताः ।२८  
वत्सान् मुञ्चन् क्रचिदसमये क्रोशसंजातहासः ।  
स्तेयं स्वाद्वृत्यथ दधि पयः कल्पितैः स्तेययोगैः ॥  
मर्कान् भोक्ष्यन् विभजति स चेन्नाति भाण्डं भिनति ।  
द्रव्यालाभे स गृहकृपितो यात्युपक्रोश्य तोकान् ॥२९॥  
हस्ताग्राहे रचयति विर्धि पीठकोलूखलाद्यै ।  
शिछं द्वान्तर्निहितवयुनः शिक्ष्यभाण्डेषु तद्वित् ॥  
ध्वान्तागारे धृतमणिगणं स्वाङ्गमर्थप्रदीपं ।  
काले गोप्यो यहिं गृहकृत्येषु सुव्यगचित्ताः ॥३०॥  
एवं धार्ष्यन्युशति कुरुते मेहनादीनिवास्तौ ।  
स्तेयोपायैर्विरचितकृतिः सुप्रतीको यथाऽऽस्ते ॥  
इत्थं स्त्रीभिः सभयनयनश्रीमुखालोकिनीभि- ।  
वर्वाख्यातार्था प्रहसितमुखी न ह्यपालब्धुमैच्छत् ॥३१॥

पाभ्यां.<sup>२५</sup> हे परीक्षित राजा! पधी थोડो काण ज्ञातं भणभद्र अने श्रीकृष्ण भगवान  
गोकुणमां पगथी चालवा लाग्या.<sup>२६</sup> पधी भणभद्र सहित श्रीकृष्ण भगवान  
पोताना सरभी अवस्थाना बाणको साथे गोपीओने आनंद उपजे ऐवी रीते  
क्रीडा करवा लाग्या.<sup>२७</sup> भगवाननी प्रिय लागे ऐवी बाणअवस्थानी चपणता  
जोઈने, सधणे धेरथी भेणी थयेली गोपीओ यशोदाज्ञाना सांभणतां, आ प्रमाणे  
राव खाती हती.<sup>२८</sup> “हे यशोदा! अमारं चित्त धरनां कामकाजमां भहु ज लागेलुं  
होय छे त्यारे आ तमारो पुत्र क्यारेक दोहवाना समय वगर पण अमारां  
वाइरडांओने छोडी भूके छे. अमे वढीऐ छीऐ तो हसे छे. योरीना उपायो करीने  
मीठा मीठा पदार्थ दही अने दूध योरी लहने खाई जाय छे. अटलुं ज नहीं पण  
पोते खाधा पहेलां वांदराओने वहेंची दे छे. तेओमां तृम होवाने लीधे कोई वांदरो  
न खाय तो पोते धाम झोडी नाखे छे. कोई समये कांઈ वस्तु न मणे तो अमारी  
उपर कोध करी, अमारां सूतेलां बाणकोने रोवरावीने भाणी जाय छे. कोई वस्तु  
उंची राखवाने लीधे हाथमां आवे एम न होय तो पाटला अने खांडिणिया आदि  
मांडी, तेना उपर यढीने पहेंचाय तेवो उपाय करे छे. वासण उंचां शीकाओमां  
राखेलां होय छे तो तेओमां राखेली वस्तु जाणी लहने तेमां फँकुं पाडे छे. धरमां  
अंधारुं होय तो पोताना अंगमां अनेक मणि पहेरी आवीने अजवाणु करे छे.<sup>२९-३०</sup>

એકदા ક્રીડમાનાસ્તે રામાદ્યા ગોપદારકા: । કૃષ્ણો મું ભક્ષિતવાનિતિ માત્રે ન્યવેદયન् ॥૩૨  
સો ગૃહીત્વા કરે કૃષ્ણમુપાલભ્ય હિતૈષિણી । યશોદા ભયસમ્ભાન્તપ્રેક્ષણાક્ષમભાષત ॥૩૩  
કસ્માન્મદમદાન્તાત્મન્ ભવાન્ ભક્ષિતવાન્ રહે: । વદનિ તાવકા હ્યેતે કુમારાસ્તેજગ્રજોઽપ્યયમ् ।

### શ્રીકૃષ્ણ ઉવાચ -

નાહં ભક્ષિતવાનમ્બ ! સર્વે મિશ્યાભિશંસિન: । યદિ સત્યગિરસર્હિ સમક્ષં પશ્ય મે મુખમ् ॥૩૫  
યદ્યેવં તર્હિ વ્યાદેહીત્યુક્તઃ સ ભગવાન્ હરિ: । વ્યાદત્તાવ્યાહતૈશ્વર્ય: ક્રીડામનુજબાલકઃ ॥૩૬  
સા તત્ત્ર દવ્દ્ધો વિશ્વં જગત્ સ્થાસ્તુ ચ ખં દિશઃ । સાદ્રિદ્વીપાબ્ધિભૂગોલં સવાચ્યગ્નિન્દુતારકમ् ॥  
જ્યોતિશ્રક્રં જલં તેજો નભસ્વાન્ વિદ્યદેવ ચ । વૈકારિકાણીન્દ્રિયણ મનો માત્રા ગુણાસ્ત્રય: ॥

એતદ્ વિચિત્રં સહ જીવકાલસ્વભાવકર્માશાયલિઙ્ગભેદમ् ।  
સૂનોસ્તનૌ વીક્ષ્ય વિદારિતાસ્યે વ્રજં સહાત્માનમવાપ શઙ્કામ् ॥૩૭॥

અરે ચોર ! એમ કહી અમે બરકીએ છીએ તો સામી ઢેકડી કરે છે કે, હું તો ઘરનો  
માલિક, તું ચોર છે. અને સારાં સારાં ઘરમાં મળમૂન્ત કરી જાય છે, આમ ચોરીના  
ઉપાયોનું કામ કરે છે તો પણ તમારી પાસે સારા માણસની પેઠે બેઠેલ છે.” આ  
પ્રમાણે ભય સહિત નેત્રવાળા ભગવાનના શ્રીમુખને જોયા કરતી ગોપીઓએ સધળી  
વાતો કહી દેખાડતાં યશોદા હસી પડ્યાં, પણ પુત્રને ઠપકો દેવાની ઈશ્યાન કરી.<sup>૩૧</sup>  
એક દિવસે કીડા કરતા બળભદ્ર આદિ છોકરાઓ યશોદા પાસે જઈને કહું કે  
‘કૃષ્ણે માટી ખાધી’. <sup>૩૨</sup> હિતની ઈશ્યાવાળાં યશોદાએ જેની આંખો ભયથી  
ચકળવકળ થયેલી હતી, એવા શ્રીકૃષ્ણનો હાથ પકડી ઠપકો દઈને કહું કે- “અરે  
અટકચાળા ! તે માટી શા માટે ખાધી ? આ તારા મિત્ર બાળકો કહે છે અને તારા  
મોટોભાઈ પણ કહે છે” <sup>૩૩-૩૪</sup> ભગવાન બોલ્યા “હે મા !” મેં માટી ખાધી નથી.  
બધાલોકો ખોટું બોલે છે. જો તમને તેનું બોલવું સાચું લાગતું હોય તો પ્રત્યક્ષ રીતે  
મારું મુખ જુઓ.” જો એમ હોય તો મુખ ઉઘાડ. એમ યશોદાએ કહેતાં અખંડિત  
એશ્વર્યવાળા અને લીલાથી મનુષ્ય જેવા થયેલા ભગવાને પોતાનું મુખ ઉઘાડ્યું. <sup>૩૫-</sup>  
<sup>૩૬</sup> એ મુખમાં યશોદાએ સ્થાવર, જંગમ, જગત, અંતરિક્ષ, દિશાઓ, પર્વતો,  
દીપો, સમુદ્રો, ભૂગોળ, પ્રવહ નામનો વાયુ, વીજળી, ચંદ્ર, તારા, સ્વર્ગલોક, જળ,  
તેજ, વાયુ, આકાશ, ઈદ્રિયોના દેવ, ઈદ્રિયો, મન, શબ્દાદિક પાંચ વિષય, ત્રણ  
ગુણ, જીવ, કાળ, સ્વભાવ, કર્મના સંસ્કાર અને તેઓથી થતા શરીરના ભેદ એક  
સામટા દીઠા. <sup>૩૭-૩૮</sup> આ પ્રમાણે પુત્રના નાના મુખમાં સધળું વિચિત્ર જગત અને  
તેની સાથે પ્રજ સહિત પોતાના શરીરને પણ જોઈને યશોદાને વિચાર થયો કે આ

કિં સ્વજ્ઞ એતદુત દેવમાયા કિં વા મદીયો બત બુદ્ધિમોહઃ ।  
અથો અમુચ્છૈવ મર્માર્ભકસ્ય ય: કશ્ચનૌત્પત્તિક આત્મયોગ: ॥૪૦॥  
અથો યથાવન્ન વિતર્કગોચરં ચેતોમન:કર્મવચોભિરજ્જસા ।  
યદાશ્રયં યેન યત: પ્રતીયતે સુર્વિભાવ્યં પ્રણતાસ્મિ તત્પદમ् ॥૪૧॥  
અહં મમાસૌ પતિરેષ મે સુતો વ્રજેશ્વરસ્યાખિલવિત્તણ સતી ।  
ગોપ્યશ્રી ગોપા: સહગોધનાશ્રી મે યન્માયયેતથં કુમતિ: સ મે ગતિ: ॥૪૨॥  
ઇથં વિદિતતત્ત્વાયાં ગોપિકાયાં સ ઈશ્વર: । વૈષ્ણવી વ્યતનોન્માયાં પુત્રસ્નેહમર્યા વિભુ: ॥૪૩  
સદ્ગ્નાષ્ટમૂર્તિગર્ણોપી સાડજોપ્યારોહમાત્મજમ્ । પ્રવૃદ્ધસ્નેહકલિલહૃદયાડ્સીદ્યથા પુરા ॥૪૪  
ત્રયા ચોપનિષદ્ધિશ્રી સાંખ્યયોગૈશ્ર સાત્વતૈ: । ઉપગીયમાનમાહાત્મ્યં હરિં સાડમન્યતાત્મજમ્ ।

તે શું સ્વપ્ર છે ? ના, આ સ્વપ્ર તો નહીં, ત્યારે શું ભગવાનની માયા છે ? ના, તે પણ  
નહીં. કેમકે માયા હોય તો બીજાઓને દેખાવામાં પણ આવવી જોઈએ. ત્યારે જેમ  
અરીસામાં મુખ પ્રતિબિંબદુપે દેખાય છે, તેમ શું આ મારી બુદ્ધિનું જ પ્રતિબિંબ  
છે ? ના, એમ તો નહીં; કેમકે એમ હોય તો અરીસામાં જેમ આરસી દેખાય નહીં  
તેમ આ પુત્રના મોઢામાં એજ પુત્ર દેખાવો જોઈએ, અને બહાર તથા અંદર  
એકરૂપથી જગત દેખાવું જોઈએ. તો શું આ મારા પુત્રનું સ્વાભાવિક કાંઈ એશ્વર્ય  
છે? <sup>૩૯-૪૦</sup> આ છેલ્લો પક્ષ જ મને પ્રબળ લાગે છે, માટે બુદ્ધિ, મન, કર્મ અને  
વચનથી જેમ છે તેમ ધારી શકાય નહિ, એવું આ જગત જેના થકી ઉત્પસ થાય  
છે, જેના થકી પાલને પામે છે અને જેમાં લય પામે છે, આવું અતકર્ય ભગવાનના  
સ્વરૂપને હું પ્રણામ કરું છું. <sup>૪૧</sup> હું યશોદા છું, આ મારો પતિ છે, આ મારો પુત્ર છે,  
નંદરાયના સધળા ધનની ધણીઆણી હું તેની સ્ત્રી છું અને ગોપીઓ, ગોવાળિયા  
તથા ગાયોનાં ધણ મારાં છે, આવી રીતની કુબુદ્ધિ જેની માયાથી થઈ છે, તે ઈશ્વર  
મારું શરણ છે. <sup>૪૨</sup> આ પ્રમાણે યશોદાને તત્વજ્ઞાન થતાં તે શ્રીકૃષ્ણે પાછી પુત્રના  
સ્નેહરૂપી માયા વિસ્તારી દીધી. <sup>૪૩</sup> માયાથી તુરત સ્મરણ જતું રહેતાં તે યશોદા  
પોતાના પુત્રને ખોળામાં બેસાડીને પ્રથમની પેઠે જ વૃદ્ધિ પામેલા સ્નેહથી ઘેરાએલાં  
હદ્યવાળાં થઈ ગયાં. <sup>૪૪</sup> કર્મકાંડરૂપ ત્રણ વેદ, જે શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપને  
ઈન્દ્રાદિકરૂપ કહે છે, ઉપનિષદો ખલ કહે છે, સાંખ્ય પુરુષ કહે છે, યોગ પરમાત્મા  
કહે છે અને ભક્તલોકો ભગવાન કહે છે, આવા શ્રીકૃષ્ણને યશોદાએ પુત્ર માન્યા. <sup>૪૫</sup>

પરીક્ષિત રાજા પૂછે છે કે મહારાજ ! નંદરાયે એવું મોટું કયું પુષ્ય કર્યું હતું ?

## राजोवाच -

नन्दः किमकरोद् ब्रह्मन् ! श्रेय एवं महोदयम् । यशोदा च महाभागा पपौ यस्याः स्तनं हरिः ४६  
पितरौ नान्विन्देतां कृष्णोदारार्थकेहितम् । गायन्त्यद्यापि कवयो यल्लोकेशमलापहम् ॥४७

## श्रीशुक उवाच -

द्रोणो वसूनां प्रवरो धरया सह भार्या । करिष्यमाण आदेशान् ब्रह्मणस्तमुवाच ह ॥४८  
जातयोर्नैः महादेवे भुवि विश्वेश्वरे हरौ । भक्तिः स्यात् परमा लोके ययाज्जो दुर्गतिं तरेत् ॥४९  
अस्त्विक्तुः स भगवान् व्रजे द्रोणो महायशः । जन्मे नन्द इति ख्याते यशोदा सा धराऽभवत् ।  
ततो भक्तिर्भगवति पुत्रीभूते जनार्दने । दम्पत्योर्नितरामासीद् गोपगोपीषु भारत! ॥५१  
कृष्णो ब्रह्मण आदेशं सत्यं कर्तुं व्रजे विभुः । सहरामो वसंश्वक्रे तेषां प्रीतिं स्वलीलया ॥५२

इति श्रीमद्बागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वर्धे

विश्वरूपदर्शनेऽष्टमोऽध्यायः ॥८॥

अने भाग्यशाणी यशोदा के जेनुं स्तनपान पोते भगवाने कर्युतेषो पशु कर्युं पुष्य  
कर्युं हथे? ४६ लोकोना पापने भटाडनारी भगवाननी बाणलीला के जेने कविओ  
अद्यापि सुधी गाय छे, ते बाणलीलानो अनुभव साचां मा-बापने नहीं मणतां  
नंद अने यशोदाने भण्यो तेनुं कारण शुं? ४७

शुकदेवज्ञ कहे छे- आठ वसुओमां उत्तम द्रोष वसु अने तेनी स्त्री धराने  
ब्रह्माए गायोनुं पालन करवा आहि कामनी आज्ञा करतां ते आज्ञानो स्वीकार  
करी, ते बसेए भाग्युं के- अमो स्त्री-पुरुष पृथ्वीमां जन्म धारण करीए त्यारे  
जगतना नाथ भगवानमां अमने परम भक्ति थवी ज्ञेई ए के जेथी अनायासे  
जन्म भरणाना झेरा मरे छे. ४८-४९ ब्रह्माए तथास्तु कहेतां, ए मोटी कीर्तिवाणा  
द्रोष वसु व्रजमां नंदराय थया अने तेनी स्त्री धरा यशोदा थई. ५० जो के सधणा  
गोवाणिया अने गोपीओने पशु भगवानमां भक्ति हती ज, तो पशु नंदराय  
अने यशोदाने पुत्ररूप थयेला भगवानमां ब्रह्माना वरदानने लीधे बहु ज भक्ति  
थई हती. ५१ परमात्मा श्रीकृष्ण भगवाने ब्रह्मानी आज्ञा सत्य करवा सारु  
बणभद्रनी साथे व्रजमां रहीने पोतानी लीलाथी नंद यशोदाने प्रीति उत्पन्न करी  
हती. ५२

इति श्रीमद्भागवतना भागवतना दशम स्कन्धनो अष्टमो अध्याय संपूर्णः ॥

## अथ नवमोऽध्यायः (९)

## श्रीशुक उवाच -

एकदा गृहदासीषु यशोदा नंदगेहिनी । कर्मातरनियुक्तासु निर्ममन्थ स्वयं दधि ॥१  
यानि यानीह गीतानि तद्वालचरितानि च । दधिनिर्मन्थने काले स्मरन्ती तान्यगायत ॥२  
क्षौमं वासः पृथुकटितटे बिभ्रती सूत्रनद्धम् । पुत्रस्वेहस्तुतकुचयुगं जातकम्पं च सुभूः ।  
रज्ज्वाकर्षश्रमभुजचलत् कङ्गणौ कुण्डले च । स्विन्नं वक्त्रं कबरविगलम्मालती निर्ममन्थ  
तां स्तन्यकाम आसाद्य मर्नन्ती जननी हरिः । गृहीत्वा दधिमन्थानं न्यषेधत् प्रीतिमावहन् ॥४  
तमङ्गमास्तु दमपाययत् स्तनं स्नेहस्तुतं सम्मितमीक्षती मुखम् ।  
अतृप्रसुत्यज्य जवेन सा ययावुत्सिच्यमाने पर्यसि त्वधिश्रिते ॥५॥  
सञ्जातकोपः स्फुरितारुणाधरं संदश्य दद्विद्विधिमन्थभाजनम् ।  
भित्त्वा मृषा श्रुद्वषदशमना रहो जघास हैयङ्गवमन्तरं गतः ॥६॥

## अध्याय ८

गोणी झोडवाथी यशोदाए श्रीकृष्णाने दामाकांथी धांध्या.

शुकदेवज्ञ कहे छे- एक दिवसे धरनी दासीओ भीजा काममां ज्ञेऽर्थां जतां  
नंदरायनी स्त्री यशोदा पोते दहीनुं मंथन करवा लाग्यां. १ भगवाननां जे जे  
बाणयरित्र अहीं कह्यां ते सर्वेनुं स्मरण करी धाश करवाना समयमां यशोदा ते  
बाण चरित्रनुं गायन करतां हतां. २ ए समयमां सुंदर भुक्तिवाणां यशोदाए  
विशाण नितंब उपर रेशभी चण्डियो पहेर्यो हतो. अने ए चण्डियाने कंदोराथी  
बांध्यो हतो, पुत्र उपर स्नेहने लीधे स्तनमांथी दूध झरतुं हतुं, शरीर हालतुं  
हतुं, नेतरुं खेंचवाना परिश्रमने लीधे हाथमां कंकण अने कानमां कुंडण हालतां  
हतां. मोढापर पसीनो वण्यो हतो, अने चोटलामांथी मालतीनां क्लू खरी पडतां  
हतां. ३ दहीनुं मंथन करतां माताज्ञनी पासे धाववानी ईर्ष्याथी आवीने प्रीति  
उपज्ञवता भगवाने दहीं वलोववानो रवैयो जालीने तेमने रोक्यां. ४ भगवानने  
भोणामां बेसाईने यशोदा स्नेहने लीधे जेमांथी दूध झरतुं हतुं ऐवुं पोतानुं स्तन  
धवरावतां हतां अने मंदहारयवाणुं तेमनुं मुख जेतां हतां, तेटलामां गरम करवा  
मूकेलुं दूध उभराई जतां तेनी संभाण लेवा सारु भगवान तृप्त थया न होता,  
तोपण तेमने भूकीने वेगथी त्यां गयां. ५ भगवानने तेथी शीस चढी, लाल होठ  
झरकवा लाग्या, खोटां खोटां आंसु आवी गयां पछी दांतवते होठ दबावीने  
पथरथी छासनी गोणी झोडी नाखी अने पछी धरनी अंदर जहूने एकांतमां

उत्तार्य गोपी सुशृंतं पयः पुनः प्रविश्य संदूश्य च दध्यमत्रकम् ।  
भग्नं विलोक्य स्वसुतस्य कर्म तत्जहास तं चापि न तत्र पश्यती ॥७॥

उलूखलाङ्गेरुपरि व्यवस्थितं मर्काय कामं ददतं शिचि स्थितम् ।  
हैयङ्गवं चौर्यविशङ्कितेक्षणं निरीक्ष्य पश्चात् सुतमागमच्छनैः ॥८॥

तामात्यर्थिं प्रसमीक्ष्य सत्वरसतोऽवरूप्यापससार भीतवत् ।  
गोप्यन्वधावन्न यमाप योगिनां क्षमं प्रवेष्टुं तपसेरितं मनः ॥९॥

अन्वञ्चमाना जननी बृहच्चलच्छ्रोणीभराक्रान्तगतिः सुमध्यमा ।  
जवेन विस्त्रिमितकेशबन्धनच्युतप्रसूनानुगतिः परामृशत् ॥१०॥

कृतागसं तं प्रसुदन्तमक्षिणी कषन्तमञ्जनमिषणी स्वपाणिना ।  
उद्वीक्षमाणं भयविह्वलेक्षणं हस्ते गृहीत्वा भिषयन्त्यवागुरत् ॥११॥

त्यक्त्वा यर्षिं सुतं भीतं विज्ञायार्भक्तवत्सला । इयेष किल तं बद्धुं दामातद्वीर्यकोविदा ॥  
न चान्तर्नं बहिर्यस्य न पूर्वं नापि चापरम् । पूर्वापरं बहिक्षान्तर्जगतो यो जगच्च यः ॥१३॥

भाखण्ड खावा लाङ्या.<sup>६</sup> बहु ज गरम थयेला दूधने चूला उपरथी उतारी यशोदा  
पाइं छाश करवाना स्थानकमां आव्यां, त्यां दहींनी गोपीने कूटेली ज्ञेई, एटले  
ते पोताना पुत्रनुं काम छे अेम जाणी भगवानने त्यां नहीं देखतां हसी पड्यां.<sup>७</sup>  
पछी ऊँधावाणेला खांडणिया उपर बेठेला, शींकानां भाखण्डने वांडराने खवरावता  
अने चोरीने लीधे यकणवकण ज्ञेया करता पुत्रने ज्ञेईने तेने पकडवा सारु धीरे  
धीरे पछवाडेथी आव्यां.<sup>८</sup> लाकडी लईने आवतां माताज्ञने ज्ञेई, भगवान तुरत  
खांडणिया उपरथी ऊतरीने भय पामेलानी पेठे भाङ्या. यशोदा तेमनी पछवाडे  
दोऽयां पाण पहेंची शक्यां नहीं, केमके, तपथी तदाकार करेलुं अने प्रवेश करवाने  
योऽय योगीओनुं मन पाण तेने पहेंची शक्तुं नथी.<sup>९</sup> वेगने लीधे जशोदानी पछवाडे  
चोटलामांथी झूल खरतां हतां अने मोटा तथा हालता नितंभना भारथी दोऽवामां  
मूँझातां ऐवां यशोदाए मांड मांड दोडीने भगवानने पकड्या.<sup>१०</sup> वांकमां आवेला,  
रोता, आंजणथी खरडायेली आंभोने बे हाथे योणता, ज्ञेया करता अने भयथी  
विहृण नेत्रवाणा एवा श्रीकृष्णनो हाथ पकडी यशोदाए तेमने बीवडाववा सारु  
धमकी आपी.<sup>११</sup> बाणकपर प्रीतिवाणां अने भगवाननी शक्तिने नहीं जाणतां  
यशोदाए पोताना पुत्रने भयभीत जाणी, लाकडी भूडी दृष्टिने तेमने दोरडांथी  
बांधवानी ईर्थणा करी.<sup>१२</sup> भगवान पोताना धाममां रहेला होवाथी केवण जगतनी  
अंदर नथी. अने केवण जगतथी भहार धाममां पाण नथी. सर्वत्र व्यापक होवाथी

तं मत्वाऽत्तमजमव्यक्तं मर्त्यलिङ्गमधोक्षजम् । गोपिकोलूखले दामा बबस्य प्राकृतं यथा ॥१४  
तद् दाम बध्यमानस्य स्वार्थकस्य कृतागसः । द्वयंगुलोनमभूतेन सन्दधेऽन्यच्च गोपिका १५  
यदाऽसीत्तदपि न्यूनं तेनान्यदपि सन्दधे । तदपि द्वयंगुलं न्यूनं यद् यदादत्त बन्धनम् ॥१६  
एवं स्वगेहदामानि यशोदा सन्दधत्यपि । गोपीनां सुस्मयन्तीनां स्मयन्ती विस्मिताऽभवत् १७  
स्वमातुः स्विन्नगात्राया विस्तकबरस्त्रजः । दृष्ट्वा परिश्रमं कृष्णाः कृपयाऽसीत् स्वबन्धने १८  
एवं संदर्शिता ह्यङ्गः ! हरिणा भृत्यवश्यता । स्ववशेनापि कृष्णोन यस्येदं सेश्वरं वशे ॥१९  
नेमं विरिञ्चो न भवो न श्रीरघ्यङ्गसंश्रया । प्रसादं लेभिरे गोपी यत्तत् प्राप विमुक्तिदात् ॥२०  
नायं सुखापो भगवान् देहिनां गोपिकासुतः । जानिनां चात्मभूतानां यथा भक्तिमतमिह २१  
कृष्णस्तु गृहकृत्येषु व्यग्रायां मातरि प्रभुः । अद्राक्षीदर्जुनौ पूर्वं गुह्याकौ धनदात्मजौ ॥२२  
पुरा नारदशापेन वृक्षतां प्रापितौ मदात् । नलकूबरमणिग्रीवाविति ख्यातौ श्रियान्वितौ ॥२३

इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्तकन्धे पूर्वार्थ  
गोपीप्रसादो नाम नवमोऽध्यायः ॥१९॥

आगण नथी अने पाइण पाण नथी. अर्थात् कोई जग्या ऐवी नथी के ज्यां  
भगवान न होय. अने जे जगतना शरीरी आत्मा छे, एवा अव्यक्त अने  
मनुष्यदेह वाणा भगवानने पुत्र मानी, यशोदा जेम प्राकृत भाणकने बांधे तेम  
खांडणिया साथे दोरडीथी बांधवा लाङ्यां.<sup>१३-१४</sup> वांकमां आवेला ते श्रीकृष्णने  
बांधतां दोरडुं बे आंगण ओछुं थयुं, एटले यशोदाए तेनी साथे बीजुं दोरडुं  
सांध्युं.<sup>१५</sup> ते पाण बे आंगण ओछुं पडतां तेनी साथे त्रीजुं सांध्युं, तो ते पाण बे  
आंगण ओछुं थयुं. ऐवी रीते जेटलां दोरडां लीधां ते सर्व तेटलां ज ओछां थयां.<sup>१६</sup>  
धरनां सधणां दोरडां सांध्यां तोपाण ओछां थतां आव्यां, तेथी बीजु गोपीओ  
हसवा लागतां, हसी पडेलां यशोदा पोते पाण विस्मय पामी गयां.<sup>१७</sup> पछी पोतानी  
माताने परिश्रमथी पसीनो वणी गयो ते ज्ञेईने कृपाथी श्रीकृष्ण भगवान दोरडांथी  
बंधाया.<sup>१८</sup>

हे परीक्षित राजा ! जे भगवानने लोकपाण देव सहित आ सधणुं जगत  
वशे छे, ते भगवाने पोते स्वतंत्र होवा छितां पाण आवी रीते भक्तवशपाणुं  
देखाइयुं.<sup>१९</sup> मुक्तिं आपनार भगवान पासेथी ब्रह्मा, सदाशिव अने अंगमां  
रहेनारां लक्ष्मीज्ञने पाण कृपा नथी मणी एम नथी, परंतु यशोदाज्ञने जे कृपा  
मणी ते कृपा कोई भेदी नथी.<sup>२०</sup> श्रीकृष्ण भगवान ज्ञेवा भक्तिवाणाओने सहेज  
मणे छे तेवा देहाभिमानी तपस्वी आदि लोकोने अने देहाभिमान वगरना ज्ञानी

## अथ दशमोऽध्यायः (७०)

राजोवाच -

कथ्यतां भगवन्नेतत्तयोः शापस्य कारणम् । यत्तद्विग्रहितं कर्म येन वा देवर्षेस्तमः ॥१  
श्रीशुक उवाच -

रुद्रस्यानुचरौ भूत्वा सुदूसौ धनदात्मजौ । कैलासोपवने रम्ये मन्दाकिन्यां मदोल्कटौ ॥२  
वारुणीं मदिरां पीत्वा मदाघूर्णितलोचनौ । स्त्रीजनैरनुगायद्विश्वेषतः पुष्पिते वने ॥३  
अन्तः प्रविश्य गङ्गायामभोजवनराजिनि । चिक्रीडतुर्युवतिर्भिर्गजाविव करेणुभिः ॥४  
यदृच्छ्या च देवर्षिर्भगवांस्तत्र कौरव ! । अपश्यन्नारदो देवौ क्षीबाणौ समबुद्ध्यत ॥५  
तं दृष्ट्वा ग्रीडिता देव्यो विवस्त्राः शापशङ्किताः । वासांसि पर्यधुः शीघ्रं विवस्त्रौ नैव गुह्यकौ ॥६

लोकोने पशु सहेजं मणता नथी.<sup>२१</sup> पछी माता पशोदा धरना कामकाजमां लागी  
जतां बंधाएला प्रभु यमलाञ्जुन के जे पूर्वजन्ममां कुबेरज्ञना पुत्र यक्ष हता  
तेमने दीठा.<sup>२२</sup> पूर्वं नण्डुभर अने भणिश्रीव एवा नामथी प्रभ्यात थयेला अने  
मोटी लक्ष्मीवाणा बे कुबेरज्ञना पुत्र हता, तेओ लक्ष्मीना मदने लीधे नारदज्ञनो  
शाप लागवाथी वृक्षपशुं पाभ्या हता.<sup>२३</sup>

इति श्रीमद् महापुराणा भागवतना दशम ऋक्ष्यनो नवमो अध्याय संपूर्णः ।

## अध्याय १०

श्रीकृष्ण भगवाने यमलाञ्जुननो करेलो भोक्ष.

परीक्षित राजा पूछे छे- हे महाराज ! ऐ नण्डुभर अने भणिश्रीवने  
नारदज्ञये शाप दीधो तेनुं कारण कहो, ऐ लोकोअे क्युं भुंकुं काम कर्यु हतुं ? अने  
नारदज्ञये पोते महावैष्णव थर्हने कोप शा माटे कर्यो ?<sup>१</sup>

शुकदेवज्ञ कहे छे- रुद्रनुं अनुयरपशुं भणवाथी बहुजं गर्व पामेला ए बे  
कुबेरज्ञना पुत्रो छकेला थर्हने कैलास पर्वतना सुंदर उपवनमां गंगाज्ञने कांठे  
झरता हता. वारुणी नामनी भदिरा पीवाने लीधे तेओनां नेत्रो मदथी धूमतां  
हतां अने झूलवाडीमां झरता हता, त्यां तेओनी पाइण स्त्रीओ गाती आवती  
हती.<sup>२४</sup> कमणोना धणा वनवाणा गंगाज्ञना प्रवाहमां प्रवेश करीने हाथीओ  
जेम कीडा करे तेम तेओ जुवान स्त्रीओनी साथे कीडा करता हता.<sup>२५</sup> हे राजा ! त्यां  
देव ईर्याथी देवर्षि नारदज्ञ आवी यड्या, तेओने जोईने आ भन्ने मदोन्मत्त छे

तौ दृष्ट्वा मदिरामत्तौ श्रीमदान्धौ सुरात्मजौ । तयोरनुग्रहार्थाय शापं दास्यन्निदं जगौ ॥७  
नारद उवाच -

न ह्यन्यो जुषतो जोष्यान् बुद्धिभ्रंशो रजोगुणः । श्रीमदादाभिजात्यादिर्यत्र स्त्री द्यूतमासवः ८  
हन्यन्ते पशवो यत्र निर्दयैरजितात्मभिः । मन्यमानैरिमं देहमजरामृत्यु नश्वरम् ॥९  
देवसंज्ञितमप्यन्ते कृमिविद्भस्मसंज्ञितम् । भूतध्वक् तत्कृते स्वार्थं किं वेद निरयो यतः ॥१०  
देहः किमन्नदातुः स्वं निषेक्तुर्मातुरेव च । मातुः पितुर्वा बलिनः क्रेतुरग्नेः शुनोऽपि वा ॥११  
एवं साधारणं देहमव्यक्तप्रभवाप्ययम् । को विद्वानात्मसात् कृत्वा हन्ति जन्मून्तेऽसतः ॥१२ ॥  
असतः श्रीमदान्धस्य दारिक्रूं परमज्जनम् । आत्मौपम्येन भूतानि दरिद्रः परमीक्षते ॥१३ ॥

ऐम जाणी गया.<sup>४</sup> वस्त्र वगरनी स्त्रीओअे नारदज्ञने जोईने लाज आवतां तेमना  
शापनी बीकथी तुरत वस्त्र पहेर्यां, पशु नग्न उभेला ते बे जणाअे पहेर्यां नहीं.<sup>५</sup>  
मदिरा पीवाथी मदोन्मत्त बनेला अने लक्ष्मीना मदथी अंध बनेला ए बे  
देवकुमारोने जोई तेओना पर अनुग्रह करवा सारु शाप देवानो निश्चय करीने  
नारदज्ञ आ प्रमाणे बोल्या.<sup>६</sup> नारदज्ञ कहे छे प्रिय विषयोने सेवनार पुरुषने  
एक लक्ष्मीना मद विना कुलीनपशाथी के विद्वानपशाथी उत्पत्त थयेलो बीजा कोई  
पशु प्रकारनो मद अथवा रजोगुणानुं कार्यं बुद्धिने भ्रष्ट करनार नथी, पशु लक्ष्मीनो  
मद ज बुद्धिने भ्रष्ट करनार छे, के जे लक्ष्मीना मदनी साथे स्त्रीओनुं, जुगारनुं  
अने भदिरा पीवानुं व्यसन रहे छे.<sup>७</sup> आ क्षाणाभंगुर देहने लक्ष्मीना मदने लीधे  
अज्जर अने अमर माननार अजितेद्रिय लोको निर्दय थर्हने पशुओने मारे छे.<sup>८</sup>  
नरदेव अने भूदेव कहेवातो होय छतां पशु जे आ देह छेल्लीवारे सदी जाय तो  
कीडारूप, खवाई जाय तो विष्ठारूप, अने बाणीनाखवामां आवे तो भस्मरूप  
थनार छे, आवा नाशवंत देहने राजा राखवा सारु प्राणीओनो द्रोह करनार  
पुरुष पोताना मोक्षरूपी स्वार्थने शुं जाणे छे ? नथी ज जाणातो. केमके प्राणीओनो  
द्रोह करवाथी तो नरक ज मणे छे.<sup>१०</sup> वास्तविक रीते आ देह कोनो छे ? अनदातानो  
कहीअे तोपशु खोटुं नथी, पितानो कहीअे तोपशु खोटुं नथी, मातानो कहीअे  
तोपशु खोटुं नथी, कोई बणवान पुरुष दास करी ले तो तेनो छे ऐम कहेवामां  
पशु खोटुं नथी, वेचातो लेनारनो कहीअे तोपशु खोटुं नथी, छेल्लीवारे बाणी  
नाखे छे तेथी अग्निनो कहीअे तोपशु खोटुं नथी. अने समयपर झूतरां खाई  
जाय तेथी झूतरांनो कहीअे तोपशु खोटुं न कहेवाय.<sup>११</sup> आवी रीते धणानो  
सहीआरो देह के जेनी उत्पत्ति प्रकृतिथी छे अने नाश पशु प्रकृतिमां ज छे, तेने

યथા કણટકવિદ્વાઙ્મો જન્તોનેચીતિ તાં વ્યથામ् । જીવસામ્યં ગતો લિઙ્ગૈર્ન તથાવિદ્વકણ્ટક: । દરિદ્રો નિરહંસતમ્ભો મુક્ત: સર્વમદૈરિહ । કૃચ્છં યદૃચ્છ્યાડજનોતિ તદ્ધિ તસ્ય પરં તપ: ॥૧૫॥ નિત્યં ક્ષુલ્કામદેહસ્ય દરિદ્રસ્યાત્રકાઙ્ઘણ: । ઇન્દ્રિયાપણનુશુદ્ધનિ હિંસાપિ વિનિવર્તતે ॥૧૬॥ દરિદ્રસ્યૈવ યુજ્યને સાધવ: સમર્દીનઃ । સદ્ગ્રદ્ધિ: ક્ષિણોતિ તં તર્ષ તત આરાદ્વિશુદ્ધ્યતિ ॥૧૭॥ સાધૂનાં સમચિત્તાનાં મુકુન્દચરણૈવણામ् । ઉપેક્ષ્ય: કિં ધનસતમ્ભૈરસદ્વિરસદાશ્ર્યયૈ: ॥૧૮॥ તદહં મત્તયોર્મધ્વા વારુણ્યા શ્રીમદાશ્યો: । તમોમર્દ હરિદ્વામિ સ્તૈણયોરજિતાત્મનો: ॥૧૯॥ યદિમૌ લોકપાલસ્ય પુત્રૌ ભૂત્વા તમ:પ્લુતૌ । ન વિવાસસમાત્માનં વિજાનીત: સુદુર્મર્દૌ ॥૨૦॥ અતોર્હત: સ્થાવરતાં સ્થાતાં નૈવં યથા પુન: । સ્મૃતિ: સ્યાન્ત્રસાદેન તત્ત્રાપિ મદનુગ્રહાત ॥૨૧

પોતારૂપ માની કયો વિદ્વાન પ્રાણીઓને મારે? દેહાભિમાનથી હિંસા કરવી એતો મૂઢનું જ કામ છે.<sup>૧૨</sup> જે મૂઢ પુરુષ લક્ષ્મીના મદથી આંધળો થયેલો હોય તેને દારિદ્ર્ય જ ઉત્તમ અંજનરૂપ છે. કેમકે દરિદ્રી પુરુષ બીજા પ્રાણીઓને પોતા સરખા જ ગણે તેથી કોઈનો દ્રોહ કરે નહિ.<sup>૧૩</sup> એકવાર જેના શરીરમાં કાંટો લાગેલો હોય એ કદી પણ ઈચ્છતો નથી કે બીજાને પણ કાંટાની પીડા સહન કરવી પડે. કેમ કે મુખનું કરમાઈ જવું વગેરે ચિહ્નોથી એ સમજે છે કે સર્વે જીવોને સરખી પીડા થાય છે. પણ જેને કાંટો વાગ્યો જ ન હોય એ કદી પણ પીડાનું અનુમાન કરી શકતો નથી.<sup>૧૪</sup> સર્વ પ્રકારના મદથી મુક્ત અને અહંકાર વગરનો દરિદ્રી પુરુષ દેવ ઈચ્છાથી કષ્ટ પામે છે, તો તે કષ્ટ જ તેને મોટા તપત્રૂપ થાય છે.<sup>૧૫</sup> ભૂખથી દુબળા થયેલા અને અત્રને ઈચ્છતા દરિદ્રી પુરુષની ઈદ્રિયો નિર્બણ થઈ જાય છે અને તેની પછીવાડે હિંસા પણ બંધ પડે છે.<sup>૧૬</sup> સમદાચિત્વાળા સાધુપુરુષોનો સમાગમ પણ દરિદ્રીને જ થાય છે અને તેઓના સંગના પ્રભાવથી તેની તૃષ્ણા મટી જતાં તે તુરત જ શુદ્ધ થાય છે.<sup>૧૭</sup> સમદાચિત્વાળા અને ભગવાનના ચરણને ઈચ્છનારા સાધુ પુરુષોને દરિદ્રીજ વહાલા હોય છે, કેમકે ધનના અભિમાનને લીધે ખોટાં કાર્યમાં લાગી રહેલા નીચ લોકોને સાધુપુરુષો ઉપેક્ષા કરવા યોગ્ય જ માને છે, તેથી તે સાધુઓને અભિમાની પુરુષોનું કશું પ્રયોજન હોતું નથી.<sup>૧૮</sup> એટલા જ માટે આ બત્રે જણા વારુણી મહિરા પીવાથી મદોન્મત, લક્ષ્મીના મદથી આંધળા, સ્ત્રીલંપટ અને અજિતેન્દ્રિય છે, તેઓના અજ્ઞાને કરેલા મદને હું હરીશ.<sup>૧૯</sup> અજ્ઞાનથી વ્યાસ અને મદોન્મત આ બે જણા લોકપાળના પુત્ર થઈને પોતાના શરીરને નરન જાણતા નથી, તેથી સ્થાવરપણાને યોગ્ય છે, તેપ્રમાણે થવાથી ફરીવાર આવું કામ ન કરે. મારી કૃપાથી તે સ્થાવરપણાના અવતારમાં પણ પૂર્વ

વાસુદેવસ્ય સાન્નિધ્યં લબ્ધવા દિવ્યશરચ્છે । વૃત્તે સ્વર્લોક્તાં ભૂયો લબ્ધભક્તી ભવિષ્યતઃ ॥૨૨  
શ્રીશુક ઉવાચ -

એવમુક્ત્વા સ દેવર્ષિર્ગતો નારાયણાશ્રમમ् । નલકૂબરમणિગ્રીવાવાસતુર્યમલાર્જુનૌ ॥૨૩॥  
ત્રષ્ણેર્ભાગવતમુખ્યસ્ય સત્યં કર્તું વચો હરિ: । જગામ શનકૈસ્તત્ર યત્રાસ્તાં યમલાર્જુનૌ ॥૨૪॥  
દેવર્ષિર્મે પ્રિયતમો યદિમૌ ધનવાત્મજૌ । તત્થા સાધયિષ્યામિ યદ્વ ગીતં તમ્મહાત્મના ॥૨૫॥  
ઇત્યન્તરેણાર્જુનયો: કૃષણસ્તુ યમયોર્યયૌ । આત્મનિર્વેશમાત્રેણ તિર્યગતમુલૂખલમ् ॥૨૬॥  
બાલેન નિષ્કર્ષયતાન્વગુલૂખલં તદ્ દામોદરેણ તરસોત્કલિતાઙ્ગિબન્ધૌ ।  
નિષ્ઠેતત્તુ: પરમવિત્રમિતાતિવેપસ્કન્ધપ્રવાલવિટપૌ કૃતચણંશબ્દૌ ॥૨૭॥  
તત્ત્ર શ્રીયા પરમયા કકુભ: સ્ફુરન્તૌ સિદ્ધાવુપેત્ય કુજયોરિવ જાતવેદા: ।  
કૃષણ પ્રણાય શિરસાખિલલોકનાથં બદ્ધાઙ્જલી વિરજસાવિદમૂચ્ચતુઃ સ્મ ॥૨૮॥  
કૃષણ કૃષણ મહાયોર્ગિસ્ત્વમાદ્ય: પુરુષ: પર: । વ્યક્તાવ્યક્તમિદ્વ વિશ્વં રૂપં તે બ્રાહ્મણ વિદુ: ૨૯  
જન્મનું સ્મરણ રહેશે અને દેવતાઓનાં સો વર્ષ પૂરાં થયા પછી ભગવાનનું દર્શન  
પામીને પાછા દેવ થશે. દેવપણામાં પણ મારા અનુગ્રહથી તેઓને ભક્તિ પ્રાપ્ત  
થશે.<sup>૨૦-૨૨</sup>

શુકદેવજી કહે છે- આ પ્રમાણે કહીને તે નારદજી નારાયણના આશ્રમમાં ગયા. અને નળકૂબર તથા મણિગ્રીવ યમલાર્જુન થયા.<sup>૨૩</sup> વૈષ્ણવોમાં ઉત્તમ  
નારદજીનું વચન સાચું કરવા સારુ એ યમલાર્જુન જ્યાં છે ત્યાં ભગવાન ધીરે  
ધીરે પધાર્યા.<sup>૨૪</sup> નારદજી મને બહુજ વ્ખાલા છે, માટે એ મહાત્મા નારદજીએ આ  
બને કૂબરજીના પુત્ર વિષે જે કહું છે, તે હું તે પ્રમાણે જ સાચું કરીશ. એવા  
વિચારથી શ્રીકૃષ્ણ ભગવાન તે બે યમલાર્જુનના મધ્યમાંથી પ્રવેશયા. પોતાના પ્રવેશ  
માત્રથી ખાંડણિયો આડો થઈ ગયો. પછી જેમના ઉદ્રમાં દોરદું બાંધેલું છે એવા  
તે બાળક શ્રીકૃષ્ણ ખાંડણિયાને જોરથી ખેંચ્યો કે તરત જ એ વૃક્ષનાં મૂળ ઊખડી  
ગયાં. અને શ્રીકૃષ્ણ ભગવાનના અત્યંત પરાક્રમને લીધે થડ, શાખા અને પાંદાં  
કંપવા લાગ્યાં, ભારે ભયંકર કડાકો થયો અને તરત જ એ બે જાડ ધરતી પર  
પડ્યાં.<sup>૨૫-૨૭</sup> એ બે જાડમાંથી જેમ મૂર્તિમાન અગ્નિ નીકળે તેમ બે દેવપુરુષો  
નીકળ્યા, મદ રહિત થયેલા અને જેની કાંતિથી દિશાઓ શોભી રહી હતી. એવા  
એ બત્રે હાથ જોડી, શ્રીકૃષ્ણ ભગવાનની પાસે આવી, પ્રણામ કરીને આ પ્રમાણે  
સ્તુતિ કરવા લાગ્યા.<sup>૨૮</sup>

નળકૂબર અને મણિગ્રીવ ભગવાનની સ્તુતિ કરે છે- હે કૃષ્ણ! હે કૃષ્ણ! હે

त्वमेकः सर्वभूतानां देहास्वात्मेन्द्रियेश्वरः । त्वमेव कालो भगवान् विष्णुरव्यय ईश्वरः ॥३०॥  
 त्वं महान् प्रकृतिः सूक्ष्मा रजः सत्त्वतमोमयी । त्वमेव पुरुषोऽध्यक्षः सर्वक्षेत्रविकारवित् ॥३१॥  
 गृह्यमाणैस्त्वमग्राहो विकारैः प्राकृतैर्गुणैः । को चिह्नार्हति विज्ञातुं प्राक्सिद्धं गुणसंवृतः ॥  
 तस्मै तु भूयं भगवते वासुदेवाय वेधसे । आत्मद्योतगुणैश्छन्नमहिम्ने ब्रह्मणे नमः ॥३३॥  
 यस्यावतारा ज्ञायने शरीरेष्वशरीरिणः । तैसैरतुल्यातिशयैवीर्येऽद्विष्वसंगतैः ॥३४॥  
 स भवान् सर्वलोकस्य भवाय विभवाय च । अवतीर्णोऽशभागेन साम्प्रतं पतिराशिषाम् ॥  
 नमः परमकल्याण! नमः परममङ्गल! । वासुदेवाय शान्ताय यदूनां पतये नमः ॥३६॥  
 अनुजानीहि नौ भूमंस्तवानुचरकिङ्ग्रौ । दर्शनं नौ भगवत् ऋषेरासीदनुग्रहात् ॥३७॥  
 वाणी गुणानुकथने श्रवणौ कथायां हस्तौ च कर्मसु मनस्तव पादयोर्नः ।  
 स्मृत्यां शिरस्तव निवासजगत्प्रणामे दृष्टिः सतां दर्शनेऽस्तु भवत्तनूनाम् ॥३८॥

मोटा योगी ! तमे सर्वना आदि परम पुरुष छो. स्थूण सूक्ष्मरूप आ सधूणुं  
 जगत तमारुं शरीर छे ऐम ब्रह्मवेताओ जाणे छे.<sup>२८</sup> सर्व प्राणीओना देह,  
 प्राण, अहंकार अने ईन्द्रियोना नियंता तमे ऐक छो. अविनाशी अने ईश्वर  
 विष्णु तमे छो. तेथी जे काण छे ते तमारी लीला छे.<sup>२९</sup> महतत्वरूप तमे छो,  
 २४, सत्त्व अने तमोगुणमय साक्षात् प्रकृति ए तमारुं शरीर छे, सर्वना अध्यक्ष  
 अने शरीरोना विकारोने जाणनारा पुरुष तमे छो.<sup>३०</sup> ईन्द्रियोथी ग्रहण करवामां  
 आवता प्रकृतिना पदार्थोथी तमारुं ग्रहण थतुं नथी. आ जगतनी उत्पत्ति पहेलां  
 ज स्वतःसिद्धप्रणाथी रहेला आपने देहादिकथी वींटाएलो कोणा जाणी शके?<sup>३२</sup>  
 वासुदेव, सर्वना कर्ता अने पोते प्रकाश करेला गुणोथी जेनुं स्वरूप ढंकाई रह्युं छे,  
 ऐवा परब्रह्मने नमस्कार करीऐ छीऐ.<sup>३३</sup> जे आप सर्व शरीरोमां रहेला छो,  
 छितां शरीरना संबंधथी रहित छो. तमारा अवतारो, बीजा प्राणीओथी न थई  
 शके ऐवां अने जेमना पराकमनी समान बीजा पराकमो न होय तथा अधिक  
 पश न होय, ऐवा पराकमो उपरथी जाणवामां आवे छे.<sup>३४</sup> सर्वलोकोने कल्याण  
 अने मोक्ष आपवा भाटे, सर्व सुखोना अधिपति आप हमणां बणरामनी साथे  
 अवतर्या छो.<sup>३५</sup> हे परमकल्याण रूप ! हे परम मंगणरूप ! वासुदेव, शांत अने  
 यादवोना पति ऐवा तमोने वारंवार प्रणाम करीऐ छीऐ.<sup>३६</sup> हे प्रभु ! अमे  
 तमारा दासानुदास छीऐ, अमने आज्ञा करो. अमोने नारदज्ञना अनुग्रहथी  
 आपनुं दर्शन थयुं छे.<sup>३७</sup>

अमारी वाणी आपना गुणना वर्णनमां तत्पर रहे, कान आपनी कथा

श्रीशुक उवाच -

इत्थं संकीर्तिस्ताभ्यां भगवान् गोकुलेश्वरः । दाम्ना चोलूखले बद्धः प्रहसन्नाह गुह्यकौ ।३९  
 श्रीभगवानुवाच -

ज्ञातं मम पुरैवैतद्विषिणा करुणात्मना । यच्छ्रीमदाध्ययोर्वार्गिभर्विभ्रंशोऽनुग्रहः कृतः ॥४०  
 साधूनां समचित्तानां सुतरां मत्कृतात्मनाम् । दर्शनान्नो भवेद्बृन्थःपुंसोऽक्षणोः सवितुर्यथा ॥४१

श्रीशुक उवाच -

तद् गच्छत्तं मत्परमौ नलकूबर! सादनम् । सज्जातो मयि भावो वामीप्सितः परमोऽभवः ॥४२  
 इत्युक्तौ तौ परिक्रम्य प्रणाम्य च पुनः पुनः । बद्धोलूखलमार्मन्य जग्मतुर्दिशमुत्तराम् ॥४३

इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्द्धे

नारदशापो नाम दशमोऽध्यायः ॥१९०॥

सांभणवामां, हाथ आपनी सेवा करवामां, मन आपना यरणाना स्मरणमां, मस्तक आपना निवासरूप जगतने प्रणाम करवामां अने दृष्टि आपना शरीररूप सत्पुरुषोनां दर्शनमां तत्पर रहे.<sup>३८</sup> शुकदेवज्ञ कहे छे- दोरडांथी खांडणियामां बंधायेला गोकुलेश्वर भगवाने आ प्रमाणे तेओनी स्तुति सांभणी, हसीने भगवान तेओने कहेवा लाग्या के- तमे लक्ष्मीना मदथी अंध थया हता तेथी दयाणु नारदज्ञाए पोतानी वाणीथी लक्ष्मीनो मद टाणी नाभवारूप अनुग्रह कर्यो हतो, ए प्रथमथी ज मारा जाणवामां हतुं.<sup>३९-४०</sup> सूर्यना दर्शनथी जेम नेत्रने बंधन रहे नहि, तेम स्वधर्ममां वर्तनार, ब्रह्मवेता अने तेओमां पण वणी मारामां चितानुं अर्पण करनार महात्माओना दर्शनथी, पुरुषने बंधन रहे ज नहीं.<sup>४१</sup> तो हवे हे नणकूबर ! तमे मारा परायण थईने तमारे ठेकाणे जाओ. तमने संसारनुं बंधन मटाइनारो ऐवो मारामां प्रेम थयो छे.<sup>४२</sup>

शुकदेवज्ञ कहे छे- खांडणियाथी बंधायेला भगवाने आ प्रमाणे कह्युं, ऐटले ते नणकूबर अने भणिशीव, भगवानने प्रदक्षिणा करी, वारंवार प्रणाम करी, आज्ञा माणीने उत्तर दिशामां गया.<sup>४३</sup>

इति श्रीमद्भागवतपुराण भागवतना दशम स्कन्धनो दशमो अद्याय संपूर्णः १०

## अथेकादशोऽध्यायः (७७)

श्री शुक उवाच

गोपा नन्दादयः श्रुत्वा द्वुमयोः पततो रवम् । तत्राजग्मुः कुरुश्रेष्ठ! निर्घातभयशङ्किताः ॥१  
 भूम्यां निपतितौ तत्र ददृशुर्यमलार्जुनौ । बभ्रमुस्तदविज्ञाय लक्ष्यं पतनकारणम् ॥२  
 उलूखलं विकर्षन्तं दाम्ना बद्धं च बालकम् । कस्येदं कुत आश्र्यमुत्यात इति कातरा ॥३  
 बाला ऊचुरनेनेति तिर्यग्गतमुलूखलम् । विकर्षता मध्यगेन पुरुषावप्यचक्षमहि ॥४  
 न ते तदुक्तं जगृहुन् घटेतेति तस्य तत् । बालस्योत्पाटनं तर्वोः केचित् सन्दिग्धचेतसः ॥५  
 उलूखलं विकर्षन्तं दाम्ना बद्धं स्वमात्मजम् । विलोक्य नन्दः प्रहसद्वनो विमुमोच ह ॥६  
 गोपीभिः स्तोभितोऽनृत्यद् भगवान् बालवत् क्रचित् । उद्गायति क्रचिमुग्धस्तद्वशो दारुयन्त्रवत्  
 बिभर्ति क्रचिदाज्ञसः पीठकोन्मानपादुकम् । बाहुष्ठेषं च कुरुते स्वानां च प्रीतिमावहन् ॥८  
 दर्शयंस्तद्विदां लोक आत्मनो भृत्यवश्यताम् । ब्रजस्योवाह वै हर्षं भगवान् बालचेष्टितैः ॥९

## अध्याय ७७

श्रीकृष्ण भगवाने वत्सासुर तथा अकासुरनो भोक्त्र कर्योः

शुकदेवज्ञ कुहे छे- हे राजा ! जाड पडवानो शब्द सांभणीने वजपातना भयथी भयभीत थयेला नंदादिक गोवाणियाओ त्यां आव्या ।<sup>१</sup> धरती पर पडेलां यमलार्जुनने जोईने तेओने पडवानुं कारण प्रत्यक्ष छतां पश तेन नहीं जाणीने अभी गया ।<sup>२</sup> दोरडांथी बंधाअेला बाणकने खांडणियो खेंयता दीठा तोपश आ कोषे कर्यु ? शाथी थयुं ? आश्र्य थयुं ! उत्पात थयो ऐम भय पामीने भमवा लाग्या ।<sup>३</sup> छोकराओये कहुं के- आ कृष्ण वयमां आवी जतां तेषो आडा थयेला खांडणियाने खेंयीने जाड पाडी नाख्यां अनेते जाडमांथी बे पुरुष नीक्ष्या तेओने पश अमे दीठा ।<sup>४</sup> गोवाणियाओमां केटलाअेक तो आ बाणक जाड उभेडी नाखे ए संभवे ज नहीं, ऐम गणीने ते छोकराओनुं कहेवुं मान्युं नहीं अने मनमां संदेह थयो ।<sup>५</sup> दोरडांथी बंधाअेला अने खांडणियाने घसडता पोताना पुत्रने जोईने नंदराये हसते मोठे तेमने छोड्या ।<sup>६</sup> गोपीओना झोसलाववाथी कोईक समये बाणकनी पेठे अने अणसमजुनी पेठे भगवान नायता हता, कोई समये गाता अने कोई समये लाकडाना यंत्रनी पेठे तेओना स्वाधीनमां ज रहेता हता ।<sup>७</sup> कोई समये गोपीओये आशा करवाथी पाटला, पाली, पवालां अने चाखडी उपाडता हता, तेमज्ज पोताना भक्त व्रजजनोने राज्ञ करवा सारु हाथ हलावता हता ।<sup>८</sup>

क्रीणीहि भोः फलानीति श्रुत्वा सत्वरमच्युतः । फलार्थी धान्यमादाय ययौ सर्वफलप्रदः ॥  
 फलविक्रियणी तस्य च्युतधान्यं करद्वयम् । फलैरपूरयद् रत्नैः फलभाण्डमपूरि च ॥११  
 सरितीरगतं कृष्णं भग्नार्जुनमथाह्यत् । रामं च रोहिणी देवी क्रीडन्तं बालकैर्भृशाम् ॥१२  
 नोपेयातां यदाऽऽहूतौ क्रीडासङ्गेन पुत्रकौ । यशोदां प्रेषयामास रोहिणी पुत्रवत्सलाम् ॥१३  
 क्रीडन्तं सा सुतं बालैरतिवेलं सहाग्रजम् । यशोदाजोहवीत् कृष्णं पुत्रस्तेहस्तुतस्तनी ॥१४  
 कृष्ण ! कृष्णारविन्दाक्ष तात एहि स्तनं पिब । अलं विहारैः क्षुक्षान्तः क्रीडाश्रान्तोऽसि पुत्रक ! ।  
 हे रामागच्छ ताताशु सानुजः कुलनन्दन ! । प्रातरेव कृताहारस्तद् भवान् भोक्तुमर्हति ॥१६  
 प्रतीक्षते त्वां दाशार्हं भोक्ष्यमाणो व्रजाधिपः । एह्यावयोः प्रियं धेहि स्वगृहान् यात बालकाः ।  
 भगवाननुं माहात्म्यं जाणनारा पुरुषोने हुं भक्तवशं छुं, ऐम देखाउता भगवान्  
 पोतानी बालयेष्टाओथी व्रजने आनन्द आपता हता ।<sup>९</sup> एक दिवस कोई फण  
 वेचनारी स्त्रीये उंचेथी साई कर्यो के “कोई फण लो फण” आवुं सांभणतानी  
 साथे ज सर्व कर्म फलप्रद भगवान् अच्युत (कृष्ण) फण भरीदवा माटे पोताना  
 नाना ऐवा खोबामां अनाजना दाणा लईने दोड्या ।<sup>१०</sup> तेमणे खोबामां लीघेलुं  
 अनाज तो रस्तामां ज वेराई गयुं पश ते फण वेचनारी स्त्रीये तेमना भन्ने हाथने  
 फणोथी भरी दीधा. आ बाजु भगवाने पश तेनो खाली थयेलो टोपलो रत्नोथी  
 भरी दीधो ।<sup>११</sup> पछी एक दिवस ते अर्जुनवृक्षने भांगनारा श्रीकृष्ण अने  
 श्रीबलरामज्ञ बाणकोनी साथये रमतां रमतां यमुनाने किनारे पहोंची गया.  
 त्यारे देवी रोहिणी तेमने पछा घोर बोलावी लाववा “ऐ राम ! !! ऐ कृष्ण !!!  
 जलदी आवो” ऐम उंचे अवाजे पोकारवा मांड्या ।<sup>१२</sup> रोहिणीये आम बोलाव्या  
 छतां ते श्रीबलराम अने श्रीकृष्ण रमवामां लाणी गया होवाथी ज्यारे न आव्या  
 त्यारे तेषो पुत्र वात्सल्य स्नेहथी यशोदाज्ञने तेमने बोलाववा मोकल्या ।<sup>१३</sup> श्रीकृष्ण  
 अने बलरामज्ञ बाणकोनी साथे घाणी वारथी रमता हता यशोदाज्ञये जैर्ने  
 तेमने साई कर्यो. ते समये पुत्र उपर वात्सल्य भावने लीघे यशोदाज्ञा स्तनोमांथी  
 दूध टपकवा लाग्युं ।<sup>१४</sup> यशोदाये पोकार कर्यो “कृष्ण ! बेटा कृष्ण ! कमणनयम  
 ! प्यारा कृष्ण !” जलदी चालो, अने स्तनपान करी लो (दूध पीओ) रमीने थाकी  
 गया हशो. बेटा ! हवे रमवानुं छोडो जुओ ते खरा, तमे भन्ने भूम्या अने दुर्बण  
 देखाओ छो ।<sup>१५</sup> कुलनन्दन बेटा राम ! तारा नाना भाई कृष्णने लईने जल्दी  
 चालो. जुओ सवारे तमे नास्तो कर्यो हतो तो अत्यारे तमारे भन्ने ऐ जमी लेवुं  
 जोईअ. <sup>१६</sup> दाशार्ह ! बेटा राम ! प्रजराज तमारा पिता नंदनज्ञ जमवा माटे

ધૂલિધૂસરિતાઙ્ગસ્તવं પુત્ર! મજ્જનમાવહ। જન્મક્ષમદ્ય ભવતો વિપ્રેભ્યો દેહિ ગા: શુચિઃ ॥૧૮  
પશ્ય પશ્ય વયસ્યાંસે માતૃમૃષ્ણન् સ્વલંકૃતાન् । ત્વં ચ સ્ત્રાત: કૃતાહારો વિહરસ્વ સ્વલંકૃત: ૧૯  
ઇથં યશોદા તમશેષોખરં મત્વા સુતં સ્નેહનિબદ્ધધીર્ણપ! ।

હસ્તે ગૃહીત્વા સહરામમચ્યુતં નીત્વા સ્વવાટં કૃતવત્યથોદયમ् ॥૨૦

ગોપવૃદ્ધા મહોત્પાતાનુભૂય બૃહદ્દને । નન્દાદય: સમાગમ્ય બ્રજકાર્યમમન્ત્રયન् ॥૨૧  
તત્ત્રોપનન્દનામાઽહ ગોપો જ્ઞાનવયોજધિક: । દેશકાલાર્થતત્ત્વજ્ઞ: પ્રિયકૃદ્રામકૃષ્ણયો: ૨૨  
ઉત્થાતવ્યમિતોઽસ્માભિર્ગોકુલસ્ય હતૈષિભિ: । આયાન્ત્યત્ર મહોત્પાતા બાલાનાં નાશહેતવ: ।  
મુક્ત: કથચિદ્રાક્ષસ્યા બાલદ્વ્યા બાલકોછ્યસૌ । હેરનુગ્રહન્નુનમનશ્રોપરિ નાપતત્ ॥૨૪  
ચત્રવાતેન નીતોઽયં દૈત્યેન વિપદ્ં વિયત્ । શિલાયાં પતિતસત્ત્ર પરિત્રાત: સુરેશ્વરૈ: ૨૫  
યત્ત્ર પ્રિયેત દુમયોરન્તરં પ્રાપ્ય બાલક: । અસાવન્યતમો વાપિ તદપ્યચ્યુતરક્ષણમ् ॥૨૬

બેસી ગયા છે અને તમારી બસ્તેની રાહ જુએ છે. ચાલો અમને સૌને ખુશી કરો.  
છોકરાઓ! હવે તમે પણ સહુ સહુને ઘેર જાઓ. <sup>૧૦</sup> પુત્ર! દેખ તારાં પ્રત્યેક અંગ  
ધૂળથી ખરડાયેલાં છે. ચાલો જલ્દી સ્નાન કરી લો. આજ તારું જન્મ નક્ષત્ર છે.  
પવિત્ર પણો બ્રાહ્મણોને ગાયોનું દાન કરો. <sup>૧૧</sup> જુઓ અમારા સાથી મિત્રોને તેમની  
માતાઓએ નવડાવી - ધોવડાવીને સારા વસ્ત્ર અલંકારોથી સજાવ્યા છે. હવે તમે  
પણ નહાઈ-ધોઈ ખાઈ-પીઈને વસ્ત્રાલંકારોથી સુસજ્જ થઈને રમવા જાજો. <sup>૧૨</sup>  
હે પરીક્ષિત! માતા યશોદાનું મન પ્રેમના બંધનથી બંધાયેલું હતું, તેઓ આ રીતે  
સમગ્ર જગતના શિરોમણિ ભગવાનને પોતાના પુત્ર માનતા હતા. એટલે ઉપર  
કલ્યા પ્રમાણે બોલીને રામ તથા કૃષ્ણનો એક એક હાથ પોતાના એક એક હાથમાં  
પકડીને પોતાને ઘેર લઈ આવ્યાં. પછી તેણે પોતાના પુત્રના શુભોદયને માટે જે  
કંઈ કરવાનું હતું તે બધું ખૂબજ પ્રેમથી કર્યું. <sup>૧૦</sup> નંદરાય આદિ વૃદ્ધ ગોવાળિયા  
ગોકુળમાં મોટા ઉત્પાત થતા જોઈ, ભેળા થઈને પ્રજના હિતનો વિચાર કરવા  
લાગ્યા. <sup>૧૧</sup> તેઓમાં ઉપનંદ નામનો એક ગોવાળ કે જે દેશકાળના તત્ત્વને જ્ઞાનનારો,  
જ્ઞાન તથા અવસ્થાથી મોટો અને બળભદ્ર તથા શ્રીકૃષ્ણનું પ્રિય કરનારો હતો, તે  
બોલ્યો કે- આપણને ગોકુળનું હિત કરવાની ઈચ્છા હોય તો અહીંથી ચાલ્યા જવું  
જોઈએ, કેમકે બાળકોનો નાશ કરે એવા મોટા ઉત્પાતો અહીં આવે છે. <sup>૧૨-૧૩</sup>  
બાળકોને મારનારી રાક્ષસીના હાથથી આ બાળક દૈવ ઈચ્છાથી બચ્યો છે. વળી  
ગાડું માથે ન પડયું એ પણ ભગવાનના અનુગ્રહથી જ. <sup>૧૪</sup> એક દૈત્ય  
વંટોળિયાનારૂપથી આ શ્રીકૃષ્ણને નિરાધાર આકાશમાં લઈ ગયો હતો અને પાછો

યાવદैત્યાતિકોરણી બ્રજં નાભિભવેદિત: । તાવદ્ર બાલાનુપાદાય યાસ્યામોડય્યત્ર સાનુગા: ।  
વનં વૃન્દાવનં નામ પશ્વયં નવકાનનમ્ । ગોપગોપીગવાં સેવ્યં પુણ્યાદ્રિતૃપણીરુધમ્ ॥૨૮  
તત્ત્રાદ્યૈવ યાસ્યામ: શકટાન્ યુડ્ક મા ચિરમ્ । ગોધનાન્યગ્રતો યાન્તુ ભવતાં યદિ રોચતે ॥  
તચ્છુત્વૈકધિયો ગોપા: સાધુ સાધ્વિતિ વાદિનઃ ।

બ્રજાન્ સ્વાન્ સ્વાન્ સમાયુજ્ય યયુ રૂઢપરિચ્છદા: ॥૩૦॥

વૃદ્ધાન બાલાન્ સ્વિયો રાજન્ સર્વોપકરણાનિ ચ । અનઃસ્વારોપ્ય ગોપાલા યત્તા આત્તશરાસના: ।  
ગોધનાનિ પુરસ્કૃત્ય શૃઙ્ગાળયાપૂર્ય સર્વતઃ: । તૂર્યધોષેણ મહતા યયુ: સહપુરોહિતાઃ ॥૩૨  
ગોપ્યો રૂઢપરથા નૂલકુચકુ ઙુમકાન્તયઃ । કૃષ્ણાલીલા જગુ: પ્રીતા નિષ્કકણન્યઃ સુવાસસ: ।  
તથા યશોદારોહિણ્યાવેકં શકટમાસ્થિતે । રેજતુ: કૃષ્ણારામાભ્યાં તત્કથાશ્રવણોત્સુકે ॥૩૪  
વૃન્દાવનં સંપ્રવિશ્ય સર્વકાલસુખાવહમ્ । તત્ર ચક્રવ્રજાવાસં શકટારધ્યચન્દ્રવત્ ॥૩૫

શિલા ઉપર પડ્યો, ત્યાં પણ આ કૃષ્ણની મોટા દેવતાઓએ રક્ષા કરી છે. <sup>૨૫</sup>  
જાડની વચમાં આવી જતાં પણ આ અથવા બીજો કોઈ બાળક મરણ પામ્યો નહીં,  
એ પણ ભગવાને જ રક્ષા કરી છે. <sup>૨૬</sup> માટે હવે બીજો કોઈ ઉત્પાતી અનર્થ પ્રજમાં  
આવે એ પહેલાં બાળકોને લઈને પરિવાર સહિત આપણે બીજે ઠેકાણે ચાલ્યા  
જવું જોઈએ. <sup>૨૭</sup> વૃન્દાવન નામનું વન પશુઓને અનુકૂળ અને ગોવાળિયા ગોપીઓ  
તથા ગાયોએ સેવવા જેવું છે. એમાં પર્વત, ખડ અને લતાઓ પણ સારાં છે, તેથી  
એ વૃન્દાવનમાં આજે જ જવું જોઈએ. માટે તમારી સૌની રૂચિ હોય તો તરત  
ગાડાં જોડો અને ગાયોના ધણને આગળ ચાલતાં કરો. <sup>૨૮-૨૯</sup> આ વાત સાંભળી  
એકમત થયેલા ગોવાળિયાઓ સારું એમ બોલી પોતપોતાનાં ગાડાં જોડી તથા  
તેઓ પર સરસામાન ચઢાવી ચાલ્યા. <sup>૩૦</sup> વૃદ્ધ, બાળકો અને સ્ત્રીઓને ગાડાંમાં  
બેસાડી તથા સર્વ સરસામાનને ગાડાંઓમાં ભરી સાવધાન અને ધનુષ જેમણે  
હાથમાં લીધાં હતાં, એવા ગોવાળો ગાયોના ધણને આગળ કરી, ચારેકોર  
શીંગડીઓ વગડતા અને તુરીના શબ્દ કરતા કરતા વૃન્દાવનમાં ગયા. <sup>૩૧-૩૨</sup>  
ગાડાંઓમાં બેઠેલી, સ્તન ઉપર લગાવેલાં નવાં કેસરથી શોભતી, સારાં વખ્તવાળી  
અને જેઓએ ગળામાં પદક નામના આભૂષણો પહેર્યા હતાં, એવી ગોપીઓ  
આનંદથી ભગવાનની લીલાઓનું ગાયન કરતી હતી. <sup>૩૩</sup> ભગવાન અને  
બળભદ્રની સાથે એક ગાડાંમાં બેઠેલી અને પુત્રની વાતો સાંભળવામાં તત્પર  
રહેલી યશોદા અને રોહિણી પોતાના પુત્રોને લીધે શોભતી હતી. <sup>૩૪</sup> જે વૃન્દાવન  
સર્વકાળમાં સુખદાયી છે, તેમાં પ્રવેશ કરીને ત્યાં ગાડાંઓ વતે અરધા ચંદ્રમાના

वृन्दावनं गोवर्धनं यमुनापुलिनानि च । वीक्ष्यासीदुत्तमा प्रीती राममाधवयोर्नैप् ! ॥३६  
एवं व्रजौकसां प्रीतिं यच्छन्तौ बालचेष्टैः । कलवाक्यैः स्वकालेन वत्सपालौ बभूवतुः ॥  
अविदूरे व्रजभुवः सह गोपालदारकैः । चारयामासतुर्वत्सान् नानाक्रीडापरिच्छदौ ॥३८  
क्रचिद् वादयतो वेणुं क्षेपणैः क्षिपतः क्रचित् । क्रचित् पादैः किङ्गिणीभिः क्रचित् कृत्रिमगोवृषैः  
वृषायमाणौ नर्दन्तौ युयुधाते परस्परम् । अनुकृत्य रुतैजन्मूंश्वेरतुः प्राकृतौ यथा ॥४०  
कदाचिद् यमुनातीरे वत्सांश्वारयतो स्वकैः । वयस्यैः कृष्णबलयोर्जिधां सुर्दैत्य आगमत् ॥४१  
तं वत्सस्तु पिण्ठं वीक्ष्य वत्सयूथगतं हरिः । दर्शयन् बलदेवाय शनैर्मुग्ध इवासदत् ॥४२  
गृहीत्वापरपादाभ्यां सहलाङ्गूलमच्युतः । श्वामयित्वा कपित्थाग्ने प्राहिणोद् गतजीवितम् ।

स कपित्थैर्महाकायः पात्यमानैः पपात ह ॥४३

तं वीक्ष्य विस्मिता बाला: शशंसुः साधु साधिवति । देवाश्च परिसन्तुष्टा बभूवुः पुष्पवर्षिणः ॥  
तौ वत्सपालकौ भूत्वा सर्वलोकैकपालकौ । स प्रातराशौ गोवत्सांश्वारयन्तौ विचरेतुः ॥४५

जेवो व्रजनो आवास कर्यो ॥४५ ते राजा ! वृन्दावन, गोवर्धन अने यमुनाज्ञना  
कंठाओ ज्ञेईने बणभद्र अने श्रीकृष्णने बहु ज आनंद थयो ॥४६ आ प्रमाणे  
बाणलीलाथी अने मनोहर वाक्योथी व्रजवासीओने प्रीति उपजावता बणभद्र  
अने श्रीकृष्ण योग्य काणे वाघरडांओने चारावता थया ॥४७ रमतनां अनेक साधनो  
राखता ए बाणको बीज बाणकोनी साथे व्रजथी थोडेक छेटे वाघरडां चारवा  
लाग्या ॥४८ कोई समये वेणुं वगाडता हता, कोई समये भीलां अने आमणां आहि  
पदार्थोने झेंकता हता । कोई समये धुघरीओवाणा पगथी प्रहार करता हता अने  
कोई समये छोकराओज धाबणा ओढीने बणद थता हता, आ रीते रमता हता ॥४९  
कोई समये बलराम अने श्रीकृष्ण पश्च बणद जेवा थई नाढ करतां करतां  
सामसामा वढता हता । कोई समये हंस अने भयूरादिक प्राणीओना शब्दथी  
चाणा पाडीने प्राकृत बाणकोनी पेठे फरता हता ॥५० एक समये ए श्रीकृष्ण अने  
बणभद्र पोताना भित्रोनी साथे यमुनाज्ञने कांठे वाघरडां चारता हता, त्यां तेओने  
मारवा सारु देत्य आव्यो ॥५१ वाघरडानुं रूप धारण करीने वाघरडाना टोणामां  
भणी गयेला ते देत्यने ज्ञेई, बणभद्रने देखाउता भगवान अज्ञानीनी पेठे धीरे  
धीरे तेनी पासे आव्या ॥५२ भगवाने अनेमां पूछडानी साथे पाघला पग पकडी,  
झेरवी झेरवीने प्राण काढी नाखवा तेने कोठना झाडमां पछाड्यो, तेथी कोठ पडवा  
लाग्यां अने तेओनी साथे भोटी कायावाणो ए देत्य पश्च पउच्यो ॥५३ ए देत्यने  
ज्ञेई विस्मय पामेला बाणको “वाह वाह” कुहेवा लाग्यां अने बहु ज राजा

स्वं स्वं वत्सकुलं सर्वे पाययिष्यन्त एकदा । गत्वा जलाशयाभ्याशं पाययित्वा पपुर्जलम् ॥  
ते तत्र ददृशुर्बाला महासत्त्वमवस्थितम् । तत्र सुर्वज्ञनिर्भिन्नं गिरे: शृङ्गिमव च्युतम् ॥४७  
स वै बको नाम महानसुरो बकस्त्रपथृक् । आगत्य सहसा कृष्णं तीक्ष्णतुण्डोऽग्रसद् बली ॥  
कृष्णं महाबकग्रस्तं दृष्ट्वा रामादयोऽर्थकाः । बभूवुरन्द्रियाणीव विना प्राणं विचेतसः ॥४९  
तं तालमूलं प्रदहन्तमग्निवद् गोपालसूनुं पितरं जगद्गुरोः ।  
चच्छर्द सद्योऽतिरुषाक्षतं बकस्तुपडेन हन्तुं पुनरभ्यपद्यत ॥५०॥  
तमापतन्तं स निगृह्य तुण्डयोर्देवं भर्या बकं कंससखं सतां पतिः ।  
पश्यत्सु बालेषु ददार लीलया मुदावहो वीरणवद् दिवौकसाम् ॥५१॥  
तदा बकारिं सुरलोकवासिनः समाकिरन् नन्दनमल्लिकादिभिः ।  
समीडिरे चानकशङ्खसंस्तवैस्तद् वीक्ष्य गोपालसुता विसिस्मिरे ॥५२॥  
मुक्तं बकास्यादुपलभ्य बालका रामादयः प्राणमिवैन्द्रियो गणः ।  
स्थानागतं तं परिरभ्य निर्वताः प्रणीय वत्सान् व्रजमेत्य तज्जगुः ॥५३॥

थयेला देवताओ पुष्पनी वृष्टि करवा लाग्या ॥५४ सर्वलोकोना मुख्य पालक ए बे  
भाईओ वाघरडांओना पालक थईने, प्रातः काणनुं जमण साथे लई,  
वाघरडांओने चारता चारता फरता हता ॥५५ एक दिवसे सर्वे लोको पोतपोतानां  
वाघरडांनां टोणांने पाणी पावा सारु जणाशयनी पासे गया अने त्यां  
वाघरडांओने पाणी पाईने पोते पाणी पीता हता ॥५६ ए बाणको ए ते स्थणमां  
वज्ञी भेदाईने जाणे पर्वतनुं शिखर पडेलुं होय, अेवुं एक मोटुं प्राणी दीकूं ॥५७  
ए मोटो बगलानारुपने धारण करनारो बकासुर हतो । तीभी चांच्यवाणो ए  
बणवान बकासुर आवीने तरत भगवानने गणी गयो ॥५८ श्रीकृष्णने मोटा  
बगलाए गणेला ज्ञेईने बणभद्रादिक बाणको प्राण विना ईंद्रियोनी पेठे जड  
थई गया ॥५९ नंदरायना पुत्र के जे ध्रस्त्राना पश्च पिता हे, एवा श्रीकृष्णो अग्निनी  
पेठे बकासुरनुं ताणवुं बाणवा मांडयुं, तेथी बकासुरे तेमने ओडी काढ्या, पश्च  
पाणी बहु कोधने लीधे बकासुर तेमने चांच्यथी मारवा आव्यो ॥६० सत्पुरुषोना  
पति अने देवताओने आनंद आपनार भगवानने चांच्यथी मारवा आवता कंसना  
भित्र बकासुरने तेनी चांच्यना बे भागोमां पकडी, बीज बाणकोना देखतां ज  
लीलामात्रथी धासनी सणीनी पेठे चीरी नाप्यो ॥६१ ए समयमां स्वर्गना रहेवासी  
देवताओ बकासुरने मारनार भगवानने नंदनवननां मल्लिका आहिनां पुष्पोथी  
वधाववा लाग्या, अने दुंदुभि, शंखनाद तथा स्तोत्रोथी स्तुति करवा लाग्या, के जे

श्रुत्वा तद् विस्मिता गोपा गोप्यश्चातिप्रियादृताः । प्रेत्यागतमिवौत्सुक्यादैक्षन्त तृष्णितेक्षणाः ॥  
अहो बतास्य बालस्य बहवो मृत्यवोऽभवन् । अप्यासीद् विप्रियं तेषां कृतं पूर्वं यतो भयम् ॥  
अथाप्यभिभवन्त्येन नैव ते घोरदर्शनाः जिधांसयैनमासाद्य नश्यन्त्यग्ने पतङ्गवत् ॥५६  
अहो ब्रह्मविदां वाचो नासत्याः सन्ति कर्हिचित् । गर्गो यदाह भगवानन्वभावि तथैव तत् ॥  
इति नन्दादयो गोपाः कृष्णरामकथां मुदा । कुर्वन्तो रममाणाश्च नाविन्दन् भववेदनाम् ॥५८  
एवं विहारैः कौमारैः कौमारं जहतुर्वजे । निलायनैः सेतुबन्धैर्मर्कटोत्प्लवनादिभिः ॥५९

इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे

पूर्वार्थं वत्सबकवधोनामैकादशोऽध्यायः ॥११॥

जोईने गोवाण बाणको विस्मय पामी गया.<sup>५२</sup> हँड्रियो प्राणने पामीने जेम सुख पामे, तेम बकासुरना मोढामांथी मुकाआवेला भगवानने पामी, सुख पामेला बणभद्रादि बाणकोअे ठेकाशे आवेला ते भगवाननुं आलिंगन कर्यु अने पछी वाइरडांओने एकठां करी ब्रजमां आवीने ते वात सौनी पासे करी देखाई.<sup>५३</sup> अे वात सांभणी विस्मय पामेला अने बहुज प्रीतिथी आदरयुक्त थयेला गोवाणिया अने गोपीओ परलोकथी आवेलाने जेम जुअे तेम, तुष्णा भरेली आंघोथी जोवा लाग्यां अने बोलवा लाग्यां के- अहो ! आ बाणकने माथे घणी घणी घातो आवी पाश जेओ घात करवा आव्या तेओनुं ज भूंदुं थयुं; केमके अे लोकोअे बीजाओने भय उत्पन्न करेल हुशे.<sup>५४-५५</sup> अे लोको भयंकर होवा छतां पाश आ बाणकनो पराभव करी शकता नथी. मारवानी ईरुषाथी आनी पासे आवीने पतंगियां जेम अग्निमां पडीने नाश पामे तेम नाश पामी जाय छे.<sup>५६</sup> अहो ! वेद ज्ञानाराओनां वयन कटी पाश खोटां पडे नहीं. महात्मा गर्गाचार्य जेवुं कडी गया हता तेवुं ज देखवामां आव्युं.<sup>५७</sup> आवी रीते आनंदथी श्रीकृष्ण तथा बणभद्रनी वातो करता अने आनंद पामता नंदादिक गोवाणियाओने संसारनी वेदना ज्ञानवामां पाश आवती न हती.<sup>५८</sup> आ प्रमाणे ज छुपाई जवुं, सडक बांधवी अने वांदरानी पेठे झुट्वुं ईत्यादिक कुमार अवस्थानी रमतोथी ऐ बन्ने भाईओअे ब्रजमां कुमार अवस्था व्यतीत करी.<sup>५९</sup>

इति श्रीमद् महापुराणा भागवतना दशम स्कन्धनो अग्नियादम्

अध्याय संपूर्णः.

अथ द्वादशोऽध्यायः (१२)

श्री शुक उवाच

क्वचिद्गुनाशाय मनो दधद्वजात्प्रातः समुत्थाय वयस्यबत्सपान् ।

प्रबोधयन् शृंगरवेण चारुणा विनिर्गतो वत्सपुरस्सरो हरिः ॥१॥

तेनैव साकं पृथुकाः सहस्राः स्त्रिधाः सुशिगवेत्रविषाणवेणवः ।

स्वान् स्वान् सहस्रोपरिसंख्यान्वितान् वत्सान् पुरस्कृत्य विनिर्युर्मुदा ॥२॥

कृष्णवत्सैरसंख्यातैर्यथीकृत्य स्ववत्सकान् । चारयन्तोऽर्भलीलाभिर्विजहुस्तत्र तत्र ह ॥३

फलप्रवालस्तबकसुमनःपिच्छातुभिः । काचगुञ्जामणिस्वर्णभूषिता अप्यभूषयन् ॥४

मुष्णान्तोऽन्योन्यशिक्यादीन्जातानाराच्च चिक्षिपुः । तत्रत्याश्च पुनर्दूराद्वसन्तश्च पुनर्ददुः ॥५

यदि दूरं गतः कृष्णो वनशोभेक्षणाय तम् । अहं पूर्वमहं पूर्वमिति संस्पृश्य रेमिरे ॥६

केचिद् वेणून् वादयन्तो धान्तः शृङ्गाणि केचन । केचिद् भृङ्गैः प्रगायन्तः कूजत्तः कोकिलैः परे ।

अध्याय १२

श्रीकृष्ण भगवाने अधासुरनो डरेलो वध.

शुकदेवज्ञ कुहे छे- कोई दिवसे वनमां ज जमवाना विचारथी प्रातःकाणमां जीर्णी सुंदर शींगडीना शष्टिथी पोताना भित्र गोवाणियाओने जगाईने, वाइरडान्तुं टोणुं आगण करी भगवान ब्रजमांथी नीकण्या.<sup>१</sup> स्नेही अने सारां सारां शींकां, छीरीओ, शींगडी तथा वेणुओने धरनारा हजारो बाणको अने हजारो पोतपोतानां वाइरडांओने आगण करी प्रीतिथी भगवाननी साथे ज नीकण्या.<sup>२</sup> श्रीकृष्णनां असंभ्यात वाइरडांनी साथे पोतानां वाइरडांओने भेगां करी, तेओने चारता ऐ बाणको स्थणे स्थणे विहार करता हता.<sup>३</sup> काच, यषोटी, मणि अने सुवर्णथी शाशगारेला हता. तोपाश फण, पांडां, गुच्छ, फूल, मोरपींछ अने धातुओथी ऐ बाणको पोतपोतानां शरीरने शाशगारता हता.<sup>४</sup> ऐक बीजानां शींकां आदि पदार्थोने चोरता हता; अने ज्यारे वस्तुना मालिकने खबर पडे त्यारे लेनारो ते वस्तुने बीजानी पासे फेंकी ढेतो हतो, बीजो त्रीजानी पासे, त्रीजो चोथानी पासे फेंकी ढेतो हतो. अने पछी हसतां हसतां ते वस्तु तेना मालिकने पाछी आपी ढेता हता.<sup>५</sup> वननी शोभा जोवा सारु भगवान दूर गया होय तो तेमने “हुं पहेलां स्पर्श करीश, हुं पहेलां स्पर्श करीश” ऐम बोली तेनी तरफ दोऽलगावता हता. अने श्रीकृष्णनो स्पर्श करीने आनंद मग्न थई जता हता, कोई वेणु वगाडता हता, कोई भ्रमरोनी साथे गाता हता, अने कोई कोयलनी साथे टहुंको करता

विच्छयाभिः प्रधावन्तो गच्छन्तः साधुंहसकैः । बैकैरुपविशन्तश्च नृत्यन्तश्च कलापिभिः ८  
 विकर्षन्तः कीशबालानारोहन्तश्च तैर्द्रुमान् । विकुर्वन्तश्च तैः साकं प्लवन्तश्च पलाशिषु ॥९  
 साकं भेकैर्विलङ्घन्तः सरित्प्रस्वरसम्प्लुताः । विहसन्तः प्रतिच्छयाः शपन्तश्च प्रतिस्वनान् ॥  
 इत्थं सतां ब्रह्मसुखानुभूत्या दास्यं गतानां परदैवतेन ।  
 मायाश्रितानां नरदारकेण साकं विजुः कृतपुण्यपुज्जाः ॥११॥  
 यत्पादपांसुर्बहुजन्मकृच्छ्रतो धृतात्मभिर्योगिभिरप्यलभ्यः ।  
 स एव यद्विविषयः स्वयं स्थितः किं वर्ण्यते दिष्टमतो व्रजौकसाम् ॥१२॥  
 अथाधनामाभ्यपतन्महासुरस्तेषां सुखक्रीडनवीक्षणाक्षमः ।  
 नित्यं यदन्तर्निजजीवितेषुभिः पीतामृतैरप्यमरैः प्रतीक्ष्यते ॥१३॥  
 दृष्ट्वार्भकान् कृष्णमुखानघासुरः कंसानुशिष्ठः स बकीबकानुजः ।  
 अयं तु मे सोदरनाशकृतयोर्द्वयोर्मैनं सबलं हनिष्ये ॥१४॥  
 एते यदा मत्सुहृदोस्तिलापः कृतास्तदा नष्टसमा व्रजौकसः ।  
 प्राणे गते वर्षसु का नु चिन्ता प्रजासवः प्राणभूतो हि ये ते ॥१५॥

हता.<sup>८-९</sup> पक्षीओना ओषधायानी साथे दोडता, हंसोनी चालनी नक्ल करीने हंसोनी साथे सुंदर गतिथी चालता, बगलाओनी साथे आंभो भींचीने बेसता, मोरनी साथे नाचता, केटलाक तो वृक्षोनी शाखाओ नीये लटकतां वांदरानां पूँछने भेंयता, पूँछां नहीं भूक्तां वांदराओनी साथे झाडपर यढी जता, वांदराओनी साथे मोढां भरडता, वृक्षोमां ठेकता, देढ़कांओनी साथे ठेकडा देता, नहीं तथा झरणाओमां नहाता, पोताना पड़धायानी हांसी करता अने पड़धाओने गालो देता हता.<sup>१०-११</sup> अभ्यानंदना अनुभवथी परमात्माना दासभावने पामेला अकान्तिक साधुपुरुषोने साक्षात् परब्रह्मरूपे ज़ज्ञाता, अने मायाथी भोहित थयेलाओने केवण बाणमनुष्यरूपे ज़ज्ञाता ऐवा श्रीकृष्ण भगवाननी साथे पूँयशाणी ऐवा गोवाणियाओ विहार करता हता.<sup>१२</sup> धण्डा जन्मोमां कष्ट वेठीवेठीने मनने वश करनारा योगीओने पश जेना चरणानी २४ मणती नथी, ते ज पोते भगवान प्रत्यक्षरूपथी ब्रजवासीओनी पासे रह्या, माटे तेओना भाऊनुं शुं वर्षान करवुं ?<sup>१३</sup> पछी गोवाणो अने श्रीकृष्ण भगवाननी सुभपूर्वक कीडाओने नहीं सहन करी शकतो ऐवो मोटो अघासुर आव्यो के जे अघासुरना भूत्युनी वाट अमृत पीनार इतां पश पोताना ज्ञवितने ईर्ष्णनारा देवताओ पश जेता हता.<sup>१४</sup> कंसे मोक्लेला तथा पूतना अने बकासुरना नानाभाई अघासुरे श्रीकृष्णादिक बाणकोने

इति व्यवस्याजगरं बृहद् वपुः स योजनायामहाद्विपीवरम् ।  
 धृत्वाद्द्रुतं व्यात्तगुहाननं तदा पथि व्यशेत ग्रसनाशया खलः ॥१६॥  
 धराधरोष्टो जलदोत्तरोष्टो दर्यननानो गिरिशृङ्गदंष्ट्रः ।  
 ध्वान्तान्तरास्यो वितताध्वजिह्वः परुषानिलश्वासदवेक्षणोष्णाः ॥१७॥  
 दृष्ट्वा तं तादृशं सर्वे मत्वा वृन्दावनश्रियम् । व्यात्ताजगरतुण्डेन ह्युत्येक्षन्ते स्म लीलया ॥१८  
 अहो मित्राणि गदत सत्त्वकूटं पुरः स्थितम् । अस्मत्संग्रसनव्यात्तव्यालतुण्डायते न वा ॥१९  
 सत्यमर्ककरारक्तमुत्तराहनुवद् घनम् । अधराहनुवद् रोधस्तत्रतिच्छाययारुणम् ॥२०  
 प्रतिस्यर्थेते सृक्षिभ्यां सव्यासव्ये नगोदरे । तुङ्गशृङ्गालयोऽप्येतास्तद्विष्ट्रभिश्च पश्यत ॥२१  
 आस्तृतायामामार्गोऽयं रसनां प्रतिगर्जति । एषामन्तर्गतं ध्वान्तमेतदप्यन्तराननम् ॥२२  
 ज्ञेईने विचार कर्यो के आ कृष्ण मारा बे सहोदरनो नाश करनार छे, माटे तेना बहलामां आ कृष्णने तेना सैन्यनी साथे हुं मारीश.<sup>१४</sup> आ छोकराओ ज्यारे मारा सहोदरोने तिल अने जणरूप करवामां आवशो. अर्थात् श्रीकृष्णनी साथे आ बाणकोने मारीश त्यारे ज भाई बहेनने अंजली आपी गणाशे अने गोपबाणोनुं भूत्यु थतां व्रजवासीओ भूतप्राय बनी जशे. संतानो एज प्राणीओना प्राण होय छे. तेथी संतानोनुं भूत्यु थतां सर्वे व्रजवासीओ पोतानी भेणे ज भूत्यु पामी जशे.<sup>१५</sup> आवो निश्चय करी, ए खण अघासुर सौने गणी जवानी आशाथी अजगरनुं मोटुं अद्भुतरूप धरीने मार्गमां सूतो. ए अजगर एक योजन लांभो हतो, मोटा पर्वत जेवो झाडो हतो, गुफा जेवुं मोहुं काडयुं हतुं, नीचलो होठ धरती पर हतो, उपलो होठ वाढणांओने अडी रह्यो हतो, गलोझां गुफा जेवां हतां, दाढो पर्वतना शिखरो जेवी हती, मोढानी अंदरनो भाग अंधारा जेवो हतो, ज्ञभ लांभी सडक जेवी हती, श्वास कठोर पवन जेवो हतो अने आंभो दावानण जेवी हती.<sup>१६-१७</sup> आवा अजगरने ज्ञेई, तेने भूलथी वृन्दावननी शोभा मानीने सधणा बाणको रमतां रमतां अजगर पर्पना फाडेला मोढानी उत्प्रेक्षा करवा लाग्यां के ‘अहो ! भित्रो ! आ आपणी सामे जे देखाय छे ते कोई प्राणी जेवुं देखाय छे के नहीं ? अने तेमां आपणने गणी जवा सारे फाडेला अजगरना मोढां जेवुं लागे छे के नहीं ? ते कहो.<sup>१८-१९</sup> साचेसाच सूरजना किरणोथी रातुं वाढणुं उपला होठ जेवुं लागे छे ते जुओ. ते वाढणांनी छायाथी रातो ज़ज्ञातो आ कांठो नीचला होठ जेवो लागे छे. आ डाबी अने जमणी पर्वतनी बे गुफाओ गलोझां जेवी लागे छे. आ उंचा शिखरनी पंक्तिओ अजगरनी दाढो जेवी

दावोष्णाखरवातोऽयं श्वासवद् भाति पश्यत । तद्वग्धसत्त्वदुर्गम्योऽप्यन्तरामिषगन्थवत् ॥२३  
 अस्मान् किमत्र ग्रसिता निविष्टानयं तथा चेद् बकवद् विनदक्षयति ।  
 क्षणादनेनेति बकार्युशम्भुखं वीक्ष्योद्भसन्तः करताडनैर्ययुः ॥२४॥  
 इत्थं मिथोऽतथ्यमतज्जभाषितं श्रुत्वा विचिन्त्येत्यमृषा मृषायते ।  
 रक्षो विदित्वाखिलभूतहृतिस्थितः स्वानां निरोद्धुं भगवान् मनो दधे ॥२५॥  
 तावत् प्रविष्टास्त्वसुरोदरान्तरं परं न गीर्णाः शिशवः सवत्साः ।  
 प्रतीक्षमाणेन बकारिवेशानं हतस्वकान्तस्मरणेन रक्षसा ॥२६॥  
 तान् विक्ष्य कृष्णः सकलाभयप्रदो हृनन्यनाथान् स्वकरादवच्युतान् ।  
 दीनांश्च मृत्योर्जठराग्निधासान् घृणार्दितो दिष्टकृतेन विस्मितः ॥२७॥  
 कृत्यं किमत्रास्य खलस्य जीवनं न वा अमीषां च सतां विहिंसनम् ।  
 द्वयं कथं स्यादिति संविचिन्त्य तज्जात्वाविशत्तुण्डमशेषदृग्घरिः ॥२८॥

जणाय छे.<sup>२०-२१</sup> आ लांबो अने पडोणो मार्ग ज्ञान जेवो जणाय छे. अंदरनुं आ अंधारुं अजगरना मोठाना मध्यभाग जेवुं जणाय छे.<sup>२२</sup> दावानणी गरम आ कठोर वायु श्वास सरभो जणाय छे, दावानणी बणी गयेलां प्राणीओनो आ हुर्ग्य अजगरे खायेलां मांसना गंध जेवो जणाय छे.<sup>२३</sup> आमां आपणे पेसीशु तो शुं आपणने पशा गणी जशे ? अने जो गणी जशे तो भगवानी पेठे आ कृष्णना हाथथी तुरत नाश पामशे. ऐम बोलता अने भगवानना सुंदर मुखनी सामुं जेता ऐ बाणको ताणीओ पाउता पाउता गया.<sup>२४</sup> ऐने राक्षस जाणता अने सर्वप्राणीओना हृदयमां रहेला भगवाने आ प्रमाणे अजाण्या बाणकोनी परस्पर भूलथी थती वात सांभणी, साचानुं खोदुं ठरे छे ऐम विचारी ते भित्रोने अटकाववानुं मन कर्यु, तेटलामां तो ते वाइरडां सहित बाणको अघासुरना पेटनी अंदर प्रवेशी गयां. तेओ पेटनी अंदर आव्या तो पशा, पोताना बे सहोदरना भरणने संभारतो अघासुर भगवानना प्रवेशनी वाट जेतो हतो, तेथी तेषो ए वाइरडां सहित बाणकोने पचावी दीधा नहीं.<sup>२५-२६</sup> सर्वने अभय आपनार भगवान पोताना हाथमांथी नीकणी गयेलां अने फेओनो बीजो कोई आश्रय नथी ऐवां दीन प्राणीओने अघासुरना जठराजिमां धास थवाना जाणी, दयाथी पुक्त थईने अने देवता कर्तव्यथी विस्मय पामीने विचार करवा लाग्या के हवे अहीं शुं करवुं ? आ हुष्ट अघासुर ज्ञवे नहीं अने आ भला प्राणीओ मरे नहीं ए बे वात शी रीते थाय ? ऐम विचार करी अने पछी तेना उपायनो निश्चय

तदा घनच्छदा देवा भयाद्वाहेति चुक्रुशः । जहृयुर्च कंसाद्या कौणपास्त्वधबान्धवाः ।२९  
 तच्छुत्वा भगवान् कृष्णस्त्वव्ययः सार्भवत्सकम् । चूर्णांचिकीर्षोरात्मानं तरसा ववृथे गले ३०  
 ततोऽतिकायस्य निरुद्धमार्गिणो ह्युदीर्णदृष्टेष्वमतस्त्वितस्ततः ।  
 पूर्णोऽन्तरङ्गे पवनो निरुद्धो मूर्धन् विनिष्पाट्य विनिर्गतो बहिः ॥३१॥  
 तेनैव सर्वेषु बहिर्गतेषु प्राणेषु वत्सान् सुहृदः परेतान् ।  
 दृष्ट्या स्वयोत्थाप्य तदन्वितः पुनर्वक्त्रान्मुकुन्दो भगवान् विनिर्ययौ ॥३२॥  
 पीनाहिभोगोत्थितमद्भुतं महज्योतिः स्वधामा ज्वलयद् दिशो दश ।  
 प्रतीक्ष्य खेऽवस्थितमीशनिर्गमं विवेश तस्मिन् मिषतां दिवौकसाम् ॥३३॥  
 ततोऽतिहृष्टः स्वकृतोऽकृतार्हणं पृष्ठैः सुरां अप्सरसश्च नर्तनैः ।  
 गीतैः सुगा वायधराश्च वायकैः स्तवैश्च विप्रा जयनिःस्वनैर्गणाः ॥३४॥  
 तदद्भुतस्तोत्रसुवायागीतिकाजयादिनैकोत्सवमङ्गलस्वनान् ।

श्रुत्वा स्वधामोऽन्त्यज आगतोऽचिराद् दृष्ट्वा महीशास्य जगाम विस्मयम् ॥३५॥

करी, सर्वज्ञ भगवान अघासुरना मोठामां पेठा.<sup>२७-२८</sup> ऐ सभयमां वाढणां आडा उभेला देवताओ भयथी हाहाकार करवा लाग्या अने अघासुरना संबंधी कंसादिक राक्षसो राज्ञ थया.<sup>२९</sup> ऐ हाहाकार सांभणी अविनाशी श्रीकृष्ण भगवान जे अघासुर बाणको सहित वाइरडांने चूर्ण करवा ईरच्छतो हतो. तेना गणामां तरत वृद्धि पाम्या.<sup>३०</sup> ऐम थवाथी गणुं रोकाई जनां आम तेम तरफ्यां मारता अने जेनी आंभो फाटी पडी छे, ऐवा अघासुरना देहनी अंदर भहु ज रोकाएलो पवन तेनुं ब्रह्मरंग्र फाटी नाखीने बहार नीकणी गयो.<sup>३१</sup> पवननी साथे ज तेनी सर्व ईंद्रियो पशा भहार नीकणी गई. पछी भरणा पामेला गोवाणिया अने वाइरडां अघासुरना पूष्ट देहमांथी नीकणेलुं महा अद्भुत अने पोताना प्रकाशथी दशे दिशाओने प्रज्वलित करतुं जे तेज, भगवानना नीकणवानी राह जेईने अकाशमां रोकाई रह्युं हतुं. ते तेज देवताओ ना देखतां भगवानमां प्रवेशी गयुं.<sup>३२</sup> पछी भहु ज राज्ञ थयेला देवताओ ऐ पुष्पथी, अप्सराओ ए नृत्यथी, सारुं गानाराओ ए गायनथी, वाजांवाणा वाजांथी, ब्राह्मणो स्तुतिथोथी अने पार्षदो ए ज्य ज्य शब्दोथी भगवाननी पूजा करी.<sup>३४</sup> ऐ अद्भुत स्तोत्र, सारां वाजां, गायन अने ज्यघोषादिकना अनेक उत्सववाणा मंगण शब्दोने पोताना धामनी अंदर सांभणी तरत वृन्दावनमां आवेला भ्रत्मा

राजन्नाजगरं चर्म शुष्कं वृन्दावनेऽद्भुतम् । व्रजौकसां बहुतिथं बभूवाक्रीडगहरम् ॥३६  
एतत् कौमारजं कर्म हरेरात्माहिमोक्षणम् । मृत्योः पौगण्डके बाला दृष्टेचर्चिर्विस्मिता व्रजे ३७  
नैतद् विचित्रं मनुजार्भमायिनः परावराणां परमस्य वेधसः ।

अघोऽपि यत्स्पर्शनधौतपातकः प्रापात्मसाम्यं त्वसतां सुदुर्लभम् ॥३८॥  
सकृद् यदङ्गप्रतिमान्तराहिता मनोमयी भागवतीं ददौ गतिम् ।  
स एव नित्यात्मसुखानुभूत्यभिव्युदस्तमायोऽन्तर्गतो हि किं पुनः ॥३९॥

सूत उवाच

इत्थं द्विजा यादवदेवदतः श्रुत्वा स्वरातुश्चरितं विचित्रम् ।  
पप्रच्छ भूयोऽपि तदेव पुण्यं वैयासिं यन्निगृहीतचेताः ॥४०॥

राजोवाच

ब्रह्मन्! कालान्तरकृतं तत्कालीनं कथं भवेत् । यत् कौमारे हरिकृतं जगुः पौगण्डकेऽर्भकाः ॥

श्रीकृष्णनो भहिमा ज्ञेष्ठने विस्मय पामी गया.<sup>३५</sup> हे राजा ! वृन्दावनमां सूक्ष्मां  
गयेलुं ए अद्भुत अर्जगरनुं यामुं पशु धण्डा काण सुधी प्रजवासीओने रमवानी  
गुङ्गात्रुप थयुं हतुं.<sup>३६</sup> पोताने मरणाथी छोडाव्या अने अधासुरने संसारथी छोडाव्यो  
ए चरित्र भगवाने कुमार अवस्थामां कर्युं. ते ज्ञेष्ठने विस्मय पामेलां बाणकोअे,  
भगवानना छहा वर्षमां आटले वयमां एक वर्ष वीती गया पट्टी, आज श्रीकृष्णे  
अधासुरने मार्यो. आ प्रमाणे गोकुणमां कहुं.<sup>३७</sup> मायाथी मनुष्यना बाणक थयेला  
अने वास्तव स्वरूपे सर्वना आदिकारणत्रुप परमात्मा श्रीकृष्णना स्पर्शशी पाप  
धोवाई जतां अधासुर पशु नीय लोकोने न ज मणे एवा भगवानना साम्यपशाने  
पाम्यो, ए वात आश्वर्यत्रुप समजवी नहीं.<sup>३८</sup> केमके जेनी केवण मनोमय मूर्तिने  
प्रह्लादादिक पुरुषोअे बणात्कारथी मनमां धरी हती तोपशु तेओने मुक्तिमणी  
छे, त्यारे निरंतर आत्मसुखना अनुभवथी मायानो तिरस्कार करनार ए  
भगवान पोते ज अधासुरना शरीरमां पेसतां अधासुरने मुक्तिमणे, एमां तो  
नवाई ज शी ?<sup>३९</sup>

सूत शौनकादिकने कहे छे- हे भ्राताणो ! आ प्रमाणे पोताना रक्षक भगवाननुं  
विचित्र चरित्र सांभणीने तेमां ज जेनुं चित लागी रह्युं छे, एवा परीक्षित राजाए  
व्यासना पुत्र शुक्देवज्ञने पाइठो ते संबंधी ज पवित्र प्रसंग पूछ्यो.<sup>४०</sup>

परीक्षित राजा पुछे छे- हे महाराज ! भगवाने कुमार अवस्थामां जे चरित्र  
कर्युं, ते चरित्र भाणकोअे भगवाननी पौगंड अवस्थामां कहुं, तो कुमार अवस्थामां

तद् ब्रूहि मे महायोगिन् परं कौतूहलं गुरो । नूनमेतद्वरेरेव माया भवति नान्यथा ॥४२  
वयं धन्यतमा लोके गुरोऽपि क्षत्रबन्धवः । यत् पिबामो मुहुस्त्वतः पुण्यं कृष्णकथामृतम् ॥

सूत उवाच -

इत्थं स्म पृष्ठः स तु बादरायणिस्तत्मारितानन्तहताऽखिलेद्रियः ।  
कृच्छ्रात्पुनर्लब्धवर्द्दिशः शनैः प्रत्याह तं भागवतोत्तमोत्तम ! ॥४४॥  
इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे  
पूर्वर्धं द्वादशोऽद्यायः ॥१२॥

अथ त्रयोदशोऽध्यायः (१३)

श्रीशुक उवाच

साधु पृष्ठं महाभाग ! त्वया भागवतोत्तम ! । यन्त्रतनयसीशस्य शृणवन्नपि कथां मुहुः ॥११

सतामयं सारभृतां निसर्गो यदर्थवाणीश्रुतिचेतसामपि ।

प्रतिक्षणं नव्यवदच्युतस्य यत् स्त्रिया विटानामिव साधुवार्ता ॥१२॥

बनेली घटना पौगंडअवस्थामां थवी शी रीते संभवे ?<sup>४१</sup> हे गुरु ! हे मोटा योगी !  
ए विषय मारी पासे कुहो; केमके ते सांभणवानो मने मोटो उत्साह छे. धयुं  
करीने ए भगवाननी ज माया होवी ज्ञेष्ठअे, एमां संशय नहीं.<sup>४२</sup> हे गुरु अमे  
प्राक्षणादिकनी सेवा करी न होवाथी मात्र नामना ज क्षत्रिय छीअे. छतां पशु  
आपनी पासेथी भगवाननी पवित्र कथात्रुप अमृत पीअे छीअे माटे भाग्यशाणी  
छीअे.<sup>४३</sup> सूत कहे छे- हे मोटा वैष्णवोमां उत्तम शौनक मुनि ! आ प्रमाणे परीक्षित  
राजाए पूछीने भगवाननुं स्मरण आपतां प्रथम तो शुक्देवज्ञनी सर्व ईद्रियो  
भगवानमां ज लीन थई गई, पशु पट्टी मांड मांड बहिर्वृत्ति आवतां शुक्देवज्ञाए  
तेमने धीरजथी उत्तर आपवा मांडयो.<sup>४४</sup>

इति श्रीमद् महापुराणा भागवतना दशम स्कन्धनो लारमो अद्याय संपूर्णः ।

अद्याय १३

अह्माए वाइठां तथा भाणकोनुं हराङा करवाथी भगवान ते  
सर्वरूप थया.

शुक्देवज्ञ कहे छे- हे वैष्णवोमां उत्तम मोटा राजा ! तमे बहुज सारं  
पञ्चश्चयुं, भगवाननी कथाने वारंवार सांभणवा छतां पशु तमने कथामां अरुयि

શૃણુષ્વાવહિતો રાજન્રિપિ ગુહ્યં વદામિ તે । બ્રૂયુઃ સ્ત્રિગધસ્ય શિષ્યસ્ય ગુરવો ગુહ્યમઘ્યુત ॥૩  
તથાધવદનાન્મૃત્યો રક્ષિત્વા વત્સપાલકાન् । સરિતુલિનમાનીય ભગવાનિદમબ્રવીત् ॥૪  
અહોઉતિરસ્ય પુલિન વયસ્યાઃ સ્વકેલિસમ્પન્મૃદુલાચ્છ્વાલુકમ् ।  
સ્ફુટત્સરોગન્ધહૃતાલિપત્રિકધ્વનિપ્રતિધ્વાનલસદ્દુમાકુલમ् ॥૫॥  
અત્ર ભોક્ત્વયમસ્માભિર્વિવારુદ્ધં ક્ષુધાર્દિતાઃ । વત્સાઃ સમીપેઽપઃ પીત્વા ચરન્તુ શનકૈસૃણમ् ૬  
તથેતિ પાયયિત્વાર્ભા વત્સાનાર્થ્ય શાદ્વલે । મુક્ત્વા શિક્યાનિ બુભુજુઃ સમં ભગવતા મુદા ॥  
કૃષ્ણસ્ય વિષ્વક્ર પુસ્રાજિમણ્ડલૈરભ્યાનાઃ ફુલદૂષો બ્રજાર્ભકાઃ ।

સહોપવિષ્ણ વિષિને વિરે જુશ્છદા યથાભ્યોરુહકર્ણિકાયાઃ ॥૬॥

કેચિત્ પુર્ણૈર્દલૈઃ કેચિત્ પલ્કૈરદ્ધૌઃ ફલૈઃ । શિગભસ્તરિભર્દ્વદ્વિશ બુભુજુઃ કૃતભાજનાઃ ॥

થતી નથી અને નવી ને નવી લાગે છે.<sup>૧</sup> સાર ગ્રહણ કરનારા સત્પુરુષોની વાણી, કાન અને ચિત્ત જો કે ભગવાનની કથામાં જ લાગી રહેલાં હોય છે, તોપણ જેમ સ્ત્રીલંપટ પુરુષોને સ્ત્રીઓની વાતો પ્રતિક્ષણ નવી નવી અને સારી લાગે છે. તેમ તે સત્પુરુષોને પ્રત્યેક ક્ષણે ભગવાનની વાતોનવી નવી અને સારી લાગતી હોય છે.<sup>૨</sup> હે રાજા ! સાવધાન થઈને સાંભળો, આ વાત છાની છે તોપણ તમારી પાસે કહું છું, કેમકે ગુરુએ સ્નેહવાળા શિષ્યની પાસે છાની વાત પણ કહેવી જોઈએ.<sup>૩</sup>  
પૂર્વે કહ્યા પ્રમાણે વાછરડાં અને ગોવાળિયાઓની અધાસુરના મુખરૂપ મૃત્યુથી રક્ષા કરીને તેઓને નદીને કિનારે લાવી, ભગવાને કહું કે- અહો ! હે મિત્રો ! આ કાંઠો આપણને રમવાની સગવડવાળો અને અત્યંત રમણીય છે. અહીંની રેતી કોમળ અને સ્વચ્છ છે. ખીલેલાં અનેક કમળોની સુગંધથી ખેંચાઈ આવેલા અમરાઓ અને પક્ષીઓના શબ્દોથી તથા જળમાં થતા પડધાઓથી શોભી રહેલાં જાડ ચારેકોર વ્યામ થઈ રહ્યાં છે.<sup>૪-૫</sup> અહીં બેસીને આપણે જમવું છે, દિવસ ચઢી ગયો છે અને ભૂખ પણ લાગી છે. વાછરડાંઓને પાણી પાઈને આપણા સમીપમાં ધીરેધીરે ધાસ ચરવા દો.<sup>૬</sup> આ ભગવાનનાં વચનનો સ્વીકાર કરી સર્વે બાળકો વાછરડાંઓને પાણી પાઈ, લીલા ધાસવાળા પ્રદેશમાં ચરતાં મૂક્તી, શીંકા ધરતી પર રાખીને ભગવાનની સાથે આનંદથી જમવા લાગ્યા.<sup>૭</sup> વનમાં ભગવાની ચારેકોર મોટી ગોળ પંક્તિઓમાં એક બીજાને અડીને બેઠેલા, પ્રફુલ્લિત દસ્તિવાળા અને ભગવાનની સામે જેઓ મોઢાં રાખ્યાં હતાં, એવા વ્રજના બાળકો કમળની પાંખડીની પેઠે શોભતા હતા.<sup>૮</sup> કેટલાક બાળકો ફૂલનાં, કેટલાક બાળકો ફૂલની પાંખડીઓનાં, કેટલાક પાંદડાંનાં, કેટલાક અંકુરનાં, કેટલાક ફળનાં, કેટલાક

સર્વે મિથો દર્શયન્તઃ સ્વસ્વભોજ્યસ્રચિ પૃથક् । હસ્તનો હાસ્યન્તશ્વાભ્યવજહુઃ સહેશ્વરાઃ ॥૧૦  
બિભ્રદ્ વેણું જઠરપટયો: શૃઙ્ગવેત્રે ચ કક્ષે વામે પાણૌ મસૃણકવલં તત્કલાન્યફૂલીષુ ।  
તિષ્ણુમધ્યે સ્વપરિસુહ્દો હાસ્યન્ નર્મભિ: સ્વૈ: સ્વર્ગે લોકે મિષિત બુભુજે યજભુગ્ બાલકેલિ: ॥  
ભારતૈવં વત્પષેષુ ભુજ્જાનેષ્વચ્યુતાત્મસુ । વત્સાસ્ત્વન્તર્વને દૂરં વિવિશુસ્ત્રણલોભિતાઃ ॥૧૨  
તાન દૃષ્ટા ભયસંસ્તાનૂંચે કૃષ્ણોઽસ્ય ભીભયમ् । મિત્રાણ્યાશાન્મા વિરમતેહાનેષ્યે વત્સકાનહમ્ ॥૩  
ઇત્યુક્ત્વાદ્રિદરીકુઞ્જગહ્રોષ્વાત્મવત્સકાન્ । વિચિન્વન્ ભગવાન્ કૃષ્ણાઃ સપાણિકવલો યયૌ ॥૪  
આભોજમજનિસ્તદનતરગતો માયાર્ભકય્યેશિતુદ્રષ્ટું મજ્જ મહિતમન્યદદપિ તદ્વત્સાનિતો વત્સપાન્ ।  
નીત્વાન્યત્ર કુરુદ્વાહનતરદ્ધાત્ ખેડવસ્થિતો યઃ પુરા દૃષ્ટાધાસુરમોક્ષણી પ્રભવત: પ્રાસ: પરં વિસમયમ् ।  
તતો વત્સાનદૃષ્ટૈત્ય પુલિનેઽપિ ચ વત્સપાન્ । ઉભાવપિ વને કૃષ્ણો વિચિકાય સમન્તતઃ ॥૧૬  
બ્રાયદૃષ્ટાન્તર્વિષિને વત્સાન્ પાલાંશ્ વિશ્વવિત । સર્વ વિધિકૃતં કૃષ્ણાઃ સહસાવજગામ હ ॥૧૭  
શીંકાંનાં, કેટલાક વૃક્ષની છાલાંનાં અને કેટલાક છીપરોનાં વાસણ કરીને જમતા હતા.<sup>૯</sup> પોતપોતાના ભોજનના નોખનોખા સ્વાદને પરસ્પર દેખાડતા, હસતા અને હસાવતા બાળકો ભગવાનની સાથે જમતા હતા.<sup>૧૦</sup>  
એ બાળકોમાં યજ્ઞભોક્તા ભગવાન પણ જમતા હતા. એ સમયમાં ભગવાને પેટ ઉપરના વશ્નની અંદર વેણું ધરી હતી, શીંગડી અને છાડી કાંખમાં લીધાં હતાં, ડાબા હાથમાં દહીંભાતનો કોળિયો હતો, અથાણાં આંગળીઓમાં લીધાં હતાં, ગોળાકારે બેઠેલા પોતાના મિત્રોની વચનમાં બેઠા હતા, હાંસીના વચનોથી હસાવતા હતા. આવી લીલાને દેવતાઓ જોઈ રહ્યા હતા.<sup>૧૧</sup> હે રાજા ! આ પ્રમાણે ગોવાળિયાઓ જમવા લાગતાં અને તેઓના ચિત્ત ભગવાનમાં લાગી જતાં વાછરડાંઓ ઘાસની લાલયથી વનની અંદર દૂર ચાલ્યાં ગયાં.<sup>૧૨</sup> વાછરડાં દૂર નીકળી ગયેલાં હોવાથી ભય પામેલા ગોવાળિયાઓને જોઈ ભગવાને તેઓને કહું કે- હે મિત્રો ! જમવું છોડશો નહીં, હું જઈને વાછરડાઓને અહીં લાવું છું.<sup>૧૩</sup> આ પ્રમાણે કહી હાથમાં દહીંભાતનો કોળિયો લઈ પર્વતો, ગુફાઓ, કુંજો અને વિષમ સ્થળોમાં પોતાનાં વાછરડાંઓને શોધવા સારુ ભગવાન ત્યાંથી આગળ વધા.<sup>૧૪</sup>  
હે રાજા ! આ અવકાશ મળતાં જે બ્રહ્મા પ્રથમ ભગવાને કરેલા અધાસુરનો મોક્ષ જોવાથી પરમ વિસ્મય પામીને આકાશમાં જ ઊભા હતા, તે બ્રહ્મા માયાથી બાળક થયેલા ભગવાનનો બીજો પણ ઉત્તમ મહિમા જોવા સારુ, અહીંથી બાળકોને અને ત્યાંથી વાછરડાંઓને બીજા સ્થળમાં લઈ જઈને પોતે અંતર્ધારન થઈ ગયા.<sup>૧૫</sup> પછી વાછરડાંઓ નહીં જોવામાં આવતાં ભગવાન પાછા કાંઠે આવ્યા, ત્યાં બાળકો પણ

ततः कृष्णो मुदं कर्तुं तम्मातृणां च कस्य च । उभयायितमात्मानं चक्रे विश्वकृदीश्वरः ॥१८  
यावद् वत्सपवत्सकाल्पकवपुर्यावत् कराङ्ग्यादिकं यावद् यष्टिविषाणवेणुदलशिग् यावद्  
विभूषाम्बरम् । यावच्छीलगुणाभिधाकृतिवयो यावद् विहारादिकं सर्वं विष्णुमयं

गिरोऽङ्गवदजः सर्वस्वरूपो बभौ ॥१९

स्वयमात्माऽऽत्मगोवत्सान् प्रतिवार्यात्मवत्सपैः । ऋडन्नात्मविहैरेश्च सर्वात्मा प्राविशद् व्रजम् ।  
तत्तद्वत्सान् पृथग्नीत्वा तत्तद् गोष्ठे निवेश्य सः । तत्तदात्माभवद् राजस्तत्सद्य प्रविष्टवान् ।

तन्मातरो वेणुरवत्वरोत्थिता उत्थाप्य दोर्भिः परिरथ्य निर्भरम् ।

स्वेहस्तुतस्तन्यपयः सुधासं मत्वा परं ब्रह्म सुतानपाययन् ॥२२॥

ततो नृपोन्मर्दनमज्जलेपनालङ्करक्षातिलकाशनादिभिः ।

संलालितः स्वाचरितैः प्रहर्षयन् सायं गतो यामयमेन माधवः ॥२३॥

ज्ञेवामां नहीं आवतां ए बन्नेने यारेकोर शोधवा लाङ्या.<sup>१६</sup> सर्वना साक्षी भगवान्  
वनमां कोई पशं स्थणे वाइरडांओने अने गोवाणोने नहीं देखीने आ सधणुं  
ब्रह्माए कर्यु छे, अम तरत जाणी गया.<sup>१७</sup> पछी जगतना कर्ता ईश्वर, वाइरडां  
अने गोवाणोनी माताओने तथा ब्रह्माने प्रीति उपजाववा सारु पोते ज सधणां  
वाइरडां अने गोवाणियारूपे थया.<sup>१८</sup> “जो हुं युप रहीश तो वाइरडां अने  
बाणकोनी माताओने खेद थशे अने तेओने लावीश तो ब्रह्माने मोह नहीं थाय”  
ऐवा विचारथी सधणुं जगत विष्णुमय छे, ऐवी वेदनी वाणीने सार्थक करवा  
माटे भगवान सर्व रुपे थया. गोवाणिया, वाइरडां, तेओनां नानां शरीर, हाथ,  
पग, लाकडी, शींगडी, वेशु, शींकां, अलंकार, वस्त्र, शील, गुण, नाम, आकृति,  
अवस्था अने विहारादिक जेवां हतां, ते प्रमाणे ज यथार्थ रीते सर्व रुपे थयेला  
भगवान शोभवा लाङ्या.<sup>१९</sup> पोते ज पोतारूप गोवाणोनी पासे पोतारूपे ज  
वाइरडांओने वणावी पोतारूप ज विहारोशी कीडा करता सर्वात्मा भगवान व्रजमां  
पधार्या.<sup>२०</sup> हे राजा ! सर्व रुपे थयेला श्रीकृष्ण, ते ते वाइरडांओने जुदां जुदां  
हांकी तेओने ते ते स्थानकमां पेसाडी ते ते घरमां पेठा.<sup>२१</sup> वेशुनाद सांभणी  
उतावणी उडेली गोपबाणोनी माताओ पुत्ररूपे थयेला श्रीकृष्णने, पोताना पुत्र  
मानी, परब्रह्मने ज हाथथी उपाडी तथा अत्यंत आलिंगन करी पुत्ररूपे थयेला  
श्रीकृष्णने, स्नेहने लीघे पोताना स्तनमांथी झरतां भीठां अने मट आपनार दूध  
धवराववा लागी.<sup>२२</sup> आ प्रमाणे ते ते समयनी कीडाना नियम प्रमाणे सायंकाण  
सुधी पहांयेला अने पोतानी सुंदर लीलाओथी आनंद आपता भगवानने

गावस्ततो गोष्ठमुपेत्य सत्वरं हुङ्कारघोषैः परिहूतसङ्गतान् ।

स्वकान् स्वकान् वत्सतरानपाययन् मुर्हलिहन्त्यः स्वदौधसं पयः ॥२४॥

गोगोपीनां मातृतास्मिन् सर्वा स्नेहद्विकां विना । पुरोवदास्पि हरेस्तोकता मायया विना ॥  
व्रजौकसां स्वतोकेषु स्नेहवल्ल्याब्दमन्वहम् । शनैर्नैःसीम ववृथे यथा कृष्णे त्वपूर्ववत् ॥२६  
इथमात्माऽऽत्मनाऽऽत्मानं वत्सपालमिषेण सः । पालयन् वत्सपो वर्ष चिन्तीडे वनगोष्योः ॥२७  
एकदा चारयन् वत्सान् सरामो वनमाविशत् । पञ्चषासु त्रियामासु हायनापूरणीष्वजः ॥२८  
ततो विदूराच्चरते गावो वत्सानुपव्रजम् । गोवर्धनाद्रिशिरसि चरन्त्यो ददृशुस्तृणम् ॥२९

दृष्ट्वाथ तत्स्वेहवशोऽस्मृतात्मा स गोव्रजोऽत्यात्मपदुर्गमार्गः ।

द्विपात् ककुदग्रीव उदास्यपुच्छोऽगाढ्हङ्कृतैरास्तुपया जवेन ॥३०॥

समेत्य गावोऽधो वत्सान् वत्सवत्योऽप्यपाययन् । गिलन्त्य इव चाङ्गानि लिहन्त्यः स्वौधसंपयः ।

माताओभे मर्दन, स्नान, लेपन, अलंकार, रक्षानां तिलक (गालमां काणुं टप्कुं)  
अने भोजनादिकथी लाड लडाव्या.<sup>२३</sup> पछी गायो पशु पोताने चरवाना वनमांथी  
उतावणी व्रजमां आवीने पोताना हुंकारना शब्दथी बोलावेलां अने पासे दोडी  
आवेलां पोत पोतानां वाइरडांओने आंचणमांथी झरतुं दूध धवराववा लागी  
अने वारंवार चाटवा लागी.<sup>२४</sup> सर्वरूपे थयेला भगवानमां गायो अने गोपीओनो  
मातृभाव तो पूर्वना जेवो तो रह्यो, पशु आ समयमां स्नेह वधतो देखायो. आ  
रीते भगवान पशु गायो तथा गोपीओनी आगण पूर्वनी पेठे बाणभावनुं प्रदर्शन  
करता रह्या, पशु ‘आ मारी मा छे अने हुं आनो पुत्र छुं’ ऐवो मोह रह्यो न  
हतो.<sup>२५</sup> व्रजवासीओने पूर्व यशोदाना पुत्र श्रीकृष्णमां पोताना पुत्रो करतां पशु  
वधारे, जेवो सीमा वगरनो स्नेह हतो, तेवो स्नेह आ समयमां एक वर्ष सुधी  
पोताना बाणकोमां पशु वधी गयो.<sup>२६</sup> आ प्रमाणे श्रीकृष्ण भगवाने वाइरडांओने  
पाणनार थर्ने वाइरडां अने बाणकोरूप पोताना स्वरूपने पोतेज पालन करतां  
एक वर्ष सुधी वनमां अने व्रजमां कीडा करी.<sup>२७</sup> एक वर्ष पुरु थवामां पांच के ७  
रात बाकी हती, त्यारे एक दिवसे भगवान बणभद्रनी साथे वाइरडांओने  
चारवा सारु वनमां पधार्या हता.<sup>२८</sup> त्यां बणभद्रने ऐवुं ज्ञेवामां आव्युं, जे  
गायो घणो छेटे गोवर्धन पर्वतना शिखरमां घास चरती हती ते गायो ए व्रजना  
समीपमां घास चरतां वाइरडांओने दीठा.<sup>२९</sup> देखतां ज स्नेहथी खेंचाएली,  
पोताना शरीरनुं भान भूली गयेली अने जेओना आंचणमांथी दूध झरतां हतां,  
ऐवी गायो पोताना गोवाण अने विषम मार्गने नहि गाणतां जाणे बे पगे चालती

गोपास्तद्रोधनायासमौघ्यलज्जोरुमन्युना । दुर्गाध्वकच्छतोऽभ्येत्य गोवत्सैर्ददृशुः सुतान् ॥३२  
तदीक्षणोत्प्रेमरसाप्लुताशया जातानुरागा गतमन्यवोऽर्भकान् ।

उदुह्य दोर्भिः परिभ्य मूर्धनि धाणैरवापुः परमां मुदं ते ॥३३॥  
ततः प्रवयसो गोपास्तोकाश्लेषसुनिर्वृत्ताः । कृच्छ्राच्छनैरपगतास्तदनुमृत्युदश्रवः ॥३४  
ब्रजस्य रामः प्रेमधीर्वीक्ष्यौत्कृष्णमनुक्षणम् । मुक्तस्तनेष्वपत्येष्वप्यहेतुविदचिन्तयत् ॥३५  
किमेतदद्भुतमिव वासुदेवेऽखिलात्मनि । ब्रजस्य सात्मनस्तोकेष्वपूर्वं प्रेम वर्धते ॥३६  
केयं वा कुत आयाता दैवी वा नार्युतासुरी । प्रायो मायास्तु मे भर्तुर्नान्या मेऽपि विमोहिनी ॥  
इति सञ्ज्ञन्य दाशाहें वत्सान् सवयसानपि । सर्वानाचष्टैकृण्ठं चक्षुषा वयुनेन सः ॥३८

होय, ऐवी रीते मोढां तथा पूछिडां उंचां करी वेगथी हुंकार करती वाइरडांओनी पासे आवी.<sup>३०</sup> ए गायोने जेके भीजां नानां वाइरडां हतां, तोपाण नीये ए वाइरडांओने भणीने तेओने धवराववा लागी, अने जाणो वाइरडांओनां शरीरने गणी जती होय एम चाटवा लागी.<sup>३१</sup> गोवाणो गायोने रोकवानो परिश्रम व्यर्थ जतां लाज सहित कोधथी भराएला विषम दुःख वेढीने नीये आव्या, त्यां वाइरडांओनी साथे पोताना पुत्रो तेओना जोवामां आव्या.<sup>३२</sup> पुत्रोने जोवाथी उभराई आवेला प्रेमरसमां दूबेला अने कोध मटी जतां जेओने स्नेह वध्यो छे, एवा ए गोवाणो पोताना पुत्रोने हाथवते उपाई लई आविंगन करी तथा तेओनां माथां सुंधीने परम आनंद पाम्या.<sup>३३</sup> पृष्ठी बाणकोना आविंगनथी सुख पामेला घरडा गोवाणो धीरे धीरे मांड मांड ते छोकराओ पासेथी खस्या, पाण छोकराओना स्मरणथी तेओनी आंख्योमां आंसु भराई आव्यां.<sup>३४</sup> आ प्रमाणे जेषो धाववुं छोडी दीधेलुं हतुं एवां खय्यांओ उपर पाण क्षणो क्षणो थतो व्रजना प्रेमनो वधारो जेईने, तेनुं कारण नहीं जाणता बणभद्र विचार करवा लाग्या के पूर्वे व्रजने सर्वना आत्मा श्रीकृष्ण उपर जेवो प्रेम हतो तेवो अपूर्व प्रेम हमणां बाणको उपर वध्यो छे, एटलुंज नहीं पाण मारा मनमां पाण वाइरडां अने बाणको उपर प्रेम वधतो जाय छे तेनुं कारण शुं हशे ?<sup>३५-३६</sup> आ ते देवताओनी, मनुष्योनी के देत्योनी माया हशे ! आ माया ते केवी अने क्यांथी आवी ? भीजाओनी माया तो संभवती नथी, केमके आथी मने पाण मोह थयो छे. माटे धाणुं करी आ मारा स्वामी श्रीकृष्णनी माया होवी जेईअे.<sup>३७</sup> आ प्रमाणे विचार करी बणभद्रे शानदण्डिथी जेयुं, त्यां सर्वे वाइरडां अने पोताना भित्रो श्रीकृष्णरूप तेमना

नैते सुरेशा ऋषयो न चैते त्वमेव भासीश ! भिदाश्रयेऽपि ।  
सर्व पृथक्त्वं निगमात् कथं वदेत्युक्तेन वृत्तं प्रभुणा बलोऽवैत् ॥३९॥  
तावदेत्यात्मभूरात्मानेन त्रुट्यनेहसा । पुरोवदब्दं क्रीडन्तं ददृशे सकलं हरिम् ॥४०  
यावन्तो गोकुले बालाः सवत्साः सर्व एव हि । मायाशये शयाना मे नाद्यापि पुनरुत्थिताः ॥  
इत एतेऽत्र कुत्रत्या ममायामोहितेरे । तावन्त एव तत्राब्दं क्रीडन्तो विष्णुना समम् ॥४२  
एवमेतेषु भेदेषु चिरं ध्यात्वा स आत्मभूः । सत्याः के कतरे नेति ज्ञातुं नेष्टे कथञ्चन ॥४३  
एवं सम्मोहयन् विष्णुं विमोहं विश्वमोहनम् । स्वयैव मायायाजोऽपि स्वयमेव विमोहितः ॥  
तस्यां तमोवत्रैहरं खद्योतर्त्तिरिवाहनि । महतीतरमायैश्यं निहन्त्यात्मनि युज्जतः ॥४५  
तावत् सर्वे वत्सपालाः पश्यतोऽजस्य तत्क्षणात् । व्यदृश्यन्त घनश्यामाः पीतकौशेयवाससः ॥

जोवामां आव्या.<sup>३८</sup> पृष्ठी तेमणे भगवानने पूछियुं के आपणे जे वाइरडांओनुं पालन करीऐ धीऐ तेओ ऋषिओना अंश छे अने बाणको देवताओना अंश छे, परंतु हमणां तेम जोवामां आवतुं नथी, हमणां तो आ बाणकोमां अने वाइरडांओमां एक तमे ज जोवामां आवो छो, माटे जेवुं होय तेवुं योध्युं कहो. पृष्ठी भगवाने संक्षेपथी सर्वे वात कहेतां ए बनाव बणभद्रना जाणवामां आव्यो.<sup>३९</sup> अहीं तो तेटलामां एक वर्ष नीकणी गयुं, पाण ब्रह्मानो तो पल मात्र काण थयो हतो. तेटला काणमां ब्रह्माए पाइ आवीने जोयुं, त्यां एक वर्ष सुधी पूर्वनी पेठे ज पोताना बाणभित्रोनी साथे कीडा करता भगवानने दीडा.<sup>४०</sup> ए जेईने ब्रह्मा तर्क करवा लाग्या के गोकुणमां जेटलां बाणको अने वाइरडां हतां ते सर्वे मारी मायारूपी शयनमां सूतां छे ते हज्ज सुधी उठ्यां नथी, माटे जेओ भारी मायाथी भोड पामेलां छे तेओथी नोभां आ वाइरडां अने बाणको अहीं केम देखाय छे ? जेटलांने हुं लई गयो छुं तेटली ज संख्यानां अने ते ज स्थगमां भगवाननी साथे एक वर्षथी कीडा करतां आ प्राणीओ एक वर्षथी क्यांथी आव्यां हशे ?<sup>४१-४२</sup> पोताना लोकमां रहेलां अने प्रजमां रहेलां वाइरडां तथा गोपबाणोना विषयमां धशीवार सुधी मनमां विचार करीने ए ब्रह्मा, आमां साचां क्यां अने खोटां क्यां ? ए कोई रीते जाणी शक्या नहीं.<sup>४३</sup> आ प्रमाणे ब्रह्मा, जगतने भोड पमाडनार, अने पोते भोड रहित एवा भगवानने पोतानी मायाथी भोड पमाडवा गया, त्यां पोते ज भोड पामी गया.<sup>४४</sup> अंधारी रातमां झाकणथी थयेलुं अंधारं जेम नोभुं आवरण करी शके नहीं, पाण तेमां ज लय पामे; अने जेम आगियानो प्रकाश दिवसमां नोभो प्रकाश करी शके नहीं, तेम भोटा पुरुष उपर भीजो कोई

चतुर्भुजाः शङ्खचक्रगदाराजीवपाणयः । किरीटिनः कुण्डलिनो हारिणो वनमालिनः ॥४७  
 श्रीवत्साङ्गदोरलकम्बुकङ्गणपाणयः । नूपैः कटकैर्भाताः कटिसूत्राङ्गुलीयकैः ॥४८  
 आङ्गिमस्तकमापूर्णस्तुलसीनवदामभिः । कोमलैः सर्वगात्रेषु भूरिपुण्यवर्दप्तैः ॥४९  
 चन्द्रिकाविशदस्मरैः सारुणापाङ्गवीक्षितैः । स्वकार्थानामिव रजःसन्त्वाभ्यां स्वष्टपालकाः ॥  
 आत्मादिस्तम्बपर्यन्तैर्मूर्तिमद्विश्वराचरैः । नृत्यगीताद्यनेकाहैः पृथक् पृथगुपासिताः ॥५१  
 अणिमाद्यैर्महिमभिरजाद्याभिर्विभूतिभिः । चतुर्विशतिभिस्तत्त्वैः परीता महदादिभिः ॥५२  
 कालस्वभावसंस्कारकामर्कमर्गुणादिभिः । स्वमहिध्वस्तमहिभिर्मूर्तिमद्विरुपासिताः ॥५३  
 सत्यज्ञानानन्तानन्दमात्रैकरसमूर्तयः । अस्यृष्टभूरिमाहात्म्या अपि हृष्णिषद्दृशाम् ॥५४

साधारण पुरुष माया यत्ताववा ज्ञाय तो ते नीय माया भोटा पुरुषने कांड पशु  
 करी शके नहीं, पशु उिलटी पोताने यत्तावनारना ज सामर्थ्यनो नाश करी नाखे.<sup>५५</sup>  
 ब्रह्मा जोई रह्या तेटली वारमां तुरत ज भीजुं आश्वर्य थयुं. सधणां वाइरडां,  
 तेओने पाणनारा बाणको, लाकडीओ अने शींगडीओ आदि सधणा पदार्थो मेघनी  
 पेठे श्याम, पीणां रेशभी वस्त्रवाणा, चार चार भुजावाणा अने जेओना हाथमां  
 शंख, चक्र, गदा तथा पद्म हतां एवा ज्ञेवामां आव्या. ए सर्वे श्रीकृष्णनां रुपो ए  
 किरीट, कुंडण, हार, वनमाणा, श्रीवत्स, बाजुबंध, नूपुर, कटक, कटिमेघणा,  
 वीटीओ अने शंखनी पेठे त्रण धारवाणा रत्नना कंकण धर्या हता.<sup>५६-५८</sup> भोटा  
 पुरुषवाणा ओ अर्पण करेकी तुलसीनी सुकोमण अने नवीन माणाओथी  
 यत्तावाथी ते छेक मस्तक सुधी सर्व अंगोमां वीटायेला हता.<sup>५९</sup> चांदनी जेवा स्वच्छ  
 मंदहास्यरुपी सत्यगुणाथी पोताना भक्तोना भनोरथोने जाणे पाणता होय अने  
 लालकमण जेवां नेत्रोना दृष्टिपातरुपी रजेगुणाथी पोताना भक्तोना भनोरथोने  
 जाणे झजता होय, एवा देखाता हता.<sup>६०</sup> ब्रह्माथी स्तंभपर्यंत ए सर्व स्थावर  
 जंगम देहधारी मूर्तिमान थर्ने नाय अने गायन आदि अनेक पूजनोथी प्रत्येकनी  
 नोभनोधी सेवा करता हता.<sup>६१</sup> अणिमा आदि सिद्धिओ, माया आदि विभूतिओ  
 अने महतत्व आदि योवीश तत्वोथी तेओ प्रत्येक वीटायेला हता.<sup>६२</sup> काण,  
 स्वभाव, संस्कार, काम, कर्म अने गुणादिक पदार्थो मूर्तिमान थर्ने प्रत्येकनी  
 नोभनोधी सेवा करता हता. अणिमा आदि सर्वे पदार्थोनी स्वतंत्रता  
 श्रीकृष्णना महिमा आगण नाश पामेली ज्ञाती हती.<sup>६३</sup> ए गोवाणियारुप  
 सर्वे श्रीकृष्णो सत्य, शान, अनंत, आनंदमात्र अने एकरस मूर्तिवाणा तथा  
 आत्मशानरुपी यक्षवाणाओथी पशु जेना माहात्म्यनो स्पर्श थर्ने शके नहीं एवा

एवं सकृद ददर्शाजः परब्रह्मात्मनोऽखिलान् । यस्य भासा सर्वमिदं विभाति सच्चाचरम् ॥  
 ततोऽतिकुतुकोद्वत्स्तिमितैकादशेन्द्रियः । तद्वाम्नाभूदजस्तृष्णी पूर्देव्यन्तीव पुत्रिका ॥५६  
 इतीरेशेऽतक्ये निजमहिमनि स्वप्रमितिके परत्राजातोऽतन्निरसनमुखब्रह्मकमितौ ।  
 अनिशेऽपि द्रष्टुं किमिदमिति वा मुहूर्ति सति चछादाजो ज्ञात्वा सपदि परमोऽजाजवनिकाम् ॥  
 ततोऽर्वाक् प्रतिलब्धाक्षः कः परेतवदुत्थितः । कृच्छ्रदुम्नील्य वै दृष्टिराचष्टेदं सहात्मना ॥५८  
 सपद्येवाभितः पश्यन् दिशोऽपश्यत् पुरः स्थितम् । वृन्दावनं जनाजीव्यद्वामकीर्ण समाप्रियम् ॥  
 यत्र नैसर्गदुर्वैराः सहासन् नृमृगादयः । मित्राणीवाजितावासद्वृतरुदर्त्तर्षकादिकम् ॥५९

तत्रोद्वहत् पशुपवंशशिशुत्वनाट्यं ब्रह्माद्वयं परमनन्तमगाधबोधम् ।

वत्सान् सखीनिव पुरा परितो विचिन्वदेकं सपाणिकवलं परमेष्ठ्यचष्ट ॥६१॥

दृष्ट्वा त्वरेण निजधोरणतोऽवतीर्य पृथ्व्यां वपुः कनकदण्डमिवाभिपात्य ।

स्पृष्ट्वा चतुर्मुकुटकोटिभिरङ्गियुगमं नत्वा मुदश्रुसुजलैरकृताभिषेकम् ॥६२॥

हता.<sup>५४</sup> आ प्रमाणे ब्रह्माए एक समयमां सर्वने परब्रह्ममय दीठा के जे  
 परब्रह्मना प्रकाशथी आ सर्व जगत प्रकाशे छे.<sup>५५</sup> पछी अत्यंत आश्वर्यथी अने  
 श्रीकृष्णना तेजथी जेनी सर्वे ईद्रियो जड थर्न गई, एवा ब्रह्मा पूतणानी पेठे  
 निश्चण थर्न गया.<sup>५६</sup> आ प्रमाणे अतक्य, स्वयंप्रकाश, सुभमय, प्रदृतिथी पर  
 अने ते नहि ते नहि आ रीते निषेध पूर्वक उपनिषदो द्वारा जाणी शकाता एवा  
 पोताना असाधारण महिमावाणा स्वरूपमां “आते शुं” एम ब्रह्मा भोउ पामी  
 गया, अने पछीथी ज्ञेवाने पशु अशक्त थर्न जतां ते जाणीने परमेश्वर श्रीकृष्णे  
 पोतानी मायारुपी पडदो खसेडी लीधो.<sup>५७</sup> पछी जाणे मरी जर्नने पाधा उक्त्या  
 होय अने जेने बहारनुं शान मण्युं एवा ब्रह्माए मांड नेत्र उधाइयां, त्यां  
 पोताना शरीरनी साथे जगत आ प्रमाणे ज्ञेवामां आव्यु.<sup>५८</sup> तरत ज चारेकोर  
 दृष्टि केरवी त्यां आगण रहेलुं सधणां प्रिय पदार्थोथी भरेलुं अने मनुष्योने ज्ञविका  
 आपे एवां वृक्षोथी व्याम वृंदावन दीर्हुं के जेमां स्वाभाविक दुष्ट वैरवाणा माणस  
 अने सिंहादिक जाणे परस्परना भित्र होय एवा थर्नने रह्या हता अने भगवानना  
 निवासने लीधे कोध लोभादिक दोषो जेमांथी नीकणी गया हता.<sup>५९-६०</sup> ए वृंदावनमां  
 पूर्वनी पेठे ज गोवाणना बाणकपशारुपी नाटक करनारा श्रीकृष्णभगवानने दीठा  
 के जे अद्वैतरुप छितां वाइरडां अने शोधता हता, एक अने अगाध ज्ञानवाणा  
 छितां भित्रोने शोधता हता, अनंत छितां चारेकोर फरता हता. सर्वेना कारणरुप  
 छितां बाणकपशुं धरी रह्या हता. अने परब्रह्म छितां हाथमां दहींभातनो कोणियो

उथायोत्थाय कृष्णस्य चिरस्य पादयोः पतन् । आस्ते महित्वं प्रागदृष्टं स्मृत्वा स्मृत्वा पुनः पुनः ।  
श्नैरथोत्थाय विमृज्य लोचने मुकुंदमुद्भीक्ष्य विनप्रकंधरः ।  
कृतांजलिः प्रश्रयवान् समाहितः स्वेपथुर्गद्वैलतेलया ॥६४॥  
इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे  
पूर्वर्धे ऋयोदशोऽध्यायः ॥१३॥

### अथ चतुर्दशोऽध्यायः (१४)

ब्रह्मोवाच -

नौमीङ्ग तेऽभ्रवपुषे तडिदंबराय गुंजावतंसपरिपिच्छलसन्मुखाय ।  
वन्यस्तजे कवलवेत्रविषाणवेणुलक्ष्मश्रिये मृदुपदे पशुपांगजाय ॥१॥  
अस्यापि देव वपुषो मदनुग्रहस्य स्वेच्छामयस्य न तु भूतमयस्य कोऽपि ।  
नेशो महि त्ववसितुं मनसाऽन्तरेण साक्षात्तवैव किमुतात्मसुखानुभूतेः ॥२॥

धरी रह्या हता. आवा भगवानने ज्ञेई ब्रह्मा तरत पोताना वाहन परथी उतरी पड्या, अने दंडवत् करवा लाग्या, चार मुकुटोनी अण्डीओथी भगवानना बे चरणारविंदनो स्पर्श कर्यो अने प्रशाम करीने आनंदना आंसुरुप जग्नथी अभिषेक कर्या.<sup>६१-६२</sup> पूर्वे ज्ञेला भहिमानुं वारंवार स्मरण आवतां उठी उठीने घणीवार सुधी भगवानना चरणमां दंडवत् प्रशाम कर्या.<sup>६३</sup> पछी धीरेथी उठी आंभओ लुई नाखी, भगवानने ज्ञेई धूजता, हाथ जोडी उभेला, सावधान अने विनयवाणा ब्रह्मा पोतानी डोक नमावीने गद्गद वाणीथी स्तुति करवा लाग्या.<sup>६४</sup> इति श्रीमद् महापुराण भागवतना दशम स्कन्धनो तेरमो अद्याय संपूर्णं.

### अद्याय १४

ब्रह्माजे श्रीकृष्णनी करेली स्तुति.

ब्रह्मा स्तुति करे छे- हे स्तुति करवा योग्य ! भेघनी पेठे श्याम शरीरवाणा, वीजणी समान पीणां वस्त्रवाणा, यशोठीनां कर्णभूषण तथा फरतां भोरपीछना मुकुटी शोभता मुभवाणा, वनमां थेलां पुष्पादिकी माणा धरनारा, कोमण चरणवाणा, गोवाणना पुत्र अने कोणियो, छडी, शींगडी तथा वेषुरुप चिह्नोथी शोभी रहेला आपने प्रशाम कर्संधुं.<sup>१</sup> हे देव ! मारा उपर अनुग्रह करनार अने भक्तोनी ईच्छा पूर्ण करनार, दिव्य शुद्धसत्त्वमय जेनुं शरीर छे. अने सर्वना

ज्ञाने प्रयासमुदपास्य नमन्त एव जीवन्ति सन्मुखरितां भवदीयवार्ताम् ।  
स्थाने स्थिताः श्रुतिगतां तनुवाङ्मनेभिर्ये प्रायशोऽजित ! जितोऽप्यसि तैस्त्रिलोक्याम् ॥३॥  
श्रेयःस्वृति भक्तिमुदस्य ते विभो ! क्लिश्यन्ति ये केवलबोधलब्धये ।  
तेषामसौ क्लेशल एव शिष्टते नान्यद् यथा स्थूलतुषावधातिनाम् ॥४॥  
पुरेह भूमन् बहवोऽपि योगिनस्त्वर्दर्पितेहा निजकर्मलब्धया ।  
विबुध्य भक्त्यैव कथोपनीतया प्रपेदिरेऽज्जोऽच्युत ! ते गर्ति पराम् ॥५॥  
तथापि भूमन् ! महिमागुणस्य ते विबोद्धुर्महत्यमलान्तरात्मभिः ।  
अविक्रियात् स्वानुभवादरूपतो ह्यनन्यबोध्यात्मतया न चाच्यथा ॥६॥  
गुणात्मनस्तेऽपि गुणान् विमातुं हितावतीर्णस्य क ईशिरेऽस्य ।  
कालेन यैर्वा विमिताः सुकल्पैर्भूपांसवः खे मिहिका द्युभासः ॥७॥

शरीरी तथा स्वस्वरूपना अनुभवथी युक्त, ऐवा तमारा भहिमानो भनवडे निश्चय करवा हुं समर्थ नथी, तो बीजा समर्थ न होय तेमां कहेवुं ज शुं ?<sup>२</sup> हे आजित ! शानमां थोडो पश परिश्रम नहीं करतां जे लोको सत्पुरुषोना मुभमांथी नीकपेली अने कानपर आवेली आपनी कथाने पोतानी धर्म भर्यादामां रहीने देह, वाणी अने मनथी सत्कार आपता ज्ञेछे, ते लोकोने आप त्रिलोकमां कोईने वश थया नथी ते वश थईने रहो छो.<sup>३</sup> जेमांथी कल्याणाना प्रवाह नीकण्या करे छे ऐवी आपनी भक्तिने छोडी दै, जे लोको एकला ब्रह्मज्ञानने माटे ज दाखडो कर्या करे छे, ते लोकोने झोतरां खांडनाराओनी पेठे केवण दाखडो ज फणरुपे मणे छे, पश बीजुं कशुं फण मणतुं नथी.<sup>४</sup> हे महाराज ! आलोकमां पूर्वे घणाक योगीओ पोतानी सर्वे येष्टाओ तमोने अर्पण करी दीधा पछी, पोताना सत्कर्मथी प्राप्त थयेली अने तमारी कथाना श्रवणादिके करीने पुष्टिने पमाडेली ऐवी, भक्तिथी ज आत्मज्ञान पामी अनायासे आपनी परमगतिने पामी गया छे.<sup>५</sup> हे अमाप ! ईद्रियोनो निग्रह करनारा पुरुषो विषय आकारथी रहित अने आत्माकार थयेला अंतःकरणथी स्वयंप्रकाशपणे अने चिदाकाशना अविषयपणे हजु कदाच आपना निर्गुण स्वरूपना भहिमाने जाणी शके छे पश आपना सगुण स्वरूपनुं परिपूर्णं ज्ञान तो थाय ज नहीं, कारण के तमारा गुणो अयिंत्य अने अनंत छे.<sup>६</sup> आप गुणोना अधिष्ठाता अने आ जगतना हितने माटे अवतरेला छो, तमारा गुणोनी गणाना करवाने पश कोण समर्थ थया छे ? जे अत्यंत निपुण लोकोये घणा जन्मथी पृथ्वीना २४कण, आकाशमां डिमनी कणीओ अने नक्षत्रादिकी किरणोना

तत्तेऽनुकम्पां सुसमीक्षमाणो भुज्जान एवात्मकृतं विपाकम् ।  
हृद्वागवपुर्भिर्विदधन्नमस्ते जीवेत यो मुक्तिपदे स दायभाक् ॥८॥  
पश्येश ! मे ऽनार्थमनन्त आद्ये परात्मनि त्वय्यपि मायिमायिनि ।  
मायां वितत्येक्षितुमात्मवैभवं ह्याहं कियानैच्छमिवार्चिरग्नौ ॥९॥  
अतः क्षमस्वाच्युत ! मे रजोभुवो ह्याजानतस्त्वत्यृथगीशमानिनः ।  
अजावलेपान्धतमोऽन्धचक्षुष एषोऽनुकम्प्यो मयि नाथवानिति ॥१०॥  
क्षाहं तमोमहदहंखचरागिनवार्भूसंवेष्टिताणडघटसमवितस्तिकायः ।  
क्लैद्विधाविगणिताणडपराणुचर्यावाताध्वरोमविवरस्य च ते महित्वम् ॥११॥  
उत्क्षेपणं गर्भगतस्य पादयोः किं कल्पते मातुरधोक्षजागसे ।  
किमस्तिनास्तिव्यपदेशभूषितं तवास्ति कुक्षेः कियदप्यनन्तः ॥१२॥

परमाणुओने गणी काढ्या होय, तेओथी पाण तमारा गुणोने गणी शकाय नहीं.<sup>९</sup>  
ऐटला माटे आपनी कृपा क्यारे थशे ? ऐम मानपूर्वक राह जोया करतो, अने  
आसक्ति छोडी दृढ़ने पोतानां कर्मझने भोगव्या करतो, जे पुरुष मन, वाणी  
अने शरीरथी आपने प्रशाम करतो ज्वे छे, ते पुरुषने मुक्तिना पदमां भाग  
मणे छे. अर्थात् मुक्तिनो अधिकारी थाय छे.<sup>१०</sup> हे ईश्वर ! मारी भूंडाई तो जुओ  
!!! आप, के जे मायावीओने पाण मोह करनार परमात्मा छो, तेमना उपर पाण  
पोतानी माया यलावीने में तमारुं ऐश्वर्य जोवानी ईश्छा करी. अग्नि थकी उत्पन्न  
थयेलो तषाखो जेम अग्नि पासे अति तुच्छ छे तेम आपनी पासे हुं शी गणत्रीमां<sup>११</sup>  
ऐटला माटे रजेगुणाथी उत्पन्न थयेल, हुं जगतनो कर्ता छुं, आवा मदरुपी  
धाटा अंधाराथी आंधणो अने तमाराथी मारी नोभी ईश्वरता माननार छुं, तेना  
अपराधने क्षमा करजो. आपे ऐम विचारी दया राखवी के ब्रह्मा ज्ञेके भीजे  
ठेकाणो प्रभुपणाथी वर्ते छे, तोपाण मारो तो दास ज छे.<sup>१२</sup> जे हुं प्रकृति, महतात्प,  
अहंकार, आकाश, वायु, अग्नि, जग अने पृथ्वीथी वीटाएला ब्रह्मांडमां सात  
वेंतनी क्रायावाणो छुं ते क्यां ? अने ऐवां अगणित ब्रह्मांडरुप परमाणुओ जेमनां  
रुवाडानां छिद्ररुप गोभलाओमां फर्या करे छे, ऐवा आपनो महिमा क्यां ? !!!  
माटे मने अति तुच्छ जाणी आपे मारा पर दया करवी.<sup>१३</sup> हे महाराज ! गर्भमां  
रहेलो भाणक पोताना पग उछाणे ए कांઈ तेषो पोतानी मातानो अपराध कर्यो  
कहेवाय ? ऐवी रीते स्थूल सूक्ष्म अथवा कार्य कारण शब्दथी कहेवामां आवतु,  
सधणुं जगत आपना उद्दरथी भहार नथी, तो तेमां हुं पाण अंतर्गत आव्यो माटे

जगत्वयान्तोदधिसम्लवोदे नारायणस्योदरनाभिनालात् ।  
विनिर्गतोऽजस्त्विति वाङ्मन वै मृषा किं त्वीश्वर त्वन्न विनिर्गतोऽस्मि ॥१३॥  
नारायणस्त्वं न हि सर्वदेहिनामात्मास्यधीशाखिललोकसाक्षी ।  
नारायणोऽङ्गं नरभूजलायनात्तच्चापि सत्यं न तवैव माया ॥१४॥  
तच्चेजजलस्थं तव सज्जगद्वपुः किं मे न दृष्टुं भगवंस्तदैव ।  
किं वा सुदृष्टुं हृदि मे तदैव किं नो सपद्येव पुनर्वर्दर्शि ॥१५॥  
अत्रैव मायाधमनावतारे हास्य प्रपञ्चस्य बहिः स्फुटस्य ।  
कृत्स्नस्य चान्तर्जंठे जनन्या मायात्वमेव प्रकटीकृतं ते ॥१६॥

मारा अपराधनी क्षमा करवी.<sup>१७</sup> हे ईश्वर ! प्रलय काणमां ऐकठा थयेला समुद्रोना  
जगमां नारायणना उद्दरनी नाभिना नाणवामांथी ब्रह्मा नीकणेल छे, ऐम जे  
कहेवामां आवे ते खोटुं नथी ज. हुं शुं आपमांथी उत्पन्न थयो नथी ? उत्पन्न थयो  
ज धुं. माटे हुं आपनो पुत्र होवाथी आपे मारा अपराधनी क्षमा करवी.<sup>१८</sup> (आप  
नारायण नथी ? छो ज. केमके नार ऐटले ज्वनो समूह, अयन ऐटले आश्रय,  
सर्वे ज्वोना आश्रय जे होय तेने नारायण कहेवाय, तो आप सर्व प्राणीओना  
आश्रयरुप अने वणी आत्मा होवाथी आपमां नारायणपणुं घटे छे. आप  
नारायण नथी ? छो ज. केमके नार ऐटले ज्वोनो समूह अयन ऐटले प्रवर्तक,  
सर्वे ज्वोना जे प्रवर्तक होय तेने नारायण कहेवाय, तो आप सर्व प्राणीओना  
प्रवर्तक होवाथी आपमां नारायणपणुं घटे छे. वणी नार ऐटले ज्वोना समूह  
अने अयन ऐटले ज्वाणनार साक्षी कहेवाय, ते आप सर्व लोकना साक्षी होवाथी  
आपमां नारायणपणुं घटे छे. (बीजो अर्थ) नार ऐटले जग, अयन ऐटले  
रहेनार, नार शब्दथी कहेला जगमां जे रहेनार होय, तेने कहेवाय नारायण.  
आवो प्रसिद्ध अर्थ लईअे तोपाण आप ज नारायण छो; केमके जगमां रहेनारी  
जे भूर्ति छे ते आपनी ज छे, वास्तविक रीते जोईअे तो व्यापक ऐवा आपनी  
जगता मापमां आवेली ए भूर्ति साची ज छे.)<sup>१९</sup> जगतना आश्रयरुप ऐवुं  
तमारुं जगमां रहेलुं ते रुप साचुं होय, तो में कमणना नाणमां अंदर पेसीने सो  
वर्ष सुधी शोध्या कर्यु त्यारे ते जोवामां केम नहीं आव्युं ? हृदयमां पाण केम न दीहुं  
? अने पाइंतप कर्या पछी तरत ज केम जोवामां आव्युं ? माटे ऐ परिच्छिन्नत्व  
केवण तमारी ईश्छा शक्तिथी ज संभवे छे. वस्तुताए आप परिच्छिन्न नथी.  
आपना स्वरूपने कोई देशनो परिच्छेद घटे ज नहीं.<sup>२०</sup> हे मायाने भटाडनार !

યस્ય કુક્ષાવિદં સર્વ સાતમં ભાતિ યથા તથા । તત્ત્વચ્છ્યપીહ તત્ સર્વ કિમિદં માયયા વિના ॥  
અદ્યૈવ ત્વદૃતેઽસ્ય કિં મમ ન તે માયાત્વમાદર્શિત મેકોડસિ પ્રથમં તતો વ્રજસુહૃદ વત્સાઃ  
સમસ્તા અપિ । તાવનોડસિ ચતુર્ભુજાસ્તદખિલૈઃ સાકં મયોપાસિતાસ્તાવન્યેવ  
જગન્યભૂસ્તદમિતં બ્રહ્માદ્વયં શિષ્યતે ॥૧૮॥

અજાનતાં ત્વયદવીમનાત્મનાત્મના ભાસિ વિતત્વ માયામ् ।  
સૃષ્ટાવિવાહં જગતો વિધાન ઇવ ત્વમેષોઽન્ત ઇવ ત્રિનેત્રઃ ॥૧૯॥  
સુરેષ્વધિષ્ણીશ! તથૈવ નૃઘણી તિર્યક્ષુ યાદસ્વધણી તેઽજનસ્ય ।  
જન્માસતાં દુર્મદનિગ્રહાય પ્રભો! વિધાતઃ સદનુગ્રહાય ચ ॥૨૦॥

આ અવતારમાં જ સમગ્ર જગત માતા યશોદાને પોતાના ઉદ્રમાં દેખાડીને જ તમોએ તમારું વિચિત્ર શક્તિપણું પ્રગટ કરેલું છે. કારણ કે તમો વિચિત્ર શક્તિથી યુક્ત હોવાથી આ રીતે બતાવવા સમર્થ છો. <sup>૧૬</sup> આપના ઉદ્રમાં જેવું સર્વ જગત દેખાયું હતું તેવું બહાર પણ દેખાય છે. અને તે વળી આપ સહિત દેખાયું હતું તો આ સર્વ તમારી વિચિત્ર શક્તિ વિના ધટે નહીં. જો બહાર રહેલા જગતનું આપના ઉદ્રમાં પ્રતિબિંબ દેખાયું હોય, તો તે બહારનાથી ઊલદું દેખાવું જોઈએ, અને જો આપ દર્પણને ઠેકાણે હો તો આપમાં જ આપનું દેખાવું ધટે નહીં. માટે સર્વથા તમારું વિચિત્રશક્તિથી યુક્તપણું જ સિદ્ધ થાય છે. <sup>૧૭</sup> તમારી વિચિત્રશક્તિથી યુક્તપણું આપે મને શું હમણાં જ ન દેખાડું? કેમ કે પ્રથમ આપ એક હતા. પછી સર્વ ગોવાળીયા અને વાઇરાંદ્રૂપ થઈ ગયા. થોડીવારમાં વળી સંઘળા ચતુર્ભુજ અને મારા સહિત સર્વ તત્વોદ્વારા સેવાતા જોવામાં આવ્યા અને પાછાં તેટલાં જ બ્રહ્માંડ બની ગયાં. આ બધું તમારી વિચિત્રશક્તિથી જ ધટે છે. <sup>૧૮</sup> હેહમાં આત્માભિમાનને કારણે અથવા “હું સ્વતંત્ર છું.” આવા સ્વતંત્રપણાના અભિમાનને કારણે આપના સ્વરૂપને નહીં જાણનારા લોકોને આપ માયાનો વિસ્તાર કરીને સૃષ્ટિના સમયમાં જાણો બ્રહ્મા થયા હો, પાલનના સમયે જાણો વિષ્ણુ થાય હો અને પ્રલયના સમયે જાણો રૂઢ થયા હો એવા જણાઓ છો. અર્થાત્ બ્રહ્માજી કહે છે કે સૃષ્ટયાદિના સમયે તમારા થકી ઐશ્વર્યને પામેલા અમે ત્રણે પરમેશ્વરપણે જણાઈએ છીએ, છતાં વાસ્તવિકપણે અમો પરમેશ્વર નથી. પરમેશ્વરતો તમો એક જ છો. <sup>૧૯</sup> હે ઈશ્વર! હે પ્રભુ! હે વિધાતા! હેવ, ઝષિ, મનુષ્ય, પણ, પક્ષી અને જળજંતુઓમાં પણ આપના જે અવતાર થાય છે તે નીચે લોકોના દુષ્ટ મદને ટાળી નાખવા અને સજજનો પર અનુગ્રહ કરવાને માટે થાય

કો વેત્તિ ભૂમન्! ભગવન्! પરાત્મન्! યોગેશ્વરોતીર્ભવતસ્ત્રિલોક્યામ् ।  
ક્ર વા કથં વા કતિ વા કદેતિ વિસ્તારયન્ ક્રીડસિ યોગમાયામ् ॥૨૧॥  
તસ્માદિદં જગદ્શેષમસત્સરૂપં સ્વધારભમસ્તધિષણં પુરુદુઃખદુઃખમ् ।  
ત્વચ્યેવ નિત્યસુખબોધતનાવનને માયાત ઉદ્યદપિ યત્ સદિવાવભાતિ ॥૨૨॥  
એકસ્ત્વમાત્મા પુરુષ: પુરાણ: સત્ય: સ્વયંજ્યોતિરનન્ત આદ્યઃ ।  
નિત્યોઽક્ષરોઽજસ્સમુખો નિરજ્જન: પૂર્ણોઽદ્વયો મુક્ત ઉપાધિતોઽમૃતઃ ॥૨૩॥  
એવંવિધં તંત્રં સકલાત્મનામપિ સ્વાત્માનમાત્મતયા વિચક્ષતે ।  
ગુર્વક્લબ્ધોપનિષત્સુચક્ષુષા યે તે તરનીવ ભવાનૃતાસ્તુધિમ् ॥૨૪॥  
આત્માનમેવાત્મતયાવિજાનતાં તેનૈવ જાતં નિખિલં પ્રપણિતમ् ।  
જાનેન ભૂયોઽપિ ચ તત્ પ્રલીયતે રજ્જચામહેર્મેગભવાભવૌ યથા ॥૨૫॥

છે. <sup>૨૦</sup> હે વ્યાપક! હે પરમાત્મા! આપ યોગમાયાનો વિસ્તાર કરી અનેક અવતારો ધારણ કરીને અનેક કીડાઓ કરો છો, તમારી એ અવતારરૂપ કીડાઓ કયા પ્રકારે કરો છો? કઈ જ્ઞાતિમાં છે? કેવી છે? ક્યારે છે? અને એ અવતારરૂપ કીડાઓ કેટલી છે? તેને ત્રિલોકીમાં કોણ જાણો છે? કોઈ પણ જાણતો નથી. <sup>૨૧</sup> એટલા માટે નિત્ય, સુખમય અને અનંત એવા આપના સ્વરૂપમાં આપના સંકલ્પથી ઉત્પત્ત થતું અને પાછું લય પામતું સ્વપ્ન સરખું અનિત્ય, અને દુઃખરૂપ આ જગત સતત પરિણમી હોવાથી અસત્ય છે, છતાં આપના સ્વરૂપને નહિ જાણનારા પુરુષોને સત્યની સમાન જણાય છે. <sup>૨૨</sup> હે પ્રભુ! તમો સત્ય છો, નિર્વિકાર છો અર્થાત્ વિકારી જડતત્ત્વથી વિલક્ષણ છો, અને તમો સ્વયંપ્રકાશ છો. સ્વરૂપ સ્વભાવે કરીને સર્વત્ર વ્યાપક છો, અર્થાત્ નિત્યમુક્તોથી વિલક્ષણ છો. અને આપ કામાધીન દેહના સંબન્ધથી રહિત છો, અને આપ પુણ્ય-પાપરૂપ અંજનથી રહિત છો. અર્થાત્ બદ્ધજીવથી વિલક્ષણ છો, અને વળી આપ અમૃત છો. અર્થાત્ ભરણ ધર્મથી રહિત છો. અને આપ અક્ષર છો, ઇપ્રકારના વિકારથી રહિત છો, આપ પૂર્ણ છો, તેથી આપની વૃદ્ધિ નથી. આપ દુઃખથી રહિત નિરંતર સુખરૂપ છો, જગતના આદિ કારણ હોવાથી આપ આદિપુરુષ છો, આપ એક છો, અર્થાત્ પ્રલયકાળે ચેતન અને અચેતન તત્ત્વને પ્રકૃતિમાં લય પમાડી આપ એક જ રહો છો. આપ અદ્વિતીય છો, અર્થાત્ આપની હરોળમાં ઊભી શકે એવો બીજો કોઈ નથી. આવા તમો છો. <sup>૨૩</sup> હે પ્રભુ! આવા સર્વ આત્માઓના પણ આત્મા તમોને જે પુરુષો ગુરુરૂપી સૂર્ય થકી જ્ઞાન દસ્તિ પ્રામ કરીને સર્વના અંતર્યામિ પણો જુએ (જાણો) છે. તે પુરુષો

अज्ञानसंज्ञौ भवबन्धमोक्षौ द्वौ नाम नान्यौ स्त ऋतज्ञभावात् ।  
 अजस्वचित्यात्मनि केवले परे विचार्यमाणे तरणाविवाहनी ॥२६॥  
 त्वामात्मानं परं मत्वा परमात्मानमेव च । आत्मा पुनर्बहिर्मृग्य अहोऽज्ञनताज्ञता ॥२७॥  
 अन्तर्भवेऽनन्त भवन्तमेव ह्यतत्त्वजन्तो मृग्यन्ति सन्तः ।  
 असन्तमध्यन्त्यहिमन्तरेण सन्तं गुणं तं किमु यन्ति सन्तः ॥२८॥  
 अथापि ते देव पदाम्बुजद्वयप्रसादलेशानुगृहीत एव हि ।  
 जानाति तत्त्वं भगवन् महिमो न चान्य एकोऽपि चिरं विचिन्वन् ॥२९॥

संसाररूपी असत्य समुद्रने तरी ज्य छे.<sup>२४</sup> हे प्रभु ! જે જીવો પરमात्माने અंतर्यामी જ्ञानता નથી, તે જીવોનे તમारा એ અજ्ञानथી જ આ સર્વे પ્રપंच (संसार) ઉભો થाय છે. કારણ કે જે જીવો તમોને સર्वान्तર्यामी જ्ञानતा નથી તે જીવો તમારી ઉપાસના કરતા નથી. તેથી દેહને વિષે આત્મભ્રમ અને પોતાને વિષે સ્વતંત્રપણાનો ભ્રમ ઉદ્ય પામે છે. અને દેહાત્મભ્રમ તથા સ્વતંત્રતાના ભમથી જ સંસારની ઉત્પત્તિ થાય છે. અને તમોને સર्वान्तર्यामી જ्ञાનવાથી પાછો એ સંસાર લીન થઈ જ्य છે. જેમ દોરડીના યથાર્થ જ્ઞાનના અભાવથી સર્પનો ઉદ્ય થાય છે. અને યથાર્થ જ્ઞાનથી પાછો સર્પનો લય થઈ જ्य છે. તેવી રીતે પરમात્માના જ્ઞાનથી મુક્તિ થઈ જ्य છે.<sup>२५</sup> હે પ્રભુ ! સંસારનું બંધન અને સંસારથકી મોક્ષ આ બગેનું મૂળ કારણ અજ્ઞાન અને જ્ઞાન મનાયેલ છે. તમારા ઉપાસનાત્મક જ્ઞાનના અભાવથી બંધન થાય છે. અને તે જ્ઞાનથી મોક્ષ થાય છે. જેમ દિવસે સૂર્યોદય થતાં જ અંધકારનો લય થઈ જ્ય છે. તેમ ઉપાસનાએ કરીને પરમતત્ત્વ પરમાત્મા એવા જે તમો, તે તમારો સાક્ષાત્કાર થતાં જ સંસાર લય પામી જ્ય છે.<sup>૨૬</sup> હે પ્રભુ ! જે પુરુષો પરમાત્મા એવા તમોને જીવસ્વરૂપ માની કરી અને જીવસ્વરૂપને દેહસ્વરૂપ માની કરીને, તમોને વારંવાર બહાર શોધે છે તો એ અજ્ઞાની પુરુષોની કેટલી અજ્ઞાનતા છે. ઘરમાં ખોવાયેલી વસ્તુને બહાર શોધવી એ આશ્રયજનક અજ્ઞાનતા છે. તેવું જ અજ્ઞાન પરમાત્માને બહાર શોધવાનું છે. જે વિવેકી પુરુષો છે એ તો આત્માના અંતરાત્માપણો તમારી ઉપાસના કરે છે.<sup>૨૭</sup> હે પ્રભુ ! વિવેકી પુરુષો છે તે આ શરીરને મધ્યે જીવપર્યન્ત પચીસ તત્ત્વોનો ત્યાગ કરીને પચીસ તત્ત્વોથી વિલક્ષણ એવા તમોને શોધે છે. જેમ દોરડીના યથાર્થ સ્વરૂપને જ્ઞાનના વિવેકી પુરુષો પોતાની સમીપે રહેલી અને તત્ત્વપૂર્વક જ્ઞાનાતી દોરડીને વિષે

તદસ્તુ મે નાથ સ ભૂરિભાગે ભવેદ્ત્ર વાન્યત્ર તુ વા તિરશ્શામ् ।  
 યેનાહમેકોઽપિ ભવજ્જનાનાં ભૂત્વા નિષેવે તવ પાદપલ્કવમ् ॥૩૦॥  
 અહોઽતિધન્યા બ્રજગોરમણ્ય: સત્યામૃતં પીતમતીવ તે મુદા ।  
 યાસાં વિભો વત્સતરાત્મજાત્મના યન્તૃસ્યેઽદ્યાપિ ન ચાલમધ્વરા: ॥૩૧॥

અહો ભાગ્યમહો ભાગ્યન નન્દગોપવજૌકસામ્ । યન્ત્રિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતનમ् ॥૩૨

એવાં તુ ભાગ્યમહિમાચ્યુત તાવદાસ્તામેકાદશૈવ હિ વયં બત ભૂરિભાગા: ।  
 એતદ્વધૂધીકચષકૈરસકૃત પિવામઃ શર્વાદ્યો�ઙ્ગ્યુદ્યમધ્વમૃતાસવં તે ॥૩૩॥

તદ્ભૂરિભાગ્યમિહ જમ કિમણ્યટવ્યાં યદ્દ્ગોકુલેઽપિ કતમાઙ્ગ્રજોઽભિષેકમ् ।  
 યજ્જીવિતં તુ નિખિલં ભગવાનું મુકુન્દસ્તવ્યાપિ યત્પદરજઃ શ્રુતિમૃગ્યમેવ ॥૩૪॥

દોરડીભાવનો ત્યાગ કરીને શું સર્પબુદ્ધિ કરે છે ? નથી કરતા. તેમ વિવેકી પુરુષો જીવાત્મામાં અંતર્યામીપણે રહેલા તમારે વિષે ચોવીસ તત્ત્વોરૂપી જડબુદ્ધિ કરતા નથી, અને જીવબુદ્ધિ પણ કરતા નથી. પરંતુ સ્વરૂપ તથા સ્વભાવે કરીને જડ તથા જીવથી વિલક્ષણ એવા તમોને જાણીને તમારી જ ઉપાસના કરે છે. જો કે વસ્તુતત્ત્વને વસ્તુરૂપે જાણીને ઉપાસના કરવાથી મોક્ષ થાય છે. છતાં પણ આપના ચરણારવિંદની થોડી પણ કૃપા મળે તો જ આપના મહિમાનું તત્ત્વ જણાય છે. અને કૃપા મળ્યા વિના ઘણા કાળ સુધી જડ ભાગનો અપવાદ કરી કરીને વિચાર કર્યા કરે તોપણ કોઈના જાણવામાં આવે નહીં।<sup>૨૮-૨૯</sup>

એટલા માટે હે નાથ ! આ જન્મમાં અથવા કોઈ પશુ પક્ષીના જન્મમાં પણ મને એવું મારું ભાગ્ય મળજો કે જે ભાગ્યથી હું આપના ભક્ત લોકોમાંનો કોઈ પણ એક થઈને આપના ચરણારવિંદનું સેવન કરું.<sup>૩૦</sup> અહો !!! પ્રજની ગાયો અને ગોપીઓ બહુ જ ભાગ્યશાળી છે; કેમકે, જે તમોને તૃત્મ કરવાને યજ્ઞો પણ અદ્યાપિ સુધી સમર્થ થયા નથી, એવા તમોએ વાછરડારૂપે થઈને ગાયો તથા ગોપીઓના પુત્રોના રૂપથી તેઓનું દૂધરૂપી અમૃતને બહુ જ પ્રેમપૂર્વક પીધું.<sup>૩૧</sup> અહો !!! નંદરાયના પ્રજની રહેનારાઓનું ખરેખર મોટું ભાગ્ય છે, કેમકે પરમાનંદ પૂર્ણ અને સનાતન સાક્ષાત્ પરમાત્મા તેના ભિત્રરૂપ થયેલા છે.<sup>૩૨</sup> હે અચ્યુત ! એ પ્રજવાસીઓના ભાગ્યનો મહિમા તો અપૂર્વ અને કોઈથી વર્ણન ન કરી શકાય એવો છે, પરંતુ દશ ઈંડિયો અને મન, બુદ્ધિ તથા અહંકારના અધિષ્ઠાતા અમે તેર દેવો કે જેઓમાં રૂપ મુખ્ય છે, તે પણ મહાભાગ્યશાળી છીએ; કેમકે, આ પ્રજવાસીઓની ઈંડિયોરૂપ ઘાલાઓથી આપના ચરણારવિંદના મકરરંદરૂપી મીઠા

एषां घोषनिवासिनामुत भवान् किं देव गतेति नश्चेतो विश्वफलात् फलं त्वदपरं कुत्राप्ययन् मुह्यति । सद्वेषादिव पूतनापि सकुला त्वामेव देवापिता यद्ग्रामार्थसुहृत्यात्मतनयप्राणाशयास्त्वलृक्ते ३५ तावद् रागादयः स्तेनास्तावत् कारागृहं गृहम् । तावमोहोऽद्विनिगडो यावत् कृष्ण ! न ते जनाः । प्रपञ्चं निष्प्रपञ्चोऽपि विडम्बयसि भूतले । प्रपञ्चजनतानन्दसन्दोहं प्रथितुं प्रभो ! ॥३७ जानन्त एव जानन्तु किं बहूकृत्या न मे प्रभो ! । मनसो वपुषो वाचो वैभवं तव गोचरः ॥३८

आसवने वारंवार पीछे छीअे. एक एक ईंद्रियना अभिमानी अमे ज्यारे आपना चरणानी कीर्ति, शोभा अने सुगंध आहि एक एक भागनुं सेवन करवाथी पण कृतार्थ छीअे, त्यारे सर्वे ईंद्रियोथी ए कीर्ति आहि सर्वे भावोनुं सेवन करनारा प्रजवासीओना भाग्यना महिमानी तो शी वात करवी ?<sup>३३</sup> एटला माटे मनुष्यलोकमां, तेमां पण जंगलने विषे अने तेमां पण गोकुणमां गमे ते जन्म आवे तोपण मोटुं भाग्य छे; केमके गोकुणमां जन्म प्राप्त थवाथी कोईपण गोकुणवासी जननी चरणराजनो अभिषेक थतो रहे. जे तमारा चरणारविंदनी २४ने श्रुतिओ पण अद्यापि सुधी शोध्या ज करे छे ऐवा तमो जे प्रजवासीओनां ज्ञवन्तुप छो, ते प्रजवासीओनी चरणराज मणे अेपण मोटो लाभ छे.<sup>३४</sup> हे देव ! आप आ प्रजवासीओने कोई समये पण सर्व फण्टुप आपनां स्वतुप करतां भीजुं अधिक फण कुयुं आपशो, ए विचारमां धुम्या करतुं अमारुं मन मुंजाय छे. आपनुं स्वतुप आपीने पण आ प्रजवासीओना ऋषामांथी आप छूटी शको एम नथी; केमके, मारवानी ईच्छाथी पण माताना सरभो वेश धरवाथी, आपे दुष्ट पूतनाने पण पोतानुं स्वतुप आप्युं छे, तो आ साचा भक्तोने एथी अधिक फण आपवुं ज घटे छे. अने एथी अधिक फण कांઈ ज्ञेवामां आवतुं नथी. साचा भक्त प्रजवासीओना संबंधीओने पण आपनुं स्वतुप आपी आप प्रजवासीओना ऋषाथी छूटी शको एम नथी; केम के, पूतनाना संबंधी बकासुर अने अद्यासुरने पण आप आपनुं स्वतुप आपी युक्त्या छो. जे प्रजवासीओनां धर, धन, संबंधी, भित्र, प्रिय, देह, पुत्र, प्राण अने अंतःकरण आपने माटे ज छे, ते प्रजवासीओने पण पूतनाना जेटलो ज लाभ आपो तो ते पूरतो कहेवाय नहीं.<sup>३५</sup> हे कृष्ण ! रागदेषादिक त्यां सुधी ज योरनुं काम करे छे, धर त्यां सुधी ज बंधनना स्थानतुप थायछे अने मोह पण त्यां सुधी ज पगमां बेडीतुप थाय छे, के ज्यां सुधी आपनी साची भक्ति करवामां आवे नहीं.<sup>३६</sup> आप प्रपंच रहित छो, तोपण शरणागत

अनुजानीहि मां कृष्ण ! सर्वं त्वं वेत्सि सर्वदृक् । त्वमेव जगतां नाथो जगदेतत्त्वार्पितम् ॥३९  
श्रीकृष्ण ! वृष्णिकुलपुष्करजोषदायिन् ! क्षमानिर्जरद्विजपशूदधिवृद्धिकारिन् ! ।  
उद्भर्मशार्वरहर क्षितिराक्षसधूग्राकल्पमार्कमहन् भगवन् ! नमस्ते ॥४०॥

श्रीशुक उवाच -

इत्यभिष्ठूय भूमानं त्रिः परिक्रम्य पादयोः । नत्वा भीष्मं जगद्वाता स्वधाम प्रत्यपद्यत ॥४१  
ततोऽनुजाप्य भगवान् स्वभुवं प्रागवस्थितान् । वत्सान् पुलिनमानिन्ये यथापूर्वसखं स्वकम् ॥  
एकस्मिन्नियि यातेऽब्दे प्राणेशं चान्तराऽऽत्मनः । कृष्णामायाहता राजन् क्षणार्थं मेनिरेऽर्भकाः ।  
किं किं न विस्मरन्तीह मायामोहितचेतसः । यन्मोहितं जगत् सर्वमभीक्षणं विस्मृतात्मकम् ॥४४  
ऊचुश्च सुहृदः कृष्णं स्वागतं तेऽतिरंहसा । नैकोऽप्यभोजि कवल एहीतः साधु भुज्यताम् ॥४५  
लोकोने आनंदनो समूह आपवा सारु पृथ्वीमां पोताना संकल्पथी ज अवतार  
लीलाओ करो छो.<sup>३७</sup> हे प्रभु ! आपने ज्ञाता होय ते भवे ज्ञाणे, पण हुं तो शुं  
वधारे कुहुं ? मारुं मन, शरीर के वयन आपना महिमाने पहोंची शके तेम नथी.<sup>३८</sup>  
हे कृष्ण ! हवे मने सत्यलोकमां ज्ञानी आज्ञा आपो. आप सर्वना द्रष्टा होवाथी  
आपना महिमाने अने अम जेवानी शक्तिने ज्ञाणोऽ छो. जगतना स्वामी आप  
ज छो, हुं नथी. एटला माटे ममताना स्थानकरुप आ जगत अने शरीर आपने  
अर्पण करुं छुं.<sup>३९</sup> यादवकुणरुपी कमणने आनंद आपवामां सूर्य समान, अने  
पृथ्वी, देव, ब्राह्मणो अने पशुरुप समुद्रने वृद्धि पमाडवामां चंद्रनी समान, अने  
पाखंडरुपी अंधाराने हरवामां सूर्य तथा चंद्रनी समान, अने पृथ्वी उपर कंसादि  
राक्षसोनो नाश करनारा, अने सूर्य पर्यंत सर्वने पूज्य, ऐवा हे श्रीकृष्ण भगवान  
! कल्प पर्यंत आपने मारा प्रणाम होजो.<sup>४०</sup>

शुकदेवज्ञ कुहे छे- आ प्रमाणे यारा भगवाननी स्तुति करी, त्रष्णवार  
प्रदक्षिणा करी, चरणमां नमस्कार करीने ब्रह्मा पोताना लोकमां गया.<sup>४१</sup> पछी  
श्रीकृष्ण भगवान ब्रह्मानी संमति लईने पूर्वी पेठे ज, जे स्थणे पोताना भित्रो  
बेठा हता ऐवा यमुनाज्ञना कांडा उपर वाइरडांओने लाव्या.<sup>४२</sup> वयमां एक  
वर्ष नीकणी गयुं अने ते वणी पोताना प्राणनाथ भगवान विना नीकण्युं, तो पण  
भगवाननी मायाथी घेराएला बाणकोअे एक वर्षना समयने अर्धों क्षण  
मान्यो.<sup>४३</sup> भगवाननी मायाथी मोह पामेला जनो आ संसारमां शुं शुं नथी भूलता  
? बधु ज भूली जाय छे. जे मायाथी मोह पामेलुं जगत वारंवार पोताना आत्माने  
पण भूली जाय छे.<sup>४४</sup> ते भित्रोअे भगवानने कहुं के तमे जलदीथी आव्या ते भहु

ततो हसन् हृषीकेशोऽभ्यवहृत्य सहार्भकैः । दर्शयंश्वर्माजगरं न्यवर्तत वनाद् व्रजम् ॥४६  
बर्हप्रसूननवधातुविचित्रिताङ्ग्न प्रोद्धामवेणुदलशृङ्गरोत्पवाढ्यः ।

वत्सान् गृणन्ननुगगीतपवित्रकीर्तिगर्णोपीदृगुत्सवदृशः प्रविवेश गोष्ठम् ॥४७॥  
अद्यानेन महाव्यालो यशोदानन्दसूनुना । हतोऽविता वयं चास्मादिति बाला व्रजे जगुः ॥४८

राजोवाच -

ब्रह्मन् परोद्भवे कृष्णे इयान् प्रेमा कथं भवेत् । योऽभूतपूर्वस्तोकेषु स्वोद्भवेष्यपि कथ्यताम् ॥

श्रीशुक उवाच

सर्वेषामपि भूतानां नृप! स्वात्मैव वल्लभः । इतरेऽपत्यवित्ताद्यास्तद्वलभत्यैव हि ॥५०  
तद् राजेन्द्र! यथा स्नेहः स्वस्वकात्मनि देहिनाम् । न तथा ममतालम्बिपुत्रवित्तगृहादिषु ॥५१  
देहात्मवादिनां पुंसामपि राजन्यसत्तम! । यथा देहः प्रियतमस्तथा न ह्यनु ये च तम् ॥५२  
देहोऽपि ममताभाक् चेत्तर्हसौ नात्मवत् प्रियः । यज्जीर्यत्यपि देहस्मिन् जीविताशा बलीयसी ॥

४ सारु थयुं. हजु अमो एके कोणीओ जम्या नथी, अहीं आवो हवे आपशे निरांते जमीऐ. ४५ पछी हास्य करता भगवान् बाणकोनी साथे जमीने अजगरनुं चामडुं देखाडता देखाडता वनमांथी ब्रजमां जवाने पाइ। वण्या. ४६ भगवाने भोरपींछ, झूल, अने वननी सिन्दूरादिक धातुओथी पोताना शरीरने विचित्र रीते अलंकृत कर्युं हतुं, वाइरडांओने लाडना शब्दोथी बोलावता हता अने गोवाणो जेमनी पवित्र कीर्तने गाता हता, ऐवा भगवान् ब्रजमां पधार्या. ४७ आनंद आपनारा आ यशोदाना पुत्रे आजे भोटा अजगरने मार्यो अने ए अजगरथी अमारी रक्षा करी, एम बाणकोए ब्रजमां कहुं. ४८ परीक्षित राजा पूछे छे- ब्रजवासीओने पोताना सगा पुत्रोमां पाण जेवो प्रेम पूर्वं थयो न हतो तेवो प्रेम पराया पुत्र श्रीकृष्णमां शाथी थयो? ते कहो. ४९ शुकदेवज्ञ कहे छे- हे राजा! सर्वे प्राणीओने पोतानो आत्मा ज मुख्यत्वे करीने प्यारो होय छे. संतान अने धन आदि बीजं पदार्थोमां घार थाय छे तेतो आत्मा उपरना प्यारने लीधे ज थाय छे. ५० ममताना स्थानकरूप पुत्र, घर अने धनादिक करतां अहंताना स्थानकरूप पोतपोताना देहमां वधारे घ्यार होय छे ते पाण आत्माने लईने होय छे. ५१ हे भोटा राजा! जे पुरुषो देहने आत्मा कहे छे ते पुरुषोने पाण जेवो देह घ्यारो होय छे, तेवां तो देहने अनुसरीने रहेलां देहनी पछवाडे प्राम थयेलां पुत्र अने धनादिक घ्यारां होतां नथी. ५२ जे विवेकी पुरुष “आ देह छे ए हुं धुं” आम नहि मानतां “आ देह मारो छे” आम माने छे ते विवेकी पुरुषने आत्मामां जेवी

तस्मात् प्रियतमः स्वात्मा सर्वेषामपि देहिनाम् । तदर्थमेव सकलं जगदेतच्चराचरम् ॥५४  
कृष्णमेनमवेहि त्वमात्मानमखिलात्मनाम् । जगद्भिताय सोऽप्यत्र देहीवाभाति मायया ॥५५  
वस्तुतो जानात्मत्र कृष्णं स्थान्नु चरिष्णु च । भगवद्वूपमखिलं नान्यद् वस्त्विह किञ्चन ५६  
सर्वेषामपि वस्तूनां भावार्थो भवति स्थितः । तस्यापि भगवान् कृष्णः किमतद्वस्तु रूप्यताम् ।

समाश्रिता ये पदपल्कपल्कं महत्पदं पुण्ययशोमुरारेः ।

भवाम्बुधिर्वत्सपदं परं पदं पदं यद् विपदं न तेषाम् ॥५८॥

एतत्ते सर्वमाख्यातं यत् पृष्ठोऽहमिह त्वया । यत् कौमारे हरिकृतं पौगण्डे परिकीर्तितम् ॥५९

प्रीति रहे छे. तेवी देहमां रहेती नथी. कारण के देह बहु ज ज्ञानी अने बीमार पडी जाय तो पश ज्ञवानी आशा बणवत्तर रहे छे. पश ज्ञानी थती नथी. ते समये ए विवेकी पुरुष एम भोले छे के, जलदी आ देहथी धुटकारो भणे तो हुं सुधी थाउं. आना उपरथी ए सिद्ध थाय छे के सर्वे प्राणीओने वास्तविक रीते पोतानो आत्मा ज अत्यंत प्रिय होय छे. अने आत्माने लईने देहमां प्रीति थाय छे. अने देहने लईने स्थावर, जंगम पदार्थोमां प्रीति थाय छे. ५३-५४ आ प्रमाणे सर्वप्राणीओने परम प्रेमना स्थानकरूप जे आत्मा छे, ए आत्माना पश आत्मा श्रीकृष्ण भगवान् छे. अर्थात् श्रीकृष्ण सर्वे आत्माओनी अंदर पश अंतर्यामीपाणे रहेला छे. तेथी श्रीकृष्ण उपर तो सर्वे सहज प्रेम थवो संभवे छे, हे परीक्षित! आ प्रमाणे तमे जाणो अने सर्वना आत्मा ऐवा श्रीकृष्ण ज ज्ञवनुं कल्याण करवा सारु पोताना संकल्पथी कर्माधीन मनुष्य जेवा ज्ञानाय छे. ५५ श्रीकृष्ण भगवान् स्थावर अने जंगम आ बन्ने पदार्थोना अंतरात्मा छे. तेथी आ समग्र जगत भगवाननुं शरीर छे. अने भगवान् सर्वे जगतना शरीरी छे. शरीर हमेशां शरीरी आत्मा करतां पृथक् होतुं नथी. तेथी कोई पाण वस्तु भगवानथी भिन्न छे ज नहि. आ प्रमाणे वस्तुताए भगवानना स्वरूपने नहि जाणनारा अज्ञानी मनुष्योने श्रीकृष्ण भगवान् मनुष्यनी समान ज्ञानाय छे. पाण ए मनुष्य नथी, एतो साक्षात् परब्रह्म परमात्मा भगवान् छे. ५६ ब्रह्मांडने विषे रहेला समग्र पदार्थोनी सता, स्थिति, अने प्रवृत्ति जे थाय छे तेनुं कारण प्रकृतिपुरुष छे. अने प्रकृतिपुरुषना पाण कारण भगवान् श्रीकृष्ण छे. माटे सर्वान्तर्यामी भगवान् श्रीकृष्णथी भिन्न कई वस्तु छे? अर्थात् अब्रह्मात्मक वस्तु कई छे? ते कहो. अर्थात् सर्वे पदार्थो ब्रह्मात्मक ज छे. ५७ भगवानना यरणकरूपी जे नौका छे, ए हमेशां महात्मा पुरुषोने आश्रय करवा योग्य छे. तो ए यरणकरूपी नौकानो

एतत् सुहृद्दिश्चरितं मुरारेरधार्दनं शाद्वलजेमनं च ।  
व्यक्तेतरद् स्तपमजोर्वभिष्वं शृण्वन् गृणन्नेति नरोऽखिलार्थान् ॥६०॥  
एवं विहारैः कौमारेः कौमारं जहतुर्ब्रजे । निलायनैः सेतुबंधर्मकटोत्प्लवनादिभिः ॥६१  
इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे  
पूर्वार्थे ब्रह्मस्तुतिर्नाम चतुर्दशोऽध्यायः ॥१४॥

### अथ पञ्चदशोऽध्यायः (१५)

श्रीशुक उवाच

ततश्च पौगंडवयः श्रितौ द्रजे बभूवतुस्तौ पशुपालसम्मतौ ।  
गाश्चारयन्तौ सखिभिः समं पदैर्वृद्धावनं पुण्यमतीव चक्रतुः ॥१॥  
तन्माधवो वेणुमुदीरयन् वृतो गोपैर्गृणद्विः स्वयशो बलान्वितः ।  
पशून् पुरस्कृत्य पशव्यमाविशद् विहर्तुकामः कुसुमाकरं वनम् ॥२॥

आश्रय करीने जे लोको रहे छे. ते लोकोने आ संसारउपी समुद्र वाइराङांना पगलाना खाबोचियांनी समान थई जाय छे. अर्थात् भगवाननो आश्रय करीने आ संसारउपी समुद्र सहेजे सहेजे तरी शकाय छे. अने वणी भगवाननुं जे धाम छे, ऐ धाम पाश ते पुरुषोने ज पामवा योग्य छे, के जे पुरुषो भगवानना चरणउपी नौकानो आश्रय करे छे. अने विपत्तिओना स्थानउप पुनर्जन्म पश तेओने कटी थतो नथी. अर्थात् धामने पाम्या पछी फ्रीवार आ संसारमां पुनरावृत्ति थती नथी.<sup>५४</sup> भगवाने कुमार अवस्थामां करेलां चरित्रनी वात बाणकोअे पौगंडावस्थामां कुह्यानुं कारण जे तमे मने पूछयुं हतुं, ते सर्वे तमने कही संभणाव्युं.<sup>५५</sup> भगवाने भित्रोनी साथे कीडा करी, अघासुरने मार्यो, लीलां धासवाणा प्रदेशमां भोजन कर्यु, शुद्ध सत्वात्मक रूप देखाइयुं अने ब्रह्माए तेमनी धाणी स्तुति करी, आ सर्वे विषयने जे माणस सांभणे अथवा गाय तेने सर्वे पुरुषार्थनी प्राप्ति थाय छे.<sup>५०</sup> आवी रीते धुपी जवा पाज बांधवी अने वांदरानी पेठे ठेकाठेक करवुं ईत्यादि कुमारावस्थाना विहारथी श्रीकृष्ण अने बणभद्रे प्रजमां कुमार अवस्था पूरी करी.<sup>५१</sup>

इति श्रीमद् महापुराणा भागवतना दशम ऋक्ष्यनो योद्भो अद्याय संपूर्णः।

तन्मज्जुघोषालिमृगद्विजाकुलं महन्मनः प्रख्यपयः सरस्वता ।  
वातेन जुष्टं शतपत्रगच्छिना निरीक्ष्य रन्तुं भगवान् मनो दधे ॥३॥  
स तत्र तत्रारुणपल्लवश्रिया फलप्रसूनोरुभरेण पादयोः ।  
स्पृशच्छिखान् वीक्ष्य वनस्पतीन् मुदा स्मयन्निवाहाग्रजमादिपुरुषः ॥४॥

श्री भगवानुवाच -  
अहो अमी देववरामरार्चितं पाजाम्बुजं ते सुमनःफलार्हणम् ।  
नमन्त्युपादाय शिखाभिरात्मनस्तमोऽपहत्यै तस्जन्म यत्कृतम् ॥५॥  
एतेऽलिनस्तव यशोऽखिललोकतीर्थं गायत्न आदिपुरुषानुपदं भजन्ते ।  
प्रायो अमी मुनिगणा भवदीयमुख्या गूढं वनेऽपि न जहत्यनघात्मदैवम् ॥६॥

### अद्याय १५

भगवान् श्रीकृष्णो ताऽवनमां करेलो धेनुकासुरनो वध.

शुकदेवज्ञ कहे छे- कुमार अवस्था व्यतीत कर्या पछी, पौगंड अवस्थामां आवेला बलराम अने कृष्ण भित्रोनी साथे गायो चारवा लाङ्या अने पोताना चरणना न्यासो वडे वृद्धावनने अतिशय पवित्र करता हता.<sup>१</sup> ते समये पोताना यशनुं गायन करता गोवाणियाओथी वींटाएला अने वेष्टु वगाडता भगवान् श्रीकृष्ण पशुओने आगण करीने विहार करवानी ईश्वाथी, पशुओने हितकारक अने फूलोनी समुद्रिवाणा ऐ वृद्धावनमां बणभद्रनी साथे प्रवेश कर्यो.<sup>२</sup> सुंदर शज्ड करनारा भ्रमर, मृग अने पक्षीओथी व्याम अने महात्मा पुरुषोना मननी पेठे स्वर्यु जग्नी भरेला तणावमांथी आवता तथा कमणी सुगंधवाणा पवने सेवेलुं ते वन जोईने भगवाने रमवानुं मन कर्यु.<sup>३</sup> त्या रातां कूंपणी शोभानी साथे फण अने फूलना धशा भारथी जेनी शाखाओना अग्रभाग पगने अडता हता, ऐवां वृक्षोने जोईने आनंदथी जाणे हसता होय, ऐवा भगवाने मोटाभाई बणभद्रने कह्युं.<sup>४</sup>

भगवान् कहे छे- अहो ! हे देवताओमां उताम ! आ वृक्ष पोताने वृक्षनो जन्म पमाडनार पापनो नाश करवाने माटे पोतानी शाखाओना अग्रभागउपी हस्तथी फूल तथा फणउपी पूजनना पदार्थो लईने, देवताओअे पश पूजेला तमारा चरणारविंदने प्रणाम करे छे.<sup>५</sup> हे आदिपुरुष ! सर्वलोकोने पवित्र करनारी आपनी कीर्तिनुं गायन करता आ भ्रमराओ पगले पगले आपनी सेवा करे छे, माटे धणुं

નૃત્યન્યમી શિખિન ઈડ્ય મુદા હરિણ્ય: કુર્વન્તિ ગોપ્ય ઇવ તે પ્રિયમીક્ષણેન ।  
સૂકૈશ્ચ કોકિલગણા ગૃહમાગતાય ધન્યા વનૌકસ ઇયાન् હિ સતાં નિસર્ગ: ॥૭  
ધન્યેયમદ્ય ધરણી તૃણવીરુધ્સસ્ત્વત્વાદસ્પૃશો દ્રુમલતા: કરજાભિમૃષ્ણા: ।  
નદ્યોડ્રય: ખગમૃગા: સદ્યાવલોકૈગોપ્યોડ્રન્તરેણ ભુજયોરપિ યત્સ્પૃહા શ્રી: ॥૮

## શ્રીશુક ઉવાચ

એવં વૃન્દાવનં શ્રીમત કૃષ્ણા: પ્રીતમના: પશૂન् । રેમે સઞ્ચારયત્ત્રદ્રે: સરિદ્રોધસ્મુ સાનુગ: ॥૯  
ક્રચિદ્ ગાયતિ ગાયત્સુ મદાન્ધાલિષ્વનુદ્રતૈ: । ઉપગીયમાનચરિત: સ્વાગ્ની સઙ્ક્રષ્ણાનિવત: ૧૦  
ક્રચિચ્ચ કલહંસાનમનુકૂજતિ કૂજિતમ્ । અભિનૃત્યતિ નૃત્યન્ત બર્હિણ હાસયન્ ક્રચિત ૧૧  
મેઘગમ્ભીરયા વાચા નામભિર્દૂરગાન્ પશૂન્ । ક્રચિદાહ્યતિ પ્રીત્યા ગોગોપાલમનોજયા ૧૨  
ચકોરક્રૌઞ્ચક્રાહ્બારદ્વાજાંશ્ બર્હિણ: । અનુરૌતિ સ્મ સત્ત્વાનાં ભીતવદ્ વ્યાગ્રસિંહયો: ૧૩

કરીને આ ભ્રમરાઓ આપના સેવકોમાં મુખ્ય મુનિઓ જણાય છે, કેમકે પોતાના ભક્તોના પરમ ગતિરૂપ એવા આપ, વનમાં મનુષ્યનાવેષથી ગુમ રહ્યા છો, તો પણ આપને એ મુનિઓ ભ્રમરના વેષથી ગુમ થઈને વનમાં પણ છોડતા નથી. <sup>૯</sup> હે સુતિ કરવા યોગ્ય! આપનું સંભાન કરવા આપની પાસે આ મધ્યરો નાચ કરે છે, મૃગલીઓ આપને આનંદથી જોઈને ગોપીઓની પેઠે આપને રાજુ કરે છે. અને કોયલના ટોળાંઓ સુંદર શબ્દોથી આપની સેવા કરે છે, માટે આ વનવાસીઓ ભાગ્યશાળી છે. કારણ કે પોતાની પાસે જે કંઈ હોય તે ઘેર આવેલા મહાત્મા પુરુષને અર્પણ કરવું, એ જ સજજનોનો સ્વભાવ છે. <sup>૧૦</sup> આજે પૃથ્વી, ઘાસ અને લતાઓ આપના ચરણારવિંદનો સ્પર્શ કરવાથી ભાગ્યશાળી થયાં છે. આ ઝડ અને લતાઓ આપના નખનો સ્પર્શ મળવાથી ભાગ્યશાળી થયાં છે. નદી, પર્વત, પક્ષી અને પશુઓ, આપની દ્યા યુક્ત દંસ્તિ પાતથી ભાગ્યશાળી થયાં છે. અને ગોપીઓ પણ તમારા વક્ષઃસ્થલના આલિંગનથી ભાગ્યશાળી બની છે. જે વક્ષઃસ્થલને લક્ષ્મીજી પણ ઈચ્છે છે. <sup>૧૧</sup>

શુકદેવજી કહે છે- આ પ્રમાણે વૃન્દાવનની શોભા જોઈને રાજુ થતા અને પર્વત પાસેની નદીઓના કંઠાઓમાં પશુઓને ચરાવતા ભગવાન ગોવાળોની સાથે રમતા હતા. <sup>૧૨</sup> માણા ધરનાર બળભદ્ર સહિત ગોવાળો જેમનાં ચરિત્રને ગાતા હતા, એવા ભગવાન કોઈ સમયે ગાયન કરતા મદોન્મત ભ્રમરાઓની સાથે પોતે પણ ગાતા હતા. કોઈ સમયે હંસની પાછળ બોલતા હતા, નૃત્ય કરતા મોરની સામે મિત્રોને હસાવવા સારુ પોતે નૃત્ય કરતા હતા. <sup>૧૩-૧૪</sup> કોઈ સમયે

ક્રચિત્ ક્રીડાપરિશ્રાન્તિ ગોપોત્સઙ્ગોપરબર્હણમ્ । સ્વયં વિશ્રમયત્વાય પાદસંવાહનાદિભિ: ૧૪  
નૃત્યતો ગાયત: ક્રાપિવલ્લાતો યુધ્યતો મિથ: । ગૃહીતહસ્તૌ ગોપાલાનુહસન્તૌ પ્રશશંસતુ: ૧૫  
ક્રચિત્ પલ્વકતલપ્યેષુ નિયુદ્ધશ્રમકર્ણિત: । વૃક્ષમૂલાશ્રય: શેતે ગોપોત્સઙ્ગોપરબર્હણ: ૧૬  
પાદસંવાહનં ચક્રુ: કેચિત્તસ્ય મહાત્મન: । અપરે હતપાપ્માનો વ્યજનૈ: સમવીજયન્ ૧૭  
અન્યે તદનુરૂપાણિ મનોજ્ઞાનિ મહાત્મન: । ગાયન્તિ સ્મ મહારાજ! સ્નેહકિલન્નાધિય: શનૈ: ૧૮

એવં નિગૂઢાત્મગતિ: સ્વમાયયા ગોપાત્મજત્વં ચરિત્રીવિંડમ્બયન્ ।

રેમે રમાલાલિતપાદપલ્વકો ગ્રામ્યૈ: સમં ગ્રામ્યવદીશચેષ્ટિત: ૧૯ ॥

શ્રીદામા નામ ગોપાલો રામકેશવયો: સખા । સુબલસ્તોકકૃષ્ણાદ્યા ગોપા: પ્રેમણેદમબુવન્ ॥  
રામ! રામ! મહાબાહો! કૃષ્ણ! દુષ્ટનિર્બ઱્ણ । ઇનોડવિદૂરે સુમહદ્ વનં તાલાલિસિકૃતલમ્ ૨૧

ગાયો તથા ગોવાળોના મનને ગમે એવી મેઘના સરખી ગંભીર વાણીશી નામ લઈને દૂર ગયેલી ગાયોને પ્રીતિપૂર્વક બોલાવતા હતા. <sup>૧૨</sup> ચકોર, ક્રૌંચ, ચકવાક, ભારદ્વાજ અને મોર બોલતા હોય તેની પછવાડે તેના જેવા જ શબ્દ કરતા હતા. અને પશુઓ વાધ તથા સિંહથી ભાગતાં હોય ત્યાં પોતે પણ ભય પામેલાની પેઠે ભાગતા હતા. <sup>૧૩</sup> કોઈ સમયે ક્રીડાથી થાકીને ગોવાળોના ખોળાનું ઓશીકું કરી બળભદ્ર પોઢ્યા હોય, ત્યારે પોતે પગ ચાંપવા આદિથી બાળકોના પરિશ્રમને દૂર કરતા હતા. <sup>૧૪</sup> ક્ર્યારેક પરસ્પરના હાથ પકડી ઊભેલા અને હસતા એ બે ભાઈઓ પરસ્પર નાચતા, ગાતા, કૂદતા અને યુદ્ધ કરતા એવા ગોવાળોને વખાણતા હતા. <sup>૧૫</sup> કોઈ સમયે શ્રીકૃષ્ણ મલ્લયુદ્ધના પરિશ્રમથી ઘેરાઈ જઈને ઝડના મૂળની પાસે ગોવાળોના ખોળામાં માથું મૂકીને પાંદડાંની શથ્યામાં પોઢતા હતા. <sup>૧૬</sup> કેટલાક નિર્દોષ ગોવાળો શ્રીકૃષ્ણના પગ ચાંપતા હતા અને કેટલાક પાંદડાં આદિથી બનાવેલા વીંઝાઓ વતે પવન ઢોળતા હતા. <sup>૧૭</sup> હે મોટા રાજી! તે સમયે સ્નેહથી આર્દ્ભુદ્ધિવાળા ગોવાળો મનને ગમે એવાં અને ભગવાનને ઘટે એવાં ગાયન ધીરે ધીરે કરતા હતા. <sup>૧૮</sup> આ પ્રમાણે પોતાના સંકલ્પથી કરેલાં ચરિત્રો દ્વારા ગોવાળના પુત્રભાવનું અનુકરણ કરતા, પોતાનો સ્વભાવ ગુમ રાખવા છતાં પણ વચ્ચમાં જેની ઈશ્વર સંબંધી લીલા જોવામાં આવતી હતી એવા અને લક્ષ્મીજીએ લાડવેલાં ચરણારવિંદવાળા શ્રીકૃષ્ણ ગામડિયા લોકોની સાથે રમતા હતા. <sup>૧૯</sup> એક વખત શ્રીકૃષ્ણ અને બળભદ્રનો સખા શ્રીદામા, સુબલ, સ્તોક અને કૃષ્ણાદિક બીજાઓ પણ પ્રેમથી કહેવા લાગ્યા કે હે બળભદ્ર! હે મોટાબાહુબળવાળા! હે દુષ્ટલોકોને મારનાર! હે શ્રીકૃષ્ણ! અહીંથી થોડેક છેટે તાડની પંક્તિઓવાળું મોટું વન છે. <sup>૨૦-૨૧</sup>

फलानि तत्र भूरीणि पतन्ति पतितानि च । सन्ति किंत्ववरुद्धानि धेनुकेन दुरात्मना ॥२२  
सोऽतिवीर्योऽसुरो राम हेकृष्ण! खरस्तपथृक् । आत्मतुल्यबलैरन्यैर्जातिभिर्बहुभिर्वृतः ॥२३  
तस्मात् कृतनराहाराद् भीतैर्नभिरमित्रहन् । न सेव्यते पशुगणैः पक्षिसङ्घैर्विर्जितम् ॥२४  
विद्यन्तेऽभुक्तपूर्वाणि फलानि सुरभीणि च । एष वै सुरभिर्गच्छो विषूचीनोऽवगृह्यते ॥२५  
प्रयच्छ तानि नः कृष्ण गन्धलोभितचेतसाम् । वाञ्छास्ति महती राम गम्यतां यदि रोचते ॥  
एवं सुहृद्वचः श्रुत्वा सुहृत्प्रियचिकीर्षया । प्रहस्य जग्मतुर्गोपैर्वृतौ तालवनं प्रभू ॥२७  
बलः प्रविश्य बाहुभ्यां तालान् सम्परिकम्पयन् । फलानि पातयामास मतङ्गं इवौजसा २८  
फलानां पततां शब्दं निशम्यासुरासभः । अभ्यधावत् क्षितितलं सनगं परिकम्पयन् ॥२९  
समेत्य तरसा प्रत्यग् द्वाभ्यां पद्भ्यां बलं बली । निहत्योरसि काशब्दं मुञ्चन् पर्यसरत् खलः ।  
पुनरासाद्य संरब्धं उपक्रोष्टा पराकृ स्थितः । चरणावपरौ राजन्! बलाय प्राक्षिपद् रूषा ॥३१  
स तं गृहीत्वा प्रपदो भ्रामयित्वैकपाणिना । चिक्षेप तृणराजाग्रे भ्रामणत्यक्तजीवितम् ॥३२  
तेनाहतो महातालो वेपमानो बृहच्छ्राः । पार्श्वस्थंकम्पयन् भग्नः स चान्यं सोऽपि चापरम् ॥

ऐ वनमां धशां इण पडेलां होय छे अने पडे छे छतां पश दुरात्मा धेनुकासुर ऐ  
इणो कोईने लेवा देतो नथी.<sup>२२</sup> हे बणभद्र ! हे कृष्ण ! ऐ धशा बणवाणो देत्य  
गधेडानुंरूप धरीने रह्यो छे अने तेनी साथे तेना ज जेवा भीजा धशा देत्यो छे.<sup>२३</sup>  
हे शत्रुओने मारनार ! मनुष्योने खाई जनारा ऐ देत्यनी भीक्षी कोई मनुष्यो ते  
वनमां जतां नथी अने पशुओअे तथा पक्षीओअे पश ते वनने छोडी दीधुं छे.<sup>२४</sup>  
ऐ वनमां सुगंधी इणो अमे कोई दिवस खाधां नथी. जुओ आ चारेकोर प्रसरतो  
ते इणनो सुगंध चाल्यो आवे छे.<sup>२५</sup> हे कृष्ण ! ऐ इणनी सुगंधीमां अमारां मन  
ललयायां छे. ऐ इणो खावानी अमारी तीव्र ईच्छा छे. माटे ऐ इण अमोने  
आपो. हे बणभद्र ! रुचि थती होय तो त्यां आपाणो चालीअे.<sup>२६</sup> आ प्रभाणे  
मित्रोनुं वयन सांभणी तेनुं प्रिय करवानी ईच्छाथी, श्रीकृष्ण अने बणभद्र भन्ने  
हसीने तेओने साथे लर्द ताडना वनमां गया.<sup>२७</sup> बणभद्र अंदर पेसीने हाथीनी  
पेठे बणथी हाथवते ताडने हलावी हलावी इण पाडवा लाग्या.<sup>२८</sup> पडतां इणोनो  
शब्द सांभणी जाड सहित धरतीने ध्रुजावी नांभतो ऐ देत्यगधेडो बणभद्र सामे  
दोड्यो.<sup>२९</sup> तुरत आवीने बणभद्रनी छातीमां पाइला बे पगनी पाटु मारी,  
गधेडांनी जातिनो शब्द करतो ऐ बणवान देत्य चारेकोर दोडवा लाग्यो.<sup>३०</sup> हे  
राजा ! कोध पामेलो ते गधेडो पाइछो आवी बणटेवज्जनी सामे पुंठ वाणीने कोधथी  
बणभद्र उपर पाइला पग उधाणवा मांड्यो.<sup>३१</sup> बणभद्रे एक हाथथी तेना

बलस्य लीलयोत्सृष्टवरदेहताहताः । तालाश्वकम्पिरे सर्वे महावातेरिता इव ॥३४  
नैतच्चित्रं भगवति ह्यनन्ते जगदीश्वरे । ओतप्रोतमिदं यस्मिंस्तनुष्वङ्ग! यथा पटः ॥३५  
ततः कृष्णं च रामं च ज्ञातयो धेनुकस्य ये । ऋषारोऽभ्यद्रवन् सर्वे संरब्धा हतबास्थवाः ॥  
तांस्तानापततः कृष्णो रामश्च नृप! लीलया । गृहीतपश्चाच्चरणान् प्राहिणोत्तराजसु ॥३७  
फलप्रकरसङ्कीर्णं दैत्यदेहर्गतासुभिः । रराज भूः सतालागैर्घैरनैरिव नभस्तलम् ॥३८  
तयोस्तत् सुमहत् कर्म निशाम्य विबुधादयः । मुमुचुः पुष्पवर्षाणि चक्रुवाद्यानि तुष्टुवुः ॥३९  
अथ तालफलान्यादन् मनुष्या गतसाध्वसाः । तृणं च पशवश्चेरुर्हतधेनुककानने ॥४०  
कृष्णः कमलपत्राक्षः पुण्यश्रवणकीर्तनः । स्तूयमानोऽनुगौर्गोपैः साग्रजो व्रजमाव्रजत् ॥४१  
तं गोरजश्छुरितकुन्तलबद्धबर्बहवन्यप्रसूनरुचिरेक्षणचारुहासम् ।

वेणुं क्षणन्तमनुगौरनुगीतकीर्ति गोप्यो दिदृक्षितदृशोऽभ्यगमन् समेताः ॥४२॥

पाइला पग पक्की लर्द फेरवीने तेने ताडना जाडमां पधाइयो.<sup>३२</sup> ऐ देत्यनुं शरीर  
अथडावाथी विशाण धटावाणुं ताडनुं वृक्ष कंपवा लाग्युं. अने बाजुमां रहेला  
भीजा ताडना वृक्षने कंपावतुं थकुं भांगी पड्युं. भीजाए त्रीजा वृक्षने अने त्रीजाए  
योथा वृक्षने कंपावीने भांगी नाघ्युं.<sup>३३</sup> बणभद्रे लीलाथी फेरेला गधेडाना शरीरथी  
पडीजता ताडवृक्षोना आधातथी सर्वे ताडो जाणे भारे पवन द्वारा हलावेलां होय  
तेम हाली गयां.<sup>३४</sup> जेनी अंदर आ जगत तांत्राओमां वस्त्रनी पेठे ओतप्रोत  
छे, ऐवा जगतना ईश्वर बणटेवज्ज्ञे आवुं बण देखाइयुं ऐ कांઈ आश्वर्य  
गाणवा जेवुं नथी.<sup>३५</sup> पछी धेनुकासुरनां संबंधी भीजां गधेडांओ के जेओनो बांधव  
मार्यो गयो हतो ते सर्वे कोध करीने श्रीकृष्ण अने बणभद्र सामे दोड्यां.<sup>३६</sup> हे  
राजा ! जे जे गधेडां आव्यां ते ते गधेडांना पाइला पग पक्कीने तेमने श्रीकृष्ण  
अने बणटेवज्ज्ञ लीलाथी ताडना वृक्षोमां पधाइयां.<sup>३७</sup> इणोना ढगलाथी, मराण  
पामेला देत्योना शरीरोथी अने ताडनी शाखाओथी व्याम थयेली पृथ्वी  
वादपांओथी ईवाएला आकाशनी पेठे शोभवा लागी.<sup>३८</sup> श्रीकृष्ण अने  
बणटेवज्जनुं ऐ मोटुं काम जोईने देवो आकाशमां रहीने झुलनी वृष्टि करवा लाग्या,  
वाजां वगाडवा तथा स्तुति करवा लाग्या.<sup>३९</sup> पछी धेनुकासुर मरी जतां ऐ वनमां  
माणसो निर्भय थईने ताडनां इण खावा लाग्यां अने पशुओ धास चरवा लाग्यां.<sup>४०</sup>  
अने पछी कमणपत्र सरभां नेत्रवाणा, पवित्र श्रवण अने कीर्तिवाणा अने अनुयर  
गोवाणो जेनी स्तुति करता हता, ऐवा भगवान श्रीकृष्ण बणटेवज्जनी साथे  
व्रजमां पधायां.<sup>४१</sup> गायोना चरणानी रजथी धेराएला, केशमां बांधेलां मोरपीछयी

पीत्वा मुकुन्दमुखसारघमक्षिभृङ्गस्तापं जहुर्विरहजं व्रजयोषितोऽह्नि ।  
तत्सत्कृतिं समधिगम्य विवेश गोष्ठं सब्रीडहासविनयं यदपाङ्गमोक्षम् ॥४३॥

तयोर्यशोदरोहिण्यौ पुत्रयोः पुत्रवत्सले । यथाकामं यथाकालं व्यथत्तां परमाशिषः ॥४४  
गताध्वानश्रमौ तत्र मज्जनोन्मर्दनादिभिः । नीर्वी वसित्वा रुचिरां दिव्यस्त्रगन्धमण्डितौ ॥  
जनन्युपहृतं प्राश्य स्वाद्वन्नमुपलालितौ । संविश्य वरशव्यायां सुखं सुषुपतुर्वजे ॥४६  
एवं स भगवान् कृष्णो वृन्दावनचरः क्रचित् । ययौ राममृते राजन्! कालिन्दी सखिभिर्वृतः ॥४७  
अथ गावश्च गोपाश्च निदाधातपपीडिताः । दुष्टं जलं पपुस्तस्यास्तृष्णार्ता विषदूषितम् ॥४८  
विषाभ्यस्तदुपस्थृश्य दैवोपहतवेतसः । निषेतुर्व्यसवः सर्वे सलिलान्ते कुरुद्वह! ॥४९  
वीक्ष्य तान् वै तथा भूतान् कृष्णो योगेश्वरेश्वरः । इक्ष्यामृतवर्षिण्या स्वनाथान् समजीवयत् ॥

अने वननां पुष्पोथी भगवान शोभी रक्ष्या हता, नेत्र तथा हास्य भुजु ज सुंदर हतां. वेशुं वगाउता हता अने अनुचरो पृष्ठवाडे कीर्तिनुं गायन करता आवता हता. ऐवा भगवानने ज्ञेवा सारु धणी उत्कंठाथी गोपीओ भेणी थईने सामी आवी.<sup>४२</sup> भगवानना मुखरूपी भधने नेत्ररूपी भ्रमरोथी पान करीने व्रजनी स्त्रीओ एव दिवसना विरहनो ताप दूर कर्यो. गोपीओ एव लाज सहित हास्य अने विनयपूर्वक कटाक्ष मारवारुप औ संकार कर्यो, तेनो स्वीकार करी भगवान व्रजमां पधार्या.<sup>४३</sup> पुत्र उपर प्रीतिवाणी यशोदा अने रोहिणी, पोताना पुत्रोने तेनी ईर्ष्या प्रमाणे समयसर सर्वे सुखनी उत्तम सगवडो करी आपती हती.<sup>४४</sup> घेर आवीने स्नान अने भर्दनाहिकथी भन्ने भाईनो थाक उत्तरी गयो. सुंदर वस्त्र पहेरी लीधां, दिव्य माणाओ अने चंदनथी शशगार्या, धणा लाउथी माताए आपेलुं स्वादिष्ट अन्न जम्या अने पढी उत्तम शय्यामां पोढी गया.<sup>४५-४६</sup> आ प्रमाणे दृरोज वृद्धावनमां झरता भगवान एक दिवस बणभद्र विना एकलाज भीजा भित्रोनी साथे यमुनाज्ञने कांठे गया.<sup>४७</sup> त्यां श्रीभक्ततुना तापथी पीडाओली गायो एव अने गोवाणो एव तरसना मार्या झेरथी दूषित थयेलुं ते यमुनानुं जण पीधुं.<sup>४८</sup> हे राजा! देवे जेनी भुद्धि हरी लीधी हती एवी गायो अने गोवाणो ते जणनो स्पर्श करतानी साथे भरण तुल्य थई पडी गया.<sup>४९</sup> जेओना नाथ पोते ज छे एवा श्रीकृष्ण आ पडेला गोवाणो तथा गायोने ज्ञेई, योगेश्वरोना पण ईश्वर श्रीकृष्ण भगवाने पोतानी अमृत वर्षावनारी अभीदृष्टिथी सर्वने ज्ञवता कर्या.<sup>५०</sup> सारी रीते जेओने स्मृति आवी छे एवा ए गोपबालो जण पासेथी उठी भुजु ज विस्मय पाम्या अने एक भीजानी सामे ज्ञेवा लाग्या.<sup>५१</sup> हे राजा! झेर पीने मरी जवा

ते सम्प्रतीतस्मृतयः समुत्थाय जलान्तिकात् । आसन् सुविस्मिताः सर्वे वीक्षमाणाः परस्परम् ५१  
अन्वमंसत तद्राजन्! गोविंदानुग्रहेक्षितम् । पीत्वा विषं परेतस्य पुनरुत्थानमात्मनः ॥५२  
इति श्रीमद्भागवते महापुराणे पारमहस्यां संहितायां दशमस्कन्दे  
पूर्वार्धं धेनुकवधो नाम पञ्चदशोऽध्यायः ॥१९५॥

## अथ षोडशोऽध्यायः (१६)

श्रीशुक उवाच

विलोक्य दूषितां कृष्णां कृष्णः कृष्णाहिना बिभुः । तस्या विशुद्धिमन्विच्छन् सर्पं तमुदवासयत् ।  
राजोवाच

कथमन्तर्जलेऽगाधे न्यृगृह्णाद् भगवानहिम् । स वै बहुयुगावासं यथाऽजसीद् विप्र कथ्यताम् २  
ब्रह्मन्! भगवतस्तस्य भूम्नः स्वच्छन्दवर्तिनः । गोपालोदारचरितं कस्तृप्येतामृतं जुषन् ॥३

श्रीशुक उवाच

कालिन्द्यां कालियस्यासीद्धदः कक्षिद् विषागिना । श्रियमाणपया यस्मिन् पतन्युपरिगाः खगाः ।  
विप्रुष्टता विषोदोर्मिमारुतेनाभिर्मार्शिताः । मियन्ते तीरगा यस्य प्राणिनः स्थिरजङ्गमाः ॥५

४ इतां पोते उड्या एव केवण भगवाननी द्वृपादष्टिथी ज थयुं, अभे गोवाणो मानवा  
लाग्या.<sup>५२</sup>

इति श्रीमद् महापुराणा भागवतना दशम ऋक्ष्यनो पंद्रमो अद्याय संपूर्णः

## अद्याय १६

भगवाने करेलुं कालीनागनुं दमनः.

शुकदेवज्ञ कहे छे श्रीकृष्ण भगवाने यमुनाज्ञने कालीनागथी दूषित थयेली  
ज्ञेई, तेने शुद्ध करवानी ईर्ष्याथी ते कालीनागने तेमांथी भहार काढ्यो.<sup>१</sup> परीक्षित  
राजा पूछे छे- ए यमुनाना अगाध जणनी अंदर भगवाने नागने शी रीते शिक्षा  
करी? अने ते कालीनाग स्थलयर प्राणी इतां धणा युग पर्यंत जणमां शा कारणथी  
अने कया प्रकारथी रहेतो हतो? ते कहो.<sup>२</sup> हे महाराज ! स्वतंत्र एवा श्रीकृष्ण  
गोवाणपणाना उदार चरित्रुपी अमृत पीतां कोष तृप्ति पामे?<sup>३</sup> शुकदेवज्ञ कहे  
छे यमुनाज्ञमां कालीनागनो एक धरो हतो, के जे धरानुं पाणी झेरुपी अग्निथी  
उक्षतुं हतुं. अने जे ए धरा उपरथी उडतां पक्षीओ पण पडी जतां हतां.<sup>४</sup> ए  
धराने कांठे जे कोई स्थावर जंगम प्राणीओ होय ते पवनना कारणे उडतां नानां

तं चण्डवेगविषवीर्यमवेक्ष्य तेन दुष्टं नदीं च खलसंयमनावतारः ।  
 कृष्णः कदम्बमधिरुह्य ततोऽतितुङ्गमास्फोट्य गाढरशनो न्यपतद् विषोदे ॥६॥

सर्पह्रदः पुरुषसारनिपातवेगसंक्षेपोभितोरगविषोच्छसिताम्बुराशिः ।  
 पर्यक्ष्मलुतो विषकषायाविभीषणोर्मिर्धावन् धनुःशतमनन्तबलस्य किं तत् ॥७॥

तस्य ह्रदे विहरतो भुजदण्डघूर्णवार्घोषमङ्गः! वरवारणविक्रमस्य ।  
 आश्रुत्य तत् स्वसदनाभिभवं निरीक्ष्य चक्षुःश्रवा समसरतदमृष्यमाणः ॥८॥

तं प्रेक्षणीयसुकुमारघनावदातं श्रीवत्सपीतवसनं स्मितसुन्दरास्यम् ।  
 क्रीडन्तमप्रतिभयं कमलोदराङ्गिं सन्दश्य मर्मसु रुषा भुजया चछाद ॥९॥

तं नागभोगपरिवीतमदृष्ट्येष्टमालोक्य तत्प्रियसखाः पशुपा भृशार्ताः ।  
 कृष्णोर्पितात्मसुहृदर्थकलत्रकामा दुःखानुशोकभयमूढधियो निपेतुः ॥१०॥

गावो वृषा वत्सतर्यः क्रन्दमानाः सुदुःखिताः । कृष्णो न्यस्तेक्षणा भीता रुदत्य इव तस्थिरे ॥  
 अथ ब्रजे महोत्पातास्त्रिविधा ह्यतिदारुणाः । उत्पेतुर्भुवि दिव्यात्मन्यासन्नभयशंसिनः ॥१२॥

जृणनां वींदुस्पर्शथी मरी जृतां हतां.<sup>४</sup> दुष्ट लोकोनो निग्रह करवा सारु ज जेषो अवतार लीधो छे, ऐवा श्रीकृष्ण भगवान कालीनागने भडुज भयंकर झेरना भणवाणो जाणीने अने तेषो नटीने दुष्ट करी नाखेली जोईने, दृढ भेट बांधी, ऊँचा कुंभ उपरथी झेरी पाणीमां पड़या.<sup>५</sup> श्रीकृष्ण भगवानना पडवाना वेगथी क्षोभ पामेला सर्पोना झेरथी पाणी ऊँचुं चउचुं, अने मोळां ऊधणवा लाङ्यां, आवो ए कालीनागनो धरो जाणे दोडतो होय ऐवी रीते चारेकोर सो सो धनुष सुधी झेलाई गयो. इतां अनंत भणवाणा भगवानने तो ए सर्व लीला मात्र छे.<sup>६</sup> धरामां विहार करता अने मदोन्मत्त उताम हाथीना सरभा पराक्रमवाणा, ए भगवानना भुजदंडथी धूमेला जृणनो शब्द सांभणीने, पोताना धरनो पराभव थयो जाणी, असहनताथी कालीनाग भगवाननी पासे आव्यो.<sup>७</sup> जोवा योऽय सुकुमार, भेदनी पेठे श्यामसुंदर, श्रीवत्सने धरनार, पीणां वस्त्रवाणा, ऐवा श्रीकृष्ण भगवानने कालियनाग कोधथी करटीने पोताना शरीरथी वींटाई वण्यो.<sup>८</sup> भगवानना प्रियमित्र गोवाणो के जेमणे भगवानने ज पोताना देह, संबंधी, धन, स्त्रीओ अने ईष्ट पदार्थो अर्पण करेलां हतां, ऐवा ते भगवान नागना शरीरथी वींटाअेला अने जेनी येष्टा जोवामां आवती न हती, ऐवा भगवानने जोईने भडु ज पीडा पाम्या, अने हुःभ, शोक तथा भयथी भूर्धित थईने पृथ्वी पर ढणी पड़या.<sup>९</sup> गायो अने वाइरडांओ हुःभथी चीसो पाउवा लाङ्यां, भय

तानालक्ष्य भयोद्ग्रिग्ना गोपा नन्दपुरोगमाः । विना रामेण गा: कृष्णं ज्ञात्वा चारयितुं गतम् । तैर्दुर्निमित्तैर्निधनं मत्वा प्रासमतद्विदः । तत्प्राणास्तन्मनस्कास्ते दुःखशोकभयातुराः ॥१४॥ आबालवृद्धवनिताः सर्वेऽङ्गः पशुवृत्तयः । निर्जग्मुर्गोकुलाद् दीना: कृष्णदर्शनलालसा: ॥१५॥ तांस्तथा कातरान् वीक्ष्य भगवान् माधवो बलः । प्रहस्य किञ्चिन्नोवाच प्रभावज्ञोऽनुजस्य सः । तेऽन्वेषमाणा दयितं कृष्णं सूचितया पदैः । भगवलक्ष्मैर्जग्मुः पदव्या यमुना तटम् ॥१७॥

ते तत्र तत्राब्जयवाङ्गुशाशनिध्वजोपपन्नानि पदानि विशपतेः ।  
 मार्गे गवामन्यपदान्तरान्तरे निरीक्षमाणा ययुरङ्गः! सत्वराः ॥१८॥  
 अन्तर्ह्रदे भुजगभोगपरीतमारात् कृष्णं निरीहमुपलभ्य जलाशयान्ते ।  
 गोपांश्च मूढधिष्ठणान् परितः पश्चूंश्च संक्रन्दतः परमकश्मलमापुराताः ॥१९॥  
 गोप्योऽनुरक्तमनसो भगवत्यनन्ते तत्सौहृदस्मितविलोकगिरः स्मरन्त्यः ।  
 ग्रस्तेऽहिना प्रियतमे भृशदुःखतसाः शून्यं प्रियव्यतिहतं ददृशुस्त्रिलोकम् ॥२०॥

पामी भगवाननी सामुं जोई रोतां होय तेम उिभां रह्यां.<sup>११</sup> एज समये व्रजमां अत्यंत भय समीपमां छे, ऐवुं सूचवनारा त्रष्ण प्रकारना उत्पातो थया. तेमां पृथ्वी उपर भूकंप आहि, आकाशमां उल्कापात आहि अने पोताना शरीरमां डाबां अंगो फरकवां ए आहि.<sup>१२</sup> उत्पातोने जोई, भयथी उद्गेग पामेला अने भगवानना स्वरुपेन नहीं जाणनारा नंदाहिक गोवाणो, गायो चारवाने एकला गयेला भगवानने जाणी अने ते अपशुक्नो उपरथी तेमने मरण पामेला मानी, भगवाननां दर्शननी ईच्छाथी बाणक, वृद्ध अने स्त्रीओ सहित सर्वे गोवाणो गोकुणमांथी भहार नीकज्या. तेना प्राण अने मन भगवानमां ज हतां. अने सर्वे व्रजवासीओ हुःभ, शोक तथा भयथी आतुर अने दीन थई गयां हतां.<sup>१३-१५</sup> गोवाणोने आ प्रमाणे भय पामेला जोई पोताना नाना भाईना प्रभावने जाणनारा भणभद्र उसवा लाङ्या, पाण कांઈ बोल्या नहीं.<sup>१६</sup> पोताना घ्यारा श्रीकृष्णने शोधवा लागेला ते गोवाणो भगवानना पगलांसे सूचवेला मार्गथी यमुनाज्ञने कांठे गया.<sup>१७</sup> ए गोवाणो गायोना पगलांनी साथे साथे कुमण, यव, अंकुश, वज्र अने उिधरेखानां चित्कवाणां भगवाननां पगलांओने जोता जोता उतावणथी त्यां पहोच्या.<sup>१८</sup> धरानी अंदर भगवानने सर्पथी वींटाअेला अने शरीरनी येष्टा वगरना जोई, अने यमुनाना कांठे गोवाणोने भूष थयेला, अने पशुओने भांभरतां जोई मुंझाई गया.<sup>१९</sup> भगवानमांज जेनुं मन लाणी रह्युं हतुं ऐवी अने भगवाननां स्नेह, मंदहास्य, कटाक्ष अने वयनोने संभारती तथा भगवान सर्पथी

ताः कृष्णमातरमपत्यमनुप्रविष्टं तुल्यव्यथा: समनुगृह्य शुचः स्ववन्त्यः ।  
 तास्ता ब्रजप्रियकथा: कथयन्त्य आसन् कृष्णाननेऽर्पितदृशो मृतकप्रतीकाः ॥२१॥  
 कृष्णप्राणान्विवशतो नन्दादीन् वीक्ष्य तं ह्रदम् । प्रत्यषेधत् स भगवान् रामः कृष्णानुभाववित् ।  
 इत्थं स्वगोकुलमनन्यगतिं निरीक्ष्य सस्त्रीकुमारमतिदुःखितमात्महेतोः ।  
 आज्ञाय मर्त्यपदवीमनुवर्तमानः स्थित्वा मुहूर्तमुदितष्टुदरङ्गबन्धात् ॥२३॥  
 तत्प्रथमानवपुषा व्यथितात्मभोगस्त्यक्त्वोन्नत्रमव्य कुपितः स्वफणान् भुजङ्गः ।  
 तस्थौ श्वसञ्ज्ववसनरन्ध्रविषाम्बरीषस्तब्देक्षणोल्मुखो हरिमीक्षमाणः ॥२४॥  
 तं जिह्वया द्विशिखया परिलोलिहनं द्वे सृक्षिणी ह्यतिकरालविषाग्निदृष्टिम् ।  
 क्रीडन्नमुँ परिसमार यथा खगेन्द्रो बध्राम सोऽप्यवसरं प्रसमीक्षमाणः ॥२५॥  
 एवं परिभ्रमहतौ जसमुन्नतां समानम्य तत्पृथुशिरः स्वधिरुद्ध आद्यः ।  
 तन्मूर्धरलनिकरस्पर्शातिताम्रपादाम्बुजोऽखिलकलादिगुरुनर्नत ॥२६॥

लेवाई जतां बहु ज दुःखथी तपी गयेली गोपीओ पोताना प्यारा श्रीकृष्ण विना  
 त्रैलोक्यने उज्जग्न देखवा लागी.<sup>२०</sup> यशोदा पोताना पुत्रनी पाइण पाणीमां पडवा  
 लाग्यां, तेमने पकडी राखीने आंसु वहावती अने यशोदानी समान ज व्यथावाणी  
 अने भगवानना मुख उपर दृष्टि राखी रहेली, ऐवी गोपीओ मडां जेवी थई  
 गई हती.<sup>२१</sup> जे ओना प्राणउप कृष्ण ज हता ऐवा नंदादि गोवाणोने धरामां  
 पडता ज्ञेई, श्रीकृष्णाना प्रभावने ज्ञानारा बणदेवज्ञाए तेओने रोकी राख्या  
 हता.<sup>२२</sup> पछी पोता सिवाय बीजु जेमनी कोई गति नथी अने पोताने माटे ज  
 दुःखी थतुं एवुं स्त्री तथा बाणको सहित गोकुणने ज्ञेई, मनुष्य लीलानुं अनुकरण  
 करता भगवान श्रीकृष्ण बे धडीवार ऐवी ज स्थितिमां रहीने, तरत सर्पना  
 बंधनमांथी बहार नीकृष्या.<sup>२३</sup> भगवाननुं शरीर वधवा मांडतां जेना शरीरना  
 सांधा त्रुटवा लाग्या छे, ऐवो कालीनागो पोतानो आंटो छोडी नाखीने कोधथी  
 पोतानी झेषो ऊंची करी, केवण भगवाननी सामुं ज्ञेईने फुङ्फाडा मार्या करतो  
 हतो.<sup>२४</sup> प्रत्येक मोठांमां बब्बे अणीवाणी ज्ञभथी गलकां चाट्या करता अने  
 अत्यंत भयंकर जेरुपी अजिनीथी भरेली दृष्टिवाणा ए कालियनागनी चारेकोर  
 कीडा करता भगवान गरुडनी पेठे फरवा लाग्या, अने लाग ज्ञेया करतो ए  
 कालियनाग पण भगवाननी चारेकोर फरवा लाग्यो.<sup>२५</sup> आ प्रमाणे फरवाथी  
 जेनी शक्ति हङ्गाई गई छे ऐवा अने ऊंची झेषोवाणा कालियने नमावी भगवान  
 तेनी भोटी फेंश उपर चढी गया. ते समये कालीनागना मस्तकमां रहेला रत्नोना

तं नर्तुमुद्यतमवेक्ष्य तदा तदीयगन्धर्वसिद्धसुरचारणदेववध्यः ।  
 प्रीत्या मृदङ्गपणवानकवाद्यगीतपुष्पोपहारनुतिभिः सहसोपसेदुः ॥२७॥  
 यद् यच्छ्रो न नमतेऽङ्गं शतैकशीर्षास्तत्तन् ममर्द खरदण्डधरोऽदिघपातैः ।  
 क्षीणायुषो भ्रमत उल्बणमास्यतोऽसृङ्गनस्तो वमन् परमकश्मलमाप नागः ॥२८॥  
 तस्याक्षिभिर्गरलमुद्भवतः शिरस्मु यद् यत् समुन्नमति निःश्वसतो रुषोच्चैः ।  
 नृत्यन् पदानुनमयन् दमयाम्बभूव पुष्पैः प्रपूजित इवेह पुमान् पुराणः ॥२९॥  
 तच्चवत्राण्डवविरुगणफणातपत्रो रक्तं मुखैरु वमन् नृप! भग्नगात्रः ।  
 स्मृत्वा चराचरगुरुं पुरुषं पुराणं नारायणं तमरणं मनसा जगाम ॥३०॥  
 कृष्णस्य गर्भजगतोऽतिभरावसन्नं पार्षिष्ठप्रहारपरिरुगणफणातपत्रम् ।  
 दृष्ट्वाहिमाद्यमुपसेदुरमुष्य पल्य आर्ताः श्लथद्वसनभूषणकेशबन्धाः ॥३१॥  
 तासं सुविग्नमनसोऽथ पुरस्कृतार्थाः कायं निधाय भुवि भूतपर्ति प्रणेमुः ।  
 साध्यवः कृताज्जलिपुटाः शमलस्य भर्तुर्मैक्षेप्सवः शरणदं शरणं प्रपन्नाः ॥३२॥

समूहना स्पर्शथी जेनां चरणारविंश बहु ज चण्डक्वा मांड्यां, ऐवा भगवान  
 नागनुं माथुं चंचण हतुं तोपण पोते नृत्यादिक सर्व कणाओना मुख्य शाता होवाथी  
 तेना उपर नृत्य करवा लाग्या.<sup>२६</sup> कालीनागनी झेष उपर नृत्य करता भगवानने  
 ज्ञेई भगवानना सेवक ऐवा गांधर्वो, सिद्ध, देव, चारण अने अप्सराओ प्रेम  
 पूर्वक मृदुंग, पणव, वाद्य, गीत, पुष्प, नैवेद्य अने स्तुतिथी सेवा करवा सभीपे  
 आव्या.<sup>२७</sup> हे राजा ! जेनां एकसो मुख्य माथां हतां ऐवो कालीनाग पोतानी  
 आयुष्य क्षीण थया छतां पण झर्या करतो हतो, तेनुं जे जे माथुं नमतुं न हतुं तेने,  
 भगवान पोताना चरणानो प्रहार करीने नमावता हता. मोठांमांथी अने नाकमांथी  
 भयंकर लोही ओकतो ऐवो नाग बहु ज कृष्ट पाभ्यो.<sup>२८</sup> कोधथी लांबा श्यास  
 लेतो अने आंधथी जेर ओकतो ए नागनो मद उतारी नाभ्यो. ते समये देवताओ  
 द्वारा पुष्पथी पूजायेला भगवान साक्षात् पुराणपुरुष जेवा, गोवाणोना ज्ञेवामां  
 आव्या. भगवाननां विचित्र तांडवने लीधे झेषाओमांथी धणुं लोही ओकतो अने  
 गात्रभंग थयेलो नाग, श्रीकृष्ण भगवानने स्थावर जंगमना गुरु ऐवा साक्षात्  
 नारायण जाणीने मनथी तेमने शरणे गयो.<sup>२९-३०</sup> जेना उदरमां सधयुं जगत  
 रहेलुं छे. ऐवा भगवानना बहु ज भारथी पीडा पामेलो अने भगवानना  
 चरणानी पानीना प्रहारथी जेनुं झेषारुपी छत्र भांगी पडचुं छे, ऐवा कालीनागने  
 ज्ञेईने पीडा पामेली अने जेनां वस्त्र भूषण अने केशबंध शिथिल थई गया हता,

નાગપત્ય ઊચુ: -

ન્યાયો હિ દણ્ડ: કૃતકિલ્બિષેઽસ્મિસ્તવાવતાર: ખલનિગ્રહાય ।  
 રિપો: સુતાનામપિ તુલ્યદૃષ્ટેર્થત્સે દમં ફલમેવાનુશંસન् ॥૩૩॥  
 અનુગ્રહોઽયં ભવત: કૃતો હિ નો દણ્ડોઽસતાં તે ખલુ કલ્પષાપહ: ।  
 યદ્ દન્દશૂકત્વમમુષ્ય દેહિન: ક્રોધોઽપિ તેઽનુગ્રહ એવ સમ્મત: ॥૩૪॥  
 તપ: સુતસં કિમનેન પૂર્વ નિરસ્તમાનેન ચ માનદેન ।  
 ધર્મોઽથ વા સર્વજનાનુકમ્પયા યતો ભવાંસ્તુષ્યતિ સર્વજીવ: ॥૩૫॥  
 કસ્યાનુભાવો�સ્ય ન દેવ વિદ્ધાહે તવાઙ્ગ્રેણુસ્પર્શાધિકાર: ।  
 યદ્વાજ્ઞયા શ્રીર્લલનાઽચરત્તપો વિહાય કામાન્ સુચિરં ધૃતવ્રતા ॥૩૬॥  
 ન નાકપૃષ્ટં ન ચ સાર્વભૌમં ન પારમેષ્ઠં ન રસાધિપત્યમ् ।  
 ન યોગસિદ્ધીરપુનર્ભવં વા વાજ્ઞનિ યત્યાદરજ:પ્રપન્ના: ॥૩૭॥

એવી નાગની પત્નીઓ ભગવાનને શરણો આવી. <sup>૩૧</sup> બહુજ ઉદ્દેગ પામેલી અને પતિના દુઃખથી છુટકારો ઈચ્છતી, એ નાગપત્નીઓ હાથ જોડી પોતાના શરીરથી ધરતી ઉપર દંડવત્પ્રણામ કરીને શરણ આપનારા ભગવાનને શરણો ગઈ <sup>૩૨</sup>

નાગ પત્નીઓ સ્તુતિ કરે છે હે મહારાજ ! આપે આ અપરાધીને તેના અપરાધની શિક્ષા કરી તે યોગ્ય જ છે. કારણ કે શત્રુ તથા પુત્રોના ઉપર સમાન દસ્તિ રાખનારા આપનો આ અવતાર, ખળ લોકોને શિક્ષા કરવા માટે છે. અને તમો પણ કર્મના ફળ તરફ જ દસ્તિ રાખીને અપરાધની શિક્ષા કરો છો. <sup>૩૩</sup> આપે અમારા પતિની શિક્ષા કરી તે પણ અમારી ઉપર અનુગ્રહ કર્યો છે. કારણ કે આ અમારા પતિને જે પાપથી સર્પનો અવતાર આવ્યો છે તે પાપ આપના કોધથી દૂર થયું છે, માટે આપના કોધને પણ અમો અનુગ્રહરૂપ માનીએ છીએ. <sup>૩૪</sup> પૂર્વે આ નાગો પોતે માનનો ત્યાગ કરીને અને બીજાઓને માન આપીને સર્વ જન ઉપર દયા રાખવા પૂર્વક કર્યું તપ કર્યું હશે ? અને કયો ધર્મ સારી રીતે પાણ્યો હશે ? કે જેથી સર્વને જીવાડનાર આપ પ્રસત્ર થયા છો. <sup>૩૫</sup> ઉત્તમ સ્ત્રી લક્ષ્મીએ પણ જે આપના ચરણને પામવાની ઈચ્છાથી સર્વ વૈભવનો ત્યાગ કરી તથા ઘણા કાળ સુધી નિયમો પાણી તપ કર્યું હતું, તે આપના ચરણના સ્પર્શનો અધિકાર આ સર્પને મળ્યો, તે શા પુણ્યના પ્રભાવથી મળ્યો ? એ અમે જાણતાં નથી. <sup>૩૬</sup> આપના ચરણારવિંદની રજને સેવનારા પુરુષો સ્વર્ગ, ચક્રવર્તીપણું, બ્રહ્માની પદવી, પાતાળનું રાજ્ય, યોગની સિદ્ધિઓ અથવા મોક્ષને પણ ઈચ્છતા નથી. <sup>૩૭</sup> હે નાથ !

તદેષ નાથાપ દુરાપમનૈસ્તમોજનિ: ક્રોધવશોઽપ્યહીશા: ।  
 સંસારચક્રે ભ્રમત: શરીરિણો યદિચ્છત: સ્યાદ્ વિભવ: સમક્ષઃ ॥૩૮॥  
 નમસ્તુભ્યં ભગવતે પુરુષાય મહાત્મને । ભૂતવાસાય ભૂતાય પરાય પરમાત્મને ॥૩૯  
 જ્ઞાનવિજ્ઞાનનિધયે બ્રહ્મણેઽનન્તશક્તયે । અગુણાયાવિકારાય નમસ્તેઽપ્રાકૃતાય ચ ॥૪૦  
 કાલાય કાલનાભાય કાલાવયવસાક્ષિણે । વિશ્વાય તડુપદ્રષ્ટે તત્કર્તે વિશ્વહેતવે ॥૪૧  
 ભૂતમાત્રેન્દ્રિયપ્રાણમનોબુદ્ધ્યાશયાત્મને । ત્રિગુણેનાભિમાનેન ગૂઢસ્વાત્માનુભૂતયે ॥૪૨  
 નમોઽનન્તાય સૂક્ષ્માય કૂટસ્થાય વિપશ્ચિતે । નાનાવાદાનુરોધાય વાચ્યવાચકશક્તયે ॥૪૩  
 નમ: પ્રમાણમૂલાય કવયે શાસ્ત્રયોનયે । પ્રવૃત્તાય નિવૃત્તાય નિગમાય નમો નમ: ॥૪૪  
 નમ: કૃષ્ણાય રામાય વસુદેવસુતાય ચ । પ્રદ્યુમ્નાયાનિરુદ્ધાય સાત્વતાં પત્યે નમ: ॥૪૫

બીજાઓને ન મળે એવી આપની ચરણરજને તમોગુણથી ઉત્પન્ન થયેલો અને કોધને વશ આ નાગ પણ પાભ્યો, કે જે ચરણરજથી સંસારચક્રમાં ભટકતો પ્રાણી માત્ર ઈચ્છા કરે તેટલામાં જ જોઈતું સુખપ્રામ થઈ જાય છે. <sup>૩૯</sup> અંતર્યામી, મહાત્મા, આકાશાદિક પંચમહાભૂતના આશ્રયરૂપ, સર્વના આદિકારણ અને સર્વ કારણોના પણ કારણ આપ ભગવાનને અમે પ્રણામ કરીએ છીએ. <sup>૪૦</sup> જ્ઞાન તથા વિજ્ઞાનના ભંડાર, પરખ્રબ્ર, અનંત શક્તિવાળા, સત્વાદિક માયિક ગુણોથી રહિત, નિર્વિકાર અને પ્રકૃતિને પ્રવર્તાવિનાર આપને પ્રણામ કરીએ છીએ. <sup>૪૧</sup> કાળસ્વરૂપ, કાળશક્તિના આશ્રયરૂપ, નિમેષથી આરંભીને વર્ષ પર્યતના જે કાળના અવયવો તેના સાક્ષી, વિશ્વરૂપ, વિશ્વના દ્રષ્ટા, વિશ્વના કર્તા, વિશ્વના કારણરૂપ, પંચભૂત, તન્માત્રા, ઈન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ અને ચિત્ત આ સર્વના પ્રવર્તક, અહંકારને કારણે દેહાદિકમાં અભિમાનવાળા તથા સ્વતંત્રપણાના અભિમાનવાળા જીવોને, પોતાના સ્વરૂપનું સુખ નહિ આપનારા, અનંત, સૂક્ષ્મ, કૂટસ્થ, સર્વજ્ઞ, સાંખ્ય, યોગ એ આદિ અનેક પ્રકારના વાદોની જેમાં સમાપ્તિ થઈ જાયછે. અને વાચ્ય પદાર્થ અને વાચ્યક શબ્દ તેના તો એક શક્તિરૂપ, અર્થાત્ આ શબ્દથી આ પદાર્થ જાણવું આવો સંકેત જેના થકી થાય છે. આવા આપને પ્રણામ કરીએ છીએ. <sup>૪૨-૪૩</sup> નેત્રાદિ સર્વ ઈન્દ્રિયોના કારણરૂપ, સર્વજ્ઞપણથી યુક્ત, વેદો જેના શાસ છે. અર્થાત્ વેદોના આવિર્ભાવના કારણરૂપ, પ્રવૃત્તિ કર્મ તથા નિવૃત્તિ કર્મનું પ્રતિપાદન કરનારા અને ઉપનિષદ્ સંબન્ધી જ્ઞાનના પ્રવર્તક, એવા આપને નમસ્કાર કરીએ છીએ. <sup>૪૪</sup> સર્વ જનોના દુઃખનું આકર્ષણ કરનારા હોવાથી કૃપણ શબ્દથી કહેલા,

નમો ગુણપ્રદીપાય ગુણાત્મચ્છાદનાય ચ । ગુણવૃત્ત્યપલક્ષ્યાય ગુણદ્રષ્ટે સ્વસંવિદે ॥૪૬  
અવ્યાકૃતવિહારાય સર્વવ્યાકૃતસિદ્ધ્યે । હૃષીકેશ નમસ્તેઽસ્તુ મુનયે મौનશીલિને ॥૪૭  
પરાવરગતિજ્ઞાય સર્વધ્યક્ષાય તે નમઃ । અવિશ્વાય ચ વિશ્વાય તદ્દ્રષ્ટેઽસ્ય ચ હેતવે ॥૪૮  
ત્વં હૃસ્ય જન્મસ્થિતિસંયમાન્ પ્રભો! ગુણૈરનીહોઽકૃત કાલશક્તિધ્રક્ ।  
તત્તત્ત્વસ્થભાવાન્ પ્રતિબોધયન્ સતઃ સમીક્ષયામોવિહાર ઈહસે ॥૪૯॥  
તસ્યૈવ તેઽમૂસ્તનવસ્ત્રિલોક્યાં શાન્તા અશાન્તા ઉત્ત મૂઢ્યોનયઃ ।  
શાન્તા: પ્રિયાસ્તે હૃધુનાવિતું સતાં સ્થાતુશ્ચ તે ધર્મપરીપ્સયેહતઃ ॥૫૦॥

સર્વે જનોને આનંદ આપનારા હોવાથી રામશબ્દથી કહેલા, શુદ્ધ અંતઃકરણમાં આવિભાવ પામનારા હોવાથી વસુદેવસુત શબ્દથી કહેલા, પ્રકૃષ્ટ ધનથી યુક્ત હોવાથી પ્રદુભ્ન શબ્દથી કહેલા, જ્ઞાની ભક્તોના નિરોધથી રહિત હોવાથી અનિરુદ્ધ શબ્દથી કહેલા, અને એકાંતિકભક્તોના પતિ એવા આપને પ્રણામ કરીએ છીએ.<sup>૪૫</sup> પોતાના ભક્તજનોની આગળ કૃપાળુપણું એ આદિક ગુણોને પ્રકટ કરનારા અથવા મનુષ્યલોકમાં આવીને સત્ય, શૌચાદિગુણોને બતાવનારા, અને દેવ મનુષ્યાદિકને વિષે અવતારો ધારણ કરીને તે તે દેવ મનુષ્યની જ્ઞાતિના જે સ્વભાવો, તેણે કરીને સમગ્ર ઐશ્વર્યથી યુક્ત સ્વસ્વરૂપને ઢાંકી દેનારા, તથા સત્વગુણની વૃત્તિરૂપ શમદમાદિ ભક્તિનાં સાધનો દ્વારા જ્ઞાણવા યોગ્ય અને દોષોનો ત્યાગ કરીને ભક્તોના કેવળ ગુણોને જ જોનારા, અને પોતાના ભક્તોની આગળ જ્ઞાન ગોષ્ઠીને કરનારા, તથા પ્રકૃતિના કાર્યથી પર વિહાર કરનારા, અથવા અવ્યાકૃત એવા બ્રહ્મપુરને વિષે વિહાર કરનારા, અને નામરૂપાદિ સર્વે વ્યાકૃતિઓની સિદ્ધિમાં કારણરૂપ ઈન્દ્રિયોને પ્રવર્તાવનારા, ગુણાત્મક વાણીના ઉચ્ચારથી રહિત જેનો સ્વભાવ છે. આવા નારાયણમુનિ જે તમો, તે તમોને અમો પ્રણામ કરીએ છીએ.<sup>૪૬-૪૭</sup> મોક્ષરૂપી પર ગતિને અને બંધનરૂપી અવર ગતિને જ્ઞાણનારા, તથા પોતાના આશ્રિતોને તો પોતાની મૂર્તિ પર્યંત સર્વે વસ્તુ આપવામાં મહાઉદ્ધાર, એ જ કારણથી સર્વે પુરુષાર્થોના અધિપતિ, સમગ્ર વિશ્વની અંદર અંતર્યામીપણે પ્રવેશ કરીને રહેલા, છતાંપણ સમગ્ર વિશ્વથી વિલક્ષણ અને સમગ્ર વિશ્વના દ્રષ્ટા તથા સમગ્ર વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કારણ એવા આપને અમો પ્રણામ કરીએ છીએ.<sup>૪૮</sup> હે પ્રભુ! આપ અનાદિભૂત કાળનામની શક્તિને ધારણ કરનારા છો. સંકલ્પ સિવાયની સમગ્ર ક્ષિયાઓથી રહિત છો. સત્વગુણ, રજોગુણ, અને તમોગુણ દ્વારા આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને

અપરાધ: સકૃદ્ધ ભર્ત્રા સોઢવ્ય: સ્વપ્રજાકૃતઃ । ક્ષત્નુમર્હસિ શાન્તાત્મન મૂઢસ્ય ત્વામજાનતઃ ॥૫૧  
અનુગૃહીષ્વ ભગવન્ પ્રાણાસ્ત્યજતિ પજ્ઞગઃ । સ્ત્રીણાનઃ સાધુશોચ્યાનાં પતિઃ પ્રાણ: પ્રવીયતામ् ૫૨  
વિધેહિ તે કિઙ્કરીણામનુષ્ટેયં તવાજ્ઞયા । યચ્છ્રદ્ધયાનુતિષ્ઠન् વૈ મુચ્યતે સર્વતોભયાત् ॥૫૩

શ્રીશુક ઉવાચ -

ઇથં સ નાગપતીભિર્ભગવાન્ સમભિષ્ટઃ । મૂર્છિતં ભગનશિરસં વિસસર્જાદિઘ્રકદ્વાનૈ: ॥૫૪  
પ્રતિલબ્ધેન્દ્રિયપ્રાણ: કાલિય: શનકૈરહરિમ् । કૃચ્છાત્ સમુચ્છ્વસન્ દીનઃ કૃષ્ણાં પ્રાહ કૃતાજ્જલિ:  
કાલિય ઉવાચ -

વયં ખલા: સહોત્પચ્યા તામસા દીર્ઘમન્યવઃ । સ્વભાવો દુસ્ત્યો નાથ લોકાનાં યદસદ્ગ્રહઃ ॥૫૬  
પ્રલયને કરનારા છો. અને સત્વાદિગુણમય જેમના સ્વભાવો છે, એવા જીવોને  
કૃપા દસ્તિથી દંડ આપીને જ્ઞાત કરો છો. અને સફળ છે જગત વ્યાપારરૂપ  
વ્યવહાર જેનો, એવા આપને અમો પ્રણામ કરીએ છીએ.<sup>૪૯</sup> હે પ્રભુ! આત્રિલોકીમાં  
સાત્ત્વિક, રાજસ અને તામસ આ ત્રણ પ્રકારનાં તમારાં શરીરો છે. અને તમો  
ત્રણોના શરીરી આત્મા છો. જો કે ત્રણો પ્રકારનાં તમારા શરીરો હોવાથી ત્રણોય  
અનુગ્રહ કરવા યોગ્ય છે, છતાં પણ સ્થિતિ કર્તા અને અત્યારે સત્પુરુષોના ધર્મનું  
રક્ષણ કરવા માટે પ્રવર્તેલા એવા તમોને સાત્ત્વિક શરીરોનું રક્ષણ કરવું એ જ  
પ્રિય છે. છતાં હે પ્રભુ! અમો દંડ મણ્યાથી પહેલાં તો તામસ શરીરવાળાં હતાં,  
પણ અત્યારે તમારા દંડને પામીને સાત્ત્વિક થયેલાં છીએ. માટે અમો આપના  
અનુગ્રહને માટે યોગ્ય છીએ, તેથી આપ અમારા ઉપર અનુગ્રહ કરો.<sup>૫૦</sup> હે  
મહારાજ! દયા કરો, હવે આ સર્પના પ્રાણ જાય છે. જે અમો સાધુ પુરુષોએ શોક  
કરવા યોગ્ય સ્ત્રીઓ છીએ, તે સ્ત્રીઓને આ પતિરૂપ પ્રાણનું દાન આપો.<sup>૫૧</sup>  
સ્વામીએ એકવાર પોતાની પ્રજાએ કરેલા અપરાધનું સહન કરવું જોઈએ. આવી  
લોક રીતિ છે, માટે હે શાંત સ્વભાવવાળા! આ નાગ મૂઢ છે અને તમને જ્ઞાતો  
નથી, તેના ઉપર ક્ષમા કરવી જોઈએ.<sup>૫૨</sup> આપને જે આજ્ઞા કરવાની હોય તે અમોને  
કરો. અમો આપની દાસીઓ છીએ, અમે તમારી આજ્ઞાનું પાલન કરીશું. કારણ  
કે આપની આજ્ઞાને શ્રદ્ધાથી પાળનાર પ્રાણી સર્વ ભયથી મૂકાય છે.<sup>૫૩</sup>

શુકદેવજી કહે છે- આ પ્રમાણો નાગ પત્નીઓએ સારી રીતે સ્તુતિ કરેલા  
ભગવાને, મૂર્છા પામેલા અને ચરણવડે પ્રહાર કરવાને લીધે જેનાં માથાં ભાંગી  
ગયાં હતાં, એવા નાગને છોડી દીધો.<sup>૫૪</sup> ધીરે ધીરે જેનાં ઈદ્રિયો અને પ્રાણ પાછાં  
મળ્યાં એવો અને કષ્ટથી શાસ લેતો અને દીન થઈ ગયેલો કાલિનાગ હાથ જોઈને

त्वया सृष्टिमिदं विश्वं धातर्गुणविसर्जनम् । नानास्वभाववीर्यौजोयोनिबीजाशयाकृति ॥५७॥  
वयं च तत्र भगवन् सर्पा जात्यरुमन्यवः । कथं त्यजामस्त्वम्मायां दुस्त्यजां मोहिताः स्वयम्  
भवान् हि कारणं तत्र सर्वज्ञो जगदीश्वरः । अनुग्रहं निग्रहं वा मन्यसे तद् विधेहि नः ॥५९॥

## श्रीशुक उवाच

इत्याकर्ण्य वचः प्राह भगवान् कार्यमानुषः । नात्र स्थेयं त्वया सर्प समुद्रं याहि मा चिरम् ।  
स्वज्ञात्यपत्यदाराढ्यो गोनृभिर्भुज्यतां नदी ॥६०॥

य एतत् संस्मरेऽन्तर्स्तुभ्यं मदनुशासनम् । कीर्तयन्नुभयोः सन्ध्योर्न युष्मद् भयमान्युयात् ॥६१  
योऽस्मिन् स्तात्वा मदाक्रीडे देवादीस्तर्पयेज्जलैः । उपोष्य मां स्मरन्नर्चेत् सर्वपापैः प्रमुच्यते ॥६२  
द्वीपं रमणंकं हित्वा ह्रदमेतमुपाश्रितः । यद्ग्रयात् सुपर्णस्त्वां नाद्यान्मत्यादलाज्जितम् ॥६३॥

बोल्यो के- अमो जन्मथी ज खण, तमोगुणी अने लांभा कोधवाणा छीअे. हे नाथ !  
लोकोने जे स्वभावथी भिथ्या आग्रह थयो छे ते स्वभाव छोडी देवो ऐ अशक्य  
छे. ५५-५६ हे प्रभु ! सत्वादिक शुणो द्वारा आ विश्वने तमोअे ज सर्जेलुं छे. जे  
विश्वनी अंदर जुदा जुदा स्वभावो, जुदी जुदी देहनी शक्तिओ, जुदी जुदी  
इन्द्रियोनी शक्तिओ, जुदी जुदी उत्पत्ति क्षेत्रनी शक्तिओ, कारण शक्तिओ अने  
जुदी जुदी वासनाओ तथा आकृतिओ रहेली छे. आ जगतनी अंदर जन्मथी ज  
अमो कोधवाणा सर्पो छीअे, तो आपे ज मोह पमाडेला अमो आपनी हुःभे  
करीने न तरी शकाय ऐवी मायाने शी रीते छोडी शकीअे? ५७-५८ सर्वश अने  
जगहीश्वर आप ज मायानो त्याग करवामां कारण छो, माटे “मारी ज मायाथी  
मोहित थयेला आलोको, प्राणीओने खाई जाय छे” ऐम जाणी अमारा पर कृपा  
करवी योग्य जणाय तो कृपा करो. ५९

शुकदेवज्ञ कुहे छे- धर्म रक्षणारुपी कार्यने माटे मनुष्यरुपे थयेला भगवान  
आ प्रमाणो नागनुं वयन सांभणी बोल्या के- हे सर्प ! तारे अहीं रहेवुं नहीं.  
तारा संबंधीओने लहीने तुं समुद्रमां जा. हवे गायो अने मनुष्यो आ धराने  
उपयोगमां लेशे. में आ जे तने शिक्षा करी तेनुं वर्णन जे मनुष्य सांभणे अने  
सांज सवार कीर्तन करशे ते माणसने तमारे भय आपवो नहीं, मारी कीडाना  
स्थानरुप आ धरामां नाहीने जे माणस जणथी देवताओनुं तर्पण करशे, तथा  
उपवास करीने स्मरण करतां मारुं पूजन करशे ते सर्वे पापथी मूकाशे. अने तुं जे  
गरुडना भयथी रमणक्षीपने मूकीने आ धरामां रह्यो छे ते गरुड हवे, तुं मारा  
यरणना चिन्हथी चिन्हित थयो तेथी तने खाशे नहीं. ६०-६१

## श्रीशुक उवाच -

एवमुक्तो भगवता कृष्णोनाद्वुतकर्मणा । तं पूजयामास मुदा नागपत्न्यश्च सादरम् ॥६४॥  
दिव्याम्बरस्त्रिमणिभिः परार्थ्यैरपि भूषणैः । दिव्यगच्छानुलैपैश्च महत्योत्पलमालया ॥६५॥  
पूजयित्वा जगन्नाथं प्रसाद्य गरुडध्वजम् । ततः प्रीतोऽभ्यनुज्ञातः परिक्रम्याभिवन्द्य तम् ॥६६  
सकलत्रसुहृत्पुत्रो द्वीपमब्धेर्जगाम ह । तदैव सामृतजला यमुना निर्विषाभवत् ।

अनुग्रहाद्वगवतः ऋद्वामानुषस्त्रिपिणः ॥६७

इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्दे पूर्वार्धे  
कालियमोक्षणं नाम षोडशोऽद्यायः ॥१६॥

## अथ सप्तदशोऽध्यायः (१७)

## राजोवाच

नागालयं रमणंकं कस्मात्तत्याज कालियः । कृतं किं वा सुपर्णस्य तेनैकेनासमंजसम् ॥१

## श्रीशुक उवाच

उपहार्यैः सर्पजनैर्मासि मासीह यो बलिः । वानस्पत्यो महाबाहो नागानां प्राङ्गनिस्त्रिपितः ॥२

शुकदेवज्ञ कुहे छे- श्रीकृष्ण भगवान आ अद्वित कर्म करीने काणीनागने  
आशा करतां ते नागे पोतानी स्त्रीओनी साथे श्रद्धाथी भगवाननी पूजा करी. ६४  
दिव्य वस्त्र, माणाओ, अमूल्य भूषण, चंदन अने कर्मणी माणाथी भगवाननी  
पूजा करी तथा तेमने प्रसाद करी राजा थयेलो काली श्रीकृष्ण भगवाननी आशा  
लई प्रदक्षिणा तथा प्रशाम करी पोताना कुटुंब परिवार साथे समुद्रना द्वीपमां  
गयो. ते दिवसथी लीला माटे मनुष्यनारुपने धारण करनार भगवानना  
अनुग्रहथी ते अमृत सरभा जणवाणी यमुना झेर रहित थई. ६५-६७

इति श्रीमद्भागवतपुराणा भागवतना दशम स्कंदनो सोलभो अद्याय संपूर्णः.

## अद्याय १७

## दावानणनुं पान करता भगवान.

परीक्षित राजा पुछे छे- २मणक द्वीप के जे नागलोकोनुं स्थान छे, तेने कालिय  
नागे शा माटे छोड्यो हतो ? अने ते ऐकलाए गरुडज्ञनुं शुं अप्रिय कर्युं हतुं ? १

शुकदेवज्ञ कुहे छे- हे राजा ! पहेलाना समयमां माताना वेरने लीघे गरुड  
हमेशां धणा सर्पों मारी खातो. तेथी वासुकि वगोरे सर्पों भयभीत थईने ब्रह्माने

स्वं स्वं भागं प्रयच्छन्ति नागाः पर्वणि पर्वणि । गोपीथायात्मनः सर्वे सुपर्णाय महात्मने ॥३  
विषवीर्यमदविष्टः काद्रवेयस्तु कालियः । कदर्थीकृत्य गरुडं स्वयं तं बुभुजे बलिम् ॥४  
तच्छ्रुत्वा कुपितो राजन्! भगवान् भगवत्प्रियः । विजिधांसुर्महावेगः कालियं समुपाद्रवत् ॥५  
तमापतनं तरसा विषायुधः प्रत्यभ्ययादुच्छ्रुतनैकमस्तकः ।  
दद्धिः सुपर्णं व्यदशद् ददायुधः करालजिह्वोच्छ्रुतिग्लोचनः ॥६॥  
तं ताक्ष्यपुत्रः स निरस्य मन्युमान् प्रचण्डवेगो मधुसूदनासनः ।  
पक्षेण सव्येन हिरण्यरोचिषा जघान कद्रूसुतमुग्रविक्रमः ॥७॥

सुपर्णपक्षाभिहतः कालियोऽतीव विह्वलः । ह्रदं विवेश कालिन्द्यास्तदगच्छं दुरासदम् ॥८  
तत्रैकदा जलचरं गरुडो भक्ष्यमीप्सितम् । निवारितः सौभरिणा प्रसह्य क्षुधितोऽहरत् ॥९  
मीनान् सुदुर्खितान् दृष्ट्वा दीनान् मीनपतौ हते । कृपया सौभरिः प्राह तत्रत्यक्षेममाचरन् ॥१०  
अत्र प्रविश्य गरुडो यदि मत्स्यान् स खादति । सद्यः प्रार्णैविद्युज्येत सत्यमेतद् ब्रवीम्यहम् ॥११  
तं कालियः परं वेद नान्यः कक्षन् लेलिहः । अवात्सीद् गरुडाद् भीतः कृष्णेन च विवासितः ॥१२

शरणे गया. अब्जाए गरुडने बोलावी परस्पर संधी करावीने ठरायुं, के सर्पोंसे नियमपूर्वक गरुडने बलिदान आपतुं. अमावास्याना दिवसे एक ज्ञात नीये सर्पोंसे गरुडनुं बलिदान भूमी आवतुं. ते खाईने गरुडे भीजा सर्पोंने हेरान करवा नहि. आवो ठराव थवाथी दरेक भणिने सर्पों पोतपोतानुं बलिदान गरुडज्ञने आपी जता हता.<sup>२-३</sup> झेर अने बणना मदथी छकेलो कदुनो पुत्र काली गरुडने नहि गणकारीने पोते ते बलिदान खाई जवा लाग्यो. ए वात सांभणी भोटा वेगवाणा अने भगवानने प्रिय गरुडज्ञ कालीय नागने मारी नाखवा सारु दोड्या.  
<sup>४-५</sup> ए समये गरुडज्ञनी सामे झेररुपी आयुधवाणो कालीनाग पोतानां अनेक माथां उंचां करीने वेगथी दोडीने गरुडज्ञने करड्यो. <sup>६</sup> भगवानना आसनउप अने प्रचंड वेग तथा उग्र पराक्रमवाणा गरुडज्ञसे क्रोधथी तेने पोताना शरीरथी झाटकीने झेंकी दीधो अने पछी सोना जेवी कांतिवाणी पोतानी डाबी पांखथी प्रहार कर्यो. <sup>७</sup> पांखना प्रहारथी भुजुङ विह्वण थयेलो नाग, यमुनाज्ञनो उंडो धरो के जेमां गरुडज्ञ जई शके तेम न हतुं तेमां पेसी गयो. <sup>८</sup> पूर्वं भूम्या थयेला गरुडज्ञसे, अे यमुनाज्ञना धरामांथी सौभरिष्ठिये वार्या इतां बणात्कारथी पोताना प्रिय भक्ष्यरूप एक भोटा मत्स्यने उपाड्यो हतो. <sup>९</sup> माछलांओनो अधिपति भरी जतां भीजां माछलांओने दुःख पामेलां झोई दयाथी ते धरामां रहेनाराओने सुखी करवा सारु सौभरिष्ठिये बोल्या हता के “गरुड अहीं आवीने माछलांओने

कृष्णं ह्रदाद् विनिष्कान्तं दिव्यस्त्रगन्धवाससम् । महामणिगणाकीर्णं जाम्बूनदपरिष्कृतम् ॥१३  
उपलभ्योत्थिताः सर्वे लब्धप्राणा इवासवः । प्रमोदनिभूतात्मानो गोपाः प्रीत्याभिरेभिरे ॥१४  
यशोदा रोहिणी नन्दो गोप्यो गोपाश्च कौरवः । कृष्णं समेत्य लब्धेहा आसङ्गलब्धमनोरथाः ॥१५  
रामश्चाच्युतमालिङ्गय जहासास्यानुभाववित् । नगा गावो वृषा वत्सा लेभिरे परमां मुदम् ॥१६  
नन्दं विप्राः समागत्य गुरुवः सकलत्रकाः । ऊचुसे कालियग्रस्तो दिष्ट्या मुक्तस्तवात्मजः ॥१७  
देहि दानं द्विजातीनां कृष्णानिर्मुक्तिहतवे । नन्दः प्रीतमना राजन्! गाः सुवर्णं तदादिशत् ॥१८  
यशोदापि महाभागा नष्टलब्धप्रजा सती । परिष्वज्याङ्गमारोप्य मुमोचाश्रुकलां मुहुः ॥१९  
तां रात्रिं तत्र राजेन्द्रं क्षुत्रृद्ध्यां श्रमकर्क्षिताः । ऊषुर्जौकसो गावः कालिन्द्या उपकूलतः ॥२०  
तदा शुचिवनोद्धूतो दावाग्निः सर्वतो ब्रजम् । सुसं निशीथ आवृत्य प्रदर्थमुपचर्क्रमे ॥२१  
तत उत्थाय सम्भान्ता दह्यमाना व्रजौकसः । कृष्णं ययुस्ते शरणं मायामनुजमीश्वरम् ॥२२॥

खाई जाय छे. माटे हवे पट्ठी जो अहीं आवशे तो तेना प्राण जता रहेशे. आ वात हुं सत्य कहुं छुं”.<sup>१०-११</sup> आ वातने केवण कालिय जाणतो हतो, भीजो कोई सर्प जाणतो न हतो. ए कारणथी गरुडथी भय पामेलो काणीनाग ए धरामां रह्यो हतो तेने भगवाने काढ्यो. <sup>१२</sup> धरामांथी नीकणेला, भोटा भणिओना समूहथी व्याम, सुवर्णथी शणागारेला अने जेषो दिव्यमाणा, चंदन अने वस्त्र धर्या हतां एवा भगवानने आव्या जोईने, प्राण आवतां ईद्रियो जेम उठे तेम उठेला अने आनंदथी पूर्ण चितवाणा थयेला सर्वे गोवाणो प्रीतिथी तेमनुं आलिंगन करवा लाग्या. <sup>१३-१४</sup> हे राजा! यशोदा, रोहिणी, नंद, गोपीओ अने गोवाणो ए सर्वेने, भगवान मणवाथी शरीरनुं भान आव्युं अने मनोरथ पूर्ण थया. <sup>१५</sup> भगवानना प्रभावने जाणनार बणभद्र भगवाननुं आलिंगन करीने हस्या. अने वृक्ष, गायो, सांठ तथा वाघरडांओ परम आनंद पाम्यां. <sup>१६</sup> गोवाणोना कुलगुरु भ्रातृष्णो ए पोतानी स्त्रीओ सहित आवीने नंदरायने कहुं के- “कालीनागे गणेलो तमारो पुत्र छूट्यो ए धणुं सारु थयुं. <sup>१७</sup> तो हवे तेनो छूटकारो थयो ते कारणथी भ्रातृष्णोने दान आपो.” हे राजा! ते समये राज्ञ थयेला नंदराये गायो अने सुवर्णानां दान दीधां. <sup>१८</sup> महाभाग्यशाणी अने जेनी प्रजा नाश पाम्या जेवी थईने पाई भणी, अेवां सती यशोदाए पुत्रनुं आलिंगन करी, खोणामां बेसाडी, वारंवार आनंदना आंसु वरसाव्यां. <sup>१९</sup> हे राजा! भुख तरस अने परिश्रमथी दुःखी थयेलां व्रजवासीओ अने गायो यमुनाज्ञना कांठे ज ते रात्री रही गयां. <sup>२०</sup> ए समयमां ग्रीष्म ऋतुने लीधे वनमांथी उत्पत्त थयेलो दावाग्नि भधराते सूतेला व्रजने यारे

કૃષ્ણ! કૃષ્ણ! મહાભાગ! હે રામામિતવિક્રમ! । એષ ઘોરતમો વહ્નિસ્તાવકાન્ ગ્રસતે હિન: ૨૩  
સુદુસ્તરાત્રઃ સ્વાન્ પાહિ કાલાગને: સુહૃદ: પ્રભો । ન શક્વનુમસ્ત્વચ્ચરણં સંત્યકુમકુતોભયમ् ॥૨૪  
દ્વિત્યં સ્વજનવૈક્લબ્યં નિરીક્ષ્ય જગદીશ્વરઃ । તમગિનમપિબત્તીવ્રમનંતોઽનન્શક્તિધ્બ્રક् ॥૨૫ ॥

ઇતિ શ્રીમદ્બાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્દ્યે પૂર્વાર્થી  
દાવાગિનમોચનં નામ સપ્તદશોઽધ્યાય: ॥૧૭॥

### અથાષ્ટાદશોઽધ્યાય: (૧૮)

॥ શ્રીશુક ઉત્તાચ ॥

અથ કૃષ્ણ: પરિવૃતો જ્ઞાતિભર્મુદિતાત્મભિ: । અનુગીયમાનો ન્યવિશદ્બ્રજં ગોકુલમણ્ડિતમ् ॥૧  
બ્રજે વિક્રીદિતોરેવં ગોપાલચ્છવિમાયયા । ગ્રીષ્મો નામરૂખભવજ્ઞાતિપ્રેયાજ્ઞીરિણામ् ॥૨ ॥  
સ ચ વૃન્દાવનગુણૌર્વસન્ત ઇવ લક્ષિતઃ । યત્રાસ્તે ભગવાન્ સાક્ષાદ્ રામેણ સહ કેશાવઃ ॥૩ ॥  
યત્ર નિર્જરનિર્ઝર્દાદનિવૃત્તસ્વનઙ્ગિલિકમ् । શશ્વત્ચ્છીકર્જીષ્ઠુમમણ્ડલમણ્ડિતમ् ॥૪ ॥

કોરથી ધેરી લઈને બાળવા લાગ્યો.<sup>૨૧</sup> તેથી બળવા લાગેલાં અને સંભ્રમ પામેલાં  
પ્રજ્વાસીઓ ઊઠીને શ્રીકૃષ્ણને શરણે ગયાં અને બોલ્યાં કે- હે કૃષ્ણ! હે અપાર  
પરાકર્મવાળા! આ અત્યંત ભયંકર અજીન તમારા સેવક એવા અમોને બાળે  
છે.<sup>૨૨-૨૩</sup> હે પ્રભુ! અમારું કાળાગિનથી રક્ષણ કરો. અમો મરણથી ડરતાં નથી  
પણ આપના નિર્ભય ચરણારવિંદનો ત્યાગ કરી શકતાં નથી, તેથી શરણે આવ્યાં  
છીએ.<sup>૨૪</sup> જગતના ઈશ્વર અને અનંતશક્તિને ધારણ કરનાર ભગવાન આ પ્રમાણે  
પોતાના સંબંધીઓની વિદ્વણતા જોઈને તે તીવ્ર અજીનને પી ગયા.<sup>૨૫</sup>

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ રૂપનાં સતતમો અધ્યાય સંપૂર્ણ.

### અધ્યાય ૧૮

ખલરામ દ્વારા કરાયેલો પ્રલંબાસુરનો વધ.

શુકુદેવજી કહે છે- પછી પ્રસત્ત થયેલાં જ્ઞાતિઓથી વીંટાયેલા શ્રીકૃષ્ણ  
ભગવાન ગાયોના સમૂહથી શોભી રહેલા એવા પ્રજમાં પધાર્યા.<sup>૧</sup> આ પ્રમાણે  
ગાયોના પાલનના મિષવાળી માયાથી એ બે ભાઈઓ પ્રજમાં કીડા કરતા હતા,  
ત્યાં શ્રીભાગ્રતુ આવી.<sup>૨</sup> એ શ્રીભ ઋતુ, જે વૃંદાવનમાં બળભદ્રની સાથે સાક્ષાત્  
ભગવાન રહે છે, તે વૃંદાવનના ગુણોને લીધે વસંત જેવી દેખાવા લાગ્યા.<sup>૩</sup> એ

સરિત્સર: પ્રસ્ત્રવણોર્મિવાયુના કહારકબ્જોત્પલરેણુહારિણા ।  
ન વિદ્યતે યત્ર વનૌકસાં દવો નિદાઘવહન્યક્રભવોત્તિશાદ્વલે ॥૫ ॥  
અગાધતોયહૃદિનીતાર્મિભર્દ્રવત્પુરીષ્યા: પુલિનૈ: સમજતસ: ।  
ન યત્ર ચણ્ડાંશુકરા વિષોલ્બણા ભુવો રસં શાદ્વલિતં ચ ગૃહ્ણતે ॥૬ ॥

વનં કુસુમિતં શ્રીમત્ત્રદચ્ચવ્રમૃગદ્વિજમ્ । ગાયન્મયૂરભ્રમરં કૂજલ્કોદ્કિલસારસમ् ॥૭ ॥  
ક્રીડિષ્યમાણસ્તત્ કૃષ્ણો ભગવાન્ બલસંયુત: । વેણું વિરણયન્ ગોપૈર્ગોધનૈ: સંવૃતોઽવિશત् ॥૮  
પ્રવાલબહૃસ્તબકસ્ત્રગધાતુક્તભૂષણા: । રામકૃષ્ણાદયો ગોપા નનૃત્યુદ્ધુર્જું ॥૯ ॥  
કૃષ્ણાસ્ય નૃત્યત: કેચિજ્જગુ: કેચિદવાદયન્ । વેણુપણિતલૈ: શૃંગૈ: પ્રશણંસુરથાપરે ॥૧૦ ॥  
ગોપજાતપ્રતિચ્છન્નો દેવા ગોપાલસુપણિણ: । ઈંડિરે કૃષ્ણારામો ચ નટા ઇવ નંતં નૃપ! ॥૧૧ ॥  
ભ્રામણૈલંદ્ઘનૈ: ક્ષેપેરાસ્ફોટનવિકર્ષણૈ: । ચિક્રીડતુર્નિયુદ્ધેન કાકપક્ષધરૌ ક્રચિત् ॥૧૨ ॥

શ્રીભાગ્રતુમાં પણ જરણાંઓના શબ્દોથી વૃંદાવનમાં તમરાંઓના શબ્દો પણ ઢંકાઈ  
જાય છે. અને નિરંતર તે જરણાંઓના બારીક જળકણોથી વૃક્ષોના મંડળો પણ  
ભીજાયેલાં રહે છે.<sup>૪</sup> શેત ક્રમણ, સામાન્ય ક્રમણ અને શ્યામ ક્રમણની રજને  
લાવનાર તથા નદી સરોવર કે જરણાંઓના તરંગો પરથી પસાર થઈને આવનારા  
શીતળ વાયુને લીધે, ત્યાં રહેનારા વનવાસીઓને ઉનાળાના દાવાનળથી કે સૂર્યથી  
થતો તાપ લાગતો ન હતો.<sup>૫</sup> એ વનમાં કંઠાઓને પહોંચ્યતી અગાધ જળવાળી  
નદીઓના તરંગોથી, જેમાં કંઠાઓની સાથે બીજી માટી પણ ચારે કોર દ્રવીભૂત  
રહ્યા કરે છે, એવી પૃથ્વીના રસને અને હરિયાળાપણાને સૂર્યનાં કિરણો જેવાં  
અતિતિક્ષણ હોવા છીતાં પણ હરી શકતાં નથી.<sup>૬</sup> એ પુષ્પની સંપત્તિવાળું વન કે  
જેમાં વિચિત્ર પ્રકારનાં પશુઓ અને પક્ષીઓ શબ્દ કર્યા કરતાં હતાં, મધ્યૂર અને  
ભમરો ગાતા હતા, અને કોયલ તથા સારસો નાદ કરી રહ્યાં હતાં, આવા વૃંદાવનમાં  
કીડા કરવા સારુ વેણુ વગાડતા અને ગાયોના ધણથી વીંટાયેલા શ્રીકૃષ્ણ ભગવાન,  
બળભદ્ર અને ગોવાળોની સાથે પધાર્યા.<sup>૭-૮</sup> ત્યાં કુંપળો, મોરપીઠાં, પુષ્પોના ગુચ્છો,  
માળા તથા ગેરુ વગેરે ધાતુઓથી સારી રીતે શાણગારેલા બળભદ્ર અને  
શ્રીકૃષ્ણાદિક ગોવાળો નાચવા લાગ્યા, બાહુ વડે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા અને  
ગાવા લાગ્યા.<sup>૯</sup> શ્રીકૃષ્ણ જ્યારે નાચ કરતા હતા ત્યારે કેટલાક ગોવાળો ગાતા  
હતા, કેટલાક ગોવાળો શીંગડી વગાડતા હતા અને કેટલાક વખાણતા હતા.<sup>૧૦</sup> હે  
રાજ! ગોવાળોની જાતમાં ગુમ રહેલા એ ગોવાળોરૂપી દેવતાઓ જેમ નટો નટને  
વખાણે તેમ, શ્રીકૃષ્ણ અને બળદેવને વખાણતા હતા.<sup>૧૧</sup> ચૂડાકર્મ કર્યાથી પહેલાંના

क्रचिन्नत्यत्सु चान्येषु गायकौ वादकौ स्वयम् । शशंसतुर्महाराज साधु साधिवति वादिनौ ॥३  
क्रचिद् बिल्वैः क्रचित् कुर्प्पैः क्रचामलकमुष्टिभिः । अस्पृश्यनेत्रबस्थाद्यैः क्रचिमृगखगेहया ॥४  
क्रचिच्च दर्दुरप्लावैर्विविधैरुपहासकैः । कदाचित् स्पन्दोलिकया कर्हिचिन्नृपचेष्टया ॥५  
एवं तौ लोकसिद्धाभिः क्रीडाभिश्चेरतुर्वने । नदिद्रिग्रोणिकुञ्जेषु काननेषु सरस्सु च ॥६  
पश्नूश्चारयतोर्गौपैस्तद्वने रामकृष्णायोः । गोपरूपी प्रलम्बोऽगादसुरस्तज्जिहीर्षया ॥७  
तं विद्वानपि दाशार्हो भगवान् सर्वदर्शनः । अन्वमोदत तत्सख्यं वधं तस्य विचिन्तयन् ॥८  
तत्रोपाहूय गोपालान् कृष्णः प्राह विहारवित् । हे गोपा ! विहरिष्यामो द्वन्द्वीभूय यथायथम् ॥९  
तत्र चक्रुः परिवृद्धौ गोपा रामजनार्दनौ । कृष्णसंघद्विनः केचिदासन् रामस्य चापरे ॥१०  
आचेरुविविधाः क्रीडा वाहवाहकलक्षणाः । यत्रारोहन्ति जेतारो वहन्ति च पराजिताः ॥११  
वहन्तो वाह्यमानाश्च चारयन्तश्च गोधनम् । भाण्डीरकं नाम वटं जग्मुः कृष्णपुरोगमाः ॥१२

लांबा केशोने धारणा करता ए भन्ने भाईओ कोई समये एकभीज्ञाने फेरववा, एकभीज्ञा उपर कूदवुं, एकभीज्ञाने पछाडवा, हाथना तणियांथी बाहुओमां ताडन करवुं, एकभीज्ञाने खेंयवा, बाहुयुद्ध करवुं वगेरे रमतोथी कीडा करता हता।<sup>१२</sup> हे राजा ! कोई समये भीज्ञाओ नाचता होय त्यारे भन्ने भाईओ गाता हता, वाज्ञा वगाडता हता अने वाह ! वाह ! करीने वधाणता हता।<sup>१३</sup> कोई समये भीलांओथी, कोई समये दडा जेवां कुंभवृक्षना फणोथी, आमणांओथी भरेली मूठीओथी, कोई समये स्पर्श करवा न देवाथी, आंभमींचामणाथी, पशु अने पक्षीओनी येष्टाथी, क्यारेक देडकांनी पेठे कूदका मारवाथी, अनेक प्रकारनां हास्योथी, हींयकाथी, राजानी येष्टाथी रमता हता।<sup>१४-१५</sup> आ प्रमाणे लोकमां प्रसिद्ध रमतोथी वनमां कीडा करता भन्ने भाईओ नदीओ, पर्वतोनी गुङ्काओ, निंकुंजो, वनो अने तणावोमां फरता हता।<sup>१६</sup> ए वनमां बणटेव अने श्रीकृष्ण गोवाणोनी साथे पशुओने चारता हता. त्यां तेओने हरी जवानी ईच्छाथी गोवाणनुं रूप धरीने प्रलंबासुर आव्यो।<sup>१७</sup> सर्वज्ञ श्रीकृष्ण भगवान ए देत्यने ज्ञाणी गया तोपण तत्काण तेनो वध कर्यो नहि, परंतु भीज्ञा उपायोथी तेना वधनो विचार करीने प्रथम श्रीकृष्ण भगवाने तेनी साथे भित्रता स्वीकारी लीधी।<sup>१८</sup> पछी कीडाना प्रकारने ज्ञाणनारा भगवाने गोवाणोने बोलावी कह्युं के- हे गोवाणो ! आपणे योग्य रीते बे भागोमां वहेंचाईने रमत करीशुं।<sup>१९</sup> वणी ए रमतमां गोवाणो ए श्रीकृष्ण अने बणटेवज्ञाने बे टोणांना नायक कर्या. केटलाअेक भगवाननी टोणीमां मण्या अने भीज्ञा बणटेवज्ञानी टोणीमां मण्या।<sup>२०</sup> ज्ञेओ ज्ञते ते माथे बेसे अने

रामसङ्घद्विनो यर्ह श्रीदामवृषभादयः । क्रीडायां जयिनस्तांस्तानूहुः कृष्णादयोनृप ! ॥२३  
उवाह कृष्णो भगवान् श्रीदामानं पराजितः । वृषभं भद्रसेनस्तु प्रलम्बो रोहिणीसुतम् ॥२४  
अविष्टह्यं मन्यमानः कृष्णं दानवपुङ्गवः । वहन् द्रुतरं प्रागादवरोहणतः परम् ॥२५  
तमुद्वहन् धरणिधरेन्द्रगौरवं महासुरो विगतरयो निजं वपुः ।  
स आस्थितः पुरटपरिच्छद्वे बभौ तडिह्यमानुडुपतिवाडिवाम्बुदः ॥२६  
निरीक्ष्य तद्वपुरलम्बरे चरत् प्रदीमद्ग्र भुकुटितटोग्रदंष्ट्रकम् ।  
ज्वलच्छिखं कटककिरीटकुण्डलत्विषाद्बुद्धुं हलधर ईषदत्रसत् ॥२७  
अथागतस्मृतिरभयो रिपुं बलो विहायसार्थमिव हरन्तमात्मनः ।  
रुषाहनच्छरसि दृढेन मुष्टिना सुराधियो गिरिमिव वज्ररंहसा ॥२८  
स आहतः सपदि विशीर्णमस्तको मुखाद् वमन् रुधिरमपस्मृतोऽसुरः ।  
महारवं व्यसुरपतत् समीरयन् गिरिर्यथा मघवत आयुधाहतः ॥२९

हारे ते उपाडे, एवी रीतनी अनेक प्रकारनी रमतो करवा लाग्या।<sup>२१</sup> हारने लीधे ज्ञतेलाने पोतानी पीठ उपर बेसाडीने चालता अने ज्ञतने लीधे हारेलानी पीठ उपर यढी बेसता अने गायोने चारता ए श्रीकृष्ण आदिक गोवाणो भांडीरक नामना वड सुधी ज्ञता हता।<sup>२२</sup> बणटेवनी टोणीवाणा श्रीदामा अने वृषभ आदि गोवाणो ज्यारे रमतमां ज्ञत्या त्यारे श्रीकृष्णादिक गोवाणो तेओने उपाडवा लाग्या।<sup>२३</sup> हारी गयेला श्रीकृष्णे श्रीदामाने पोतानी पीठ पर उपाड्यो, भद्रसेने वृषभने उपाड्यो अने प्रलंबासुरे बणटेवने उपाड्या।<sup>२४</sup> बणटेवज्ञने उपाडी चालतो प्रलंबासुर श्रीकृष्णने बणवतर ज्ञाणी, तेमनी दृष्टि युक्तवा सारु भडु ज उतावणो चाली, उतारवाना स्थानकनी आगण घणे दूर चाल्यो गयो।<sup>२५</sup> मोटा पर्वत जेवा भारवाणा बणटेवने उपाडनार, प्रलंबासुर थाकी गयो एटले वेग मंद पडी ज्ञाणी जेणे राक्षसी स्वरूप धरी लीधुं एवो, अने सोनानां घरेलांवाणो ते प्रलंबासुर मेधनी समान शोभवा लाग्यो।<sup>२६</sup> आकाश सुधी पडोंयेलुं अने अत्यंत वेगथी दीम दृष्टिवाणुं, भृकुटी सुधी पडोंयेली उत्र दाढोवाणुं, बणती शिखाजेवा पीणा केशवाणुं अने कडां, मुकुट तथा कुडणनी कांतिथी अद्भुत लागतुं ए देत्यनुं शरीर ज्ञेइने बणटेव कांडिक त्रास पाम्या।<sup>२७</sup> पछी पोताना बणनी स्मृति आवतां निर्भय थअेला बणटेवे आकाश मार्गथी पोताना मालनी पेठे पोताने लई ज्ञता ए देत्यने, ईंद्रे जेम वजना वेगथी पर्वतने प्रहार कर्यो, तेम कोधवते तेना माथामां ज्ञोरदार मूठीथी प्रहार कर्यो।<sup>२८</sup> मूठीना प्रहारथी माथुं

दूष्टा प्रलम्बं निहतं बलेन बलशालिना । गोपाः सुविस्मिता आसन् साधु साधिवति वादिनः ३०  
आशिषोऽभिगृणन्तसं प्रशशंसुस्तर्दहणम् । प्रेत्यागतमिवालिङ्गय प्रेमविह्लचेतसः ॥३१  
पापे प्रलम्बे निहते देवाः परमनिर्वृताः । अभ्यर्वन् बलं माल्यैः शशंसुः साधुसाधिवति ॥३२

इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे  
पूर्वार्थं प्रलम्बवधो नामाष्टादशोऽध्यायः ॥१९॥

### अथैकोनविंशोऽध्यायः (१९)

श्रीशुक उवाच

क्रीडासक्तेषु गोपेषु तद्वावो दूरचारिणीः । स्वैरं चरन्त्यो विविशुस्तृणलोभेन गह्वरम् ॥१  
अजा गावो महिष्यश्च निर्विशन्त्यो वनाद् वनम् । इषीकाटवीं निर्विविशुः ऋन्दन्त्यो दावतर्षिताः २  
तेऽपश्यन्तः पशून् गोपाः कृष्णरामादयस्तदा । जातानुतापा न विदुर्विचिन्वन्तो गवां गतिम् ३

झाठी जतां मोढामांथी लोहीने ओक्तो, शरीरनुं भान भूली गयेलो अने मोटो  
नाए करतो ऐ प्रलंबासुर मरण पामीने पृथ्वी उपर पड़यो.<sup>२५</sup> बणवाणा बणदेवे  
प्रलंबासुरने मारेलो जोઈने भहु ज विस्मय पामेला गोवाणो वाह ! वाह ! कहेवा  
लाग्या.<sup>३०</sup> आशीर्वाद देता अने चितमां प्रेमथी व्याकुण थयेला गोवाणो वभाषावाने  
योग्य अने ज्ञाणे मरण पामीने पाइ आव्या होय ऐवा बणदेवनुं आलिंगन  
करीने वभाषावा लाग्या.<sup>३१</sup> पापी प्रलंबासुर मरी जतां भहु ज आनंद पामेला  
देवताओं ऐ बणदेवज्ञ उपर पुष्पनी वृष्टि करी अने सारुं थयुं सारुं थयुं आ  
प्रमाणे कहेवा लाग्या.<sup>३२</sup>

इति श्रीमद्भागवतना दशम स्कन्धनो अटारमो अध्याय संपूर्णं.

### अध्याय १८

दावानणनुं पान करीने गोपो तथा गायोनी रक्षा करता  
भगवान्.

शुकदेवज्ञ कहे छे- गोवाणो रमतमां लागी जतां दूर नीकणी गयेली अने  
पोतानी ईर्ष्या प्रमाणे चरती गायो घासनी लालचथी घाटा वनमां चाली गई.<sup>१</sup>  
एक वनमांथी बीजा वनमां जतां गरभीथी तरसी थयेली अने भांभरती मुंज  
घासना गाढ वनमां पेसी गई.<sup>२</sup> श्रीकृष्ण तथा बणभद्रादिक गोवाणो पशुओंने

तृणैस्तत्खुरदच्छिन्नैर्गोप्यदैरङ्गतैर्गवाम् । मार्गमन्वगमन् सर्वे नष्टाजीव्या विचेतसः ॥४  
मुज्जाटव्यां भ्रष्टमार्गं क्रन्दमानं स्वगोधनम् । सम्प्राप्य तृषिताः श्रान्तास्ततस्ते संन्यवर्तयन् ५  
ता आहूता भगवता मेघगम्भीरया गिरा । स्वनामां निनदं श्रुत्वा प्रतिनेदुः प्रहर्षिताः ॥६॥

ततः समन्नाद् वनधूमकेतुर्यदृच्छ्याभूत् क्षयकृद् वनौकसाम् ।

समीरितः सारथिनोल्बणोल्मुकैर्विलेलिहानः स्थिरजङ्गमान् महान् ॥७॥

तमापतन्तं परितो दवार्णिं गोपाश्च गावः प्रसमीक्ष्य भीताः ।

ऊचुश्च कृष्णं सबलं प्रपन्ना यथा हरिं मृत्युभयादिता जनाः ॥८

कृष्ण ! कृष्ण ! महावीर ! हे रामामितविक्रम ! । दावाग्निना दह्यमानान् प्रपन्नांस्त्रातुमर्हथः ॥९  
नूनं त्वद्वान्धवाः कृष्ण ! न चार्हन्त्यवसीदितुम् । वयं हि सर्वर्धमंज त्वन्नाथास्त्वत्परायणाः ॥१०

श्रीशुक उवाच -

वचो निशास्य कृपणं बन्धूनां भगवान् हरिः । निमीलयत मा भैष्ट लोचनानीत्यभाषत ॥११  
तथेति मीलिताक्षेषु भगवानग्निमुल्बणम् । पीत्वा मुखेन तान् कृच्छ्राद् योगाधीशो व्यमोचयत्  
ततश्च तेऽक्षीण्युम्भील्य पुनर्भाण्डीरमपिताः । निशास्य विस्मिता आसन्नात्मानं गाश्च मोचिताः १३

नहीं देखवाथी शोधवा लाग्या. पश गायो क्यां गई हती ऐ ज्ञाषवामां आव्युं  
नहीं.<sup>३</sup> ज्ञिकानुं साधन जतुं रहेतां मुंजाई गयेला गोवाणो गायोनी खरीओ  
अने मुखथी कपाएलां घासने निषाणता निषाणता ते गायोना रस्ते गया.<sup>४</sup> पछी  
थाकेला अने तरस्या थयेला गोवाणोने मुंजघासना वनमां भूलुं पडेलुं अने  
भांभरतुं गायोनुं धाण त्यांथी मञ्जुं, तेने पाइं वाणी भगवाने भेघनी समान  
गंभीर वाणीथी ज्यारे गायोने नाए कर्यो त्यारे गायो पश पोताना नामने ज्ञाणीने  
आनंदथी सामे नाए करवा लागी.<sup>५-६</sup> त्यां देव ईर्ष्याथी वनमां रहेनारने बाणनार  
अने वायुओ वधारेला भयंकर ज्वाणाओथी स्थावर जंगमनो नाश करतो मोटो  
दावानण चारे दिशाओथी लाग्यो.<sup>७</sup> चारे बाजुथी आवता ऐ दावानणने जोઈने  
गोवाणो अने गायो भय पाम्यां. पछी जेम संसारना भयथी पीडाएला लोको  
भगवाननी प्रार्थना करे, तेम सर्वे गोवाणो अने बणदेवज्ञ ऐ सहित श्रीकृष्णनी  
प्रार्थना करी के- हे कृष्ण ! हे परम पराक्रमवाणा ! हेराम ! दावानणथी बणता  
ऐवा अमो तमारे शरण आव्या छीओ. माटे अमारी रक्षा करो. कारण के शरणे  
आवेला ऐवा, अमारा नाथ अने परम शरणरूप तमे ज छो.<sup>८-९०</sup>

शुकदेवज्ञ कहे छे- बंधुओनुं आव्युं दीन वयन सांभणी भगवाने कह्युं के-  
“भयरहित थई आंभो मींथी ज्ञाओ” ऐटले तरत सर्वे गोवाणो आंभो मींथी

कृष्णस्य योगवीर्यं तद् योगमायानुभावितम् । दावाग्नेरात्मनः क्षेमं वीक्ष्य ते मेनिरेऽमरम् १४  
गाः सन्निवर्त्य सायाह्ने सहरामो जनार्दनः । वेणुं विरणयन् गोष्ठमगाद् गोपैरभिष्टुतः ॥१५  
गोपीनां परमानन्द आसीद्गोपिंददश्नने । क्षणं युगशतमिव यासां येन विनाभवत् ॥१६

इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्दे पूर्वर्थे

दावानिपानं नाम एकोनविंशोऽध्यायः ॥१९॥

### अथ विंशोऽध्यायः (२०)

श्रीशुक उवाच -

तयोस्तदद्भुतं कर्म दावाग्नेर्मोक्षमात्मनः । गोपाः स्त्री॒श्यः समाचर्ख्युः प्रलम्बवधमेव च ॥१  
गोपवृद्धाश्च गोप्यश्च तदुपाकर्ण्य विस्मिताः । मेनिरे देवप्रवरौ कृष्णरामौ व्रजं गतौ ॥२  
ततः प्रावर्ततं प्रावृद् सर्वसत्त्वसमुद्भवा । विद्योतमानपरिधिर्विस्फूर्जितनभस्तला ॥३

जतां, योगेश्वरं भगवानं पोताना मुखवडे दावानणे पी गया अने सर्वने  
कष्टमांथी मुकाव्या.<sup>११-१२</sup> पछी सर्वे गोवाणो आंभो उघाडीने जुवेछे त्यां  
भांडीरवडनी नज्जुक पोताने अने गायोने दावानणी मुकायेला ज्ञेई विस्मय  
पाभ्या.<sup>१३</sup> पोतानी दावानणी रक्षा करनार भगवाननुं योगबण ज्ञेईने ते  
गोवाणो भगवानने देव भानवा लाग्या.<sup>१४</sup> गायोने पाई वाणीने गोवाणो द्वारा  
स्तुति कराता बणभद्र सहित भगवानं सायंकाणे वेणु वगाडता गोकुणमां  
पधार्या.<sup>१५</sup> जे गोपीओने भगवानं विना एक क्षणं युग जेवो जतो हतो ते  
गोपीओने भगवाननां दर्शनीय परम आनंद थयो.<sup>१६</sup>

इति श्रीमद् महापुराणा भागवतना दशम स्कन्दनो अोगाणीशमो अद्याय  
संपूर्णः.

### अद्याय २०

वर्षांक्रस्तु तथा शरदक्रस्तुनुं प्राकृतिक वार्षिनि.

शुकदेवज्ञ कહे छे- गोवाणो ए ब्रजमां ज्ञैने पोताने दावानणी मुकावारूप  
अने प्रलंभासुरनो नाश करवारूप बने भाईओनुं अद्भुत पराक्रम पोतानी  
स्त्रीओ पासे कह्युं.<sup>१</sup> वृद्ध गोवाणो अने गोपीओ ए वात सांभणी विस्मय पाभ्यां,  
अने “भगवान् श्रीकृष्ण तथा राम ए कोई ब्रजमां मोटा देव आव्या छे” ऐम

सान्द्रलीलाम्बुदैव्योम सविद्युत्सनयितुभिः । अस्पृष्टज्योतिराच्छन्नं ब्रह्मेव सगुणं बभौ ॥४  
अष्टौ मासान् निपीतं यद् भूम्याश्वोदमयं वसु । स्वगोभिर्मोक्षमारेभे पर्जन्यः काल आगते ॥५  
तडित्वन्तो महामेघाश्वाण्डश्वसनवेपिताः । प्रीणनं जीवनं ह्यस्य मुमुक्षुः करुणा इव ॥६  
तपःकृशा देवमीढा आसीद् वर्षीयसी मही । यथैव काम्यतपसस्तनुः सम्प्राप्य तत्कलम् ॥७  
निशामुखेषु खद्योतास्तमासा भान्ति न ग्रहाः । यथा पापेन पाखण्डा न हि वेदाः कलौ युगे ॥८  
श्रुत्वा पर्जन्यनिनदं मण्डूका व्यसृजन् गिरः । तूष्णी शयानाः प्राग् यद्वद् ब्राह्मणा नियमात्यये ॥९  
आसन्नत्यथवाहिन्यं क्षुद्रनद्योऽनशुष्टितीः । पुंसो यथा स्वतन्त्रस्य देहद्रविणसम्पदः ॥१०  
हरिता हरिभिः शष्यैरिन्द्रगोपैश्च लोहिताः । उच्छ्वलीन्धकृतच्छाया नृणां श्रीरिव भूरभूत् ॥११

मानवा लाग्यां.<sup>२</sup> पछी सर्व प्राणीओने उत्पत्ति अने ज्ञवन आपनारी वर्षांक्रतु  
आवी, सूर्य अने चंद्रमाने कुंडाणां थवा लाग्यां, अने वीजणीओ वडे दिशाओ  
प्रकाशवा लागी, आकाशमां अवाजो थवा लाग्या.<sup>३</sup> वीजणी साथे गडगडाट करतां  
अति काणां अने घाटां वाढणोथी आकाश ढंकाई गयुं. अने आकाशमां ज्योति  
मंडणो पण अस्पष्ट जङ्गावा लाग्या.<sup>४</sup> राजा जेवी रीते प्रजा पासेथी धन लर्हने  
समय पर पाइं आपेछे, तेम सूर्य पण आठ महिना सुधी पृथ्वीनुं जणरूप धन,  
के जे पोते पोतानां किरणोद्धारा लीधुं हतुं तेने समय आवतां पाइं आपवा लाग्या.<sup>५</sup>  
दयाणु पुरुषो जेम हुः भीजनने ज्ञेईने तेने सुभी करवा दयाथी ध्रूज्जने पोतानुं  
ज्ञवन पण मूकी हे, तेम मोटा मेध वीजणीरूप नेत्रथी जगतने तपेलुं ज्ञेई, भारे  
पवनथी ध्रूज्जने जणरूप ज्ञवन मूकवा लाग्या.<sup>६</sup> जेम सकाम तप करनारानुं शरीर  
प्रथम तपथी दुबणुं थर्हने पछी तपनुं फळ पामीने पुष्ट थाय, तेम पृथ्वी के जे  
श्रीधर्म ऋतुथी दुबणी थर्ह हती, ते पण पाई मेधनुं जण मणवाथी पुष्ट थर्ह.<sup>७</sup>  
जेम क्लीयुगमां पापने लीधे पाखंडमार्ग प्रकाशो पण वेदमार्ग प्रकाशो नहीं, तेम  
प्रदोषकाणमां अंधाराने लीधे पतंगीयां प्रकाशवा लाग्यां अने ग्रहो ढंकायेला  
रह्या.<sup>८</sup> जेम गुरुनुं नित्य कर्म चालतुं होय त्यारे गुरु पासे अध्ययन करवा माटे  
आवेला शिष्यो गुरुने नित्य कर्ममां विधन न थाय ए हेतुथी प्रथम मौन बेठेला  
होय अने पछी गुरुनुं नित्य कर्म समाप्त थतां “अध्ययन माटे आवो” आवो  
गुरुनो शब्द सांभणीने शिष्यो गुरुनी समीपे ज्ञैने वेदनुं उच्चारण करवा लागे  
छे. तेम मेघनो शब्द सांभणी देडकां झाँ झाँ शब्द करवा लाग्यां.<sup>९</sup> जेम अजितेन्द्रिय  
पुरुषनुं शरीर, धन अने दोलत सर्व अवणे मार्गं जाय छे, तेम उनाणामां सुकाती  
नानी नानी नदीओ वर्षांक्रतुमां जण मणतां ज आडी अवणी वडेवा मांडी.<sup>१०</sup>

क्षेत्राणि सस्यसम्पद्दिः कर्षकाणां मुदं ददुः । धनिनामुपतापं च दैवाधीनमजानताम् ॥१२  
जलस्थलौकसः सर्वे नववारिनिषेवया । अविभ्रद् रुचिरं रूपं यथा हरिनिषेवया ॥१३  
सरिद्दिः सङ्गतः सन्धुशुक्षुभे श्वसनोर्मिमान् । अपक्रयोगिनश्चितं कामाक्तं गुणयुग्यं यथा ॥१४  
गिरयो वर्षधाराभिर्हन्यमाना न विव्यथुः । अभिभूयमाना व्यसनैर्यथाधोक्षचेतसः ॥१५  
मार्गा बूबूः सन्दिग्धास्तृपौष्टिक्षन्ना ह्रसंस्कृताः । नाभ्यस्यमानाः श्रुतयो द्विजैः कालहता इव ॥१६  
लोकबन्धुषु मेघेषु विद्युतश्वलसौहृदाः । स्थैर्यं न चक्रु कामिन्यः पुरुषेषु गुणिष्विव ॥१७  
धनुर्वियति माहेद्रं निर्गुणं च गुणिन्यभात् । व्यक्ते गुणव्यतिकरे उगुणवान् पुरुषो यथा ॥१८  
न रराजोङ्गुणश्छन्नः स्वज्योत्स्वाराजितैर्घनैः । अहंमत्या भासितया स्वभासा पुरुषो यथा ॥१९  
मेघागमोत्सवा हृष्णः प्रत्यनन्दित्तिष्ठिखण्डिनः । गृहेषु तसा निर्विणा यथाच्युतजनागमे ॥२०

जेम राजाओनी सैन्यं संपत्ति, रंगभेरंगी धज्ञा पताकाओने लीधे, रंग भेरंगी  
अने ऊंचां करेलां छत्रोनी छायावाणी जाणाय छे, तेम लीला धासथी हरियाणी  
अने ईन्द्र गोप नामना लाल छवडाओने लीधे राता रंगवाणी तथा ज्यां त्यां  
उगेली बिलाईओनी छत्राकार टोपीओथी पृथ्वी छायावाणी थई गई.<sup>११</sup>  
भेतरमां धान्यनी समृद्धि जोई खेडूतो आनंद मङ्ग थया अने लाभ थवो देवने  
आधीन छे, ऐम न जाणता धान्य संग्रह करवावाणा व्यापारी हुःभी थया.<sup>१२</sup>  
जेम भगवाननो भक्त भगवाननी सेवा करी सुंदर स्वरूपने प्राम थाय, तेम  
जगन्नथणमां रहेवावाणां सर्व जगयर प्राणीओ नवीन जग्नथी तथा वनथी सुंदर  
स्वरूपने प्राम थयां.<sup>१३</sup> जेम काचा योगीनुं वासनावाणुं चित विषयोथी जोडाईने  
क्षोभ पामे, तेम पवनथी उठता तरंगोवाणो समुद्र नदीओथी जोडाईने क्षोभ  
पामवा लाग्यो.<sup>१४</sup> जेम भगवानमां चित राखनारा भक्तलोको हुःभो पडवाथी  
पण व्यथा न पामे, तेम पर्वतो वरसाईनी धाराओ पडवाथी पण व्यथा पामता न  
हता.<sup>१५</sup> ख्रात्मणोओ अभ्यास करवामां नहीं आवता अने समय ज्तां भूली  
जवायेला वेदो जेम संहित्य थई ज्याय, तेम लोकोना गमनागमन विनाना थयेला  
अने धासथी ढंकाएला भागों संहित्य थई गया.<sup>१६</sup> जेम क्षणिक स्नेहवाणी  
व्यभिचारिणी स्त्रीओ गुणवान पुरुषमां स्थिरता न धरे, तेम यपण वीजणीओ  
सर्वे लोकोना बंधुरूप मेघोमां स्थिरता पकडती न हती.<sup>१७</sup> जेम गुणोना  
परिणामरूप देहने विषे त्रष्ण गुणोथी रहित ज्व शोभे, तेम शब्द जेनो गुण छे  
ऐवा आकाशमां गुण (दोरी) वगरनुं ईंद्रधनुष शोभवा लाग्युं.<sup>१८</sup> जेम आत्मा  
पोताना ज धर्मभूत ज्ञानवडे प्रकाशित देहात्मभ्रान्तिने लीधे देहथी पृथक प्रकाशतो

पीत्वापः पादपाः पद्मिरासन्नानात्मरूप्यः । प्राक् क्षामास्तपसा श्रान्ता यथा कामानुसेवया ॥२१  
सरस्वशान्तरोधस्मु न्यूषुरङ्गापि सारसाः । गृहेष्वशान्तकृत्येषु ग्राम्या इव दुराशयाः ॥२२  
जलौघैर्निरभिद्यन्त सेतवो वर्षतीश्वरे । पाखणिडनामसद्वादैर्वेदमार्गाः कलौ यथा ॥२३  
व्यमुञ्चन् वायुभिर्नुन्ना भूतेभ्योऽथामृतं घनाः । यथाऽशिषो विश्पतयः काले काले द्विजेरिताः  
एवं वनं तद् वर्षिष्ठं पक्षखर्जरजम्बुमत् । गोगोपालैवृतो रन्तुं सबलः प्राविशद्वरिः ॥२५॥  
धेनवो मन्दगामिन्य ऊधोभारेण भूयसा । ययुर्भगवताऽऽहृता द्रुतं प्रीत्या स्नुतस्तनीः ॥२६॥  
वनौकसः प्रमुदिता वनराजीर्मधुच्युतः । जलधारा गिरेनादानासन्ना ददृशे गुहाः ॥२७॥  
क्षचिद् वनस्यतिक्रोडे गुहायां चाभिवर्षति । निर्विश्य भगवान् रेमे कन्दमूलफलाशनः ॥२८

नथी. तेम चंद्र पोताना ज प्रकाशथी प्रकाशित ऐवा भेघोथी ढंकाईने भेघोथी  
विलक्षणा पणे शोभतो नथी.<sup>१९</sup> जेम धरमां संताप पामेला विरक्त पुरुषो  
वैष्णवज्ञनना समागमथी राज्ञ थईने, तेओने वाणीथी अभिनंदन आपे, तेम  
गरभीथी तपेला भयूरो भेघ आववाना उत्सवथी राज्ञ थईने भेघोने टहुकाथी  
अभिनंदन आपवा लाग्या.<sup>२०</sup> जेम प्रथम तप करवाथी दुबणा थयेला अने थाकी  
गयेला पुरुषो संसारना विषय सुख भोगववाथी प्रकुल्लित थाय, तेम उनाणाथी  
दुर्बल थयेलां वृक्षो पोतानां भूणवते पाणी पीवाथी प्रकुल्लित थयां.<sup>२१</sup> जेके धर  
अनेक प्रकारना कर्तव्यनी पीडाथी भरेलां छे, तोपण तेमां विषयनी ईच्छावाणा  
पामर पुरुषो जेम वसे छे, तेम तणावो जेके क्रीयड अने कांटा भरेला कांटाओवाणां  
हतां, तोपण तेओमां सारस पक्षीओ रहेवा लाग्यां.<sup>२२</sup> जेम कणियुगमां  
पांडियोना नीय वादोथी वेदभार्ग तूटी ज्याय, तेम भेघ वरसता पाणीना प्रवाहोथी  
सेतुओ तूटी गया.<sup>२३</sup> जेम राजाओ समये समये पुरोहितोनी प्रेरणाथी लोकोने  
सुख आपे, तेम वादणां वायुओनी प्रेरणाथी प्राणीओने अमृत सरभुं जग आपवा  
लाग्यां.<sup>२४</sup> आवा समृद्धिवाणा ते वनमां विष्णार करवाने भाटे गायो अने  
गोवाणोथी वीटायेला श्रीकृष्ण अने बलराम पधार्या.<sup>२५</sup> ते समये मोटा आउना  
भारथी जेके गायो मंद मंद चालती हती, छतां पण भगवानना बोलाववाने  
लीधे दूध झरती उतावणी चालवा लागी.<sup>२६</sup> भगवाने ज्यारे वृन्दावनमां प्रवेश  
कर्यो त्यारे ए वनमां वनवासीओने अत्यंत हर्ष पामेलां भगवाने जोयां, वृक्षनी  
पंकितओने मदजरती जोई, पर्वतोमांथी वहेती जलधाराओ जोई, तथा  
जलधाराओनी सभीपे रहेली गुफाओने जोई.<sup>२७</sup> कोई समये वरसाद वरसतां

दध्योदनं समानीतं शिलायां सलिलान्तिके । सम्भोजनीर्यैर्बुभुजे गोपैः सङ्कर्षणान्वितः ॥२९॥  
शाद्वलोपरि संविश्य चर्वतो मीलितेक्षणान् । तृष्णान् वृषान् वत्सतरान् गाश्च स्वोधोभरश्रमाः ॥३०  
प्रावृद्धश्रियं च तां वीक्ष्य सर्वभूतमुदावहाम् । भगवान् पूजयाञ्छ्रक्रे आत्मशक्त्युपबृहिताम् ॥३१  
एवं निवसतोस्तस्मिन् रामकेशवयोर्वर्जे । शरत् समभवद् व्यभा स्वच्छाम्बवपरुषानिला ॥३२  
शरदा नीरजोत्पत्त्या नीराणि प्रकृतिं ययुः । भ्रष्टानामिव चेतांसि पुनर्योगनिषेवया ॥३३  
व्योम्नोऽवं भूतशाबल्यं भुवः पङ्कमपां मलम् । शरज्जहाराश्रमिणां कृष्णे भक्तिर्यथाशुभम् ॥३४  
सर्वस्वं जलदा हित्वा विरेजुः शुभ्रवर्चसः । यथा त्यक्तैषणाः शान्ता मुनयो मुक्तकिल्बिषाः ॥३५  
जाइना कोतरमां अने गुफामां पेसीने भगवान् रमता हता अने कुंदभूषण तथा  
इण जमता हता.<sup>२८</sup> बण्डेवज्ज सहित श्रीकृष्ण भगवान् जमाइवा योऽय  
गोवाणोनी साथे पाणीने कांठे शिला पर बेसीने घेरथी आणेलां दृष्टिभातने जमता  
हता.<sup>२९</sup> तृप्त थर्थने लीला धासवाणी पृथ्वी उपर बेसी आंघो भीयीने ओगाणता  
बणहो, वाढरडां अने आउना भारथी थाकी रहेली गायोने जोईने, भगवाने  
पोतानी शक्तिथी वृद्धि पमाडेली अने सर्व प्राणीओने सुख देनारी वर्षांतुनी  
शोभाने वभाषाता हता.<sup>३०-३१</sup> आ प्रमाणे श्रीकृष्ण अने बणराम ज्यारे व्रजमां  
रहेता त्यारे वर्षांतु गई अने शरद ऋतु आवी, वाढणांनो धमधोर मटी गयो,  
जण स्वर्च्छ थर्थ गयां अने पवननी कठोरता मटी गई.<sup>३२</sup> जेम योगमांथी भष्ट  
थयेलाओनां चित पाढां योगानुं सेवन करवाथी स्वर्च्छ थाय, तेम पाणी कमणोने  
उत्पत्त करनारी शरदऋतुथी पाढां स्वर्च्छ थयां.<sup>३३</sup> जेम भगवानने विषे भक्ति  
छे ए भ्रम्यारीना गृहस्थनी स्पृहारूप अशुभने हरे छे, तेम शरदऋतुअे  
आकाशानां वाढणांने हरी लीधां, जेम गृहस्थने जो भगवानमां भक्ति उद्य  
थाय तो वैराग्यनी उत्पत्तिद्वारा पुत्रादिक्नी संकडामाणने हरे छे. (केमके भक्तने  
ऐकांत वासमां रुचि उत्पत्त थाय छे.) तेम शरदऋतुअे, जे प्राणीओ वरसाईनी  
बीकथी ऐकठा थर्थने सांकडमां भराई रहेतां हतां, तेमनी सांकडने हरी लीधी.  
जेम वानप्रस्थने क्यारेक असमर्थपणाने लीधे पोताना आश्रमने योग्य कर्म न  
थर्थ शक्वाथी लागेला प्रत्यवाय दोषने भगवाननी भक्ति हरी ले छे. तेम  
शरदऋतुअे पृथ्वीना क्राद्वने हरी लीधो. जेम भगवानना भक्त, कर्मकणो  
त्याग करी देनारा संन्यासीओना मोक्षमां प्रतिबन्धक पुण्यपापरूप अशुभने  
हरी ले छे. तेम शरदऋतुअे जणनो मेल हरी लीधो.<sup>३४</sup> जेम शांत मुनिलोको  
तृष्णानो त्याग करी स्वर्च्छ थर्थ शोभा आपे छे, तेम पोतानुं सर्वस्व छोडी वाढणां

गिरयो मुमुचुस्तोयं क्वचिन्न मुमुचुः शिवम् । यथा ज्ञानामृतं काले ज्ञानिनो ददते न वा ॥३६  
नैवाविदन् क्षीयमाणं जलं गाधजलेचरा: । यथाऽऽयुरन्वहं क्षयं नरा मूढाः कुटुम्बिनः ॥३७  
गाधवारिचरास्तापमविन्दञ्चर्दक्जम् । यथा दरिद्रः कृपणः कुटुम्बविजितेन्द्रियः ॥३८  
शनैः शनैर्जहुः पङ्कं स्थलान्यामं च वीरुधः । यथाहममतां धीराः शरीरादिष्वनात्मसु ॥३९  
निश्चलाम्बुरभूत्तर्ष्णी समुद्रः शरदागमे । आत्मन्युपरते सम्यङ्मुनिव्युपरतागमः ॥४०  
केदारेभ्यस्त्वपोऽगृह्णन् कर्षका दृढसेतुभिः । यथा प्राणैः स्वज्ञानं तन्निरोधेन योगिनः ॥४१  
शरदर्काशुजांस्तापान् भूतानामुदुपोऽहरत् । देहाभिमानजं बोधो मुकुन्दो व्रजयोषिताम् ॥४२  
खमशोभत निर्मेधं शरद्विमलतारकम् । सत्त्वयुक्तं यथा चित्तं शब्दब्रह्मार्थदर्शनम् ॥४३  
अखण्डमण्डलो व्योग्नि रराजोऽुगणैः शशी । यथा यदुपतिः कृष्णो वृष्णिचक्रावृते भुवि ॥४४

थेत थर्थ शोभा देवा लाग्यां.<sup>३५</sup> जेम शानी लोको पोतानुं शानरूप अमृत कोई  
सेवा करनारा अधिकारी शिष्यने समये समये आपे छे. अने कोई अनविकारीने  
नथी आपता. तेम पर्वत पोतानुं निर्भण जण क्यांक वर्षावता हता, अने कोई  
स्थणे वर्षावता न हता.<sup>३६</sup> जेम कुटुंबी मूर्ख पुरुष पोतानी नित्य क्षीण थती  
आयुष्यने ज्ञानो नथी, तेम थोडां पाणीमां रहेवावाणां जणजंतु क्षीण थतां जणने  
ज्ञानां न हतां.<sup>३७</sup> जेम अजितेन्द्रिय कुटुंबी पुरुष दरिद्री अने कृपण थर्थने भूभथी  
थयेला तापने पामे छे. तेम थोडा जणमां रहेवावाणां जंतु शरदना सूर्यनो ताप  
पामवा लाग्यां.<sup>३८</sup> जेम धीर पुरुष धीरे धीरे आत्माथी भित्र शरीरादि पदार्थोमांथी  
अहंता छोडी दे छे, तेम लताओ धीरे धीरे काचापणानो त्याग करवा लागी. अने  
जेम अनात्म पदार्थोमांथी धीरे धीरे भमता छोडे छे, तेम स्थल प्रदेशो क्राद्वनो  
त्याग करवा लाग्या.<sup>३९</sup> जेम अंतःकरण शांत थतां मुनि वेदधोषने छोडी चूप थर्थ  
ज्ञाय छे, तेम शरदऋतु आववाथी समुद्र निश्चण जणवाणो थर्थ पोतानो धोष  
छोडी चूप थर्थ गयो.<sup>४०</sup> जेम योगीलोको ईन्द्रियरूप द्वारथी भवी जता शानने  
ईन्द्रियोनो रोध करी पकडी राखे छे, तेम शरदऋतु आवतां खेडूतो डांगर वगेरेना  
क्याराओमांथी वही जतां पाणीने मज्जभूत बंध बांधीने अटकाववा मांड्या.<sup>४१</sup>  
जेम आत्मज्ञान देहाभिमानना तापने हरे छे, अने भगवान् व्रजनी स्त्रीओना  
तापने हरे छे, तेम यंद्रमाए शरदना सूर्यना किरणो संबंधी छवोना तापने हरवा  
मांड्यो.<sup>४२</sup> जेम रजोगुण तमोगुण रहित शुद्ध सत्वगुण युक्त अने वेदार्थने  
भताववावाणुं चित शोभित थाय, तेम मेघ रहित शरदना निर्भण तारागणाना  
प्रकाशवाणुं आकाश शोभवा लाग्युं.<sup>४३</sup> जेम यदुपति श्रीकृष्ण भूमि उपर याद्व

આશિલાષ્ય સમશીતોષ્ણાં પ્રસૂનવનમારુતમ् । જનાસ્તાપં જહુરોષ્યો ન કૃષ્ણાહૃતચેતસ: ॥૪૫  
ગાવો મૃગાઃ ખગા નાર્યઃ પુષ્પિણયઃ શરવાભવન् । અન્વીયમાનાઃ સ્વવૃષૈઃ ફલैરીશક્રિયા ઇવ ॥૪૬  
ઉદ્વદ્ધન્ વારિજાનિ સૂર્યોથાને કુમુદ્ વિના । રાજા તુ નિર્ભયા લોકા યથા દસ્યુન્ વિના નૃપ! ॥૪૭  
પુરગ્રામેષ્વાગ્રયણૌન્દ્રિયૈશ્ મહોત્સવૈ: । બભૌ ભૂ: પક્ષસસ્યાદ્વા કલાભ્યાં નિતરાં હ્રે: ॥૪૮  
વણિદ્ભુનિનૃપસ્નાતા નિર્ગમ્યાર્થાન્ પ્રપેદિરે । વર્ષરુદ્વા યથા સિદ્ધા: સ્વર્પિંડાન્ કાલ આગતે ॥૪૯

ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્દે પૂર્વર્થી

પ્રાવૃત્તશરદ્વર્ણનં નામ વિંશોડધ્યાય: ॥૨૦॥

મંડળથી વીંટાઈને શોભા આપે, તેમ ચંદ્ર સંપૂર્ણ તારામંડળથી વીંટાઈને આકાશમાં  
શોભવા લાગ્યો.<sup>૪૪</sup> શરદ્ધતુ આવતાં પુષ્પવનમાં સમશીતોષ્ણ પવનનું આદિંગન  
કરવાથી સર્વ લોકોનો તાપ મટી જતો હતો, પરંતુ ભગવાને જેઓનું ચિત્ત હરી  
લીધું હતું, એવી ગોપીઓનો તાપ મટતો ન હતો.<sup>૪૫</sup> ગાયો, મૃગલીઓ, પક્ષિશીઓ  
અને સ્ત્રીઓની પછિવાડે શરદ્ધતુના પ્રભાવને લીધે તેઓની ઈચ્છા વગર પણ તે  
તે જાતિના પતિ પુરુષો દોડતા હતા, તેથી તેઓ ઈશ્વરના આરાધનની કિયાઓ  
જેમ આરાધનના કરનારની ઈચ્છા વગર પણ ફળવાળી થાય, તેમ ગર્ભવાળી  
થવા લાગી.<sup>૪૬</sup> હે રાજા! જેમ ચોર વિના બીજા સર્વ લોકો રાજાના ઉદ્યથી નિર્ભય  
થાય, તેમ ચંદ્રવિકાસી કુમુદ વિના બીજાં સર્વે કમળો સૂર્યના ઉદ્યથી પ્રરુદ્ધિત  
થવા લાગ્યાં.<sup>૪૭</sup> પાકેલાં ધાન્યોની સમૃદ્ધિવાળી પૃથ્વી નગરોમાં અને ગામોમાં નવીન  
અસ ખાવાના વૈદિક યજોથી અને ઈંદ્રિયોનેસુખ આપનારા લૌકિક ઉત્સવોથી  
પણ શોભવા લાગી, અને તેમાં શ્રીકૃષ્ણ અને બલરામના વિહારને લીધે તો બહુ  
જ શોભતી હતી.<sup>૪૮</sup> જેમ મંત્ર અને યોગાદિકથી સિદ્ધ થયેલા પુરુષો આયુષ્યના  
બંધનથી મનુષ્ય દેહમાં રોકાઈ રહ્યા હોય છતાં, તેઓ સમય આવતાં આ દેહમાંથી  
નીકળી બીજા દેહને પામી પોતપોતાના તપથી સાધ્ય ભોગોને પામે, અથવા મોક્ષને  
પણ પામે છે. તેમ વરસાદથી રોકાશેલા વેપારી, સંન્યાસી, રાજા અને  
બ્રહ્મચારીઓ શરદ્ધતુમાં છૂટથી નીકળીને પોતપોતાના અર્થોને પામ્યા.  
(વેપારીઓ વ્યપાર કરવા લાગ્યા, સંન્યાસીઓ સ્વેચ્છાથી ફરવા લાગ્યા, રાજાઓ  
દિજિવજય કરવા નીકળ્યા અને બ્રહ્મચારીઓ વિદ્યાધ્યયન કરવા લાગ્યા.)<sup>૪૯</sup>  
ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંદના વીશભો અદ્યાય સંપૂર્ણ.

અથેકવિંશોડધ્યાય: (૨૯)

શ્રીશુક ઉવાચ

ઇતથી શારત્વચ્છજલં પદ્માકરસુગંધિના । ન્યવિશ્વાદ્વાયુના વાતં સગોગોપાલકોડચ્યુત: ॥૧

કુસુમિતવનરાજિશુષ્પિભૃજદ્વિજકુલઘુષ્ટમાર: સરિન્મહીધ્રમ.

મધુપતિરવગાદ્વા ચારયન્ ગા: સહપશુપાલબલશ્વકૂજ વેણુમ् ॥૨॥

તદ્વજસ્ત્રિય આશ્રુત્વ વેણુગીતં સ્મરોદયમ् । કાશ્શ્ત્રપરોક્ષં કૃષ્ણસ્ય સ્વસર્ખીભ્યોડચ્વવર્ણયન્ ૩

તદ્વર્ણયિતુમારબ્ધા: સ્મરન્યઃ કૃષ્ણચેષ્ટિતમ् । નાશકન્ સ્મરવેગેન વિક્ષિસમનસો નૃપ! ॥૪

બહીપીડં નટવરવપુ: કર્ણયો: કર્ણિકારં બિશ્વદ્ વાસ: કનકકપિણં વૈજયન્તી ચ માલામ् ।

અદ્યાય ૨૧

ગોપીઓ દ્વારા થયેલું શ્રીકૃષ્ણાના વેણુનાદનું વાર્ણિન.

શુકદેવજી કહે છે- આવી રીતે વૃંદાવન શરદ્ધતુને લીધે સ્વર્ણ જળવાણું  
અને કમળોના સમૂહથી સુગંધીમાન વાયુથી વ્યામ હતું આવાં વૃંદાવનમાં ગાયો  
અને ગોવાળોની સાથે ભગવાન પધાર્યા.<sup>૧</sup> ખીલેલાં પુષ્પોથી યુક્ત વૃક્ષોની ઘટાઓમાં  
મદોન્મત ભમરાઓ અને પક્ષીઓથી શબ્દાયમાન થયેલાં સરોવરો, નદીઓ અને  
પર્વતોથી વ્યામ એવા વૃંદાવનમાં પ્રવેશ કરીને ભગવાન શ્રીકૃષ્ણ ગોપબાળકોની  
સાથે તથા બળદેવજીની સાથે ગાયો ચારતાં વાંસળી વગાડવા લાગ્યા.<sup>૨</sup> કેટલીક  
પ્રજની સ્ત્રીઓ કામદેવને ઉત્પત્ત કરનાર વેણુનાદ સાંભળીને પોતાની સખીઓ  
પાસે શ્રીકૃષ્ણનું વર્ણન કરવા લાગી.<sup>૩</sup> લીલાનું સ્મરણ કરતી ગોપીઓએ વર્ણન  
કરવા માંડયું પણ કામદેવના વેગથી મન વ્યાકુળ થઈ જતાં વર્ણન થઈ ન શક્યું.<sup>૪</sup>

મસ્તકમાં મોરપીઠનો મુગટ, કાનમાં કર્ણિકારનાં ઝૂલ, શરીરપર સોના  
જેવું પીણું વસ્ત્ર અને કંઠમાં વૈજયન્તીમાળાને ધારણ કરતા, નટનીપેઠે શોભતા,  
ઉત્તમ શરીરવાળા, પોતાના નીચલા હોઠના અમૃતથી વેણુના છિદ્રને પૂરતા, અને  
ગોવાળો જેમના યશનું ગાયન કરતા હતા, એવા ભગવાન પોતાના ચરણ ચિહ્નોથી  
રમણીય એવા વૃંદાવનમાં પધાર્યા, અને ત્યાં બંસીનાદ ગજાવ્યો.<sup>૫</sup> હે રાજા! આ  
પ્રમાણો સર્વ પ્રાણીઓના મનને હરનાર વેણુનાદ સાંભળીને કામાતુર થઈ જતાં  
પણ વર્ણન કરવા લાગેલી સર્વ ગોપીઓ વર્ણન કરતાં કરતાં પદેપદે મનથી  
ભગવાનનું આદિંગન કરતી હતી.<sup>૬</sup> હે સખીઓ! મિત્રોની સાથે પશુઓને વનમાં  
લઈ જતા બલરામ અને શ્રીકૃષ્ણનું વેણુ વગાડતું અને સ્નેહ ભર્યા કટાક્ષને મૂક્તનું

રન્ધ્રાન् વેણોરધરસુધ્યા પૂર્યન् ગોપવૃદ્ધેવૃન્દારણયં સ્વપદરમણં પ્રાવિશદ् ગીતકીર્તિઃ ॥૫  
ઇતિ વેણુરવં રાજન! સર્વભૂતમનોહરમ् । શ્રુત્વા વ્રજસ્ત્રિયઃ સર્વા વર્ણયન્યોગભિરેભિરે ॥૬

ગોપ્ય ઊચુઃ -

અક્ષેપવતાં ફલમિદં ન પરં વિદામઃ સખ્યઃ પશૂનુનુ વિવેશયતોર્વયસ્યૈ: ।  
વક્ત્રં વજેશસુત્યોરનુવેણ જુણું યૈર્વા નિપીતમનુરક્તકટાક્ષમોક્ષમ् ॥૭॥  
ચૂતપ્રવાલબર્હસ્તબકોત્પલાબ્જમાલાનુપૃક્તપરિધાનવિચિત્રવેષૌ ।  
મધ્યે વિરેજતુરલં પશુપાલગોછ્યાં રઙ્ગે યથા નટવરૌ ક્રચ ગાયમાનૌ ॥૮॥  
ગોપ્યઃ કિમાચરદ્વયં કુશલં સ્મ વેણુર્દમોદરાધરસુધ્યામણિ ગોપિકાનામ ।  
ભુડ્કે સ્વયં યદવશિષ્ટસં હૃદિન્યો હૃષ્યત્વચોઽશ્રુ મુમુચુસ્તરવો યથાઽર્યા: ॥૯॥  
વૃન્દાવનં સખિ ભુવો વિતનોતિ કીર્તિ યદ્દ દેવકીસુતપદામ્બુજલબ્ધલક્ષ્મિ ।  
ગોવિન્દવેણુમનુ મત્તમયૂરનૃત્યં પ્રેક્ષ્યાદ્રિસાન્વપરતાન્યસમસ્તસત્ત્વમ् ॥૧૦॥

મુખારવિંદ જેમણે જોયું તેઓને જ નેત્રનું ફળ મળ્યું, એ વિના નેત્રવાળાઓને  
પોતાના નેત્રનું બીજું કંઈ ફળ અમો જાણતી નથી.<sup>૦</sup> બીજી ગોપી કહેવા લાગી કે,  
આંબાનાં ફુંપળો, મોર પીછે, ફૂલનાગુચ્છ અને કમળોની માળાઓને લીધે શોભતા  
નીલ અને પીત વસ્ત્રોથી વિચિત્ર વેષવાળા, બળદેવ અને શ્રીકૃષ્ણ કોઈ સમયે  
ગાયન કરતાં નાટકશાળામાં ઉત્તમ નટની પેઠે ગોવાળોની સભામાં બહુ જ શોભતા  
હતા.<sup>૧</sup> અહો ! ગોવાળોના પુણ્યની શી વાત ! હે ગોપીઓ ! ભગવાનના અધરનું  
અમૃત ગોપીઓને ભોગ્ય છે તોપણ તેને આ વેણુ પોતે એકલી જ સ્વતંત્રપણે થોડો  
જ રસ બાકી રહે એવી રીતે પીએ છે કે જે જોઈને તેને પોતાના જળથી ઉછેરનારી  
તેની મા જેવી નદીઓ ખીલી રહેલા કમળોના મિષથી રોમાંચિત થયેલી જણાય  
છે, અને જે વૃક્ષોના વંશમાં એ વેણુ ઉત્પત્ત થયો છે તેઓ, જેમ ભગવત્સેવકોને  
ઉત્પત્ત થયેલા જોઈ કુળના વૃદ્ધપુરુષો રોમાંચિત થઈને આનંદના અશ્રુ મૂકે, તેમ  
પ્રકુલ્લિત થઈને મકરંદની ધારાના મિષથી આંસુ મૂકે છે, માટે એ વેણુએ ક્યું  
પુણ્ય કર્યું હશે?<sup>૨</sup> હે સખી ! આ વૃંદાવન સ્વર્ગ કરતાં પણ અધિક પૃથ્વીની કીર્તિને  
વધારે છે. કેમ કે દેવકીના પુત્રનાં ચરણારવિંદ ફરવાથી તેને વધારે શોભા મળી  
છે અને આ વૃંદાવનમાં ભગવાનના વેણુ નાદને સાંભળીને તેને મંદ ગર્જનાવાળો  
નીલમેઘ માની મદોન્મત થયેલા મયૂરો નાચવા લાગી જાય છે, તે નાચને જોઈને  
પર્વતનાં શિખરોમાં બીજાં સર્વ પ્રાણીઓ પોતપોતાની કિયાઓ છોડી દે છે. માટે

ધ્યાઃ સ્મ મૂઢમત્યોગપિ હરિણ્ય એતા યા નન્દનન્દનમુપાત્તવિચિત્રવેષમ् ।  
આકર્ષય વેણુરણિતં સહકૃષ્ણસારા: પૂજાં દર્ધરૂપરચિતાં પ્રણયાવલોકે: ॥૧૧॥  
કૃષ્ણાં નિરીક્ષ્ય વનિતોત્સવરૂપશીલં શ્રુત્વા ચ તત્કાળિતવેણુવિચિત્રગીતમ् ।  
દેવ્યો વિમાનગતયઃ સ્મરનુપ્રસારા ભ્રષ્યત્પ્રસૂનકબરા મુમુર્વિનીવ્ય: ॥૧૨॥  
ગાવશ્ચ કૃષ્ણમુખનિર્ગતવેણુગીતપીયૂષમુત્તભિતકર્ણપુટૈ: પિબન્ત્ય: ।  
શાવા: સ્નુતસ્તનપયઃકવલા: સ્મ તસ્થુર્ગોવિન્દમાત્મનિ દૂશાશ્રુકલા: સ્પૃશન્ત્ય: ॥૧૩॥  
પ્રાયો બતામ્બ વિહગા મુનયો વનેઽસ્મિન્ કૃષ્ણોક્ષિતં તદુદિતં કલવેણુગીતમ્ ।  
આરુદ્ધ યે દ્રુમભુજાન્ રુચિરપ્રવાલાન્ શૃષ્ટવન્યમીલિતદૃશો વિગતાન્યવાચ: ॥૧૪॥

આવો આનંદ બીજા કોઈ લોકમાં નથી.<sup>૧૦</sup> હે સખી ! આ મૃગલીઓ મૂઢ બુદ્ધિવાળીછે  
છતાં પણ ધન્ય છે કે જે બંસીનાદને સાંભળી સ્નેહપૂર્વક દષ્ટિ કરીને વિચિત્ર  
વેષવાળા કૃષ્ણનું સન્માન કરે છે, અને તે પણ પોતાના પતિ કાળીયાર મૃગોની  
સમક્ષમાં કરે છે. (આપણા પતિ એવા ક્ષુદ્ર છે, કે આપણે તેની હાજરીમાં એમ  
કરીએ તો કદી સહન કરે નહીં).<sup>૧૧</sup> હે ગોપીઓ ! આશ્ર્વયની વાત સાંભળો. જેનાં  
રૂપ અને વેષ સ્ત્રીઓને આનંદ આપનાર છે, એવા કૃષ્ણને જોઈ તથા તેમણે વગાડેલ  
વિચિત્ર વેણુનું ગાયન સાંભળીને, વિમાનોમાં બેસીને જતી દેવાંગનાઓ પોતાના  
સ્વામીના ખોળામાં બેઠેલી છતાં પણ કામદેવથી વ્યાકુળ થઈને મોહ પામી જાય  
છે, તેના ચોટલામાંથી ફૂલ સરકી જાય છે, અને તેના ચણિયાનાં બંધનો ઢીલાં પડી  
જાય છે.<sup>૧૨</sup> ગાયો અને વાછરડાં ભગવાનના મુખમાંથી નીકળેલું વેણુગીતરૂપ  
અમૃતને કાનરૂપી પડીઆથી પીતાં પીતાં આંસુ આવી જવાથી પોતાની સર્વ કિયા  
ભૂલી જાય છે. ધાવતાં વાછરડાં વેણુના નાદ સાંભળી ધાવવું છોડી દે છે, એટલું  
જ નહીં પણ મોઢાંમાં જે ધાવણ આવ્યું હોય તેને પીધા વિના એમને એમ રાખી  
મૂકે છે, અને ગાયો પણ દષ્ટિ માર્ગવડે મનમાં ભગવાનનું આલિંગન કરવા લાગી  
જાય છે.<sup>૧૩</sup> હે મા ! આ વનમાં જે પક્ષીઓ છે તે મુનિઓ હોવા જોઈએ, કેમકે  
મુનિઓ જેમ વેદરૂપી વૃક્ષની શાખા ઉપર આધાર રાખીને ભગવાનનું જે રીતે  
દર્શન થાય, એ રીતે કામ્ય કર્મકૃષ્ણનો ત્યાગ કરીને ભગવાનમાં જ એક દષ્ટિ  
રાખી કરી, સભિયા થઈને ભગવાનનો મહિમા સાંભળે છે. તેમ આ પક્ષીઓ પણ  
સુંદર ફુંપળો વાળી વૃક્ષની શાખા ઉપર બેસી, પોતાને ભોગ્ય ફળાદિકનો ત્યાગ  
કરી, કેવળ ભગવાનનાં દર્શન થાય એવી રીતે પોતાની સર્વ શારીરિક યેષાઓ

નદ્યસ્તદા તદુપધાર્ય મુકુન્દગીતમાવર્તલક્ષિતમનોભવભગનવેગા: ।  
આલિઙ્ગનસ્થિગતમૂર્મિભૂજૈમુરરેર્ગ્લન્નિ પાદયુગલં કમલોપહારા: ॥૧૫॥  
દૃષ્ટાઽતપે વ્રજપશૂન્ સહ રામગોપૈ: સઞ્ચારયન્તમનુ વેણુમુદીરયન્તમ્ ।  
પ્રેમપ્રવૃદ્ધ ઉદિત: કુસુમાવલીભિ: સખ્યુર્વધાત્ સ્વવપુષામ્બુદ આતપત્રમ् ॥૧૬॥  
પૂર્ણા: પુલિન્દ્ય ઉરગાયપદાબ્જરાગ શ્રીકુઙ્કુમેન દયિતાસ્તનમણ્ડતેન ।  
તદર્શનસ્મરસ્તણસ્થિતિન લિમ્પન્ય આનન્કુચેષુ જહુસ્તદાધિમ् ॥૧૭॥  
હન્તાયમદ્રિબલા હરિદાસવર્યો યદ્ રામકૃષ્ણચરરણસ્પર્શપ્રમોદ: ।  
માનં તનોતિ સહગોગણયોસ્તયોર્યત પાનીયસૂયવસકદ્રકદ્રમૂલૈ: ॥૧૮॥  
ગા ગોપકૈરનુવનં નયતોરુદાર વેણુસ્વનૈ: કલપદૈસ્તનુભૃત્સુ સખ્ય: ।  
અસ્પન્દનં ગતિમાં પુલકસ્તર્ણાં નિર્યોગપાશકૃતલક્ષણયોર્વિચિત્રમ् ॥૧૯॥

છોડી દઈને ભગવાનના વેણું નાદને જ સાંભળે છે.<sup>૧૪</sup> આ સચેતન પ્રાણીઓની વાત તો ઢીક. પરંતુ નદીઓ પણ ભગવાનનો બંસીનાદ સાંભળીને જાણે પાણીમાં પડતી ભમરીઓરૂપી કામદેવને લીધે મંદવેગવાળી થઈ સ્થિર બની જાય છે. અને પોતાના તરંગોરૂપી હસ્તથી ભગવાનના ચરણમાં કમળ અર્પણ કરીને જાણે આલિંગન કરેછે.<sup>૧૫</sup> તડકામાં બળદેવ અને ગોવાળોની સાથે વ્રજના પશુઓને ચારતા અને વેણુનો નાદ કરતા પોતાના ભિત્ર ભગવાનને જોઈને મેઘ તેમના ઉપર પ્રેમથી વૃદ્ધિ પામી, ફૂલ જેવા પોતાના છાંટા નાખે છે, અને પોતાના શરીરથી છત્ર છાયા કરે છે.<sup>૧૬</sup> પ્રથમ લક્ષ્મીજીના સ્તન ઉપર લગાડેલું, અને પછી કીડા સમયે લક્ષ્મીજીએ પ્રેમને વશ થઈને ભગવાનના બસ્તે ચરણ પોતાના સ્તન ઉપર ધારણ કરેલાં હોવાથી, ભગવાનના ચરણમાં કુંકુમ લાગેલું હોય છે. પછી જ્યારે ભગવાન વનમાં વિચરણ કરતા હોય ત્યારે ધાસ ઉપર ચોટેલું અને સહજે લાલ ચરણ કમળની લાલાશથી અન્યાન્ય લાલ બનેલું કુંકુમને જોઈને કામના તાપથી પીડાયેલી ભીલડીઓ ધાસ ઉપર લાગેલા એ કુંકુમને પોતાના મુખ ઉપર તથા સ્તન ઉપર લગાવીને એ માનસિક તાપને દૂર કરે છે. માટે ભીલડીઓ પણ આપણા કરતાં અધિક ભાગયશાળી છે.<sup>૧૭</sup> હે સાખીઓ ! આ ગોવર્ધન પર્વત અવશ્ય ભગવાનનો કોઈ મોટો ભક્ત જણાય છે, કેમકે તેને બલરામ અને કૃષ્ણના ચરણનો સ્પર્શ મળતાં તૃણાદિક બહાર નીકળી આવવાના મિષથી રૂંવાડાં ઉભાં થઈ જતાં દેખાય છે અને એ પર્વત ગાયો તથા ગોવાળોની સાથે બલરામ અને શ્રીકૃષ્ણને પાણી, ઉત્તમ ધાસ, ગુફાઓ તથા કંદમૂળ આપીને સન્માન કરે છે. અને કુદરતી વનની

એવંવિધા ભગવતો યા વૃંદાવનચારિણ: । વર્ણયંત્યો મિથો ગોપ્ય: ક્રીડાસ્તન્મયતાં યયુ: ૨૦  
ઇતિ શ્રીમદ્બાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વાર્થી  
વેણુગીતં નામ એકવિંશોઽધ્યાય: ॥૨૧॥

### અથ દ્વાવિંશોઽધ્યાય: (૨૨)

॥ શ્રીશુક ઉવાચ ॥

હેમંતે પ્રથમે માસિ નંદવજકુમારિકા: । ચેરૂહેવિષ્ણું ભુજ્જાના: કાત્યાયન્યર્ચનવ્રતમ् ॥૧  
આપ્લુત્યાભસિ કાલિન્દ્ય જલાને ચોદિતેરૂળે । કૃત્વા પ્રતિકૃતિં દેવીમાનર્ચુન્ત્રપ સૈકતીમ् ૨  
ગાયૈમાર્લ્યૈ: સુરભિભર્લિભર્ધૂપદીપકૈ: । ઉચ્ચાવચૈશ્વોપહારૈ: પ્રવાલફલતણ્ડુલૈ: ॥૩  
કાત્યાયનિ મહામાયે મહાયોગિન્યધીશ્વરિ । નન્દગોપસુત દેવિ પર્તિ મે કુરુ તે નમઃ ।

ઇતિ મન્ત્ર જપન્યસ્તા: પૂજાં ચક્ર: કુમારિકા: ॥૪

શોભા પણ એ બસ્તે ભાઈઓને માન આપે છે.<sup>૧૮</sup> ગાયોના (દોહતી વખતે) પગ બાંધવાના શેલાને માથા પર વીંટી લેવાથી અને બહુ બળવાન તથા તોફાની ગાયોને બાંધીને ખેંચી જવા માટેની રાશોને ખભા ઉપર રાખવાથી મોટા ગોવાળની શોભા દેખાડતા એ બસ્તે ભાઈઓ જ્યારે ગોવાળોને સાથે લઈ વનમાં ગાયો ચારે છે, ત્યારે મધુર સ્વરવાળા વેણુના નાદ સાંભળી જંગમ પણ સ્થાવરની પેઠે સ્થિર થઈ જાય છે, અને વૃક્ષાદિ જેઓ સ્થિરથી તે વેણુ સાંભળીને ડોલવા માંડે છે, એથી મોટું આશ્રય થાય છે.<sup>૧૯</sup> શુકદેવજી કહે છે- આ પ્રમાણે વૃંદાવનમાં ફરનારા ભગવાનની કીડાનું પરસ્પર એકબીજાની પાસે વર્ણન કરતી ગોપીઓ ભગવાન મય થઈ ગઈ હતી.<sup>૨૦</sup>

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો એકવિશમ્બ અદ્યાય સંપૂર્ણ.

### અદ્યાય ૨૨

વસ્ત્ર હરણાની લીલા કરતા ભગવાન.

શુકદેવજી કહે છે- હેમંત ઋતુના માગશર મહિનામાં પ્રજની કુમરિકાઓ હવિષ્ય જમવાનો નિયમ રાખીને, કાત્યાયની દેવીના પૂજનનું પ્રત કરતી હતી.<sup>૧</sup> હે રાજી ! યમુનાના જળમાં સ્નાન કરીને સૂરજ ઊંઘા પછી રેતીથી દેવીની મૂર્તિ

એવं માસં ક્રતં ચેરુઃ કુમાર્યઃ કૃષ્ણાચેતસઃ । ભદ્રકાલીં સમાનર્ચુર્ભૂયાત્રન્દસુતઃ પતિઃ ॥૫  
ઉષસ્યુથાય ગોત્રૈઃ સ્વરેન્યોન્યાબદ્ધબાહ્વઃ । કૃષ્ણમુચ્ચૈર્જગુર્યાન્યઃ કાલિન્દાં સ્ત્રાતુમન્વહમ् ॥૬  
નન્દાં કદાચિદાગત્ય તીરે નિક્ષિપ્ય પૂર્વવત् । વાસાંસિ કૃષ્ણં ગાયન્યો વિજહુઃ સલિલે મુદા ॥૭  
ભગવાંસ્તદભિપ્રેત્ય કૃષ્ણો યોગે શ્વરેશ્વરઃ । વયસ્યૈરાવृત્તસ્તત્ર ગતસ્તત્કર્મસિદ્ધયે ॥૮  
તાસાં વાસાંસ્યુપાદાય નીપમારુહ્ય સત્ત્વરઃ । હસદ્ધિઃ પ્રહસન् બાલૈઃ પરિહાસમુવાચ હ ॥૯  
અત્રાગત્યાબલાઃ કામં સ્વં સ્વં વાસઃ પ્રગૃહ્યતામ् । સત્યં બ્રવાણિ નો નર્મ યદ્યૂયં વ્રતકર્ષિતાઃ ॥૧૦  
ન મયોદિતપૂર્વ વા અનુત્તં તદિમે વિદુઃ । એકૈકશઃ પ્રતીચ્છ્યં સહૈવોત સુમધ્યમાઃ ॥૧૧  
તસ્ય તત્ ક્ષેવલિં દૃષ્ટા ગોયઃ પ્રેમપરિપ્લુતાઃ । વ્રીડિતાઃ પ્રેક્ષય ચાન્યોન્ય જાતહાસા ન નિર્યયુઃ  
એવં બ્રુવતિ ગોવિન્દે નર્મણાઽક્ષિસચેતસઃ । આકણઠમગનાઃ શીતોદે વેપમાનાસ્તમબ્રુવન् ॥૧૩॥

કરીને પૂજાના પુષ્પાદિ સર્વ પદાર્થોવડે કાત્યાયની જગદ્ભાનું પૂજન કરતી હતી. <sup>૨-૩</sup>  
હે કાત્યાયનિ ! હે મહામાયા ! શ્રીકૃષ્ણને મારા પતિ કરજો. હું તમને નમન કરું  
છું.<sup>૪</sup> આ પ્રમાણે મંત્રનો જાપ કરીને દરેક કુમારિકાઓ કાત્યાયની દેવીનું પૂજન  
કરતી હતી. આ રીતે ભગવાનમાં ચિત્ત રાખીને ગોપબાલિકાઓ એક મહિના  
સુધી વ્રત કર્યું.<sup>૫</sup> શ્રીકૃષ્ણ અમારા પતિ હોજો, એવી ઈચ્છાથી દેવીનું પૂજન કરતી  
હતી, એક બીજાઓને નામથી બોલાવી, સવારમાં ઊઠી, એક બીજાઓના હાથ  
પકડીને ઊંચા સ્વરથી ભગવાનનું ગાયન કરતી કરતી દરરોજ યમુનાઞ્ચમાં નહાવા  
માટે જતી હતી. એક દિવસે યમુનાઞ્ચમાં આવી, પ્રથમની પેઢે પોતાનાં કપડાં કંઠે  
મૂકી, ભગવાનનું ગાયન કરતી આનંદથી જળમાં વિહાર કરતી હતી. ત્યાં શ્રીકૃષ્ણ  
ભગવાન તે વાત જાણીને તેના પ્રતનું ફળ દેવા સારુ પોતાના મિત્રોની સાથે પધારી,  
તેઓનાં કપડાં લઈ તરત કંદંબના જાડ ઉપર ચઢી જઈને હસવા લાગ્યા, અને  
તેમની સાથે બાળકો પણ હસવા લાગ્યા. પછી ભગવાને એ કુમારિકાઓને હાસ્યનું  
વચન કહ્યું કે

શ્રી ભગવાન કહે છે- હે સ્ત્રીઓ ! તમો અહીં આવીને પોતપોતાનાં કપડાં  
મારી પાસેથી લઈ જાઓ. <sup>૬-૧૦</sup> હું સાચું કહું છું, ગમ્મત કરતો નથી. કેમકે તમે  
વ્રત કરવાને લીધે થાકી ગયેલી છો. હું કોઈ દિવસ ખોટું બોલ્યો નથી તે આ  
ગોવાળો જાણો છે.<sup>૧૧</sup> હે સુંદરીઓ ! ઈચ્છા હોય તો એક એક જણ અહીં આવીને  
લો અથવા સર્વ સાથે લો. <sup>૧૨</sup>

શુક્ટેવજી કહે છે- આ પ્રમાણે ભગવાને હાંસી કરી તે જોઈને પ્રેમરસમાં  
દૂબેલી અને એક બીજાની સામે જોઈને હસતી ગોપીઓ લાજને લીધે બહાર નીકળી

માઝનંય ભોઃ કૃથાસ્ત્વાં તુ નન્દગોપસુતં પ્રિયમ् । જાનીમોડઙ્ગ! ક્રજશલાદ્યં દેહિ વાસાંસિ વેપિતાઃ ॥૪  
શ્યામસુન્દર! તે દાસ્ય: કરવામ તવોદિતમ् । દેહિ વાસાંસિ ધર્મજાં! નો ચેદ રાજે બુવામહે ॥૫

## શ્રીભગવાનુવાચ -

ભવત્યો યદિ મે દાસ્યો મયોક્ત વા કરિષ્યથ । અત્રાગત્ય સ્વવાસાંસિ પ્રતીચ્છ્યનું શુચિસ્મિતાઃ ॥૧૬  
તતો જલાશયાત્ સર્વા દારિકાઃ શીતવેપિતાઃ । પાણિશ્યાં યોનિમાચ્છાદ્ય પ્રોત્સેરુઃ શીતકર્ષિતાઃ  
ભગવાનાહ તા વીક્ષ્ય શુદ્ધભાવપ્રસાદિતઃ । સ્કંધ્યે નિધાય વાસાંસિ પ્રીતઃ પ્રોવાચ સસ્મિતમ્

યૂયં વિવસ્તા યદપો ધૃતવ્રતા વ્યગાહતૈતતદુ દેવહેલનમ् ।

બદ્ધાબ્જલિ મૂર્ધન્યપનુત્તયેઽહસ: કૃત્વા નમોઽધો વસન્ પ્રગૃહ્યતામ् ॥૧૯॥

ઇત્યચ્યુતેનાભિહતિં બ્રજાબલા મત્વા વિવસ્તાલ્વનં બ્રતચ્યુતિમ् ।

તત્પૂર્તિકામાસ્તદશેષકર્મણાં સાક્ષાત્કૃતં નેમુરવદ્યમૃગ યતઃ ॥૨૦॥

તાસ્તથાવનતા દૃષ્ટા ભગવાન્ દેવકીસુતઃ । વાસાંસિ તાથ્ય: પ્રાયચ્છત્ કરુણસ્તેન તોષિતઃ ॥૨૧

નહીં. કૃષ્ણનું વચન સાંભળી મોહ પામેલી અને ઠંડા જળમાં કંઠ સુધી દૂબવાને  
લીધે ધ્રૂજતી ગોપીઓએ કહ્યું કે હે કૃષ્ણ ! તમો અન્યાય ન કરો, તમે નંદરાજાના  
ઘારા પુત્ર અને પ્રજમાં કેવા વખાશવાને યોગ્ય છો, એ અમો જાણીએ છીએ,  
અમને વસ્ત્ર આપો, કેમકે ટાઢને લીધે અમો ધ્રૂજાએ છીએ. <sup>૧૩-૧૪</sup> હે શ્યામસુંદર !  
અમો તમારી દાસીઓ છીએ, તેથી જેમ કહેશો તેમ કરીશું. હે ધમ્ને જાણનારા !  
વસ્ત્ર આપો, નહીંતો અમે નંદરાજાને કહી દઈશું. <sup>૧૫</sup> ત્યારે કૃષ્ણે કહ્યું- સુંદર મંદ  
હાસ્યવાળી સ્ત્રીઓ ! તમે જો મારી દાસીઓ હો અને મારું કહ્યું કરવું હોય, તો  
અહીં આવીને પોતપોતાનાં વસ્ત્રો લઈ જાઓ. <sup>૧૬</sup>

શુક્ટેવજી કહે છે- પછી ટાઢી ધ્રૂજતી અને મુંજાએલી સર્વે કુમારિકાઓ  
બે હાથવાને પોતાનાં ગુદ્ય અંગોને ઢાંકીને જળાશયમાંથી બહાર નીકળી. <sup>૧૭</sup> તેઓએ  
શુદ્ધ અંત: કરણથી પ્રસન્ત કરેલા ભગવાન, બાલ્ય અને યુવાવસ્થાની મધ્યે રહેલી  
ગોપીઓને જોઈ રાજી થઈ, તેઓનાં વસ્ત્ર પોતાના ખભા પર મૂકી મંદમંદ હસીને  
બોલ્યા કે- વ્રતનું ધારણ કર્યા છતાં તમે નર્જન થઈને જળમાં સ્નાન કર્યું એ વરુણ  
દેવનો અપરાધ કર્યો છે, માટે એ અપરાધને ટાળવા સારુ માથા ઉપર હાથજોડી  
પ્રણામ કરીને વસ્ત્રો લો. <sup>૧૮-૧૯</sup>

શુક્ટેવજી કહે છે- આ પ્રમાણે ભગવાને કહ્યું એટલે ગોપીઓ નર્જન સ્નાન,  
એ વ્રતનો ભંગ કરનાર છે એમ માની, તે વ્રતને પૂર્ણ કરવાની ઈચ્છાથી ગોપીઓ  
સર્વ કર્માના ફળરૂપ ભગવાનને જ પગે લાગી, કેમકે તે સર્વ દોષને ટાળનાર

દૂરં પ્રલબ્ધાસ્ત્રપયા ચ હાપિતા: પ્રસ્તોભિતા: ક્રીડનવચ્ચ કારિતા: ।

વસ્ત્રાણિ ચૈવાપહૃતાન્યથાપ્યમું તા નાભ્યસૂયન् પ્રિયસઙ્ગનિર્વત્તા: ॥૨૨॥

પરિથાય સ્વવાસાંસિ પ્રેષ્ટસઙ્ગમસજ્જિતા: । ગૃહીતચિત્તા નો ચેલુસ્તસ્મિંશ્કજ્જાયિતેક્ષણા: ॥૨૩॥  
તાસાં વિજ્ઞાય ભગવાન્ સ્વપાદસ્પર્શકામ્યયા । ધૃતવ્રતાનાં સંકલ્પમાહ દામોદરોઽબલા: ॥૨૪॥  
સંકલ્પો વિદિત: સાધ્યો ભવતીનાં મર્દર્ચનમ્ । મયાનુમોદિત: સોઽસૌ સત્ત્વો ભવિતુર્મહતિ ॥૨૫  
ન મય્યાવેશિતધિયાં કામ: કામાય કલ્પતે । ભર્જિતા ક્રથિતા ધાના પ્રાયો બીજાય નેષ્ટતે ૨૬  
યાતાબલા બ્રજં સિદ્ધા મયેમા રંસ્યથ ક્ષપા: । યદુહિશ્ય બ્રતમિદં ચેરુરાર્યાર્ચનં સતી: ॥૨૭

શ્રીશુક ઉવાચ -

ઇત્યાદિષ્ટ ભગવતા લબ્ધકામા: કુમારિકા: । ધ્યાયન્યસ્તત્પદામ્ભોજં કૃછ્ણન્રીવિવશુર્વજમ् ॥૨૮  
અથ ગોપૈ: પરિવૃતો ભગવાન્ દેવકીસુત: । વૃદ્ધાવનાદ્ગતો દૂરં ચારયન્ગા: સહાગ્રજ: ॥૨૯  
નિદાઘાર્કાર્તપે તિગ્મે છાયાભિ: સ્વાભિરાત્મન: । આતપત્રાયિતાન્ વીક્ષ્ય દ્રુમાનાહ બ્રજૌકસ: ॥૩૦

છે. <sup>૨૦</sup> કૃપાળુ ભગવાને આ પ્રમાણે નમેલી ગોપીઓને જોઈ પ્રસન્ન થઈને વસ્ત્રો આપ્યાં. <sup>૨૧</sup> ભગવાને ગોપીઓને તેઓનાં વખ્ત લઈ છેતરી લીધી, લાજ રહિત કરી, હાંસી કરી અને રમકડાંની પેઠે રમાડી, તો પણ તેઓએ શ્રીકૃષ્ણ પ્રત્યે દોષ દાચ્છિ કરી નહીં. <sup>૨૨</sup> પોતપોતાનાં વખ્ત પહેરી પ્રિયના સમાગમે વશ કરેલી અને લાજના વિલાસથી ભગવાનની સામું જોયા કરતી ગોપીઓ પોતાનાં ચિત્ત પકડાઈ જવાને લીધે ત્યાંથી ખસી નહીં. <sup>૨૩</sup> દામોદર ભગવાને પોતાના ચરણના સ્પર્શની ઈચ્છાથી જેઓએ વ્રત કર્યું હતું, એવી ગોપીઓનો સંકલ્પ જાણી લઈને તે સ્ત્રીઓને કહ્યું. <sup>૨૪</sup> શ્રી ભગવાન કહે છે- હે ભલી સ્ત્રીઓ ! મારું પૂજન કરવાનો જે તમારો મનોરથ છે તે તમે શરમથી બોલતી નથી તોપણ મેં જાણી લીધો છે, અને તેમાં મારી સંમતિ છે, માટે તે મનોરથ સફળ થવાને યોગ્ય છે. <sup>૨૫</sup> મારામાં મન રાખનારાઓની ઈચ્છા મારાથી પૂર્ણ થઈને પાછી શાંતિ જ આપે છે, પણ બીજી ઈચ્છાને ઉત્પત્ત થવા દેતી નથી. બજેલું અથવા રાંધેલું બીજ ધણું કરીને બીજા બીજને ઉત્પત્ત કરે જ નહીં. <sup>૨૬</sup> હે સ્ત્રીઓ ! વ્રજમાં જાઓ તમારો મનોરથ સિદ્ધ થશે, આ આવતી રાત્રીઓમાં મારી સાથે રમણ કરશો. કેમ કે હે સતીઓ ! મારા ઉદ્દેશથી આ જગદંબાના પૂજનરૂપ વ્રત તમે કર્યું છે. <sup>૨૭</sup>

શુકુદેવજી કહે છે- આ પ્રમાણે આજા કરતાં જેના મનોરથ પૂર્ણ થયા છે એવી અને ભગવાનના ચરણારવિદ્યનું જ ધ્યાન કરતી ગોપીઓ માંડમાંડ વ્રજમાં ગઈ. <sup>૨૮</sup> પછી ગોવાળોથી વીંટાયેલા ભગવાન અને બલરામ ગાયો ચારતા ચારતા

હે સ્તોકકૃષ્ણ! હે અંશો શ્રીદામન્ સુબલાર્જુન! વિશાલર્થ તેજસ્વિન્ દેવપ્રસ્થ વસ્તુથ્ય ૩૧  
પશ્યતૈતાન્ મહાભાગાન્ પરાર્થેકાન્તજીવિતાન્ । વાતવર્ષાતપહિમાન્ સહન્તો વારયન્તિ નઃ ॥૩૨  
અહો એણ વરં જન્મ સર્વપ્રાણ્યુપજીવનમ્ । સુજનસ્યેવ યેણા વૈ વિમુખા યાન્તિ નાર્થિન: ॥૩૩  
પત્રપુષ્પફલચ્છાયામૂલવલ્કલદારુભિ: । ગસ્થનિર્યાસભસ્માસ્થિતોક્મૈ: કામાન્ વિતન્વતે ॥૩૪  
એતાવજ્જમસાફલન્ દેહિનામિહ દેહિષુ । પ્રાણર્થેર્થિયા વાચા શ્રેય એવાચેરેત સવા ॥૩૫  
ઇતિ પ્રવાલસ્તબકફલપુષ્પદલોત્કરૈ: । તર્ણણાં નમ્રશાખાનાં મધ્યેન યમુનાં ગત: ॥૩૬  
તત્ત્વ ગા: પાયયિત્વાપ: સુમૃષ્ટા: શીતલા: શિવા: । તતો નૃપ! સ્વયં ગોપા: કામં સ્વાદુ પુર્જલમ્ ૩૭  
તસ્યા ઉપવને કામં ચારયંત: પશ્ચાત્પ! । કૃષ્ણરામાવૃપાગમ્ કૃથાર્તા ઇદમબ્રવન् ॥૩૮

ઇતિ શ્રીમદ્બાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સહિતાયાં દશમસ્કન્દ્યે પૂર્વાર્થ  
ગોપીવસ્ત્રાપહારો નામ દ્વારિંશોઽધ્યાય: ॥૨૨॥

વૃંદાવનથી દૂર નીકળી ગયા. <sup>૩૯</sup> તીક્ષ્ણ સૂર્યના તડકામાં ધાયાથી છત્રરૂપ થઈ રહેલાં વૃક્ષોને જોઈને ભગવાને ગોવાળોને કહ્યું કે- હે સ્તોકકૃષ્ણ ! હે અંશુ ! હે શ્રીદામા ! હે દેવપ્રસ્થ ! હે વૃષભ ! પારકાને માટે જ જેનું જીવન છે એવાં આ ભાગ્યશાળી વૃક્ષોને જુઓ. પોતે વાયુ, વરસાદ, તડકો અને ટાઢ સહન કરીને આપણી એ પીડાઓનું નિવારણ કરે છે. <sup>૩૦-૩૨</sup> અહો ! આ વૃક્ષો પાસેથી કોઈ નિરાશ થતું નથી. પ્રાણીઓના પ્રાણરૂપ એવાં આ વૃક્ષોને ધન્ય છે. <sup>૩૩</sup> પાંડાં, ઝૂલ, ઝણ, છાયા, મૂળ, છાલ, લાકડાં, ગંધ, ગુંદર, ભસ્મ, ઠળિયા અને અંકુરોથી બીજાઓની ઈચ્છાને પરિપૂર્ણ કરે છે. <sup>૩૪</sup> આ સંસારમાં પ્રાણીઓના જન્મની સફળતા એટલી જ છે કે પ્રાણથી, ધનથી, બુદ્ધિથી, અને વાણીથી સર્વદા પ્રાણીઓનું હિત કરવું. <sup>૩૫</sup>

શુકુદેવજી કહે છે- આ પ્રમાણે વૃક્ષોના વખાણ કરતા ભગવાન ઝૂંપણ, ગુંધણ, ઝણ, ઝૂલ, અને પાંડાંના સમુહથી જેઓની શાખાઓ નમી ગઈ હતી, એવાં વૃક્ષોના મધ્યમાં થઈને યમુનાજીને કાંઠે પદ્ધાર્યા. <sup>૩૬</sup> હે રાજા ત્યાં ગાયોને સ્વર્ણ, શીતળ અને પવિત્ર યમુનાનું પાણી પાઈને પછી ગોવાળોએ પાણી પીધું. <sup>૩૭</sup> એ નદીના ઉપવનમાં યથેષ્ટ રીતે પશુઓને ચારતા ગોવાળો બહુ જ ભૂખ્યા થઈ જવાથી, બલરામ અને શ્રીકૃષ્ણ પાસે કહેવા લાગ્યા. <sup>૩૮</sup>

ધાતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંદનો બાવીશમો અદ્યાય સંપૂર્ણ.

## अथत्रयोविंशोऽध्यायः (२३)

गोपा ऊचुः

राम राम महावीर्य! कृष्ण! दुष्टनिर्वहण! । एषा वै बाधते क्षुन्नस्तच्छान्ति कर्तुमर्हथः ॥१  
श्रीशुक उवाच -

इति विज्ञापितो गोपैर्भगवान् देवकीसुतः । भक्ताया विप्रभार्यायाः प्रसीदन्निदमब्रवीत् ॥२  
प्रयात देवयजनं ब्राह्मणा ब्रह्मवादिनः । सत्रमाङ्गिरसं नाम ह्वासते स्वर्गकाम्यया ॥३  
तत्र गत्वौदनं गोपा याचतास्मद्विसर्जिताः । कीर्तयन्तो भगवत आर्थस्य मम चाभिधाम् ॥४  
इत्यादिष्टा भगवता गत्वायाचन्त ते तथा । कृताज्जलिपुटा विप्रान् दण्डवत् पतिता भुवि ॥५  
हे भूमिदेवाः शृणुत कृष्णस्यादेशकारिणः । प्राप्ताज्जानीत भद्रं वो गोपान् नो रामचोदितान् ॥६

गाश्चारयन्तावविदूर ओदनं रामाच्युतौ वो लषते बुधुक्षितौ ।

तयोर्द्विजा ओदनर्थिनोर्यदि श्रद्धा च वो यच्छत धर्मवित्तमाः ॥७॥

दीक्षायाः पशुसंस्थायाः सौत्रामण्याश्च सत्तमाः । अन्यत्र दीक्षितस्यापि नान्नमशनन् हि दुष्ट्यति ॥८

## अध्याय २३

विप्रपत्नीओ उपर अनुग्रह करवा भाटे भगवाने यज्ञाभां  
करावेली अन्ननी याचना.

गोवाणो कहे छे- हे बणभद्र ! हे पराकमी कृष्ण ! हे दुष्टोनो नाश करनार !  
आ भूम अमने पीडा पमाडे छे, भाटे आप भूमनी निवृत्ति पमाडवाने भाटे  
योग्य छो.<sup>१</sup>

शुकदेवज्ञ कहे छे- आ प्रमाणे गोवाणो द्वारा प्रार्थना कराता भगवान पोतानी  
भक्त ख्रास्त्राणी स्त्रीओ उपर कृपा करवानो वियार करी बोल्या के हे गोवाणो !  
वेद ज्ञानारा ख्रास्त्राणो ए स्वर्ग पामवानी ईच्छाथी आंगिरस नामना सत्रनो  
प्रारंभ कर्यो छे, ते यज्ञभूमिमां ज्ञाओ अने त्यां जर्ह आ मोटाभाई तथा मारं  
नाम लहैने तेनी पासे अन्ननी मागाणी करजो. अमारा कहेवाथी त्यां ज्वानुं छे,  
भाटे तमारे कशी शरम राखवी नहीं.<sup>२-४</sup> आ प्रमाणे भगवाने आशा करी तेथी  
सर्वे गोवाणो त्यां जर्ह ख्रास्त्राणो ने दंडवत् प्रणाम करी हाथ जोडीने माझ्युं के हे  
ख्रास्त्राणो ! अमारी विज्ञानि सांभणो, भगवाननी आज्ञाथी अने बणदेवज्ञनी  
प्रेरणाथी अमो तमारी पासे आव्या छीअे.<sup>५-६</sup> भगवान अने बलराम आ स्थणथी  
थोडे दूर गायोने चारता चारता आव्या छे, तेओ भूम्या थवाने लीधे तमारी  
पासेथी अन्न लेवानी ईच्छा करे छे, भाटे हे धर्मज्ञ ख्रास्त्राणो ! श्रद्धा होय तो केवण

इति ते भगवद्याच्चां शृणवन्तोऽपि न शुश्रुवः । क्षुद्राशा भूरिकर्माणो बालिशा वृद्धमानिनः ॥९  
देशः कालः पृथग् द्रव्यं मन्त्रतन्त्रित्विजोऽग्नयः । देवता यजमानश्च क्रतुर्धर्मश्च यन्मयः ॥१०॥  
तं ब्रह्म परमं साक्षाद् भगवन्तमधोक्षजम् । मनुष्यदृष्ट्या दुष्प्रज्ञा मर्त्यात्मानो न मेनिरे ॥११॥  
न ते यदोमिति प्रोचुर्न नेति च परंतप ! गोपा निराशा: प्रत्येत्य तथोचुः कृष्णरामयोः ॥१२  
तदुपाकर्ण्य भगवान् प्रहस्य जगदीश्वरः । व्याजहार पुनर्गोपान् दर्शयैङ्गौकिकीं गतिम् ॥१३॥  
मां ज्ञापयत पत्नीभ्यः संस्कर्षणमागतम् । दास्यन्ति काममन्नं वः स्निधा मध्युषिता धिया ॥१४  
गत्वाथ पत्नीशालायां दृष्ट्वाऽसीनाः स्वलङ्घताः । नत्वा द्विजसतीर्गोपाः प्रश्रिता इदमब्रुवन् ॥१५  
नमो वो विप्रपत्नीभ्यो निबोधत वचांसि नः । इतोऽविदूरे चरता कृष्णोनेहेषिता वयम् ॥१६

भातनी याचना करता ए भस्ते भाईओने भाटे अन्न आपो.<sup>७</sup> हे उत्तम ख्रास्त्राणो !  
कदाचित आप कहेशो के अमे दीक्षित छीअे. अमारं अन्न खावुं न जोईअ. तेथी  
ऐवो निर्णय छे के जेमां पशुनुं मारण छे ऐवी दीक्षा, अने सौत्रामणी याग, आ  
भस्ते यागोने छोडीने बीजा यागोमां दीक्षितनुं अन्न खावामां कोई दोष नथी.<sup>८</sup>  
स्वर्गाद्विक तुर्थं फणी आशा राखनारा, बहु ज श्रम भरेलां वेदोक्त कर्मो करनारा  
अने भूर्भ छतां पोताने ज्ञानी माननारा, ए ख्रास्त्राणो भगवाननी मांगाणीने  
सांभणी रहेला होवा छतां पाण जाणे सांभणी नहि.<sup>९</sup> देश, काण, चरुपुरोडाशाद्विक  
द्रव्य, मंत्र, तंत्र, ऋत्विज, अग्नि, देवता, यज्ञमान, यज्ञ अने धर्म ए सर्वे जे  
श्रीकृष्ण भगवानमय छे, ऐवा ते साक्षात् श्रीकृष्ण भगवानने मनुष्य मानी, ए  
दुर्भुद्धिवाणा अने अमे भोटा छीअे ऐम अभिमान धरावनारा ख्रास्त्राणो ए ते  
मागाणीने मान आप्युं नहि.<sup>१०-११</sup> हे राजा ! ए ख्रास्त्राणो ज्यारे हा के ना कांઈ पाण  
बोल्या नहीं त्यारे निराश थयेला गोवाणो पाइ आवीने बणदेव अने श्रीकृष्णानी  
पासे सर्व वात कही संभणावी.<sup>१२</sup> भगवाने ते वात सांभणी हसीने “कार्य साधवुं  
होय तो थाकी जवुं नहीं, अने मागवा जनारनुं अपमान थया वगर रहे ज  
नहीं” ऐवी लोकरीति देखाणीने गोवाणो ने फरीवार कह्युं- “कार्य साधनार होय  
तेमणे क्यारेय पाण कुटाणवुं नहि. तरणा करतां हलको कपास होय छे, अने  
कपास करतां पाण हलको याचक कहेवाय छे. भाटे क्यो याचक अनादर पामतो  
नथी ? सर्वे याचको अनादर पामे ज छे.” त्यारे भगवान कहे छे- हुवे तमो  
तेमनी स्त्रीओ पासे जर्ह पूर्ववत् ज्ञानावो, केवण देहथी धरमां रहेती पाण स्नेह  
भरेली बुद्धिथी मारामां रहेनारी ते स्त्रीओ तमने सारी पेठे अन्न आपशे.<sup>१३-१४</sup>  
पछी गोवाणो, ख्रास्त्राण स्त्रीओ पासे गया, त्यां बेठेली अने सारी रीते शाश्वारेली

गाश्चारयन् सगोपालैः सरामो दूरमागतः । बुभुक्षितस्य तस्यान्नं सानुगस्य प्रदीयताम् ॥१७  
श्रुत्वाच्युतमुपायातं नित्यं तद्दर्शनोत्सुकाः । तत्कथाक्षिसमनसो बभूर्जातसम्भ्रमाः ॥१८  
चतुर्विधं बहुणमन्नमादाय भाजनैः । अभिसन्धुः प्रियं सर्वाः समुद्रमिव निम्नगाः ॥१९  
निषिध्यमानाः पतिभिर्भ्रातृभिर्भ्रुभिः सुतैः । भगवत्युत्तमश्लोके दीर्घश्रुतधृताशयाः ॥२०  
यमुनोपवनेऽश्लोकनवपल्लवमण्डते । विचरन्त वृतं गोपैः साग्रजं ददृशुः स्त्रियः ॥२१

यथामं हिरण्यपरिधिं वनमाल्यबहूद्धातुप्रवालनटवेषमनुव्रतांसे ।

विन्यस्तहस्तमितेरण धुनानमज्जनं कर्णोत्यलालकपोलमुखाब्जहासम् ॥२२॥

प्रायः श्रुतप्रियतमोदयकर्णपूर्वयस्मिन् निमग्नमनसस्तमथाक्षिरन्ध्यैः ।

अन्तः प्रवेश्य सुचिरं परिरभ्य तापं प्राज्ञं यथाभिमतयो विजहुन्नरन्ध्न! ॥२३॥

तास्था त्यक्तसर्वाशाः प्राप्ता आत्मदिदृक्षया । विज्ञायाखिलदृग्द्रष्टा प्राह प्रहसिताननः ॥२४

प्राक्षणीओने प्राणाम करी नम्रताथी बोल्या के- हे ब्राक्षणीओ ! तमोने नमन करीए धीअे. अमारी वात सांभणो. अहींथी थोडेक छेटे आवेला श्रीकृष्णे अमने अहीं मोकल्या छे. १५-१६ गायो चारता भगवान, गोवाणो अने बलरामनी साथे प्रजथी दूर आव्या छे. अने पोताना अनुयरो सहित भूम्या थया छे, तेमने माटे खावानुं आपो. १७ भगवानना गुणो जेणो सांभणेला छे एवी अने निरंतर दर्शननी ईच्छा धरावनारी ते स्त्रीओ भगवानने सभीपे आव्या सांभणी, त्यां जवाने सारु भइ ज हर्षधेली थई. १८ भक्ष्यादि चार प्रकारनां अप्नानां पात्रो लઈने तेओ सर्वे पोताने प्रिय एवा भगवाननी पासे चाली, लांबा दिवसना श्रवणाने लीधे जेनुं चित उत्तमश्लोक भगवानमां ज लागी रह्युं हतुं, एवी स्त्रीओने तेओना पति, भाईओ आहि संबंधीओ रोकवा लाङ्या तोपाण तेओने नहीं गणकारीने, नहींओ जेम समुद्रने ज मणे तेम भगवाननी पासे गई. १९-२० आसोपालवना नवीन पल्लवोथी शोभी रहेला यमुनाज्ञना उपवनमां बलराम सहित अने गोवाणोथी वींटाएला भगवानना ब्राक्षणीओअे दर्शन कर्या. २१ भगवाने सुवर्ण जेवां पीणां वस्त्र पहेर्या हतां, वर्णं श्याम हतो, मोरपींछ धातु अने फूंपणोथी नटवरवेष धारी रहेला, एक हाथ भित्रना खभा उपर अने बीजा हाथथी कमण हलावता अने मंदमंद हसता एवा भगवानने ज्ञेया. २२ कानने कृतार्थं करनारा गुणो सांभणवाने लीधे पोतानां मन जेमां लागी रह्यां हतां ते भगवानने नेत्रउप द्वारथी, पोताना हृदयमां पधरावी, धणीवार सुधी आविंगन करी सर्व तापथी मुक्त थई. २३ पोतानां दर्शननी ईच्छाथी ज आवेली सर्वे गोपीओ प्रत्ये भगवान

स्वागतं वो महाभागा आस्यतां करवाम किम् । यन्नो दिवृक्षया प्राप्ता उपपन्नमिदं हि वः ॥२५  
नन्वद्वा मयि कुर्वन्ति कुशलाः स्वार्थदर्शनाः । अहैतुक्यव्यवहितां भक्तिमात्मप्रिये यथा ॥२६  
प्राणबुद्धिमनःस्वात्मदारपत्यधनादयः । यत्सम्पर्कात् प्रिया आसंस्ततः को न्वपरः प्रियः ॥२७  
तद् यात देवयजनं पतयो वो द्विजातयः । स्वसत्रं पारयिष्वन्ति युष्माभिर्गृहमेधिनः ॥२८

पत्न्य ऊचुः -

मैवं विभोर्जहति भवान् गदितुं नृशंसं सत्यं कुरुष्व निगमं तव पादमूलम् ।

प्राप्ता वयं तुलसिदाम पदावसृष्टं केशैनिवोद्भुमतिलङ्घ्य समस्तबन्धून् ॥२९

गृह्णन्ति नो न पतयः पितरौ सुता वा न भ्रातृबन्धुसुहृदः कुत एव चाच्ये ।

तस्माद् भवत्प्रपदयोः पतितात्मनां नो नान्या भवेद् गतिररन्दम तद् विधेहि ॥३०॥

श्रीभगवानुवाच -

पतयो नाभ्यसूयेरन् पितृभ्रातृसुतादयः । लोकाश्च वो मयोपेता देवा अप्यनुमन्वते ॥३१

हसीने कहेवा लाङ्या के- हे भाङ्यशाणी ब्राक्षणीओ ! तमे भवे आवी बेसो, अमे तमारुं शुं काम करीए ? कोई पश बंधनने नहीं गणकारी अमारां दर्शने तमे आवी छो ए तमने धटे छे. २४-२५ कुशण अने पोताना पुरुषार्थं उपर लक्ष राखनारा लोको आत्माओने पश अति प्रिय एवो जे हुं, ते मारे विषे निष्क्रम अने निर्विध्न भक्ति यथार्थं रीते करे छे. २६ प्राण, बुद्धि, मन, ज्ञातिज्ञनो, देह, स्त्री, पुरुष अने धनादिक पदार्थो जे अंतर्यामी आत्माना संबंधने लीधे ज प्रिय लागे छे, ते अंतर्यामी एवो जे हुं ते माराथी वधारे प्रिय बीजो कोणा होय ?. २७ तमो मारा दर्शनथी ज कृतार्थं थयां छो तो हवे तमो यज्ञना स्थानके जाओ, कारण के तमे जशो त्यारेज तमारा पति यज्ञने पूर्ण करी शक्शे.” २८

ब्राक्षणीओ कहे छे- हे प्रभु ! तमारे आवुं कठण वयन न कहेवुं जोईए. ‘मारो भक्त कोई रीते हुःभी न ज थाय’ एवी जे आपनी प्रतिज्ञा छे तेने अथवा तमने पामेलो पाणो फरेज नहीं, एवुं जे वेद वयन छे तेने आप सत्य करो. अमो सर्वे बंधुओनो त्याग करीने आपनी दासी थवा आवेली धीए. २९ अमारा पति, मा-बाप आहिक बंधुओ अने स्नेहीओ हवे अमोने ग्रहण करशे नहीं, त्यारे बीजा तो केम ग्रहण करे ? हे प्रभु ! अमे आपना यरणमां समर्पित थयेली धीए. तेथी हवे अमारी बीजु कोई गति नथी. एक ज आप गतिरुप छो, माटे अमोने आप पोतानी दासी तरीके राखो. ३०

भगवान कहे छे- हवे मारी आज्ञाने लीधे पति, मा, बाप, भाईओ अने

ન પ્રીતયેઝનુરાગાય હૃદ્ભસઙ્ગો નૃણામિહ । તમ્મનો મયિ યુઝ્જાના અચિરાન્મામવાપ્યથ ॥૩૨  
શ્રીશુક ઉવાચ -

ઇત્યુક્તા દ્વિજપત્યસ્તા યજવાટં પુર્ણતાઃ । તે ચાનસૂયવઃ સ્વાભિઃ સ્ત્રીભિઃ સત્ત્રમપારયન् ॥૩૩  
તત્ત્રૈકા વિધૃતા ભર્ત્રા ભગવન્તં યથાશ્રુતમ् । હૃદોપગૃહ્ય વિજહૌ દેહં કર્માનુબન્ધનમ् ॥૩૪ ॥  
ભગવાનપિ ગોવિન્દસ્તેનૈવાત્રેન ગોપકાન् । ચર્તુવિધેનાશવિત્વા સ્વયં ચ બુઝે પ્રભુઃ ॥૩૫ ॥  
એવં લીલાનરવપુર્ણલોકમનુશીલયન् । રેમે ગોગોપગોપીનાં રમયન् રૂપવાકૃતૈઃ ॥૩૬ ॥  
અથાનુસ્મત્ય વિપ્રાસ્તે અન્વતપ્યન્ કૃતાગસઃ । યદ્વિશ્વેશ્વરયોર્યાચ્ચામહન્મ નૃવિદ્મબયોઃ ॥૩૭ ॥  
દૃષ્ટા સ્ત્રીણાં ભગવતી કૃષ્ણો ભક્તિમલાનીકીમ् । આત્માનં ચ તથા હીનમનુત્સા વ્યર્ગહયન् ॥૩૮ ॥  
ધિગજનમ નસ્ત્રિવૃદ્ધ વિદ્યાં ધિગ્ બ્રતં ધિગ્ બહુજ્ઞતામ् ।

ધિક્ કુલં ધિક્ ક્રિયાદાક્ષયં વિમુખા યે ત્વધોક્ષજે ॥૩૯ ॥

નૂં ભગવતો માયા યોગિનામપિ મોહિની । યદ્વ વયં ગુરુવો નૃણાં સ્વાર્થે મુહ્યામહે દ્વિજાઃ ॥૪૦ ॥  
અહો પશ્યત નારીણામપિ કૃષ્ણો જગદ્દૂરો । દુર્નત્ભાવં યોડવિધ્યનૃત્યુપાશાન્ ગૃહાભિધાન્ ॥૪૧ ॥

પુત્રાદિક કોઈ પણ તમારો દોષ નહીં ગણે. જુઓ આ દેવતાઓ પણ સંમનિ આપે છે.<sup>૩૧</sup> શુકદેવજી કહે છે- આ પ્રમાણે ભગવાનનાં વચન સાંભળી બ્રાહ્મણ પત્નીઓ પાછી યજસ્થાનકમાં ગઈ, ત્યારે તેઓના પતિઓએ પણ દોષ દાસ્તિ નહીં રાખતાં તેમની સાથે રહી પોતાનો યજા પૂર્ણ કર્યો. <sup>૩૨</sup> એ સર્વે સ્ત્રીઓ ભગવાનની પાસે જતી હતી તે સમયે એક સ્ત્રીને તેમના પતિએ રોકી રાખ્યો. તે સ્ત્રી પોતાના સાંભળ્યા પ્રમાણે ભગવાનનું હંદયથી આલિંગન કરી, કર્મથી બંધાએલો દેહ છોડી દીધો. (મૃત્યુ પામી ગઈ) <sup>૩૪</sup> આ બાજુ ગોવિંદ ભગવાન પણ ચારપ્રકારના તે અન્શથી ગોવાળોને જમાડી પોતે પણ જમ્યા. ઉપ આ પ્રમાણે લીલાથી મનુષ્યરૂપે થયેલા, મનુષ્ય રીતિનું અનુકરણ કરતા, અને રૂપ, વાણી તથા કર્મથી ગાયો, ગોવાળો અને ગોપીઓને આનંદ આપતા કીડા કરતા હતા. <sup>૩૬</sup> પછી મનુષ્યોનું અનુકરણ કરતા અને જગતના ઈશ્વર શ્રીકૃષ્ણ અને બળભદ્રની માગણીને માન આપ્યું નહીં, એ વાતને સંભારી પોતાને અપરાધી ગણતા તે બ્રાહ્મણો પશ્ચાતાપ કરવા લાગ્યા. <sup>૩૭</sup> શ્રીકૃષ્ણ ભગવાનમાં સ્ત્રીઓની અલોકિક ભક્તિ જોઈને પસ્તાએલા બ્રાહ્મણો ભક્તિ વિનાના પોતાના આત્માને વિક્કારવા લાગ્યા. <sup>૩૮</sup> “આપણે ભગવાનથી વિમુખ છીએ, તેથી ત્રણ પ્રકારના જન્મને, બ્રહ્મયર્થને, ધર્મનું જાણનારપણાને, કુળને, ક્રિયાઓને અને ચાતુરીને વિક્કાર છે. <sup>૩૯</sup> ભગવાનની માયા જ્ઞાનીઓને પણ મોહ પમાડનારી છે, કેમકે આપણે મનુષ્યોના ઉપદેશક જ્ઞાની છીએ, છતાં પણ પોતાના

નાસાં દ્વિજાતિસંસ્કારો ન નિવાસો ગુરાવપિ । ન તપો નાતમીમાંસા ન શૌચં ન ક્રિયા: શુભા: ॥૪૨ ॥  
અથાપિ હૃત્તમશલોકે કૃષ્ણો યોગેશ્વરેશ્વરે । ભક્તિર્દૂઢા ન ચાસ્માકું સંસ્કારાદિમતામપિ ॥૪૩ ॥  
નનુ સ્વાર્થીવિમૂઢાનાં પ્રમત્તાનાં ગૃહેહ્યા । અહો ન: સ્મારયામાસ ગોપવાક્યૈ: સતાં ગતિઃ ॥૪૪ ॥  
અન્યથા પૂર્ણકામસ્ય કૈવલ્યાદ્યાશિષાં પતે: । ઈશિતવ્યા: કિમસ્માભિરીશસ્વૈતદ્વિવિદ્મબનમ् ॥૪૫ ॥  
હિત્વાન્યાન્ ભજતે યં શ્રી: પાદસ્પર્શણશ્યા સકૃત । આત્મદોષાપરોણ તદ્વાચ્ચ જનમોહિની ॥૪૬ ॥  
દેશ: કાલ: પૃથગ્રવ્યં મન્ત્રતન્ત્રિવ્યજોગનયઃ । દેવતા યજમાનશ્ચ ક્રતુર્ધર્મશ્ચ યન્મયઃ ॥૪૭ ॥  
સ એ ભગવાન્ સાક્ષાદ વિષ્ણુયોગેશ્વરેશ્વર: । જાતો યદુષ્વિત્વશ્રણમ હ્યાપિ મૂઢા ન વિદ્યાહે ॥૪૮ ॥  
અહો વયં ધન્યતમા યેણાં નસ્તાદૂશી: સ્ત્રીયઃ । ભક્ત્યા યાસાં મતિર્જાતા અસ્માકું નિશ્ચલા હોય ॥૪૯ ॥  
નમસ્તુભ્યં ભગવતે કૃષ્ણાયાકુણઠ્યેદેશેસે । યન્માયામોહિતથિયો ભ્રમામ: કર્મવર્ત્મસુ ॥૫૦ ॥  
સ વૈ ન આદ્યઃ પુરુષ: સ્વમાયામોહિતાત્મનામ । અવિજ્ઞાતાનુભાવાનાં ક્ષન્તુમહૃત્યતિક્રમમ ॥૫૧ ॥  
હિતના વિષયમાં મોહ પામેલા છીએ. <sup>૫૧</sup> અહો !!! આ સ્ત્રીઓને પણ જગતના ગુરુ ભગવાનમાં કેવો અપાર ભાવ છે ! કે જેઓએ ઘરરૂપ મૃત્યુના પાશ કાપી નાખ્યા. <sup>૫૨</sup> આ સ્ત્રીઓને ઉપનયન સંસ્કાર, ગુરુને ઘેર નિવાસ, તપ, આત્મવિચાર, પવિત્રતા કે શુભ ક્રિયાઓ એમાંનું કંઈ પણ થયું નથી, છતાં મોટી કીર્તિવાળા ભગવાનમાં દેછ ભક્તિ ઉત્પન્ન થઈ, અને આપણાને સંસ્કારાદિક થયા છતાં પણ ભક્તિ ઉત્પન્ન થઈ નથી. <sup>૫૨-૫૩</sup> અહો ! સ્વાર્થમાં મૂઢ અને ઘરના કામકાજને લીધે પ્રમત્ત એવા આપણા ઉપર અનુગ્રહ કરવા માટે ગોવાળોનાં વચનોથી ભગવાને પોતાનું સ્મરણ જ આપ્યું. <sup>૫૪</sup> નહિતર પૂર્ણકામ અને મોક્ષ આપનાર ભગવાનને પામર એવા આપણનું શું કામ હોય ? છતાં અન્શની યાચના કરી, એતો ભગવાને મનુષ્ય લીલાની યેષા જ કરી છે. <sup>૫૫</sup> વારંવાર જેના ચરણસ્પર્શની આશાથી લક્ષ્મી પણ બીજાઓનો ત્યાગ અને પોતાનો ચંચળપણાદિક દોષ છોડી દઈને જેને ભજે છે, તે ભગવાન બીજાની પાસે માંગણી કરે તે તો કેવળ લોકોને મોહ ઉત્પન્ન કરનાર છે. <sup>૫૬</sup> દેશ, કાળ, અનેક પ્રકારનાં પદાર્થો, મંત્ર, તંત્ર, ઋત્વિજ, અજિનાઓ, દેવતા, યજમાન, યજા અને ધર્મ એ સર્વ જેના મય છે તે સાક્ષાત્ ઈશ્વર વિષણુ યાદોમાં જન્મ્યા છે એમ આપણે સાંભળ્યું છે, તોપણ આપણે મૂઢપણાથી ચેત્યા નહિ. <sup>૫૭-૫૮</sup> અહો ! આપણે બહુ જ ભાગ્યશાળી છીએ કે- આપણી બુદ્ધિને ભગવાનમાં નિશ્ચળ કરાવનારી સ્ત્રીઓ આપણા ઘરમાંં છે. <sup>૫૯</sup> અમે જેની માયાથી મોહ પામીને કર્માના માર્ગોમાં ભભ્યા કરીએ છીએ, તે અખંડ જ્ઞાનવાળા શ્રીકૃષ્ણને અમો પ્રણામ કરીએ છીએ. <sup>૬૦</sup> પોતાની માયાએ મોહ પમાડેલા અને પ્રભાવને

इति स्वाधमनुस्मृत्य कृष्णे ते कृतहेलनाः । दिवूक्षवोऽप्यच्युतयोः कंसाद्भीता न चाचलन् ॥५२  
 इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्थे  
 यज्ञपत्न्युद्धरणं नाम त्रयोविंशोऽध्यायः ॥२३॥

### अथ चतुर्विंशोऽध्यायः (२४)

॥ श्रीशुक उवाच ॥

भगवानपि तत्रैव बलदेवेन संयुतः । अपश्यन्निवसन् गोपानिन्द्रयागकृतोद्यमान् ॥१  
 तदभिज्ञोऽपि भगवान् सर्वात्मा सर्वदर्शनः । प्रश्रयावनतोऽपृच्छद् वृद्धान् नन्दपुरोगमान् ॥२  
 कथ्यतां मे पितः कोऽयं सम्भ्रमो व उपागतः । किं फलं कस्य चोद्देशः केन वा साध्यते मखः ॥३  
 एतद् ब्रह्म महान् कामो महां शुश्रूषवे पितः । न हि गोप्यं हि साधूनां कृत्यं सर्वात्मनामिह ॥४  
 अस्त्यस्वपरदृष्टीनाममित्रोदास्तविद्विषाम् । उदासीनोऽरिवद् वर्ज्य आत्मवत् सुहृदुच्यते ॥५॥

नहीं जाणारा आपणा अपराधने ते आदिपुरुष भगवान क्षमा करवाने योग्य छे.<sup>५१</sup> भगवाननुं अपमान करनारा ते ब्राह्मणोने आ प्रमाणे पोताना अपराधनुं स्मरण आववाथी, श्रीकृष्ण अने बणभद्रनुं दर्शन करवानी ईच्छा थई, तोपण कंसनी भीकथी तेओ गया नहीं.<sup>५२</sup>

इति श्रीमद् महापुराण भागवतना दशम स्कन्धनो त्रेवीशमो अध्याय संपूर्णः ॥

### अध्याय २४

श्रीकृष्ण भगवाने करावेलो गोवर्धन भ्रह्मोत्सव.

शुकदेवज्ञ कुहे छे- पछी बलरामनी साथे व्रजमां रहेता भगवाने एक दिवस गोवाणोने ईंद्रनो यज्ञ करवानो उद्यम करता जोया.<sup>१</sup> सर्वना आत्मा अने सर्वज्ञ भगवान पोते जाणता हता तोपण तेमाणे नंदादिक वृद्ध गोवाणोने नम्रताथी पूछ्युं के- हे पिता ! आ तमो शुं करो छो ? ते भने कुहो. आ कोई यज्ञने माटे धामधूम होय तो तेनुं शुं झण छे ? तेना देवता कोण छे ? अने क्या साधनथी ते यज्ञ थाय छे ? हे पिता ! हुं सांभणवाने ईच्छु छुं, तो भने आ वात कुहो. तमने कोई भोटो मनोरथ देखाय छे ? (नंदराय कांઈ बोल्या नहिं तोपण भगवान कुहे छे) सर्व पदार्थमां आत्मदृष्टि राखनार साधु पुरुषोने कांઈ पण गुम राखवा योग्य होतुं नथी.<sup>२-४</sup> साधुओने भित्र, उदासीन के शत्रु होतो नथी. तेथी तेने पोतानो के

ज्ञात्वाज्ञात्वा च कर्मणि जनोऽयमनुतिष्ठति । विदुषः कर्मसिद्धिः स्यात्तथा नाविदुषो भवेत् । द तत्र तावत् क्रियायोगो भवतां किं विचारितः । अथवा लौकिकस्तम्भे पृच्छतः साधु भण्यताम् ॥७  
 नन्द उवाच

पर्जन्यो भगवानिन्द्रो मेघास्तस्यात्ममूर्तयः । तेऽभिवर्षन्ति भूतानां प्रीणनं जीवनं पयः ॥८  
 तं तात वयमन्ये च वार्षुचां पतिमीश्वरम् । द्रव्यस्तद्रेतसा सिद्धैर्यजन्ते ऋतुभिर्नरा: ॥९  
 तच्छेषणोपजीवन्ति त्रिवर्गफलहेतवे । पुंसां पुरुषकाराणां पर्जन्यः फलभावनः ॥१०  
 य एवं विसृजेद् धर्मं पारम्पर्यागतं नरः । कामालोभाद् भयाद्द्वेषात् स वै नाजोति शोभनम् ॥११

श्रीशुक उवाच -

वचो निशम्य नन्दस्य तथान्येषां व्रजौकसाम् । इन्नाय मन्युं जनयन् पितरं प्राह केशवः ॥१२

श्रीभगवानुवाच -

कर्मणा जायते जन्तुः कर्मणैव विलीयते । सुखं दुःखं भयं क्षेमं कर्मणैवाभिपद्यते ॥१३

पारको ऐवी दृष्टि होय ज नहीं. कदाच भेद दृष्टि होय तोपण उदासीनताने शत्रुनी पेठे छोडी देवी ज्ञेईअे, परंतु जे भित्र होय तेतो पोता तुल्य ज छे, तेथी तेने विचारमां साथे लेवो ज ज्ञेईअे.<sup>५</sup> माणसो समज्ञने अने समज्या वगर पण कर्म करे छे. तेओमां समज्ञने कर्म करनारने ज्ञेवी सिद्धि थाय छे तेवी गाउरिया प्रवाहनी पेठे समज्या विना करनारने थती नथी.<sup>६</sup> प्रथम तो तमे आ जे किया करवानुं धारो छो ते शास्त्र रीति प्रमाणे छे के लोकनी रीत प्रमाणे छे ? आ वात जे में पूछी तेनो उत्तर तमो भने आपवाने योग्य छो.<sup>७</sup>

नंदराय कुहे छे- ईंद्र महाराज मेघरूप छे, केमके मेघ तेमनी प्रिय मूर्तिओ छे, ए मेघ प्राणीओने तृप्ति अने श्ववन आपनार जणने वरसावे छे, माटे ते मेघोना स्वामी अने महासमर्थ ईंद्र महाराजनुं अमे तथा बीजां माणसो पण ईंद्र वरसावेला जण वडे तैयार थयेला पदार्थो वडे करेला यज्ञमां पूजन करीअे छीअे, अने पूजन करतां जे वधे छे तेथी धर्म, अर्थ अने कामनी सिद्धिने माटे पोतानी आज्ञविका कल्पीअे छीअे, एकला खेती आदि पुरुषार्थथी कांઈ थतुं नथी, मेघ ज पुरुषार्थनुं झण आपनार छे.<sup>८-१०</sup> आ धर्म ज्ञानी वृद्ध परंपराथी चात्यो आवे छे. तेने कामथी, लोभथी, भयथी के द्वेषथी जे माणस छोडी दे तेनुं कल्याण थाय नहिं.<sup>११</sup> शुकदेवज्ञ कुहे छे- आ प्रमाणे नंदरायनुं अने बीज गोवाणोनुं वयन सांभणी, श्रीकृष्णो मात्र ईंद्रने कोध यदावी तेनो गर्व उतारवा सारु नंदरायने आ प्रमाणे कहुं.<sup>१२</sup>

અસ્તિ ચેવીશ્વર: કશ્ચિત્ ફલસુપ્યન્યકર્મણામ् । કર્તારં ભજતે સોઽપિન હૃકર્તુ: પ્રભુર્હિસ: ॥૧૪  
કિમિન્દ્રેણેહ ભૂતાનાં સ્વસ્વકર્માનુર્વર્તિનામ् । અનીશેનાન્યથા કર્તુસ્વભાવવિહિતં નૃણામ् ॥૧૫  
સ્વભાવત્ત્રો હિ જનઃ સ્વભાવમનુર્વત્તો । સ્વભાવસ્થિમદં સર્વસદેવાસુરમાનુષ્મ ॥૧૬॥  
દેહાનુચ્ચાવચાજ્જન્તુ: પ્રાપ્યોત્સ્વજતિ કર્મણા । શત્રુર્મિત્રમુદાસીન: કર્મૈવ ગુરુરીશ્વર: ॥૧૭॥  
તસ્માત્ સમ્પૂજયેત કર્મ સ્વભાવસ્થ: સ્વકર્મકૃત । અજસા યેન વર્તેત તદેવાસ્ય હિ દૈવતમ् ॥૧૮

ભગવાન કહે છે- જીવ પોતાના કર્મથી જ જન્મે છે, મરે છે અને સુખ દુઃખ,  
ભય તથા કલ્યાણને પણ કર્મથી જ પામે છે. માટે દેવતાઓ કર્મના ફળ આપે છે  
એમ માનવું યોગ્ય નથી.<sup>૧૩</sup> પૂર્વ મીમાંસાની રીતિ પ્રમાણે કર્મજ સીધે સીધું ફળ  
આપે છે, આવો નિશ્ચય છે, તેમાં વચ્ચે દેવોને લેવાની કોઈ જરૂર નથી. પણ  
કેટલાકના માનવા પ્રમાણે કોઈ દેવ, જીવોએ કરેલાં કર્મનાં ફળ આપે છે એમ  
ઘડી ભર સ્વીકારીએ, તો પણ દેવ કર્મને પરતંત્ર થયા; કેમકે કર્મ કરનારને જેવું  
કર્મ કર્યું હશે તેવું ફળ તે આપી શકશે, પણ કર્મ નહિ કરે તેને તે કાંઈ પણ આપી  
શકવાના નથી.<sup>૧૪</sup> આ ઉપરથી આપોઆપ સિદ્ધ થાય છે કે ફળની સિદ્ધિતો કર્મથી  
જ છે, માટે દેવ કર્મને પરતંત્ર રહેવાને લીધે બકરીના ગળાના આંચળ જોવા વ્યર્થ  
છે, એમાં દેવનું કાંઈ કામ નથી. અહીં જે ઈંડ પોતપોતાના કર્મને અનુસરનારા  
પ્રાણીઓનાં પૂર્વજન્મના સંસ્કારે જ કરાવેલાં કર્મને ફેરવી નાખવાને અસમર્થ છે,  
એવા ઈન્દ્રનું શું કામ છે?<sup>૧૫</sup> લોકો પોતાના પૂર્વ સંસ્કારને આધીન હોવાથી તેને જ  
અનુસરે છે. અને દેવ, અસુર તથા મનુષ્યો સહિત આ સધળું જગત્  
પૂર્વસંસ્કારમાંજ રહેલું છે, માટે દેવો પણ પૂર્વ સંસ્કારને આધીન છે. કર્મની પ્રવૃત્તિ  
પણ સંસ્કારાધીન છે, તો તે પ્રવૃત્તિમાં અંતર્યામી ઈશ્વરની પણ કોઈ અપેક્ષા નથી.<sup>૧૬</sup>  
પૂર્વસંસ્કારે થતું કર્મ જ સર્વેનું કારણ છે માટે કર્મને જ પૂજાવું જોઈએ. જીવ કર્મથી  
જ ઊંચા નીચા દેહ પામીને પાછા કર્મથી જ તેઓને છોડી દે છે. ઈશ્વર છે એ પણ  
સર્વસ્વ કર્મ જ છે. પ્રથમ શત્રુ હોય અને પાછળથી મિત્ર જોવામાં આવે છે, અને  
પ્રથમ મિત્ર હોય અને પાછળથી ઉદાસીન જોવામાં આવે છે, એ પણ કર્મથી જ  
થાય છે. ઈશ્વર સર્વસ્વ કર્મ છે. માટે પૂર્વસંસ્કારને આધીન રહીને કર્મ કરનારાએ  
પોતાના કર્મનું જ પૂજન કરવું જોઈએ. દેવતાઓને ઉદ્દેશીને દ્રવ્યનો ત્યાગ કરવો.  
એ જ કર્મ છે. માટે દેવતાઓ વિના કર્મની સિદ્ધિ કેમ થશે? એમ તમારા મનમાં  
હોય તો પણ તે દેવતાઓ કર્મના અંગભૂત ઠરે છે, પણ મુખ્ય તો કોઈ રીતે ઠરતા

આજીવ્યકૃતરં ભાવં યસ્ત્વન્યમુપજીવતિ । ન તસ્માદ્ વિન્દતે ક્ષેમ જારં નાર્યસતી યથા ॥૧૯॥  
વર્તેત બ્રહ્મણ વિપ્રો રાજન્યો રક્ષયા ભુવ: । વૈશ્વસ્તુ વાર્તયા જીવેચ્છ્વદ્ભસ્તુ દ્વિજસેવયા ॥૨૦॥  
કૃષિવાળિયગોરક્ષા કુસીદં તુર્યમુચ્યતે । વાર્તા ચર્તુર્વિધા તત્ત્વ વયં ગોવૃત્તયોઽનિશમ् ॥૨૧॥  
સત્ત્વં રજસ્તમ ઇતિ સ્થિત્યત્ત્યનહેતવઃ । રજસોત્પદ્યતે વિશ્વમન્યોન્યં વિવિધં જગત ॥૨૨॥  
રજસા ચોદિતા મેધા વર્ષન્યમ્બ્રનિ સર્વત: । પ્રજાસ્તૈરેવ સિદ્ધ્યાનિ મહેન્દ્ર: કિં કરિષ્યતિ ॥૨૩  
ન ન: પુરો જનપદા ન ગ્રામા ન ગૃહા વયમ् । નિત્યં વનૌકસસ્તાત વનશૈલનિવાસિન: ॥૨૪  
તસ્માદ્ ગવાં બ્રાહ્મણાનામદ્રેશાર્થ્યતાં મખ: । ય ઇન્દ્રયાગસમ્ભારાસ્તૈરયં સાધ્યતાં મખ: ૨૫  
પચ્ચન્તાં વિવિધા: પાકા: સૂપાન્તા: પાયસાદય: । સંયાવાપૂર્પશકુલ્ય: સર્વદોહશ્ચ ગૃહ્યતામ  
નથી. ઈશ્વરને કર્મનાં ફળ આપનાર સમજવામાં પણ ઉપર પ્રમાણે તેને કર્મમાં  
અંગપણું આવે છે. વાસ્તવિક વિચાર કરો તો જેથી જેની આજીવિકા અનાયાસે  
ચાલે તે જ તેનો દેવતા કહેવાય. <sup>૧૭-૧૮</sup> જેમ વ્યભિચારી સ્ત્રી જાર પુરુષને સેવવાથી  
કલ્યાણને પામે નહીં, તેમ જે માણસ એકે આપેલી આજીવિકા છોડી, બીજાનું  
સેવન કરે તે માણસ પણ તેને સેવવાથી સુખ પામેજ નહીં. <sup>૧૯</sup> બ્રાહ્મણે  
વેદાધ્યયનાદિકથી, ક્ષત્રિયે પૃથ્વીની રક્ષાથી, વેશ્યે વાર્તાથી અને શુદ્રે દ્વિજ લોકોની  
સેવાથી વર્તવું જોઈએ. <sup>૨૦</sup> ઉપર જે વાર્તા નામની આજીવિકા કહી તેના ખેતી,  
વેપાર, ગાયોનું રક્ષણ અને વ્યાજ લેવું, આ ચાર પ્રકાર છે. તેઓમાં આપણી  
આજીવિકા તો ગાયોના રક્ષણથી નિરંતર ચાલે છે. <sup>૨૧</sup> પણ ગાયોની આજીવિકા  
ઈન્દ્રને આધીન છે, એમ સમજવું નહીં, કેમકે સત્ત્વ, ૨૪ અને તમ એ ન્રણગુણ  
જગતની સ્થિતિ, ઉત્પત્તિ અને પ્રલયના કારણરૂપ છે. અનેક પ્રકારવાળું જગત  
રજોગુણથી થયેલ સ્ત્રીપુરુષના સંયોગથી ઉત્પત્ત થાય છે. <sup>૨૨</sup> વાદળાં રજોગુણની  
પ્રેરણાથી જ સર્વ સ્થળમાં પાણી વરસાવે છે. જો ઈંડ વરસાવતો હોય તો સમુદ્ર  
શીલા અને ખારી ધરતી આદિમાં તે સમજુના હાથે મઝતની વૃષ્ટિ ન થવી જોઈએ.  
આથી સિદ્ધ થાય છે કે સધળી પ્રજા મેધથી જ જીવે છે, તેમાં ઈંડનું કશું કામ  
નથી. <sup>૨૩</sup> આપણને યોગક્ષેમને માટે પણ ઈંડાદિક દેવતાઓની અપેક્ષા નથી, કેમકે  
આપણને દેશ, નગર, ગામડાં કે ઘર કાંઈ પણ નથી. આપણે તો વગડાઉ માણસ  
છીએ, અને નિરંતર વન તથા પર્વતોમાં જ રહીએ છીએ, માટે આપણું યોગક્ષેમ  
કરનારા દેવ તો વન અને પર્વતો જ છે. એટલા માટે ગાયો, બ્રાહ્મણો અને પર્વતોનો  
યજ્ઞ આરંભો. ઈંડના યજ્ઞને માટે જે સામગ્રી ભેણી કરી છે, તે સામગ્રીથી આ  
યજ્ઞને સિદ્ધ કરો. <sup>૨૪-૨૫</sup> અનેક પ્રકારની રસોઈ કરાવો, લાપશી, માલપુવા, જલેબી,

હૃયન્તામગનય: સમ્યગ् બ્રાહ્મણૈર્બ્રહ્મવાદિભિ: । અત્રં બહુવિધં તેભ્યો દેયં વો ધેનુદક્ષિણા: ॥૨૭  
અન્યેભ્યશ્ચાશ્વચાપણદાલપતિતેભ્યો યથાર્હતઃ । યવસં ચ ગવાં દત્તવા ગિરયે દીયતાં બલિઃ ॥૨૮  
સ્વલઙ્કૃતા ભુક્તવન્તઃ સ્વનુલિસા: સુવાસસ: । પ્રદક્ષિણં ચ કુરુત ગોવિપ્રાનલપર્વતાન् ॥૨૯  
એતન્મમ મતં તાત ક્રિયતાં યદિ રોચતે । અયં ગોબ્રાહ્મણાદ્રીણાં મહ્યં ચ દયિતો મખઃ ॥૩૦

## શ્રીશુક ઉવાચ -

કાલાત્મના ભગવતા શક્રદર્પ જિધાંસતા । પ્રોક્તં નિશાસ્ય નન્દાદ્યા: સાધ્વગૃહન્ત તદ્વચઃ ૩૧  
તથા ચ વ્યવધુ: સર્વ યથાઽહ મધુસૂદન: । વાચયિત્વા સ્વસ્ત્યયનં તદ્વદ્વ્યેણ ગિરદ્વિજાન્ ૩૨  
ઉપહૃત્ય બલીન્ સર્વાનાદૃતા યવસં ગવામ । ગોધનાનિ પુરસ્કૃત્ય ગિરિચક્રુ: પ્રદક્ષિણમ् ॥૩૩॥  
અનાંસ્યનદુદ્વૃક્તાનિ તે ચારુહ્ય સ્વલઙ્કૃતા: । ગોપ્યશ્ચ કૃષ્ણવીર્યાળિ ગાયન્ત્રઃ સદ્વિજાશિષ: ૩૪  
કૃષ્ણસ્ત્વન્યતમં રૂપં ગોપવિશ્રાંભણં ગતઃ । શૈલોઽસ્મીતિ બ્રુવન્ ભૂરિ બલિમાદદ્વબ્રહ્મપુ: ૩૫  
તસ્મે નમો બ્રજજનૈ: સહ ચક્રોઽત્મનાઽજત્મને । અહો પશ્યત શૈલોઽસૌ રૂપી નોઽનુગ્રહું વ્યધાત ૩૬

દૂધ, દહીં, દૂધપાક, દાળ આદિ સર્વે પદાર્થોને એકદા કરો. અને વેદીઆ બ્રાહ્મણો  
પાસે અભિનામાં સારી રીતે હોમ કરાવો, અને તે બ્રાહ્મણોને ધણા પ્રકારનું અન્ન,  
ગાયો તથા દક્ષિણા આપો. <sup>૨૭</sup> કૂતરાં, ચંડાળ અને પતિત પર્વત બીજાં પ્રાણીઓને  
પણ યથાયોગ્ય રીતે અન્ન આપો, ગાયોને ધાસ, પર્વતોને બલિદાન આપો. <sup>૨૮</sup>  
ત્યાર પછી શાશગારેલી જમીનમાં ચંદનાદિકનાં લેપન કરી તથા સારાં સારાં વઞ્ચ  
પહેરી, ગાયો, બ્રાહ્મણો, અભિનામો અને પર્વતને પ્રદક્ષિણા કરો. <sup>૨૯</sup> હે પિતા ! આ  
પ્રમાણે મારો મત છે, તે જો તમને રૂચે તો કરો. ગાયો, બ્રાહ્મણો અને આ પર્વતોનો  
યજ્ઞ મને ટીક લાગે છે. <sup>૩૦</sup> (આપ્રમાણે શ્રીકૃષ્ણ ભગવાને પિતા નંદરાયને કહ્યું.)

શુક્દેવજી કહે છે- ઈંદ્રના ગર્વને નાશ કરવા ઈચ્છિતા કાળરૂપ ભગવાનનું  
તે વચન સાંભળીને, નંદ આદિ ગોવાળોએ સારું સારું, એમ કહી તેનો સ્વીકાર  
કર્યો. <sup>૩૧</sup> જે પ્રમાણે ભગવાને કહ્યું તે પ્રમાણે સર્વે કર્યું, સ્વસ્તિવાચન કરાવી, ઈંદ્રના  
યજ્ઞના પદાર્થોથી પર્વત અને બ્રાહ્મણોને બલિદાન આપી, ગાયોને ધાસ ખવરાવી  
તથા ગાયોના ધણને આગળ કરી, સર્વેલોકોએ ગોવર્ધન પર્વતને પ્રદક્ષિણા કરી. <sup>૩૨</sup>-  
<sup>૩૩</sup> ભગવાનના પરાક્રમોનું ગાયન કરતી ગોપીઓ અને ગોવાળોએ બળદગાડાંઓ  
ઉપર બેસીને પ્રદક્ષિણા કરી અને બ્રાહ્મણોના આશીર્વાદ લીધા. <sup>૩૪</sup> ગોવાળોને  
વિશ્વાસ આવે તેમાટે બીજું મોટું રૂપ ધરી ‘હું પર્વત છું’ એમ બોલતા ભગવાન  
ધણું બલિદાન જમી ગયા. <sup>૩૫</sup> વ્રજના લોકો સાથે શ્રીકૃષ્ણ ભગવાન પણ અહો !  
જુઓ ! આ પર્વતે મૂર્તિમાન થઈને આપણા પર અનુગ્રહ કર્યો. આ પર્વત પોતાનું

એષોડવજાનતો મર્ત્યાન્ કામરૂપી વન્નैકસ: । હન્તિ હૃસ્મૈ નમસ્યામ: શર્મણે આત્મનો ગવામ् ૩૭  
ઇત્યદ્રિગોદ્વિજમખં વાસુદેવપ્રણોદિતાઃ ॥ યથા વિધાય તે ગોપા: સહકૃષ્ણા બ્રજમ् યયુઃ ॥૩૮

ઇતિ શ્રીમદ્બાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્દ્યે પૂર્વાર્થ  
ચતુર્વિશોઽધ્યાય: ॥૨૪॥

## અથ પञ્ચવિંશોઽધ્યાય: (૨૫)

## શ્રીશુકઉવાચ

ઇન્દ્રસ્તદાઽત્મન: પૂજાં વિજ્ઞાય વિહતાં નૃપ! । ગોપેભ્ય: કૃષ્ણાનથેભ્યો નંદાદિભ્યશ્રુકોપ સ: ૧  
ગણં સાંવર્તકં નામ મેઘાનાં ચાન્તકારિણામ् । ઇન્દ્ર: પ્રાચોદયત્ કુલ્દો વાક્યં ચાહેશમાન્યુત ૨  
અહો શ્રીમદ્માહાત્મયં ગોપાનાં કાન્નૌકસામાં । કૃષ્ણં મર્ત્યમુપાશ્રિત્ય યે ચક્રુદ્વેહલનમ् ॥૩  
યથાદ્વાદૈ: કર્મમયૈ: ક્રતુભર્નામનૌનિભૈ: । વિદ્યામાન્વાક્ષિકી હિત્વા તિતીર્ષન્તિ ભવાર્વમ् ૪

અપમાન કરનાર વનવાસીઓને યથેષ્ટરૂપ ધરી મારી નાખે છે, માટે આપણા  
અને ગાયોના કલ્યાણને અર્થે આને પણ આપણે પ્રણામ કરીએ એમ કહીને તે  
સર્વે મૂર્તિમાન શ્રીકૃષ્ણના બીજા સ્વરૂપને ગોવર્ધન માનીને પગો લાગ્યા. <sup>૩૬-૩૭</sup>  
ભગવાને પ્રેરેલા તે ગોવાળો આ પ્રમાણે પર્વત, ગાયો અને બ્રાહ્મણોના યજ્ઞને  
યથાર્થ રીતે સંપૂર્ણ કરી શ્રીકૃષ્ણની સાથે પ્રજમાં ગયા. <sup>૩૮</sup>

ધતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ રૂપદાનો યોવીશમો અદ્યાય સંપૂર્ણ.

## અદ્યાય ૨૫

## ગોકુળની રક્ષા માટે ગોવર્ધન પર્વતને ઉપાડતા ભગવાન.

શુક્દેવજી કહે છે- હે રાજા ! તે સમયે ઈંદ્રે પોતાની પૂજાનો ભંગ થયો જાણી,  
નંદાદિક ગોવાળો કે જેઓના સ્વામી શ્રીકૃષ્ણ જ છે તેમના ઉપર કોપ કર્યો. <sup>૧</sup> કોષે  
ભરાએલા ઈંદ્રે પ્રલય કરનારા મેઘના સાંવર્તક નામના ગણને પ્રજ ઉપર  
વરસવાની આજ્ઞા કરી, અને હું જ ઈશ્વર છું એવા ગર્વથી કહ્યું કે- “અહો !  
વગડામાં રહેનારા ગોવાળોએ કે જે મરી જનારા કૃષ્ણનો આશ્રય લઈ દેવોનું  
અપમાન કર્યું. તેને લક્ષ્મીનું કેવું અભિમાન આવ્યું છે એ તો જુઓ! ! !” <sup>૨-૩</sup> જેમ  
યાજીકો પ્રભુવિદ્યાનો ત્યાગ કરી નામ માત્રથી જ નૌકાની સમાન અને કેવળ  
કિયામય એવા યજ્ઞનો આશ્રય કરી સંસારસાગરને તરવાની ઈચ્છા કરે છે. એ

वाचालं बालिशं स्तब्धमज्जं पण्डितमानिनम् । कृष्णं मर्त्यमुपाश्रित्य गोपा मे चक्रुरप्रियम् ५  
एषां श्रियावलिसानां कृष्णोनाध्मायितात्मनाम् । धुनुत श्रीमदस्तम्भं पशून् नयत संक्षयम् ६  
अहं चैरावतं नागमारुह्यानुव्रजे व्रजम् । मरुद्रौणैर्महावीर्यैर्नन्दगोष्टजिघांसया ॥७

## श्रीशुक उवाच

इत्थं मधवताऽऽज्ञसा मेधा निर्मुक्तबन्धनाः । नन्दगोकुलमासारैः पीडयामासुरोजसा ॥८  
विद्योतमाना विद्युद्धिः स्तनन्तः स्तनयितुभिः । तीव्रैर्मरुद्रौणैर्नुन्ना वृषुर्जलशर्कराः ॥९  
स्थूणास्थूला वर्षधारा मुञ्चत्स्वध्रेष्वभीक्षणशः । जलौधैः प्लाव्यमाना भूर्नादृश्यत नतोन्नतम्  
अत्यासारातिवातेन पश्चो जातवेपनाः । गोपा गोच्यश्च शीतार्ता गोविन्दं शरणं ययुः ॥११  
शिरः सुतांश्च कायेन प्रच्छाद्यासारपीडिताः । वेपमाना भगवतः पादमूलमुपाययुः ॥१२  
कृष्ण कृष्ण महाभाग! त्वन्नाथं गोकुलं प्रभो! । त्रातुर्महसि देवान्नः कुपिताद् भक्तवत्सल!  
शिलावर्धनिपातेन हन्यमानमचेतनम् । निरीक्ष्य भगवान् मेने कुपितेन्नकृतं हरिः ॥१४  
अपर्त्त्वत्युल्बणं वर्षमतिवातं शिलामयम् । स्वयागे विहतेऽस्माभिरिन्द्रो नाशाय वर्षति ॥१५

मूढ़ छे. तेम बहु बक्नार, पोताने पंडित माननार, बाणक, नम्रता वगरनो  
उद्धत गोवाणियो, जे श्रीकृष्ण मनुष्य छे तेनो आश्रय लईने, सुभी थवा ईछिता  
अेवा मूढ़ गोवाणो अभिय कर्यु छे.<sup>४५</sup> लक्ष्मीथी इकेला अने कृष्णे यडावेला  
अे गोवाणोनी लक्ष्मीना मदथी थयेली अकडाईने तोडी नाखो, अने पशुओनो  
क्षय करी नाखो.<sup>६</sup> हुं पश ऐरावत छाथी उपर बेसी, भारे बणवाणा देवताओना  
सैन्यनी साथे तमारी पछवाडे ज व्रजमां आवुं छुं.<sup>७</sup> आ प्रमाणे ईंद्रे आशा करतां  
बंधनमांथी इरहेला भेद भारे जोरथी नंदरायना गोकुणने पीडवा लाग्या.<sup>८</sup>  
वीजणी जबकवा लागी, कडाका अने गर्जनाओ थवा लागी, तीव्र पवनोना  
जपाटाथी करा पडवा लाग्या.<sup>९</sup> वाणां सखात मुशण जेवी धारोओथी वरसवा  
लाग्यां, तेथी जणथी ढंकावा मांडेली पृथ्वी ऊंची के नीची देखाती न हती.<sup>१०</sup>  
अत्यंत वरसाए अने पवनथी ध्रूजतां अने टाढथी पीडा पामतां पशु, गोवाणो  
अने गोपीओ भगवानने शरणे गयां.<sup>११</sup> वरसाएथी पीडा अेला अने ध्रूजता लोको  
पोताना नाना छोकरांओने शरीरथी ढांकीने भगवानना यरणानी पासे आव्या  
अने कहुं के- हे कृष्ण! हे भक्तवत्सल! आप कोप पामेला ईंद्रथी अमारुं रक्षणा  
करो.<sup>१२-१३</sup> भगवान पश पोताना गोकुणने वरसाएथी पीडा पामतुं अने मृतप्राय  
थयेलुं जोर्ने, आ काम ईंद्रे ज करेलुं छे अेम जाणी गया.<sup>१४</sup> अमे यज्ञनो भंग  
कर्यो तेथी अमारो नाश करवा माटे ऋतु विना धणा पवनवाणी करानी वृष्टि करे

तत्र प्रतिविधिं सम्यगात्मयोगेन साधये । लोकेशमानिनां मौद्याद्विष्ये श्रीमदं तमः ॥१६  
न हि सद्भावयुक्तानां सुराणामीशविस्मयः । मत्तोऽसतां मानभङ्गः प्रशमायोपकल्पते ॥१७  
तस्मान्मच्छरणं गोष्ठं मन्नाथं मत्परिग्रहम् । गोपाये स्वात्मयोगेन सोऽयं मे व्रत आहितः ॥१८  
इत्युक्त्वैकेन हस्तेन कृत्वा गोवर्धनाचलम् । दधार लीलया कृष्णश्छत्राकमिव बालकः १९  
अथाह भगवान् गोपान् हेऽम्ब तात व्रजौकसः । यथोपजोषं विशत गिरिर्गर्तं सगोधनाः २०  
न त्रास इह वः कार्यो मद्भस्ताद्रिनिपातने । वातवर्षभयेनालं तत्वाणं विहितं हि वः ॥२१  
तथा निर्विविशुर्गर्तं कृष्णाश्चासितमानसाः । यथावकाशां सधनाः सब्रजाः सोपजीविनः ॥२२  
क्षुत्तद्व्याथां सुखापेक्षां हित्वा तैर्वजवसिभिः । वीक्ष्यमाणो दधावद्विं समाहं नाचलत् पदात् २३  
कृष्णयोगानुभावं तं निशाम्येन्द्रोऽतिविस्मितः । निःस्तम्भो भ्रष्टसङ्कल्पः स्वान् मेधान् संन्यवारयत् २४  
खं व्यभ्रमुदितादित्यं वातवर्षं च दारुणम् । निशाम्योपरतं गोपान् गोवर्धनधरोऽब्रवीत् ॥२५

छे, तो आ प्रसंगमां मारा योगबणी छुं सारी रीते रक्षानो उपाय करीश, अने  
मूढपणाथी लोकपाणपणानुं अभिमान राखनारा देवताओना लक्ष्मीना मदरुपी  
अंधाराने हरी लईश.<sup>१५-१६</sup> सत्वगुणवाणा देवताओने समर्थपणानुं अभिमान  
न थवुं जोर्ने, पश थयुं छे माटे ते दुष्टोनुं मानभंग करीश, अेझ मारो तेना  
उपर अनुग्रह गणाशे.<sup>१०</sup> अेटला माटे गोकुण के जेनो स्वामी छुं ज छुं, में ग्रहण  
करेलुं छे अने मारे ज शरणे छे तेथी शरणागतनुं रक्षण करवुं ए मारुं बिरुद छे,  
तेथी कोई पश उपाये योगबणी तेनुं रक्षण करीश.<sup>११</sup> अेम कही बाणक जेम  
जिलाईना टोपने उभेडे तेम, भगवाने लीला मात्रथी एक हाथवडे गोवर्धन पर्वतने  
धरी लीधो.<sup>१२</sup> पछी भगवाने कहुं के “हे माता! हे पिता! हे व्रजवासीओ! तमे  
गायोनां धण सहित आ पर्वतना तणियामां सुभेथी प्रवेश करो.”<sup>२०</sup> अहीं मारा  
हाथमांथी पर्वत पडवानी बीक राखशो नहीं, पवन अने वरसाएनी बीक दूर  
थई समझो. में आ तमारा सारु रक्षण कर्यु छे”<sup>२१</sup> आ प्रमाणे भगवाने आश्यासन  
आपवाथी धीरजवाणा थयेला व्रजवासीओ, गायो, गाडां अने अनुयरो सहित  
सर्वे पर्वतना तणियामां पेठां.<sup>२२</sup> भूष तरसनी पीडा तथा सुखनी अपेक्षा छोडी  
दईने गोवाणो जेमनी सामुं जोया करता हता, अेवा भगवान सात दिवस सुधी  
पर्वत धरी रह्या.<sup>२३</sup> आवुं भगवाननुं योगबण जोर्ने बहु ज विस्मय पामेला,  
गर्व रहित थयेला अने जेनो संकल्प भांगी गयो छे एवा ईंद्रे पोताना भेदने  
वार्या.<sup>२४</sup> गिरिधारी भगवान आकाशने वाणां विनानुं, सूर्यना प्रकाशवाणुं जोर्ने  
तेमज भयंकर वायु तथा वृष्टिने शांत थयेली जोर्ने कहेवा लाग्या के हे गोवाणो !

निर्यात त्यजत त्रासं गोपाः सस्त्रीधनार्थकाः । उपारतं वातवर्षं व्युदप्रायाश्च निमग्नाः ॥२६  
ततस्ते निर्ययुर्गोपाः स्वं स्वमादाय गोधनम् । शकटोदोपकरणं स्त्रीबालस्थविराः शनैः २७  
भगवानपि तं शैलं स्वस्थाने पूर्ववत् प्रभुः । पश्यतां सर्वभूतानां स्थापयामास लीलया २८  
तं प्रेमवेगान्निभृता व्रजौकसो यथा समीयुः परिरम्भणादिभिः ।

गोप्यश्च सस्त्रेहमपूजयन् मुदा दध्यक्षताद्विर्युयुजुः सदाशिषः ॥२९॥  
यशोदा रोहिणी नन्दो रामश्च बलिनां वरः । कृष्णमालिङ्गय युयुजुराशिषः स्नेहकातराः ३०  
दिवि देवगणाः साध्याः सिद्धगन्धर्वचारणाः । तुष्टुवुर्मुचुसुष्टुः पुष्पवर्षाणि पार्श्विव ॥३१  
शङ्खदुन्दुभयो नेदुर्दिवि देवप्रणोदिताः । जगर्गुर्न्धर्वपतयस्तुम्बुरुप्रमुखा नृप! ॥३२  
ततोऽनुरक्तैः पशुपैः परिश्रितो राजन्! स गोष्ठेसबलोऽव्रजद्वरिः ।  
तथाविधान्यस्य कृतानि गोपिका गायन्य ईयुर्मुदिता हृदिस्पृशः ॥३३॥  
इति श्रीमद्बागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वर्धे  
पञ्चविंशोऽध्यायः ॥ २५ ॥

हे गोपीओ ! धश अने बाणको सहित बहार नीकणो. वायु अने वरसाए शांत थई गयां छे. अने नदीनां जण पश धशाभरां उतरी गयां छे. २५-२६ पछी गोवाणो, स्त्रीओ, बाणको अने वृद्धो पोतपोतानी गायोनां धश लईने तथा सामान गाडांओमां भरीने बहार नीकण्या. २७ पछी श्रीकृष्ण भगवाने सर्व प्राणीओना देखतां ज ए पर्वतने प्रथमनी पेठे पृथ्वी उपर स्थिर कर्यो. २८ प्रेमना वेगथी भरायेला व्रजवासीओ यथायोऽय भगवानने भण्या, अने गोपीओये स्नेह सहित आनंदथी भगवाननी ढही, दूधादि उपचारो वडे पूजा करी तथा आशीर्वाद आप्या. २९ यशोदा, रोहिणी, नंदराय अने बण्डेव, तेओये स्नेहथी परवश थईने भगवाननुं आलिंगन करी आशीर्वाद आप्या. ३० हे राजा ! आकाशमां देवताओना गण, साध्य, सिद्ध, गंधर्व अने चारणो राज्ञ थईने स्तुति तथा पुष्पनी वृष्टि करवा लाग्या. ३१ स्वर्गमां देवोनी आशाथी शंभ अने हुंदुभिवागवा लाग्यां. तुंबरु आहि गंधर्वो गायन करवा लाग्या. ३२ हे राजा ! पछी स्नेहवाणा गोवाणोथी वीटायेला भगवान श्रीकृष्ण बणरामनी साथे पोताना व्रजमां पधार्या. हृदयमां वसी गयेला भगवानना तेवा कर्मोनुं गायन करती अने राज्ञ थती गोपीओ पश व्रजमां गई. ३३

इति श्रीमद् महापुराण भागवतना दशम रक्ष्यानो परीशमो अद्याय संपूर्णः.

अथ षड्विंशोऽध्यायः (२६)

श्रीशुक उवाच

एवंविधानि कर्माणि गोपाः कृष्णस्य वीक्ष्य ते । अतद्वीर्यविदः प्रोचुः समभ्येत्य सुविस्मिताः १  
बालकस्य यदेतानि कर्माण्यत्यद्भुतानि वै । कथमहृत्यसौ जन्म ग्राम्येष्वात्मजुगुप्सितम् ॥२  
यः समहायनो बालः करेणैकेन लीलया । कथं बिभ्रद् गिरिकरं पुष्करं गजराडिव ॥३  
तोकेनामीलिताक्षेण पूतनाया महौजसः । पीतः स्तनः सह प्राणैः कालेनेव वयस्तनोः ॥४  
हिन्वतोऽधः शयानस्य मास्यस्य चरणावुदक् । अनोऽपतद् विपर्यस्तं रुदतः प्रपदाहतम् ॥५  
एकहायन आसीनो ह्रियमाणो विहायसा । दैत्येन यस्तृणावर्तमहन् कण्ठग्रहातुरम् ॥६  
क्वचिद्द्वैयङ्गवस्तैन्ये मात्रा बद्ध उलूखले । गच्छन्नर्जुनयोर्मध्ये बाहुभ्यां तावपातयत् ॥७  
वने सञ्चारयन् वत्सान् सरामो बालकैर्वतः । हन्तुकामं बकं दोर्भ्या मुखतोऽरिमपाटयत् ॥८  
वत्सेषु वत्सरूपेण प्रविशन्तं जिघांसया । हत्वा न्यपातयतेन कपित्थानि च लीलया ॥९

अद्याय २६  
भगवाननां अद्भुत कर्माणि विस्मय पामेला गोवाणो प्रत्ये  
गर्गाचार्यनी उक्तिनुं वार्तान उरता नंदराय.

शुकदेवज्ञ कहे छे- हे राजा ! श्रीकृष्णनां आवां पराकम जोईने विस्मय पामेला गोवाणो, भगवाननी परम शक्ति नहि जाशवाथी नंदरायने कहेवा लाग्या के बाणकनुं आ कर्तव्य अति अद्भुत छे, माटे आपणा जेवा गामियाने मध्ये ए बाणकने न धटे एवो जन्म केम थयो हशे. १-२ हाथी जेम कमणने धरी ले, तेम सात वर्षनी बाल्यावस्थामां आ बाणके एकहाथवडे लीला मात्रथी मोटो पर्वत केम उपाऊचो हशे ? ३ शरीरनी युवानीने जेम काण गणी जाय, तेम सूतेलो आ बाणक मोटा बणवाणी पूतनाना स्तनपाननी साथे तेना ग्राणने पश गणी गयो. ! ४ त्रष महिनानो अने गाडां नीये सूतेलो आ बाणके रडीने पोताना पग उंचा करतां गाढुं उंधुं पाइयुं ! ५ एक वर्षनी अवस्थामां आ बाणक बेठेल हतो त्यां तेने तृष्णावर्त देत्य आकाश मार्गे लई जतां ए देत्यने गणुं पकडवाथी परवश करीने आ बाणके शी रीते मार्यो हशे ? ६ वणी कोई समये माखणनी योरी करतां माताए खांडिण्या साथे बांधेला एवा आ कृष्णे बे जाडनी वय्ये नीकणतां पोताना बे हाथवते आ जाडने केवी रीते पाडी नाख्यां हशे ? ७ वाइरडांओने चारता, वनमां बाणकोथी वीटायेला अने बणराम सहित आ बाणकने, मारवा आवेला शत्रु

हत्वा रासभदैतेयं तद्वन्धुंश्च बलान्वितः । चक्रे तालवनं क्षेमं परिपक्व फलान्वितम् ॥१०  
प्रलम्बं धातयित्वोग्रं बलेन बलशालिना । अमोचयद् व्रजपशून् गोपांश्चारण्यवह्निः ॥११  
आशीविषतमाहीन्द्रं दमित्वा विमदं हृदात् । प्रसह्योद्भास्य यमुनां चक्रेऽसौ निर्विघोदकाम् ॥१२  
दुस्त्यजश्चानुरागोऽस्मिन् सर्वेषां नो व्रजौकसाम् । नन्द! ते तनयेऽस्मासु तस्याप्यौत्पत्तिकःकथम् ॥१३  
क्रसमहायनो बालः क्रमहाद्रिविधारणम् । ततो नो जायते शङ्खा व्रजनाथ! तवात्मजे ॥१४

## नन्द उवाच

श्रूयतां मे वचो गोपा व्येतु शङ्खा च वोऽर्भके । एनं कुमारमुद्दिश्य गर्गो मे यदुवाच ह ॥१५  
वर्णास्त्रयः किलास्यासन् गृह्णतेऽनुयुगं तनूः । शुक्लो रक्तस्तथा पीत इदानीं कृष्णातां गतः ॥१६  
प्रागयं वसुदेवस्य क्रचिज्जातस्तवात्मजः । वासुदेव इति श्रीमानभिज्ञाः सम्प्रचक्षते ॥१७

ब्राक्षसुरनुं भोदुं पक्तीने तेने मारी नाभ्यो हतो !<sup>१</sup> मारवानी ईच्छाथी वाइरडाना  
रुपथी तेनी साथे रहेला हेत्यने मारी, तेनुं शब पद्मावाथी लीला मात्रमां कोठीनां  
जाइ पाई नांभ्यां हतां<sup>२</sup> बण्डेव सहित आ बाणके गधेडाना रुपवाणा धेनुकासुर  
सहित तेना बंधुओने मारी नाभी, पाकां फणवाणुं ताडवन सर्वने उपयोगमां  
आवे तेवुं करी दीधुं हतुं<sup>३</sup> बणरामनी पासे प्रलंबासुरने भरावी नाभता आ  
बाणके व्रजना पशुओने अने गोवाणोने दावानणथी छोडाव्या हता.<sup>४</sup> अतिशय  
जेरी ऐवा मोटा नागनुं दमन करी, भद रहित करी, तेने बणात्कारथी काढीने  
यमुनाने जेर रहित करी हती.<sup>५</sup> हे नंदराय ! अमो सर्वे व्रजवासीओ तमारा  
पुत्र उपरथी स्नेह केमे करीने छोडी शकीये तेम नथी, अने तमारो पुत्र पश अमारी  
उपरथी स्नेह छोडे तेम नथी. आवी रीते परस्पर स्वभाविक केवी रीते स्नेह  
थयो छे ?<sup>६</sup> हे व्रजना स्वामी ! सात वर्षनो बाणक क्यां ? अने मोटा पर्वतनुं  
धारण करवुं क्यां ? तेथी तमारा पुत्र उपर अमने शंका थाय छे के रभेने ए  
सर्वनो आत्मा होय.<sup>७</sup>

नंदराय कहे छे- हे गोवाणो ! आ कुमारने उद्देशीने गर्गाचार्ये मने जे कहुं  
हतुं, ते मारी पासेथी सांभणो, के जेथी तमारी शंका दूर थाय. “प्रत्येक युगमां  
अवतार धरता आ बाणकना धोणो, रातो अने श्याम ऐवा त्रष्ण वर्षा थया हता.  
तेमां सत्ययुगने विषे श्वेत वर्षावाणा थया हता. त्रेतायुगमां रक्त वर्षावाणा थया  
हता. द्वापर युगमां श्याम वर्षावाणा थया हता. अने अत्यारे कणियुगमां पश  
श्याम वर्षावाणा थया छे.”<sup>८-९</sup> पूर्वे कोई समयमां आ तमारो पुत्र वसुदेवनो पुत्र

बहूनि सन्ति नामानि रूपाणि च सुतस्य ते । गुणकर्मानुरूपाणि तान्यहं वेद नो जनाः ॥१८  
एष वः श्रेय आधास्यद् गोपगोकुलनन्दनः । अनेन सर्वदुर्गाणि यूमञ्जस्तरिष्यथ ॥१९  
पुरानेन व्रजपते साधवो दस्युपीडिताः । अराजके रक्ष्यमाणा जिग्युर्दस्यून् समेधिताः ॥२०  
य एतस्मिन् महाभागा: प्रीति कुर्वन्ति मानवाः । नारयोऽभिभवन्त्येतान् विष्णुपक्षानिवासुराः  
तस्मान्नन्दनः । कुमारोऽयं नारायणसमो गुणः । श्रिया कीर्त्यानुभावेन तल्कर्मसु न विस्मयः ॥२१  
इति नन्दवचः श्रुत्वा गर्गीतं व्रजौकसः । दृष्टश्रुतानुभावास्ते कृष्णस्यामिततेजसः ।

मुदिता नन्दमानर्वुः कृष्णं च गतविस्मयाः ॥२४

देवे वर्षति यज्ञविष्णवरुषा वज्राशमपर्षान्तिलैः ।

सीदत्पालपशुस्त्रि आत्मशरणं दद्वाऽनुकम्युत्प्रयन् ॥

उत्पाव्यक्रेण शैलमबलो लीलोच्छिलीर्थं यथा ।

विभ्रद् गोष्ठमपान्महेद्रमदभित्रीयान्न इन्द्रो गवाम् ॥२५॥

इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्दे पूर्वार्थे  
षड्विंशोऽद्यायः ॥२६॥

थयो हतो. तेथी सभजु लोको आने “वासुदेव” कहे छे.<sup>१०</sup> आ तमारा पुत्रना  
गुण अने कर्म उपरथी थयेलां नाम अने उप धणां छे. ते सर्वने आपणे कोई  
जाणता नथी.<sup>११</sup> गोवाणो अने गोकुणने राजु करनार आ पुत्र तम लोकोनुं कल्याण  
करशे अने आना प्रभावथी तमो सर्वे कष्टोने अनायासे तरी जशो.<sup>१२</sup> हे नंदजु !  
पूर्वे कोई राजा न हतो ते समयमां दुर्जनोथी पीडायेला साधु लोकोनी आ तमारा  
पुत्रे रक्षा अने वृद्धि करतां ते साधुओ योरनी समान दुर्जनोने छत्या हता.<sup>१३</sup> जे  
माणसो आना उपर प्रीति करे छे ते खरेखर महाभाग्यशाली छे, हैत्यो जेम  
विष्णुना पक्षवाणाओनो पराभव करी शक्ता नथी तेम कोई शत्रुओ आनो  
पराभव करी शके तेम नथी.<sup>१४</sup> माटे हे नंद ! आ तमारो पुत्र शुण, लक्ष्मी, कीर्ति  
अने प्रभावथी नारायण समान छे.” आ प्रमाणे गर्गाचार्ये मने कहुं हतुं, माटे  
आ बाणकना कर्तव्यमां कांઈ आश्र्य जेवुं नथी.<sup>१५</sup> मने आशा कर्या पछी गर्गाचार्य  
पोताने धेर गया, त्यारथी हुं आ मोटा काम करनारा कृष्णने साक्षात् नारायण  
मानुं धुं.<sup>१६</sup>

शुक्देवजु कहे छे- आ प्रमाणे नंदरायना मुखथी गर्गाचार्यनां वयन  
सांभणी, जे गोवाणोअे अपार तेजवाणा श्रीकृष्णना पराक्रम ज्ञेयां अने सांभणीं

## अथ समविंशोऽध्यायः (२७)

॥ श्रीशुक उवाच ॥

गोवर्धने धृते शैल आसाराद् रक्षिते व्रजे । गोलोकादाव्रजत्कृष्णं सुरभिः शक्र एव च ॥१  
विविक्त उपसङ्गस्य व्रीडितः कृतहेलनः । पर्पर्श पादयोरेनं किरीटेनार्कवर्चसा ॥२  
दृष्टश्रुतानुभावोऽस्य कृष्णस्यामितोजसः । नष्टित्रिलोकेशमद इन्द्र आह कृताज्जलिः ॥३

इन्द्र उवाच -

विशुद्धसत्त्वं तव धाम शान्तं तपोमयं ध्वस्तरजस्तमस्कम् ।  
मायामयोऽयं गुणसम्प्रवाहो न विद्यते तेऽग्रहणानुबन्धः ॥४॥

હतां, તે ગોવાળો તો વિસમય રહિત થઈ તથા રાજુ થઈ નંદરાય અને કૃષ્ણનો ભારે સત્કાર કરવા લાગ્યા.<sup>૨૪</sup> યજણનો ભંગ કરવાથી કોપેલા ઈંડ્રે વૃષ્ટિ કરતાં કરા અને કઠણ પવનથી જે ગોવાળો, પશુઓ, અને સ્ત્રીઓ પીડ્યો હતાં, એવા ગોકુળને પોતાની શરણો આવેલું જોઈ પોતાનું ઐશ્વર્ય પ્રગટ કરતા તે દ્યાળું ભગવાને ગોવર્ધન પર્વતને એક હાથથી ધારણ કરી, ગોકુળની રક્ષા કરી અને ઈંડ્રનું અભિમાન ઉતાર્યું. તે ગાયોના પાલક શ્રીકૃષ્ણ ભગવાન અમારી ઉપર પ્રસત્ત થજો.<sup>૨૫</sup>

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંદના છલીશમો અધ્યાય સંપૂર્ણ ॥

## अध्याय २७

કામધેનુ અને ઈન્દ્રે શ્રીકૃષ્ણ ભગવાનનો અભિષેક કર્યો ।

શુકુદેવજી કહે છે- ભગવાને ગોવર્ધન પર્વતનું ધારણ કરતાં ઈંડ્ર ભયને લીધે સ્વર્ગમાંથી ભગવાનની પાસે આવ્યો, અને ભગવાને વરસાદથી બ્રજની રક્ષા કરતાં કામધેનુ હધને લીધે ગોલોકમાંથી ભગવાનની પાસે આવી.<sup>૧</sup> અપરાધથી લજી પામેલા ઈંડ્રે એકાંતમાં મળીને પોતાના તેજસ્વી મુગટથી ભગવાનના ચરણનો સ્પર્શ કર્યો.<sup>૨</sup> અપાર તેજવાળા શ્રીકૃષ્ણનો પ્રભાવ નજરે જોવાથી અને સાંભળવાથી જેને તૈલોક્યના સ્વામી પણાનું અભિમાન ટળી ગયું હતું એવા ઈંડ્રે હાથ જોડીને સ્તુતિ કરી.<sup>૩</sup>

ઈંડ્ર સ્તુતિ કરે છે- હે કૃષ્ણ ! તમારું ધામ સત્વ, ૨૪, અને તમ આ ત્રણ માયાના ગુણોથી પરાભવ પામેલું નથી. માટે વિશુદ્ધ સત્વમય કહેલું છે. એટલા

કુતો નુ તદ્દેતવ ઈશ તત્કૃતા લોભાદયો યેઽબુધલિઙ્ગભાવા: ।  
તથાપિ દણં ભગવાન् વિભર્તિ ધર્મસ્ય ગુપ્ત્યૈ ખલનિગ્રહાય ॥૫॥

પિતા ગુરુસ્ત્વં જગતામથીશો દુરત્યય: કાલ ઉપાત્તદણં: ।  
હિતાય સ્વેચ્છાતનુભિઃ સમીહસે માનં વિધુન્વબ્જગદીશમાનિનામ् ॥૬॥  
યે મદ્દિધાજ્ઞા જગદીશમાનિનસ્ત્વાં વીક્ષ્ય કાલે�ભયમાશુ તત્મદમ् ।  
હિત્વા�ર્થમાર્ગ પ્રભજન્યપસ્મયા ઈહા ખલાનામપિ તેજનુશાસનમ् ॥૭॥

સ ત્વं મમૈશ્વર્મદપ્લુતસ્ય કૃતાગસસ્તેઽવિદુષ: પ્રભાવમ् ।  
ક્ષનું પ્રભો�થાર્થસિ મૂઢચેતસો મૈવં પુનર્ભૂત્મતિરીશ મેઽસતી ॥૮॥  
તવાવતારો�યમધોક્ષજેહ સ્વયભરાણામુર્ખભારજન્મનામ् ।  
ચમૂપતીનામભવાય દેવ ભવાય યુષ્મચ્વરણાનુવર્તિનામ् ॥૯॥

નમસ્તુભ્ય ભગવતે પુરુષાય મહાત્મને । વાસુદેવાય કૃષ્ણાય સાત્વતાં પતયે નમ: ॥૧૦

જ માટે રાગ દ્વેષાદિ દોષોથી રહિત છે, અને એ ધામ તમારી ઉપાસનારૂપી તપથી પામવા યોગ્ય છે. અને વળી તમારો જે આ માયામય સંસાર તથા સંસારનું મૂળકારણ કર્માનુભન્ધ જે તમારા ધામમાં નથી. તો પછી શરીરગ્રહણના સંબન્ધે પ્રાત થતા અને ફરીવાર શરીરસંબન્ધને આપનારા, તથા અજ્ઞાનપણાને સૂચવનારા લોભાદિક દોષો તમારા સ્વરૂપમાં હોય જ ક્યાંથી ? ન જ હોય. તોપણ તમે ધર્મના રક્ષણને માટે અને ખળપુરુષોના નિગ્રહને માટે દંડનું ધારણ કરો છો.<sup>૪-૫</sup>

જગતના પિતા, શુરુ, ઈશ્વર અને પ્રબળકાળરૂપ આપ જગતના ઈશ્વરપણાનું અભિમાન ધરાવનારા અમારા જેવાના માનનો ભંગ કરી, હિત કરવાને માટે દંડનું ગ્રહણ કરી, પોતાની ઈશ્યા પ્રમાણો ધરેલા અવતારોથી લીલા કરો છો.<sup>૬</sup>

જગતના ઈશ્વરપણાનું અભિમાન ધરાવનારા મારા જેવા મૂર્ખ લોકો ભયના સમયમાં પણ નિર્ભય એવા આપને જોઈ, તરત જ તે અભિમાનને છોડી ટેતાં ગર્વ રહિત થઈને ઉત્તમ માર્ગ પકડે છે, માટે આપની જે લીલા છે તે જ ખળ પુરુષોને દંડરૂપ છે.<sup>૭</sup> હે પ્રભુ ! એટલા જ માટે હું ઐશ્વર્યના મદથી ઘેરાએલો તમારો અપરાધી, તમારા પ્રભાવને નહીં જાણનાર અને મૂઢ બુદ્ધિવાળો છું, તેથી મારા ઉપર આપે ક્ષમા કરવી જોઈએ, અને માગું છું કે ફરીવાર મારી આવી દુષ્ટબુદ્ધિ ન થાય.<sup>૮</sup> હે દેવ ! હે મહારાજ ! પોતે ભારતુપ રાજાઓ અને વધારે ભારને ઉત્પન્ન કરનારા સેનાપતિઓના નાશને માટે અને તમારા ચરણની સેવા કરનારાઓના કલ્યાણને માટે આ પૃથ્વીમાં તમારો અવતાર થયો છે.<sup>૯</sup> સર્વના

સ્વચ્છદોપાત્તદેહાય વિશુદ્ધજ્ઞાનમૂર્તયે । સર્વસ્મૈ સર્વબીજાય સર્વભૂતાત્મને નમઃ ॥૧૧  
મયેદં ભગવન्! ગોષ્ઠનાશાયાસારવાયુભિઃ । ચેણ્ટિં વિહતે યજે માનિના તીવ્રમન્યુના ॥૧૨  
ત્વયેશાનુગૃહીતોऽસ્મિ ધ્વસ્તસ્તભો વૃથોદ્યમઃ । ઈશ્વરં ગુરુમાત્માનં ત્વામહં શરણં ગતઃ ॥૧૩

શ્રીશુક ઉવાચ -

એવં સઙ્કીર્તિઃ કૃષ્ણો મધોના ભગવાનમુમ् । મેઘગભીરીયા વાચા પ્રહસન્નિદમબ્રવીત् ॥૧૪  
શ્રીભગવાનુવાચ -

મયા તેઽકારિ મધવન्! મખભડ્ઝોઽનુગૃહ્તા । મદનુસ્મતયે નિત્યં મત્તસ્યેન્દ્ર! શ્રિયા ભૃષમ્ ૧૫  
મામૈશ્ર્વર્યશ્રીમદાન્ધો દણદ્યાર્ણિં ન પશ્યતિ । તં ભ્રણયામિ સમ્પદ્યો યસ્ય ચેચ્છાયનુગૃહ્મ ૧૬  
ગમ્યતાં શક્ત! ભર્દં વઃ ક્રિયતાં મેઝનુશાસનમ् । સ્થીર્યતાં સ્વાધિકારેષુ યુક્તૈર્વઃ સ્તમ્ભવર્જિતૈ:  
અથાહ સુર્ભિઃ કૃષ્ણમભિવન્દ્યમનસ્વિની । સ્વસન્તાનૈરૂપામન્ય ગોપરૂપિણમીશ્વરમ् ॥૧૮

અંતર્યામી, પરિચ્છેદ રહિત, સર્વના નિવાસરૂપ અને યાદવોના પતિ આપ શ્રીકૃષ્ણ ભગવાનને હું પ્રણામ કરું છું.<sup>૧૦</sup> ભક્તોની ઈચ્છા પ્રમાણે અવતાર ધરનાર, વિશુદ્ધ અને સંકોચ વિકાસથી રહિત જ્ઞાન ગુણથી યુક્ત છે મૂર્તિ જેમની, સર્વના કારણરૂપ અને સર્વ પદાર્થોના આત્મા આવા આપને હું નમન કરું છું.<sup>૧૧</sup> હે ભગવાન ! યજનો ભંગ થતાં તીવ્ર અભિમાન અને કોથને લીધે વરસાદ અને વાયુથી વ્રજનો નાશ કરવાને માટે આ કૃત્ય મેં કર્યું હતું.<sup>૧૨</sup> હે ઈશ્વર ! તમે મારા ઉદ્ઘમને વ્યર્થ કરી ગર્વનો નાશ કર્યો એ મારા ઉપર અનુગ્રહ કર્યો છે, હવે હું ઈશ્વર, ગુરુ અને પરમાત્મા આપના શરણો આવેલો છું.<sup>૧૩</sup>

શુક્ટેવજ્ઞ કહે છે- આ પ્રમાણે ઈદ્રે સ્તુતિ કરી એટલે શ્રીકૃષ્ણ ભગવાને હસીને મેધના સરખી ગંભીર વાણીથી તેને આ પ્રમાણે કહેવા લાગ્યા.<sup>૧૪</sup>

ભગવાન કહે છે- હે ઈદ્ર ! તું ઈન્દ્ર પદવીના વૈભવોથી બહુ જ ઉન્મત થઈ ગયો હતો, તેથી તને નિરંતર મારું સમરણ રહે એ માટે મેં અનુગ્રહ કરીને તારા યજનો ભંગ કર્યો છે.<sup>૧૫</sup> દંડ ધારણ કરનારો એવો જે હું, તે મને ઐશ્વર્ય અને લક્ષ્મીના મદથી આંધળો થયેલો પુરુષ દેખતો નથી, માટે હું જેના ઉપર અનુગ્રહ કરવા ધારું છું તેને સંપત્તિઓથી ભષ્ટ કરું છું.<sup>૧૬</sup> હે ઈદ્ર ! જાઓ, તમારું સારું થશે. હવે સાવધાન અને ગર્વ રહિત થઈને તમારા પોતપોતાના અધિકારમાં રહીને મારી આજ્ઞા પ્રમાણે ચાલજો.<sup>૧૭</sup>

શુક્ટેવજ્ઞ કહે છે- પછી પોતાના સંતાન સહિત ઉદાર મનવાળી ક્રામધેનું એ ગોવાળના રૂપને ધારણ કરનારા શ્રીકૃષ્ણને પ્રણામ કરી તથા હે કૃષ્ણ ! હે કૃષ્ણ !

સુરભિરુવાચ -

કૃષ્ણ કૃષ્ણ મહાયોગિન्! વિશ્વાત્મન्! વિશ્વસાખિવ! । ભવતા લોકનાથેન સનાથા વયમચ્યુત! ૧૯  
ત્વં નઃ પરમકં દૈવં ત્વં ન ઇન્દ્રો જગત્પતે! । ભવાય ભવ ગોવિપ્રદેવાનાં યે ચ સાધવઃ ॥૨૦  
ઇન્દ્રં નસ્ત્વાભિષેક્ષ્યામો બ્રહ્માણા નોદિતા વયમ् । અવતીર્ણોઽસિ વિશ્વાત્મન्! ભૂમેર્ભારાપનુત્તયે

શ્રીશુક ઉવાચ -

એવં કૃષ્ણમુપામન્ય સુરભિઃ પયસાડીતમનઃ । જલલૈરાકાશગઙ્ગાયા ઐરાવતકરોદ્ધતૈ: ॥૨૨  
ઇન્દ્ર: સુર્બિષભિઃ સાકં નોદિતો દેવમાતૃભિઃ । અભ્યાષિંશ્ચત દાશાહ્ ગોવિન્દ ઇતિ ચાભ્યધાત ૨૩

તત્ત્રાગતાસ્તુમ્બુરુનારદાદયો ગન્ધર્વવિદ્યાધારસિદ્ધચારણા: ।

જગુર્યશો લોકમલાપહં હો: સુરાઙ્ગના: સંનનૃતુર્મુદાન્ચિતા: ॥૨૪॥

તં તુષ્ટુર્વુર્દેવનિકાયકેતવો વ્યવાકિરં શાદ્વતપુષ્પવૃષ્ટિભિઃ ।

લોકા: પરાં નિર્વિતિમાનુવંસ્ત્રયો ગાવસ્તદા ગામનયન્ પયોદૃતામ્ ॥૨૫॥

નાનારસૌધા: સરિતો વૃક્ષા આસન્ મધુસ્ત્રવા: । અકૃષ્ણપચ્યૌષધયો ગિરયોઽબિભ્રદુન્મણીન્ ૨૬

એમ સંબોધન આપીને આ પ્રમાણે કહ્યું.<sup>૧૮</sup> ક્રામધેનું કહે છે હે કૃષ્ણ ! હે મોટાયોગી ! હે જગતના આત્મા ! હે જગતને ઉત્પત્ત કરનારા ! હે અચ્યુત ! ઈદ્રે તો અમને મારી નાખ્યાં હતાં, પણ જગતના નાથ આપે અમારી રક્ષા કરી.<sup>૧૯</sup> અમારા ઈષ્ટદેવ તમે છો, માટે હે જગતના પતિ ! ગાયો, બ્રાહ્મણો અને સાધુલોકોના કલ્યાણને માટે આજીથી તમે જ ઈંદ્ર થાઓ.<sup>૨૦</sup> બ્રહ્માની પ્રેરણાથી અમે તમને જ ઈન્દ્ર પદવીનો અભિષેક કરીશું, હવે ઈંદ્રનું અમારે કાંઈ કામ નથી, હે જગતના આત્મા ! તમે પૃથ્વીનો ભાર ઉતારવા માટે અવતર્યા છો.<sup>૨૧</sup>

શુક્ટેવજ્ઞ કહે છે- આ પ્રમાણે ભગવાનની આજ્ઞા લઈ ક્રામધેનું એ પોતાના દૂધથી ભગવાનનો અભિષેક કર્યો, અને દેવતાઓ તથા ઋષિઓ સહિત ઈદ્રે પણ દેવમાતાઓની પ્રેરણાથી ઐરાવત હાથીની સૂંઠવતે લાવેલા આકાશ ગંગાના જળથી ભગવાનનો અભિષેક કર્યો અને ગોવિંદ એવું નામ રાખ્યું.<sup>૨૨-૨૩</sup> તે સમયે ત્યાં આવેલા ગાંધર્વ, વિદ્યાધર, સિદ્ધ, ચારણો, તુંબરુ અને નારદાદિક મુનિઓ સાંભળનારા જનોના પાપને દૂર કરનારી ભગવાનની ક્રીતિનું ગાન કરવા લાગ્યા અને અપ્સરાઓએ આનંદથી નૃત્ય કર્યું.<sup>૨૪</sup> મુખ્ય દેવતાઓએ તેમની સ્તુતિ કરી અને અદ્ભુત પુષ્પની વૃષ્ટિઓથી વધાવ્યા, ત્રણેલોક પરમ સુખ પામ્યા, ગાયોએ પૃથ્વીને દૂધથી ભીની કરી નાખી.<sup>૨૫</sup> નદીઓમાં દૂધ આદિ રસો ચાલવા લાગ્યા, વૃક્ષોમાંથી મધની ધારાઓ જરવા લાગી, અને ખેડ્યા વગર પાકી ગયાં અને

कृष्णोऽभिषिक्त एतानि सत्त्वानि कुरुनन्दन! । निर्वैराण्यभवस्तात् क्रूराण्यपि निसर्गतः २७  
इति गोगोकुलपतिं गोविदमभिषिक्य सः । अनुज्ञातो ययौ शक्रो वृतोदेवादिभिर्दिवम् ॥२८॥

इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्दे पूर्वार्थे  
इन्द्रस्तुतिर्नाम सप्तविंशोऽध्यायः ॥२७॥

### अथाष्टाविंशोऽध्यायः (२८)

॥ श्रीशुक उवाच ॥

एकादश्यां निराहारः समभ्यर्च्य जनार्दनम् । स्नातुं नंदस्तु कालिंद्या द्वादश्यां जलमाविशत् १  
तं गृहीत्वानयद् भूत्यो वरुणस्यासुरोऽन्तिकम् । अविज्ञायासुरी वेलां प्रविष्टमुदकं निशि ॥२  
चुकुशुस्तमपश्यन्तः कृष्ण! रामेति गोपकाः । भगवांस्तदुपश्रुत्य पितरं वरुणाहृतम् ।  
तदन्तिकं गतो राजन्! स्वानामभयदो विभुः ॥३

पर्वतोमां धृपाई रहेला भाषि स्वयं भहार आववा लाग्या.<sup>२६</sup> हे राजा! जे प्राणीओ स्वभावथी ज झूर हता तेओ ऐ पाण भगवाननो अभिषेक थतां वेर भूकी धीधां.<sup>२७</sup>  
आ प्रमाणे गायो अने गोकुणना पति भगवाननो अभिषेक करी, तेमनी आशा लई देवाटिकनी साथे ईंद्र स्वरूपमां गयो.<sup>२८</sup>

इति श्रीमद् महापुराणा भागवतना दशम स्कन्दनो सत्यावीशमो अध्याय  
संपूर्णः।

### अध्याय २८

श्रीकृष्ण भगवान वस्तु लोकमांथी नंदरायने पाणा लाव्या  
अने गोवाणोने वैकुंठ देखाऊं.

शुकदेवज्ञ कहे छे- एकादशीने दिवसे नारायणानुं पूजन करी जेणे उपवास कर्यो हतो, ऐवा नंदराये बारशने दिवसे स्नान करवाने माटे यमुनाज्ञना जग्नमां दुखकी भारी.<sup>१</sup> बारशना वहेलुं पारण्युं करवा सारुं आसुरीवेणाने नहि जाणीने, रातना पाणीमां प्रवेशेला ते नंदरायने पक्कीने वरुणानो अनुज्ञा एक असुर वरुणादेवनी पासे लई गयो.<sup>२</sup> त्यार पछी प्रभाते गोवाणो नंदरायने नहीं देखवाथी, हे कृष्ण! एक तमे ज तमारा पिताने लावी शको छो, हे बणराम! अमने एक तमारो ज भरोसो छे. आ प्रमाणे ऊंचेथी कहेवा लाग्या. भक्तोने

प्रासं वीक्ष्य हृषीकेशं लोकपालः सपर्यया । महत्या पूजयित्वाऽऽह तद्वर्णनमहोत्सवः ॥४  
वरुण उवाच

अद्य मे निभूतो देहोऽद्यैवाथोऽधिगतः प्रभो! । त्वत्पादभाजो भगवन्नवापुः पारमध्वनः ॥५  
नमस्तुभ्यं भगवते ब्रह्मणे परमात्मने । न यत्र श्रूयते माया लोकसृष्टिकल्पना ॥६  
अजानता मामकेन मूढेनाकार्यवेदिना । आनीतोऽयं तव पिता तद् भवान् क्षन्तुर्महिति ॥७  
ममाप्यनुग्रहं कृष्ण! कर्तुर्महस्यशेषदृक् । गोविन्द! नीयतामेष पिता ते पितृवत्सल! ॥८  
श्रीशुक उवाच

एवं प्रसादितः कृष्णो भगवानीश्वरेश्वरः । आदायागात् स्वपितरं बन्धूनां चावहन् मुदम् ॥९  
नन्दस्त्वतीन्द्रियं दृष्ट्वा लोकपालमहोदयम् । कृष्णो च सन्तर्ति तेषां ज्ञातिभ्यो विस्मितोऽब्रवीत् १०  
ते त्वौत्सुक्यधियो राजन्! मत्वा गोपास्तमीश्वरम् । अपि नः स्वगतिं सूक्ष्मामुपाधास्यदधीश्वरः ।  
इति स्वानां स भगवान् विज्ञायाखिलदृक् स्वयम् । सङ्कल्पसिद्धये तेषां कृपयैतदचिन्तयत् १२

अभय आपनार श्रीकृष्ण भगवान गोवाणोनो आर्तनाद सांभणी, वरुणादेव पक्की लई गयेला छे ते जाणी पोते वरुणादेवनी पासे गया.<sup>३</sup> भगवानने आवेला ज्ञेई, तेमनां दर्शनथी मोटो आनंद पामेला लोकपाण वरुणादेवे मोटी पूजाथी तेमनुं पूजन करीने आ प्रमाणे कहुं.<sup>४</sup>

वरुणादेव कहे छे- आज मारो जन्म सङ्ख थयो. हे प्रभु ! आज मने सर्वोत्तम लाभ मण्यो. आजे मारो संसार पाण मटी गयो, केमके आपना चरणारविंदनुं भजन करनारा धणा पुरुषो मोक्ष पामी गया छे.<sup>५</sup> हे प्रभु ! जे ना स्वरूपमां ज्ञवना ज्ञानने संकोच पमाइनारी ऐवी माया सांभणवामां पाण आवती नथी, ऐवा परब्रह्म परमात्मा भगवान तमोने प्रणाम करुं छुं.<sup>६</sup> शास्त्रमर्यादाने तथा कर्तव्यने नहि ज्ञानारा मारा भूष अनुयरे आ तमारा पिताने अहीं लावेला छे, तो ते अपराध आप क्षमा करवाने योग्य छो.<sup>७</sup> अमो अपराधी छीअे तोपाण तमारी प्रज्ञा छीअे. माटे अमो तमारा अनुग्रहने योग्य छीअे. हे गोविन्द ! आ तमारा पिताने लई जाओ.<sup>८</sup>

शुकदेवज्ञ कहे छे- आ प्रमाणे वरुणादेवे प्रसाद करेला अने ईश्वरना ईश्वर श्रीकृष्ण भगवान पोताना पिताने लई आव्या, अने संबंधीओने आनंद आप्यो.<sup>९</sup> कोई दिवसे नहीं जो अलुं वरुणादेवनुं ऐश्वर्य ज्ञेईने अने ते देवो सर्वे श्रीकृष्णने नभ्या ते ज्ञेईने विस्मय पामेला नंदराये ते वात संबंधीओने कही देखाइ.<sup>१०</sup> हे राजा ! गोवाणो श्रीकृष्णने ईश्वर मानी मोटा उत्साही संकल्प करवा लाग्या के

जनो वै लोक एतस्मिन्नविद्याकामकर्मभिः । उच्चावचासु गतिषु न वेद स्वां गतिं भ्रमन् ॥३  
 इति सञ्ज्ञिन्यं भगवान् महाकारुणिको हरिः । दर्शयामास लोकं स्वं गोपानां तमसः परम् ॥४  
 सत्यं ज्ञानमनन्तं यद् ब्रह्म ज्योतिः सनातनम् । यद्धि पश्यन्ति मुनयो गुणापाये समाहिताः ॥५  
 ते तु ब्रह्माद्वं नीता मग्नाः कृष्णो चोद्घृताः । ददृशु ब्रह्मणो लोकं यत्राक्रूरोऽध्यगत् पुरा ॥६  
 नंदादयस्तु तं हृष्ट्वा परमानंदनिर्वृताः । कृष्णं च तत्र छन्दोभिः स्तूयमानं सुविस्मिताः ॥७  
 इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्दे पूर्वार्थं

अष्टाविंशोऽध्यायः ॥२८॥

### अथैकोनत्रिंशोऽध्यायः (२९)

॥ श्रीशुक उत्तराच ॥

भगवानपि ता रात्रीः शारदोत्कुलमङ्गिकाः । वीक्ष्य रन्तुं मनश्चक्रे योगमायामुपाश्रितः ॥१  
 तदोडुराजः ककुभः करैर्मुखं प्राच्या विलिम्पन्नरुणेन शन्तमैः ।  
 स चर्षणीनामुदगच्छुचो मृजन् प्रियः प्रियाया इव दीर्घदर्शनः ॥२॥

ईश्वर अमोने पोतानुं स्थान अने सूक्ष्म स्वरूप देखाइशे ?<sup>११</sup> सर्वश भगवाने आ प्रमाणे संबंधीओनो संकल्प जाणी लઈने, तेनो संकल्प सिद्ध करवा सारं दयाथी विचार कर्यो के देहादिकमां अहंभुद्धि अने तेथी थयेली विषयोमां तृष्णाथी थयेलां कर्मो अने कर्मोथी ऊंचा नीचा जन्मोमां भटक्तो माणस, आलोकमां पोतानी गतिने जाणतो नथी.<sup>१२-१३</sup> आ प्रमाणे विचार करीने महादयाणु श्रीकृष्ण भगवाने गोवाणोने प्रकृतिथी पर पोतानुं ब्रह्मस्वरूप देखाइयुं अने पछी वैकुंठलोक पाणे देखाइयो.<sup>१४</sup> सत्य, शानदृप, अनंत, स्वयं प्रकाश, अने निरंतर सिद्ध पोतानुं ब्रह्मस्वरूप के जेने त्राणे गुणाथी रहित थयेला समाधिनिष्ठ पुरुषो देखे छे, आवुं पोतानुं स्वरूप प्रथम देखाइयुं.<sup>१५</sup> परब्रह्मरूपी धरामां लई जઈने श्रीकृष्ण भगवाने तेमांथी पाणा काढेला ते गोवाणोअे वैकुंठलोक दीठो, के जेमां पूर्व अकूर गया हता.<sup>१६</sup> ए वैकुंठलोकने जोईने तथा तेमां वेद जेमनी स्तुति करता हता, ऐवा भगवानने जोईने नंदादिक गोवाणो बहुज आनंद पाभ्या, अने विस्मय पाभ्या.<sup>१७</sup>

इति श्रीमद् महापुराणा भागवतना दशम स्कन्दनो अठ्यावीशमो अद्याय संपूर्णः

दूष्टा कुमुद्भूतमखण्डमण्डलं रमाननार्भं नवकुङ्कुमारुणम् ।  
 वनं च तत्कोमलगोभिरञ्जितं जगौ कलं वामदृशां मनोहरम् ॥३॥  
 निशम्य गीतं तदनङ्गवर्धनं व्रजस्त्रियः कृष्णागृहीतमानसाः ।  
 आजग्मुरन्योन्यमलक्षितोद्यमाः स यत्र कान्तो जवलोलकुण्डलाः ॥४॥  
 दुहन्त्योऽभियुः काश्चिद् दोहं हित्वा समुत्सुकाः । पयोऽधिश्वित्य संयावमनुद्वास्यापारा ययुः ५  
 परिवेषयन्त्यस्तद्वित्वा पाययन्त्यः शिशून् पयः । शुश्रूषन्त्यः पतीन् काश्चिदशनन्योऽपास्य भोजनम् ६  
 लिपन्त्यः प्रमृजन्योऽन्या अज्जन्त्यः काश्च लोचने ।  
 व्यत्यस्तवस्त्राभरणाः काश्चित् कृष्णान्तिकं ययुः ॥७॥

### अद्याय २८

रासलीलाना सभारंभमां श्रीकृष्णाभगवाननुं अंतर्धान थवुं.

शुकदेवज्ञ कहे छे- शरदऋतुथी जेमां मत्विका फूली रही छे अने जेमां रमवानी पोते प्रतिज्ञा करी हती अेवी रात्रीओने जोई, योगमायाने धारण करी भगवाने रासलीला करवानो विचार कर्यो.<sup>१</sup> ज्यारे भगवाने रमवानी ईश्वा करी ते ज समये धधा काणे प्राम थयेल पति जे पोतानी प्यारीना मुखने जेम केसर लगावे, तेम पूर्व दिशारूपी स्त्रीना मुखने, पोतानी सुखकारी किरणोनी रताशथी लेपन करतो अने लोकोना तापने मटाइतो चंद्रमा, भगवानने प्रसन्न करवाने भाटे उदयने प्राम थयो.<sup>२</sup> ते दिवसे पूर्णिमा होवाथी चंद्र अंबंड अने गोणाकार हतो, लक्ष्मीना मुखनी समान शोभायमान हतो, नवीन कुंकुमनी समान लाल वर्णवाणो हतो, आवा चंद्रमाने उदय पामेलो जोईने अने तेना कोमण किरणोथी रंजित वनने जोईने, भगवाने कमिनी स्त्रीओना मनने हरण करनारो वेशुनाद कर्यो.<sup>३</sup> जे कामदेवने वधारनार ते गीतने व्रजवासी स्त्रीओअे सांभर्युं, तेथी तेओनुं चित श्रीकृष्णमां आसक्त थयुं, स्वेक बीजाने पोताना जवानी भवर न पडे ए रीते घारा श्रीकृष्णनी पासे पहेंची गई. ते समये चालवाना वेगथी कुंडो डोली रहेलां हतां.<sup>४</sup> केटलीक गोपीओ गायने दोहती हती ते गायोनुं दोहवुं छोडीने चाली, बीज चूला उपर भूकेलां दूधने वगर उतारे चाली, केटलीक कंसार चूला उपर भूकीने वगर उतारे चाली.<sup>५</sup> केटलीक पीरसती हती ते भूकीने चाली, केटलीक नानां बाणकोने धवरावती हती ते नानां बाणकोने भूकीने, केटलीक पतिनी सेवा करती हती, केटलीक भोजन करती हती ते सर्वे अधूरुं भूकीने श्रीकृष्ण पासे

ता वार्यमाणाः पतिभिः पितृभिर्भ्रातृबन्धुभिः । गोविन्दापहृतात्मानो न न्यवर्तन्त मोहिताः ८  
अन्तर्गृहगताः काश्चिद् गोप्योऽलब्ध्यविनिर्गमाः कृष्णं तद्ब्रावनायुक्ता दध्युर्मीलितलोचनाः ९  
दुःसहप्रेष्ठविरहतीव्रतापधुताशुभाः । ध्यानप्राप्ताच्युताश्लेषणिर्वृत्या क्षीणमङ्गलाः १०  
तमेव परमात्मानं जारबुद्ध्यापि सङ्गताः । जहुर्णुणमयं देहं सद्यः प्रक्षीणबन्धनाः ११

राजोवाच

कृष्णं विदुः परं कान्तं न तु ब्रह्मतया मुने । गुणप्रवाहोपरमस्तासां गुणधियां कथम् ॥१२  
श्रीशुक उवाच

उक्तं पुरस्तादेतत्ते चैद्यः सिद्धं यथा गतः । द्विष्टन्नपि हृषीकेशं किमुताधोक्षजप्रियाः ॥१३

आवी.<sup>९</sup> केटलीक लीपती हती, केटलीक अंगोने स्वर्थु करती हती, केटलीक आंघो आंजती हती ते सर्वे भूकी इ९ने भगवान पासे आवी. केटलीक तो उतावणने लीधे वस्त्रो पश्च अवणां सवणां पहेरीने आवी.<sup>१०</sup> मोह पामेली ते स्त्रीओने पोताना पति, मा-बाप भाईओ अने बंधुओ ए वारवा छतां पश्च भगवानमां ज जेनां चित खेचावाने लीधे पाई वणी नहि.<sup>११</sup> केटलीक गोपीओथी कोइ रीते नीकणी शकायुं नहीं एवी गोपीओ परमभाववाणी होवाने लीधे घरनी अंदर ज आंघो भींचीने श्रीकृष्णनुं ध्यान करवा लागी.<sup>१२</sup> ए ध्यान करनारी गोपीओ श्रीकृष्णमां कामभावे आसक्त थै हती तोपश्च, जेम अभृतने बीजुं कांई समज्ञने पीधा छतां पश्च पीनारने मरणानो भय भटे छे, तेम ते त्रण गुणानुं बंधन टणी जतां निर्गुणा पश्चाने पामी. प्रारब्ध कर्मनुं बंधन होय त्यां सुधी देह रहित थवाय नहि एवो सिद्धांत छे, तो ते प्रमाणे तेनुं पुण्य पापात्मक प्रारब्ध पश्च तुरत ज मटी गयुं; केमके श्रीकृष्णना सहन न थाय एवा विरहना तीक्र तापनुं दुःख भोगवत्वाथी तेओनां पाप बणी गयां अने ध्यानथी मणेला श्रीकृष्णना आविंगनथी प्राप्त थयेला परम सुखना भोगथी तेओनां पुण्य पश्च बणी गयां. प्रथम विरहनुं दुःख पश्च अत्यंत थयुं, पछी आविंगन सुख पश्च अत्यंत थयुं, तेथी सर्वे पाप अने पुण्यनो एक सामर्टो क्षय थवाथी प्रारब्धकर्म तूटी जतां देह पडी गयो अने भगवत्प्राप्ति थै.<sup>१०-११</sup>

परीक्षित राजा पूछे छे- हे शुक्टेवज्ञ ! आ गोपीओ श्रीकृष्णने केवण कामना करवा योग्य जाणती हती, अर्थात् परं पति तरीके जाणती हती, पश्च “परब्रह्म” तरीके जाणती न होती, तो पश्च विषयमां लंपट बुद्धिवाणी ते गोपीओनो गुणाना

नृणां निःश्रेयसार्थ्य व्यक्तिर्भगवतो नृप । अव्यवस्थाप्रमेयस्य निर्गुणस्य गुणात्मनः ॥१४  
कामं क्रोधं भयं स्नेहमैक्यं सौहृदमेव च । नित्यं हौर विदधतो यान्ति तन्मयतां हि ते ॥१५  
न चैव विस्मयः कार्यो भवता भगवत्यजे । योगेश्वरेश्वरे कृष्णे यत एतद् विमुच्यते ॥१६  
ता दृष्टान्तिकमायाता भगवान् व्रजयोषितः । अवदद् वदतां श्रेष्ठो वाचः पैशैर्विमोहयन् ॥१७

श्रीभगवानुवाच

स्वागतं वो महाभागः प्रियं किं करवाणि वः । व्रजस्यानामयं कच्चिद् ब्रूतागमनकारणम् १८  
रजन्येषा घोररूपा घोरसत्त्वनिवेतिता । प्रतियात व्रजं नेह स्थेयं स्त्रीभिः सुमध्यमाः १९  
मातरः पितरः पुत्रा भ्रातरः पतयश्च वः । विचिन्वन्ति ह्यपश्यन्तो मा कृद्वं बन्धुसाध्वसम् २०  
दृष्टं वनं कुसुमितं राकेशकररञ्जितम् । यमुनानिललीलैजत्तरुपल्लवशोभितम् ॥२१

प्रवाहुरुप संसार केम निवृत थयो ? अर्थात् भोक्ष केम थयो ?<sup>१२</sup>

शुक्टेवज्ञ कुहे छे- आ वात तमने आगण कही छे के शिशुपाण भगवाननो द्वेष करवा छतां पश्च मुक्तिपाभ्यो, त्यारे भगवान उपर प्रेम राखनारनी मुक्तिथाय तेमां शुं कुहेवुं ?<sup>१३</sup> हे राजा ! अविनाशी, अप्रभेय एवा भगवान पोते गुणोना नियंता छतां पश्च निर्गुणा छे. तेमनो अवतार मनुष्योना कल्याणने माटे ज छे. (माटे श्रीकृष्ण भगवानने ज्ञव तुल्य कुहेवा ए संभवतुं नथी.)<sup>१४</sup> भगवानमां जेओ निरंतर काम, कोध, भय, स्नेह, संबंध के भक्तिभाव राखे छे तेओ भगवानमयपश्च पामे छे. अर्थात् निर्गुणपश्चाने पामे छे.<sup>१५</sup> अजन्मा अने योगेश्वरोना ईश्वर श्रीकृष्ण भगवान के जेथी स्थावरादिक्ने पश्च मुक्तिमणे छे, माटे तेमना विषयमां तमारे जरा पश्च विस्मय पामवुं जोईअे नहि.<sup>१६</sup> निपुण वाहिओने भध्ये पश्च श्रेष्ठ भगवान श्रीकृष्ण ते गोपीओने सभीपमां आवेली जोई, वाणीना विलासथी तेमने मोहित करता आ प्रमाणे बोल्या.<sup>१७</sup> श्रीकृष्ण भगवान कुहे छे- हे महा भाग्यशाणी गोपीओ ! तमो भले आवी हुं तमारुं शुं प्रिय काम करुं ? (सर्वने उतावणी आवेली जोईने कहुं,) प्रजमां सर्वे कुशण तो छे ने ? तमारा आववानुं कारण कहो.<sup>१८</sup> (गोपीओने मंद हास्य करती जोईने कहुं,) आ रात्रि भयंकर प्राणीओ ए सेवेली छे अने पोते पश्च भयंकररूपवाणी छे, माटे प्रजमां पाई जाओ. हे सुंदरीओ ! रात्रीने विषे स्त्रीओ ए अहीं उभां न रहेवुं जोईओ.<sup>१९</sup> तमारा मा-बाप, दीकरा, भाईओ अने पतिओ तमने धरमां नहीं जोईने शोधता हशे, माटे संबंधीओने त्रास न आपो.<sup>२०</sup> विकसित फूलवाणुं, पूर्णयंद्रथी रंगाएलुं अने यमुनाना पवनथी शोत्ती

તद્યાત મા ચિરં ગોષ્ઠં શુશ્રૂષદ્વં પતીન् સતીઃ । ક્રન્દન્તિ વત્સા બાલાશ્ચ તાન् પાયયત દુહૃત ૨૨  
અથવા મર્દભિસ્તેહાદ્ ભવત્યો યત્ત્રિતાશયાઃ । આગતા હૃપપત્રં વઃ પ્રીયને મયિ જન્તવઃ ॥૨૩  
ભર્તુઃ શુશ્રૂષણં સ્ત્રીણં પરો ધર્મો હ્યામાયયા । તદ્દ્વન્ધૂનાં ચ કલ્યાણયઃ પ્રજાનાં ચાનુપોષણમ् ૨૪  
દુઃશીલો દુર્ભગો વૃદ્ધો જડો રોગયધનોઽપિ વા । પતિઃ સ્ત્રીભિર્ન હાતવ્યો લોકેપ્સુભિરપાતકી ૨૫  
અસ્વર્ગર્મયશસ્યં ચ ફલ્લુ કૃછ્યં ભયાવહમ् । જુગુપ્સિતં ચ સર્વત્ર ઔપપત્યં કુલસ્ત્રિયાઃ ૨૬  
શ્રવણાદ દર્શનાદ ધ્યાનાન્મયિ ભાવોઽનુકીર્તનાત् । ન તથા સત્ત્રિકર્ષેણ પ્રતિયાત તતો ગૃહાન् ૨૭

## શ્રીશુક ઉત્તર

ઇતિ વિપ્રિયમાકર્ણ્ય ગોપ્યો ગોવિદભાવિતમ् । વિષણા ભગ્નસક્ળ્યાશ્રિતામાપુરુત્યયામ् ૨૮  
કૃત્વા મુખાન્યવ શુચઃ શ્વસનેન શુષ્ટ્યદ્વિભાધરાણિ ચરણેન ભુવં લિખન્યઃ ।  
અસ્વૈરૂપાત્તમષિભિઃ કુચકુઙ્કુમાનિ તસ્થુર્મજન્ત્ય ઊરુદુઃખભરાઃ સ્મ તૂષ્ણીમ् ॥૨૯॥  
પ્રેષ્ટ પ્રિયેતરમિવ પ્રતિભાષમાણં ક્રણં તદર્થેવિનિવર્તિતસર્વકામાઃ ।  
નેત્રે વિમૃજ્ય રુદિતોપહતે સ્મ કિઞ્ચિત્સંરઘનગ્નદગિરોઽબુવતાનુરક્તાઃ ॥૩૦॥

રહેલું આ વન તમોએ જોઈ લીધું, તો હવે તરત પ્રજમાં જાઓ અને તમારા પતિની સેવા કરો, હે સતીઓ ! તમારાં વાઇરડાં અને છોકરાં રડતાં હશે. માટે તેઓને ધવરાવો. <sup>૨૧-૨૨</sup> (કોધથી ક્ષોલ પામેલાં નેત્રવાળી ગોપીઓને જોઈને ભગવાને કહું.) અથવા તમો મારા ઉપર સ્નેહના બંધનથી બેંચાઈને અહીં આવેલી હો તો એ તમોને યોગ્ય છે, કારણ કે મારા ઉપર સર્વ લોકો પ્રીતિ રાખે જ છે. <sup>૨૩</sup> હે ભલી સ્ત્રીઓ ! નિષ્કપટપણાથી પતિનું તથા પતિના સંબંધીઓનું સેવન કરવું, અને છોકરાંઓનું પોષણ કરવું એ સ્ત્રીઓનો ઉત્તમ ધર્મ છે. <sup>૨૪</sup> પતિ દુષ્ટ સ્વભાવનો, દુર્ભાગી, વૃદ્ધ, જડ, રોગી કે નિર્ધન ગમે તેવો હોય તોપણ એ મહાપાપી ન થયો હોય, ત્યાં સુધી પોતાનું શુભ ઈચ્છનારી સ્ત્રીઓએ તેનો ત્યાગ ન કરવો. <sup>૨૫</sup> સારાં કુણીને જાર પુરુષનું સુખ સ્વર્ગની હાનિ કરનાર, ક્રીતિને તોડનાર, તુચ્છ, કષ્ટરૂપ અને નિંદિત છે. <sup>૨૬</sup> સાંભળવાથી, દર્શનથી, ધ્યાનથી અને કીર્તનથી જેવો મારામાં ભાવ રહે છે તેવો સાથે રહેવાથી રહેતો નથી, માટે ઘેર જાઓ. <sup>૨૭</sup>

શુકદેવજી કહે છે- આ પ્રમાણે શ્રીકૃષ્ણાનું અપ્રિય વચન સાંભળીને ખેદ પામેલી અને જેઓનો સંકલ્પ ભાંગી ગયો છે, એવી ગોપીઓ બહુ ચિંતામાં પડી. <sup>૨૮</sup> શોકના નિઃસાસાથી જેઓના લાલ હોઠ સૂકાતા હતા, એવાં પોતાનાં મોઢાં નીચાં કરી પગના અંગૂઠાથી ધરતી ખોતરતી, આંખનાં આંસુઓથી સ્તન ઉપરના કેસરને ધોતી અને બહુજ દુઃખી દુઃખી દુઃખી ગોપીઓ ઊભી થકી કાંઈ પણ બોલી નહીં. <sup>૨૯</sup>

## ગોપ્ય ઉચ્ચ:

મैવं વિભોર્હંતિ ભવાન् ગર્દિતું નૃંસં સન્યાસ્ય સર્વવિષયાંસ્તવ પાદમૂલમ् ।  
ભક્તા ભજસ્વ દુરવગ્રહ મા ત્યજાસ્માન् દેવો યથાડદિપુરૂષો ભજતે મુમુક્ષુન् ॥૩૧॥  
યત્પત્યપત્યસુહૃદામનુવૃત્તિરઙ્ગસ્ત્રીણાં સ્વર્ધર્મ ઇતિ ધર્મવિવા ત્વયોક્તમ् ।  
અસ્ત્વેવમેતદુપેદેશપદે ત્વીશે પ્રેષોભવાંસ્તનુભૂતાં કિલ બન્ધુરાત્મા ॥૩૨॥  
કુર્વન્તિ હિ ત્વયિ રતિ કુશલાઃ સ્વ આત્મન્ નિત્યપ્રિયે પતિસુતાદિભિરાતિદૈઃ કિમ् ।  
તત્ત્રાઃ પ્રસીદ પરમેશ્વર મા સ્મ છિન્દા આશાં ભૂતાં ત્વયિ ચિરાદવિન્દનેત્ર ॥૩૩॥  
ચિત્તં સુખેન ભવતાપહં ગૃહેષુ યત્ત્રિવિશાયુત કરાવયિ ગૃહાકૃત્યે ।  
પાદૌ પદં ન ચલતસ્તવ પાદમૂલાદ યામઃ કથં બ્રજમથો કરવામ કિં વા ॥૩૪॥

સેહ પામેલી અને ભગવાની પ્રાભિને માટે જ સંસારનાં સર્વ સુખનો ત્યાગ કર્યો છે, એવી ગોપીઓની રોઈ રોઈને આંખો પણ સૂજી ગઈ હતી. જે શ્રીકૃષ્ણ ગોપીઓને અતિ પ્યારા હતા છતાં પણ શત્રુની પેઠે બોલતા હતા, તેમને જોઈને ગોપીઓ કાંઈક કોધના આવેગથી ગદ્ગદ કંઠે આ પ્રમાણે કહેવા લાગી. <sup>૩૦</sup>

ગોપીઓ કહે છે- હે પ્રભુ ! આપને આવું ફૂર વચન ન બોલવું જોઈએ. હે સ્વતંત્ર ! અમે સર્વે વિષયોનો ત્યાગ કરી આપના ચરણારવિંદને સેવનારી છીએ, આવી અમોને, જેમ નારાયણ મુમુક્ષુઓને ભજે છે તેવી રીતે ભજો, અર્થાત્ અમોને અનુકૂળ થાઓ અને અમારી કામનાઓ પૂર્ણ કરો. પરંતુ અમારો ત્યાગ કરો મા. <sup>૩૧</sup> હે કૃષ્ણ ! ધર્મને જાણનારા આપે કહું કે પતિ, સંતાન અને સંબંધીઓને અનુસરવું એજ સ્ત્રીનો સ્વર્ધર્મ છે, તો તે સર્વે સ્વર્ધર્મ આપના સેવનથી જ સિદ્ધ થશે, કેમ કે સર્વે ઉપદેશનાં વાક્યો ઈશ્વરની સેવાને જ લાગુ પડે છે, અને આપ જ સર્વ પ્રાણીઓના અંતરાત્મા હોવાથી ઈશ્વર, પ્રિય અને બંધુ છો. અથવા તમે જો ધર્મના ઉપદેશક હો અને અમે જો ધર્મને જાણવાને ઈચ્છતી હોઈએ, તો ધર્મને જાણનારા તમોએ જે કહું તે યોગ્ય ગણાય, પરંતુ તમે ધર્મના ઉપદેશક નથી પણ સર્વના અંતરાત્મા છો, અને અમે ધર્મ જાણવાને ઈચ્છતી નથી, પણ ધર્મના ફળરૂપ આપની સેવાને જ ઈચ્છીએ છીએ, માટે આપનું કહેવું યોગ્ય નથી, અથવા પતિ આદિની સેવા કરવી એ ધર્મ છે એમ જે આપે કહું તે આપની સેવાથી અમને સિદ્ધ થશે. <sup>૩૨</sup> શાશ્વત નિપુણ પુલષો પોતાના આત્મારૂપ આપનામાં જ પ્રીતિ રાખે છે. પીડા આપનારા પતિ અને પુત્રાદિક્રમાં પ્રીતિ રાખવાનું શું પ્રયોજન છે ? એટલા માટે હે પરમેશ્વર ! અમારા ઉપર કૃપા કરો. હે કમળ સરખાં નેત્રવાળા ! ઘણા કાળથી

સિંગારુનસ્તવદધરામૃતપૂરકેણ હાસાવલોકકલગીતજહચ્છયાગિનમ् ।  
નો ચેદ્ વયં વિરહજાગન્યુપયુક્તદેહા ધ્યાનેન યામ પદયો: પદવી સખે તે ॥૩૫॥  
યર્હાંબુજાક્ષ તવ પાદતલં રમાયા દત્તક્ષણં ક્રચિદરણ્યજનપ્રિયસ્ય ।  
અસ્પ્રાક્ષમ તત્પ્રભૂતિ નાન્યસમક્ષમઙ્ગસ્થાતું ત્વયાભિરમિતા બત પારયામ: ॥૩૬॥  
શ્રીયર્ત્પદામ્બુજરજશ્વકમે તુલસ્યા લબ્ધવાપિ વક્ષસિ પદં કિલ ભૃત્યજુષ્મ ।  
યસ્યા: સ્વવીક્ષણકૃતેઽન્યસુરપ્રયાસસ્તદ્વદ્બ્રવયં ચ તવ પારજ: પ્રપત્રા: ॥૩૭॥  
તત્ત્ર: પ્રસીદ વૃત્તિનાર્દન તેઽદ્વિજમૂલં પ્રાસા વિસૃજ્ય વસતીસ્તવદુપાસનાશા: ।  
ત્વત્સુન્દરસિમતનિરીક્ષણતીવ્રકામતસાત્મનાં પુરુષભૂષણ દેહિ દાસ્યમ् ॥૩૮॥

આપમાં ધરેલી આશાને તોડી નાખો નહિ. ૩૩ આપે અમોને પાછું જવાનું કહું પણ  
તે અમારાથી થઈ શકે તેમ નથી, કેમ કે જે અમારું ચિત આજ દિવસ સુધી  
સુખેથી ધરમાં લાગતું હતું તે આપે હરી લીધું છે અને જે હાથ ધરના કામકાજમાં  
લાગતા હતા તે પણ આપે હરી લીધા છે. અમારા પગ તમારા ચરણારવિંદ પાસેથી  
પગલું પણ ખસતા નથી; માટે પ્રજમાં શી રીતે જઈએ અને શું કરીએ? ૩૪ હે  
શ્રીકૃષ્ણ! તમારા હાસ્ય સહિત જોવાથી અને સુંદર ગાયનથી ઉત્પત્ત થયેલા અમારા  
કામાંનિને તમારા અધરામૃતની પિચકારીથી ઠારી નાખો, અને નહીં ઠારો તો  
એક કામાંનિ અને બીજો વિરહાંનિ આ બસે અભિનીથી બળી જઈને યોગીઓની  
પેઠે ધ્યાન કરીને પણ તમારા ચરણારવિંદને પામીશું. અર્થાત્ મરી જઈને પણ  
અમે આપને છોડીશું નહિ. ૩૫ હે કમળ નેત્ર! વનમાં રહેનારા મુનિ લોકો ઉપર  
પ્રેમ ધરાવનારા આપનું ચરણારવિંદ કે જેની સેવા કરવાનો અવકાશ લક્ષ્મીજીને  
પણ કોઈ સમયે જ મળે છે, એ ચરણનો જ્યારથી અમોએ સ્પર્શ કર્યો છે અને તે  
સ્પર્શ કરવાનો આપે આનંદ આપ્યો છે, ત્યારથી અમો બીજાની પાસે ઊભી રહી  
પણ શકતી નથી. (અમારા તુચ્છ પતિઓ અમને ગમતા નથી.) ૩૬ જે લક્ષ્મીજીની  
દાસી પોતા ઉપર પડે તેને માટે બીજા દેવતાઓ પ્રયાસ જ કરે છે, તે લક્ષ્મીજી પોતે  
તમારા વક્ષઃસ્થળમાં આગવું સ્થાન પામ્યા છતાં પણ, આપના ચરણારવિંદની જે  
રજમાં તુલસી શોક્યની પેઠે ભાગ પડાવનાર છે અને વળી જે રજ સર્વ દાસોએ  
સેવેલી છે, તે રજને લક્ષ્મીજી પણ ઈચ્છે છે તો તે લક્ષ્મીજીની પેઠે અમે પણ તે જ  
રજને પ્રામ થએલી છીએ. ૩૭ એટલા માટે હે દુઃખોને મટાડનાર! અમે યોગીઓની  
પેઠે તમારી સેવાની આશાથી ધરબાર છોડી દઈને આવેલી છીએ, માટે અમારા

વીક્ષયાલકાવૃતમુખં તવ કુણડલશ્રીગણ્ડસ્થલાધરસુધં હસ્તિબાલોકમ્ ।  
દત્તાભયં ચ ભુજદણ્ડયું વિલોક્ય વક્ષઃ શ્રીયૈકરમણં ચ ભવામ દાસ્યઃ ॥૩૯॥  
કા સ્વ્યઙ્ગતે કલપદાયતમૂર્ચ્છિતેન સમ્મોહિતાઽર્થચરિતાત્ર ચલેત્તિલોક્યમ્ ।  
ત્રૈલોક્યસૌભગમિરં ચ નિરીક્ષ્ય રૂપં યદ્ ગોદ્વિજદ્વુમૃગાઃ પુલકાન્યબિભ્રન् ॥૪૦॥  
વ્યક્તં ભવાન્ બ્રજભયાર્તિહોરોભિજાતો દેવો યથાઽદિપુરુષઃ સુરલોકગોમા ।  
તત્ત્રો નિધેહિ કરપઙ્કજમાર્તબન્ધો તમસ્તનેષુ ચ શિરસ્સુ ચ કિઙ્ઘીણામ् ॥૪૧॥

શ્રીશુક ઉત્તા

ઇતિ વિકલવિતં તાસાં શ્રુત્વા યોગેશ્વરેશ્વરઃ । પ્રહસ્ય સદ્વયં ગોપીરામારામોઽધ્યરીરમત् ॥૪૨  
તાભિ: સમેતાભિરુદારચેષ્ટિઃ પ્રિયેક્ષણોત્ફલમુખીભિરચ્યુતઃ ।  
ઉદારહાસદ્વિજકુન્દદીધિતિર્વર્યોચતૈણાઙ્કિંડોડુભિર્વતઃ ॥૪૩॥

ઉપર કૃપા કરો. હે પુરુષોત્તમ ! તમારા સુંદર મંદ હાસ્ય સહિત જોવાને લીધે  
ઉત્પત્ત થયેલા તીવ્ર કામદેવથી તપી ગયેલી અમોને દાસીપણું આપો. ૩૮ કેશથી  
વીંટાએલું, ગંડસ્થળમાં કુંડળની શોભાવાળું અને અધર ઓષ્ઠમાં સુધાથી ભરેલું  
તમારું મુખારવિંદ જોઈને, અભય આપનારા તમારા બે ભુજદંડને જોઈને, અને  
લક્ષ્મીજીને એક કીડાના સ્થાનકરૂપ તમારા વક્ષઃસ્થળને જોઈને, અમો તમારી  
દાસી થવા જ માગીએ છીએ. ૩૯ હે કૃષ્ણ ! આપે વ્યભિચારને નિંદિત કહ્યો, પણ  
તમારા સુંદર પદવાળાં વેણુગીતથી અને ત્રૈલોક્યમાં સર્વોત્તમ સુંદરતાવાળું આ  
તમારું રૂપ જોવાથી મોહ પામેલી કિં સ્ત્રી પોતાના ઉત્તમ પતિત્રતાપણાના ધર્મથી  
ભાષ ન થાય ? જે ગીત સાંભળીને તથા રૂપ જોઈને ગાયો, પક્ષીઓ, ઝાડ અને  
મૃગનાં પણ રૂવાડાં ઊભાં થઈ જાય છે. ૪૦ જેમ આદિપુરુષ નારાયણ દેવલોકની  
પીડાને હરે છે તેમ તમે અવશ્ય પ્રજના ભય અને પીડાને હરવા સારુ જન્મયા  
છો. એટલા માટે હે દીનબંધુ ! અમો દાસીઓનાં કામદેવથી તપી ગયેલાં સ્તન  
ઉપર અને મસ્તક ઉપર આપનાં હસ્તકમળ ધરો. ૪૧

શુકદેવજી કહે છે આ પ્રમાણો તે પ્રજાંગનાઓના કાલાવાલા સાંભળીને  
યોગેશ્વર ભગવાને હસીને પોતે આત્મારામ હોવા છતાં પણ દયાથી તે ગોપીઓને  
રમાડી. ૪૨ મળેલી અને પ્રિયના દર્શનથી પ્રકુલ્પિત મુખોવાળી તે ગોપીઓથી  
વીંટાએલા, ઉદાર લીલાવાળા, અને સુંદર હાસ્યમાં તથા દાંતોમાં મોગરાના ફૂલ  
સરખી શોભાવાળા ભગવાન નક્ષત્રોથી વીંટાએલા ચંદ્રમાની પેઠે શોભવા લાગ્યા. ૪૩  
અનેક સ્ત્રીઓના યૂથના અધિપતિ, સ્ત્રીઓને ગવરાવતા, અને પોતે ગાતા, વૈજ્યંતિ

ઉપगીયમાન ઉદ્ઘાયન् વનિતાશત્યુથપઃ । માલાં બિભ્રદ् વैજયન્તી વ્યચરમ્મણદ્યન् વનમ् ૪૪  
નદ્યાઃ પુલિનમાવિશ્ય ગોપીભિર્હિમવાલુકમ् । રેમે તત્તરલાનન્દકુમુદામોદવાયુના ॥૪૫  
બાહુપ્રસારપરિમ્ભકરાલકોરુનીવીસ્તનાલભનનર્મનખાગ્રપાતૈઃ ।

ક્ષેત્રલ્યાવલોકહસિતૈર્વજસુન્દરીણામુત્તમ્ભયન् રતિપર્તિ રમયાઞ્ચકાર ॥૪૬॥  
એવं ભગવતઃ કૃષ્ણાલ્યભ્રમાના મહાત્મનઃ । આત્માનં મેનિરે સ્ત્રીણાં માનિન્યોઽભ્યધિકં ખુબિ ૪૭  
તાસાં તત્સૌભગમદં વીક્ષ્ય માનં ચ કેશવઃ । પ્રશમાય પ્રસાદાય તત્ત્વૈવાંતરધીયત ॥૪૮॥  
ઇતિ શ્રીમદ્બાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્દ્યે પૂર્વર્દ્ધ  
ભગવતો રાસક્રીડાવર્ણનં નામૈકોનત્રિંશોઽધ્યાય: ॥૨૯॥

માણાને ધારણ કરતા અને વનને શોભાવતા ભગવાન તે વનમાં ફરતા હતા. ૪૪  
પછી ભગવાન યમુનાનદીના તરંગોથી આનંદને પામતાં ચંદ્રવિકાસી કમળોની  
સુગંધવાળા વાયુથી સેવાયેલો, શીતળ રેતીવાળો, એવો યમુના નદીનો કાંઠો,  
તેના ઉપર જઈને ગોપીઓની સાથે હાથ લાંબા કરવાથી, આલિંગનથી, હાથ,  
કેશ, સાથળ, નાડી અને સ્તનના સ્પર્શથી, હાસ્યનાં વચ્ચનથી, નખની અણીઓવડે  
ચિન્હો કરવાથી, કીડાથી, જોવાથી અને હાસ્યથી વ્રજાંગનાઓના કામદેવને બહુ  
જ વૃદ્ધિ પમાડતા શ્રીકૃષ્ણ ભગવાન તે ગોપીઓને રમાડવા લાગ્યા. ૪૫-૪૬ આ  
પ્રમાણે મહાત્મા અને જ્ઞાની શ્રીકૃષ્ણથી જેઓને માન મળેલું છે, એવી ગોપીઓ  
પૃથ્વીની સર્વે સ્ત્રીઓના આત્માથી પોતાના આત્માને શ્રેષ્ઠ માનવા લાગી. ૪૭ બ્રહ્માને  
અને રૂદ્રને પણ વશ કરનાર ભગવાન, તે ગોપીઓના સૌંદર્યપણાના અભિમાનથી  
ઉત્પત્ત થયેલો મદ તથા અભિમાનને જોઈ તેને દૂર કરવા અને પછી પ્રસન્ન થવાને  
માટે ત્યાં જ અંતર્ધાન થઈ ગયા. ૪૮

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંદના અંગાણત્રીશમો  
અદ્યાય સંપૂર્ણ.

અથ ત્રિંશોઽધ્યાય: (૩૦)

॥ શ્રીશુકુત્વાચ ॥

અંતર્હિતે ભગવતિ સહસૈવ વ્રજાંગનાઃ । અતથંસ્તમચક્ષાણાઃ કરિણય: એવ યુથપમ् ॥૧  
ગત્યાનુરાગસ્મિતવિભ્રમેક્ષિતર્મનોરમાલાપવિહારવિભ્રમૈ: ।  
આક્ષિકાચિત્તાઃ પ્રમદા રમાપતેસ્તાસ્તા વિચેષા જગૃહુસ્તદાત્મિકા: ॥૨॥  
ગતિસ્મિતપ્રેક્ષણભાષણાદિષુ પ્રિયા: પ્રિયસ્ય પ્રતિરૂઢમૂર્ત્યઃ ।  
અસાવહં ત્વિત્યબલાસ્તદાત્મિકા ન્યવેદિષુ: કૃષ્ણાવિહારવિભ્રમા: ॥૩॥  
ગાયન્ત્ય ઉચ્ચૈરમુમેવ સંહતા વિચિક્યુરુન્મત્તકવદ્ વનાદ્ વનમ્ ।  
પપ્રચ્છુરાકાશવદનતરં બહિર્ભૂતેષુ સંત્તં પુરુષ વનસ્પતીન् ॥૪॥  
દૃષ્ટે વઃ કચ્ચિવદ્શ્વથ્ પ્લક્ષ ન્યગ્રોધ નો મનઃ । નન્દસ્નૂર્ણતો હૃત્વા પ્રેમહાસાવલોકનૈ: ॥૫  
કચ્ચિત્ કુરબકાશોકનાગપુન્નાગચમ્પકાઃ । રામાનુજો માનિનીનામિતો દર્પહરસ્મિત: ॥૬

### અદ્યાય ૩૦

વિરહુથી તપેલી ગોપીઓ ભગવાનને વનમાં શોધે છે.

શુકુદેવજી કહે છે- ભગવાન તરત જ અંતર્ધાન થઈ જતાં જેમ હાથથીઓ  
હાથીને નહિ દેખવાથી પરિતાપ પામે, તેમ ગોપીઓ ભગવાનને નહીં દેખવાથી  
પરિતાપ પામવા લાગી. ૧ ભગવાનની ગતિ, સ્નેહ, લીલા સહિત જોવું, સુંદર  
ભાષણ, કીડા અને બીજા પણ વિલાસોથી જેઓનાં મન ખેંચાઈ ગયાં હતાં એવી  
અને તેથી ભગવદ્વૂપ થયેલી વ્રજાંગનાઓ ભગવાનની તે તે લીલા સરખી લીલા  
કરવા લાગી. ૨ પ્યારા શ્રીકૃષ્ણનું ચાલવું, મંદહાસ્ય, જોવું અને ભાષણ ઈત્યાદિક  
લીલાઓમાં જેઓનાં શરીર તન્મય થઈ ગયાં હતાં એવી અને તેને લીધે ભગવાનની  
પેઠે જ કીડા અને વિલાસને કરતી ભગવદ્વૂપ ગોપીઓ ‘હું જ કૃષ્ણ છું’ એમ  
પરસ્પર જણાવવા લાગી. ૩ પરસ્પર ભેગી મળીને ઊંચા સ્વરથી ભગવાનનું જ  
ગાયન કરતી ગોપીઓ ઊંમતાની પેઠે એક વનથી બીજા વનમાં શોધવા લાગી,  
અને ભગવાન કે જે સર્વ પદાર્થોમાં બહાર અને અંદર વ્યાપક છે તેમના સમાચાર  
વૃક્ષોને પૂછવા લાગી. ૪ આ વૃક્ષો ઊંચાં છે તેથી કદાચ શ્રીકૃષ્ણને જોતાં હશે એમ  
માની ગોપીઓ વૃક્ષાદિકને પૂછે છે- હે પીપળા ! હે પીપશ ! પ્રેમ સહિત  
હાસ્ય અને અવલોકનથી અમારા મનની ચોરી કરીને ભગવાન ગયા છે તે તમારા  
જોવામાં આવ્યા ? ૫ આ વૃક્ષો મોટાં છે અને પુષ્પો વગેરેથી ઘણાનો ઉપકાર કરનારાં

કच્ચવતુલસિ કલ્યાણિ ગોવિન્દચરણપ્રિયે । સહત્વાલિકુલૈર્બિભ્રદ્ દૃષ્ટસેડતિપ્રિયોડચ્યુત: ॥  
માલત્યર્દર્શિ વ: કચ્ચન્મલિકે જાતિયૂથિકે । પ્રીતિં વો જનયન્ યાત: કરસ્પર્ણેન માધવ: ॥  
ચૂઠપ્રિયાલપનસાસનકોવિદારજમ્બવ્રકબિલ્વબકુલામ્રકદમ્બનીપા: ।  
યેડન્યે પરાર્થભવકા યમુનોપકૂલા: શંસન્તુ કૃષ્ણપદવી રહિતાત્મનાં ન: ॥૧॥  
કિં તે કૃતં ક્ષિતિ તપો બત કેશવાદ્વિશ્વસ્પર્ણોત્પુલકિતાઙ્રહૈર્વિભાસિ ।  
અષ્ટદ્વિશસમ્ભવ ઉસ્ક્રમવિક્રમાદ્ વા આહો વરાહવપુષ: પરિરમ્ભણેન ॥૧૦॥  
અષ્ટેણપન્યુપગત: પ્રિયયે ગાત્રેસ્તન્વન્ દૂશાં સખિ સુનિર્વિતમચ્યુતો વ: ।  
કાન્તાઙ્ગસઙ્ગકુચકુઙ્ગમરભિજતાયા: કુન્દસ્વજ: કુલપતેરિહ વતિ ગન્ધ: ॥૧૧॥  
બાહું પ્રિયાંસ ઉપધાય ગૃહીતપદ્મો રામાનુઝસ્તુલસિકાલિકુલૈર્મદાન્ધી: ।  
અન્વીયમાન ઇહ વસ્તરવ: પ્રણામં કિં વાભિનન્દતિ ચરન્ પ્રણયાવલોકે: ॥૧૨॥

છે. તેથી તેઓ ઉત્તર આપશે એમ માની ગોપીઓ પૂછે છે કે હે બપોરિયા ! હે આસોપાલવ ! હે નાગ ! હે પુન્નાગ ! હે ચંપક ! માનવતી સ્ત્રીઓના માનને હરનાર મંદહાસ્યવાળા શ્રીકૃષ્ણા, અહીં તમારી પાસે થઈને નીકળ્યા હતા ? <sup>૯</sup> હે તુલસી ! અમરોની સાથે તારું ધારણ કરનાર અને તને અત્યંત પ્યારા શ્રીકૃષ્ણ તારા જોવામાં આવ્યા છે ? <sup>૧૦</sup> હે માલિતી ! હે માલિકા ! હે જાતિ ! હે જુર્દી ! તમોએ ભગવાનને દીઠા છે ? હાથના સ્પર્શથી તમોને રાજી કરતા અહીંથી ગયા છે ? <sup>૧૧</sup> હે આંબા ! હે રાયશ ! હે પનસ ! હે અસન ! હે કોવિદાર ! હે જાંબુ ! હે આકડા ! હે બોરસલી ! હે આપ્રમ ! હે કદમ ! હે નીપ ! અને હે બીજાં પણ વૃક્ષો ! તમારો જન્મ પરોપકારને માટે છે અને વળી તમો યમુનાજીને કાંઠે રહેનારાં હોવાથી તીર્થવાસી છો, માટે શૂન્યચિત્તવાળી અમોને શ્રીકૃષ્ણનો માર્ગ કહો. <sup>૧૨</sup> હે પૃથ્વી તેં કયું તપ કર્યું છે ? કેમ કે ભગવાનના ચરણનો સ્પર્શ મળવાથી તને આનંદ થયો છે, અને તેથી તારાં રૂવાંં ઊભાં થયેલાં જણાય છે. આ આનંદ તને હમણાં જ ભગવાનના ચરણનો સ્પર્શ મળવાથી થયો છે, કે વામનાવતારમાં ભગવાનના ચરણથી તું મપાએલી છે તેથી મળ્યો છે ? અથવા વરાહ અવતારમાં ભગવાનના શરીરનું આલિંગન મળ્યું છે તેથી થયો છે ? <sup>૧૩</sup> હે મૃગલી સખી ! પોતાના અવયવોથી તમારી દાણિને આનંદ આપતા ભગવાન પ્યારીની સાથે અહીં તમારી પાસે આવ્યા હતા ? કેમકે શ્રીકૃષ્ણે પહેરેલી મોગરાના પુષ્પની માળા કે જે પ્યારીને અંગસંગ કરવાના સમયમાં તેના સ્તન ઉપરના કેસરથી રંગાએલી હશે તેનો સુગંધ અહીં આવે છે. <sup>૧૪</sup> હે વૃક્ષો ! એક હાથ પ્યારીના ખભા ઉપર ધરી અને બીજા હાથમાં કમળ લઈ અહીં ફરતા

પૃછ્છતેમા લતા બાહુન્યાશિલણ વનસ્પતે : નૂં તત્કરજસ્પૃષ્ટ બિભ્રત્યુપુલકાન્યહો ॥૧૩  
ઇત્યુન્મત્તવચો ગોપ્ય: કૃષ્ણાન્વેષણકાતરા: । લીલા ભગવતસ્તાસ્તા હ્યનુચ્ક્રુસ્તદાતિમિકા: ૧૪  
કસ્યાશ્રિત્ પૂતનાયન્યા: કૃષ્ણાયન્યપિબત્ સ્તનમ્ । તોકાયિત્વા રુદ્યન્યા પદાહૃષ્કટાયતીમ્  
દૈત્યાયિત્વા જહારાન્યામેકા કૃષ્ણાર્ભભાવનામ્ । રિઙ્ગયામાસ કાપ્યઙ્ગધી કર્ષની ઘોષનિઃસ્વનૈઃ  
કૃષ્ણાર્થાયિતે દ્વે તુ ગોપાયન્યશ્વ કાશ્શન । વત્સાયતી હન્તિ ચાન્યા તત્રૈકા તુ બકાયતીમ્ ૧૭  
આહૂય દૂરગા યદ્વત્ કૃષ્ણાસ્તમનુકુર્વતીમ્ । વેણું ક્રણની ક્રીડનીમન્યા: શંસન્તિ સાધ્વિતિ ૧૮  
કસ્યાંચિત્ સ્વભું ન્યસ્ ચલન્યાહપા નનુ । કૃષ્ણોજહં પશ્યત ગર્તિ લલિતામિતિ તમના: ૧૯  
મા મૈષ્ટ વાતવર્ષાભ્યાં તત્વાણાં વિહિતં મયા । ઇત્યુક્તવૈકેન હસ્તેન યતન્યુન્નિદધેઽમ્બરમ્ ॥૨૦  
અને જેમની પાછળ મદ્ધથી મદ્દોન્મત બનેલા ભમરો ઉડ્યા કરે છે, એવા ભગવાન  
સ્નેહ પૂર્વક જોઈને તમારા પ્રશામનો સ્વીકાર કરે છે કે શું ? <sup>૧૨</sup> હે સખીઓ ! આ  
લતાઓ અવશ્ય શ્રીકૃષ્ણને મળેલી હોવી જોઈએ; કેમકે પોતાના પતિ (વૃક્ષ) ના  
બાહુને આલિંગન કરી રહેલી છતાં પણ પોતાનાં મોટાં ભાગ્યને લીધે ભગવાનના  
નખનો સ્પર્શ મળવાથી રોમાંચિત થઈ રહેલી છે, માટે આ લતાઓને પૂછો. <sup>૧૩</sup>  
શુક્ટેવજી કહે છે- આ પ્રમાણે ઉન્મતાના જેવાં વચન બોલતી ભગવાનને શોધવાથી  
વિદ્ધણ થયેલી અને ભગવાનમાં જ જેનાં ચિત્ત લાગી રહ્યાં છે, એવી ગોપીઓ  
ભગવાનની તે તે લીલાઓનું અનુકરણ કરવા લાગી. <sup>૧૪</sup> ભગવાનના જેવી લીલા  
કરતી કોઈ ગોપીએ, પૂતનારૂપ થયેલી બીજી ગોપીનું સ્તનપાન કર્યું. બાળક થઈને  
રોતી એક ગોપીએ શક્તાસુરનું અનુકરણ કરી, ગાંડારૂપ થયેલી બીજી ગોપીને  
લાત મારી. <sup>૧૫</sup> એક ગોપી તૃણાવર્ત દૈત્યરૂપ થઈને, શ્રીકૃષ્ણના બાળકપણાની  
ભાવના કરનારી બીજી ગોપીને હરી ગઈ. એક ગોપી શ્રીકૃષ્ણરૂપ થઈને  
ધુધરીઓના ધમકાર સહિત પગને ઘસડતી ભાંખડીયાભેર ચાલવા લાગી. <sup>૧૬</sup> બે  
ગોપીઓ બલરામ અને કૃષ્ણરૂપ થઈ અને બીજી કેટલીક ગોવાળોરૂપ થઈ. એક  
ગોપી વત્સાસુરનું અનુકરણ કરીને વાછડા જેવી થઈ, કૃષ્ણરૂપે થયેલી અને  
ગોવાળોરૂપે થયેલી બીજી ગોપીને પ્રહાર કર્યો. અને એકે બગલારૂપ થયેલીને  
પ્રહાર કર્યો. <sup>૧૭</sup> એક છેટે ગઅેલી ગાયોને જેમ શ્રીકૃષ્ણ બોલાવતા હતા, તેમ  
બોલાવીને તેનું અનુકરણ કરતી હતી, વેણું વગાડતી હતી અને કીડા કરતી હતી,  
તેને બીજી ગોપીઓ વાહ વાહ કહેતી હતી. <sup>૧૮</sup> એક ગોપીના ઉપર હાથ મૂકીને  
ચાલતી અને ભગવાનમાં જ જેનું મન લાગ્યું હતું, એવી બીજી ગોપી બોલી કે હું  
કૃષ્ણ છું. મારી સુંદર ચાલ જુઓ. <sup>૧૯</sup> એક ગોપીએ વાયુ તથા વરસાદથી બીશો

આરુહ્યકા પદાર્ડક્રમ્ય શિરસ્યાહાપરાં નૃપ । દુષ્ટાહે ગચ્છ જાતોઝં ખલાનાં નનુ દણદઘ્યક્ ૨૧  
તત્ત્વકોવાચ હે ગોપા દાવાર્દિન પશ્યતોલ્બણમ् । ચક્ષુષ્યાશ્વપિદધ્વં વો વિધાસ્યે ક્ષેમમઽજસા ૨૨  
બદ્ધાન્યા સ્ત્રજા કાચિતન્ની તત્ત્વ ઉલ્લખલે । ભીતા સુદ્ગ્ર્દ્ધ પિથાયાસ્ય્ય ખેજે ભીતિવિદ્ભનમ્ ૨૩  
એવં કૃષ્ણાં પૃચ્છમાના વૃન્દાવનલતાસ્તર્ણન્ । વ્યચક્ષત વનાદેશો પદાનિ પરમાત્મન: ॥૨૪  
પદાનિ વ્યક્તમેતાનિ નન્દસૂનોર્મહાત્મન: । લક્ષ્યન્તે હિ ધ્વજાભોજવજાઙ્ગુશયવાદિભિ: ॥૨૫  
તૈસ્તૈ: પદૈસ્તત્યદવીમન્ચિચ્છન્ત્યોર્ગતોર્બલા: । વધ્વા: પદૈ: સુપૃક્તાનિ વિલોક્યાર્તા: સમબુવન્ ૨૬  
કસ્યા: પદાનિ ચૈતાનિ યાતાયા નન્દસૂનુના । અંસન્યસ્તપ્રકોષ્ટાયા: કરેણો: કરીણા યથા ૨૭  
અન્યાર્જરાધિતો નૂનં ભગવાન્ હરિરીશ્વર: । યન્ત્રો વિહાય ગોવિન્દ: સ્ત્રીતો યામનયદ્રહઃ ॥૨૮  
ધન્યા અહો અમી આલ્યો ગોવિન્દાઙ્ગ્રબ્જરેણવઃ । યાન્ બ્રહ્મેશો રમા દેવી દધરુમ્દર્ઘયનુત્તયે ૨૯  
તસ્યા અમૂનિ નઃ ક્ષોભં કુર્વન્યુચ્ચૈ: પદાનિ યત્ । યૈકાપહૃત્ય ગોપીનાં રહો ભુડ્દેક્ષ્યુતાધરમ્ ૩૦

નહીં; તેથી રક્ષણનો ઉપાય હું કરું છું, એમ કહી યત્ કરીને પોતાનું વસ્ત્ર ઊચું  
ઉપાડ્યું. ૨૦ એક ગોપી બીજી ગોપી ઉપર ચઢી તેના માથાને પગથી દબાવીને  
બોલી કે હે દુષ્ટ સર્પ ! જતો રહે. ખળ લોકોને શિક્ષા કરવા સારુ હું અવતર્યો  
છું. ૨૧ ત્યાં એક ગોપી બોલી કે હે ગોવાળો ! આ ભયંકર દાવાનળને જુઓ. તરત  
આંખ્યો મીંથી જાઓ, હું તમારું રક્ષણ જોતજોતામાં કરીશ. ૨૨ તેમાં યશોદા બનેલી  
એક ગોપીએ, માળાથી ખાંડણીઆ સાથે બાંધેલી ગોપીને જોઈ, બીજી સારી  
આંખોવાળી અને પાતળી ગોપી પોતાનું મોહું ઢાંકીને ભયનું અનુકરણ કરવા  
લાગી. ૨૩ આ પ્રમાણે વૃંદાવનની લતાઓ અને વૃક્ષોને ભગવાનના સમાચાર પૂછીતી  
અને ભગવાનની લીલાનું અનુકરણ કરતી ગોપીઓ વનના પ્રદેશમાં ભગવાનનાં  
પગલાં દીઠાં, એને જોઈને વિચાર્યુ કે ધ્વજ, કુમળ, વજ, અંકુશ અને યવ આદિ  
રેખાનાં ચિન્હો ઉપરથી અવશ્ય આ મહાત્મા શ્રીકૃષ્ણાનાં પગલાં જણાય છે. ૨૪-૨૫  
પછી તે તે પગલાં ઉપરથી ભગવાનના માર્ગને શોધતી તે સ્ત્રીઓ આગળ જતાં  
એક સ્ત્રીનાં પગલાંથી મળેલાં ભગવાનનાં પગલાં જોઈ, બેદ પામીને બોલી કે  
હાથીની સાથે જેમ હાથણી જાય તેમ ભગવાનની સાથે ગયેલી અને ભગવાનના  
ખભા ઉપર પોતાનું કંદું મૂકનારી આ કઈ ગોપીનાં પગલાં છે. ૨૬-૨૭ આ ગોપીએ  
અવશ્ય પ્રભુની આરાધના કરેલી હોવી જોઈએ; કેમકે આપણને છોડી દઈને તેના  
પર રાજુ થયેલા શ્રીકૃષ્ણ તેને એકાંતમાં લઈ ગયા. ૨૮ હે સખીઓ ! અહો ! આ  
ભગવાનના ચરણકુમળની ૨૯ અત્યંત પવિત્ર છે કે જે રજને બ્રહ્મા, સદાશિવ  
અને લક્ષ્મીજી પણ પાપ દૂર કરવા સારુ પોતાના મસ્તક ઉપર ધરે છે. ૨૯ બીજી

ન લક્ષ્યન્તે પદાન્યત્ર તસ્યા નૂન તૃણાઙ્ગ્નાં: । ચિદ્યત્સુજાતાદિશ્તતલામુન્ત્રિન્યે પ્રેયર્સી પ્રિય: ॥૩૧  
દ્રીમાન્યધિકમગનાનિ પદાનિ વહતો વધૂમ્ । ગોપ્ય: પશ્યત કૃષ્ણસ્ય ભારાક્રાન્તસ્ય કામિન: ૩૨  
અત્રાવરોપિતા કાન્તા પુષ્પહેતોર્મહાત્મના । અત્ર પ્રસૂનાવચય: પ્રિયાર્થે પ્રેયસા કૃત: ।

પ્રપદાક્રમણે એતે પશ્યતાસકલે પદે ॥૩૩

કેશપ્રસાધનં ત્વત્ કામિન્યા: કામિના કૃતમ્ । તાનિ ચૂંદ્યતા કાન્તામુપવિષ્ટમિહ ધ્યુવમ્ ૩૪  
રેમે તથા ચાત્મરત આત્મારામોર્પ્યખણિંડત: । કામિનાં દર્શયન્ દૈન્યં સ્ત્રીણાં ચૈવ દુરાત્મામ્ ૩૫  
દૃત્યેવં દર્શયન્યસ્તાશ્રેરૂર્ગોપ્યો વિચેતસ: । યાં ગોપીમનયત્ કૃષ્ણો વિહાયાન્યા: સ્ત્રીયો વને ૩૬  
સા ચ મેને તદાર્જતમાનં વરિષ્ઠ સર્વયોષિતામ્ । હિત્વા ગોપી: કામયાના મામસૌ ભજતે પ્રિય: ૩૭  
તતો ગત્વા વનાદેશં દૂસા કેશવમબ્રીત્ । ન પારયેજં ચલિતું નય માં યત્ર તે મન: ॥૩૮

ગોપીઓ બોલી કે- શ્રીકૃષ્ણાની સાથે ગયેલી સ્ત્રીના પગલાં જ આપણને અદેખાઈનું  
મોટું દુઃખ ઉત્પત્ત કરે છે. કારણ કે સર્વે ગોપીઓને ચુંબન કરવા યોગ્ય શ્રીકૃષ્ણના  
અધરામૃતનું હરણ કરીને પોતે એકલી જ એકાંત સ્થળમાં જઈને ભોગવે છે. ૩૦  
આ ઠેકાણો એ સ્ત્રીના પગલાં દેખાતાં નથી, પણ તેનું કારણ અવશ્ય એ હોવું  
જોઈએ, કે ખડના અંકુરથી તેના કોમળ પગ પીડાતા હશે તેથી તે પ્યારીને પ્યારા  
ભગવાને પોતાના ખભા પર તેડી લીધી હશે. ૩૧ આ ઠેકાણો તે પ્યારીને માટે પ્યારા  
ભગવાને વૃક્ષો ઉપરથી કુલ વીણેલાં જણાય છે. જુઓ, કે પેનીઓ ઉંચી કરેલી  
હોવાને કારણે ધરતી પર પગના આગળા ભાગનું જ દુબાણ આવવાથી અધુરાં  
પગલાં છપાયાં છે. ૩૨ આ ઠેકાણો તે કામી ભગવાને કામિનીના કેશ ગુંથેલા છે;  
કેમકે તેના ચોટલામાં કુલ ગુંથતાં અવશ્ય શ્રીકૃષ્ણ આ સ્થળમાં બેઠેલા હોવા  
જોઈએ. ૩૩

શુક્દેવજી કહે છે- શ્રીકૃષ્ણ ભગવાન પોતાથી જ સંતુષ્ટ, આત્મારામ અને  
સ્ત્રીઓના વિલાસમાં નહીં લલચાયેલા છતાંપણ, સ્ત્રીઓની ભૂંડાઈ અને કામી  
પુરુષોની દીનતા દેખાડવા સારુ તે સ્ત્રીની સાથે રમતા હતા. ૩૪ જે ગોપીને શ્રીકૃષ્ણ  
લઈ ગયા હતા, તે સિવાય બીજી ગોપીઓ આ પ્રમાણે પરસ્પર બતાવતી અને  
વિલ્લણ થઈ વનમાં ફરતી હતી. ૩૫ કામનાવાળી બીજી ગોપીઓને મૂકી દઈને,  
આ પ્યારા શ્રીકૃષ્ણ મને ભજે છે, માટે સર્વે સ્ત્રીઓમાં હું જ શ્રેષ્ઠ છું. આમ શ્રીકૃષ્ણ  
જે સ્ત્રીને લઈ ગયા હતા તે સ્ત્રી માનવા લાગી. ૩૬ પછી વનના એક પ્રદેશમાં  
જઈને ગર્વ પામેલી તે સ્ત્રીએ ભગવાનને કહ્યું કે હું ચાલી શકતી નથી, માટે જ્યાં  
તમારે જવાની ઈચ્છા હોય ત્યાં મને ઉપાડીને લઈ જાઓ. ૩૭ કામી પુરુષો સ્ત્રી

एवमुक्तः प्रियामाह स्कन्ध आरुह्यतामिति । ततश्चान्तर्दधे कृष्णः सा वधूरन्वतप्यत ॥३९॥  
हा नाथ रमण प्रेष्ठ क्रासि क्रासि महाभुज । दास्यास्ते कृपणाया मे सखे दर्शय सत्त्विधिम् ॥४०  
अन्विच्छन्त्यो भगवतो मार्गं गोप्योऽविदूरतः । ददूशः प्रियविश्लेषमोहितां दुःखितां सखीम् ॥४१  
तया कथितमाकर्ण्य मानप्राप्तिं च माधवात् । अवमानं च दौरात्म्याद् विस्मयं परमं ययुः ॥४२  
ततोऽविश्नवनं चन्द्रज्योतस्त्रियावद् विभाव्यते । तमः प्रविष्टमालक्ष्य ततो निवृतुः स्त्रियः ॥४३  
तन्मनस्कास्तदालापास्तद्विचेष्टास्तदात्मिकाः । तदुणानेव गायन्त्यो नात्मागाराणि सस्मरुः ॥४४  
पुनः पुलिनमागत्य कालिन्द्याः कृष्णभावानाः । समवेता जगुः कृष्णं तदागमनकाङ्क्षिताः ॥४५

इति श्रीमद्बागवते महापुराणे परमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वर्धे  
रासक्रीडायां कृष्णान्वेषणं नाम त्रिंशोऽध्यायः ॥३०॥

आगण केवा दीन थઈने २हे छे ए अहीं दर्शावे छे. आ प्रमाणे ते स्त्री बोलतां  
भगवाने कह्युं के तो पछी मारी कांध उपर बेस, पछी ते स्त्री कांध उपर बेसवाने  
सज्ज थतां भगवान अंतर्धान थई गया. एम थतां ए स्त्री पस्ताईने बोलवा  
लागी के हे नाथ ! हे सुंदर ! हे घ्यारा ! हाय हाय क्यां छो ? क्यां छो ? हे सभा !  
हुं तमारी कंगाल दासी छुं, तेने दर्शन दो. ३८-३९ एटलामां भगवानना मार्गने  
शोधती शोधती चाली आवती पेली सर्वे गोपीओ ए पोताना सभीपमां घ्याराना  
वियोगथी मोह पामेली अने हुः ख पामेली ते पोतानी सभीने ढीठी. ४० भगवाने  
प्रथम मान आप्युं अने पछी भूंडाई ज्ञोईने अपमान कर्यु, ए सर्वे वात तेना  
मोठांथी सांभणीने सर्वे गोपीओ महाविस्मय पामी. ४१ पछी ज्यां सुधी चंद्रमानुं  
अजवाणुं देखायुं त्यां सुधी तेओ सभीने साथे लई, वनमां भगवानने शोधवा  
आगण आगण ज चाली गई. पछी अंधारुं आव्युं ज्ञोईने ते स्त्रीओ पाई  
वणी. ४२ ए गोपीओ के जेनां मन भगवानमां ज लाग्यां हतां, तेमनुं भाषण  
भगवान संबंधी ज हतुं, भगवाननां अनुकरणानी लीला करती भगवद्वृप थई  
गई हती, ते गोपीओने पोताना धरनुं समरण ज आव्युं नहीं. ४३ भगवाननुं ज  
ध्यान करती ते गोपीओ पाई यमुनाञ्जने कांठे आवीने भगवानना पाई  
पधारवानी आशा राखी, जेणी थईने भगवाननुं गायन करवा लागी. ४४  
इति श्रीमद्भागवताणा भागवतना दशम ऋक्यनो श्रीशमो अद्याय संपूर्ण.

## अथैकत्रिंशोऽध्यायः (३९)

॥ गोप्य ऊचुः ॥

जयति तेऽधिकं जन्मना व्रजः श्रयत इंदिरा शश्वदत्र हि ।  
दयित दृश्यतां दिक्षु तावकास्त्वयि धृतासवस्त्वां विचिन्वते ॥१॥  
शरदुदाशये साधुजातसत् सरसिजोदरश्रीमृषा दृशा ।  
सुरतनाथ तेऽशुल्कदासिका वरद निजतो नेह किं वधः ॥२॥  
विषजलाप्ययाद् व्यालराक्षसाद् वर्षमारुताद् वैधुतानलात् ।  
वृषमयात्मजाद् विश्वोभयादृभ ते वयं रक्षिता मुहुः ॥३॥  
न खलु गोपिकानन्दनो भवानखिलदेहिनामन्तरात्मदृक् ।  
विखनसार्थितो विश्वगुप्ते सख उदेयिवान् सात्वतां कुले ॥४॥

अद्याय ३१  
भगवानना अंतर्धानिथी निराश थयेली अने केवण भगवाननाज  
गुडांनुं गायन करती गोपीओ. (गोपी गीत)

गोपीओ घाय छे- हे घ्यारा ! तमारा जन्मथी प्रजनो वधारे उत्कर्ष थयो  
छे, अने तमारे लीघे ज लक्ष्मीज्ञ निरंतर प्रजने शोभा आपे छे. आ प्रमाणे  
सधणुं प्रज आनंद पाभ्या करे छे, तेमां तमारी दासी गोपीओ ज के जेओ तमारे  
माटे ज प्राण राखेलां छे, तेओ तमने चारेकोर शोधवामां हुः खी थाय छे माटे  
दर्शन आपो.<sup>१</sup> हे संभोगना पति ! हे मनोरथ पूरनार ! तमारी जे दृष्टि  
शरदऋतुना तणावमां सारी रीते उत्पन्न थयेला प्रकृत्यित कमणना गर्भनी  
शोभाने हरी लेनार छे, ते दृष्टिथी अमो वगर महेनताणांनी दासीओने तमे  
मारो छो, ते शुं तमे वध करता नथी ? शखथी जे वध थाय ए ज शुं वध कुहेवाय ?  
माटे दृष्टिथी हरी लीघेला अमारा प्राणने पाई आपवा सारुं तमे दर्शन आपो.<sup>२</sup>  
जेरी जग्नथी थयेल नाशथी, अधासुरथी, वरसाद पवन अने वींजणीना पडवाथी,  
अरिष्टासुरथी, व्योमासुरथी अने बीजा पण सर्वे प्रकारना भयथी तमे अमारी  
वारंवार रक्षा करी छे, तो हमणां केम उपेक्षा करो छो ? कृपा करी घणा प्रकारना  
मृत्युथी रक्षा करीने हमणां दृष्टिथी कामदेवने मोक्षी अमने शा माटे मारी नाखो  
छो ?<sup>३</sup> हे भित्र ! तमे कांठ यशोदाना पुत्र नथी, पण सर्व प्राणीओनी बुद्धिना  
साक्षी ईश्वर छो. जगतना रक्षणने माटे ब्रह्माए प्रार्थना करवाथी यादवोना कुणमां

વિરચિતાભયં વૃણિધૂર્ય તે ચરણમીયુષાં સંસ્તેર્ભયાત् ।  
 કરસરોહં કાન્ત કામદં શિરસિ ધેહિ નઃ શ્રીકરગ્રહમ् ॥૫॥  
 બ્રજજનાર્તિહન્ વીર યોષિતાં નિજજનસ્મયધ્વંસનસ્પિત ।  
 ભજ સખે ભવત્કિઙ્કરીઃ સ્મ નો જલરુહાનનં ચારુ દર્શય ॥૬॥  
 પ્રણતદેહિનાં પાપકર્ણનં તૃણચરાનું શ્રીનિકેતનમ् ।  
 ફળિફળાર્પિતં તે પદામ્બું કૃણ કુચેષુ નઃ કૃન્થિ હૃછ્યમ् ॥૭॥  
 મધુરયા ગિરા વલનુવાક્યયા બુધમનોજ્ઞયા પુષ્કરેક્ષણ ।  
 વિધિકરીરિમા વીર મુહ્યતીરધરસીધુનાઽયાયયસ્વ નઃ ॥૮॥  
 તવ કથામૃતં તસ્મીવનં કવિભરીડિતં કલ્પણાપહમ् ।  
 શ્રવણમઙ્ગલં શ્રીમદાતતં ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જનાઃ ॥૯॥

અવતર્યા છો. જગતના પાલનને માટે અવતરેલા આપ ભક્તજનની ઉપેક્ષા કરો  
 એ અત્યંત અયોગ્ય છે. ૫ હે યાદવોમાં ઉત્તમ ! હે કાંત ! આપનું હસ્તકમળ સંસારના  
 ભયથી શરણે આવેલાને અભય આપનાર, મનોરથોને પૂરનાર અને લક્ષ્મીજીનો  
 હાથ જાલનાર છે, તે અમારા મસ્તક ઉપર ધારણ કરો. ૬ હે વ્રજવાસીઓનાં દુઃખને  
 હરનાર ! હે વીર ! હે મંદહાસ્યોથી ભક્તોના ગર્વને હરનાર ! હે મિત્ર ! અમો  
 તમારી દાસીઓ છીએ, તેથી અમોને તમે ભજો; અને પ્રથમ તો અમો સ્ત્રી લોકોને  
 તમારું કમળ સરખું મુખ દેખાડો. ૭ તમારું ચરણારવિંદ તમને નમસ્કાર કરનાર  
 પ્રાણીઓના પાપને હરનાર, કૃપાને લીધે પશુઓની પાછળ વનોવન શિલા તૃણ એ  
 આદિકને વિષે ભ્રમણ કરનાર, સૌભાગ્યને લીધે લક્ષ્મીજીના સ્થાનકરૂપ, અને  
 પરાકમને લીધે કાલીયનાગની ફણો ઉપર નાચેલું હતું, તે ચરણારવિંદને અમારા  
 સ્તન ઉપર ધરો અને કામજવરને મટાડો. ૮ હે કમળ સરખાં નેત્રવાળા ! હે વીર !  
 સુંદર વચ્ચનવાળી અને સમજુઓના મનને ગમે એવી તમારી મધુર વાણીથી મોહ  
 પામતી અમો દાસીઓને અધરામૃત પાઈને જીવાડો. ૯

તમારા વિરહથી અમને મોત આવ્યું જ હતું, પરંતુ ભાગ્યશાળી લોકોએ  
 અમને તમારી કથારૂપ અમૃત પાઈને તે મોતને કાઢી મેલ્યું છે. તમારી કથા જ  
 વાસ્તવિક રીતે અમૃત છે, કેમકે તે તાપ પામેલાઓને જીવાડનાર છે. ભ્રમવેતાઓ  
 પણ એજ અમૃતના વખાણ કરે છે, અને દેવતાઓને પીવાના અમૃતને તો તુચ્છ  
 ગણે છે. કથારૂપી અમૃત કામ અને કર્મને મટાડનાર છે અને દેવતાઓનું અમૃત  
 તો કામ અને કર્મને વધારનાર છે. કથારૂપી અમૃત સાંભળવા માત્રથી જ કલ્યાણ

પ્રહસિતં પ્રિય પ્રેમવીક્ષણં વિહરણં ચ તે ધ્યાનમઙ્ગલમ् ।  
 રહસ્ય સંવિદો યા હૃદિસ્પૃશઃ કુહક નો મનઃ ક્ષોભયન્તિ હિ ॥૧૦॥  
 ચલસિ યદ્વ બ્રજાચ્વારયન્ પશૂન્ નલિનસુન્દરં નાથ તે પદમ् ।  
 શિલતૃપાઙ્કુરૈ: સીદતીતિ નઃ કલિલતાં મન: કાન્ત ગચ્છતિ ॥૧૧॥  
 દિનપરિક્ષયે નીલકુન્તલૈર્વનરુહાનનં બિભ્રદાવૃતમ् ।  
 ઘનરજસ્વલં દર્શન્ મુહૂર્મનસિ નઃ સ્મરં વીર યચ્છસિ ॥૧૨॥  
 પ્રણતકામદં પદ્માજાર્ચિતં ધરણિમણદં ધ્યેયમાપદિ ।  
 ચરણપઙ્કજં શાન્તમં ચ તે રમણ નઃ સ્તનેષ્વર્યાધિહન્ ॥૧૩॥

આપે છે, અને દેવતાઓનું અમૃત તો યશાદિક કરીએ ત્યારે મળે છે. કથારૂપી  
 અમૃત તો શાંત છે, અને દેવતાઓનું અમૃત તો માદક છે. તમારી કથારૂપી આવા  
 અમૃતનું ભૂલોકમાં જેઓ વિસ્તારથી નિરૂપણ કરે છે, તેને અમો જીવન આપનારા  
 ગાણીએ છીએ. આ પ્રમાણે જ્યારે તમારી કથા પણ અમૃતથી અધિક છે ત્યારે  
 તમારું દર્શન તો સર્વોત્તમ હોય તેમાં શું કહેવું ? માટે માણીએ છીએ કે દર્શન દો. ૧૦  
 હે પ્રિય ! હે કપટી ! તમારું હસવું, પ્રેમથી જોવું, ધ્યાનમાં સુખ આપનાર વિહાર  
 અને હદ્યમાં લાગી રહેલી એકાંતની વાતો અમારા મનને ક્ષોભ પમાડે છે, માટે  
 જો કે તમારી કથાનું શ્રવણ જ સુખદાયી છે, તોપણ તેમાં અમારું મન શાંતિ  
 પામતું નથી, માટે દર્શન દો. ૧૧ હે નાથ ! હે કાંત ! જ્યારે પશુઓને ચારવા માટે  
 વ્રજથી તમે પદ્મારો છો ત્યારે, કમળ જેવાં તમારાં ચરણ કાંકરીઓ, ધાસ અને  
 અંકુરોથી કલેશ પામતાં હશે, એમ જાણી અમારું મન અસ્વસ્થ થઈ જાય છે, તો  
 આવી રીતે અમો તમારા ઉપર બહુ જ પ્રેમ રાખીએ છીએ, છતાં તમો અમારી  
 સાથે શા માટે કપટથી રમો છે ? ૧૨ હે વીર ! સાયંકાળે શ્યામ કેશથી વીંટાવાને  
 લીધે અને ગાયોની રજ ઉિડવાને લીધે ભ્રમરોથી વીંટાએલું અને ગાયોના પગથી  
 ઊડેલી પુષ્કળ રજથી ભરાયેલું તથા એ રજને પરાગ જાણીને ભ્રમરોથી ઘેરાએલું  
 આવું કમળ સરખું મુખ ધારણ કરીને આવતા આપ, તે મુખ વારંવાર દેખાડીને  
 કેવળ અમારા મનમાં કામદેવ ઉત્પત્ત કરો છો, પણ સંગ આપતા નથી માટે તમે  
 કપટી છો. ૧૩ હે મનની પીડાને મટાડનાર ! હે પ્રિય ! એટલા માટે હવે કપટ મૂકી  
 દઈને આપનું ચરણારવિંદ કે જે ભ્રમાએ પૂજેલું છે, પૃથ્વીના શાણગારરૂપ, કષ્ટના  
 સમયમાં ધ્યાન કરવાથી જ કષ્ટ મટાડનાર અને સેવાના સમયમાં પણ પરમ  
 સુખરૂપ છે, તેને અમારા કામજવરની શાંતિને માટે અમારા સ્તનો ઉપર ધારણ

સુરતવર્ધનં શોકનાશનં સ્વરિતવેણુના સૃષ્ટ ચુંબિતમ् ।  
 ઇતરરાગવિસ્મારણં નૃણાં વિતર વીર નસ્તેઽધરામृતમ् ॥૧૪॥

અટતિ યદ્ભ ભવાનહિ કાનનં ત્રુટ્યરૂપાયતે ત્વામપશ્યતામ् ।  
 કુટિલકુન્તલં શ્રીમુખં ચ તે જડ ઉદીક્ષતાં પદ્મકૃદ્દૃશામ् ॥૧૫॥

પતિસુતાન્વયભાતૃબાન્ધવાનિતિવિલઙ્ગ્ઘ્ય તેઽન્યચ્યુતાગતાઃ ।  
 ગતિવિદસ્તવોદ્ગીતમોહિતાઃ કિતવ યોષિતઃ કસ્ત્યજેન્નિશિ ॥૧૬॥

રહસ્ય સંવિદં હૃદ્યોદયં પ્રહસિતાનન્ન પ્રેમવીક્ષણમ् ।  
 બૃહદુરઃ શ્રિયો વીક્ષ્ય ધામ તે મુહુરતિસ્યહા મુહૃતે મનઃ ॥૧૭॥

વ્રજવનૌકસાં વ્યક્તિરઙ્ગ્ઠ તે વૃજિનહન્યલં વિશ્વમઙ્ગલમ् ।  
 ત્યજ મનાક્ષ ચ નસ્ત્વત્પૃહાત્મનાં સ્વજનહૃજું યત્ત્રિષૂદનમ् ॥૧૮॥

કરો. ૧૩ હે વીર ! તમારું અધરામૃત કે જે સંભોગને વધારનાર છે, શોકનો નાશ કરનાર છે, સ્વરવાળા વેણુએ સારી રીતે ચૂસેલ અને મનુષ્યોને બીજાં સર્વ સુખોની ઈચ્છાને ભૂલાવનાર છે, તે અધરામૃત અમને આપો. ૧૪ જ્યારે તમે દ્વિવસે વનમાં ફરો છો ત્યારે તમને નહિ દેખવાથી અમને અલ્પકાળ પણ યુગ જેવડો થઈ પડે છે, અને સાયંકાળે પાછું વાંકા કેશવાળું તમારું શ્રીમુખ જ્યારે જોઈએ છીએ ત્યારે, અમારા નેત્રોની પાંપણો આડી આવીને દર્શનમાં પ્રતિબંધ કરે છે. તેને સહન ન કરી શકવાથી તે પાંપણોને બનાવનાર બ્રહ્મા ઉપર અમને દ્રેષ આવે છે. એટલા માટે ક્ષણ માત્ર પણ તમારું દર્શન નહીં મળતાં દુઃખ, અને મળતાં સુખ થાય છે, આવી પરિસ્થિતિ હોવાથી સર્વ સંગનો ત્યાગ કરી, સંન્યાસિનીઓની પેઠે અમો તમારી પાસે આવેલી છીએ, તેમ છતાં તમો અમારો ત્યાગ કરવાનું મન કેમ કરો છો ? ૧૫ હે પ્રભુ ! હે કપટી ! અમે સર્વ પતિ, પુત્ર, સંબંધીઓ, ભાઈઓ અને બાંધવોને નહીં ગણકારીને, અમારા આવવાના કારણને જાણનારા આપની પાસે, આપના ગાયનથી મોહ પામીને પોતાની મેળે ચાલી આવેલી સ્ત્રીઓ છીએ, તે સ્ત્રીઓનો રાત્રીના સમયમાં તમારા વિના બીજો કોણ ત્યાગ કરે. ૧૬ તમારું હસતું મુખારવિંદ, પ્રેમપૂર્વક જોવું, લક્ષ્મીના સ્થાનકરૂપ મોટું વક્ષઃસ્થળ, એકાંતના સંકેત, તેને જોઈને અમારા મનમાં કામદેવનો ઉદ્ય થયેલો છે, તેથી આપની જંખના કરતું અમારું મન વારંવાર મુંઝાય છે. ૧૭ હે શ્રીકૃષ્ણ ! આપનું પ્રાકટ્ય વન અને પ્રજમાં રહેનારાઓના દુઃખને મટાડનાર છે, અને જગતમાં અયંત મંગળરૂપ છે, માટે અમારાં મન તમારી કામનાથી વ્યાત છે, તેઓને પોતાના ભક્તજનોના

યત્તે સુજાતચરણાંબુરુહં સ્તનેષુ ભીતાઃ શનૈઃ પ્રિય દધીમહિ કર્કશેષુ ।  
 તેનાટવીમટસિ તદ્વયથતે ન કિસ્વિત્કૂર્પાદિભિર્ભર્મતિ ધીર્ભવદાયુષાં નઃ ॥૧૯॥

ઇતિ શ્રીમદ્બાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્દ્યે પૂર્વર્ધી રાસક્રીડાયાં ગોપીગીતં નામેકત્રિંશોઽધ્યાય: ॥૩૧॥

## અથ દ્વાત્રિંશોઽધ્યાય: (૩૨)

॥ શ્રીશુકુત્વાચ ॥

ઇતિ ગોપ્ય: પ્રગાયન્ત્ય: પ્રલપંત્યશ્ર ચિત્રથા । રૂરુદુ: સુસ્વરં રાજનુ કૃષ્ણાર્દર્શનલાલસા: ॥૧  
 તાસામાવિરભૂછ્છૈરિ: સ્મયમાનમુખામ્બુજઃ । પીતામ્બરધર: સ્વર્ગવી સાક્ષાત્નમન્મથમન્મથ: ॥૨  
 તં વિલોક્યાગતં પ્રેષું પ્રીત્યતુફલ્લંશોઽબલાઃ । ઉત્સ્વરૂપગત્ત સર્વાસ્તન્નઃ પ્રાણમિવાગતમ् ॥૩

હદ્યના રોગનો નાશ કરનાર જે અયંત ગુમ ઔષધ છે, તે થોડુંક પણ આપો. એ ઔષધને તમે જાણો છો. ૧૦ (અયંત પ્રેમથી વ્યાકુળ થઈ રોતી રોતી ખોલે છે) હે પ્રિય ! તમારા જે સુકોમળ ચરણારવિંદને અમે અમારા કઠણ સ્તન ઉપર ભીતી ભીતી ધરીએ છીએ, તે ચરણારવિંદથી તમે તો વનમાં ફરો છો, તો એ ચરણારવિંદ જીણી કાંકરીઓ આદિથી વથા નહીં પામતું હોય ? આવો વિચાર કરીને તો તમોને જ આધીન જેમનું જીવન છે, એવી જે અમો તે અમારી બુદ્ધિ મુંઝાઈ જાય છે, અમારી બુદ્ધિને ચક્કર આવી જાય છે. ૧૧

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંદના એકગ્રીશમા અદ્યાય સંપૂર્ણ.

## અદ્યાય ૩૨

ગોપીઓના વિરહથી પીગળોલા શ્રીકૃષ્ણ ભગવાને પ્રગટ થઈ,  
 માન આપી, ગોપીઓને શાંત કરી.

શુકુદેવજી કહે છે- હે રાજા ! આ પ્રમાણે ગાતી અને વિચિત્ર પ્રકારે પ્રલાપ કરતી ગોપીઓ ભગવાનનાં દર્શનની ઈચ્છાથી ઊંચે સ્વરે રોવા લાગી. ૧ તે સમયે પીતાંબર તથા માળાને ધરનાર, સાક્ષાતું કામદેવને પણ મોહ પમાડનાર અને જેમનું મુખારવિંદ હસતું હતું એવા ભગવાન તે ગોપીઓની વચ્ચમાં પ્રકટ થયા. ૨ તે પ્રિય શ્રીકૃષ્ણને આવ્યા જોઈ જેની દસ્તિઓ પ્રીતિથી પ્રદુલ્લિત થઈ ગઈ છે.

काचित् कराम्बुजं शौरेर्जग्नेऽज्जलिना मुदा । काचिद् दधार तद्वाहुमंसे चन्दनसूषितम् ॥४  
 काचिद्भज्जलिनागृह्णात्तन्वी ताम्बूलचर्चितम् । एका तदिङ्ग्रकमलं सन्तसा स्तनयोरधात् ॥५  
 एका भुकुटिमाबध्य प्रेमसंरभविह्वला । घनीवैक्षत् कटाक्षेपैः संदष्टशनच्छदा ॥६ ।  
 अपरानिमिषद्गृह्यां जुषाणा तनुखाम्बुजम् । आपीतमपि नातृप्यत् सन्तस्तच्चरणं यथा ॥७  
 तं काचिन्नेत्रन्धेण हृदि कृत्य निमील्य च । पुलकाङ्गयुपगुह्यास्ते योगीवानन्दसम्पुलता ॥८  
 सर्वास्ताः केशवालोकपरमोत्सवनिर्वृताः । जहुर्विरहं तापं प्राज्ञं प्राप्य यथा जनाः ॥९  
 ताभिर्विधूतशोकाभिर्भगवानच्युतो वृतः । व्यरोचताधिकं तात पुरुषः शक्तिभिर्यथा ॥१०  
 ताः समादाय कालिद्या निर्विश्य पुलिनं विभुः । विकसत्कुन्दमन्दासुरभ्यानिलषट्पदम् ॥११

अेवी सर्वे स्त्रीओ जेम प्राण आववाथी ईन्द्रियो उठे तेम एक सामटी उभी थई.<sup>३</sup> कोई गोपीओ प्रेमथी भगवाननुं हस्तकमण पोतानी अंजलीमां लीधुं, कोई ए यंदनथी शोभी रहेला भगवानना हाथने पोताना खभापर धर्यो.<sup>४</sup> कोई ए भगवाननुं यावेलुं पानबीडुं पोताना हाथमां लीधुं, क्रामज्जवरथी तपी रहेली कोई गोपी भगवाननुं यरण कमण पोताना स्तन उपर धर्यु.<sup>५</sup> स्नेहना कोपथी परवश थयेली कोई गोपी होठ उंसीने तथा अभर यढावीने कटाक्ष नाभवाथी ज्ञाने प्रहार करती होय तेम ज्ञेवा लागी.<sup>६</sup> नहीं भीयेली आंभोथी भगवानना मुखारविंदने ज्ञेया छतां पश वारंवार ज्ञेया करती कोई गोपी जेम भगवानना यरणने सेववाथी सत्पुरुषो तृमि न पामे तेम तृमि न पामी.<sup>७</sup> नेत्ररूप द्वारथी भगवानने हृदयमां लई, आंभो भींची जई, जेनां रुंवाडां उभां थई गयां हतां एवी कोई गोपी योगीनी पेठे भगवाननुं आविंगन करीने आनंदमां ज दुबी गई.<sup>८</sup> भगवानना दर्शनना परम आनंदथी सुख पामेली ते सर्वे गोपीओ ए जेम ईश्वरने पामी मुमुक्षु लोको ताप छोडी दे, जेम ब्रह्मवेताने पामी संसारी लोको ताप छोडी दे, अने जेम सुखुमिना साक्षीने पामी विश्व अने तेज्जस ज्ञव ताप छोडी दे, तेम विरहनो ताप छोडी दीधो.<sup>९</sup> हे राजा ! ते समये शोक रहित थयेली ते व्रजांगनाओथी वीटाएला श्रीकृष्ण, जेम सत्वादिक शक्तिओथी ईश्वर शोभे, उपासक पुरुष जेम शानादिक शक्तिथी शोभे, अने ज्ञव जेम योवीस तत्वात्मक शक्तिओथी शोभे तेम अत्यंत शोभवा लाग्या.<sup>१०</sup> ते समये श्रीकृष्ण भगवान ते स्त्रीओने लई यमुनाना कांठा उपर पधार्या. ऐ सुखकारी कांठामां भीली रहेलां कुंद अने मंदारना पुण्योना सुगंधवाणा पवनने लीधे अभरो उडता हता.<sup>११</sup>

शरच्चन्द्रांशुसन्दोहध्वस्तदोषात्मः शिवम् । कृष्णाया हस्ततरलाचितकोमलवालुकम् ॥१२  
 तदर्शनाहादविधूतहृद्वजो मनोरथान्तं श्रुतयो यथा ययुः ।  
 स्वैरुत्तरीयैः कुचकुङ्कुमाङ्कितैरचीक्लृपन्नासनमात्मबन्धवे ॥१३॥  
 तत्रोपविष्टे भगवान् स ईश्वरो योगेश्वरान्तहृदि कल्पितासनः ।  
 चकास गोपीपरिषद्गतोऽर्चितस्त्रैलोक्यलक्ष्म्येकपदं वपुर्दधत् ॥१४॥  
 सभाजयित्वा तमनङ्गदीपनं सहासलीलेक्षणविभ्रमभ्रुवा ।  
 संस्पर्शनेनाङ्ककृताङ्गिहस्तयोः संस्तुत्य ईषत्कुपिता बभाषिरे ॥१५॥  
 गोप्य ऊचुः  
 भजतोऽनुभजन्त्येक एक एतद्विपर्ययम् । नोभयांश्च भजन्त्येक एतत्रो ब्रूहि साधु भोः ॥१६

शरदऋतुना यंद्रमानां किरणोना समूहथी रात्रीनुं अंधारं मटी गयुं हतुं, यमुनाङ्गाथे पोताना तरंगोथी कोमण रेती पाथरी दीधी हती.<sup>१२</sup> जेम कर्मकांडमां परमात्मा नहीं देखावाने लीधे ते ते कामनाओथी अपूर्ण जेवी जणाती श्रुतिओ, शानकांडमां परमात्माने देखी तेना आनंदथी पूर्ण थवाने लीधे सर्वे कामनाने छोडी दे छे, तेम प्रथम भगवाननां दर्शनथी आतुर थयेली गोपीओ ए भगवाननां दर्शनना आनंदथी पूर्णकाम थईने हृदयना सर्वे संताप छोडी दीधा. (गीत पूर्ण) आवी रीते पूर्णकाम थया छतां पश प्रेमने लीधे ते गोपीओ अंतर्यामी एवा श्रीकृष्णने माटे स्तन उपरना क्षेत्रसोथी रंगायेलां पोतानां उत्तरीय वस्त्रोथी आसन करी आप्यु.<sup>१३</sup> गोपीओ ए मान आपेला, गोपीओ नी सभामां बेठेला, त्रैलोक्यनी शोभाना एक स्थानकरूप शरीरने धारण करता अने योगेश्वरोना अंतःकरणमां आसन करनारा भगवान, ते गोपीओ ए आपेला आसन पर बेसीने शोभवा लाग्या.<sup>१४</sup> भगवानना यरण अने हस्तने पोताना खोणामां लई यांपती एवी गोपीओ हास्य तथा लीला सहित ज्ञेवाथी शोभती एवी भृकुटीना विलासथी, क्रमदेवने वधारनार भगवाननो सत्कार करी, भीळ वातोनो प्रसंग लावीने कांઈक रीसने लीधे गोपीओ आप्रमाणे भगवानने पूछ्युं.<sup>१५</sup>

गोपीओ पूछे छे हे कृष्ण ! केटलाक पुरुषो पोताने भजनाराने पोताना भजनना प्रमाणमां भजे छे, केटलाक तेना भजननी अपेक्षा नहीं राखतां नहीं भजनाराओ ने पश भजे छे अने केटलाक भजनाराओ ने पश भजता नथी. आ विषयनुं अमारी पासे सारी रीते विवेचन करी कहो.<sup>१६</sup>

## શ્રીભગવાનુવાચ

મિથો ભજન્તિ યે સખ્યઃ સ્વાર્થીકાનોદ્યમા હિતે । ન તત્ત્ર સૌહૃદં ધર્મઃ સ્વાર્થાર્થ તદ્ધિ નાન્યથા ૧૭  
ભજન્ત્યભજતો યે વૈ કરુણાઃ પિતરો યથા । ધર્મો નિરપવાદોઽત્ર સૌહૃદં ચ સુમધ્યમાઃ ॥૧૮  
ભજતોऽપિ ન વૈ કેચિદ્ ભજન્ત્યભજતઃ કુતઃ । આત્મારામા હ્યામકામા અકૃતજ્ઞ ગુરુદ્રુહઃ ૧૯

નાહં તુ સખ્યો ભજતોઽપિ જન્મૂન્ ભજામ્યમીષામનુવૃત્તિવૃત્તયે ।

યથાધનો લબ્ધધને વિનષે તચ્છ્વન્તયાન્યન્ત્રિભૃતો ન વેદ ॥૨૦॥

એવં મદથોઝિતલોકવેદસ્વાનાં હિ વો મય્યનુવૃત્તયેઽબલાઃ ।

મયા પરોક્ષં ભજતા તિરોહિતં માસૂયિતું માર્હથ તત્ત્વિયં પ્રિયાઃ ॥૨૧॥

શ્રી ભગવાન કહે છે હે સખીઓ ! જેઓ પરસ્પરને ભજે છે એટલે ભજનારાઓને ભજે છે, તેઓ બીજાને ભજતા નથી પણ પોતાને જ ભજે છે, કેમકે એ લોકોનું ભજન કેવળ પોતાનો સ્વાર્થ મેળવવાના ઉધમરૂપ હોય છે, એ ભજન વાસ્તવિક રીતે ગાય, ભેંસની ચાકરી કર્યા જેવું સ્વાર્થરૂપ હોય છે, માટે તેવા ભજનમાં સાચો સ્નેહ નહીં રહેવાને લીધે સુખ નથી અને દેખીતા ફળનો ઉદ્દેશ હોવાને લીધે ધર્મ પણ નથી.<sup>૧૦</sup> હે સુંદરીઓ ! નહિ ભજનારાઓને પણ ભજનારા બે પ્રકારના છે. એક તો દ્યાળુ લોકો અને બીજા માતા-પિતા જેવા સ્નેહી લોકો. તેમાં સંસૂતિના દુઃખને પામેલા જનોને જોઈને સ્વાર્થથી રહિત કેવળ દ્યાળુ સાધુપુરુષો પોતાને નહિ ભજનારા એવા જનોને પણ ભગવાનના શાનનો ઉપદેશ આપીને સંસાર થકી તારે છે. માટે દ્યાળુ થઈને ભજવામાં નિર્દોષ ધર્મ રહ્યો છે. અને માતા પિતા પોતાને નહિ ભજનારા એવા પણ પુત્રોનું પોષણ કરે છે. તેમાં સાચો પ્રેમ રહ્યો છે.<sup>૧૧</sup> હવે ત્રીજા પ્રશ્ન વિષે કહું છું. જેઓ ભજનારાઓને પણ ભજતા નથી, ત્યારે નહીં ભજનારાઓને તો કયાંથી ભજે ? એવા હોય છે તેઓ ચાર પ્રકારમાં સમાય છે. એક તો આત્મારામ, બીજા પ્રિય પદાર્થ દેખવામાં આવતાં પણ પોતે પૂર્ણકામ હોવાને લીધે ભોગની ઈચ્છા વગરના અર્થાત્ જેઓને સર્વ સંપૂર્ણ હોવાથી કોઈ પદાર્થની અપેક્ષા નથી તેઓ. ત્રીજા અકૃતજ્ઞ (ઉપકારને નહીં જાણારા) ચોથા ગુરુદ્રોહી. છેલ્લા પ્રશ્નમાં શ્રીકૃષ્ણ આવી જાય છે એમ માની ગોપીઓ સામ સામા આંખના ઈશારા કરી એકબીજાને જણાવવા લાગી અને છાનું માનું હસવા લાગી તે જોઈને શ્રીકૃષ્ણ કહેવા લાગ્યા. <sup>૧૨</sup> હે સખીઓ ! હું તેમાંથી કોઈ પણ પ્રકારનો નથી, પણ પરમ દ્યાળુ અને પરમ સ્નેહી છું; કેમકે

ન પારયેઽહં નિરવદ્યસંયુજાં સ્વસાધુકૃત્યં વિબુધાયુષાપિ વઃ ।

યા માભજન્ દુર્જરગેહશૃઙ્ગલાઃ સંવૃષ્ટ્ય તદ્વઃ પ્રતિયાતુ સાધુના ॥૨૨॥

ઇતિ શ્રીમદ્બાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સહિતાયાં દશમસ્કન્દ્યે પૂર્વાર્થી  
રાસક્રીડાયાં ગોપીસાન્ત્વનં નામ દ્વાત્રિંશોઽધ્યાય: ॥૩૨॥

ભજનારાઓનું મારામાં નિરંતર ધ્યાન રહે તેને માટે, હું ભજતો હોય તેને પણ ભજતો નથી. જેમ નિર્ધન માણસ પોતાને મળેલું ધન જતું રહેતાં તેની ચિંતાથી એવો વ્યાકુણ થઈ જાય છે કે તેને બીજું ભૂખ તરસ આદિનું પણ શાન રહેતું નથી, અર્થાત્ તેનું ધ્યાન નિરંતર ધનમાં જ રહે. એજ રીતે તમો યોગ્ય અયોગ્ય નહીં જોવાથી લોકનો, ધર્મ અધર્મ નહીં જોવાથી વેદનો, અને સ્નેહ છોડી દેવાથી સંબંધીઓનો પણ મારે માટે ત્યાગ કર્યો છે, તમારું ધ્યાન મારામાં જ નિરંતર રહે તેને માટે હું અંતર્ધાન થઈ ગયો હતો, અને એવી રીતે અદ્દ્ય રહીને પણ તમારાં પ્રેમનાં વચન સાંભળતો હતો. માટે, હે પ્યારી સ્ત્રીઓ ! તમે મને ન જુઓ એ રીતે હું તમોને ભજતો હતો, અને તમારા પ્રેમના આલાપ સાંભળતો હતો, તેથી પ્રિયતમ એવો જે હું તે મારા ઉપર દોષારોપણ કરવાને તમે યોગ્ય નથી.<sup>૨૦-૨૧</sup> આ વાત પડતી મૂકીને હવે વાસ્તવિક વાત કહું છું તે સાંભળો. જે તમો મારી સાથે નિર્દોષ રીતે જોડાએલી છો, તેથી દેવતાઓના જેટલી આયુષ્યથી પણ હું તમારા ઉપકારનો બદલો વાળી શકું તેમ નથી. કારણ કે તોડી ન શકાય એવી ઘરરૂપી સાંકળોને તોડી નાખીને તમોએ મારું સેવન કર્યું છે, માટે એ તમારા ઉપકારનું ઋષા તમારી સુશીલતાથી જ મારા ઉપરથી ઉત્તરવું જોઈએ, પણ મેં કરેલા પ્રત્યુપકારથી ઉતરે એમ નથી.<sup>૨૨</sup>

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કર્યાનો  
બત્રીશમો અદ્યાય સંપૂર્ણ.

## अथ त्रयस्त्रिंशोऽध्यायः (३३)

श्रीशुकउवाच

इत्थं भगवतो गोप्यः श्रुत्वा वाचः सुपेशलाः । जहुर्विरहं तापं तदंगोपचिताशिषः ॥१  
तत्रारभत गोविन्दो रासक्रीडामनुकृतैः । स्त्रीतैरन्योन्याबद्धबाहुभिः ॥२  
रासोत्सवः सम्प्रवृत्तो गोपीमण्डलमण्डितः । योगेश्वरेण कृष्णेन तासां मध्ये द्वयोद्वयोः ।

प्रविष्टेन गृहीतानां कण्ठे स्वनिकटं स्त्रियः ॥३

यं मन्येरन् नभस्तावद् विमानशतसङ्कुलम् । दिवौकसां सदाराणामौत्सुक्यापहृतात्मनाम् ॥४  
ततो दुन्दुभयो नेदुनिपेतुः पुष्पवृष्टयः । जगुर्गन्धर्वपतयः सस्त्रीकास्तद्यशोऽमलम् ॥५  
वलयानां नूपुराणां किङ्किणीनां च योषिताम् । सप्रियाणामभूच्छब्दस्तुमुलो रासमण्डले ॥६  
तत्रातिशुशुभे ताभिर्भगवान् देवकीसुतः । मध्ये मणीनां हेमानां महामरकतो यथा ॥७  
पादन्यासैर्भुजविधुतिभिः सस्मितैर्भूविलासैर्भञ्ज्यमध्यैश्वलकुचपटैः कुण्डलैर्गण्डलोलैः ।  
स्विद्यन्मुख्यः कबररशनाग्रन्थयः कृष्णावध्यो गायन्त्यस्तं तडित इव ता मेघचक्रे विरेजुः ॥८

## अध्याय ३३

गोपीओनी साथे रासलीला तथा जगलीला करता भगवान्.

शुक्टेवज्ञ कहे छे- हे राजा ! आ प्रभाणे भगवाननां अत्यंत कोमणि वयन सांभणीने जेना मनोरथो पूर्ण थया छे, ऐवी गोपीओनो विरहथी थअेलो ताप मटी गयो.<sup>१</sup> पछी त्यां भगवाने पोताने अनुसरनारी, राज्ञ थयेली अने परस्परना हाथनी साथे हाथ गूँथी लઈने उभेली ए उत्तम व्रजांगनाओनी साथे रासकीडा करवानो प्रारंभ कर्यो.<sup>२</sup> सर्वे गोपीओ मंडलाकारथी उभी रही, त्यारे श्रीकृष्ण भगवाने पोतानी शक्तिथी बे बे गोपीओनी वयमां एक एक रुपथी प्रवेश कर्यो अने तेमणे पोताना बन्ने पडभानी गोपीओना कंठीमां हाथ मूळया. प्रत्येक गोपी अम भानवा लागी के भगवान मारी पासे ज छे अने मारुं ज आविंगन कर्यु छे. आवी रीते रासोत्सव चालुं थयो, तेटली वारमां उत्साहथी चित भेंचावाने लीधे पोतपोतानी स्त्री सहित देवताओ आकाश मार्ग जेवा आव्या, तेथी सेंकडो विमानोनी आकाशमां भीड जामी.<sup>३-४</sup> पछी हुँदुभी वागवा लाँयां. फूलनी वृष्टिओ पडवा लागी, स्त्रीओ सहित मोटा मोटा गंधर्वो भगवानना निर्मण यशने गावा लाँया.<sup>५</sup> रासमंडलमां श्रीकृष्ण सहित गोपीओना कंकण, जांजर अने धुधरीओनो तुमुल शब्द थयो.<sup>६</sup> जेम बबे सोनाना मणीओनी वयमां निलमणी शोभे तेम सोना जेवा वर्णवाणी ते बज्बे गोपीओनी वयमां देवकीना

उच्चैर्जगुर्नृत्यमाना रक्तकण्ठयो रतिप्रियाः । कृष्णाभिर्मर्शमुदिता यदीतेनेदमावृतम् ॥९  
काचित् समं मुकुदेन स्वरजातीरमिश्रिताः । उत्तिन्ये पूजिता तेन प्रीयता साधु साधिति ।

तदेव ध्रुवमुनिन्ये तस्मै मानं च बह्वात् ॥१०

काचिद् रासपरिश्रान्ता पार्श्वस्थस्य गदाभृतः । जग्राह बाहुना स्कन्धं श्लथद्वलयमळिका ११  
तत्रैकांसगतं बाहुं कृष्णस्योत्पलसौरभम् । चन्दनालिमाद्याय हृष्टरोमा चुचुम्ब ह ॥१२  
कस्याश्चिन्नाट्यविक्षिप्तकुण्डलत्विषमण्डितम् । गण्डं गण्डे सन्दधत्या अदाताम्बूलचर्वितम् १३  
नृत्यनी गायती काचित् कूजन्नपुरमेखला । पार्श्वस्थाच्युतहस्ताब्जं श्रान्ताऽधात् स्तनयोः शिवम् १४  
गोप्यो लब्धवाच्युतं कान्तं श्रिय एकान्तवल्लभम् । गृहीतकण्ठस्तद्वैर्यां गायन्त्यस्तं विजहिरे १५

पुत्र नीलवर्णवाणा श्रीकृष्ण शोभवा लाँया.<sup>७</sup> पग मांडवा, हाथ हलाववा, मंद हास्य सहित भृकुटीना विलास, जाणे कटका थई जती होय तेम वणी कमर, हालतां स्तन, हालतां वस्त्र, गंडस्थणमां हालतां कुंडण अने पसीनावाणां मोढांओथी शोभती भगवाननुं गायन करती अने जेओना केश तथा कटीमेखणाओनी गांठो ढीली पडी जती हती, ऐवी गोपीओ भेघना समूहमां वीजणीओनी पेठे शोभती हती.<sup>८</sup> नायती, जातजातना स्वरोथी मधुर कंठवाणी, रतिमां प्रीतिवाणी अने भगवानना स्पर्शथी राज्ञ थयेली गोपीओ उंचा स्वरेथी गावा लागी, ते गायनथी सर्वे जगत शब्दथी भरपूर थई गयुं.<sup>९</sup> कोई गोपीऐ भगवानना स्वरनी साथे पोताना स्वरनो आलाप न मणतो होवाने कारणो ते समये ज ध्रुव ताल करीने पोतानो स्वर उंचो कर्यो, तेथी भगवाने राज्ञ थईने तेने वाह वाह कही सत्कार कर्यो अने मान आप्युं.<sup>१०</sup> रासथी थाकेली अने जेनां कंकण तथा भलिकानां फूल शिथिल थई जतां हतां एवी कोई गोपी पोताना हाथथी पडभामां रहेला भगवाननो खत्तो पकडी उभी रहेती हती.<sup>११</sup> कोई गोपी कमणि सरभी सुगंधवाणा चंदनथी लीपाएला अने पोताना खभा उपर रहेला श्रीकृष्णना हाथने सुंधी रुवाडां उभां थई जतां चूंबन करवा लागी जती हती.<sup>१२</sup> कोई गोपी नृत्यने लीधे चालतां कुंडणोनी कांतिथी शोभी रहेला गालने ज्यारे श्रीकृष्णना गाल साथे जेडी देती हती, त्यारे भगवान तेने चावेलुं पान आपता हता.<sup>१३</sup> नायती, गाती अने जेनां जांजर तथा कटीमेखणा शब्द करता हता ऐवी कोई गोपी थाकी जवाने लीधे पडभामां उभेला श्रीकृष्णनो हस्त पोताना स्तन उपर धारणा करती हती.<sup>१४</sup> लक्ष्मीज्ञना परम प्रिय भगवाननो पतिरुपे समागम पामी, तेमनुं गायन करती अने श्रीकृष्णना हाथ जेना गणामां लाँया

કર્ણોત્પલાલકવિટઙ્કકપોલઘર્મવકવ્રશ્રિયો વલયનૂરુધોષવાદૈઃ ।  
 ગોપ્યઃ સમં ભગવતા નનૃતુઃ સ્વકેશસ્વસ્તસ્તવજો ભ્રમરગાયકરાસગોછ્યામ् ॥૧૬॥  
 એવં પરિષ્વઙ્કરાભિમર્શસ્નિગ્ધેક્ષળોદ્દામવિલાસહાસૈઃ ।  
 રેમે રેમેશો વ્રજસુન્દરીભર્યથાર્ભકઃ સ્વપ્રતિબિમ્બવિભ્રમઃ ॥૧૭॥  
 તદ્ભૂત્પ્રમદુકાલેન્દ્રિયાઃ કેશાનુદુકુલં કુચપદ્ધિકાં વા ।  
 નાભ્જઃ પ્રતિવ્યોદુમલં વ્રજસ્ત્રિયો વિસ્ત્રસ્તમાલાભરણાઃ કુરુદ્વા ॥૧૮॥

કૃષ્ણવિક્રીડિતં વીક્ષ્ય મુમુહુઃ ખેચરસ્ત્રિયઃ । કામાર્દિતાઃ શાશાઙ્કશ્ચ સગણો વિસ્મિતોऽભવત् ૧૯  
 કૃત્વા તાવન્તમાત્માનં યાવતીર્ગોપ્યોષિતઃ । રેમે સ ભગવાંસ્તાભિરાત્મારામોઽપિ લીલયા ॥૨૦  
 તાસામતિવિહારેણ શ્રાન્તાનાં વદનાનિ સ: । પ્રામૃજત् કરુણઃ પ્રેમણ શન્તમેનાઙ્ગ પાણિના ૨૧

હતા એવી ગોપીઓ ભગવાનની સાથે વિહાર કરતી હતી.<sup>૧૫</sup> ત્યાં સ્ત્રીઓ સહિત ગાંધર્વો અને કિશરાદિક વાજાં વગાડતા હતા અને ગવૈયા બન્યા હતા, ઇતાં તેઓ સર્વે રાસના આવેશથી મોહ પામતાં અને નાચવા લાગી જતાં કંકણ અને ઝાંઝર જ જેમાં વાજાંનું કામ કરતાં હતાં, અને આવી તે રાસમંડળીમાં ગોપીઓ ભગવાનની સાથે નાચતી હતી, કાન ઉપરનાં પુષ્પના ગુંઘોથી, કેશથી શોભી રહેલા ગાલથી અને પસીનાથી તેઓનાં મોઢાં શોભી રહ્યાં હતાં. નાચ કરતાં કેશમાંથી ફૂલની માળાઓ ખરી પડતી હતી તેથી એવું જણાતું હતું કે તાલની ગતિથી રાજુ થયેલા કેશ જાણો માથાં હલાવીને પગ ઉપર ફૂલની વૃષ્ટિ કરતા હોય.<sup>૧૬</sup> ગોપીઓ જેમ ભગવાનની સાથે નાના પ્રકારના વિલાસોથી રમતી હતી તેમ ભગવાન પણ આલિંગન, હાથના સ્પર્શ, સ્નેહથી જોવું, ઉત્તમ વિલાસ અને હાસ્યથી તે ગોપીઓની સાથે રમતા હતા. બાળક જેમ પોતાની સમાન બીજાં બોળકોની સાથે કીડા કરે તેમ પોતાના સાધર્મ્યપણાને પામેલી ગોપીઓ સાથે ભગવાન કીડા કરતા હતો.<sup>૧૭</sup> હે રાજા ! ભગવાનનો અંગસંગ મળવાના પ્રેમથી પરવશ થયેલી અને જેની માળા તથા આભરણ ખસી જતાં હતાં એવી ગોપીઓના કેશ, સાડીઓ કે સતન ઉપરની ડગલીઓ શિથિલ થઈ જતી હતી. તેઓની સંભાળ રાખવાને પણ સમર્થ રહી ન હતી.<sup>૧૮</sup> ભગવાનની રાસકીડા જોવાથી દેવતાની સ્ત્રીઓ પણ કામાતુર થઈને મોહ પામી ગઈ અને ચંદ્રમા પણ ગ્રહનક્ષત્રાદિકના મંડળ સહિત વિસ્મય પામી ગયો હતો.<sup>૧૯</sup> જેટલી ગોપીઓ હતી તેટલાં જ પોતાનાં શરીર ધારણ કરીને પોતે આત્મારામ હોવા ઇતાં પણ ગોપીઓની સાથે રમ્યા.<sup>૨૦</sup> હે રાજા ! દયાળું ભગવાન અત્યંત વિહારથી થાકી ગયેલી એ ગોપીઓનાં મોઢાં

ગોપ્યઃ સ્ફુરત્યુરટકુન્ડલકુન્તલત્વિઙ્ગણ્ડશ્રિયા સુધિતહાસનિરીક્ષણેન ।  
 માનં દધત્ય ઋષભસ્ય જગુઃ કૃતાનિ પુણ્યાનિ તત્કરરુહસ્પર્શપ્રમોદાઃ ॥૨૨॥  
 તાભિર્યુત: શ્રમમપોહિતુમઙ્ગદ્યુષ્ટસ્ત્રજઃ સ કુચકુઙ્ગમરજ્જતાયા: ।  
 ગન્ધર્વપાલિભિરનુદ્રુત આવિશદ્વા: શ્રાન્તો ગજીભિરિભરાંડિવ ભિન્નસેતુ: ॥૨૩॥  
 સોઽભ્રસ્યલં યુવતિભિ: પરિષિચ્યમાન: પ્રેમોક્ષિત: પ્રહસતીભિરિતસતોઽઙ્ગ ।  
 વૈમાનિકૈ: કુસુમવર્ષિભિરીઙ્ગમાનો રેમે સ્વયં સ્વરતિરત્ર ગજેન્દ્રલીલ: ॥૨૪॥  
 તત્શ્ર કૃષ્ણોપવને જલસ્થલપ્રસૂનગન્ધાનિલજષ્ટદિક્તટે ।  
 ચચાર ભૂઙ્ગ્રમદાગણાવૃતો યથા મદચ્યુદ દ્વિરદ: કરેણુભિ: ॥૨૫॥  
 એવં શશાઙ્કાંશુવિરાજિતા નિશા: સ સત્યકામોઽનુરતાબલાગણ: ।  
 સિષેવ આત્મન્યવરુદ્ધસૌરત: સર્વા: શરત્કાવ્યકથારસાશ્રયા: ॥૨૬॥

પોતાના પરમ સુખદાયી હાથથી સાઝ કરતા હતા.<sup>૨૧</sup> ચણકતાં સોનાનાં કુંડળ અને કેશની કાંતિથી થયેલી ગાલ ઉપરની શોભાવડે અને અમૃત સમાન મંદ હાસ્ય સહિત જોવાથી ભગવાનને માન આપતી અને ભગવાનના નખના સ્પર્શથી પરમ સુખ પામતી ત્રાજાંગનાઓ ભગવાનના પવિત્ર ચરિત્રોનું ગાયન કરતી હતી.<sup>૨૨</sup>  
 થાકી રહેલા અને જણે લોક તથા મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું એવા ભગવાન, જેમ હાથી હાથણીઓની સાથે જળમાં પ્રવેશ કરે તેમ ગોપીઓની સાથે થાક ઉતારવા માટે જળમાં પ્રવેશ કર્યો અને તે સમયમાં અંગસંગથી મર્દન પામેલી અને સ્તનનાં કેસરોથી રંગાએલી માળાના ભમરાઓ પણ ગાંધર્વોની પેઠે ગાયન કરતા તેમની પછીવાડે ગયા.<sup>૨૩</sup> હે રાજા ! જળની અંદર ખડ્યાટ હસતી યુવાનિ ગોપીઓ ચોતરફથી ભગવાન ઉપર પાણી ઉડાડતી પ્રેમ પૂર્વક જોતી હતી. બીજી તરફ વિમાનમાં બેઠેલા દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરી ભગવાનની સ્તુતિ કરતા હતા, આવા ભગવાન પોતે આત્મારામ ઇતાં પણ મોટા હાથીના જેવી લીલાથી જળમાં રમ્યા.<sup>૨૪</sup>  
 પછી ભમરો અને સ્ત્રીઓના ટોળાંથી વીંટાએલા ભગવાન, જેમ મદ જરતો હાથી હાથણીઓની સાથે ફરે તેમ જળ અને સ્થળનાં પુષ્પોની સુગંધીવાળા પવનથી જેની દિશાઓ અને સ્થળ વ્યામ હતાં, એવા યમુનાજીના ઉપવનમાં ફર્યા.<sup>૨૫</sup> આ પ્રમાણે સત્ય સંકલ્પવાળા, સ્નેહ ભરેલી સ્ત્રીઓના સમૂહમાં રહેલા અને જેને પોતાના વીર્યને સ્ખલિત થવા દીધું નથી, એવા ભગવાને ચંદ્રમાના કિરણોથી શોભી રહેલી શરદીતુની રાત્રીઓમાં, શરદીતુમાં કરવાની જે જે લીલાઓ સાહિત્યના ગ્રંથોમાં લખેલી છે તે સર્વે કરી.<sup>૨૬</sup>

## राजोवाच

संस्थापनाय धर्मस्य प्रशमायेतरस्य च । अवतीर्णो हि भगवानंशेन जगदीश्वरः ॥२७  
स कथं धर्मसेतूनं वक्ता कर्ताभिरक्षिता । प्रतीपमाचरद् ब्रह्मन् परदाराभिर्मर्शनम् ॥२८  
आसकामो यदुपतिः कृतवान् वै जुगुप्सितम् । किमभिप्राय एतं नः संशयं छिन्थि सुव्रत २९

## श्रीशुक उवाच

धर्मव्यतिक्रमो दृष्टे ईश्वराणां च साहसम् । तेजीयसां न दोषाय वहेः सर्वभुजो यथा ॥३०  
नैतत् समाचरेज्जातु मनसापि हनीश्वरः । विनश्यत्याचरन् मौद्याद्यथारुद्रोऽविजं विषम् ३१  
ईश्वराणां वचः सत्यं तथैवाचरितं क्वचित् । तेषां यत् स्ववचोयुक्तं बुद्धिमांस्तत् समाचरेत् ३२  
कुशलाचरितेनैषमिह स्वार्थो न विद्यते । विपर्ययेण वानर्थो निरहंकारिणां प्रभो ॥३३

परीक्षित राजा पूछे छे- हे महाराज ! धर्मनुं स्थापन करवाने माटे अने अधर्मनो नाश करवाने माटे जगतना ईश्वर भगवान पोते बलरामनी साथे अवतर्या छे, तो धर्मनी भर्यादाओने कहेनारा, करनारा अने रक्षण करनारा ते भगवाने मात्र अधर्मरूप अने महासाहसरूप परस्त्रीओनो संग केम कर्यो? २७-२८  
हे भुने ! भगवान पूर्णकाम होवाने लीधे तेमणे करेलुं आ काम अधर्मरूप न कहेवाय, ऐम आप धारता हो तो कांઈ पण कामना नहीं होवा छतां, आवुं निंदित काम शा अभिप्रायथी कर्यु ? ऐ विषयनो अभारो संशय दूर करो. २९

शुकदेवज्ञ कहे छे- भ्रत्सा, ईश्वर, यंद्रमा अने विश्वामित्र आहि महात्मा पुरुषो ए धर्मनुं उल्लंघन अने साहस पण करेला छे, परंतु अग्निने जेम सर्व पदार्थनुं भक्षण करवाथी दोष लागतो नथी, तेम तेजस्वी पुरुषो ए धर्मनुं उल्लंघन करवानो के साहस कर्म करवानो दोष लागतो नथी. ३० आ उपरथी ऐम समजवुं नहीं के मोटाओनुं जोईने बीजा पुरुषो पण ए प्रमाणे करशे. केमके देहादिकना अभिमानवाणा ज्वकोटिना पुरुषे तो मनथी पण कही आवुं काम करवुं योग्य नथी. समुद्रमांथी उत्पन्न थयेलुं झेर सदाशिव पी गया हता, पण तेने जोईने बीजो कोई झेर पीए तो जेम भरण पाम्या विना रहे ज नहीं, तेम भूर्भूपणाथी बीजो कोई आवुं काम करे तो तेनुं अकल्याश थया विना रहे ज नहीं. ३१ आ उपरथी सदाचारनुं प्रमाणपणुं भटी जाय छे ऐम पण समजवुं नहीं, केमके मोटापुरुषो नुं वयन प्रमाणरूप होय छे, पण तेओनुं आयरण तो कोई समये प्रमाणरूप गणाय नहीं. ऐटला माटे पोताना वयनथी विरुद्ध नहीं जतुं, अवुं जे जे महापुरुषो नुं आयरण होय ते प्रमाणो ज बुद्धिमाने चालवुं जोईए. ३२ हे राजा !

किमुताखिलसत्त्वानां तिर्यङ्गर्त्यदिवौकसाम् । ईशितुश्वेशितव्यानां कुशलाकुशलान्वयः ३४

यत्पादपङ्कजपरागनिषेवत्सा योगप्रभावविधुताखिलकर्मबन्धाः

स्वैरं चरन्ति मुनयोऽपि न नह्यमानास्तस्येच्छ्याऽऽत्तवपुषः कुत एव बन्धः ॥३५  
गोपीनां तत्यतीनां च सर्वेषामेव देहिनाम् । योऽन्तश्शरति सोऽध्यक्षः क्रीडनेनेह देहभाक् ३६  
अनुग्रहाय भूतानां मानुषं देहमास्थितः । भजते तादृशीः क्रीडा याः श्रुत्वा तत्परो भवेत् ३७  
नासूयन् खलु कृष्णाय मोहितास्तस्य मायया । मन्यमानाः स्वपार्श्वस्थान् स्वान् दारान् व्रजौकसः  
ब्रह्मरात्र उपावृत्ते वासुदेवानुमोदिताः । अनिच्छन्त्यो ययुर्गाप्यः स्वगृहान् भगवत्यिर्याः ॥३९

विक्रीडितं व्रजवधूभिरिदं च विष्णोः श्रद्धान्वितोऽनुशृण्यादथ वर्णयेद्याः ।

भर्त्ति परां भगवति प्रतिलभ्य कामं ह्योगमाश्वपहिनोत्यचिरेण धीरः ॥४०॥

इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे

रासक्रीडावर्णनं नाम त्रयस्त्रिंशोऽद्यायः ॥३३॥

देहाभिमान वगरना ए महात्मा पुरुषो ने सत्कर्म करवाथी कशो लाभ थतो नथी अने हुष्कर्म करवाथी कशो अनर्थ थतो नथी. अर्थात् प्रारब्धकर्मनो क्षय करवो एज महात्मा पुरुषो ने करवानुं होय छे. बीजूं कोई प्रयोजन होतुं नथी.<sup>३३</sup> आ प्रमाणे ज्यारे बीजा महात्मा पुरुषो ने पण पापपुण्यनो संबंध नथी, त्यारे श्रीकृष्ण भगवान के जे पशु, पक्षी, मनुष्य अने देवता आहि पोताना नियम तणे रहेनारां सर्व प्राणीओना नियामक छे, तेमने तो पाप के पुण्यनो संबंध होय ज केम ?<sup>३४</sup>  
जेना यरणारविंदी रजना सेवनथी तृप्ति पामेला अने योगना प्रभावथी ज सधगां कर्म बंधनो ने तोडी नाखनारा भुनिओ पण बंधन नहीं पामतां यथेष्ठ आयरण करे छे, तो पोतानी ईश्वाथी अवतार धरनार ते भगवानने तो बंधन थाय ज क्यांथी ? आ समाधान गोपीओनुं परस्त्रीपणुं स्वीकारीने थाय छे, पण वास्तविक विचारी ए तो भगवानने कोई परस्त्री ज नथी, केमके गोपीओना, तेओना पतिओना अने सर्वे प्राणीओना अंतर्यामी अने बुद्धिआदिना जे साक्षी छे, ते ज ईश्वरलीलाथी अहीं देहधारी थया हता. आपणा जेवा न हता के जेथी अने दोष लागे.<sup>३५-३६</sup> पोते पूर्णकाम छतां एवा काममां प्रवृत्ति करी तेनुं कारण ए छे के प्राणीओ उपर अनुग्रह करवाने माटे तेमणे मनुष्यदेह धर्यो हतो. ते देह धरीने एवी कीडा करी के जे कीडाओने सांभणनाराओनुं मन तेमनामां ज लागे. शृंगार रसमां जेनुं मन लागी रह्युं होय एवा अत्यंत बहिर्मुख लोकोने

## अथ चतुस्त्रिंशोऽध्यायः (३४)

॥ श्रीशुकउवाच ॥

एकदा देवयात्रायां गोपाला जातकौतुकाः । अनोभिरनदुद्युक्तैः प्रयुस्तेऽम्बिकावनम् ॥१  
तत्र स्नात्वा सरस्वत्यां देवं पशुपतिं विभुम् । आनर्चुरहृणैर्भक्त्या देवीं च नृपतेऽम्बिकाम् २  
गावो हिरण्यं वासांसि मधु मध्वन्नमादृताः । ब्राह्मणेभ्यो ददुः सर्वे देवो नः प्रीयतामिति ॥३  
ऊषुः सरस्वतीतीरे जलं प्राश्य धृतवताः । रजनीं तां महाभागा नन्दसुनन्दकाद्यः ॥४  
कश्चिम्हानहिस्तस्मिन् विपिनेऽतिबुभुक्षितः । यदृच्छ्याऽगतो नन्दं शयानमुरगोऽग्रसीत् ५

पशु पोतामां रुचि कराववा सारु आवुं काम कुर्यु उतुं.<sup>३७</sup> भगवाननी मायाथी  
मोह पामेला अने तेथी पोतानी स्त्रीओ भगवाननी पासे गृह इतां पशु तेओने  
पोतपोताना पडभामां ज सूतेली मानता गोवाणोने भगवाननी उपर कांઈ पशु  
देख आव्यो नहीं.<sup>३८</sup> भगवान उपर प्रेम धरावनारी गोपीओ जो के पोताने त्यांथी  
जवानी ईश्वा न हती तोपशु पाइली ऐ घडी रात रही ते समये भगवाननी  
आशाथी पोताने घेर गृह.<sup>३९</sup> गोपीओनी साथे श्रीकृष्णे विहार कर्यानी आ कथाने  
जे माणस श्रद्धाथी सांभणे छे, अथवा वर्णन करे छे, ते माणस भगवानमां  
परम भक्ति मणवाथी थोडा काणमां धीर थईने तुरत हृदयना रोगरूप कामदेवनो  
त्याग करे छे.<sup>४०</sup>

इति श्रीभद्र महापुराण भागवतना दशम स्कन्धनो तेऽत्रीशमो अद्याय संपूर्णः ।

## अद्याय ३४

अज्ञारनो भोक्ष तथा शंखयुडनो वथु करता श्रीकृष्ण भगवान् ।

शुकदेवज्ञ कहे छे- हे राजा ! एक दिवसे गोवाणो पोताना देवनी यात्रा  
करवानो उत्साह थवाथी बण्डगाडां जेडी अंबिका वनमां गया हता. (अंबिकावन  
ऐ मथुराथी पश्चिममां आवेलुं एक तीर्थ छे.)<sup>१</sup> हे राजा ! त्यां सरस्वती नदीमां  
स्नान करी, पशुपति सदाशिवनी अने देवी अंबिकानी पूजनना पदार्थोथी पूजा  
करी.<sup>२</sup> “अमारा उपर देव प्रसन्न थजो” ऐम बोली सर्वे गोवाणोऐ आदरभावथी  
भ्रातृष्णोने गायो, सुवर्ण, वश, मध अने अनन्तां दान आप्यां.<sup>३</sup> त्रत करनारा नंद  
अने सुनंद आहि भाग्यशाणी गोवाणो केवण पाणी पीने उपवास करेलो हतो,  
ते रात्री सरस्वतीने कांठे रह्या हता.<sup>४</sup> ते वनमां बहु ज भूम्यो थयेलो कोई भोटो

स चुक्रोशाहिना ग्रस्तः कृष्ण कृष्ण महानयम् । सर्पो मां ग्रसते तात प्रपत्रं परिमोचय ॥६  
तस्य चाक्रन्दितं श्रुत्वा गोपालाः सहसोत्थिताः । ग्रस्तं च दृष्ट्वा विश्वान्ताः सर्पं विव्यधुरुलमुकैः ७  
अलातैर्दद्यामानोऽपि नामुञ्जत्तमुरङ्गमः । तमस्पृशत् पदाभ्येत्य भगवान् सात्वतां पतिः ॥८  
स वै भगवतः श्रीमत्यादस्पर्शहताशुभः । भेजे सर्पवपुर्हित्वा रूपं विद्याधरार्चितम् ॥९  
तमपृच्छद् धृषीकेशः प्रणतं समुपस्थितम् । दीप्यमानेन वपुषा पुरुषं हेमालिनम् ॥१०  
को भवान् परया लक्ष्म्या रोचतेऽद्भुतदर्शनः । कथं जुगुप्सितामेतां गर्ति वा प्रापितोऽवशः ॥११  
सर्पं उवाच

अहं विद्याधरः कश्चित् सुदर्शन इति श्रुतः । श्रिया स्वरूपसम्पन्न्या विमानेनाचरं दिशः ॥१२  
ऋषीन् विरुपानङ्गिरसः प्राहसं रूपदर्पणितः । तैरिमां प्रापितो योनिं प्रलब्धैः स्वेन पाप्मना १३  
शापो मेऽनुग्रहायैव कृतस्तैः करुणात्मभिः । यदहं लोकगुरुणा पदा स्पृष्टो हताशुभः ॥१४  
तं त्वाहं भवभीतानां प्रपन्नानां भयापहम् । आपृच्छे शापनिर्मुक्तः पादस्पर्शादमीवहन् ॥१५

अज्ञगर अशेधार्यो आवीने सूतेला नंदरायने गणवा लाग्यो.<sup>५</sup> अज्ञगर गणवा  
मांडेला ते नंदराय उिये साहे कहेवा लाग्या के हे कृष्ण ! हे कृष्ण ! आ भोटो सर्प  
मने गणी जाय छे. माटे हे बाप ! शरणागत ऐवो हुं ते मने छोडावो.<sup>६</sup> नंदरायनी  
यीसो सांभणी तरत उिठेला गोवाणो नंदरायने गणेला जोई सणगां लाकडांथी  
अज्ञगरने भारवा लाग्या.<sup>७</sup> लाकडां वागवा इतां पशु तेषे नंदरायने छोडाया  
नहीं, त्यारे यादवोना पति भगवाने आवीने अज्ञगरने पोतानो पग अडाइयो.<sup>८</sup>  
भगवानना यरणोना स्पर्शथी जेनुं पाप टणी गयुं छे ऐवा अज्ञगरनुं शरीर  
छूटी जतां विद्याधरो ए पूजेलुं स्वरूप पाभ्यो.<sup>९</sup> सोनानी माणवाणा दीपता  
शरीरवाणा अने माथु नमावीने उिभेला ए पुरुषने भगवाने पूछयुं के तुं कोष  
छे ? अने केवी रीते परवश थईने अज्ञगरनी नीच योनिने पाभ्यो हतो.<sup>१०-११</sup>

अज्ञगर कहे छे- हुं लक्ष्मी अने रूपनी संपत्तिथी प्रभ्यात सुदर्शन नामनो  
कोई विद्याधर हतो, ते विमानमां बेसी दिशाओमां फरतो हतो.<sup>१२</sup> एक समये  
रूपना अभिमानने लीघे में अंगिराकुणना ऋषिओ के जे कुरुपा हता तेनी हांसी  
करी, तेथी तेओअे मारा पापने योग्य ज मने आ नीच अवतार आप्यो हतो.<sup>१३</sup>  
हुं धारुं छुं के ए दयाणु भ्रातृष्णो ए मारा उपर अनुग्रह करवा सारु ज शाप  
आप्यो हतो, केमके आप परमेश्वरना यरणोनो मने स्पर्श मणतां मारां पापो  
नाश पामी गयां छे.<sup>१४</sup> हे दुःखनो नाश करनार ! हुं सापयोनिथी छूटेलो छुं. हवे  
हुं पोताना लोकमां जवाने माटे, संसारथी भय पामेला शरणागतोना भयने

प्रपन्नोऽस्मि महायोगिन् महापुरुष सत्पते । अनुजानीहि मां देव सर्वलोकेश्वरेश्वर ॥१६  
ब्रह्मदण्डाद् विमुक्तोऽहं सद्यस्तेऽच्युत दर्शनात् । यन्नाम गृह्णन्निलान् श्रोतृनात्मानमेव च ।

सद्यः पुनाति किं भूयस्तस्य स्पृष्टः पदा हि ते ॥१७  
इत्यनुजाप्य दाशार्हं परिक्रम्याभिवन्द्य च । सुदर्शनो दिवं यातः कृच्छ्रान्नन्दश्च मोचितः ॥१८  
निशास्य कृष्णस्य तदात्मवैभवं व्रजौकसो विस्मितचेतसस्तः ।

समाप्य तस्मिन् नियमं पुनर्वर्जं नृपाययुस्तत् कथयन्त आदृताः ॥१९॥  
कदाचिदथ गोविन्दो रामश्चाद्गुतविक्रमः । विजहृतुर्वने रात्र्यां मध्यगौ व्रजयोषिताम् ॥२०  
उपगीयमानौ ललितं स्त्रीजनैर्बद्धसौहृदैः । स्वलङ्घतानुलिपाङ्गौ स्मृगिणौ विरजोऽम्बरौ ॥२१  
निशामुखं मानयन्तावुदितोऽपुतारकम् । मलिकागन्धमत्तालिजुष्टं कुमुदवायुना ॥२२  
जगतुः सर्वभूतानां मनःश्रवणमङ्गलम् । तौ कल्पयन्तौ युगपत् स्वरमण्डलमूर्च्छितम् ॥२३  
गोप्यस्तद्वीतमाकर्ण्य मूर्च्छिता नाविदन् नृप । स्वंसद्वृक्लमात्मानं स्वस्तकेशस्तं ततः ॥२४

मटाउनारा आशा मागुं धुं.<sup>१५</sup> हे मोटा योगी ! हे महापुरुष ! हुं आपने  
शरण धुं. तो हे सर्वलोकना ईश्वरोना ईश्वर ! मने आशा आपो.<sup>१६</sup> हे अच्युत !  
तमारां दर्शन मणतां हुं तरत ब्राह्मणोना शापथी धूटयो धुं. जे तमारुं नाम  
लेनार सर्वं पुरुषो सांभणनाराओने अने पोताने पाण तरत पवित्र करे छे, ते  
आपना यरशनो स्पर्श मणवाथी हुं पवित्र थाउं तेमां शुं कहेवुं ?.<sup>१७</sup>

शुक्देवज्ञ कहे छे- आ प्रमाणे भगवाननी आशा लई प्रदक्षिणा करी प्रशाम  
करी सुदर्शन स्वर्गमां गयो अने नंदराय कष्टमांथी धूटया.<sup>१८</sup> आ भगवानना  
वैभवने जोई विस्मय पामेला गोवाणो, ए स्थणमां पोतानो नियम पूरो करी  
प्रीतिथी ते विषयनी वातो करता पाइ। व्रजभां गया.<sup>१९</sup> कोई समये अद्भुत  
पराकमवाणा श्रीकृष्ण अने बलराम ए बन्नेभाईओ रात्रीअे व्रजांगनाओना  
मध्यमां विष्ठार करता हता.<sup>२०</sup> स्नेहथी बंधाएली स्त्रीओ सुंदर रीते तेमनुं गायन  
करती हती। शरीरमां शशगार अने लेपन कर्या हतां, माणाओ पहेरी हती तथा  
निर्मण वस्त्रो धर्या हतां.<sup>२१</sup> प्रदोष काणे यंद्रमा अने ताराओ उिया हता,  
मलिकानी सुगंधथी भ्रमरो मदोन्मत थया हता अने यंद्रविकासी कमणोना  
सुगंधथी युक्त वायु वाई रह्यो हतो, तेने मान देवा सारु एक सामटी स्वरमंडणी-  
ओना यड उितर आलोपो करता ए बन्ने सर्व प्राणीओना मनने अने कानने प्रिय  
लागे ऐवुं गायन करता हता.<sup>२२-२३</sup> हे राजा ! तेओनुं गायन सांभणी आसक्त  
थयेली गोपीओने पोतानां वस्त्र खसी जवानुं अने केशमांथी माणा पडी जवानुं

एवं विक्रीडतोः स्वैरं गायतोः सम्प्रमत्तवत् । शङ्खचूड इति ख्यातो धनदानुचरोऽभ्यगात् २५  
तयोर्निरीक्षतो राजंस्तत्राथं प्रमदाजनम् । क्रोशन्तं कालयामास दिश्युदीच्यामशङ्कितः ॥२६॥  
क्रोशन्तं कृष्ण रामेति विलोक्य स्वपरिग्रहम् । यथा गा दस्युना ग्रस्ता भ्रातरावन्वधावताम् २७  
मा भैष्णेत्यभयारावौ शालहस्तौ तरस्विनौ । आसेदतुस्तं तरसा त्वरितं गुह्यकाधमम् ॥२८  
स वीक्ष्य तावनुप्राप्तौ कालमृत्यू इवोद्विजन् । विसृज्य स्त्रीजनं मूढः प्राद्रवज्जीवितेच्छ्या २९  
तमन्वधावद् गोविन्दो यत्र यत्र स धावति । जिहीर्षुस्तच्छ्रोरतं तस्थौ रक्षन् स्त्रियो बलः ३०  
अविदूर इवाभ्येत्य शिरस्तस्य दुरात्मनः । जहार मुष्टिनैवाङ्ग्म सहचूडामणिं विभुः ॥३१॥  
शंखचूडं निहत्यैवं मणिमादाय भास्वरम् । अग्रजायाददात् प्रीत्या पश्यतीनां च योषिताम् ३२

इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्द्धे  
शङ्खचूडवधो नाम चतुस्त्रिंशोऽद्यायः ॥३४

ज्ञान पाण रह्युं न हतुं.<sup>२४</sup> आ प्रमाणे बन्नेभाईओ मन गमती कीडा करता हता  
अने प्रमतानी पेठे गाता हता, त्यां शंखचूड नामनो कुबेरनो अनुयर एक यक्ष  
आव्यो.<sup>२५</sup> हे राजा ! बन्ने भाईओ जेमना नाथ छे तथा चीसो पाडती एवी  
स्त्रीओने ए बन्ने भाईओना देखतां जे ते यक्ष निर्भय रीते उत्तर दिशामां हरी  
ज्वा लाय्यो.<sup>२६</sup> पोतानी गोपीओने हे कृष्ण ! हे राम ! एम वावे पकडेली गायोनी  
पेठे चीसो पाडती जोई एटले बन्ने भाईओ पाइया दोड्या.<sup>२७</sup> बीशो नहीं, बीशो  
नहीं. एम अभय वयन बोलता, वेगवाणा अने सागनां जाऊ जेओअे हाथमां  
पकड्यां हतां एवा बन्ने भाईओ तरत ते यक्षनी पासे जई पहोंच्या.<sup>२८</sup> काण  
अने मृत्यु सरभा ए बे आव्या, तेने जोई उद्वेग पामेलो ते यक्ष स्त्रीओने छोडी  
दृष्टिने ज्ववानी ईच्छाथी भाय्यो.<sup>२९</sup> ते यक्ष दोडीने ज्यां ज्यां गयो त्यां त्यां  
भगवान तेना माथानो मणि लई लेवा सारु पछिवाडे दोड्या, अने बण्डेव  
स्त्रीओनी रक्षा करवा सारु उिभा रह्या.<sup>३०</sup> ते यक्ष दूर गयो हतो छतां भगवान  
तरत त्यां पहोंचीने पोतानी मूठीनो पहार करी ते हुष्टना माथा साथे युडामणि  
लई लीधो.<sup>३१</sup> आ प्रमाणे स्त्रीओना देखतां शंखचूडने मारी नापी तेनो कांतिवाणी  
मणि लावीने श्रीकृष्ण भगवाने प्रीतिथी मोटा भाई ने आप्यो.<sup>३२</sup>

इति श्रीमद् महापुराणा भागवतना दशम स्कन्धना  
योग्रीशमो अद्याय संपूर्णः

## अथ पञ्चत्रिंशोऽध्यायः (३५)

॥ श्रीशुकउवाच ॥

गोप्यः कृष्णे वनं याते तमनुद्रुतचेतसः । कृष्णालीलाः प्रगायंत्यो निन्युर्दुःखेन वासरान् ॥१  
गोप्य ऊचुः

वामबाहुकृतवामकपोलो वल्लितभुरधर्पर्तवेणुम् ।  
कोमलाङ्गुलिभिराश्रितमार्गं गोप्य ईरयति यत्र मुकुन्दः ॥२॥  
व्योमयानवनिताः सह सिद्धैर्विस्मितास्तदुपधार्य सलज्जाः ।  
काममार्गणसमर्पितचित्ताः कश्मलं ययुरपस्मृतनीव्यः ॥३॥  
हन्त चित्रमबलाः शृणुतेदं हारहास उरसि स्थिरविद्युत् ।  
नन्दसूनुरयमात्जनानां नर्मदो यर्हि कूजितवेणुः ॥४॥  
वृन्दशो व्रजवृषा मृगगावो वेणुवाद्यहृतचेतस आरात् ।  
दन्तदष्टकवला धृतकर्णा निद्रिता लिखितचित्रमिवासन् ॥५॥  
बर्हिणस्तबकथातुपलाशैर्बद्धमल्परिबहविडम्बः ।  
कर्हिचित् सबल आलि स गोपैर्गाः समाहृति यत्र मुकुन्दः ॥६॥

## अध्याय ३५

भगवान् वनमां ज्ञातां युगलगीत गाइने द्वुःभथी दिवसो पसार  
करती गोपीओ.

शुकदेवજ्ञ कહे છે- રात्रीમां શ્રીકૃષ્ણે મનગમતી રીતે રમાદેલી ગોપીઓ,  
દિવસે કૃષ્ણ વનમાં જતાં તેમાં જ ચિત્ત લાગી રહેવાને લીધે તેમની લીલાઓનું  
ગાયન કરીને માંડ માંડ દિવસો વ્યતીત કરતી હતી. ૧

ગોપીઓ ગાય છે- હે ગોપીઓ ! ડાબા ખભા ઉપર ડાબો ગાલ રાખી ચંચળ  
ભૂકુટિવાળા ભગવાન પોતાના અધરમાં રાખેલ વેણુને જ્યારે તેના સ્વરનાં છિદ્રો  
ઉપર કોમળ આંગળીઓ ફેરવીને વગાડે છે, ત્યારે સિદ્ધ લોકોની સ્ત્રીઓ પોતાના  
પતિઓની સાથે હોવા છતાં પણ તે ગાયન સાંભળી, વિસમય પામી, કામદેવનાં  
બાણથી પરવશ થઈને લજાઈ જતાં મોહ પામે છે અને તેઓને પોતાનાં વસ્ત્રો  
ખસી ગયાનું પણ ભાન રહેતું નથી. ૨-૩ હે સ્ત્રીઓ ! આ આશ્રય સાંભળો કે હાર  
જેવા ઉજજવળ હાસ્યવાળા, પીડિત લોકોને સુખ આપનાર અને જેનાં વક્ષઃસ્થળમાં  
વીજળી જેવી ચંચળ લક્ષ્મીજી રહે છે. એવા ભગવાન જ્યારે વેણુ વગાડે છે ત્યારે  
તે વેણુના શબ્દથી ચિત્ત હરાઈ જતાં ટોળેટોળાં બળદો, મૃગો અને ગાયો દૂરથી જ

तર्हि भग्नगतयः सरितो वै तत्पदाम्बुजरजोऽनिलनीतम् ।  
स्पृहयतीर्वयमिवाबहुपुण्याः प्रेमवेपितभुजाः स्तिमितापः ॥७॥  
अनुचरैः समनुवर्णितवीर्यं आदिपूरुष इवाचलभूतिः ।  
वनचरो गिरितटेषु चरन्तीर्वेणुनाऽऽह्वयति गाः स यदा हि ॥८॥  
वनलतास्तरव आत्मनि विष्णुं व्यञ्जयन्त्य इव पुष्पफलाढ्याः ।  
प्रणतभारविटपा मधुधाराः प्रेमहृष्टतनवः ससृजुः स्म ॥९॥  
दर्शनीयतिलको वनमालादिव्यगन्धतुलसीमधुमतैः ।  
अलिकुलैरलघुगीतमभीष्माद्रियन् यर्हि सन्धितवेणुः ॥१०॥  
सरसि सारसहंसविहङ्गशारुगीतहृतचेतस एत्य ।  
हरिमुपासत ते यतचित्ता हन्त मीलितदृशो धृतमौनाः ॥११॥  
सहबलः स्नगवतंसविलासः सानुषु क्षितिभूतो ब्रजदेव्यः ।  
हर्षयन् यर्हि वेणुरवेण जातहर्ष उपरम्भति विश्वम् ॥१२॥

દાંતમાં જ કોળિયા રાખી મેલી અને કાન ઊંચા કરી જાણો ઊંઘી ગયાં હોય અને  
જાણે ચિત્તમાં આણેખેલાં હોય તેવાં થઈ જાય છે. ૪-૫ હે સખી ! મોર પીંછી, ગુચ્છ,  
ગેરુ વગેરે ધાતુ અને કુંણાં પાંડડાંઓવડે મદ્દોના વેષનું અનુકરણ કરનારા શ્રીકૃષ્ણ  
બળદેવ તથા ગોવાળો સહિત જ્યારે વેણુ વગાડીને ગાયોને બોલાવે છે ત્યારે  
નદીઓ જાણો પવન દ્વારા આવેલી ભગવાનના ચરણારવિંદની રજને ઈચ્છાતી  
હોય તેમ પોતાની ગતિને બંધ કરી દે છે, આપણી પેઠે નદીઓ પણ થોડાં ભાગવાળી  
હોવાને લીધે તે રજને પામી શકતી નથી, એટલે કેવળ પોતાના તરંગરૂપી હાથ  
હલાવ્યા કરે છે અને જળને થંભાવી રાખે છે. ૬-૭ નારાયણની પેઠે અવિચણ  
લક્ષ્મીવાળા અને ગોવાળો તથા દેવાદિક પણ જેના પરાક્રમને ગાય છે એવા કૃષ્ણ  
જ્યારે વનમાં ફરતાં પર્વતોના તટોમાં ચરતી ગાયોને વેણુનાદથી બોલાવે છે,  
ત્યારે ભારથી નમેલી શાખાઓવાળી, ફળ ફૂલથી સંપત્ત અને પ્રેમવડે રોમાંચિત  
ગાત્રવાળી વનની લતાઓ જાણો પોતાના હદ્યમાં પ્રકટ થયેલા વિષ્ણુને સૂચવતી  
હોય તેમ મકરંદની ધારાઓને વરસાવા લાગે છે, અને તેઓના પતિ વૃક્ષોને પણ  
તેવો જ આનંદ થાય છે. ૮-૯ વનમાળામાં દિવ્ય ગંધવાળી તુલસીના મકરંદથી મત  
થયેલા ભ્રમરાઓના ઊંચા તથા અનુકૂળ ગાયનને માન આપતા અને સુંદરમાં  
શિરોમણિ ભગવાન જ્યારે વેણુનાદ કરે છે ત્યારે, તળાવનાં સારસ, હંસ અને  
બીજાં પણ પક્ષીઓ તે સુંદર ગાયનથી ચિત્ત ખેંચાતાં પોતાનાં સ્થાનકમાંથી આવીને

મહદતિક્રમણશઙ્કૃતચેતા મન્દમન્દમનુગર્જતિ મેઘઃ ।  
 સુહુદમભ્યવર્ષત્ સુમનોભિશ્છાયયા ચ વિદધત્ પ્રતપત્રમ् ॥૧૩॥  
 વિવિધગોપચરણેષુ વિદગ્ધો વેણુવાદ્ય ઉસ્થા નિજશિક્ષાઃ ।  
 તવ સુતઃ સતિ યદાધરબિસ્વે દત્તવેણુરનયત્ સ્વરજાતીઃ ॥૧૪॥  
 સવનશસ્તદુપથાર્ય સુરેશાઃ શક્રશર્વપરમેષ્ઠિપુરોગાઃ ।  
 કવય આનતકન્ધરચિત્તાઃ કશમલં યયુરનિશ્ચિતતત્ત્વાઃ ॥૧૫॥  
 નિજપદાબ્જદલૈર્ધ્યજવજ્ઞનીરજાઙ્ગુશવિચ્ત્રલલામૈઃ ।  
 બ્રજભુવઃ શામયન્ ખુરતોદં વર્ષધ્યર્થગતિરીડિતવેણુ: ॥૧૬॥  
 બ્રજતિ તેન વયં સવિલાસ વીક્ષણાર્પિતમનોભવવેગાઃ ।  
 કુજગતિ ગમિતા ન વિદામઃ કશમલેન કબરં વસનં વા ॥૧૭॥  
 મળિધારઃ ક્રચિદાગણયન્ ગ માલયા દયિતગન્ધતુલસ્યાઃ ।  
 પ્રણયિનોઽનુચરસ્ય કદાંસે પ્રક્ષિપન્ ભુજમગાયત યત્ર ॥૧૮॥

આંખો મીંચી તથા મોન પકડી ભગવાનની પાસે બેસે છે ! ! ૧૦-૧૧ હે ગોપીઓ ! બલરામ સહિત, મોતીની માળાનાં આભૂષણથી વિલાસ પામેલા, પર્વતોની આસપાસ ફરતા, આનંદ પામેલા અને બીજાને આનંદ પમાડતા ભગવાન જ્યારે વેણુના શબ્દથી જગતને પરિપૂર્ણ કરી મેલે છે, ત્યારે મેઘ પણ તે મહાત્માના અપરાધથી ભય પામીને આગળ વધતો નથી અને મોટી ગર્જના કરતો નથી, પણ ત્યાં જ સ્થિર રહીને વેણુના શબ્દની પછિવાડે મંદમંદ ગર્જના કરે છે, અને જગતની પીડા હરવાને લીધે પોતાના સરખા કૃષ્ણની ઉપર છત્ર કરીને ઝીણાં ઝીણાં બિંદુરૂપ પુષ્પોની વૃષ્ટિ કરે છે. ૧૨-૧૩ હે યશોદા ! અનેક પ્રકારની કીડાઓમાં ચતુર તમારો પુત્ર જ્યારે પોતાના હોઠ ઉપર વેણુ રાખીને પોતે જ નવી ઉત્પન્ન કરેલી સ્વરની જાતિઓને પ્રકટ કરે છે, ત્યારે હુંદ્ર, શિવ અને બ્રહ્મા આદિક દેવતાઓ તે ગાયનનો શબ્દ મંદ, મધ્યમ અને ઊંચા પ્રકારથી જે દિશામાંથી આવે છે તે દિશામાં પોતાની ડોક અને ચિત્ત નમાવીને સાંભળવા છતાં અને પોતે વિદ્વાન છતાં પણ તે ગાયનનો ભેદ નહીં સમજાયથી મોહ પામી જાય છે. ૧૪-૧૫ ધ્વજ, વજ, કમળ અને અંકુશનાં વિચિત્ર ચિહ્નોવાળાં પોતાનાં ચરણરૂપી કમળની પાંખડીઓ વડે, પશુઓની ખરીઓના દબાણથી થતી બ્રજભૂમિની પીડાને શમાવતા અને હાથી સરખી ચાલવાળા ભગવાન જ્યારે વેણુનો નાદ કરતા ચાલે છે ત્યારે તેમના વિલાસ ભરેલા કટાક્ષને લીધે કામદેવના વેગથી વ્યામ થએલી અને ઝડના જેવી સ્થિતિને

બ્રણિતવેણુરવવચ્છિતચિત્તાઃ કૃષ્ણમન્વસત કૃષ્ણગૃહિણ્યઃ ।  
 ગુણગણાર્થમનુગત્ય હરિણ્યો ગોપિકા ઇવ વિમુક્તગૃહાશા: ॥૧૯॥  
 કુન્દદામકૃતકૌતુકવેષો ગોપગોધનવૃત્તો યમુનાયામ ।  
 નન્દસૂનુરનઘે તવ વત્સો નર્મદ: પ્રણયિનાં વિજહાર ॥૨૦॥  
 મન્વાયુરૂપવાત્યનુકૂલં માનયન્ મલયજસ્પર્ણેન ।  
 વન્દિનસ્તમુપદેવગણા યે વાદ્યગીતબલિભિઃ પરિવવ્બુ: ॥૨૧॥  
 વત્સલો બ્રજગવાં યદગધો વન્દ્યમાનચરણ: પથિ વૃદ્ધૈ: ।  
 કૃત્સંગોધનમુપોહ્ય દિનાન્તે ગીતવેણુરનુગેડિતકીર્તિઃ ॥૨૨॥  
 ઉત્સવં શ્રમરુચાપિ દૃશીનામુન્યન્ ખુરજશ્છુરિતસ્તક્ ।  
 દિત્સયૈતિ સુહુદાશિષ એષ દેવકીજઠરભૂસુદુરાજઃ ॥૨૩॥  
 મદવિધૂર્ણિતલોચન ઇષન્માનદ: સ્વસુહુદાં વનમાલી ।  
 બદરપાણદુવદનો મૃદુગણં મણ્ડયન્ કનકકુણ્ડલલક્ષ્મ્યા ॥૨૪॥

પામેલી અમોને મોહના બળથી વલનું કે કેશનું પણ ભાન રહેતું નથી. ૧૬-૧૭ મણિઓની માળાને ધરનાર, કોઈ સમયે મણિઓથી ગાયોને ગણતા અને પ્યારી, ગંધવાળી તુલસીની માળાને પહેરનાર ભગવાન પોતાના સ્નેહી અનુચરના ખત્મા ઉપર હાથ મેલીને જ્યારે ગાય છે, ત્યારે વેણુના શબ્દથી જેનાં ચિત્ત હરાઈ જાય છે, એવી કાળિયાર મૃગની સ્ત્રીઓ, ગોપીઓની પેઠે ધરની આશા છોડી દઈને અનેક ગુણના સમુક્રરૂપ ભગવાનની પાસે જઈ તેમને અનુસરે છે પણ પાછી વળતી નથી. ૧૮-૧૯ હે યશોદા ! ઉત્સવને લીધે મોગરાના ફૂલની માળાને ધરનારા ગોવાળો તથા ગાયોના ધાણથી વીંટાએલા અને સ્નેહીઓને આનંદ આપનારા પુત્ર નંદકુમાર જ્યારે યમુનાછુમાં વિહાર કરે છે, ત્યારે પોતાના સર્પશીથી ભગવાનને માન આપતો દક્ષિણાં મંદ પવન અનુકૂળ રીતે વીજણો નાખે છે, અને ગંધર્વાદિકનાં ટોળાં બંદિજનની પેઠે સ્તુતિ વાજાં વગાડી ગાયન અને ભેટથી તે ભગવાનનું સેવન કરવા મંડી પડે છે. ૨૦-૨૧ ગોવર્ધન પર્વતનું ધારણ કરવું એ આદિ કર્માથી વ્રજ અને ગાયોનું રક્ષણ કરનાર, પરિશ્રમવાળી કાંતિથી પણ નેત્રોને આનંદ આપનાર, ખરીઓની રજથી ભરાઈ રહેલી માળાવાળા, ભક્તોના મનોરથોને પૂર્ણ કરવા સારુ દેવકીના ઉત્પન્ન થયેલા, વેણુનો નાદ કરતા અને અનુચર લોકો જેમની કીર્તિને ગાય છે, એવા શ્રીકૃષ્ણયંત્ર સાયંકાળે સર્વ ગાયોના ધણને વાળીને જ્યારે વ્રજમાં પદ્ધારે છે. ત્યારે માર્ગમાં બ્રહ્માદિક પુરુષો તેમના ચરણમાં

यदुपतिद्विरदाजविहारो यामिनीपतिरिवैष दिनान्ते ।  
मुदितवक्त्र उपयाति दुरन्तं मोचयन् व्रजगवां दिनतापम् ॥२५॥

श्रीशुक उवाच

एवं व्रजस्त्रियो राजन् कृष्णलीलानुगायतीः । रेमिरेऽहः सु तच्चितास्तन्मनस्का महोदयाः  
इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वर्द्धे  
वृन्दावनक्रीडायां गोपिकायुगलगीतं नाम पञ्चत्रिंशोऽध्यायः ॥३५॥

### अथ पञ्चत्रिंशोऽध्यायः (३६)

श्रीशुकउवाच ॥

अथ तर्हांगतो गोष्ठमग्निष्ठो वृषभासुरः । महीं महाककुत्कायः कंपयन् खुरविक्षताम् ॥१  
रम्भमाणः खरतरं पदा च विलिखन् महीम् । उद्यम्य पुच्छं वप्राणि विषाणाग्रेण चोद्धरन् ॥२

प्रशाम करवा लागे छे तेथी आवतां केटलीक वार लागी जाय छे ॥२२-२३ कांडाक  
मदथी धूमतां नेत्रवाणा, पोताना स्नेहीओने मान आपनार, थोडाक पाकेलां बोरनी  
पेठे पांडुवर्षना मुखवाणा, वनमाणाने धरनारा, सोनाना कुंडणी शोभाथी कोमण  
गंडस्थणने शोभावनार, हाथीना जेवी चालवाणा, आ यादवोना पति भगवान  
सायंकाणे हसते भोढे ज्यारे प्रजमां पधारे छे, त्यारे आपणे के जेओ व्रजमां  
बांधी राखेली गायो छीअे तेना दिवसमां थयेल भारे तापने चंद्रमानी पेठे शमावे  
छे, आवा भगवाननो विरह आपणाथी केवी रीते खभी शकाय ? ॥२४-२५

शुकुदेवज्ञ कुहे छे-हे परीक्षित राजा ! आवी रीते जेओनुं ज्वन अने मन  
भगवानमां ज हतुं, ऐवी भहाभायशाणी गोपीओ भगवाननी लीलाओनुं  
गायन करीने दिवसमां पश राज रहेती हती ॥२६

इति श्रीमद्भागवताणा भागवतना दशम स्कन्धनो पांत्रीशमो अध्याय संपूर्णं ॥

### अध्याय ३६

अरिष्टासुरनो वध तथा श्रीकृष्ण अने खण्डेवज्ञने वसुदेवना  
पुत्र जाणी मथुरा लाववा भाटे कुंसे करेली अफूरने आज्ञा.

शुकुदेवज्ञ कुहे छे-पाई बणदना रुपने धारण करनार अरिष्टासुर प्रजमां  
आव्यो. ए दैत्यनी कांध अने शरीर भारे भोटां हतां, अने खरीओथी खोदी

किञ्चित् किञ्चिच्छक्नुश्चन् मूत्रयन् स्तब्धलोचनः । यस्य निर्झादितेनाङ्ग निष्ठुरेण गवां नृणाम्  
पतन्त्र्यकालतो गर्भाः स्नवन्ति स्म भयेन वै । निर्विशन्ति घना यस्य ककुद्यचलशङ्क्या ॥४  
तं तीक्ष्णशृङ्गमुद्वीक्ष्य गोप्यो गोपाश्च तत्रसुः । पशावो दुदुवुर्भीता राजन् संत्यज्य गोकुलम् ५  
कृष्ण कृष्णोति ते सर्वे गोविन्दं शरणं ययुः । भगवानपि तद् वीक्ष्य गोकुलं भयविद्वतम् ॥६  
मा भैष्णति गिराऽश्वास्य वृषासुरमुपाह्यत् । गोपालैः पशुभिर्मन्द त्रासितैः किमसत्तम ॥७  
बलदर्पहाहं दुष्टानां त्वद्विधानां दुरात्मनाम् । इत्यास्फोट्याच्युतोऽरिष्टं तलशब्देन कोपयन् ॥८  
सख्युरंसे भुजाभोगं प्रसार्यावस्थितो हरिः । सोऽप्येवं कोपितोऽरिष्टः खुरेणावनिमुल्लिखन् ।

उद्यत्युच्छ्रमन्मेधः क्रुद्धः कृष्णमुपाद्रवत् ॥९  
अग्रन्यस्तविषाणाग्रः स्तब्धासृग्लोचनोऽच्युतम् । कटाक्षिप्याद्रवत्तूर्णमिन्द्रमुक्तोऽशनिर्वथा  
गृहीत्वा शृङ्गयोस्तं वा अष्टादश पदानि सः । प्रत्यपेवाह भगवान् गजः प्रतिगं यथा ॥११

नाखेली धरतीने ध्रुजावतो हतो ।<sup>१</sup> अत्यंत कठोर शब्द करतो हतो, पगथी धरतीने  
उभेडतो हतो, पूछिं उंचुं करी शींगांनी अणीओथी कांडा खोदी नाखतो हतो ॥<sup>२</sup>  
मूत्रतो अने पोटणा करतो ऐवो ए अरिष्टासुर एक नजरे जोई रव्यो हतो,  
ऐनो कठोर नाई सांभणी बीकने लीधे गायोना अने स्त्रीओना गर्भ अचानक  
झवी जता हता, ऐनी कांधने पर्वत समज्ज वाढणां ऐनी उपर बेसतां हतां ॥<sup>३-४</sup>  
हे राजा ! तीक्ष्ण शींगांवाणा ए बणदरूपी अरिष्टासुरने जोईने गोपीओ अने  
गोवाणो त्रास पाभ्या, भय पाखेलां पशुओ गोकुणने छोडी दृष्टने भागवा लाग्यां ॥<sup>५</sup>  
ए सर्वे हे कृष्ण ! हे कृष्ण ! एम बोलतां भगवानना शरणे गयां, भगवाने पश  
गोकुणने भयथी भागतुं जोई, भीशो मा, भीशो मा, आवां वयनथी धीरज आपी,  
अरिष्टासुरने बोलाव्यो के हे मंद ! हे महादुष्ट ! गोवाणो अने पशुओने  
बिवराववामां तारुं शुं वणवानुं छे ? तारा जेवा दुष्ट अने दुरात्माओना बण  
तथा गर्वने हणनार तो हुं छुं, आ प्रभाणे बोलता, खभा ठोकता अने हाथनी  
ताणीओना शब्दथी अरिष्टासुरने कोप उत्पत्त करवा भगवान पोतानो हाथ  
भित्रना खभा उपर लांबो करी उभा रह्या. आ प्रभाणे क्यवायेलो खरीथी धरतीने  
खोदतो अने पूछिं उपर थवाने लीधे जेना शरीर उपरनां वाढणां विखेराई  
जतां हतां, ऐवो अरिष्टासुर कोध करीने भगवाननी सामे दोऽयो ॥<sup>६</sup> जेनी आंघ्यो  
लोही जेवी लाल अने अकुड हती, ऐवो ए दैत्य कटाक्षथी आँडुं जोई तथा शींगां  
आगण राखी, ईंद्रे ईंकेलां वज्ञनी पेठे तरत भगवान तरफ दोऽयो ॥<sup>७</sup> हाथी  
ऐम सामा हाथीने हठावे तेम भगवाने तेनां शींगां पकडीने तेने अढार पगलां

सोऽपविद्वो भगवता पुनरुत्थाय सत्वरः । आपतत् स्विन्नसर्वाङ्गो निःश्वसन् क्रोधमूर्छितः  
तमापतनं स निगृह्य शृङ्ख्योः पदा समाक्रम्य निपात्य भूतले ।  
निष्ठीडयामास यथाऽऽर्द्धम्बरं कृत्वा विषाणेन जघान सोऽपतत् ॥१३॥  
असृग् वमन् मूत्रशकृत् समुत्सृजन् क्षिपंश्च पादाननवस्थितेक्षणः ।

जगाम कृच्छ्रं निर्वतेरथं क्षयं पृष्ठैः किरन्तो हरिमीडिरे सुराः ॥१४॥  
एवं ककुचिनं हत्वा स्तूयमानः स्वजातिभिः । विवेश गोष्ठं सबलो गोपीनां नयनोत्सवः ॥१५  
अरिष्टे निहते दैत्ये कृष्णोनाद्भुतकर्मणा । कंसायाथाह भगवान् नारदो देवदर्शनः ॥१६  
यशोदायाः सुतां कन्यां देवक्याः कृष्णमेव च । रामं च रोहिणीपुत्रं वसुदेवेन बिभ्यता ॥१७  
न्यस्तौ स्वमित्रे नन्दे वै याभ्यां ते पुरुषा हताः । निशम्य तद् भोजपतिः कोपात् प्रचलितेन्द्रियः  
निशात्मसिमादत्त वसुदेवजिघांसया । निवारितो नारदेन तत्सुतौ मृत्युमात्मनः ॥१९  
ज्ञात्वा लौहमयैः पाशैर्बन्धं सह भार्यया । प्रतियाते तु देवर्णैः कंस आभाष्य केशिनम् ॥२०

पाइषण उठायो ॥१ भगवाने उठावीने पृथ्वी उपर पथाडेलो ते हैत्य के जेनां सर्व  
अंगमां परसेवो वर्ण्यो उतो, हाँझ्तो उतो अने क्रोधथी व्याम थयो उतो, ते पाइयो  
उठीने भगवान सामे दोऽयो ॥२ आवता ते हैत्यनां शींगडां पक्कीने तेने धरती  
पर पथाडी, पगथी दबावीने भगवाने भीना कपडांनी पेढे नीयोव्यो अने शींगहुं  
काढी लई ते शींगडाथी ४ तेने मार्यो एटले ते मृत्युना चिर्णने पाम्यो ॥३ लोही  
ओक्तो, मूत्र तथा विष्टा करतो, पग पथाडतो अने जेनी आंध्यो भमती उती,  
ऐवो हैत्य धण्युं कुष पामीने मरी गयो. पाइ देवताओ भगवानने पुण्योथी  
वधाववा लाग्या अने स्तुति करवा लाग्या ॥४ आ प्रमाणे बण्ठने मारी गोवाणो  
जेनी स्तुति करता उता ऐवा अने गोपीओनां नेत्रोने आनंदरूप भगवान बण्ठेव  
सहित प्रजमां पधार्या ॥५ अद्भुत कर्म करनारा श्रीकृष्णो अरिष्टासुरने मारतां,  
देव सरभा ज्ञानवाणा नारदज्ञाए कुहुं के जे कन्या उती ते यशोदानी दीकरी  
उती अने कृष्ण देवकीनो पुत्र छे अने बण्ठेव रोहिणीनो पुत्र छे. ऐ बे पोताना  
पुत्रोने वसुदेवे तारी बीकथी पोताना भित्र नंदने आपेला छे के जेओ तारा  
अनुयरोने मार्या छे, ऐ वात सांभणी कोपने लीधे जेनी ईंद्रियो यत्वायमान थई  
छे ऐवा कंसे वसुदेवने मारी नाखवा सारु सज्जावेली तलवार उपाई. पश्च  
वसुदेवने अत्यारे मारी नाखीश तो तेना पुत्रो भागी जशे भाटे वसुदेवने हमणां  
मारवो नहीं, आवी सलाह आपीने नारदज्ञाए कंसने वार्यो. पाइ वसुदेवना  
पुत्रने पोताना मृत्युरूप जाओ वसुदेवने अने देवकीने कंसे लोढानी बेडीओथी

प्रेषयामास हन्तेतां भवता रामकेशवौ । ततो मुष्टिकचाणूरशलतोशलकादिकान् ॥२१  
अमात्यान् हस्तिपांश्चैव समाहृयाह भोजराट् । भो भो निशम्यतामेतद् वीरचाणूरमुष्टिकौ ॥  
नन्दव्रजे किलासाते सुतावानकदुन्दुभेः । रामकृष्णौ ततो मह्यं मृत्युः किल निर्दर्शितः ॥२३  
भवद्भ्यामिह सम्प्रासौ हन्तेतां मल्ललीलया । मञ्चाः क्रियन्तां विविधा मल्लङ्घपरिश्रिताः ।

पौरा जानपदाः सर्वे पश्यन्तु स्वैरसंयुगम् ॥२४

महामात्र त्वया भद्र रङ्गद्वार्युपनीयताम् । द्विपः कुवलयापीडो जहि तेन ममाहितौ ॥२५  
आरभ्यतां धनुर्याश्चतुर्दश्यां यथाविधि । विशसन्तु पश्नून् मेध्यान् भूतराजाय मीढुषे ॥२६  
इत्याज्ञाप्यार्थतन्त्रज्ञ आहूय यदुपुङ्गवम् । गृहीत्वा पाणिना पाणिं ततोऽक्रूरमुवाच ह ॥२७  
भो भो दानपते मह्यं क्रियतां मैत्रमादृतः । नान्यस्त्वतो हिततपो विद्यते भोजवृष्णिषु ॥२८  
अतस्त्वामाश्रितः सौम्य कार्यगौरवसाधनम् । यथेन्द्रो विष्णुमाश्रित्य स्वार्थमध्यगमद् विभुः  
गच्छ नन्दव्रजं तत्र सुतावानकदुन्दुभेः । आसाते ताविहानेन रथेनानय मा चिरम् ॥३०

बांधी दीधा. नारदज्ञ गया पाइ कुंसे केशी हैत्यने बोलावी “तारे भलरामने अने  
कृष्णने मारी नाखवा.” ऐवी भलामण आपी गोकुणमां भोकल्यो. पाइ मुष्टिक,  
चाणूर, शल अने तोशल आटि मल्लोने, मंत्रीओने अने हाथीना महावतोने  
बोलावी कुंसे कुहुं के ले वीर लोको ! ले चाणूर ! मारूं वयन सांभणो ॥६-२२ वसुदेवना  
पुत्र राम अने कृष्ण नंदरायना प्रजमां रहे छे. तेना हाथथी मारुं मरण थवानुं  
देवताओअे कुहेलुं छे. २३ माटे ऐ बे जाण अहीं आवे एटले तमारे मल्लयुद्धमां  
तेने मारी नाखवा. मल्लना अभाडाने फरता अनेक प्रकारना बेसवाना मंच तेयार  
करावो. २४ सर्वे नगरना अने देशना लोकोने ऐ यथेष्ट युद्ध जेवानी छूट आपवी.  
ले महावत ! तारे अभाडाना द्वारमां आपणो कुवलयापीड हाथी राखवो अने  
तेनी पासे मारा शत्रुने मरावी नाखवो. यौद्धाने द्विवसे विधि प्रमाणे धनुर्यांगनो  
आरंभ करवो. अने वर आपनारा रुद्रना उद्देशथी पवित्र पशुग्नोने कापवा ॥२५-२६  
अर्थ शास्त्रना ४ सिद्धांतने जाणनार कुंसे मल्लादिक्ने आ प्रमाणे आज्ञा करी,  
पाइ यादवोमां उतम अक्षरज्ञने बोलावी तेमनो हाथ पोताना हाथथी पक्की  
कुहुं के ले अक्षर ! तमारे मारे माटे भित्र कार्य करवानुं छे. भोज अने वृष्णिकुणना  
यादवोमां मारो तम जेवो स्नेही अने आदरवाणो बीजो कोई नथी. २७-२८ एटला  
माटे ले भला माणस ! जेम विष्णुनो आश्रय लई ईंद्रे स्वार्थ मेणव्यो छे, तेम  
स्वार्थ मेणववाने माटे, तमे के जे मोटा कार्यना साधनरुपे हुं तमारो आश्रय लउं  
छुं. २९ माटे ले अक्षर ! नंदना प्रजमां जाओ, अने त्यां वसुदेवना ऐ दीकरा रहे छे

निसृष्टः किल मे मृत्युर्देवैर्कुण्ठसंश्रयैः । तावानय समं गोपैर्नन्दाद्यैः साभ्युपायनैः ॥३१  
घातयिष्य इहानीतौ कालकल्पेन हस्तिना । यदि मुक्तौ ततो मल्लैर्घातये वैद्युतोपमैः ॥३२  
तयोर्निहतयोस्तमान् वसुदेवपुरोगमान् । तद्व्यून् निहनिष्यामि वृष्णिभोजदशार्हकान् ॥३३  
उग्रसेनं च पितरं स्थविरं राज्यकामुकम् । तद्भातरं देवकं च ये चान्ये विद्विषो मम ॥३४  
ततश्चैषा मही मित्र भवित्री नष्टकण्टका । जरासन्धो मम गुरुद्विषो दयितः सखा ॥३५  
शम्बरो नरको बाणो मध्येव कृतसौहृदाः । तैरहं सुरपक्षीयान् हत्वा भोक्ष्ये महीं नृपान् ॥३६  
एतज्ञात्वाऽन्य क्षिप्रं रामकृष्णाविहार्भक्तौ । धनुर्मखनिरीक्षार्थं द्रष्टुं यदुपुरश्रियम् ॥३७

अक्रूर उवाच

राजन् मनीषितं सम्यक् तव स्वावद्यमार्जनम् । सिद्ध्यसिद्ध्योः समं कुर्याद् दैवं हि फलसाधनम्  
मनोरथान् करोत्युच्चैर्जनो दैवहतानपि । युज्यते हर्षशोकाभ्यां तथाप्याज्ञां करोमि ते ॥३९

तेने आ रथमां भेसाईने तरत अहीं तेडी आवो.<sup>३०</sup> विष्णुना आश्रयवाणा  
देवताओ ते बे जग्नाना हाथथी भारुं मरण निश्चित कर्युं छे, भाटे ए बे जग्ने  
नंदादिक गोवाणोनी साथे अहीं लावो. भारे भाटे भेट लाववानुं पश गोवाणोने  
कहेजो.<sup>३१</sup> ए बे जग्न अहीं आवशे एटले काण जेवा हाथीनी पासे तेने मरावी  
नाखीश अने ऐभांथी छूटशे तो पछी, वीज्जीना अज्ञ जेवा मल्लोनी पासे  
मरावी नाखीश.<sup>३२</sup> ए बत्रेने भारी नाख्या पछी बहुं ज संतापने पामेला  
वसुदेवाहि तेना संबंधीओने अने भीजा पश वृष्णि, भोज अने दाशार्हकुणना  
यादवोने भारी नाखीश.<sup>३३</sup> वृद्ध छतां राज्यनी ईश्वा राखनारा भारा बाप  
उग्रसेनने, तेना भाई देवकने अने भीजा पश मारा शत्रुओ छे तेने हुं भारी  
नाखीश.<sup>३४</sup> पछी हे भित्र ! आ पृथ्वी निष्कट्टक थई रहेशे. जरासंध मारो ससरो  
छे, द्विविद वानर मारो प्यारो सभा छे. शंभरासुर, नरकासुर अने भाषासुर  
भारी साथे ज स्नेह राखे छे. तेनी सहायताथी हुं देवताओना पक्षना राज्ञाओने  
भारी नाखीने पृथ्वीनुं राज्य करीश.<sup>३५-३६</sup> आ भारुं प्रयोजन छे तेने जाझीने ए  
बाणक बणभद्र अने कुष्णने धनुषनो यश ज्ञेवाना अने मथुरानी शोभा ज्ञेवाना  
बहानाथी तरत अहीं तेडी आवो.<sup>३७</sup>

अकूर कहे छे हे राजा ! तमारो विचार सारो छे अने ते तमारा मरणने  
मटाडे ऐवो छे, तोपश आवडो हठाग्रह नहीं राखतां कामनी सिद्धि अने  
असिद्धिमां समभावे रहेवुं ज्ञेईए, केमके फण आपवुं ए देवना हाथमां छे.<sup>३८</sup>  
देवे नाश करी नाखेला ऐवा मनोरथोने पश लोको भारे हठाग्रहथी करे छे अने

श्रीशुक उवाच  
एवमादिश्य चाक्रूरं मन्त्रिणश्च विसृज्य सः । प्रविवेश गृहं कंसस्तथाऽक्रूरः स्वमालयम् ४०  
इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्दे पूर्वार्धे  
अकूरसंप्रेषणं नाम षट्ट्रिंशोऽध्यायः ॥३६॥

## अथ सप्तत्रिंशोऽध्यायः (३७)

॥ श्रीशुकउवाच ॥

केशी तु कंसप्रहितः खुरैर्महीं महाहयो निर्जरयन् मनोजवः ।  
सटावधूताभ्रविमानसंकुलं कुर्वन्नभो हेषितभीषिताखिलः ॥१॥  
विशालनेत्रो विकटास्यकोटरो बृहद्वलो नीलमहाम्बुदोपमः ।  
दुराशयः कंसहितं चिकीषुर्वर्जं स नन्दस्य जगाम कम्पयन् ॥२॥

ऐम करवाथी हर्ष अने शोकनी प्राप्ति थाय छे, कोई समये पोताना सुखने भाटे  
करेलां ऐवां पश कर्म वडे हुः खनी प्राप्ति थाय छे. अने कोई समये भीजाने हुः ख  
आपवा भाटे करेलां ऐवां पश कर्म वडे भीजाने हुः ख थतुं नथी अने ऊलटुं पोताने  
ज हुः ख थाय छे. आवी वास्तविक परिस्थिति छे. तोपश हुं तमारी आज्ञा प्रमाणे  
करीश.<sup>३८</sup>

शुकदेवज्ञ कहे छे- आ प्रमाणे अकूरज्ञने आज्ञा करी अने भंतीओनुं  
विसर्जन करी, कंस पोताना धरमां पेठो अने अकूरज्ञ पोताने धेर गया.<sup>३९</sup>  
द्यति श्रीमद्भागवताण भागवतना दशम रक्ष्यनो छत्रीशभो अद्याय संपूर्ण.

## अद्याय ३७

केशी तथा व्योमासुर दैत्यने भारता श्रीकृष्ण भगवान्.

शुकदेवज्ञ कहे छे- पछी कंसे भोक्लेलो केशी दैत्य, भोटा घोडानुं रुप धरीने  
गोकुणमां आव्यो. मन सरभा वेगवाणो ए दैत्य धरीओथी धरतीने उभेडी  
नाखतो हतो, आकाशने केशवाणीथी चारेकोर इँकी नाखेलां वादणांथी अने  
विमानोथी संकीर्ण करी भेलतो हतो, अने पोताना हणहणाटथी सर्वने बिवरावतो  
हतो.<sup>१</sup> तेनी आंघो भोटी हती, मुख भयंकर गुफा सरभुं जग्नातुं हतुं, गणुं भोडुं  
हतुं अने शरीर काणुं तथा भेघना जेवुं हतुं, ए दुष्टना विचार कंसनुं भलुं करवाना

तं त्रासयन्तं भगवान् स्वगोकुलं तद्देषितर्वालविघूणिताम्बुदम् ।  
आत्मानमाजौ मृगयन्तमग्रणीरुपाहृयत् स व्यनदन्मृगेन्द्रवत् ॥३॥  
स तं निशाम्याभिमुखो मुखेन खं पिबन्निवाभ्यद्रवदत्यर्थणः ।  
जघान पदभ्यामरविन्दलोचनं दुरासदश्शण्डजवो दुरत्ययः ॥४॥  
तद् वञ्चयित्वा तमधोक्षजो रुषा प्रगृह्य दोर्भ्या परिविद्य पादयोः ।  
सावज्ञमुत्सृज्य धनुःशतान्तरे यथोरगं ताक्षर्यसुतो व्यवस्थितः ॥५॥  
स लब्धसंज्ञः पुनरुत्थितो रुषा व्यादाय केशी तरसाऽपतद्वरिम् ।  
सोऽप्यस्य वक्त्रे भुजमुत्तरं स्मयन् प्रवेशयामास यथोरगं बिले ॥६॥  
दन्ता निपेतुर्भगवद्भूजस्पृशस्ते केशिनस्तसमयःस्पृशो यथा ।  
बाहुश्च तद्वेहगतो महात्मनो यथाऽमयः संवृद्धे उपेक्षितः ॥७॥  
समेधमानेन स कृष्णबाहुना निरुद्धवायुश्चरणांश्च विक्षिपन् ।  
प्रस्तिन्नगात्रः परिवृत्तलोचनः पपात लेण्डं विसृजन् क्षितौ व्यसुः ॥८॥  
तद्वेहतः कर्कटिकाफलोपमाद् व्यसोरपाकृष्ण भुजं महाभुजः ।  
अविस्मितोऽयत्नहतारिस्तम्यैः प्रसूनवर्णीदिविषद्विरीडितः ॥९॥

हता. अने ते नंदना व्रजने कंपावतो हतो.<sup>२</sup> कठोर हण्ठषाटथी व्रजने त्रास पमाडनार अने युद्ध माटे भगवानने शोधता ऐवा हैत्यने, भगवाने सामे जृद्धने पोतानी पासे बोलायो, भगवाननुं वयन सांभणी ते हैत्ये सिंहनी पेठे गर्जना करी.<sup>३</sup> भयंकर वेगवाणो, पराभव करवाने अशक्य अने बीजानो मार्यो मरे नहीं, ऐवो ए केशी हैत्य भगवानने ज्ञेई जाणे आकाशने पी जतो होय तेम मोहुं फ़ाटीने भगवाननी सामे गयो, अने पाइला बे पगथी पाटु मारवा लायो.<sup>४</sup> भगवाने ते प्रहार पोताने लागवा नहीं हेतां कोधथी तेना पग पकडी लઈ, आकाशमां फ़ेरवीने लीला मात्रमां सो धनुष दूर फ़ेंकी दीधो, अने पछी सर्पने फ़ेंकीने जेम गरुड़ज्ञ उभा रहे तेम उभा रह्या.<sup>५</sup> पछी भान आवतां ते केशी हैत्य पाइछो उटी कोधथी मोहुं फ़ाटीने तरत भगवान पासे आव्यो. भगवाने पश छसतां हसतां पोताना डाबा हाथने तेना भोदामां नाख्यो.<sup>६</sup> जेम तपावेला लोदाने स्पर्श करवाथी दांत पडी जाय, तेम भगवानना हाथनो स्पर्श करवाथी ते हैत्यना दांत पडी गया, अने तेना देहमां गयेलो भगवाननो हाथ जेम औषधादिक उपचार नहीं करवाथी जणोदर वधे तेम वध्यो.<sup>७</sup> पछी वृद्धि पामेला भगवानना हाथथी श्वास रोकाई जतां तेने पसीनो वणी गयो, पग पछाडवा लायो, आंखो फ़ाटी गई अने मण-मूत्र छूटी गयां अने प्राण नीकणी जतां धरती उपर पड्यो.<sup>८</sup>

देवर्षिरुपसङ्गम्य भागवतप्रवरो नृप । कृष्णमक्लिष्टकर्मणं रहस्येतदभाषत ॥१०  
कृष्ण कृष्णाप्रमेयात्मन् योगेश जगदीश्वर । वासुदेवाखिलावास सात्वतां प्रवर प्रभो ॥११  
त्वमात्मा सर्वभूतानामेको ज्योतिरिवैधसाम् । गूढो गुहाशयः साक्षी महापुरुष ईश्वरः ॥१२  
आत्मनाऽत्माश्रयः पूर्व मायया ससृजे गुणान् । तैरिदं सत्यसंकल्पः सृजस्यत्यवसीश्वरः ॥१३  
स त्वं भूरभूतानां दैत्यप्रमथरक्षसाम् । अवतीर्णो विनाशाय सेतूनां रक्षणाय च ॥१४  
दिष्ट्या ते निहतो दैत्यो लीलयायं ह्याकृतिः । यस्य हेषितसंत्रस्तास्त्यजन्त्यनिमिषा दिवम् ॥  
चाणूरं मुष्टिकं चैव मळानन्यांश्च हस्तिनम् । कंसं च निहतं द्रक्ष्ये परश्वोऽहनि ते विभो ॥१६  
तस्यानु शङ्खयवनमुराणां नरकस्य च । पारिजातापहरणमिन्द्रस्य च पराजयम् ॥१७  
उद्धाहं वीरकन्यानां वीर्यशुल्कादिलक्षणम् । नृगस्य मोक्षणां पापाद् द्वारकायां जगत्पते ॥१८  
पाकेला कंकडीना फ़णी पेठे चिराई गयेला, अने प्राण रहित थयेला ऐवा हैत्यना  
देहमांथी भगवाने कंई पश गर्व नहीं करतां हाथ काढी लीधो. विस्मय पामेला  
देवताओ, जेषो वगर परिश्रमे शत्रुने मारी नाख्यो ऐवा भगवान उपर पुण्यवृष्टि  
करवा लाया अने स्तुति करी. <sup>९</sup>हे राजा ! पछी नारदज्ञ ऐवां मोटां कार्य करनारा  
भगवानने मणी, आ प्रमाणे ऐकांतमां कुहेवा लाया.<sup>१०</sup>

नारदज्ञ कुहे छे- हे कुण्ण ! हे अमाप स्वरूपवाणा ! हे योगेश्वर ! हे जगतना  
ईश्वर ! हे वासुदेव ! हे सर्वना निवासरूप ! हे प्रभु ! हे यादवोमां उताम ! सर्व  
पदार्थोना धारक तमे एक ज छो. लाकडांमां अज्जिनी पेठे सर्वमां गूढ़उपे रह्या  
छो. बुद्धिना पश साक्षी छो. अल्प मतिवाणा पुरुषो तमने जाणता नथी. सर्व  
ज्ञवना ईश्वर तमे ज छो.<sup>११-१२</sup> हे ईश्वर ! हे सत्यसंकल्प ! आप सर्वना आधार  
थैद्धने पोतानी शक्तिरूप मायावडे प्रथम महदादिक तत्पोने सर्जो छो, अने त्यार  
पछी ए महदादिक तत्पो द्वारा आ जगतने झज्जो छो, पालन करो छो, अने  
प्रलय करो छो.<sup>१३</sup> ते आप अत्यारे राजाओना रूपथी अवतरेला हैत्यो, प्रमथो  
अने राक्षसोनो विनाश करवा माटे अने धर्मनी भर्यादानुं रक्षण करवा सारु  
अवतर्या छो.<sup>१४</sup> आ घोडाना रूपवाणो हैत्य के जेना शष्टिथी त्रास पामीने देवताओ  
स्वर्गने छोडी देता हता, तेने आपे लीला मात्रथी मार्यो ऐ धणुं सारु कर्यु.<sup>१५</sup> हवे  
आवता ऐ दिवसमां आप चाणूर, मुष्टिक, बीजा मल्लो, हाथी अने कंसने मारशो  
ते हुं ज्ञेईश.<sup>१६</sup> ते पछी हे जगतना पति ! तमे पंचजन, काणयवन, मुरदानव  
अने नरकासुरने मारशो, पारिजातकनुं हरण करी आवशो, ईद्रनो पराजय करशो,  
पराकमरूपी मूल्यादिक आपीने राजाओनी कन्याओने परणशो, द्वारकामां नृग

स्यमन्तकस्य च मणेरादानं सह भार्यया । मृतपुत्रप्रदानं च ब्राह्मणस्य स्वधामतः ॥१९  
 पौण्ड्रकस्य वर्धं पश्चात् काशिपुर्याश्च दीपनम् । दन्तवक्त्रस्य निधनं चैद्यस्य च महाक्रतौ ॥  
 यानि चान्यानि वीर्याणि द्वारकामावसन् भवान् । कर्ता द्रक्ष्याम्यहं तानि गेयानि कविभिर्भुवि  
 अथ ते कालस्तपस्य क्षपयिष्णोरमुष्य वै । अक्षौहिणीनां निधनं द्रक्ष्याम्यजुनसारथेः ॥२२  
 विशद्विज्ञानघनं स्वसंस्थया समाससर्वार्थमोघवाञ्छतम् ।  
 स्वतेजसा नित्यनिवृत्तमायागुणप्रवाहं भगवन्तमीमहि ॥२३॥  
 त्वामीश्वरं स्वाश्रयमात्ममायया विनिर्मिताशेषविशेषकल्पनम् ।  
 क्रीडार्थमद्यात्तमनुष्वविग्रहं नतोऽस्मि धर्म यदुवृष्णिसात्वताम् ॥२४॥

## श्रीशुक उवाच

एवं यदुपर्ति कृष्णं भागवतप्रवरो मुनिः । प्रणिपत्याभ्यनुज्ञातो ययौ तद्वर्णोत्सवः ॥२५  
 भगवानपि गोविन्दो हत्वा केशिनमाहवे । पशूनपालयत् पालैः प्रीतैर्व्रजसुखावहः ॥२६  
 एकदा ते पशून् पालाश्चारयन्तोऽद्रिसानुषु । चक्रुन्निलायनक्रीडाश्चोरपालापदेशतः ॥२७

राजाने तेना पापथी छोडावशो ॥१७-१८ जांखवतीनी साथे स्यमंतकभणिने लावशो, ख्रान्माशना भरी यथेला पुत्रोने महाकाणना पुरमांथी पाइशा ज्वता लावी आपशो ॥१९ पौण्ड्रक नामना भिथ्या वासुदेवने मारशो, काशीपुरीने बाणशो, दंतवक्तने मारशो, राजसूय यशमां शिशुपाणने मारशो अने ऐवां बीजां पश्च पृथ्वीमां कविओने गावा योऽय जे जे पराक्रम द्वारकामां रहीने करशो ते हुं ज्ञेईश ॥२०-२१ पृष्ठी काण्डृप अने आ पृथ्वीना भारने उतारवाने ईच्छता आप अर्जुनना सारथि थृष्ट अक्षोहिणीओनो नाश करावशो ते पश्च हुं ज्ञेईश ॥२२ आप शुद्ध ज्ञानरूप निरतिशय आनंदमय ऐवा स्वस्वरूपना अनुभवथी ज सर्व प्रकारे पूर्णकाम अने पोताना सामर्थ्यवडे जेमां मायाना कार्यरूप संसारनो प्रवाह निरंतर निवृत्ति पामेलो ज छे ऐवा जे तमो, ते तमारे शरणे अमो आवेला धीये ॥२३ ईश्वर, स्वतंत्र, पोताना संकल्पथी सर्व प्रकारना विशेषोनी कल्पना करनार, हमणां क्रीडाने माटे मनुष्य देहनुं ग्रहण करनार, अने यदु, वृष्णि तथा भागवत भक्तोना अग्रणी आपने प्रणाम करुं छुं ॥२४

शुकदेवज्ञ कुहे छे- आ प्रमाणे यादवोना पति भगवानने प्रणाम करी, आशा लई तेमना दर्शनथी राज्ञ थयेला महावैष्णव नारदज्ञ त्यांथी विदाय थया ॥२५ व्रजने सुख आपनार भगवान श्रीकृष्ण पश्च युद्धमां केशी देत्यने मारीने, राज्ञ थयेला गोवाणोनी साथे पशुओनुं पालन करवा लाग्या ॥२६ पृष्ठी एक हिवसे

तत्रासन् कतिचिच्चोरा: पालाश्च कतिचिन्नृप । मेषायिताश्च तत्रैके विजहुरकुतोभ्याः ॥२८  
 मयपुत्रो महामायो व्योमो गोपालवेषधृक् । मेषायितानपोवाह प्रायश्चोरायितो बहून् ॥२९  
 गिरिदर्या विनिक्षिप्य नीतं नीतं महासुरः । शिलया पिदथे द्वारं चतुःपञ्चावशेषिताः ॥३०  
 तस्य तत् कर्म विज्ञाय कृष्णः शरणः सताम् । गोपान् नयन्तं जग्राह वृक्षं हरिरिवौजसा ॥३१  
 स निजं रूपमास्थाय गिरीन्द्रसदृशं बली । इच्छन् विमोक्षुमात्मानं नाशकनोद्ग्रहणातुरः ॥  
 तं निगृह्याच्युतो दोर्धर्या पातयित्वा महीतले । पश्यतां दिवि देवानां पशुमारममारयत् ॥३३  
 गुहायिधानं निर्भिद्य गोपात्रिः सार्य कृच्छ्रतः । स्तूयमानः सुरैर्गोपैः प्रविवेश स्वगोकुलम् ॥

इति श्रीमद्भागवते महापुराणे परमहंस्यां संहितायां दशमस्तकन्धे पूर्वोर्ध्वे व्योमासुरवधो नाम सप्तत्रिंशोऽद्यायः ॥१३७॥

पर्वतना शिखरो उपर पशुओने चारता गोवाणो, घेटांओने अमो योरीऐ अने तमे घेटाओनुं रक्षणा करो. आ रीते योर अने पालक थृष्टने धूपाई ज्वानी रमतो रमता हता ॥२७ गोवाणोमां केटलाक योर थया हता. केटलाक पालक थया हता, अने केटलाक घेटां थया हता. गोवाणो आवी रीते भय रहित थृष्टने रमत रमवा मांड्या हता ॥२८ त्यां भोटी मायावाणो अने गोवाणो वेष धरी आवेलो भयदानवनो पुत्र व्योमासुर धणी वज्ञन योर थृष्टने घेटारूप थयेला धणा गोवाणो ने हरी गयो अने एके एकने हरी जृद्ध पर्वतनी गुफामां नाभीने ते गुफाना द्वारने शिलाथी बंध करी देतो हतो. आम करतां चार पांच गोवाणो बाकी रह्या ॥२९-३० भगवान व्योमासुरनुं आ काम जाणीने सिंह जेम शियाणने पकडे तेम गोवाणो ने लृष्ट जता ऐवा देत्यने बणात्कारथी पकड्यो ॥३१ पकडवाथी आतुर थयेला ऐ बणवान देत्ये भोटा पर्वत जेवडुं पोतानुं रूप धरीने पोताना शरीरने छोडाववा मांड्युं पश्च छोडावी शक्यो नहीं ॥३२ भगवाने तेने ऐ हाथथी पकडी धरती पर पाटीने आकाशमां देवताओना देखतां ज पशुने जेम भारे तेम भारी नाभ्यो ॥३३ पृष्ठी गुफाना ढांकणने तोडी नाभी गोवाणो ने दुःखमांथी काढ्या. पृष्ठी देवता अने गोवाणो जेनी स्तुति करवा लाग्या, ऐवा भगवान पोताना गोकुणमां पधार्या ॥३४

इति श्रीमद्भागवतपुराणा भागवतना दशम स्तक्यनो  
 साऽऽग्रीशमो अद्याय संपूर्णः.

## अथाप्तात्रिंशोऽध्यायः (३८)

॥ श्रीशुक्लबाच ॥

अक्रूरोऽपि च तां रात्रिं मधुपुर्या महामतिः । उषित्वा रथमास्थाय प्रययौ नंदगोकुलम् ॥१  
 गच्छन् पथिं महाभागो भगवत्यम्बुजेक्षणे । भक्तिं परामुपगत एवमेतदचिन्तयत् ॥२  
 किं मयाऽउच्चरितं भद्रं किं तसं परमं तपः । किं वाथाप्यर्हते दत्तं यद् द्रक्ष्याम्यद्य केशवम् ॥३  
 ममैतद् दुर्लभं मन्य उत्तमश्लोकदर्शनम् । विषयात्मनो यथा ब्रह्मकीर्तनं शूद्रजन्मनः ॥४  
 मैवं ममाधमस्यापि स्यादेवाच्युतदर्शनम् । ह्रियमाणः कालनद्या क्रचित्तरति कश्चन ॥५  
 ममाद्यामङ्गलं नष्टं फलवांशैव मे भवः । यन्नमस्ये भगवतो योगिध्येयाद्विष्पङ्कजम् ॥६  
 कंसो बताद्याकृत मेऽत्यनुग्रहं द्रक्ष्येऽद्विष्पदं प्रहितोऽमुना हरेः ।  
 कृतावतारस्य दुरत्ययं तमः पूर्वेऽतरन् यन्नखमण्डलत्विषा ॥७॥

## अद्याय ३८

गोकुणमां जग्ने श्रीकृष्ण तथा अणादेवशु द्वारा  
 सङ्कारने पामता अक्षरशु.

शुक्लेवशु कहे छे- मोटी बुद्धिवाणा अक्षरशु पशु कंसे आज्ञा कर्या पठी, ते  
 रात्रि मथुरामां रहीने भीजा दिवसे रथमां भेसी गोकुणमां जवा नीकण्या.<sup>१</sup> मार्गमां  
 चालतां श्रीकृष्ण भगवानमां जेने परम भक्ति उत्पन्न थई छे. ऐवा अक्षरशु  
 आ प्रमाणो विचार करवा लाग्या.<sup>२</sup> अक्षरशु विचार करे छे में कयुं पुष्य कर्युं हशो ?  
 कयुं मोटुं तप कर्युं हशो ? अने पात्रने कयुं दान आप्युं हशो ? के जेना प्रभावथी  
 आज मने भगवाननुं दर्शन थशो.<sup>३</sup> जेम शूद्रजातिना माणसने वेदनुं उच्यारण  
 हुर्लभ छे, तेम विषयोथी घेरायेला मने भगवाननुं दर्शन पशु हुर्लभ छे, ऐम  
 मानुं छुं.<sup>४</sup> हुं अधम छतां पशु मने भगवाननुं दर्शन भण्शो ज, जेम नदीमां  
 तशाता जता धास आदि पदार्थोमां कोई पदार्थ कोई सभये कांठे आवे छे, अने  
 अटकी जाय छे. तेम कुर्मने लीघे काण्डुप नदीमां तशाता जता ज्वोमां पशु कोई  
 ज्व तरीने पार पामे ऐ वात संभवे छे.<sup>५</sup> मारी आ प्रवृत्तिथी ज अत्यारे मारुं  
 सर्व पाप नाश पाम्युं अने जन्म सङ्खण थयो जणाय छे, के जेथी योगीओने ध्यान  
 करवा योग्य भगवच्यरणारविंदने हुं प्रणाम करीशा.<sup>६</sup> अहो ! कंसे मारा उपर  
 मोटो अनुग्रह कर्यो छे; केमके तेषो मोकलेलो हुं पृथ्वीमां अवतरेला परमेश्वरना  
 यरणारविंदनुं दर्शन करीशा, के जे यरणना नभमंडणी कांतिथी पूर्वना भग्नात्मा

यदर्चितं ब्रह्मभवादिभिः सुरैः श्रिया च देव्या मुनिभिः ससात्वतैः ।  
 गोचारणायानुचरैश्वरद्वने यद् गोपिकानां कुचकुङ्कमाङ्कितम् ॥८॥  
 द्रक्ष्यामि नूनं सुकपोलनासिकं स्मितावलोकारुणकञ्जलोचनम् ।  
 मुखं मुकुन्दस्य गुडालकावृतं प्रदक्षिणं मे प्रचरन्ति वै मृगाः ॥९॥  
 अप्यद्य विष्णोर्मनुजत्वमीयुषो भारावताराय भुवो निजेच्छया ।  
 लावण्यधाम्नो भवितोपलभ्ननं महां न न स्यात् फलमञ्जसा दृशः ॥१०॥  
 य ईक्षिताहंरहितोऽप्यसत्पतोः स्वतेजसापासत्तमोभिदाभ्रमः ।  
 स्वमाययाऽउत्तमन् रचितैस्तदीक्षया प्राणाक्षधीभिः सदनेष्वभीयते ॥११॥  
 यस्याखिलामीवहिभिः सुमङ्गलैर्वाचो विमिश्रा गुणकर्मजन्मभिः ।  
 प्राणन्ति शुभ्मन्ति पुनन्ति वै जगद् यास्तद्विरक्ताः शवशोभना मताः ॥१२॥

लोको आ अपार संसारउपी अंधाराने तरी गया छे.<sup>०</sup> भ्रत्मा अने शंकर आदि  
 देवताओ, लक्ष्मीदेवी अने भक्तजन सहित सनकादिक मुनिओअे पूजेलुं,  
 गोपीओना स्तन उपर रहेला हुंकुमथी चिक्कित थयेलुं, ऐवुं ऐ यरणारविंद  
 हुपाणुपणाथी अनुचरोनी साथे गायोने यारवा भाटे वनमां फरे छे अने वणी ऐ  
 मात्र प्रेमथी ज सुलभ छे. आवां यरणारविंदने हुं ज्ञेर्षा.<sup>१</sup> हसीने ज्ञेनार रातां  
 कमण सरभां नेत्रवाणुं, वांका केशोथी वींटाअेलुं अने जेमां कपोल तथा नासिका  
 सुंदर छे, ऐवुं भगवाननुं मुभारविंद हुं अवश्य देखीश, केमके आ हरणो मारी  
 जमाणी बाजु उतरे छे.<sup>२</sup> पृथ्वीनो भार उतारवाने भाटे पोतानी ईच्छाथी  
 मनुष्यरुपे अवतरेला विष्णुना सुशोभित स्वरूपनुं मने आज दर्शन थशे ? अने  
 जे ते दर्शन थाय तो अनायासे भारां नेत्रानुं साझेल्य थशो.<sup>३</sup> येतन तथा अयेतन  
 वर्णना साक्षात् दृष्टा छतां पशु दृष्टापणाना अभिमानथी रहित, अने पोताना  
 सामर्थ्य वडे पोताना आश्रित ज्वोना अज्ञानने नाश करनारा, तथा देव,  
 मनुष्यादिक प्राकृत भेदने नाश करनारा, अने हुःभरुप शब्दादिक विषयोने विषे  
 सुभपणानी बुद्धिरुप जे भ्रम तेने नाश करनारा, ऐवा जे नारायण छे, तेनी  
 दृष्टि जे भने विषे रहेली छे. ऐवी पोतानी शक्तिरुप त्रिगुणात्मक प्रकृति द्वारा  
 ज्व तसमूहने विषे रथायेलां प्राण, ईन्द्रियो अने अंतःकरण वडे करीने गोपो तथा  
 गोपीओज नारायणने पोताना धरोमां, वृन्दावनमां, लतागृहोमां प्रत्यक्षपणे  
 प्राम करे छे.<sup>५</sup> जे ईश्वरनी सर्व लोकोना पापोने नाश करनारी, अने  
 महामंगणरुप, गुण, जन्म अने कर्मोना वर्णनवाणी वाणी जगतने ज्वाडे छे,

स चावतीर्णः किल सात्वतान्वये स्वसेतुपालामरवर्यशर्मकृत् ।  
 यशो वितन्वन् व्रज आस्त ईश्वरो गायनि देवा यदशेषमङ्गलम् ॥१३॥  
 तं त्वद्य नूनं महतां गर्ति गुरुं त्रैलोक्यकान्तं दृशिमन्होत्सवम् ।  
 रूपं दधानं श्रिय ईप्सितास्पदं द्रक्ष्ये ममासन्नुषसः सुदर्शनाः ॥१४॥  
 अथावरुढः सपदीशयो रथात् प्रधानपुंसोश्वरणं स्वलब्धये ।  
 धिया धृतं योगिभिरप्यहं धृवं नमस्य आभ्यां च सखीन् वनौकसः ॥१५॥  
 अप्यडिग्रमूले पतितस्य मे विभुः शिरस्यधास्यन्निजहस्तपङ्कजम् ।  
 दत्ताभयं कालभुजङ्गरंहसा प्रोट्रेजितानां शरणौषिणां नृणाम् ॥१६॥  
 समर्हणं यत्र निधाय कौशिकस्थाव बलिश्चाप जगत्वयेन्नताम् ।  
 यद् वा विहारे व्रजयोषितां श्रमं स्पर्शेन सौगम्धिकगन्ध्यपानुदत् ॥१७॥  
 न मव्युपैष्ट्यरिबुद्धिमच्युतः कंसस्य दूतः प्रहितोऽपि विश्वदृक् ।  
 योऽन्तर्बंहिश्वेतस एतदीहितं क्षेत्रज्ञ ईक्षत्यमलेन चक्षुषा ॥१८॥

शोभावे छे अने पवित्र करे छे, अने तेना वर्णन विनानी वाणी सारी रीतना अलंकार वाणी होय छतां पाण वस्त्रादिकथी शाशगारेला शब जेवी मानेली छे; आवा ते ईश्वर पोते करेली वर्णाश्रमनी भर्यादाओने पाणनारा लोकपाणोने सुख आपवा सारु यादवोना वंशमां अवतरेला छे, अने देवताओ जे यशनुं गायन करे छे ऐवा सर्व मंगणरूप यशने विस्तारता प्रजमां रहे छे.<sup>१२-१३</sup> महात्माओना गुरु अने गतिरूप ते ईश्वर त्रैलोक्यमां सर्वोत्तम, लक्ष्मीज्ञना प्रिय स्थानकरूप अने नेत्रवाणाओने मोटा आनंदरूप शरीरने धरी रह्या छे, तेमने हुं आज देखीश; केम्के प्रातः काणमां मने थयेलां सारां शकुनो ए शुभ दर्शनां सूचक हतां.<sup>१४</sup> दर्शन थतां तरत ज रथमांथी उत्तरीने कृष्ण अने बलरामनां यरण के जेओनुं योगीओ पाण स्वरूपनी प्राभिने माटे केवण बुद्धिथी ज ध्यान करे छे, ते यरणमां हुं साक्षात् प्रणाम करीश, अने तेमनी साथे गोवाणोने पाण प्रणाम करीश.<sup>१५</sup> हुं अना यरणमां पडीश ते समये श्रीकृष्ण भगवान पोताना हस्तकमणे मारा मस्तक उपर धरशे? ए हस्त काणरूपी सर्पे बिवडावेला अने शरणने ईच्छनारा मनुष्योने अभय देनार छे.<sup>१६</sup> ईद्र अने बलिराजा जे हस्तकमणमां पूजनरूप दान आपीने त्रष्ण लोकना स्वाभीप्रणाने पामेला छे, आ प्रमाणे मुमुक्षु पुरुषोने मोक्ष आपनारा, तथा सकाम पुरुषोने अभ्युदयने आपनारा अने सुगंधिमान कमण जेवी सुगंधवाणा जे हस्तकमणे रासकीडाना समयमां पोताना स्पर्शथी

अप्यडिग्रमूलेऽवहितं कृताज्जर्लिं मामीक्षिता सस्मितमार्द्रया दृशा ।  
 सपद्यपध्वस्तसमस्तकिल्बिषो वोढा मुदं वीतविशङ्क ऊर्जिताम् ॥१९॥  
 सुहत्तमं ज्ञातिमनन्यदैवतं दोर्भ्या बृहद्भ्यां परिप्प्यतेऽथ माम् ।  
 आत्मा हि तीर्थीक्रियते तदैव मे बन्धश्च कर्मात्मक उच्छ्वसित्यतः ॥२०॥  
 लब्धाङ्गसङ्गं प्रणतं कृताज्जर्लिं मां वक्ष्यतेऽत्रूर ततेत्युरुश्वाः ।  
 तदा वयं जन्मभूतो महीयसा नैवादृतो यो धिगमुष्य जन्म तत् ॥२१॥  
 न तस्य कश्चिद् दयितः सुहत्तमो न चाप्रियो द्वेष्य उपेक्ष्य एव वा ।  
 तथापि भक्तान् भजते यथा तथा सुरद्रुमो यद्वदुपाश्रितोऽर्थदः ॥२२॥  
 किञ्चाग्रजो मावनतं यदूत्तमः स्मयन् परिष्वज्य गृहीतमञ्जलौ ।  
 गृहं प्रवेश्यासप्तसमस्तसत्कृतं संप्रक्ष्यते कंसकृतं स्वबन्धुषु ॥२३॥

गोपीओनो थाक टाण्यो हतो.<sup>१७</sup> हुं जोके कंसनो मोक्लेलो दूत हुं, तोपण भगवान भने आ शत्रुनो दूतछे अेम गणशे ज नहीं; केम्के ए पोते सर्वज्ञ अने अंतर्यामी होवाने लीषे पोताना नित्यज्ञानथी मारा भननी अने बहारनी येष्टाने जाणे छे.<sup>१८</sup> हुं बहारथी कंसने अनुसरुं हुं अने अंदरथी भगवानने अनुसरुं हुं, ए सर्वे भगवान जाणे छे. हुं अेमना यरणनी पासे सावधानपणाथी हाथ जोडी उिभो रहीश त्यारे हसीने कोभण दृष्टिथी भगवान मारी सामुं ज्ञेशो तो ते समये तरत ज सर्व पापथी अने शंकाथी मुक्त थर्थने हुं भारे आनंद पामीश.<sup>१९</sup> मारो श्रीकृष्ण विना बीजो कोई ईष्टदेव नथी अने वणी ए श्रीकृष्णानो बहु ज स्नेही पित्राई हुं, आवो जे हुं ते मने भगवान पोताना मोटा हाथथी ज्यारे आलिंगन करशे त्यारे ज मारो देह अत्यंत पवित्र थशे.<sup>२०</sup> हुं प्रणाम करी हाथ जोडी उिभो रहीश त्यारे मने आलिंगन आपीने मोटी कीर्तिवाणा भगवान ज्यारे हे अङ्कूर ! हे काका ! एम कुही बोलावशे, त्यारे ज मारो जन्म सङ्कण थशे. भगवान जेनो अनादर करे तेमना जन्मने धिक्कार छे.<sup>२१</sup> जो के ते श्रीकृष्णने प्रिय, अप्रिय, हितकारी, देखनुंपात्र के उपेक्षानुं पात्र क्रोध पाण नथी तोपण आश्रय करनाराओने पुरुषार्थ आपनार भगवान कल्पवृक्षनी पेठे भजनाराओने भजे छे.<sup>२२</sup> हुं ज्यारे प्रणाम करी हाथ जोडीश त्यारे मारा हाथ पकडी लेतां हास्यपूर्वक आलिंगन करी, धरमां तेडी जै सर्व सत्कार आपीने मोटा भाई बणदेवज्ञ पोताना बंधुओ विषे कंसे यलावेली वर्ताण्डुक विषे मने पूछेश ?<sup>२३</sup>

शुकदेवज्ञ कुहे छे- हे राजा ! आ प्रमाणे मार्गमां भगवाननुं चिंतवन करता

## श्रीशुक उवाच

इति सञ्ज्ञितयन् कृष्णं श्वफलक्तनयोऽध्वनि । रथेन गोकुलं प्राप्तः सूर्यश्वास्तगिरिं नृप ॥२४  
 पदानि तस्याखिललोकपालकिरीटजुष्टामलपादेरेणोः ।  
 ददर्श गोष्ठे क्षितिकौतुकानि विलक्षितान्यब्जयवाङ्गुशाद्यैः ॥२५॥  
 तदर्शनाहादविवृद्धसम्भ्रमः प्रेमणोर्धरोमाश्रुकलाकुलेक्षणः ।  
 रथादवस्कन्द्य स तेष्वचेष्टत प्रभोरमून्यदिग्नरजांस्यहो इति ॥२६॥  
 देहंभूतामियानथो हित्वा दम्भं भियं शुचम् । संदेशाद् यो हरेलिङ्गदर्शनश्रवणादिभिः ॥२७  
 ददर्श कृष्णं रामं च ब्रजे गोदोहनं गतौ । पीतनीलाम्बरधरौ शरदम्बुरुहेक्षणौ ॥२८  
 किशोरौ श्यामलश्वेतौ श्रीनिकेतौ बृहद्गुजौ । सुमुखौ सुन्दरवरौ बालद्विरदविक्रमौ ॥२९  
 ध्वजवज्राङ्गुशाभ्मोजैश्चिह्नितैरड्यभिर्वर्जम् । शोभयन्तौ महात्मानावनुक्रोशस्मितेक्षणौ ॥३०  
 उदाररुचिरक्रीडौ स्त्रिवण्णौ वनमालिनौ । पुण्यगच्छानुलिमाङ्गौ स्नातौ विरजवाससौ ॥३१

जता अङ्गूरज्जु गोकुणमां आव्या त्यां तो सूर्य अस्तायणने पाम्यो.<sup>२४</sup> जे भगवाननी चरण रजने सर्वे लोकपाणो पोताना मुगट उपर धरे छे, तेमनां कमण, यव, अंकुश आदि रेखाओ उपरथी ओणभाई आवतां पगलां पृथ्वी उपर जाणे शाशगार ज होय ऐवी रीते ऊठी रह्यां हतां, तेने अङ्गूरज्जु ए दीठां.<sup>२५</sup> ए पगलांनां दर्शनना आनंदथी अङ्गूरज्जुनो भारे आनंद वृद्धि पाम्यो, प्रेमथी रुवाडां उभां थै गयां अने आंभो आंसुथी व्याकुण थै. अहो ! आ प्रभुना चरणानी २७ दुर्लभ छे, ऐम धारीने रथमांथी छेठा उतरी अङ्गूरज्जु पृथ्वीपर आणोटवा लाया.<sup>२६</sup> देहधारी पुरुषोने माटे ए ज परम पुरुषार्थ छे के दंभ, भय अने शोकनो त्याग करीने कंसना संदेशाथी लईने अहीं सुधी अङ्गूरज्जुना चितानी जे अवस्था भतावी, ए अवस्था भगवाननां दर्शन श्रवणादिके करीने प्राप्त करवी. अर्थात् भक्तिनी पराकाष्ठाने ग्राम करवी. एज परम पुरुषार्थ छे.<sup>२७</sup> श्रीकृष्ण अने बलराम गायो दोषवाना स्थानकमां गया हता त्यां तेने अङ्गूरज्जु ए दीठा. श्रीकृष्ण पीणांवत्र पहेर्या हतां अने बलरामे श्यामवत्र पहेर्या हतां, भनेनी आंभो शरदऋतुना कमण सरभी हती.<sup>२८</sup> एकनो वर्षा श्याम हतो अने बीजानो शेत हतो, अवस्था किशोर हती, हाथ मोटा हता. भन्ने शोभाना आश्रयउप हता, मुख सुंदर हतां, चाल नाना हाथीना जेवी हती, कान्ति सर्वोत्तम हती.<sup>२९</sup> ए भन्ने महात्मा ध्वज, वज्र, अंकुश अने कमणनी रेखाना चिह्नवाणां चरणाथी व्रजने शोभा आपता हता, दयापूर्वक हसीने जेता हता.<sup>३०</sup> उदार अने मनोहर

## श्रीमद्भागवतपुराणम्

प्रधानपुरुषावाद्यौ जगद्वेतू जगत्पती । अवतीर्णौ जगत्वर्थे स्वांशेन बलकेशवौ ॥३२  
 दिशो वितिमिरा राजन् कुर्वाणौ प्रभया स्वया । यथा मारकतः शैलो रौप्यश्च कनकाचितौ रथान्तर्णमवप्लुत्य सोऽक्रूरः स्नेहविह्वलः । पपात चरणोपान्ते दण्डवद् रामकृष्णायोः ॥३४  
 भगवद्वर्णनाहादबाष्पपर्याकुलेक्षणः । पुलकाचिताङ्गौ औत्कण्ठयात् स्वाख्याने नाशकन् नृप भगवांस्तमभिप्रेत्य रथाङ्गाङ्गितपाणिना । परिरेभेऽभ्युपाकृष्य प्रीतः प्रणतवत्सलः ॥३६  
 संकर्षणश्च प्रणतमुपगुह्य महामनाः । गृहीत्वा पाणिना पाणी अनयत् सानुजो गृहम् ॥३७  
 पृष्ठाथ स्वागतं तस्मै निवेद्य च वरासनम् । प्रक्षाल्य विधिवत् पादौ मधुपर्कर्हणमाहरत् ॥३८  
 निवेद्य गां चातिथ्ये संवाह्य श्रान्तमादृतः । अन्नं बहुगुणं मेध्यं श्रद्धयोपाहरद् विभुः ॥३९  
 तस्मै भुक्तवते प्रीत्या रामः परमधर्मवित् । मुखवासैर्गन्धमाल्यैः परां प्रीतिं व्यधात् पुनः ॥  
 पप्रच्छ सत्कृतं नन्दः कथं स्थ निरनुग्रहे । कंसे जीवति दाशार्ह सौनपाला इवावयः ॥४१

कीडा करता हता, रत्ननी माणा तथा वनमाणा पश पहेरी हती. उतम चंदननु शरीरमां लेपन कर्यु छतुं, स्नान करी स्वच्छ वस्त्र पहेरेलां हतां.<sup>३१</sup> पोतानी कांतिथी दिशाओनो अंधकार दूर करता हता. जे भ सुवर्णथी व्याम थयेला भरकत मणिना अने रुपाना पर्वत शोभे तेम सुवर्णना अलंकारोथी भन्ने शोभता हता. उतम पुरुषो सर्वना आदि, जगतना कारणउप, जगतना पति अने पृथ्वीनो भार उतारवा सारु ज भिन्न भिन्न शरीरथी अवतरेला ए बलराम अने श्रीकृष्णने ज्ञेय स्नेहथी विह्वल थयेला अङ्गूरज्जु तरत रथमांथी उतरी पडी, तेना चरणानी पासे दुँडनी पेठे पड्या.<sup>३२-३४</sup> हे राजा ! भगवाननां दर्शन थवानो आनंद थवाथी, आंसुथी नेत्र व्याकुण थै जतां अने उत्कंठाथी रुवाडां उभां थै जतां, अङ्गूरज्जु पोतानु नाम लईने हुं प्रशाम करुं छुं, ऐम कही शक्या नहीं.<sup>३५</sup> प्रसन्न थयेला अने भक्तो पर प्रीति राखनारा भगवाने तेमना मननी सर्व वात जाणी लई, यक्कां चिह्नवाणा पोताना हाथथी तेमने सभीपे लईने आलिंगन कर्यु.<sup>३६</sup> श्रीकृष्ण सहित भोटा मनवाणा बलराम पश पोताने नमेला अङ्गूरज्जुनु आलिंगन करी पोताना हाथथी तेमना भन्ने हाथ पक्कीने घेर तेढी गया.<sup>३७</sup> पछी भले आव्या. ऐम कही कुशण समाचार पूछी तेमने सुंदर आसन आप्यु अने विधि प्रमाणे तेमना पग धोई मध सहित दहींथी पूजन कर्यु तथा गायनु निवेदन करी पग चांप्या. प्रीतिवाणा बणभद्रे अङ्गूरज्जुनो थाक उतरी गया पछी तेमने धणा गुणवाणु पवित्र अन्न श्रद्धाथी जमवा आप्यु.<sup>३८-३९</sup> परम धर्म जाणनारा बणहेवज्जु अङ्गूरज्जु जभी रह्या पछी प्रीतिथी मुखवास चंदन अने पुण्य आपीने तेमने बहु

योऽवधीत् स्वस्वसुस्तोकान् क्रोशन्त्या असुतृप् खलः । किं नु स्वित्तत्रजानां वः कुशलं विमृशामहे  
इत्थं सूनृतया वाचा नंदेन सुसभाजितः । अक्रूरः परिपृष्ठेन जहावध्वपरिश्रमम् ॥४३  
इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वर्धे  
अकूरागमनं नाम अष्टात्रिंशोऽध्यायः ॥३८॥

### अथैकोनचत्वारिंशोऽध्यायः (३९)

॥ श्रीशुकउवाच ॥

सुखोपविष्टः पर्यङ्के रामकृष्णोरुमानितः । लेभे मनोरथान् सर्वान् पथि यान् स चकार ह ॥१  
किमलभ्यं भगवति प्रसन्ने श्रीनिकेतने । तथापि तत्परा राजन्न हि वाञ्छन्ति किञ्चन ॥२  
सायंतनाशनं कृत्वा भगवान् देवकीसुतः । सुहृत्सु वृत्तं कंसस्य पप्रच्छन्यच्चकीर्षितम् ॥३

४ राज्ञ कर्या ४० सारी रीते सत्कार कर्या पृथी नंदराये अकूरज्ञने पूछ्युं के हे  
अकूरज्ञ ! निर्दृष्ट कंस ज्ञवे छे त्यां सुधी, क्साईना हाथ नीये बंधाएला घेटांओना  
जेवी स्थितिवाणा तमे केवी रीते ज्ञवो छो ? ४१ खण अने पोतानी ईद्रियोने तृम  
करनार जे कंसे पोतानी बहेने चीसो नांभवा छतां तेनां बाणकोने मारी नाख्यां,  
आवा हुष्ट कंसनी प्रज्ञ थईने रहेला तमोने ज्ञवन पाण दुर्लभ छे, त्यां कुशणतानो  
तो शो विचार करीऐ ? ४२ आ प्रमाणे नंदराये मधुर वयनथी सारी रीते सत्कार  
करेला अकूरज्ञनो मार्गनो परिश्रम तो नंदरायना पूछवाथी जे हणवो थई  
गयो ४३

इति श्रीमद् महापुराणा भागवतना दशम स्कन्धनो आठत्रिंशमो अद्याय  
संपूर्णः

### अद्याय ३९

कृष्ण मथुरा ज्वाथी गोपीओनो विलाप तथा अकूरज्ञने  
यमुनाना ज्ञामां इक्व दर्शन.

शुकृदेवज्ञ कहे छे- पलंग पर सुखेथी बेठेला अने बलराम तथा श्रीकृष्णे  
घण्युं मान आपेला अकूरज्ञना सर्वे मनोरथो सिद्ध थया के जे तेमणे मार्गमां कर्या  
हता १ लक्ष्मीना निवासरूप भगवान प्रसन्न थाय त्यारे कशी वस्तु दुर्लभ रहेती  
नथी, तोपण हे राजा ! भगवानना साचा भक्तो कोई वस्तुनी ईच्छा करता

श्रीभगवानुवाच

तात सौम्यागतः कच्चित् स्वागतं भद्रमस्तु वः । अपि स्वज्ञातिबन्धुनामनमीवमनामयम् ॥४  
किं नु नः कुशलं पृच्छे एधमाने कुलामये । कंसे मातुलनाम्यङ्ग स्वानां नस्तप्रजासु च ॥५  
अहो अस्मदभूद् भूरि पित्रोर्वृजिनमार्ययोः । यद्धेतोः पुत्रमरणं यद्धेतोर्बन्धनं तयोः ॥६  
दिष्ट्याद्य दर्शनं स्वानां महां वः सौम्य कांक्षितम् । सज्जातं वर्ण्यतां तात तवागमनकारणम् ॥

श्रीशुक उवाच

पृष्ठे भगवता सर्वं वर्ण्यामास माधवः । वैरानुबन्धं यदुषु वसुदेववधोद्यमम् ॥८  
यत्संदेशो यदर्थं वा दूतः संप्रेषितः स्वयम् । यदुक्तं नारदेनास्य स्वजन्मानकदुन्मुखः ॥९  
श्रुत्वाकूरवचः कृष्णो बलश्च परवीरहा । प्रहस्य नन्दं पितरं राजाऽदिष्ट्य विजज्ञतुः ॥१०  
गोपान् समादिशत् सोऽपि गृह्यतां सर्वगोरसः । उपायनानि गृहीध्वं युज्यन्तां शकटानि च ॥

नथी २ देवकीना पुत्र भगवाने रात्रीनुं भोजन करीने कंस संबंधीओ साथे केवी  
रीते वर्तन करे छे तथा तेमणे बीजुं शुं करवा धारेलुं छे ऐ विषे अकूरज्ञने आ  
प्रमाणे पूछ्युं ३ भगवान पूछे छे हे तात ! हे सौम्य ! तमो अहीं क्षेम कुशण  
आव्या छो ने ? तमारुं सारु थजो. आपणा सर्वे बंधु अने संबंधीओ सुधी अने  
नीरोगी छे ने ? ४ आवी रीतनुं पूछ्युं पाण आ समयमां घटतुं नथी, केम्के कुणमां  
रोगरूप अने अमारो मामो कहेवातो कंस ज्ञवे छे, त्यां सुधी आपणा श्वातिज्ञनो  
अने तेमनी प्रज्ञानुं शुं कुशण पुछ्युं ? ५ अहो ! अमारे माटे अमारा निरपराधी मा-  
बापने बहु हुः ख पड्युं. तेओना पुत्रनुं मरण तथा तेओने बंधन मारे माटे जे  
थयुं छे ६ हे सौम्य ! जे तमो अमारा पोताना जे छो, तमारा दर्शनने हुं ईच्छितो  
जे हतो, ते आज थयुं, ऐ घण्युं सारु थयुं. हे तात ! हवे जे तमारे आववानुं  
कारण छोय ते कहो ७

शुकृदेवज्ञ कहे छे- आ प्रमाणे भगवाने पूछितां यादवोनी साथे कंसे राखेलो  
वैरानुबन्ध, कंसे करेलो वसुदेवना वधनो उद्यम, जे धनुर्यांगना समाचार लईने  
पोते आव्या छे ते, याणुराहिकना हाथे मरावी नाभवाने पोताने दूतरूपे भोक्लेल  
छे ते, अने नारदज्ञाए कंसनी पासे वसुदेवथी भगवाननो जन्म थयानी वात  
कही ते सर्वे हकीकित अकूरज्ञाए कही देखाई ८८ अकूरज्ञनुं वयन सांभणीने  
शत्रुओने मारनार भगवान अने बलराम हसीने पोताना पिता नंदरायनी पासे  
कंस राजाए आज्ञा कर्यानी वात कही देखाई १० नंदराये पाण गोवाणोने आज्ञा  
करी के सर्वे प्रकारना गायोना दृध दहीं वगोरे रसो अने उतम वस्तुओने साथे लो

यास्यामः श्रो मधुपुरीं दास्यामो नृपते रसान् । द्रक्ष्यामः सुमहत् पर्व यान्ति जानपदाः किल ।  
एवमाघोषयत् क्षत्रा नन्दगोपः स्वगोकुले ॥१२  
गोप्यस्तास्तदुपश्रुत्य बभूवर्व्यथिता भृशम् । रामकृष्णौ पुरीं नेतुमकूरं व्रजमागतम् ॥१३  
काश्चित्तक्तृतहत्तापश्चासम्लानमुखश्रियः । संसद्दुकूलवलयकेशग्रन्थ्यश्च काश्चन ॥१४  
अन्याश्च तदनुध्याननिवृत्ताशेषवृत्तयः । नाभ्यजानन्निमं लोकमात्मलोकं गता इव ॥१५  
स्मरन्त्यश्चापरा: शौरेनुरागस्मितेरिताः । हृदिस्पृशश्चित्रपदा गिरः संमुमुः स्त्रियः ॥१६  
गर्ति सुललितां चेष्टां निर्गंधहासावलोकनम् । शोकापहनि नर्मणि प्रोद्धामचरितानि च ॥१७  
चिन्तयन्त्यो मुकुन्दस्य भीता विरहकातरा: । समेताः सङ्घशः प्रोचुरश्रुमुख्योऽच्युताशयाः ॥

गोप्य ऊचुः

अहो विधातस्तव न क्लचित् दया संयोज्य मैत्रा प्रणयेन देहिनः ।  
तांश्चाकृतार्थान् वियुद्दक्ष्यपार्थकं विक्रीडितं तेऽर्थकचेष्टिं यथा ॥१९॥  
यस्त्वं प्रदश्यासितकुन्तलावृतं मुकुन्दवक्रं सुकपोलमुन्नसम् ।  
शोकापनोदस्मितलेशसुन्दरं करोषि पारोक्ष्यमसाधु ते कृतम् ॥२०॥

अने गाडां जोडो. आवती काले मथुरामां जैर्थुं, राजने दूध दहीं वगेरे रसो आपीशुं अने मोटो उत्सव जोईर्थुं, देशना सर्वे लोको मथुरामां जाय छे, आ प्रमाणे पोताना गोकुणमां कोटवाण साथे साद ईराव्यो.<sup>११-१२</sup> आ वात सांभणी अने बण्ठेव तथा श्रीकृष्णने मथुरामां लै जवा सारु अकूरज्ज व्रजमां आवेल जाणी, गोपीओ बहु ज खेद पामी.<sup>१३</sup> केटलीक गोपीना मुखनी शोभा, ए वातथी उत्पश थयेला हृदयना संतापथी नीकण्ठा श्वासथी करमाई गई. केटलीक गोपीओनां वस्त्र, कंकण अने केशनी गांडो शिथिल थई जवा लागी.<sup>१४</sup> भगवानना ध्यानने लीघे केटलीक गोपीओनी सर्वे ईंद्रियोनी वृत्तिओ बंध पडी जतां मुक्त लोकोनी पेठे तेमने पोताना ढेहनुं पश भान रह्युं नहि.<sup>१५</sup> स्नेह पूर्वक मंदहास्ये बोलेली, हृदयमां लागी रहेली अने विचित्र पदवाणी भगवाननी वातोने संभारती केटलीक स्त्रीओ मूर्धा पामी गई.<sup>१६</sup> भगवाननी सुंदर चाल, येष्टा, स्नेह भरेला हास्य पूर्वक जोवुं, शोकने मटाइनार हांसीनां वयनो अने भगवाननी लीलानुं चिंतवन करती तथा विरहथी भीती अने भगवानमां ज जेओनां चित लाग्यां हतां, ऐवी ते गोपीओ टोणे टोणां भणीने रोती रोती आ प्रमाणे बोलवा लागी.<sup>१७-१८</sup>

गोपीओ कहे छे- हे देव ! तने कोईना उपर दया आवती नथी. ऐकवार मित्र अने स्नेहथी ग्राणीओने भेणां करी, तने हजु पूरां सुख मण्यां न होय ते

क्रूरस्त्वमक्रूरसमाख्यया स्म नश्चक्षुर्ह दत्तं हरसे बताज्ञवत् ।  
येनैकदेशेऽखिलसर्गसौष्ठुवं त्वदीयमद्राक्षम वयं मधुद्विषः ॥२१॥  
न नन्दसूनुः क्षणभङ्गसौहृदः समीक्षते नः स्वकृतातुरा बत ।  
विहाय गेहान् स्वजनान् सुतान् पर्तीस्तद्वास्यमद्वोपगता नवप्रियः ॥२२॥  
सुखं प्रभाता रजनीयमाशिषः सत्या बभूवः पुरयोषितां ध्वम् ।  
याः संप्रविष्ट्य मुखं व्रजस्पते: पास्यन्त्यपाङ्गोत्कलितस्मितासवम् ॥२३॥  
तासां मुकुन्दो मधुमञ्जुभाषितर्गृहीतचित्तः परवान् मनस्व्यपि ।  
कथं पुनर्नः प्रतियास्यतेऽबला ग्राम्याः सलज्जस्मितविभ्रमैर्भ्रमन् ॥२४॥  
अद्य ध्रुवं तत्र दृशो भविष्यते दाशार्हभोजान्धकवृष्णिसात्वताम् ।  
महोत्सवः श्रीरमणं गुणास्पदं द्रक्ष्यन्ति ये चाध्वनि देवकीसुतम् ॥२५॥

पहेलां तुं वृथा नोभां पाडी नाखे छे, माटे तारी कीडा बाणकोनी रमत जेवी छे.<sup>१९</sup>  
तुं श्याम केशथी वींटाअेलुं सुंदर गालवाणुं, सरस नासिकावाणुं अने शोकने टाणनार मंदहास्यथी सुंदर अेवुं भगवाननुं मुखारविंद ऐकवार देखाईने पाइं  
अटेश्य करे छे, माटे तारुं काम धिक्कारवा जेवुं छे.<sup>२०</sup> हे विधाता ! जे तुं झूर छे,  
तारा विना बीजा कोईथी आवुं काम थाय नहीं, माटे अझूर आवुं नाम धारी तुं ज  
आवेल छे. तें आपेलां जे यक्षुथी भगवानना ऐक ऐक अंगमां तारुं सर्वे सृष्टिनुं  
उहापणा अमे जोयुं छे, ते अमारां यक्षुने मूर्खनी पेठे तुं हरी लै अमने आंधणी  
करी भेले छे.<sup>२१</sup> अरेरे ! धर, स्वजन, पुत्र अने पतिओनो त्याग करी साक्षात्  
दासीपणुं पामेली अने तेमणे करेला हास्यादिकथी परवश थयेली आपणाने, आ  
क्षणाभंगुर स्नेहवाणा अने जेने नवुं नवुं ज घ्यारुं लागे छे, ऐवा श्रीकृष्ण आपणी  
सामे जोता पश नथी, माटे अमने आपणे रोकीशुं.<sup>२२</sup> मथुरानी स्त्रीओने अवश्य आजनी रात्रीनुं प्रभात सारा शकुनवाणुं थयुं हशे अने तेना मनोरथ पश सत्य  
ज थया, केम के जे मथुरानी स्त्रीओ मथुरामां पधारेला भगवाननुं कटाक्ष वडे  
शोभतुं, मंद हास्यरूपी अमृतवाणुं जे मुख छे तेनुं पान करशे.<sup>२३</sup> हे स्त्रीओ !  
श्रीकृष्ण जेके मा-बाप आदिने पराधीन छे अने धीर छे तोपणे ते मथुरानी  
स्त्रीओना भधनी पेठे भीठां भाषणोथी तेमनुं चित वश थई जशे. अने तेओनां  
लाज भरेलां मंदहास्यथी तथा विलासोथी भभी जशे. तेथी आपणे के जेओ  
गामडानी रहेनारी छीओ, तेओनी पासे पाछा शी रीते आवशे ?<sup>२४</sup> आज मथुरामां  
रहेनारी तमाम वर्षानी प्रजाओने अवश्य मोटो उत्सव थशे के जेओ लक्ष्मीना

મैતद्विधस्याकरुणस्य नाम भूदक्त्रूर इत्येदतीव दारुणः ।  
 योऽसावनाश्वास्य सुदुःखितं जनं प्रियात्प्रियं नेष्ठति पारमध्वनः ॥૨૬  
 अनार्द्धधीरेष समास्थितो रथं तमन्वमी च त्वयन्ति दुर्मदाः ।  
 गोपा अनेभिः स्थविरैरुपेक्षितं दैवं च नोऽद्य प्रतिकूलमीहते ॥૨૭  
 निवारयामः समुपेत्य माधवं किं नोऽकरिष्यन् कुलवृद्धबान्धवाः ।  
 मुकुन्दसङ्गान्निमिषार्धदुस्त्यजाद् दैवेन विध्वंसितदीनचेतसाम् ॥૨૮  
 यस्यानुरागललितस्मितवल्लुमन्त्रलीलावलोकपरिम्भणरासगोच्छाम् ।  
 नीताः स्म नः क्षणमिव क्षणदा विना तं गोप्यः कथं न्वातिरेम तमो दुरन्तम् ॥૨૯  
 योऽह्नः क्षये व्रजमनन्तसखः परीतो गोपैर्विशन् खुररजश्छुरितालकस्त्रक् ।  
 वेणुं ब्रग्नन् स्मितकटाक्षनिरीक्षणेन चित्तं क्षिणोत्यमुमृते नु कथं भवेम ॥૩૦

પ्यारा અને ગુણોના સ્થानરूપ શ્રીકૃષ્ણને માર्गમાં દેખશે.<sup>૨૫</sup> આવું કામ કરનારા નિર્દ્ય માણસનું “અકૂર” એવું નામ ન હોવું જોઈએ, કેમ કે અત્યંત કૂર સ્વભાવવાળો આ માણસ બહુ જ દુઃખ પામેલી આપણને આશ્વાસન આપ્યા વિના પ્રાણથી પણ પ્યારા શ્રીકૃષ્ણને આપણે ન દેખીએ એવા દૂર સ્થળમાં લઈ જશે.<sup>૨૬</sup> અરે ! કઠણ મનવાળા આ કૃષ્ણ રથમાં પણ બેસી ગયા. આ છકેલા ગોવાળો વળી તેની પછવાડે ગાડાંઓમાં બેસી ઉતાવળ કરે છે. આ અનીતિ જોઈને બૂધાઓ કોઈ ના પાડતા નથી. આ સમયમાં કોઈ ગોવાળોને વિધન, અક્સમાત, વજપાત કે બીજું પણ કાંઈ અનિષ્ટ થતું નથી કે જેથી આને રોકાઈ જવું પડે. માટે આજ દૈવ જ આપણું પ્રતિકૂળ કરવા ધારે છે.<sup>૨૭</sup> આપણે બધી ભેળી થઈ ભગવાનને રોકીએ, કુળના બુઢા અને બાંધવો આપણને શું કરી શકશે ? આંખના અડધા પલકારા જેટલો સમય પણ છોડી શકાય નહીં, એવા ભગવાનના પ્રસંગનો વિયોગ આપીને જેના ચિત્તને દૈવ દીન કરી નાખ્યાં છે, એવી આપણને હવે મોતની પણ બીક નથી.<sup>૨૮</sup> હે ગોપીઓ ! રાસકીડાની સભામાં સ્નેહ ભરેલી રીતે જે ભગવાનનું સુંદર મંદહાસ્ય, સુંદર વિચાર, લીલાપૂર્વક દર્શન અને આદિંગન મળવાથી આપણને ઘણી રાત્રીઓ એક કણ સમાન લાગી હતી તે ભગવાન વિના વિરહના અપાર દુઃખને આપણે શી રીતે તરી શકીએ ? આ દુઃખ અસહ્ય છે. માટે આપણે અવશ્ય સાહસ કરવું જોઈએ.<sup>૨૯</sup> સાયંકાળે બળદૈવ સહિત ગોવાળોથી વીટાએલા, વેણુ વગાડતા અને જેમના કેશ તથા માળા ખરીઓની રજથી ભરાઈ રહેલાં હોય છે, એવા ભગવાન બ્રજમાં પદ્મારતાં મંદહાસ્ય પૂર્વક કટાક્ષના જોવાથી આપણા

श્રીશુક ઉવાચ  
 એવं બુવાણા વિરહાતુરા ભૃણં વ્રજસ્ત્રિય: કૃષ્ણવિષક્તમાનસા: ।  
 વિસૃજ્ય લજ્જાં રૂદુ: સ્મ સુસ્વરં ગોવિન્દ દામોદર માધવેતિ ॥૩૧  
 સ્ત્રીણામેવં રૂદન્તીનામુદિતે સવિતર્યથ । અકૂરશ્રોદ્વયામાસ કૃતમૈત્રાદિકો રથમ् ॥૩૨  
 ગોપાસ્તમન્વસજ્જન્ત નન્દાદ્યા: શકટૈસ્તતઃ । આદાયોપાયનં ભરી કુભાન્ ગોરસમ્ભૂતાન્  
 ગોપ્યશ્રી દયિતં કૃષ્ણમનુવ્રજ્યાનુરજ્જતાઃ । પ્રત્યાદેશં ભગવતઃ કાદ્યસ્ત્રયશ્વાવતસ્થિરે ॥૩૪॥  
 તાસ્તથા તપ્તીર્વીક્ષ્ય સ્વપ્રસ્થાને યદૂત્તમ: । સાન્વયામાસ સપ્રેમારાયાસ્ય ઇતિ દૌત્યકૈ: ૩૫  
 યાવદાલક્ષ્યતે કેતુર્યાવદ્ રેણુ રથસ્ય ચ । અનુપ્રસ્થાપિતાત્માનો લેખાનીવોપલક્ષ્યતાઃ ॥૩૬  
 તા નિરાશા નિવબૃતુગોવિન્દવિનિર્વત્તને । વિશોકા અહની નિન્યુર્ગાયન્યઃ પ્રયચેષ્ટિતમ् ॥૩૭  
 ભગવાનપિ સમ્પ્રાસો રામાકૂરયુતો નૃપ । રથેન વાયુવેગેન કાલિન્દીમઘનાશિનીમ् ॥૩૮  
 તત્ત્રોપસ્પૃશ્ય પાનીં પીત્વા મૃષ્ટ મણિપ્રભમ् । વૃક્ષષણડમુપવ્રજ્ય સરામો રથમાવિશત् ॥૩૯  
 ચિત્તને હરી લે છે, તે ભગવાન વિના આપણે કર્ય રીતે જીવી શકીશું ?<sup>૩૦</sup>  
 શુકેદેવજી કહે છે- આ પ્રમાણે બોલતી, વિરહથી આતુર થયેલી અને જેઓનાં  
 મન કૃષ્ણમાં જ લાગ્યાં હતાં, એવી પ્રજાંગનાઓ લાજ મૂકી દઈને હે ગોવિંદ ! હે  
 દામોદર ! હે માધવ ! એમ ઊંચા સ્વરથી રોવા લાગી.<sup>૩૧</sup> પછી સૂર્ય ઊગતાં  
 અકૂરજીએ સ્નાન સંધ્યાદિક સર્વે કર્મ કરીને સ્ત્રીઓના રોવા ઉપર કાંઈ પણ  
 ધ્યાન નહીં આપતાં રથ હાંક્યો.<sup>૩૨</sup> નંદાદિક ગોવાળો ઘણા ઉત્તમ પદાર્થો અને  
 ગોરસથી ભરેલા ઘડાઓમાં ભરી તેમની પછવાડે ચાલ્યા.<sup>૩૩</sup> ગોપીઓ  
 પ્યારા કૃષ્ણની પાછળ જવા લાગી, ત્યાં કૃષ્ણો પાછું વળી જોવા આદિથી તેઓને  
 કાંઈક રાજી કરી એટલે તેઓ ભગવાનનો પ્રત્યુત્તર મળવાની આશા રાખી ઊભી  
 રહી.<sup>૩૪</sup> પોતાના પ્રયાણના સમયમાં આ પ્રમાણે તાપ પામતી તે ગોપીઓને જોઈ  
 ભગવાને “હું આવીશ” એવાં પ્રેમ ભરેલાં વચન દૂતની પાસે કહેવરાવી તેઓની  
 સાંત્વના કરી.<sup>૩૫</sup> પછી જ્યાં સુધી રથની ધજી અને રથની ૨૪ દેખાણી ત્યાં સુધી  
 જેઓએ પોતાનાં ચિત્ત ભગવાનની સાથે જ મોકલ્યાં હતાં, એવી ગોપીઓ ચીતરેલી  
 પૂતળીઓની પેઠે નિશ્ચળ થઈને ઊભી રહી.<sup>૩૬</sup> પછી ભગવાનના પાછા ફરવા  
 વિષે નિરાશ થયેલી ગોપીઓ પાછી વળી અને ભગવાનની લીલાનું ગાયન કરવા  
 રૂપ સાધનથી શોક રહિત થઈને રાત્રિ દિવસ વિતાવવા લાગી.<sup>૩૭</sup> બલરામ અને  
 અકૂરજીની સાથે ભગવાન પણ વાયુ સરખા વેગવાળા રથથી પાપનો નાશ  
 કરનારી યમુના નદીને કિનારે પહોંચ્યા.<sup>૩૮</sup> ત્યાં સ્વચ્છ પાણીમાં સ્નાન, પાન કરીને

અક્રૂરસ્તાવુપામન્ય નિવેશ્ય ચ રથોપરિ । કાલિન્દ્યા હૃદમાગત્ય સ્નાનં વિધિવદાચરત् ॥૪૦  
નિમજ્જ્ય તસ્મિન્ સલિલે જપન્ બ્રહ્મ સનાતનમ् । તાવેવ દદ્દોઽક્રૂરો રામકૃષ્ણા સમન્વિતૌ ॥  
તૌ રથસ્થૌ કથમિહ સુતાવાનકદુન્દુભે: । તર્હિ સ્વિત્ સ્યન્દને ન સ્ત ઇત્યુન્મજ્જ્ય વ્યચાષ્ટસ: ॥  
તત્ત્રાપિ ચ યથાપૂર્વમાસીનૌ પુનરેવ સ: । ન્યમજ્જદ્ દર્શનં યન્મે મૃષા કિં સલિલે તયો: ॥૪૩  
ભૂયસ્તત્રાપિ સોઽદ્રાક્ષીત् સ્તૂયમાનમહીશ્વરમ् । સિદ્ધચારણગન્થરેસુરૈન્તકથરૈ: ॥૪૪  
સહસ્તરસં દેવં સહસ્તરફળમૌલિનમ् । નીલામ્બરં બિસશ્વેતં શૃઙ્ગૈ: શ્વેતમિવ સ્થિતમ् ॥૪૫  
તસ્યોત્પઙ્ગે ઘનશ્યામં પીતકૌશેયવાસમમ् । પુરુષં ચતુર્ભુજં શાન્તં પદ્મપત્રાસુણેક્ષણમ् ॥૪૬  
ચારુપ્રસન્ત્રવદનં ચારુહાસનિરીક્ષણમ् । સુભૂત્રસં ચારુકર્ણ સુકપોલારુણાધરમ् ॥૪૭  
પ્રલમ્બપીવરભુજં તુઙ્ગાંસોરઃસ્થલશ્રિયમ् । કમ્બુકણઠ નિમ્નાર્થિ વલિમત્પલ્લવોદરમ् ॥૪૮  
બૃહત્કટિત શ્રોણિકરભોરુદ્વયાન્વિતમ् । ચારુજઙ્ગાયુગલસંયુતમ् ॥૪૯

વૃક્ષના સમૂહની પાસે આવી બળદેવ સહિત શ્રીકૃષ્ણ ભગવાન રથમાં બેઠા.<sup>૩૮</sup>  
શત્રુઓની શંકાથી એ બને ભાઈઓને રથમાં બેસાડી તેમની આશા લઈને  
અકૂરજીએ યમુનાઞ્ચાના ધરામાં આવી વિધિ સહિત સ્નાન કર્ય.<sup>૩૯</sup> તે જળમાં દૂબકી  
મારીને ગાયત્રીના જપ કરતા અકૂરજીએ સાથે બેઠેલા તે શ્રીકૃષ્ણ બળદેવને જળમાં  
દીઠા.<sup>૪૦</sup> એ બને વસુદેવના પુત્રો રથમાં બેઠા છે, માટે જળમાં આવવા કેમ સંભવે?  
અને અહીં છે તો હવે રથમાં નહીં હોય, એવા વિચારથી અકૂરજીએ પાણીથી  
બહાર નીકળીને જોયું, ત્યાં રથમાં પણ પ્રથમની પેઠે જ બેઠેલા એ બને ભાઈને  
દીઠા. ત્યારે મેં જે પાણીમાં દીઠા તે શું ખોટા દીઠા ? એવા વિચારથી અકૂરજીએ  
ફરીવાર દૂબકી મારી, તો ત્યાં પણ ફરીવાર શેષનાગનાં દર્શન થયાં. સિદ્ધ, ચારણ,  
ગાંધર્વ અને અસુરો પોતાનાં માથાં નમાવીને તેમની સ્તુતિ કરતા હતા. એ  
શેષનાગને હજાર મસ્તક હતાં, હજાર ફેણોમાં મુકુટ પહેર્યા હતા, વસ્ત્ર શ્યામ  
હતાં, કંતિ કમળના નાળની સમાન શ્વેત હતી, અને શિખરોથી ધોળા ડેલાસની  
પેઠે શોભતા હતા.<sup>૪૧-૪૫</sup> એ શેષનાગના કુંડળ આકારે વળેલા શરીર ઉપર  
શાંતસ્વરૂપ ભગવાનને પોઢેલા જોયા. એ પરમપુરુષ નારાયણની કંતિ મેઘના  
સરખી શ્યામ હતી, પીળાં રેશમી વસ્ત્ર પહેર્યા હતાં, ભુજ ચાર હતી, નેત્ર કમળપત્ર  
સરખાં રાતાં હતાં. મુખ સુંદર અને પ્રસંગ હતું, ભૂકુટી સુંદર હતી, નાસિકા, કાન  
અને કપોળ મનોહર હતાં, હોઠ રાતા હતા, વક્ષ:સ્થળમાં લક્ષ્મીજી હતાં, કંઠ  
શંખ જેવો હતો, નાભિ ઊંડી હતી, પીપળાના પાંદડા સરખા ઉદરમાં ત્રણ વળીઓ  
પડતી હતી, કટી અને નિતંબ મોટા હતા, બે સાથળ ઉપર જાડા અને નીચે પાતળા

તુઙ્ગગુલ્ફારુણનખવાતદીધિતિભર્વતમ् । નવાઙ્ગુલ્યઙ્ગુષ્ટદલૈર્વિલસત્પાદપઙ્કજમ् ॥૫૦  
સુમહાર્હમણિવાતકિરીટકટકાઙ્ગરૈ: । કટિસૂત્રબ્રહ્મસૂત્રબ્રહ્મ વિન્ડલૈ: ॥૫૧  
ભ્રાજમાન પદ્મકરં શઙ્ગુચક્રગદાધરમ् । શ્રીવત્સવક્ષસં ભ્રાજત્કાસુભં વનમાલિનમ् ॥૫૨  
સુનન્દનન્દપ્રમુખૈ: પાર્ષવૈ: સનકાદિભિ: । સુરેશૈર્બહ્રસ્રદ્રાદ્યૈર્નવભિશ્ર દ્વિજોત્તમૈ: ॥૫૩  
પ્રહ્રાદનારદવસુપ્રમુખૈભર્ગવતોત્તમૈ: । સ્તૂયમાન પૃથગ્ભાવૈર્વચોભિરમલાત્મભિ: ॥૫૪  
શ્રિયા પુષ્ટગ્ના ગિરા કાન્દ્યા કીર્ત્વા તુષ્ટચેલયોર્જયા । વિદ્યાવિદ્યા શક્ત્યા માયયા ચ નિષેવિતમ્  
વિલોક્ય સુભૂષં પ્રીતો ભક્ત્યા પરમયા યુત: । હૃદ્યત્તનુરૂહે ભાવપરિક્લિનાત્મલોચન: ॥૫૬  
ગિરા ગદ્વદ્યાઽસ્તૌબીત્સત્વમાલાંબ્ય સાચ્ચતઃ: । પ્રણાય મૂર્ખાઽવહિત: કૃતાજ્જલિપુટ: શનૈ: ॥

ઇતિ શ્રીમદ્બાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સહિતાયાં દશમસ્કન્ધો પૂર્વાર્થ  
અકૂરપ્રતિયાને એકોનચત્વારિંશોઽદ્યાય: ॥૩૯॥૧

હતા, બે ગોઠણ અને બે પીંડીઓ શોભી રહી હતી. ૪૬-૪૮ કંઈક ઉપડતી ઘૂંઠીઓથી  
અને રાતા નખના સમૂહની કંતિથી વીટાએલા હતા, કોમળ આંગળીઓ અને  
અંગૂધારૂપ પાંખડીઓથી ચરણકમળ શોભી રહ્યાં હતાં. ૪૦ અનેક અમૂલ્ય  
મણિવાળાં કિરીટ, કડાં, બાજુબંધ, કટિમેખળા, જનોઈ, હાર, ઝાંઝર અને  
કુંડળોથી દીપી રહ્યા હતા. ૪૧ ચાર હસ્તમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કર્યા  
હતાં, વક્ષ:સ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન હતું, કૌસ્તુભમણિ શોભતો હતો, વનમાળા  
પહેરી હતી. ૪૨ નંદ, સુનંદ આદિ પાર્ષવો, સનકાદિકો, બ્રહ્મા આદિ મોટા દેવો,  
મરીચિ આદિ નવ બ્રહ્મર્થિઓ અને પ્રહ્લાદ, નારદ તથા ઉપરિયર વસુ આદિ  
મોટા વૈષ્ણવો નિર્મળ અંત:કરણથી નોખાનોખા પ્રકારનાં વચ્ચનોવડે સ્તુતિ કરતા  
હતા. ૪૩-૪૪ લક્ષ્મી, પુષ્ટિ, સરસ્વતી, કંતિ, કીર્તિ, ઈલા, ઊર્જા, વિદ્યા, અવિદ્યા,  
માયા અને બીજી પણ શક્તિઓ સેવા કરતી હતી. ૪૫ આવા ભગવાનને જોઈ બહુ  
જ રાજુ થયેલાં પરમ ભક્તિવાળા રોમાંચિત થયેલાં અને ભાવને લીધે જેનાં નેત્ર  
તથા અંત:કરણ આર્દ્ર થઈ ગયાં હતાં, એવા અકૂરજી ધીરજ રાખી, મસ્તકથી  
પ્રણામ કરી, હાથ જોડી, સાવધાન થઈ, ધીરે ધીરે ગદ્ગદ વાણીથી આ પ્રમાણે  
સ્તુતિ કરવા લાગ્યા. ૪૬-૪૭

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમસ્કંદ્યનો અંગણાયાણીશમો  
અદ્યાય સંપૂર્ણ.

## अथ चत्वारिंशोऽध्यायः (४०)

॥ अक्लू उवाच ॥

नतोऽस्म्यं त्वाखिलहेतुहेतुं नारायणं पूरुषमाद्यमव्ययम् ।

यन्नाभिजातादर्विदकोशाद् ब्रह्माऽविरासीद् यत एष लोकः ॥१॥

भूस्तोयमणिः पवनः खमादिर्महानजादिर्मन इन्द्रियाणि ।

सर्वेन्द्रियार्था विबुधाश्च सर्वे ये हेतवस्ते जगतोऽङ्गभूताः ॥२॥

नैते स्वरूपं विदुरात्मनस्ते ह्यजादयोऽनात्मतया गृहीताः ।

अजोऽनुबद्धः स गुणैरजाया गुणात् परं वेद न ते स्वरूपम् ॥३॥

त्वां योगिनो यजन्त्यद्वा महापुरुषमीश्वरम् । साध्यात्मं साधिभूतं च साधिदैवं च साधवः ॥४  
त्रया च विद्यया केचित् त्वां वै वैतानिका द्विजाः । यजन्ते वितत्यैर्ज्ञैर्नासूर्पामराख्यया  
एके त्वाखिलकर्मणि संन्यस्योपशमं गताः । ज्ञानिनो ज्ञानयज्ञेन यजन्ति ज्ञानविग्रहम् ॥५  
अन्ये च संस्कृतात्मानो विधिनाभिहितेन ते । यजन्ति त्वम्यास्त्वां वै बहुमूर्त्येकमूर्तिकम् ॥

अध्याय ४०

अक्लूरश्च अे भगवाननी स्तुति करी.

अक्लूरश्च स्तुति करे छे- सर्वे कारणाना कारण, आदिपुरुष अने अविनाशी  
आप नारायण के जेनी नाभिमांथी उत्पन्न थयेला कमणना कोशमांथी ब्रह्मांडना  
कर्ता ब्रह्मा प्रकट थया छे, तेमने हुं प्रशाम करुं छुं.<sup>१</sup> पृथ्वी, जग, वायु,  
आकाश, अहंकार, महतत्त्व, माया, पुरुष, मन, इंद्रियो, सर्वविषयो अने देवताओ  
के जेओ जगतना कारणरूप छे ते सर्वे आपना अंगरूप छे.<sup>२</sup> प्रकृत्यादिक पदार्थो  
जड होवाने कारणो जेम आपना स्वरूपने जाणतां नथी, तेम ब्रह्मादिक ज्ञवो  
येतन होवा इतां पश मायाना गुणोथी बंधाएला होवाने लीधे गुणथी पर आपना  
स्वरूपने जाणता नथी.<sup>३</sup> केटलाक योगीओ साक्षात् महापुरुष अने अंतर्यामी  
ईश्वररूपे आपने भजे छे. केटलाक योगीओ सर्वभूतोने विषे रहेला सर्वेना  
शरीरी एवा आपने भजे छे. केटलाक योगीओ “साधिदेव” एटले ईन्द्र यंद्रादिक  
देवोना अंतरात्मारूपे आपने भजे छे. अने केटलाक योगीओ यक्षु हृदय ए  
आदिकमां रहेला आपने भजे छे.<sup>४</sup> कर्मयोगवाणा केटलाएक द्विज लोको अनेक  
प्रकारना ईन्द्रादिक देवताओना नामथी मोटा यज्ञो करी पूर्वभीमांसानी अंदर  
प्रतिपादन करायेली कर्मकांडरूपी विद्याथी तमने भजे छे.<sup>५</sup> केटलाक ज्ञानीओ सर्व  
कर्मो भगवानने समर्पित करी शब्दादि विषयोने विषे भोग्यता बुद्धिथी रहित

## श्रीमद्भागवतपुराणम्

त्वामेवान्ये शिवोक्तेन मार्गेण शिवरूपिणम् । ब्रह्माचार्यविभेदेन भगवन् समुपासते ॥८  
सर्व एव यजन्ति त्वां सर्वदेवमयेश्वरम् । येऽप्यन्यदेवताभक्ता यद्यप्यन्यधियः प्रभो ॥९  
यथाद्रिप्रभवा नद्यः पर्जन्यापूरिताः प्रभो । विशन्ति सर्वतः सिन्धुं तद्वत्त्वां गतयोऽन्ततः ॥१०  
सत्त्वं रजस्तम इति भवतः प्रकृतेगुणाः । तेषु हि प्राकृताः प्रोता आब्रह्मस्थावरादयः ॥११  
तु त्वयं नमस्तेऽस्त्वविषक्तदृष्ट्ये सर्वात्मने सर्वधियां च साक्षिणे ।

गुणप्रवाहोऽयमविद्यया कृतः प्रवर्तते देवनृतिर्यगात्मसु ॥१२॥

अग्निर्मुखं तेऽवनिरदिग्रीक्षणं सूर्यो नभो नाभिरथो दिशः श्रुतिः ।

द्यौः कं सुरेन्द्रास्तव बाहवोऽर्णवाः कुक्षिर्मरुत् प्राणबलं प्रकल्पितम् ॥१३॥

रोमाणि वृक्षौषधयः शिरोरुहा मेधाः परस्यास्थिनखानि तेऽद्रयः ।

निमेषणं रात्र्यहनी प्रजापतिर्मेदस्तु वृष्टिस्तव वीर्यमिष्यते ॥१४॥

थृष्णानयश्वदे श्वानस्वरूप अेवा तमोने भजे छे.<sup>६</sup> आपे कहेला पंचरात्र शास्त्र  
प्रमाणे तमभुद्रानुं धारणा ए आदि पांच संस्कारोवदे संस्कृत बनेला, अने तमारुं  
एक ज स्वरूप जेने प्रधान छे, अेवा बीजा केटलाक व्यूह विभवादिकरूपथी अनेक  
मूर्तिवाणा अने नारायणरूपे एक मूर्तिवाणा आपने भजे छे.<sup>७</sup> केटलाक लोको  
वणी बहु आचार्योना आचारभेदो जेने विषे रहेला छे अेवा अने सदाशिवे  
कहेला पाशुपतादिक मार्गोथी शिवरूपी आपने भजे छे.<sup>८</sup> हे प्रभु! जे लोको बीजा  
देवताओना भक्त छे तेओनी बुद्धि ज्ञेके बीजाओमां होय छे, तोपण वास्तविक  
विचारतां ते सर्वे आप के जे सर्व देवमय अने ईश्वर छो ते आपने ज भजे छे.<sup>९</sup>  
हे प्रभु! जेम पर्वतथी उत्पन्न थयेली नदीओ वरसादथी धणा प्रवाहवाणी थृष्णे  
अंते समुद्रने पामे छे. तेम सर्वे पूजाना मार्गो अंते आपनी अंदर ज विराम पामे  
छे.<sup>१०</sup> सत्व, २४ अने तम आ त्रष्णगुणो तमारी मायाना छे. स्थावरथी ते ब्रह्म  
सुधीना सर्वे ज्ञवो गुणोमां परोवाएला छे, गुणो मायामां परोवाएला छे अने  
माया आपमां परोवाएली छे.<sup>११</sup> गुणोना लेप वगरनी बुद्धिवाणा, सर्वना आत्मा  
अने सर्वनी बुद्धिओना साक्षी एवा आपने प्रश्नाम करुं छुं, अविद्याए करेलो आ  
गुणमय संसारनो प्रवाह तो देव, माशस अने पशु पक्षीओनां शरीरोने पोतारूप  
माननाराओमां ज प्रवर्ते छे, पश आपनी अंदर प्रवर्ततो नथी.<sup>१२</sup> अग्नि तमारुं  
मुख छे, पृथ्वी पग छे, सूर्य नेत्र छे, आकाश नाभि छे, दिशाओ कान छे, स्वर्गलोक  
मस्तक छे, देवताओ हाथ छे, समुद्रो पेट छे, वायु प्राण अने बणरूप कल्पाएला  
छे. वृक्ष अने औषधिओ रुवाडां छे, भेद केश छे, पर्वतो अस्थि अने नभरूप छे,

ત्वय्यव्यात्मन् पुरुषे प्रकल्पिता लोकाः सपाला बहुजीवसङ्कूलाः ।  
यथा जले सञ्जिहते जलौकसोऽप्युद्भवे वा मशका मनोमये ॥१५॥

यानि यानीह स्पाणि क्रीडनार्थं बिर्भर्षि हि । तैरामृष्टशुचो लोका मुदा गायन्ति ते यशः ॥  
नमः कारणमत्स्याय प्रलयाब्धिचराय च । हयशीर्षो नमस्तुभ्यं मधुकैटभमृत्यवे ॥१७  
अकूपाराय बृहते नमो मन्दरधारिणे । क्षित्युद्धारविहाराय नमः सूकरमूर्तये ॥१८  
नमस्तेऽद्भुतसिंहाय साधुलोकभयापह । वामनाय नमस्तुभ्यं क्रान्तिभुवनाय च ॥१९  
नमो भृगूणां पतये दृमक्षत्रवनच्छिदे । नमस्ते रघुवर्याय रावणान्तकराय च ॥२०  
नमस्ते वासुदेवाय नमः सङ्कर्षणाय च । प्रद्युम्नायानिरुद्धाय सात्वतां पतये नमः ॥२१  
नमो बुद्धाय शुद्धाय दैत्यदानवमोहिने । म्लेच्छायाक्षत्रहन्ते नमस्ते कल्किरूपिणे ॥२२  
भगवज्जीवलोकोऽयं मोहितस्तव मायया । अहंममेत्यसद्ग्राहो भ्राम्यते कर्मवर्त्मसु ॥२३  
अहं चात्मात्मजागारदारार्थस्वजनादिषु । भ्रमामि स्वप्नकल्पेषु मूढः सत्यधिया विभो ॥२४

रात्रि अने दिवस निर्भेष्टुप छे, प्रज्ञापति शिश्नुप छे अने वृष्टि वीर्युप छे.<sup>१३-१४</sup>  
हे अविनाशी ! धणा छ्वाथी व्याम आ लोकपाण सहित ख्रस्तांडो शुद्ध मनथी  
ग्रहण करवा योग्य अेवा आप ते आपना स्वरुपमां आधीन रहेलां छे, जणमां  
सूक्ष्म जणजंतुओनी पेठे अने उटंभराना फणमां भर्ष्यरोनी पेठे, एक झीजनी  
वातने नहीं जाणतां अनेक ख्रस्तांडो आपना स्वरुपमां ज फर्या करे छे.<sup>१५</sup> आप  
झीडाने माटे जे जे रुप धरो छो ते ते रुपथी जेना शोक मटी जाय छे, अेवा लोको  
प्रीतिथी तमारी क्रीति गाय छे.<sup>१६</sup> प्रलयना समुद्रमां फरनार भत्स्यावतार रुप  
आपने प्रशाम करुं छुं. मधुकैटभने मारनार हयशीवरुप आपने प्रशाम करुं  
छुं.<sup>१७</sup> मंदराचयणे धारणा करनार कूर्मरुप आपने प्रशाम करुं छुं, पृथ्वीने जणमांथी  
बहार काढवारुप विहार करनार वाराहरुप आपने प्रशाम करुं छुं.<sup>१८</sup> हे  
साधुलोकोना भयने मटाउनार ! अद्भुत नृसिंहरुप आपने प्रशाम करुं छुं.<sup>१९</sup>  
त्रैलोक्यने त्राण पगलांथी मापी लेनार वामनरुप आपने प्रशाम करुं छुं.<sup>२०</sup>  
गर्ववाणा क्षत्रियोरुपी वनने कापनारा परशुरामरुप आपने प्रशाम करुं छुं.  
रावणानो नाश करनार रामयंदरुप आपने प्रशाम करुं छुं.<sup>२१</sup> भक्तोना रक्षक  
वासुदेव, संकर्षण, प्रद्युम्न अने अनिरुद्धरुप आपने प्रशाम करुं छुं.<sup>२२</sup> शुद्ध  
छितां देत्य दानवोने मोह पमाउनारा बुद्धरुप आपने प्रशाम करुं छुं. मोटे भागे  
म्लेच्छरुप थयेला क्षत्रियोने हणनार क्लिकरुप आपने प्रशाम करुं छुं.<sup>२३</sup> हे  
भगवान ! तमारी मायाथी मोह पामेलो अने देहादिकमां “हुं अने मारु” अेवो

अनित्यानात्मदुःखेषु विपर्ययमतिर्हाहम् । द्वन्द्वारामस्तमोविष्टे न जाने त्वाऽत्मनः प्रियम् ॥  
यथाबुधो जलं हित्वा प्रतिच्छन्नं तदुद्धवैः । अभ्येति मृगतृष्णां वै तद्वत्त्वाहं पराङ्मुखः ॥२६  
नोत्सहेऽहं कृपणधीः कामकर्महतं मनः । रोद्धुं प्रमाथिभिश्चाक्षैर्ह्यमाणमितस्ततः ॥२७  
सोऽहं तवाङ्ग्रह्युपगतोऽस्यसतां दुरापं तच्चाप्यहं भवदनुग्रह ईश मन्ये ।

पुंसो भवेद् यर्हि संसरणापवर्गस्त्वय्यज्ञनाभ सदुपासनया मतिः स्यात् ॥२८॥  
नमो विज्ञानमात्राय सर्वप्रत्ययहेतवे । पुरुषेशप्रधानाय ब्रह्मणेऽनन्तशक्तये ॥२९  
नमस्ते वासुदेवाय सर्वभूतक्षयाय च । हृषीकेश नमस्तुभ्यं प्रपत्रं पाहि मां प्रभो ॥३०  
इति श्रीमद्वागवते महापुराणे परमहस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे  
अकूरस्तुतिनर्मि चत्वारिंशोऽध्यायः ॥४०॥

आग्रह धरनार आ छ्वालोक कर्मना मार्गोमां भटक्या करे छे.<sup>२५</sup> हे प्रभु ! अत्यंत  
मूढ हुं पशु देह, पुत्र, धर, स्त्री, धन, अने स्वजनादिक स्वप्र जेवा पदार्थोमां  
तेओने साचा मानी भटक्या करुं छुं.<sup>२६</sup> अनित्य कर्मक्षणे नित्य माननार,  
अनात्मा देहने आत्मा माननार, हुःभरुप धर आहिने सुभरुप माननार,  
सुभद्रुःभादिकमां ज रमनार अने अज्ञानथी व्याम थयेलो हुं परम प्रेमना  
स्थानकरुप आपने ज्ञाणतो नथी.<sup>२७</sup> जे भ मूर्ख माणस जणथी ज उत्पन्न थयेला  
धासथी ढंकाअेला पाणीने छोटी दृष्टि, अंजवाना पाणी उपर दोडे, तेभ हुं पशु  
आपने मूकी दृष्टि, देहादिक उपर दोड्या करुं छुं, अर्थात् देहने ज आत्मा मानी,  
तेना लालन पालनमां भयी रह्यो छुं.<sup>२८</sup> वासना भरेली बुद्धिवाणो हुं जे मारुं  
मन, काम तथा कर्मथी क्षोभ पामेलुं छे, अने बणवतर ईद्रियोथी यारेकोर खेंचायुं  
जाय छे, तेने रोकवाने समर्थ नथी.<sup>२९</sup> हे परमेश्वर ! हे पद्मनाभ ! हुं विषयी  
पुरुषोने न भणे अेवा आपना चरणारविंदने शरण आवेलो छुं. अने ते शरणे  
आववुं पशु आपना अनुग्रहथी ज थयुं छे, अभ मानुं छुं, ज्यारे छ्वाने जन्म  
मरणानी समाप्तिथवानी होय त्यारे ज महात्मा पुरुषोनी सेवाथी आपना भजननुं  
मन थाय छे.<sup>३०</sup> विज्ञानरुप, सर्वज्ञानना काररुप, पुरुषने सुभद्रुःभादि आपनार  
काण, कर्म अने स्वभावादिकना नियंता अने अनंत शक्तिवाणा परब्रह्म आपने  
नमन करुं छुं.<sup>३१</sup> सर्व भूतप्राणी मात्रनी अंदर निवास करीने रहेला वासुदेव  
अेवा आपने प्रशाम करुं छुं. हे ईद्रियोना स्वामी ! आपने नमुं छुं. हे प्रभु ! हुं  
शरणागत छुं, तेनी आप रक्षा करो.<sup>३२</sup>

इति श्रीमद्वागवतपुराणा भागवतना दशम कर्ण्दनो यालीशमो अद्याय संपूर्ण.

## अथेकचत्वारिंशोऽध्यायः (४१)

॥ श्रीशुकुञ्चाच ॥

स्तुवतस्तस्य भगवान् दर्शयित्वा जले वपुः । भूयः समाहरत् कृष्णो नटो नाट्यमिवात्मनः  
सोऽपि चान्तर्हितं वीक्ष्य जलादुन्मज्ज्य सत्वरः । कृत्वा चावश्यकं सर्वं विस्मितो रथमागमत् २  
तमपृच्छद्वीकेशः किं ते दृष्टिमिहाद्बुतम् । भूमौ वियति तोये वा तथा त्वां लक्षयामहे ॥३  
अक्रूर उवाच

अद्बुतानीह यावन्ति भूमौ वियति वा जले । त्वयि विश्वात्मके तानि किं मेऽदृष्टं विपश्यतः ॥४  
यत्राद्बुतानि सर्वाणि भूमौ वियति वा जले । तं त्वानुपश्यतो ब्रह्मान् किं मे दृष्टिमिहाद्बुतम् ॥५  
इत्युक्त्वा चोदयामास स्यन्दनं गान्दिनीसुतः । मथुरामनयद् रामं कृष्णं चैव दिनात्यये ॥६  
मार्गे ग्रामजना राजंस्तत्र तत्रोपसंगताः । वसुदेवसुतौ वीक्ष्य प्रीता दृष्टिं न चादुः ॥७  
तावद् व्रजौकस्तत्र नन्दगोपादयोऽग्रतः । पुरोपवनमासाद्य प्रतीक्षन्तोऽवतस्थिरे ॥८

## अध्याय ४१

भगवाने भथुरामां प्रवेशीने धोखीने भार्यो तथा सुषाभा भाणी  
अने दरशु उपर प्रसन्न थया.

शुकुटेवज्ञ कुहे छे- हे राजा ! आ प्रमाणे श्रीकृष्णे अकूरज्ञने जणमां पोतानुं  
दर्शन आपी ते हजु सुति करता ज हता, त्यां नट जेम पोताना नाटकने संकेली ले  
तेम पोतानुं स्वरूप संकेली लीधुं.<sup>१</sup> विस्मय पामेला अकूरज्ञ पश भगवानने  
अंतर्धान थयेला जोई, पाणीमांथी भहार आवी, कपडां आहि पहेरी, तरत रथनी  
पासे आव्या.<sup>२</sup> भगवाने अकूरज्ञने पूष्यं देतमो पृथ्वीमां, आकाशमां के जणमां  
कांઈ आश्वर्य जेवुं जेयुं ? तमो कांઈ आश्वर्य जेयुं होय तेवुं, तमारी आकृति  
उपरथी जणाय छे.<sup>३</sup> अकूरज्ञ कुहे छे आजगतमां, पृथ्वीमां, आकाशमां अने  
जणमां जे कांઈ आश्वर्य जेवुं छे तेतमे ज छो. तमे सर्व जगतरूप छो. तो तमने  
ज में जेया, माटे सर्व आश्वर्य मारा जेवामां आव्युं.<sup>४</sup> हे परमेश्वर ! तमारे विषे  
ज सर्वे आश्वर्यो रह्यां छे. तो तमारां दर्शन करनारो हुं तेमें पृथ्वी, आकाश के  
जणमां तमारा विना बीजुं शुं आश्वर्य जेयुं होय ?<sup>५</sup>

शुकुटेवज्ञ कुहे छे- आम कही अकूरज्ञ रथ हांक्यो अने दिवस आथमतां  
पहेलां बणेहेव अने कृष्णने भथुरामां पहोंचाड्या.<sup>६</sup> हे राजा ! मार्गमां स्थणे  
स्थणे मणेला गामना लोको आ वसुदेवना भन्ने पुत्रोने जोईने, राज्ञ थतां पोतानी  
दृष्टिने पाणी ज खेयता न हता.<sup>७</sup> अकूरज्ञनो रथ पहोंच्यो ते पहेलां ज नंदादिक

तान् समेत्याह भगवानकूरं जगदीश्वरः । गृहीत्वा पाणिना पाणिं प्रश्रितं प्रहसन्निव ॥९  
भवान् प्रविशतामग्रे सहयानः पुरीं गृहम् । वयं त्विहावमुच्याथ ततो द्रक्ष्यामहे पुरीम् ॥१०

अकूर उवाच

नाहं भवद्भ्यां रहितः प्रवेक्ष्ये मथुरां प्रभो । त्यक्तुं नार्हसि मां नाथ भक्तं ते भक्तवत्सल ॥११  
आगच्छ याम गेहान् नः सनाथान् कुर्वधोक्षज । सहाग्रजः सगोपालैः सुहृद्दिश्श सुहृत्तम् ॥१२  
पुनीहि पादरजसा गृहान् नो गृहमेधिनाम् । यच्छौचेनानुतृप्यन्ति पितरः सागन्यः सुराः ॥१३  
अवनिज्यांद्युगलामासीच्छ्लोक्यो बलिर्महान् । ऐश्वर्यमतुलं लेखे गर्ति चैकानिनां तु या ॥१४  
आपस्तेऽद्यवनेजन्यस्त्रीलोकाङ्गुवयोऽपुनन् । शिरसाधत याः शर्वः स्वर्यातः सगरात्मजाः  
देवदेव जगन्नाथ पुण्यश्रवणकीर्तन । यदूत्तमोत्तमश्लोक नारायण नमोऽस्तु ते ॥१६

श्रीभगवानुवाच

आयास्ये भवतो गेहमहार्यसमन्वितः । यदुचक्रद्वाहं हत्वा वितरष्ये सुहृत्प्रियम् ॥१७

गोवाणो आगणीथी मथुराना उपवन पासे आवी राह जोता त्यां ज उभा हता.<sup>८</sup>  
नंदादिं गोवाणोने भणीने कृष्णे भगवाने नभ्रतावाणा अकूरज्ञनो हाथ पोताना  
हाथे पकडी, जाणे हसता होय तेम आ प्रमाणे कहुं.<sup>९</sup> भगवान कुहे छे तमो रथ  
सहित मथुरा नगरीमां तमारे धेर जाओ. अमो तो अहीं उतारो करीने पधी  
मथुराने ज्ञेईशुं.<sup>१०</sup> अकूरज्ञ कुहे छे- हे प्रभु ! हे नाथ ! हे भक्तवत्सल ! तमारा  
भन्ने जण विना हुं एकलो मथुरामां नहीं जाउं. कारण के हुं तमारो भक्त धुं, तेथी  
तमारे मारो त्याग न करवो ज्ञेईओ.<sup>११</sup> हे श्रीकृष्ण ! यालो आपाणे साथे जईओ.  
मोटा भाई, गोवाणो अने मित्रोनी साथे परम स्नेही आप अमारे धेर पधारीने  
अमारा धरने सनाथ करो.<sup>१२</sup> आपनां यरण धोवानुं जण आंगाणे पडवाथी पितृ,  
अग्नि अने देवताओ तृम थाय छे, ते यरणरज्ञी अमारां गृहस्थनां धर पवित्र  
करो.<sup>१३</sup> महात्मा बणिराजा पश आपना यरणारविंदने धोवाथी पवित्र कीर्तने  
योग्य थया छे. अने सर्वोत्तम ऐश्वर्यने तथा साचा भक्तलोकनी गतिने पाभ्या  
छे.<sup>१४</sup> तमारां यरणानो स्पर्श कुरेल जण (गंगाज्ञ) त्राणे लोकने पवित्र करे छे. ते  
जणने शंकरे पोताना मस्तक उपर धरेल छे, अने जेना प्रभावथी सगर राजाना  
पुत्रो स्वर्गमां गया छे.<sup>१५</sup> हे देवना देव ! हे उत्तम कीर्तिवाणा ! हे नारायण ! जे  
आपनुं श्रवण तथा कीर्तन पवित्र छे तेमने हुं प्रशाम करुं धुं.<sup>१६</sup>

श्रीकृष्ण भगवान कुहे छे- यादवोना मंडणो द्रोह करनारा कंसने भार्या पधी,  
मोटाभाईनी साथे हुं तमारे धेर आवीश अने संबंधीओने आनंद आपीश.<sup>१७</sup>

## શ્રીશુક ઉવાચ

એવમુકો ભગવતા સોઽકૂરો વિમના ઇવ । પુરીં પ્રવિષ્ટઃ કંસાય કર્મવૈદ્ય ગૃહં યયૌ ॥૧૮  
 અથાપરાહે ભગવાન् કૃષ્ણઃ સઙ્ક્રષ્ણણાન્વિતઃ । મથુરાં પ્રાવિશદ् ગોપૈર્દિદ્બક્ષુઃ પરિવારિતઃ ॥૧૯  
 દર્દશ તાં સ્ફાટિકતુઙ્ગાંપુરદ્વારાં બૃહદ્દેમકપાટતોરણામ् ।  
 તાપ્રારકોષ્ટાં પરિખાદુરાસદામુદ્યાનરમ્યોપવનોપશોભિતામ् ॥૨૦॥  
 સૌવર્ણશૃઙ્ગાટકહર્મ્યનિષ્કૃટૈઃ શ્રેણીસભાભિર્ભવનૈરૂપસ્કૃતામ् ।  
 વैદૂર્યવજ્રામલનીલવિદ્રુમ્ભુમુક્તાહરિદ્વિર્વલભીષુ વેદિષુ ॥૨૧॥  
 જુષ્ટેષુ જાલામુખરન્ધકુદ્વિમેષાવિષ્ટપારાવતબર્હિનાદિતામ् ।  
 સંસ્ક્રતરથ્યાપણમાર્ગચત્વરાં પ્રકીર્ણમાલ્યાદ્વુરલાજતપણુલામ् ॥૨૨॥  
 આપૂર્ણકુઘ્રૈર્ધિચન્દનોક્ષિતિઃ પ્રસૂનદીપાવલિભિઃ સપણ્ણૈઃ ।  
 સવૃન્દરમ્ભાક્રમુકૈઃ સકેતુભિઃ સ્વલ્લુતદ્વારગૃહાં સપણ્ણૈકૈઃ ॥૨૩॥

શુક્ટેવજ્ઞ કહે છે- આ પ્રમાણે શ્રીકૃષ્ણ બોલતાં જોણે ઉદાસ થયા હોય  
 એવા અદ્રૂજી મથુરામાં ગયા, અને પોતે કરેલા કામની વાત કંસની પાસે કહીને  
 પોતાને ધેર ગયા.<sup>૧૮</sup> પછી પાછલે પહોરે બલરામ સહિત ગોવાળોથી વીંટાએલા  
 ભગવાન શ્રીકૃષ્ણ જોવાની ઈચ્છાથી મથુરામાં પદ્ધાર્યા.<sup>૧૯</sup> મણિનાં ઊંચાં નાકાં  
 અને દ્વારવાળી, મોટાં સોનાનાં કમાડ અને તોરણવાળી, ખાઈઓને લીધે શત્રુઓથી  
 પેસાય નહીં એવી તથા સમીપની વાડીઓથી શોભી રહેલી અને જેમાં ધાન્યના  
 કોઠાર તથા અશ્વશાળા આદિ સ્થાનકો ત્રાંબાનાં અને લોઢાનાં હતાં એવી મથુરાને  
 ભગવાને જોઈ.<sup>૨૦</sup> સોનાના ચૌટા, ધનવાનોની હવેલીઓ, ઉપવન, એક ધંધાથી  
 જીવનાર લોકોના બેસવાનાં સ્થાનકો અને બીજા ધરોથી પણ મથુરા શોભી રહી  
 હતી. વૈદૂર્યમણિ, હીરા, સ્ફટિક, નીલમણિ, પરવાળાં, મોતી અને હારિતમણિથી  
 જરેલા ગોખના છિદ્રો, છાજલીઓ, વેદીઓ તથા બાંધેલી તળીયાની ભૂમિમાં બેઠેલાં  
 પારેવાં અને મોર નાદ કરી રહ્યા હતા, રાજમાર્ગ, બજાર, અને આંગણાંઓમાં  
 પાણી છાંટ્યાં હતાં. ફૂલ, નવાં પાંદડાં, ધાણી અને ચોખા ચારેકોર વેરાએલા  
 હતા.<sup>૨૧-૨૨</sup> પ્રત્યેક ધરના દ્વારોની બજે બાજુએ ચોખાના ઢગલા ઉપર રાખેલા  
 જળ ભરેલા કળશો શાશગારેલા હતા. તે કળશ ઉપર દહીં અને ચંદન છાંટેલાં  
 હતાં, કળશની ઉપર ચારેકોર ફૂલની માળાઓ રાખેલી હતી. કળશના ગળામાં  
 વસ્ત્રો વીંટ્યાં હતાં. મુખમાં આંબા આદિનાં પાંદડાં ખોસેલાં હતાં, ઉપર બીજાં  
 પાત્ર મૂકી તેઓમાં અનેક દીવા કર્યા હતા, ધજાઓ ચાઢાવેલી હતી અને તેની

તાં સમ્પ્રવિષ્ટૈ વસુદેવનન્દનૌ વૃત્તૌ વયસ્યૈર્નર્દેવવર્તમાન ।  
 દ્રષ્ટું સમીયુસ્ત્રવરિતાઃ પુરસ્ત્રિયો હર્ષાર્ણિ ચૈવારુહુન્પોત્સુકાઃ ॥૨૪॥

કાશ્ચિદ્ વિપર્યાગધૃતવસ્ત્રભૂપણા વિસ્મૃત્ય ચૈકં યુગાલ્બ્ધથાપારાઃ ।  
 કૃતૈકપત્રશ્રવણૈકનૂપુરા નાઙ્કત્વા દ્વિતીયં ત્વપરાશ્ચ લોચનમ् ॥૨૫॥

અશનન્ત્ય એકાસ્તદપાસ્ય સોત્સવા અભ્યજ્યમાના અકૃતોપમજ્જનાઃ ।  
 સ્વપન્ન્ય ઉથાય નિશમ્ય નિઃસ્વનં પ્રપાયયન્ત્યોર્ભમપોહ્ય માતરઃ ॥૨૬॥

મનાંસિ તાસામરવિન્દલોચનઃ પ્રગલભલીલાહસિતાવલોકનૈઃ ।  
 જહાર મતદ્વિર્દેન્નવિક્રમો દૃશાં દદચ્છીરમણાત્મનોત્સવમ् ॥૨૭॥

દૃષ્ટા મુહુઃ શ્રુતમનુદ્બુતચેતસસ્તં તત્પ્રેક્ષણોત્સમુદ્ધોક્ષણલબ્ધમાનાઃ ।  
 આનન્દમૂર્તિમુપગૃહ્ય દૃશાઽત્તમલબ્ધં હૃદ્યત્વચો જહુરનન્તમરિન્દમાધિમ् ॥૨૮॥

પ્રાસાદશિખરાસ્થાઃ પ્રીત્યુત્કુલમુખામ્બુજાઃ । અભ્યવર્ણન્સૌમનસ્યૈ પ્રમદા બલકેશવૌ ॥૨૯

સમીપે હથા સહિત કેળો તથા સોપારીનાં જાડ લગાવી દીધાં હતાં.<sup>૨૩</sup> હે રાજ ! એ  
 નગરીમાં રાજમાર્ગથી આવેલા અને ભિત્રોથી વીંટાએલા શ્રીકૃષ્ણ તથા બણદેવને  
 જોવા સારુ ગામની સ્ત્રીઓ ઉત્કંઠાથી અને ઉતાવળથી ભેળી થવા લાગી અને  
 કેટલીક પોતાના મહેલ ઉપર ચઢી.<sup>૨૪</sup> કેટલીક કપડાં અને ધરેણાં પણ ઊલટાં  
 પહેરી લીધાં હતાં. કેટલીક ધારણ કરવા યોગ્ય કુંડળ કંકણ આદિ ધરેણાંઓને  
 મધ્યે એક એક ધરેણું પહેરીને આવી હતી, એક ઝાંઝર, અને એક કાનમાં પત્ર  
 લગાવ્યાં હતાં અને કેટલીક સ્ત્રીઓ બીજી આંખ આંજ્યા વિના જ આવી હતી.<sup>૨૫</sup>  
 કેટલીક જમતી હતી તે જમવું મૂકીને આવી, કેટલીક તેલથી શરીરનું  
 મર્દન કરતી હતી તે અધૂરું મૂકીને આવી અને કેટલીક નાદ્યા વિના જ આવી,  
 કેટલીક છોકરાંને ધવરાવવાનું પડતું મૂકીને આવી.<sup>૨૬</sup> મોટા મદોન્મત હાથીની  
 પેઠે ચાલતા અને લક્ષ્મીજીને પ્રીતિ આપનારા શ્રીકૃષ્ણ ભગવાન મનોહર લીલા  
 સહિત પોતાનું હાસ્ય અને દસ્થિથી તેના મનને હરતા હતા.<sup>૨૭</sup> હે કામદેવને જીતનારા  
 રાજ ! વારંવાર સાંભળેલા હોવાને લીધે શ્રીકૃષ્ણમાં જ જેનું મન લાગી રહ્યું હતું  
 એવી તથા શ્રીકૃષ્ણના જોવા તથા હસવારુપ અમૃતના સિંચનથી માન પામેલી  
 અને રોમાંચિત થયેલી સ્ત્રીઓએ નેત્રરૂપદ્વારથી આનંદમય ભગવાનને હૃદયમાં  
 પધરાવી તેમનું આલિંગન કરી પોતાને પ્રથમ ભગવાન નહીં મળવાથી મનમાં જે  
 ધાણી વ્યથા હતી એ અવસ્થાને છોડી દીધી.<sup>૨૮</sup> મહેલના શિખરો પર ચઢેલી અને  
 પ્રીતિથી પ્રકૃતિલિત મુખવાળી સ્ત્રીઓ બલરામ તથા શ્રીકૃષ્ણને ફૂલોથી વધાવતી

દધ્યક્ષતાઃ સોદપાત્રૈः સ્વગંધૈરભ્યુપાયનૈઃ । તાવાનર્ચુઃ પ્રમુદિતાસ્તત્ર તત્ત્ર દ્વિજાતયઃ ॥૩૦  
ઊરુઃ પૌરા અહો ગોપ્યસ્તત્પાઃ કિમચરન् મહત् । યા હૃતાવનુપશ્યન્તિ નરલોકમહોત્પાવૌ ॥૩૧  
રજકં કઞ્ચિદાયાન્તં રઙ્ગકારં ગદાગ્રજઃ । દૃષ્ટાયાચત વાસાંસિ ધૌતાન્યત્યુત્તમાનિ ચ ॥૩૨  
દેહાવયોઃ સમુચ્ચિતાન્યદ્વા વાસાંસિ ચાહતોઃ । ભવિષ્યતિ પરં શ્રેયો દાતુસ્તે નાત્ર સંશયઃ ॥૩૩  
સ યાચિતો ભગવતા પરિપૂર્ણે સર્વત: । સાક્ષેપં રૂષિત: પ્રાહ ભૃત્યો રાજઃ સુરુર્મદ: ॥૩૪  
ઇંદ્રશાન્યેવ વાસાંસિ નિત્યં ગિરિવનેચરા: । પરિધિત્ત કિમુદ્રૂતા રાજદ્રવ્યાણ્યભીપ્સથ ॥૩૫  
યાતાશુ બાલિશા મૈવં પ્રાર્થ્ય યદિ જિજીવિષા । બધન્તિ ઘન્તિ લુમ્પન્તિ દૂસં રાજકુલાનિ વૈ ॥  
એવં વિકથમાનસ્ય કુપિતો દેવકીસુત: । રજકસ્ય કરાગ્રેણ શિર: કાયાદપાતયત ॥૩૭  
તસ્યાનુજીવિન: સર્વે વાસ: કોશાન् વિસૃજ્ય વૈ । દુદુવુઃ સર્વતો માર્ગ વાસાંસિ જગૃહેઽચ્યુતઃ ॥  
વસિત્વાઽત્મપ્રિયે વસ્ત્રે કૃષા: સર્વખર્ણસ્તથા । શેષાણ્યાદત્ત ગોપેભ્યો વિસૃજ્ય ભુવિ કાનિચિત्  
તત્તસ્તુ વાયક: પ્રીતસ્તયોર્વેષમકલ્પયત । વિચિત્રવર્ણેશ્વેતેયૈરાકલ્પૈરનુરૂપતઃ ॥૪૦

હતી.<sup>૨૯</sup> રાજુ થયેલા દ્વિજલોકો સ્થળે સ્થળે જળનાં પાત્ર સહિત દઈં, અક્ષત, માણા, ચંદન અને બેટોથી બને ભાઈઓનો સત્કાર કરવા લાગ્યા હતા.<sup>૩૦</sup> મથુરાની સ્ત્રીઓ બોલતી હતી કે અહો ! ગોપીઓએ કૃયું મોટું તપ કર્યું હશે ? કે જેઓ મનુષ્યલોકના મહોત્સવરૂપ આ શ્રીકૃષ્ણ તથા બળદેવજીને સર્વદા ટેચે છે.<sup>૩૧</sup> મથુરામાં ચાલ્યા જતા ભગવાને કોઈ રંગારા ધોબીને આવતો જોઈ, તેની પાસે ધોએલાં અને અતિ ઉત્તમ વસ્ત્ર માગ્યાં.<sup>૩૨</sup> ભગવાને કહ્યું કે- હે ધોબી ! અમો બને જળાને જેવાં જોઈએ તેવાં વસ્ત્રો આપ, તેથી તારું પરમ કલ્યાણ થશે. એમાં સંશય નથી.<sup>૩૩</sup> સર્વપ્રકારે પરિપૂર્ણ ભગવાને આ પ્રમાણે માગણી કરતાં એ રાજાનો ચાકર મદોન્મત ધોબી કોધ કરીને તોછડા શબ્દોથી બોલ્યો કે હે છકેલા લોકો ! તમો પર્વતોમાં અને વનોમાં ફરનારા થઈને નિત્યે આવાં જ કપડાં પહેરતા હશો નહિ ? કે જેથી પોતાના અધિકારનો વિચાર કર્યા વિના રાજાના પદાર્થોને માગો છો.<sup>૩૪-૩૫</sup> અરે મૂર્ખ લોકો ! જતા રહો. જો જીવવાની ઈચ્છા હોય તો આવી માગણી કરશો નહીં. રાજાના ચાકરો અભિમાની માણસને કેદ કરે છે, લૂંટી લે છે, અને મારી પણ નાખે છે.<sup>૩૬</sup> આ પ્રમાણે ધોબી બકવાદ કરતાં કોપ પામેલા ભગવાને પોતાના હાથની એક થપાટથી કાયા ઉપરથી માથું પાડી નાખ્યું.<sup>૩૭</sup> તેના હાથ નીચેના બીજા સર્વ ધોબીઓ વસ્ત્રોના ગાંસડા ત્યાં જ મૂકી ચારેકોર ભાગી ગયા, પછી ભગવાને વસ્ત્ર લઈ લીધાં.<sup>૩૮</sup> ભગવાન અને બલરામ પોતાને સરસ લાગે એવાં વસ્ત્ર પહેર્યાં અને વધ્યાં તે ગોવાળોને માટે લઈ લીધાં અને બાકી પૃથ્વી પર પડતાં

નાનાલક્ષણવેષાભ્યાં કૃષ્ણામૌ વિરેજતુઃ । સ્વલ્લઙ્કતૌ બાલગજૌ પર્વણીવ સિતેતરા ॥૪૧  
તસ્ય પ્રસન્નો ભગવાનું પ્રાદાતું સારુપ્યમાત્મનઃ । શ્રીયં ચ પરમાં લોકે બલૈશ્ર્યસ્મૃતીન્દ્રિયમ् ॥  
તતઃ સુદામ્નો ભવનં માલાકારસ્ય જગ્મતુઃ । તૌ દૃષ્ટા સ સમુત્થાય નનામ શિરસા ભુવિ ॥૪૩  
તયોરસનમાનીય પાદ્યં ચાર્યાહૃણાદિભિઃ । પૂજાં સાનુગયોશ્ક્રે સ્વક્તામ્બૂલાનુલેપનૈઃ ॥૪૪  
પ્રાહ નઃ સાર્થકં જન્મ પાવિત્રં ચ કુલં પ્રભો । પિતૃવેર્ષયો મહાં તૃશ્ણ હ્યાગમને વામ् ॥૪૫  
ભવન્તૌ કિલ વિશ્વસ્ય જગત: કારણં પરમ । અવતીર્ણાવિહાંશેન ક્ષેમાય ચ ભવાય ચ ॥૪૬  
ન હિ વાં વિષમા દૃષ્ટિ: સુહોર્જગદાત્મનોઃ । સમયો: સર્વભૂતેષુ ભજન્તનું ભજતોરપિ ॥૪૭  
તાવાજ્ઞાપયતં ભૃત્યં કિમહું કરવાળિ વામ । પુંસોઽત્યનુગ્રહો હોષ ભવદ્વિદ્વિન્યિયુચ્યતે ॥૪૮  
ઇત્યભિપ્રેત્ય રાજેન્દ્ર સુદામા પ્રીતમાનસ: । શસ્ત્રૈ: સુગંધૈ: કુસુમેર્માલા વિરચિતા દર્વો ॥૪૯  
તાભિ: સ્વલ્લઙ્કતૌ પ્રીતૌ કૃષ્ણામૌ સહાનુગૌ । પ્રણતાય પ્રપન્નાય દદતુર્વર્દૌ વરાન् ॥૫૦

મૂક્યાં.<sup>૩૯</sup> પછી રાજુ થયેલા એક દરજીએ વિચિત્ર વર્ણવાણાં વસ્ત્રોથી અને આભરણથી તેઓને જેવો જોઈએ તેવો શાશગાર કરી આપ્યો.<sup>૪૦</sup> અને ક લક્ષણોવાળા વેષોથી શાશગારેલા એ શ્રીકૃષ્ણ અને બલરામ ઉત્સવમાં શાશગારેલા ધોળા અને કાળા બે હાથીઓની પેઠે શોભવા લાગ્યા.<sup>૪૧</sup> એ દરજી ઉપર પ્રસન્ન થઈને ભગવાને તેને પોતાના સરખું રૂપ, જગતમાં ઉત્તમ લક્ષ્મી, બળ, એશ્ર્ય, સ્મરણ અને ઈદ્રિયોની શક્તિ આપી.<sup>૪૨</sup> પછી એ બને ભાઈઓ સુદામા નામના માળીને ઘેર ગયા. તે બને ભાઈને આવેલા જોઈ માળી મસ્તકથી પગે લાગ્યો.<sup>૪૩</sup> ગોવાળો સહિત એ બને ભાઈઓને આસન તથા પગ ધોવા જળ આપી, માણા, તાંબુલ, ચંદન અને બીજાં પણ ઉત્તમ પદાર્થોથી પૂજા કરીને માળી બોલ્યો કે હે પ્રભુ ! આજ તમારા આવવાથી મારો જન્મ સફળ થયો, મારું કુણ પવિત્ર થયું અને પિતૃ, દેવ તથા ઋષિઓ પણ મારા ઉપર પ્રસન્ન થયા.<sup>૪૪-૪૫</sup> તમો આ સર્વે જગતના પરમ કારણરૂપ છો અને જગતની વૃદ્ધિ તથા અભયને માટે પોતાના સંકલ્પરૂપ જ્ઞાનથી પૃથ્વીમાં અવતરેલા છો.<sup>૪૬</sup> તમો જોકે ભજતો હોય તેને જ ભજો છો, તોપણ સર્વે પ્રાણીઓમાં સમાન સર્વના મિત્ર અને જગતના આત્મા છો. તેથી તમો વિષમ દસ્તિથી વર્તો છો એમ કહી શકાય નહીં.<sup>૪૭</sup> હું તમારો દાસ છું, માટે મને આપ આજા કરો. હું આપનું શું કાર્ય કરું ? આપ આજા કરો એજ અમારી ઉપર મોટો અનુગ્રહ કર્યો ગણાશો.<sup>૪૮</sup> આ પ્રમાણે બોલતા સુદામા માળીએ શ્રીકૃષ્ણનો અભિપ્રાય જાણી રાજુ થઈને સારાં અને સુગંધી ફૂલોથી રચેલી માળાઓ પહેરાવી.<sup>૪૯</sup> એ માળાઓથી શાશગારેલા ગોવાળો સહિત પ્રસન્ન થયેલા

सोऽपि वव्रेऽचलां भक्तिं तस्मिन्नेवाखिलात्मनि । तद्वक्तेषु च सौहार्दं भूतेषु च दयां पराम् ॥  
इति तस्मै वरं दत्ता श्रियं चान्वयवर्धिनीम् । बलमायुर्यशः कांतिं निर्जगाम सहाग्रजः ॥५२  
इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्दे पूर्वार्थं  
पुरप्रवेशो नाम एकत्वारिंशोऽध्यायः ॥४९॥

### अथ द्वित्त्वारिंशोऽध्यायः (४२)

॥ श्रीशुकउवाच ॥

अथ व्रजन् राजपथेन माधवः त्रियं गृहीतांगविलेपभाजनाम् ।  
विलोक्य कुञ्जां युवतिं वराननां प्रपच्छ यांतीं प्रहसन् रसप्रदः ॥१॥  
का त्वं वरोवेतदुहानुलेपनं कस्याङ्गने वा कथयस्व साधु नः ।  
देहावयोरङ्गविलेपमुत्तमं श्रेयस्ततस्ते न चिराद् भविष्यति ॥२॥

अने वर आपनारा ए भन्ने भाईओ नमेला अने शरणागत थयेला ए माणीने वरदान भागवानुं कह्युं.<sup>५०</sup> सुदामाए पश शर्वना आत्मा ते भगवानमां अविचय प्रीति, भगवानना भक्तो उपर स्नेह अने प्राणीओ उपर परम दया माणी.<sup>५१</sup> बलराम सहित भगवान तेना माझ्या प्रभाषे तेने वरदान आपी अने नहीं माझ्या छिं पश तेना वंशमां लक्ष्मी वधती जशे, ऐवुं वयन, बण, आयुष्य, पश अने कांति आपीने त्यांथी विदाय थया.<sup>५२</sup>

इति श्रीमद् महापुराणा भागवतना दशम स्कन्दनो एकतातीशमो अद्याय संपूर्णः।

### अद्याय ४२

श्रीकृष्ण भगवाने कुष्ठभनो उद्घार तथा धनुष्ठनो भंग कर्यो.

शुकुदेवज्ञ कहे छे- पछी राजमार्गमां यालता भगवाने एक कुबडां मोढावाणी युवति कुञ्जा स्त्री के लेण्डो शरीरमां लेपन करवाना यंदननुं पात्र हाथमां लीधुं हतुं तेने जती दीठी। तेने जोईने सुख आपनारा भगवाने पूछ्युं के हे सुंदरी! हे उत्तम साथणवाणी! तुं कोषा छे? अने आ यंदन कोनुं छे? अमारी पासे सारी रीते वात कर अने अमोने आ उत्तम लेपन आप. एम करवाथी तारुं तरत ४ कुल्याश थशे.<sup>१-२</sup>

सैरन्ध्रघुवाच  
दास्यस्म्यहं सुन्दर कंससम्मता त्रिवक्रनामा ह्यनुलेपकर्मणि ।  
मद्भावितं भोजपतेरतप्रियं विना युवां कोऽन्यतमस्तदर्हति ॥३॥  
रूपपेशलमाधुर्यहसितालापवीक्षितैः । धर्षितात्मा ददौ सान्द्रमुभयोरनुलेपनम् ॥४  
ततस्तावङ्गरागेण स्ववर्णेतरशोभिना । सम्प्राप्तपरभागेन शुशुभातेऽनुरज्जितौ ॥५  
प्रसन्नो भगवान् कुञ्जां त्रिवक्रां रुचिराननाम् । ऋज्वीं कर्तुं मनश्चक्रे दर्शयन् दर्शने फलम् ॥६  
पद्भ्यामाक्रम्य प्रपदे द्वयङ्गुल्युत्तानपाणिना । प्रगृह्य चुबुकेऽध्यात्ममुदनीनमदच्युतः ॥७  
सा तदर्जुसमानाङ्गी बृहच्छ्रीणिपयोधरा । मुकुन्दस्पर्शनात् सद्यो बभूव प्रमदोत्तमा ॥८  
ततो रूपगुणौदार्यसम्पन्ना प्राह केशवम् । उत्तरीयान्तमाकृष्य स्मयन्ती जातहच्छ्या ॥९  
एहि वीर गृहं यामो न त्वां त्यक्तुमिहेत्सहे । त्वयोन्मथितचित्तायाः प्रसीद पुरुषर्भ ॥१०  
एवं स्त्रिया याच्यमानः कृष्णो रामस्य पश्यतः । मुखं वीक्ष्यानुगानां च प्रहसंस्तामुवाच ह ॥११

कुञ्जा कहे छे- हे सुंदर! हुं त्रिवक्ता नामनी दासी छुं अने लेपननुं यंदन करवाना काममां हुं कंसने प्यारी छुं, मारुं घसेलुं यंदन कंसने बहुं ज वडालुं छे, तो ते यंदनने तमारा विना भीजो कोषा योग्य छे ?<sup>३</sup> शुकुदेवज्ञ कहे छे रूप, कुमारपशुं, रसिकपशुं, हसवुं, बोलवुं अने जोवुं तेथी परवश थयेली ते कुञ्जाए ते भन्ने भाईओने घाटुं यंदन आप्युं.<sup>४</sup> पीणा आहि वर्णथी शोभता ते यंदनथी नाभि उपरना घणा भरा भागमां जेओअे लेपन करी लीधुं छे, ऐवा बे भाईओ शोभवा लाग्या.<sup>५</sup> प्रसन्न थयेला भगवाने तरत ज पोताना दर्शननुं फै देखाउवा माटे, ए रूपाणा मोढावाणी अने त्राश ठेकाणे वांकी कुञ्जाने सरभी करवानुं मन कर्युं.<sup>६</sup> तेना बे पगना आगला भागने पोताना बे पगथी देखावी, जेनी बे आंगणीओ उंची राखी हती ऐवा हाथथी तेनी चिबुक पकडीने भगवाने तेना शरीरने उंचुं कर्युं.<sup>७</sup> एम करवाथी अंग सरण अने समान थै जतां, मोटा निंतंबवाणी अने मोटा स्तनवाणी ते कुञ्जा भगवानना स्पर्शना महिमाने लीधे स्त्रीओमां श्रेष्ठ थै.<sup>८</sup> पछी रूप, गुण अने उदारताथी भरेली, हसती अने कामदेवथी व्याकुण थयेली ते कुञ्जाए भगवानना वस्त्रनो छेडो ताणीने तेमने कह्युं के हे वीर! यालो आपणे घेर जृष्ठअे, हुं तमने अहीं मूळी देवाने ईश्यती नथी. हे पुरुषोत्तम! भारा चित्ताने तमे परवश करी नाघ्युं छे, माटे भारा उपर कृपा करो.<sup>९-१०</sup> बलरामना देखतां आ प्रभाषे ए स्त्रीओ माणिक्यी करतां, भगवाने पोताना मित्रोनां मोटां जोई हसतां हसतां तेने कह्युं के हे सुंदरी! जे घर पुरुषोना

એષ्यामि તે ગૃહં સુભૂઃ પુંસામાધિવિકર્ણનમ् । સાધિતાર્થો ઽગ્રહાણાં નઃ પાન્થાનાં ત્વં પરાયણમ् ॥  
વિસૃજ્ય માધ્યા વાણ્યા તાં વ્રજન્માર્ગે વર્ણિકૃપથૈઃ । નાનોપાયનતામ્બુલસ્વરગાદ્યૈ: સાગ્રજોર્મચિત: ।  
તહર્ષનસ્મરક્ષોભાદાત્માનં નાવિદન્સ્ત્રિયઃ । વિસ્વસ્તવાસ: કબરવલયાલેખ્યમૂર્તયઃ ॥૧૪  
તત: પૌરાન્ પૃચ્છમાનો ધનુષ: સ્થાનમચ્યુતઃ । તસ્મિન્ પ્રવિષ્ટે દૃદ્શે ધનુરેન્દ્રમિવાદ્વત્તમ् ॥૧૫  
પુરુષૈબૃહુભિર્ગુસમર્ચિતં પરમર્દ્ધિમત । વાર્યમાણો નૃભિઃ કૃષા: પ્રસંગ્ય ધનુરાદવે ॥૧૬  
કરેણ વામેન સલીલમુદ્ભૂતં સજ્યં ચ કૃત્વા નિમિષેણ પશ્યતામ् ।

નૃણાં વિકૃષ્ય પ્રબ્રહ્મજ મધ્યતો યથેક્ષુદણં મદકર્યુરુક્રમ: ॥૧૭॥  
ધનુષો ભજ્યમાનસ્ય શબ્દઃ ખં રોદસી દિશઃ । પૂર્યામાસ યં શ્રુત્વા કંસસ્ત્રાસમુપાગમત ॥૧૮  
તત્ત્રક્ષિણ: સાનુચરા: કૃપિતા આતતાયિન: । ગ્રહીતુકામા આવવૃગ્રહ્યતાં બધ્યતામિતિ ॥૧૯  
અથ તાન્ દુરભિપ્રાયાન્ વિલોક્ય બલકેશવૌ । કૃદ્ધૌ ધન્વન આદાય શકલે તાંશ્ જગ્નતુઃ ॥

મનની પીડાને શમાવનાર છે, ત્યાં હું મારું કામ પૂર્ણ થયા પછી આવીશ. કારણ કે અમો ઘર વિનાના વટેમાર્ગું છીએ, તેઓને આશરો લેવાનું ઠેકાણું તું જ છે. ૧૧-૧૨  
આ પ્રમાણે મધુર વચનથી તેને વિદાય કરી, શ્રીકૃષ્ણ માર્ગમાં ચાલ્યા જતા હતા,  
ત્યાં વેપારીઓએ અનેક પ્રકારની ભેટો, પાનબીડાં, માળાઓ અને સુગંધવાળાં  
પદાર્થોથી તેમનું અને બળદેવજીનું પૂજન કર્યું. ૧૩ ભગવાનાં દર્શન થવાથી  
કામદેવ ઉત્પન્ન થવાને લીધે ચિત્રામણ જેવી થઈ રહેલી અને જેઓનાં વસ્ત્ર, કંકણ  
તથા ડેશ ખસી જતાં હતાં, એવી સ્ત્રીઓને પોતાના શરીરનું ભાન પણ રહેતું ન  
હતું. ૧૪ પછી ગામના લોકોને ધનુષ્યનું ઠેકાણું પૂછ્યા જતા ભગવાને તે સ્થળમાં  
જઈને, જાણે ઈંદ્રનું હોય તેવું અદ્ભુત ધનુષ્ય જોયું. ૧૫ ધણા પુરુષોવડે રક્ષણ  
કરાએલા, પૂજેલા અને મોટી શોભાવાળા તે ધનુષને શ્રીકૃષ્ણો પોતાને રક્ષક લોકોએ  
વાર્યા છતાં પણ બળાત્કારથી ઉપાડ્યું. ૧૬ રક્ષણ કરનારા લોકોના દેખતાં જ લીલા  
માત્રમાં ડાબા હાથથી ઉપાડેલા તે ધનુષને, આંખ મીંચી ઉંઘાડીએ એટલી વારમાં  
સજ્જ કરી, ખેંચીને, ભગવાને જેમ મદોન્ભત હાથી શેરડીના સાંઠાને ભાંગી નાખે  
તેમ ભાંગી નાખ્યું. ૧૭ ધનુષ ભાંગતાં તેનો શબ્દ સ્વર્ગ, અંતરિક્ષ, પૃથ્વી અને  
દિશાઓમાં વ્યાપ થઈ રહ્યો કે જે શબ્દને સાંભળી કંસ ત્રાસ પાખ્યો. ૧૮ કોપ પામેલા  
ધનુષના રક્ષકો પોતાના અનુયરો સહિત શસ્ત્રો ઉપાડીને ભગવાનને પકડી લેવા  
સારુ “પકડો અને બાંધો” એમ બોલતા બોલતા ભગવાનને ઘેરી વણ્ણા. ૧૯ પછી  
તેઓનો દુષ્ટ અભિપ્રાય જોઈ કોષ પામેલા બલરામ અને શ્રીકૃષ્ણો ધનુષના કટકા  
લઈ તેનાથી તે લોકોને માર્યા અને કંસે મોકલેલા બીજા સૈન્યને પણ માર્યું. પછી એ

बलं च कंसप्रहितं हत्वा शालामुखात्ततः । निष्कम्य चेरतुर्हृष्टौ निरीक्ष्य पुरसम्पदः ॥૨૧  
तयोस्तदद्भूतं वीर्य निशाम्य पुरवासिनः । तेजः प्रागलभ्यं रूपं च मेनिरे विबुधौत्तमौ ॥૨૨  
तयोर्विचरतोः स्वैरमादित्योऽस्तमुपेयिवान् । कृष्णरामौ वृतौ गोपैः पुराच्छकटमीयतुः ॥૨૩  
गोप्यो मुकुन्दविगमे विरहातुरा या आशासताशिष ऋता मधुपुर्यभूवन् ।

सમ्प्रश्यतां पुરुषभूषणगात्रलક्ष्मी हित्वेतरान् नु भजतश्शકમेऽयनं श्री: ॥૨૪॥  
अवनिक्तादिग्न्युગलौ भुक्त्वा क्षीરोपसेचनम् । ऊषतुसां સुखं रात्रिं ज्ञात्वा कंसचिकीर्षितम् ॥  
कंसस्तु धनुषो भધं રક्षणां સ्वबलस्य च । वथं નिशाम्य गोविन्दरामविक्रीडितं परम् ॥૨૬  
दीर्घप्रजागરो भीતो दुर्निमित्तानि दुर्मतिः । बहून्यचष्टोभयथा मृत्योदौत्यकरणि च ॥૨૭  
अदर्शनं સ्वशिरસः પ્રતિરૂપે ચ સત्यપि । અસત्यપિ દ્વિતીયે ચ દ્વૈરूપ्यं જ્યોતિષાં તથા ॥૨૮  
છિદ્પ્રતીતિશ્છાયાં પ્રાણघોષાનુપત્રશ્રુતિ: । સ્વર્ણપ્રતીતિર્વક્ષેષુ સ્વપદાનામદર્શનમ् ॥૨૯  
સ્વને પ્રેતપરિષ્વઙ્ગઃ ખરયાનં વિષાદનમ् । યાયાત્રલદમાલ્યેકસ્તૈલાભ્યક્તો દિગ્મબર: ॥૩૦

ધનુષની શાળાના દ્વારમાંથી બહાર નીકળીને એ બત્રે ભાઈઓ ગામમાં ફરવા  
લાગ્યા અને ગામની શોભા જોઈને રાજી થયા. ૨૦-૨૧ તે બત્રે ભાઈઓનું અદ્ભુત  
પરાકમ, તેજ, દેખતા અને રૂપ જોઈને ગામના રહેવાસીઓ, આ કોઈ ઉત્તમ દેવ  
છે, એમ માનવા લાગ્યા. ૨૨ આ પ્રમાણે મન ગમતી રીતે ફરતાં ફરતાં સૂર્ય આથમી  
ગયો, એટલે ગોવાળોથી વીટાએલા શ્રીકૃષ્ણ અને બળદેવજી ગામમાંથી ઉતારે  
આવ્યા. ૨૩ ભગવાન પ્રજમાંથી પદ્ધાર્યા તે સમયમાં વિરહથી આતુર થયેલી  
ગોપીઓએ મથુરામાં જે જે થવાની કલ્યાન કરી હતી તે સર્વે કલ્યાનાઓ, ભગવાનનું  
શરીર કે જેમાં લક્ષ્મીજી પોતાને ભજનારા બ્રહ્માદિક દેવોને છોડી દઈ નિવાસ  
કરીને રહેલ છે, તે શરીરની શોભાને જોનારા મથુરાના લોકોમાં સાચી થઈ. ૨૪  
પછી શ્રીકૃષ્ણ તથા બળદેવ પોતાના પગ ધોઈ તથા દૂધવાળું અને જમી અને કંસે  
જે કરવાનું ધાર્યું હતું તે જાણી લઈ, તે રાત્રી ઉતારામાં જ સુખેથી રહ્યા. ૨૫ ધનુષનો  
ભંગ અને રક્ષણ કરનારાઓનો તથા પોતાના બીજા સૈન્યનો વધ કેવળ ભગવાન  
તથા બળદેવે લીલા માત્રમાં જ કર્યો, તે સાંભળીને લાંબા ઉજાગરાવાળો અને  
ભય પામેલો દુર્બુદ્ધિ કંસ સ્વપ્રમાં અને જગ્રતમાં મૃત્યુને સૂચયવનારાં ઘણાં દુષ્ટ  
શુકનો દેખવા લાગ્યો. ૨૬-૨૭ પ્રતિબિંબ દેખવા છતાં પણ તેમાં પોતાનું માથું દેખતો  
ન હતો. ચંદ્રાદિક બે ન હોવા છતાં પણ ચંદ્રાદિકનાં બંધે બિંબ દેખતો હતો. ૨૮  
પડછાયામાં છિદ્ર દેખાતાં હતાં. કાનને બંધ કરતાં અંદર જે શબ્દ સાંભળવામાં  
આવે તેને સાંભળતો ન હતો. વૃક્ષોને સોનાનાં દેખતો હતો. ૨૯ અને કીચડ આટિમાં

अन्यानि चेत्यं भूतानि स्वजजागरितानि च । पश्यन् मरणसन्त्रस्तो निद्रां लेखे न चिन्तया ॥३१  
व्युष्टायां निशि कौरव्य सूर्ये चाद्यः समुत्थिते । कारयामास वै कंसो मल्क्रीडामहोत्सवम् ॥  
आनर्चुः पुरुषा रङ्गं तूर्यभेर्यश्च जग्निरे । मज्जाश्वालङ्कृताः स्नागिभः पताकाचैलतोरणैः ॥३३  
तेषु पौरा जानपदा ब्रह्मक्षत्रपुरोगमाः । यथोपजोषं विविशू राजानश्च कृतासनाः ॥३४  
कंसः परिवृतोऽमात्यै राजमञ्च उपाविशत् । मण्डलेश्वरमध्यस्थो हृदयेन विदूयता ॥३५  
वाद्यमानेषु तूर्येषु मल्कालोत्तरेषु च । मल्लाः स्वलङ्कृता दृमाः सोपाध्यायाः समाविशन् ॥३६  
चाणूरो मुष्टिकः कूटः शलस्तोशल एव च । त आसेदुरुपस्थानं वल्मुवाद्यप्रहर्षिताः ॥३७  
नंदगोपादयो गोपा भोजराजसमाहृताः । निवेदितोपायनास्ते एकस्मिन्मञ्च आविशन् ॥३८  
इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वर्थे  
मल्लङ्घोपवर्णनं नाम द्वित्यारिंशोऽध्यायः ॥४२॥

पोतानां पण्डितानां देखतो न हतो. २९ स्वप्रमां मुडानुं आलिंगन करतो हतो, गधेडा  
पर यदीने जतो हतो, झेर खातो हतो, जासुद्धना फूलनी माणा पहेडी, तेलथी  
भरडाअेलो अने न०० ऐकलो जतो हतो. ३० स्वप्र अने जाग्रतमां एवी रीतनां  
बीजां पण केटलांक अपशुक्नो देखीने भरणाथी त्रास पामेला कंसने चिंताने लीधे  
निद्रा ज आवी नहीं. ३१ हे राजा ! मांड मांड प्रभात पडतां अने जग्मांथी सूर्य  
भहार नीकण्ठां कंसे मल्लोनी रमतनो महोत्सव कराव्यो. ३२ लोकोअे अभाडानी  
पूजा करी तूराई अने भेरी वागवा लाग्यां. माणा, पताका अने वस्त्रना तोरणोथी  
भेसवाना मंचोने शाशगार्या. ३३ ब्राह्मण अने क्षत्रिय आदि नगरना लोको अने  
देशना लोको ते मंचो उपर बेठा तथा राजाओ पण झेम पोताने अनुकूण आवे तेम  
आसनो नाखीने तेओ उपर बेठा. ३४ कारभारीओथी वीटाअेलो अने जेनुं हृदय  
क्यवाया करतुं हतुं एवो कंस, पोतानी नीयेना राजाओना भध्यमां राजमंच  
उपर बेठो. ३५ वाजांओ वागवा लाग्यां, मल्लोना तबोटा (मल्लताल) वाजांओने  
पण दाबी देता संभणावा लाग्या, त्यारे शाशगारेला अने गर्ववाणा मल्लो  
पोताना आचार्यो सहित आव्या. ३६ सुंदर वाजांथी राज थयेला याणूर, मुष्टिक,  
कूट, शल अने तोशल ए मल्लो अभाडामां आव्या. ३७ कंसे बोलावेला नंदादि  
गोवाणो पण कंसने भेटो आपीने एक मंच उपर बेठा. ३८

इति श्रीमद्भागवतपुराण भागवतना दशम ऋक्यना  
बेतालीशमो अद्याय संपूर्ण

अथ त्रिचत्वारिंशोऽध्यायः (४३)

॥ श्रीशुकुञ्चित्वाच ॥

अथ कृष्णश्च रामश्च कृतशौचौ परंतप । मल्लदुंदुभिन्दीषं श्रुत्वा द्रष्टुपेयतुः ॥१  
रङ्गद्वारं समासाद्य तस्मिन् नागमविस्थितम् । अपश्यत् कुवलयापीडं कृष्णोऽम्बष्टप्रचोदितम् ।  
बद्ध्वा परिकरं शौरिः समुद्धु कुटिलालकान् । उवाच हस्तिपं वाचा मेघनादगभीरया ॥२  
अम्बष्टाम्बष्ट मार्ग नौ देह्यपक्रम मा चिरम् । नो चेत् सकुञ्जरं त्वाद्य नयामि यमसादनम् ॥४  
एवं निर्भर्तिस्तोऽम्बष्टः कुपितः कोपितं गजम् । चोदयामास कृष्णाय कालान्तकयमोपमम् ।  
करीन्द्रस्तमभिद्रुत्य करेण तरसाग्रहीत् । कराद् विगलितः सोऽमुनिहत्याद्विष्वलीयत ॥६  
संक्रुद्धस्तमचक्षाणो घाणदृष्टिः स केशवम् । परामृशत् पुष्करेण स प्रसह्य विनिर्गतः ॥७  
पुच्छे प्रगृह्यातिबलं धनुषः पञ्चविंशतिम् । विचकर्ष यथा नागं सुपर्ण इव लीलया ॥८

### अद्याय ४३

अभाडाना द्वारभां फुवल्यापीड हाथीने मारीने, मल्लना  
अभाडामां प्रवेश करता श्रीकृष्ण भगवान तथा धणदेवशु.

शुकुटेवज्ञ कुहे छे- हे परीक्षित राजा ! “अपे धनुषनो भंग आदि कर्म करी  
अमारुं ऐश्वर्य सूचयन करावी दीधुं छे, तोपण अमारा माता-पिताने आ छोडतो  
नथी अने अमने पण मारवा ईछ्ये छे, तेथी आ मामाने मारतां अमने कांई पण  
दोष नथी.” आ प्रमाणे पहेले हिवसे जेओये पोतानी पवित्रता करी लीधी हती.  
ऐवा श्रीकृष्ण अने बणदेवज्ञ मल्लोना नगारांनो शब्द सांभणी जेवा सारु  
आव्या. १ अभाडाना द्वारथी आगण आव्या, त्यां ते ठेकाणे उभेलो फुवल्यापीड  
नामनो हाथी के जेने अंबाष (महावत) हांकतो हतो तेने भगवाने दीठो. २ भेट  
वाणी तथा पोताना वांका केश बांधीने भगवाने मेघनी गर्जना सरभी गंभीर  
वाणीथी ए हाथीना रक्षक अंबाषने कह्युं के ‘हे अंबाष ! हे अंबाष ! अमने मार्ग  
दे. तुरत खसी जा, अने जो नहीं खसे तो तने तथा तारा हाथीने हमणां यमपुरीमां  
मोक्ली आपीश. ३-४ आ प्रमाणे तरछोडेला अने कोपेला अंबाषे मृत्यु, मृत्युनुं  
निभितकाण अने मृत्युना नियंता यम जेवा हाथीने भगवाननी सामे हांक्यो. ५  
हाथीये सामे दोडी तरत पोतानी सूंठथी भगवानने पकड्या. भगवान पण  
सूंठमांथी छटकी तथा तेने मुक्को मारीने तेना यार पणमां धूपी रह्या. ६ भगवानने  
नहीं देखतां कोध पामेला अने सुंधीने जाणनार ते हाथीये वणी भगवानने पकड्या

स पर्यावर्तमानेन सव्यदक्षिणतोऽच्युतः । बभ्राम भ्राम्यमाणेन गोवत्सेनेव बालकः ॥१  
 ततोऽभिमुखमध्येत्य पाणिनाऽहत्य वारणम् । प्राद्रवन् पातयामास स्पृश्यमानः पदे पदे ॥१०  
 स धावन् क्रीडया भूमौ पतित्वा सहसोस्थितः । तं मत्वा पतितं क्रुद्धो दन्ताभ्यां सोऽहनक्षितिम्  
 स्वविक्रमे प्रतिहते कुञ्जरेन्नोऽत्यर्थितः । चोद्यमानो महामात्रैः कृष्णमध्यद्रवद् रुषा ॥१२  
 तमापतन्तमासाद्य भगवान् मधुसूदनः । निगृह्य पाणिना हस्तं पातयामास भूतले ॥१३  
 पतितस्य पदाऽक्रम्य मृगेन्द्र इव लीलया । दन्तमुत्पाट्य तेनेभं हस्तिपांश्चाहनद्विरः ॥१४  
 मृतकं द्विपमुत्सृज्य दन्तपाणिः समाविशत् । अंसन्यस्तविषाणोऽसृङ्गमदबिन्दुभिरङ्गितः ।  
 विरुद्धस्वेदकणिकावदनाम्बुरुहो बभौ ॥१५  
 वृतौ गोपैः कतिपर्यैर्बलदेवजनार्दनौ । रङ्गं विविशत् राजन् गजदन्तवरायुधौ ॥१६  
 मल्लानामशनिर्नृणां नरवरः स्त्रीणां स्मरो मूर्तिमान् ।  
 गोपानां स्वजनोऽसतां क्षितिभुजां शास्ता स्वपित्रोः शिशुः ।

पशु भणात्कारथी ते नीकणी गया.<sup>७</sup> गरुड जेम नागने खेंचे तेम भगवान मोटा  
 भणवाणा हाथीने तेनुं पूँछुं पकडीने लीला मात्रथी पर्यीस धनुष जेटले दूर सुधी  
 पाइण पगे खेंच्यो.<sup>८</sup> पछी जेम कोई बाणक, चारे बाजू फरता गायना वाढृतांनी  
 साथे फरे, तेम बाणकरुप श्रीकृष्ण डाबी अने जमणी कोर फर्या करता ते हाथीनी  
 साथे फरवा लाग्या.<sup>९</sup> पछी सामे आवी पोताना हाथी ते हाथीने प्रहार करी,  
 भगवान ए हाथीने पाडी नाखवा ए रीते दोड्या, के आणे हमणां हाथी भगवाननो  
 स्पर्श करी जशे.<sup>१०</sup> दोडता भगवान कीडाथी पृथ्वी उपर पडीने पाणा तुरत उठी  
 गया. भगवानने पडेला मानी ते कोधी हाथीए भगवानने मारवा पोताना दांत  
 धरतीमां मार्या.<sup>११</sup> पोतानुं पराक्रम व्यर्थं जतां बहु ज कोध पामेला अने महावतो  
 जेने हंक्या करता हता, ऐवो हाथी कोधथी भगवाननी सामे दोड्या.<sup>१२</sup> ते आवता  
 हाथीनी सामे जैर्थ भगवाने पोताना हाथथी तेनी सूळ पकडीने तेने पाडी नाघ्यो.<sup>१३</sup>  
 ए पडेला हाथीने सिंहनी पेठे पगथी दबावी रमत मात्रमां तेनो दांत खेंची लઈने  
 ते ज दांतथी हाथीने तथा तेना रक्षको महावतोने मार्या.<sup>१४</sup> मरी गयेला हाथीने  
 छोडी दृढ तेनो दांत हाथमां लઈने भगवान अभाडामां पधार्या. हाथीनो दांत  
 खभा उपर राख्यो हतो. पोताना शरीरमां ते हाथीना मद तथा लोहीना छांटा  
 उड्या हता.<sup>१५</sup> अने मुखारविंद उपर परसेवानां विंदुओ लागी रहेलां होवाथी  
 शोभता हता. हे राजा ! केटलाक गोवाणोथी वीटाअेला अने हाथीना दांतरुपी  
 उत्तम आयुधवाणा ए बत्रे भाईओ अभाडाना स्थानकमां प्रवेश कुर्या.<sup>१६</sup> मल्लोने

मृत्युर्भोजपतेर्विराङ्गिदुषां तत्त्वं परं योगिनां ।  
 वृष्णीनां परदेवतेति विदितो रङ्गं गतः साग्रजः ॥१७॥  
 हतं कुवलयापीडं दृष्ट्वा तावपि दुर्जयौ । कंसो मनस्यपि तदा भृशमुद्विजे नृप ॥१८  
 तौ रेजतू रङ्गगतौ महाभुजौ विचित्रवेषाभरणस्त्रगम्बरौ ।  
 यथा नटावुत्तमवेषधारिणौ मनः क्षिपन्तौ प्रभया निरीक्षताम् ॥१९॥  
 निरीक्ष्य तावुत्तमपूरुषौ जना मञ्चस्थिता नागरराष्ट्रका नृप ।  
 प्रहर्षवेगोत्कलितेक्षणाननाः पपुन् तृप्ता नयनैस्तदाननम् ॥२०॥  
 पिबन्त इव चक्षुभ्यां लिहन्त इव जिह्या । जिग्रन्त इव नासाभ्यां शिलघ्यन्त इव बाहुभिः ॥२१  
 ऊचुः परस्परं ते वै यथादृष्टं यथाश्रुतम् । तद्रूपगुणमाधुर्यप्रागलभ्यस्मारिता इव ॥२२  
 एतौ भगवतः साक्षाद्वरेनरायणस्य हि । अवतीर्णविहांशेन वसुदेवस्य वेशमनि ॥२३  
 एष वै किल देवक्यां जातो नीतश्च गोकुलम् । कालमेतं वसन् गूढो ववृथे नन्दवेशमनि ॥२४

वृश्चुरुप जषाता, मनुष्योने उत्तम मनुष्य जषाता, स्त्रीओने देहधारी क्रामदेवरुप  
 जषाता, गोवाणोने संबंधीजन जषाता, दुष्ट राजाओने दंड आपनार जषाता,  
 पोताना मा-आपने बाणकरुप जषाता, कंसने मृत्युरुप जषाता, अशानीओने  
 लोहीथी भरडावाने लीघे बीभत्सनी समान जषाता, योगीओने परमात्मारुपे  
 जषाता अने यादवोने परम देवतरुप जषाता श्रीकृष्ण भगवान पोताना मोटा  
 भाईनी साथे अभाडामां गया.<sup>१७</sup> हे राजा ! कुवलयापीड हाथीने मारेलो जाणी ते  
 बत्रे भाईओने श्रुतवा कठण जाणी, कंस देह मनवाणो इतां पशु ते समये बहु  
 ज उद्देग पाभ्यो.<sup>१८</sup> अभाडामां आवेला मोटा हाथवाणा, पोतानी कांतिथी  
 जोनाराओना मननुं हरण करता अने जेओ विचित्र वेषना आभरण, माणाओ  
 अने वस्त्रे धार्या हतां. ऐवा बत्रे उत्तम वेष धारण करनार बे नटनी पेठे शोभता  
 हता.<sup>१९</sup> ऐ बे उत्तम पुरुषने जोडीने जेनां मोठां तथा नेत्र आनंदना वेगथी प्रकुलित  
 थयां छे ऐवा राजाओ, नगरना लोको अने देशना लोको तेमना मुखारविंदने  
 आसक्ति पूर्वक जोवा लाग्या, इतां जेतां तृप्ति पामता न हता. तेथी नेत्रथी पान  
 करता होयने शुं ? ज्ञानीथी चाटता होयने शुं ? नाकथी सुंधता होयने शुं ? अने  
 हाथथी आलिंगन करता होयने शुं ? ऐम जषाता हता.<sup>२०-२१</sup> भगवाननां रुप,  
 गुण, मधुरता अने प्रौढपश्चात्ये जाणे स्मरण आपेलुं होय ऐवी रीते सर्वे लोको  
 भगवाननां देखेलां अने सांभणेलां पराक्रमो विषे वातो करवा लाग्या.<sup>२२</sup> आ  
 बत्रे जषा साक्षात् नारायणना अंशथी अहीं वसुदेवना धरमां अवतरेला छे.<sup>२३</sup>

पूतनानेन नीतान्तं चक्रवातश्च दानवः । अर्जुनौ गुह्यकः केशी धेनुकोऽन्ये च तद्विधाः ॥२५  
गावः सपाला एतेन दावाग्नेः परिमोचिताः । कालियो दमितः सर्प इन्द्रश्च विमदः कृतः ॥२६  
सप्ताहमेकहस्तेन धृतोऽद्विप्रवरोऽमुना । वर्षवाताशनिभ्यश्च परित्रातं च गोकुलम् ॥२७  
गोप्योऽस्य नित्यमुदितहसितप्रेक्षणं मुखम् । पश्यन्यो विविधांस्तापांस्तरन्ति स्माश्रमं मुदा ॥  
वदन्त्यनेन वंशोऽयं यदोः सुबहुविश्रुतः । श्रियं यशो महत्त्वं च लप्प्यते परिरक्षितः ॥२९  
अयं चास्याग्रजः श्रीमान् रामः कमललोचनः । प्रलम्बो निहतो येन वत्सको ये बकादयः ॥३०  
जनेष्वेवं ब्रुवाणेषु तूर्येषु निनदत्सु च । कृष्णरामौ समाभाव्य चाणूरो वाक्यमब्रवीत् ॥३१  
हे नन्दसूनो हे राम भवन्तो वीरसंमतौ । नियुद्धकुशलौ श्रुत्वा राज्ञाऽहूतौ दिव्दक्षुणा ॥३२  
प्रियं राज्ञः प्रकुर्वन्त्यः श्रेयो विन्दन्ति वै प्रजाः । मनसा कर्मणा वाचा विपरीतमतोऽन्यथा ३३  
नित्यं प्रमुदिता गोपा वत्सपाला यथा स्फुटम् । वनेषु मल्लयुद्धेन क्रीडन्तश्चारयन्ति गाः ॥३४

आ कृष्ण देवकीना उदृथी जन्मतां तेमने गोकुणमां लई जवामां आवेल छे अने  
आटला वर्ष सुधी नंदरायना घरमां गुम रहीने भोटा थयेल छे.<sup>२४</sup> पूतना,  
तृष्णावर्त, यमलाञ्जुन, शंभयूढ, केशी, धेनुकासुर अने भीजा पण ऐवा हुष्ट लोकोने  
आ कृष्णे मारेला छे.<sup>२५</sup> आ कृष्णे गोवाणो अने गायोने दावानभामांथी बचावेली  
हती, कालिय नागनु दमन कर्यु हतुं अने ईद्रनो मद उतार्यो हतो.<sup>२६</sup> सात दिवस  
सुधी एक हाथथी गोवर्धन पर्वत धर्यो हतो अने वरसाए, पवन तथा कडाकाथी  
गोकुणनु रक्षण कर्यु हतुं.<sup>२७</sup> आनुं मुख के जेमां जोवुं अने हसवुं निरंतर आनंद  
भरेलुं ज छे, तेने प्रेमथी जोया करती गोपीओ वगर परिश्रमे अनेक प्रकारनां  
तपोने तरी गई हती.<sup>२८</sup> कहेवाय छे के आ कृष्णावडे रक्षा कराएलो यहुवंश बहु  
ज प्रभ्यात थर्हने लक्ष्मी, यश तथा भोटाईने पामशे.<sup>२९</sup> आ कमण सरभा  
नेत्रवाणा बणदेव आ श्रीकृष्णना भोटाभाई थाय छे, के जेषो प्रलंबासुर,  
वत्सासुर अने भक्षासुर आहिने मार्या छे. (वत्सासुर तथा भक्षासुरनो वध श्रीकृष्णे  
करेलो छे, छतां रामयरित्रने विषे बणदेवज्ञ द्वारा वर्षवाएलो छे. अने  
धेनुकासुरनो वध बणदेवज्ञे करेलो छे, छतां श्रीकृष्ण यरित्रने विषे कृष्ण द्वारा  
वर्षवाएलो छे.)<sup>३०</sup> आ प्रमाणे लोको वातो करता हता अने वाज्ञ वागतां हतां ते  
समयमां याशूरमल्ले श्रीकृष्ण अने भलरामने बोलावीने कहुं हे नंदना पुत्र ! हे  
भलराम ! तमो भन्ने जणा वीर लोकोमां मान पामेला अने मलयुद्ध करवामां  
कुशण छो, एम सांभणी ते मलयुद्ध जोवानी ईच्छाथी राजा ए तमोने अहीं  
बोलावेला छे.<sup>३१-३२</sup> जे प्रजा मनथी, कर्मथी अने वाणीथी राजा ने प्रसन्न करे तेनुं

तस्माद् राज्ञः प्रियं यूयं वयं च करवामहे । भूतानि नः प्रसीदन्ति सर्वभूतमयो नृपः ॥३५  
तत्रिशम्याब्रवीत् कृष्णो देशकालोचितं वचः । नियुद्धमात्मनोऽभीष्टं मन्यमानोऽभिनन्द्य च  
प्रजा भोजपतेरस्य वयं चापि वनेचराः । करवाम प्रियं नित्यं तत्रः परमनुग्रहः ॥३७  
बाला वयं तुल्यबलैः क्रीडिष्यामो यथोचितम् । भवेन्नियुद्धं माधर्मः स्पृशेन्मल सभासदः ३८

चाणूर उवाच

न बालो न किशोरस्त्वं बलश्च बलिनां वरः । लीलयेभो हतो येन सहस्रद्विपसत्त्वभृत् ॥३९  
तस्माद्वद्वद्यां बलिभिर्योद्धव्यं नानयोऽत्रवै । मयि विक्रम वार्ष्ण्य बलेन सह मुष्टिकः ४०

इति श्रीमद्भागवते महापुराणे परमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे  
कुवलयापीडवधो नाम त्रिचत्वारिंशोऽध्यायः ॥४३॥

कृत्याण थाय छे, अने अथी विरुद्ध चाले तेनुं अकल्याण थाय छे.<sup>३३</sup> गायो अने  
वाइरडां ओनुं पालन करनारा लोको वनमां निरंतर आनंद करे छे अने मल्लयुद्धनी  
कीडाओ करतां गायोने चारे छे ए वात प्रसिद्ध ज छे.<sup>३४</sup> माटे अमारे अने तमारे  
राजानुं प्रिय करवुं जोईअे. राजा प्रसन्न थाय एटले सर्वे प्राणीओ प्रसन्न थयां  
ऐम समज्वुं, केम के राजा सर्व देवतारूप छे.<sup>३५</sup> मल्लयुद्ध पोताने घारु मानता  
श्रीकृष्ण भगवान ए याशूरनुं वयन सांभणी तथा तेनो सत्कार करी देशकाणने  
अनुसरतुं वयन बोल्या के- तमो अने वनमां फरनारा अमो पण कंस राजानी  
प्रजा छीअे, माटे आपणे निरंतर कंस राजाने राजु करवा जोईअे ज अने एवी  
रीतनी आपणे राजानी आज्ञा मणे एज मोटो अनुग्रह समज्वो.<sup>३६-३७</sup> परंतु  
अमो बाणक छीअे माटे अमारा सरभा साथे लडीशुं, केमके मल्लयुद्ध योग्य रीते  
थाय तो मल्लोनी सभाना अधिकारीओने अधर्मनो स्पर्श न थाय.<sup>३८</sup>

याशूर बोल्यो तुं बाणक नथी अने किशोर पण नथी; केमके तें दसहजार  
हाथीना बणवाणा कुवलयापीड हाथीने रमतां रमतां मारी नाघ्यो. तेमज बलदेव  
पण बणवाणाओमां उतम छे.<sup>३९</sup> माटे तमो भन्ने भाईओगे बणवाणानी साथे  
लडवुं पडशे एमां कांઈ पण अनीति नथी. हे कृष्ण ! तुं मारी साथे लड अने  
बणदेवे मुष्टिकनी साथे लडवुं.<sup>४०</sup>

इति श्रीमद् महापुराण भागवतना दशम स्कंधनो तेतालीशमो अद्याय  
संपूर्णः.

## अथ चतुश्त्वारिंशोऽध्यायः (४४)

॥ श्रीशुकुञ्जाच ॥

एवं चर्चितसंकल्पो भगवान् मधुमूदनः । आससादाथ चाणूरं मुष्टिकं रोहिणीसुतः ॥१  
हस्ताभ्यां हस्तयोर्बद्ध्वा पदभ्यामेव च पादयोः । विचकर्षतुरन्योन्यं प्रसह्य विजिगीषया ॥२  
अरती द्वे अरतिभ्यां जानुभ्यां चैव जानुनी । शिरः शीण्डोरसोरस्तावन्योन्यमभिजघ्नतुः ॥३  
परिभ्रामणाविक्षेपपरिभ्रामावपातनैः । उत्सर्पणापसर्पणैश्चान्योन्यं प्रत्यरुद्धताम् ॥४  
उत्थापनैरुत्त्रयनैश्चालनैः स्थापनैरपि । परस्परं जिगीषन्तावपचक्रतुरात्मनः ॥५  
तद् बलाबलवद्युद्धं समेताः सर्वयोषितः । ऊचुः परस्परं राजन् सानुकम्पा वस्तुथशः ॥६  
महानयं बताधर्म एषां राजसभासदाम् । ये बलाबलवद्युद्धं राजोऽन्विच्छन्ति पश्यतः ॥७  
क्रवज्ञसारसर्वाङ्गौ मल्लौ शैलेन्द्रसन्निभौ । क्रचातिसुकुमाराङ्गौ किशोरौ नासयौवनौ ॥८

## अध्याय ४४

**श्रीकृष्ण भगवाने भल्लोनो तथा कुंसनो नाश करी भाता पिताने केद्मांथी मुक्त कर्या.**

शुकदेवज्ञ कहे छे- आ प्रमाणे वात थतां प्रथमथी ज निश्चय करी राख्यो  
हतो ऐवा भगवान, याशूर भल्लनी साथे अने बलराम मुष्टिक भल्लनी साथे  
युद्ध करवा लाग्या.<sup>१</sup> साम सामा हाथथी हाथ अने पगथी पग मेणवीने छतवानी  
ईच्छाने लीधे एक बीजाने खेंचवा लाग्या.<sup>२</sup> एकबीजाना कोषीओमां कोषी,  
गोठाणमां गोठाण, माथामां माथुं अने छातीमां छाती अझणाववा लाग्या.<sup>३</sup>  
हलाववुं, धक्को देवो, बाथमां लहिने दाबवुं, नीचे पछाडवुं, मूडी दहिने आगण  
जवुं अने पाइण हठवुं ऐवी कियाथी एकबीजाने ज्य पामतां अटकाववा लाग्या.<sup>४</sup>  
गोठाण अने पगनो गोटोवाणी पडेलाने खसेडवो, उपाठीने लह ज्वो, वणगी  
रहेलाने दूर करवो अने पग आहि अवयवोनो गोटो वाणवो, ऐवी कियाओथी  
ऐ बख्खे जाणा ज्यनी ईच्छाने लीधे एकबीजाना शरीरोने पीडा करता हता.<sup>५</sup> हे  
राजा ! जेमां एक बणवान अने बीजो निर्भण हतो ऐवुं ते भल्लयुद्ध जोईने दया  
आवतां सर्वे स्त्रीओ टोणेटोणां मणीने परस्परमां आ प्रमाणे वातो करवा लागी.<sup>६</sup>

स्त्रीओ वातो करे छे- अरेरे ! ! ! आ राजाना सभासदो के जेओ राजाना  
देखतां विणया अने नबणाना युद्धने पोते पण स्वीकारे छे, सभासदोने आ  
मोटो अधर्म लागे छे.<sup>७</sup> जेओगां सर्वे अंग वज जेवां कठाण छे ऐवा अने मोटा

धर्मव्यतिक्रमो ह्यस्य समाजस्य ध्रुवं भवेत् । यत्राधर्मः समुत्तिष्ठेत्र स्थेयं तत्र कर्हिचित् ॥९  
न सभां प्रविशेत् प्राज्ञः सभ्यदोषाननुस्मरन् । अबुवन् विबुवन्नज्ञो नरः किल्बिषमश्नुते ॥१०  
वलातः शत्रुमधितः कृष्णस्य वदनाम्बुजम् । वीक्ष्यतां श्रमवार्युं पद्मकोशमिवाम्बुधिः ॥११  
किं न पश्यत रामस्य मुखमाताप्रलोचनम् । मुष्टिकं प्रति सामर्षं हाससंरभशोभितम् ॥१२॥

पुण्या बत वजभुवो यदयं नूलिङ्गादः पुराणपुरुषो वनचित्रमाल्यः ।

गाः पालयन् सहबलः क्रणयंश्च वेणुं विक्रीडयाञ्छ्रुति गिरित्ररमार्चिताङ्गिरः ॥१३॥

गोप्यस्तपः किमचरन् यदमुष्य रूपं लावण्यसारमसमोर्ध्वमनन्यसिद्धम् ।

दृगिभः पिबन्यनुसवाभिनवं दुरापमेकान्तधाम यशसः श्रिय ऐश्वरस्य ॥१४॥

या दोहनेऽवहनने मथनोपलेपप्रेष्टेष्टुनार्भसुदितोक्षणमार्जनादौ ।

गायन्ति चैनमनुरक्तधियोऽश्रुकण्ठ्यो धन्या व्रजस्त्रिय उरुक्रमचित्तयानाः ॥१५॥

पहाड जेवडा आ बे मल्ल क्यां ? अने अत्यंत सुकोमण अंगवाणा तथा जेओने  
हजु युवानी पण आवी नथी ऐवां आ बे बाणको क्यां ?<sup>८</sup> आ सभामां अवश्य  
धर्मनुं उल्लंघन थवानुं छे अने ज्यां अधर्म प्रवर्ते त्यां कटी पण उिभुं रहेवुं न  
जोईअे.<sup>९</sup> (बीजु स्त्री कहे छे) सभासदोने केवा केवा दोष लागे छे ए जाणार  
समजु माणसे सभामां आववुं न जोईअे, केमके जाणवा छतां युप रहेनार अथवा  
अवणुं बोलनार भूर्भ माणसने दोष लागे छे.<sup>१०</sup> शत्रुनी यारे बाजु फरता आ  
श्रीकृष्णानुं मुखारविंद ज्ञानां बिंदुओथी कमणना डोडानी पेठे पसीनाथी व्याम  
थई रह्युं छे ते जुओ.<sup>११</sup> बलरामनुं मुख के जे रातां नेत्रवाणुं, मुष्टिकनी उपर  
कोधथी भराएलुं अने हास्यथी थयेला आवेशने लीधे शोभी रहेलुं छे, तेने तमो  
शुं जोती नथी ?<sup>१२</sup> अहो आनंद थाय छे के मनुष्य देहथी गूढ, वननां विचित्र  
पुष्पोने पहेनार, गायोने चारता, वेणु वगाडता अने जेना चरणाने सदाशिव  
अने लक्ष्मीज्ञ पण पूजे छे ऐवा, आ पुराण पुरुष श्रीकृष्ण जे प्रजभूमिमां  
बलरामनी साथे अनेक प्रकारनी कीडा करता फरे छे ते प्रजभूमिने धन्य छे.<sup>१३</sup>  
आ सभाने तो घिक्कार छे के जेमां आ श्रीकृष्ण दुःख पामे छे, आ भगवाननुं रुप  
के जे लावण्यने लीधे सुंदर, स्वाभाविक, समये समये नवीन लागे ऐवुं, यश,  
लक्ष्मी अने ऐश्वर्यना अविच्छिन्न स्थानकरुप, बीजाने न मणे ऐवुं अने जेना रुपनी  
समान अथवा अधिक बीजुं कोई पण नथी ऐवुं छे, ते रुपने गोपीओ पोताना  
नेत्रोथी जाणे पी जती होय तेम जुवे छे, माटे ते गोपीओ ए क्युं तप कर्यु हषे ?<sup>१४</sup>  
आपणां पुण्य तो थोडां ज छे केमके आवा अवसरमां आ रुपने जोईअे छीअे,

પ્રાતર્વજાદ્વ્રજત આવિશતશ્ચ સાયં ગોભિઃ સમં ક્રણયતોરસ્ય નિશમ્ય વેણુમ् ।  
 નિર્ગમ્ય તૂર્ણમબલાઃ પથિ ભૂરિપુણ્યાઃ પશ્યન્તિ સસ્મિતમુખ્યં સદ્યાવલોકમ् ॥૧૬॥  
 એવં પ્રભાષમાણાસુ સ્ત્રીષુ યોગેશ્વરો હરિઃ । શત્રું હન્તું મનશ્શ્રકે ભગવાન् ભરતર્ષભ ॥૧૭  
 સભ્યાઃ સ્ત્રીગિરઃ શ્રુત્વા પુત્રસ્નેહશુચાઽતુરૌ । પિતરાવન્વતષ્ટેતાં પુત્રયોરબુધૌ બલમ् ॥૧૮  
 તૈસ્તૈનિયુદ્ધવિધિભર્વિવિધૈરચ્યુતેતરૌ । યુદ્ધાતે યથાન્યોન્યં તથૈવ બલમુષ્ટિકૌ ॥૧૯  
 ભગવદ્ગ્રાત્રનિષ્ઠાતૈર્વજનિષ્ઠેષનિષ્ઠૈર્સ્તે: । ચાણૂરો ભજ્યમાનાઙ્ગો મુહુરલાનિમવાપ હ ॥૨૦  
 સ શ્યેનવેગ ઉત્પત્ય મુષ્ટીકૃત્ય કરાવુભૌ । ભગવન્તિ વાસુદેવં ક્રુદ્ધો વક્ષસ્યબાધત ॥૨૧  
 નાચલતત્પ્રહારેણ માલાહત ઇવ દ્વિપઃ । બાઢોર્નિગ્રહ્ય ચાણૂરં બહુશો ભ્રામયન् હરિઃ ॥૨૨  
 ભૂપષ્ઠે પોથયામાસ તરસા ક્ષીણજીવિતમ् । વિસ્રસ્તાકલ્પકેશસ્વર્ગિન્દ્રધ્વજ ઇવાપતત્ ॥૨૩  
 તથૈવ મુષ્ટિકઃ પૂર્વ સ્વમુષ્ટ્યભિહતેન વૈ । બલભ્રેણ બલિના તલેનાભિહતો ભૃશમ् ॥૨૪  
 અને આંસુથી ભરાએલા કંઠવાળી ગોપીઓ તો ભગવાનનું જ ચિંતવન કરતી  
 અને પ્રેમને લીધે ખાંડતાં, ધાશ કરતાં, લીંપતાં, હીંચકતાં, બાળકો રમાડતાં, પાણી  
 છાંટતાં અને વાશીદું વાળવું આદિ કિયા કરતાં આ ભગવાનનું જ ગાયન કરે છે,  
 માટે મહાત્માયશાળી છે.<sup>૧૫</sup> પ્રાતઃકાળે પ્રજમાંથી ગાયોની સાથે જતાં અને  
 સાંયંકાળે પાછા પ્રજમાં આવતાં આ ભગવાન વેણુ વગાડે છે, ત્યારે ભાગ્યશાળી  
 ગોપીઓ તે વેણુનાદને સાંભળતી તરત ઘરથી બહાર નીકળી માર્ગમાં આવતા,  
 ભગવાનના દ્યાથી પુક્ત દૃષ્ટિવાળા અને મંદમંદ હસતા મુખારવિંદને જુએ છે.<sup>૧૬</sup>

શુક્ટેવજ્ઞ કહે છે- હે રાજી ! આ પ્રમાણે સ્ત્રીઓ, જ્યારે વાતો કરી રહી  
 હતી તે જ સમયે યોગેશ્વર ભગવાને તેઓનો ભય દૂર કરવા માટે શત્રુને મારી  
 નાખવાનનું મન કર્યું.<sup>૧૭</sup> સ્ત્રીઓની ભય ભરેલી વાતો સાંભળી, પુત્રના સ્નેહને લીધે  
 શોકાતુર થયેલાં અને પુત્ર જેવા કૃષ્ણના બળને નહિ જાણતાં દેવકી અને વસુદેવની  
 જેમ પુત્રભાવે દેખનારા સજજનો પરિતાપ પામવા લાગ્યાં.<sup>૧૮</sup> તે અનેક મલ્લયુદ્ધ  
 પ્રકારોથી શ્રીકૃષ્ણ અને ચાણૂર તથા બલરામ અને મુષ્ટિક ન્યાય પ્રમાણે મલ્લયુદ્ધ  
 કરતા હતા.<sup>૧૯</sup> ભગવાનના વજ્પાત જેવા કઠણ પ્રહારોથી અંગ ભાંગી જવા  
 માંડતાં ચાણૂર વારંવાર જ્વાનિ પામવા લાગ્યો.<sup>૨૦</sup> પછી કોધાયમાન થયેલો તે  
 ચાણૂર બાજપક્ષીના જેવા વેગથી ઊછળી, બે હાથની મૂઠીઓ વાળીને ભગવાનની  
 છાતીમાં મારી.<sup>૨૧</sup> જેમ ઝૂલની માળા લાગવાથી હાથી કંપે નહિ તેમ ચાણૂરના  
 પ્રહારોથી ભગવાન કંપ્યા નહિ. પછી ભગવાને ચાણૂરને બેહાથે પક્કી, ઘણીવાર  
 ફેરવીને તેના જીવિતને કીણ કરી નાખતાં જોરથી પૃથ્વી ઉપર પછાડ્યો. જેનાં

પ્રવેપિત: સ રુધિરમુદ્રમન્ મુખતોર્દિતઃ । વ્યસુ: પપાતોર્વૃપસ્થે વાતાહત ઇવાદિશ્રિપઃ ॥૨૫  
 તતઃ કૂટમનુપ્રાસં રામ: પ્રહરતાં વરઃ । અવધીલીલયા રાજન્ સાવજ્ઞ વામમુષ્ટિના ॥૨૬  
 તહેવ હિ શાલ: કૃષ્ણપદાપહતશીર્ષકઃ । દ્વિધા વિદીર્ણસ્તોશલક ઉભાવપિ નિપેતતુઃ ॥૨૭  
 ચાણૂરે મુષ્ટિકે કૂટે શાલે તોશલકે હતે । શોષા: પ્રદુદ્રવુર્મલાઃ સર્વે પ્રાણપરીપ્સવઃ ॥૨૮  
 ગોપાન્ વયસ્યાનાકૃષ્ણ તિ: સંસ્જ્ય વિજહૃતુઃ । વાદ્યમાનેષુ તૂર્યેષુ વલાન્તૌ રૂણપૂરું ॥૨૯  
 જના: પ્રજહૃષુ: સર્વે કર્મણા રામકૃષ્ણાયો: । ઋતે કંસં વિપ્રમુખ્યાઃ સાધવઃ સાધુ સાધ્વિતિ ॥૩૦  
 હતેષુ મલ્લવર્યેષુ વિદૃતેષુ ચ ભોજરાદ । ન્યવારયત્ સ્વત્યાર્થિ વાક્યં ચેદમુવાચ હ ॥૩૧  
 નિઃસારયત દુર્વૃતૌ વસુદેવાત્મજૌ પુરાત । ધંને હરત ગોપાનાં નન્દ બધીત દુર્મિતિમ् ॥૩૨  
 વસુદેવસ્તુ દુર્મેધા હન્યતામાશ્વસત્તમઃ । ઉગ્રસેન: પિતા ચાપિ સાનુગઃ પરપક્ષગઃ ॥૩૩

ભૂધ્યણ, ક્રેશ અને માળા વિખરાઈ ગયાં છે, એવો ચાણૂર ઈંડના ધ્વજની જેમ  
 પડ્યો. ૨૨-૨૩ એજ રીતે મુષ્ટિક કે જેણે બલરામને પ્રથમ મૂક્કો માર્યો હતો. પછી  
 તે બલરામના પ્રહારથી પીડાતાં ધ્રૂજતો અને મોઢામાંથી લોહી ઓકતો પ્રાણ રહિત  
 થઈને વા વંટોળથી ભાંગેલા જાડની જેમ ધરતી ઉપર પડ્યો. ૨૪-૨૫ હે રાજા ! પછી  
 ભારે પ્રહાર કરનારા બલરામ પોતાની સામે આવેલા કૂટ નામના મલ્લને  
 અપમાનથી ડાબાહાથી મૂક્કો મારીને લીલા માત્રમાં મારી નાખ્યો. ૨૬ તે સમયમાં  
 શ્રીકૃષ્ણ ભગવાને શાલ નામના મલ્લનું માથું લાત મારીને ભાંગી નાખ્યું અને તોશલ  
 નામના મલ્લના બે ફાડિયાં કરી નાંખ્યાં, તે બે મલ્લ પણ પડી ગયા. ૨૭ ચાણૂર,  
 મુષ્ટિક, કૂટ, શાલ અને તોશલ માર્યા જતાં અવશેષ રહેલા મલ્લો પ્રાણના રક્ષણની  
 ઈચ્છાથી ભાંગી ગયા. ૨૮ જ્યારે વાજાં વાગતાં હતાં ત્યારે, નાચતા અને ચરણમાં  
 ઝાંઝાર કરતાં ઝાંઝરોવાળા શ્રીકૃષ્ણ અને બળદેવજ્ઞ પોતાના સરખી ઉંમરવાળા  
 ગોવાળોને અખાડામાં ખેંચી લઈને તેઓની સાથે મળીને રમવા લાગ્યા. ૨૯ શ્રીકૃષ્ણ  
 અને બલરામનું કામ જોઈને એક કંસ વિના બીજા સર્વે બ્રત્યાદિક દેવતાઓ અને  
 મનુષ્યો રાજુથા અને સારું થયું એમ બોલવા લાગ્યા. ૩૦ પાંચ મલ્લ માર્યા જતાં  
 અને બીજા ભાંગી જતાં કંસ પોતાનાં વાજાં બંધ કરાવી આ પ્રમાણે બોલ્યો. ૩૧ કંસ  
 કહે છે- વસુદેવના આ દુષ્ટ પુત્રોને ગામમાંથી કાઢી મૂક્કો, ગોવાળોનું ધન લૂંટી લો  
 અને દુષ્ટબુદ્ધિવાળા નંદને બાંધી લો. ૩૨ વસુદેવ પણ કુબુદ્ધિવાળા અને દુષ્ટ છે,  
 તેને પણ જલદી મારી નાખો અને ઉગ્રસેન મારા પિતા હોવા છતાં પણ પોતાના  
 અનુયાયિઓએ સહિત શત્રુઓ સાથે ભળેલા છે. એટલા માટે તેને પણ જીવતા ન  
 છોડો. ૩૩

एवं विकथमाने वै कंसे प्रकुपितोऽव्ययः । लघिम्नोत्पत्य तरसा मञ्चमुत्तङ्गमारुहत् ॥३४  
तमाविशन्तमालोक्य मृत्युमात्मन आसनात् । मनस्वी सहसोत्थाय जगृहे सोऽसिचर्मणी ॥३५  
तं खद्गपाणिं विचरन्तमाशु श्येनं यथा दक्षिणसव्यमब्बरे ।  
समग्रहीद् दुर्विष्होग्रतेजा यथोरगं तार्क्ष्यसुतः प्रसद्य ॥३६॥  
प्रगृह्य केशेषु चलल्किरीटं निपात्य रङ्गोपरि तुङ्गमञ्चात् ।  
तस्योपरिष्ठात् स्वयमब्जनाभः पपात विश्वाश्रय आत्मतन्त्रः ॥३७॥  
तं सम्परेतं विचकर्ष भूमौ हरियथेभं जगतो विपश्यतः ।  
हाहेति शब्दः सुमहांस्तदभूदुर्दीरितः सर्वजनैरन्द्र ॥३८॥  
स नित्यदोष्टिग्नधिया तमीश्वरं पिबन् वदन् वा विचरन् स्वपञ्चसन् ।  
ददर्श चक्रायुधमग्रतो यस्तदेव रूपं दुरवापमाप ॥३९॥  
तस्यानुजा भ्रातरोऽष्टौ कङ्गन्यग्रोधकादयः । अभ्यधावन्नभिकुञ्जा भ्रातुर्निर्वेशकारिणः ॥४०  
तथातिरभसांस्तांस्तु संयत्तान् रोहिणीसुतः । अहन् परिघमुद्यम्य पशूनिव मृगाधिपः ॥४१  
नेदुर्दुर्दुभयो व्योम्नि ब्रह्मेशाद्या विभूतयः । पुष्टैः किरन्तस्तं प्रीताः शशंसुर्ननृतुः स्त्रियः ॥४२

शुकदेवज्ञ कहे छे- आ प्रमाणे कंसे बकवाइ करतां कोप पामेला श्रीकृष्ण,  
पोतानी चतुराईथी डेकीने तरत उिंचा भंय उपर चढी गया.<sup>३४</sup> ए पोताना  
मृत्युरुप भगवानने आवता जोई हिमतवाणा कंसे तरत आसन परथी उठीने  
ढाल तलवार लीधी.<sup>३५</sup> आकाशमां जेम बाजपक्षी फरे तेम हाथमां तलवार लઈने  
डाबी बाजू तथा जमणी बाजू फर्या करतो ऐवो जे कंस तेने असह्य उग्र तेजवाणा  
भगवाने, गरुड जेम नागने पकडे तेम बणात्कारथी पकडयो.<sup>३६</sup> केश पकडी मस्तक  
उपरथी खसी गयेला मुगटवाणा ए कंसने उिंचा भंय उपरथी अभाडामां नाख्यो,  
अने तेनी उपर सर्व जगतना आश्रयरुप अने स्वतंत्र भगवान पोते पश्च  
अभाडामां पडया.<sup>३७</sup> सिंह जेम भरेला हाथीने खेंचे तेम भगवाने सर्व लोकोना  
देखतां ए मरी गयेला कंसने धरती उपर खेंच्यो. ते समयमां हे राजा ! सर्व  
लोकोना मोढामांथी मोटो हाहाकार नीकण्यो.<sup>३८</sup> कंस निरंतर उद्वेगने लीधे पीतां,  
बोलतां, फरतां, सूतां, अने श्वास लेतां पोतानी आगण भगवानने ज देखतो  
हतो. तेथी बीजाने न मणे ऐवा एज भगवानना स्वरुपने पाख्यो.<sup>३९</sup> कंक अने  
न्यग्रोधक आठि आठ कंसना नाना भाईओ कोध करीने भाईनुं वेर वाणवा सारु  
युद्ध करवा दोऽया.<sup>४०</sup> ते समये अति वेगथी धसी आवेला अने सज्ज थयेला ए  
आठे नाना भाईओने बणदेवज्ञ ए सिंह जेम पशुओने मारे तेम भोगण उपाईने

तेषां स्त्रियो महाराज सुहन्मरणदुःखिताः । तत्राभीयुर्विनिघन्त्यः शीर्षाण्यश्रुविलोचनाः ॥४३  
शयानान् वीरशस्यायां पतीनालिङ्गय शोचतीः । विलेपुः सुस्वरं नार्यो विसृजन्त्यो मुहु शुचः ४४  
हा नाथ प्रिय धर्मज्ञ करुणानाथवत्सल । त्वया हतेन निहता वयं ते सगृहप्रजाः ॥४५  
त्वया विरहिता पत्या पुरीयं पुरुषर्षभ । न शोभते वयमिव निवृत्तोत्सवमङ्गला ॥४६  
अनागसां त्वं भूतानां कृतवान् द्रोहमुल्बणम् । तेनेमां भो दशां नीतो भूतधृक् को लभेत शाम्  
सर्वेषामिह भूतानामेष हि प्रभवाप्ययः । गोसा च तदवध्यायी न क्रचित् सुखमेधते ॥४८

## श्रीशुक उवाच

राजयोषित आश्चास्य भगवाँलोकभावनः । यामाहुलौकिकीं संस्थां हतानां समकारयत् ॥४९  
मातरं पितरं चैव मोचयित्वाथ बन्धनात् । कृष्णरामौ ववन्दाते शिरसाऽस्पृश्य पादयोः ॥५०  
देवकी वसुदेवश्च विज्ञाय जगदीश्वरौ । कृतसंवंदनौ पुत्रौ सस्वजाते न शंकितौ ॥५१  
इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्तकन्धे पूर्वार्थ  
कंसवधो नाम चतुश्छत्वारिंशोऽध्यायः ॥४४॥

मारी नाख्या.<sup>४१</sup> ते समये आकाशमां दुंदुभिं वाग्यां, ब्रह्मा अने शिवज्ञ आठि  
देवताओं प्रेमथी पुष्पवडे भगवान उपर पुष्पनी वृष्टि करवा लाग्या अने  
अप्सराओं नायवा लागी.<sup>४२</sup> हे राजा ! पतिओना भरणाथी दुःख पामेली ए  
कंसादिकनी स्त्रीओ रोती अने माथां कूटती त्यां आवी.<sup>४३</sup> रणभूमिमां सूतेला  
पोताना पतिओनुं आविंशन करी शोक करती अने वारंवार आंसु खेरवती ते  
उिंचा स्वरथी विलाप करवा लागी. हे नाथ ! हे प्रिय ! हे धर्मने जाणनारा ! हे  
दयाणु ! हे दीनबंधु ! तमे पोते हण्डाई जईने धर अने प्रजा सहित अमोने पश्च  
हण्डी नाखी छे.<sup>४४-४५</sup> हे पुरुषोमां श्रेष्ठ ! स्वामी ऐवा तमारा वियोगने पामेली  
अने जेमां उत्साह तथा मंगण कार्य बंध पडी गयां छे, ऐवी आ नगरी अमारी  
पेठे ज शोभा रहित थई छे.<sup>४६</sup> तमे निरपराधी प्राणीओनो बहुज द्रोह कर्यो तेथी  
आ दशाने पाख्या छो. प्राणीओनो द्रोह करवाथी कोनुं सारु थाय ?<sup>४७</sup> आ श्रीकृष्ण  
सर्व प्राणीओने उत्पन्न, रक्षण अने प्रलय करनार छे, तो तेनो द्रोह करनार कदी  
पश्च सुख पामे नहि.<sup>४८</sup>

शुकदेवज्ञ कहे छे- पछी लोकोना रक्षक श्रीकृष्ण भगवाने ए राणीओने  
आश्वासन आपी अने मरी गयेलाने माटे जे कांड लोकिक कार्य करवानुं होय ते  
कराव्युं.<sup>४९</sup> श्रीकृष्ण अने बलरामे पोताना माता-पिताने बंधनमांथी छोडावी चरण  
स्पर्श करीने पोताना मस्तकथी तेओना चरणमां प्रणाम कर्या.<sup>५०</sup> पुत्रो पगे लाग्या

## अथ पञ्चत्वारिंशोऽध्यायः (४५)

॥ श्रीशुक उवाच ॥

पितरावुपलब्धार्थो विदित्वा पुरुषोत्तमः । मा भूदिति निजां मायां ततान जनमोहिनीम् ॥१  
उवाच पितरावेत्य साग्रजः सात्वतर्षभः । प्रश्यावनतः प्रीणन्नम्ब ततेर्ति सादरम् ॥२  
नास्मतो युवयोस्तात नित्योत्कण्ठितयोरपि । बाल्यपौगण्डकैशोराः पुत्राभ्यामभवन् क्रचित् ॥३  
न लब्धो दैवहतयोर्वासो नौ भवदन्तिके । यां बालाः पितृगेहस्था विन्दन्ते लालिता मुदम् ॥४  
सर्वार्थसम्भवो देहो जनितः पेषितो यतः । न तयोर्याति निर्वेशं पित्रोर्मत्यः शतायुषा ॥५  
तोपश जगतना ईश्वर ज्ञाणयानी शंकाने लीघे देवकी अने वसुदेवे तेऽनोनुं  
आलिंगन कर्यु नहिं ॥६

इति श्रीमद् महापुराण भागवतना दशम स्कंधनो चुंमालीशमो अध्याय  
संपूर्णः ।

## अध्याय ४५

मातापिताने भद्युर वयनोर्थी सांत्वना आपी, उग्रसेननो  
राज्यालिषेक करी, गुरुने घेर भगवावा ज्ञा श्रीकृष्ण भगवान्.

शुकुदेवज्ञ कहे छे हे परीक्षित ! हुं प्रसन्न थतां आ मातापिताने ज्ञान तो  
कंઈ दुर्लभ ज नथी, पश भने पुत्र समज्जने मारा उपर प्रेम ज दुर्लभ छे, माटे  
हमाणां आ मातापिताने पुत्र स्नेहनुं सुख भोगव्या पहेलां मारी ईश्वरतानुं ज्ञान  
थवुं ते ढीक नहीं. अम विचारी भगवाने लोकोने मोह पमाडनारी पोतानी मायानो  
तेओना चितमां विस्तार कर्यो । पछी मोटा भाई सहित पासे आवीने स्नेहथी  
नमता, अने हे भा ! हे भाप ! अम आदरथी भोलता भगवाने ते माबापने आ  
प्रमाणे कह्युं ॥७

भगवान कहे छे-हे पिता ! तमो बत्रे ज्ञां अमो ढीकराओने माटे निरंतर  
उत्कंठा राखतां हतां, तोपश अमारी भाव्य, पौगंड अने किशोर अवस्थानां जे  
सुख तमोने मणवां ज्ञेहअे ते कटी पश मण्यां नथी ॥८ अमारा (कमनसीबे)  
दुर्देवना योगथी तमारी पासे रहेवानुं भय्युं नथी, अने माबापने घेर रहेवाथी  
लाड पामेला बाणकोने जे आनंद मणे छे ते पश मण्यो नथी ॥९ सुखनी हानि तो  
तमोने तथा अमोने सरभी थई, पश तमारी सेवानो लोप थवाने लीघे अमने तो

यस्तयोरात्मजः कल्प आत्मना च धनेन च । वृत्तिं न दद्यात्तं प्रेत्य स्वमांसं खादयन्ति हि ॥६  
मातरं पितरं वृद्धं भार्या साध्वी सुतं शिशुम् । गुरुं विप्रं प्रपन्नं च कल्पोऽविभृच्छ्वसन् मृतः ॥७  
तत्रावकल्पयोः कंसान्नित्यमुद्विग्नचेतसोः । मोघमेते व्यतिक्रान्ता दिवसा वामनर्चतोः ॥८  
तत् क्षन्तुर्महर्थस्तात मातर्नौ परतन्ययोः । अकुर्वतोर्वा शुश्रूषां क्लिष्टयोर्दुर्वदा भृतम् ॥९

श्रीशुक उवाच

इति मायामनुष्यस्य हर्विश्वात्मनो गिरा । मोहितावङ्गमारोप्य परिष्वज्यापतुर्मुदम् । ॥१०  
सिञ्चनावश्रुधाराभिः स्नेहपाशेन चावृतौ । न किञ्चिद्दूचतूराजन् बाष्पकण्ठौ विमोहितौ ॥११  
एवमाश्वास्य पितरौ भगवान् देवकीसुतः । मातामहं तूग्रसेनं यदूनामकरोन्नृपम् ॥१२  
आह चास्मान् महाराज प्रजाशाङ्गसुर्महसि । यवातिशापाद् यदुभिर्नासितव्यं नृपासने ॥१३  
धर्मनी हानि पश थई छे, धर्मादिक सर्वे पुरुषार्थो जे देह थकी थाय छे ऐवो देह  
जे ओथी उत्पत्त थयो छे अने जे ओअे तेनुं पोधश कर्यु छे, ऐवां मातापिताना  
ऋणमांथी पुत्र सो वर्षनुं आयुष्य भोगवतां पश छूटी शक्तो नथी. जे दीकरो  
पोते समर्थ होवा छतां पश पोताना देहथी अने धनथी ते माता पिताने आज्ञविका  
न आपे ते दीकराने परलोकमां यमदूतो तेनुं पोतानुं ज मांस खवरावे छे ॥१४ पोते  
समर्थ छतां जे पुरुष माता, पिता, वृद्ध, पतिव्रता स्त्री, बाणक, गुरु अने शरणे  
रहेलो कोई पश पुरुष तेनुं पोधश न करे, तेने ज्ञवते मुवो ज्ञावो ॥१५ तो अमो के  
जे ओ असमर्थ अने कंसथी निरंतर उद्देग पामता हता ने अमारा आटला दिवस  
तमारी सेवा नहीं थवाने लीघे व्यर्थ गया छे ॥१६ हे पिता ! हे माता ! ऐटला माटे जे  
अमो शत्रुनी धाणी क्यवाट अने परतंत्रताने लीघे तमारी सेवा करी शक्या नथी,  
तेथी तमो अमोने क्षमा आपवाने योग्य छो ॥१७

शुकुदेवज्ञ कहे छे-आ प्रमाणे मायाथी मनुष्य थयेला विश्वात्मा भगवाननी  
वाणीथी मोह पामेलां देवकी अने वसुदेव पोताना पुत्रोने खोणामां बेसाडी  
आलिंगन करीने आनंद पाम्यां ॥१८ आंसुनी धाराओथी नवरावतां, स्नेहरूपी  
पासथी बंधाएलां, मोह पामेलां अने जेनां गणा सुधी आंसु पहेंयी गयां हतां  
ऐवां देवकी अने वसुदेव प्रेमना भारथी कंઈपश बोली शक्या नहीं ॥१९ भगवाने  
आ प्रमाणे मातापिताने आश्वासन आपी करी, पोताना मातामह (नानाभापा)  
उग्रसेनने यादवोनुं राज्य आयुं अने कह्युं के हे महाराज ! अमो तमारी प्रजा  
धीअे, तेने आप आशा करवाने योग्य छो. यवाति राजाना शापने लीघे  
यद्ववंशीओथी राज्यासन उपर बेसाय नहीं, ऐटला माटे हुं राज्य करीश नहीं

મયિ ભૃત્ય ઉપાસીને ભવતો વિબુધાદ્યઃ । બલિ હરન્ત્યવનતાઃ કિમુતાન્યે નરાધિપાઃ ॥૧૪  
સર્વાન્સ્વાજ્ઞાતિસંબન્ધાન્દિગ્ભ્યઃ કંસભયાકુલાન् । યદુવૃષ્ટયથકમધુદાશાહ્રકુરાદિકાન્  
સભાજિતાન્સમાશ્વાસ્ય વિદેશાવાસકર્ણિતાન્ । ન્યવાસયત્ સ્વગેહેષુ વિત્તૈઃ સંતર્ય વિશ્વકૃત્  
કૃષ્ણસંકર્ણભુજૈર્ગુસા લબ્ધમનોરથાઃ । ગૃહેષુ રેમિરે સિદ્ધાઃ કૃષ્ણરામગતજ્વરાઃ ॥૧૭  
વીક્ષનોઽહરઃ પ્રીતા મુકુન્દવદનામ્બુજમ् । નિત્યં પ્રમુદિતં શ્રીમત્ સદયસ્મિતીક્ષણમ् ॥૧૮  
તત્ત્ર પ્રવયસોઽપ્યાસન્યુવાનોઽતિબલૌજસઃ । પિવનોઽક્ષેર્મુકુન્દસ્ય મુખામ્બુજસુધાં મુહુઃ ॥૧૯  
અથ નન્દં સમાસાદ્ય ભગવાન્ દેવકીસુતઃ । સંકર્ણશ્રી રાજેન્ પરિષ્વજ્યેદમૂચ્યતુઃ ॥૨૦  
પિતર્યુવાભ્યાં સ્ત્રીગધાભ્યાં પોષિતૌ લાલિતૌ ભૃત્યમ् । પિત્રોર્ભ્યાધિકા પ્રીતિરામજેષાસુનોઽપિ હિ  
સ પિતા સા ચ જનની યૌ પુષ્ણીતાં સ્વપુત્રવત् । શિશૂન્ બચ્છુભરુત્સૃષ્ટનકલ્પૈઃ પોષરક્ષણે ॥૨૨  
યાત યુયં બ્રજં તાત વયં ચ સ્નેહદુઃખિતાન્ । જ્ઞાતીન્ વો દ્રષ્ટુમેષ્યામો વિધાય સુહુદાં સુખમ् ॥૨૩

અને તમે પણ યદ્દુવંશી છો તોપણ મારી આજ્ઞાને લીધે તમને કશો દોષ નથી. ૧૨-  
૧૩ હું સેવક થઈને તમારી પાસે રહીશ એટલે દેવ આદિ લોકો પણ તમને નમીને  
કર આપશો, તો પછી બીજા રાજ્ઞાઓ આપે એમાં કહેવું જ શું ? ૧૪ પછી ભગવાને  
યદુ, વૃષ્ણિ, અંધક, મધુ, દાર્શાહ અને કુકુર આદિ પોતાના જ્ઞાતિ અને સંબંધીઓ  
જેઓ કંસના ભયને લીધે પરદેશમાં ભાગી ગયાં હતાં, અને દુઃખી થઈ ગયાં હતાં  
તેઓને પરદેશથી તેડાવી આશ્વાસના કરી, સત્કાર કરી તથા ધનથી તૃપુ કરી  
પોતપોતાના ધરોમાં રાખ્યા. ૧૫-૧૬ શ્રીકૃષ્ણ અને બલરામના હાથથી રક્ષણ પામેલા,  
પૂર્ણ થયેલા અને ભગવાનના પ્રતાપથી તાપ મટી જતાં જેના સર્વે મનોરથ સિદ્ધ  
થયા છે, એવા યાદવો ઘરમાં રમવા લાગ્યા. ૧૭ નિરંતર આનંદ ભરેલું શોભાવાળું  
અને દ્યા સહિત મંદહાસ્યવાળું ભગવાનનું મુખારવિંદ દરરોજ જોવામાં આવતાં  
યાદવોમાં જેઓ વૃદ્ધ હતા તેઓ પણ યુવાન થઈ ગયા અને મુખારવિંદરૂપી અમૃત  
વારંવાર નેત્રથી પીવામાં આવતાં યાદવોના શરીરની અને હંત્રિયોની શક્તિ પણ  
બહુ જ વધી. ૧૮-૧૯ પછી હે રાજી ! દેવકીના પુત્ર શ્રીકૃષ્ણ અને બલરામ નંદરાયની  
પાસે આવી તેમનું આલિંગન કરી આ પ્રમાણે બોલ્યા. ૨૦

શ્રીકૃષ્ણ તથા રામ કહે છે- હે પિતા ! સ્નેહ ભરેલાં તમો બત્તેએ અમોને  
ઉધેર્યા અને બહુજ લાડ લડાવ્યા છે. માબાપને પોતાના શરીર કરતાં પણ પુત્રો  
ઉપર ઘણીજ વધારે પ્રીતિ હોય છે. ૨૧ પોષણ અને રક્ષણ કરવામાં અસર્મથ  
બંધુઓએ છોડી દીધેલા બાળકોનું જેઓ પોતાના પુત્રની પેઠે રક્ષણ કરે, તેઓ જ  
માતા અને પિતા ગણાય. ૨૨ હે પિતા ! તમો પ્રજમાં જાઓ, અહીં સંબંધીઓને સર્વે

એવં સાન્ત્વય્ય ભગવાન્ નન્દં સવરજમચ્યુતઃ । વાસોઽલઙ્ગારકુપ્યાદ્યરહ્યામાસ સાદરમ્ ॥૨૪  
ઇત્યુક્તસ્તૌ પરિષ્વજ્ય નન્દઃ પ્રણયવિહ્બલઃ । પૂર્યન્નશ્રુભિર્નેત્રે સહ ગોપૈર્વર્જં યયૌ ॥૨૫  
અથ શૂરસુતો રાજન્ પુત્રયોઃ સમકારયત્ । પુરોધસા બ્રાહ્મણૈશ્ચ યથાવદ્ દ્વિજસંસ્કૃતિમ् ॥૨૬  
તેભ્યોઽવાદાદ્યક્ષિણા ગાવો રૂક્મમાલાઃ સ્વલઙ્ગુત્તોભ્યઃ સંપૂર્ણ સવત્સાઃ ક્ષૌમમાલિનીઃ  
યાઃ કૃષ્ણરામજમજ્ઞે મનોદત્તા મહામતિઃ । તાશ્રાદવાદનુસ્મત્ય કંસેનાધર્મતો હૃતાઃ ॥૨૮  
તત્શ્ર લબ્ધસંસ્કારો દ્વિજત્વં પ્રાપ્ય સુવ્રતૌ । ગર્ગાદ્ યદુકુલાચાર્યાદ્ ગાયત્રં વ્રતમાસ્થિતૌ ૨૯  
પ્રભવૌ સર્વવિદ્યાનાં સર્વજ્ઞૈ જગવીશ્વરૌ । નાન્યસિદ્ધામલજાનાં ગ્રહમાનૌ નરેહિતૈઃ ॥૩૦  
અથો ગુરુકુલે વાસમિચ્છતાવુપજગમતુઃ । કાશ્યં સાન્દીપનિનામ હ્યવન્તીપુરવાસિનમ્ ॥૩૧  
યથોપસાદ્ય તૌ દાન્તૌ ગુરૌ વૃત્તિમનિન્દિતામ્ । ગ્રાહયન્તાવુપેતૌ સ્મ ભક્ત્યા દેવમિવાદૃતૌ ૩૨  
તયોર્દ્વિજવરસ્તુષ્ટઃ શુદ્ધભાવાનુવૃત્તિભિઃ । પ્રોવાચ વેદાનખિલાન્ સાઙ્ગેપનિષદો ગુરુઃ ॥૩૩

સુખની સગવડ કરી આપ્યા પછી અમો પણ તમારી પાસે આવીશું. ૨૪

શુકુદેવજી કહે છે- આવી રીતે શ્રીકૃષ્ણ ભગવાને નંદરાયને અને ગોવાળોને  
આશાસન આપી, વસ્ત્ર, અલંકાર અને કાંસા, પીતળનાં પાત્રો આદિ આપીને તેનું  
પ્રીતિપૂર્વક પૂજન કર્યું. ૨૫ આવાં ભગવાનનાં વચન સાંભળી ગોવાળો સહિત પ્રેમથી  
વિહૃણ થયેલા અને આંસુથી નેત્રને ભરી મૂક્તા નંદરાય, શ્રીકૃષ્ણ તથા બળદેવજીનું  
આલિંગન કરી પ્રજમાં ગયા. ૨૬ પછી વસુદેવે પુરોહિત અને બ્રાહ્મણોને બોલાવીને  
તેની પાસે પોતાના બત્તે પુત્રોનો શાસ્ત્રવિધિ પ્રમાણે ઉપનયન સંસ્કાર કરાયો. ૨૭  
બ્રાહ્મણોનું પૂજન કરી દક્ષિણા આપી અને સોનાની માળાવાળી શાણગારેલી અને  
વાધ્યરડાં સહિત ગાયો આપી. ૨૮ શ્રીકૃષ્ણ તથા બલરામના જન્મને દિવસે પોતે જે  
ગાયોનું દાન આપવાનો સંકલ્પ કર્યો હતો તે યાદ કરી અને કંસે અધર્મથી લઈ  
લીધેલી ગાયોને રાજ્યની ગૌશાળામાંથી છોડાવી ને વસુદેવે પુત્રોના જન્મ નક્ષત્રને  
દિવસે બ્રાહ્મણોને દાન આપ્યું. ૨૯ પછી ઉપનયન સંસ્કાર થતાં દ્વિજપણું પામેલા  
અને સર્વનિયમ પાળનાર તે બત્તે ભાઈઓ યદુકુણના આચાર્ય ગર્ગમુનિના કહેવા  
પ્રમાણે ગાયત્રી સંબંધી પ્રત પાળ્યું. ૩૦ પછી સર્વવિદ્યાઓને ઉત્પત્ત કરનાર, સર્વજ્ઞ  
અને જગતના ઈશ્વર છતાં પણ મનુષ્ય યેષાથી પોતાના સ્વતઃસિદ્ધ નિર્મણ જ્ઞાનને  
ઢાંકતા એ બત્તે ભાઈઓ ગુરુકુણમાં નિવાસ કરવાની ઈશ્વરાથી ઉજ્જૈનના  
રહેવાસી સાંદીપનિ નામના બ્રાહ્મણની પાસે ગયા. ૩૧ બીજાઓને સર્વોત્તમ  
ગુરુની સેવા કરવાનું શીખવવા સારુ પોતે પણ ગુરુની પાસે જિતેંદ્રિયપણાથી  
અને પ્રીતિથી દેવની પેઠે ગુરુની સેવા કરવા લાગ્યા. ૩૨ શુદ્ધ ભાવનાવાળી સેવાથી

सरहस्यं धनुर्वेदं धर्मान् न्यायपथांस्तथा । तथा चान्वीक्षिकीं विद्यां राजनीतिं च षड्विधाम् ॥३४  
सर्वं नरवरश्रेष्ठौ सर्वविद्याप्रवर्तकौ । सकृत्रिगदमात्रेण तौ संजगृहतुर्नृप ॥३५  
अहोरात्रैश्शतुःषष्ठ्या संयत्तौ तावतीः कलाः । गुरुदक्षिणयाऽचार्यं छन्द्यामासतुर्नृप ॥३६  
द्विजस्तयोस्तं महिमानमद्भुतं संलक्ष्य राजन्नतिमानुषीं मतिम् ।

सम्पन्न्य पत्न्या स महार्णवे मृतं बालं प्रभासे वरयाम्बभूव ह ॥३७॥  
तथेत्यथारुह्य महारथौ रथं प्रभासमासाद्य दुरन्तविक्रमौ ।

वेलामुपव्रज्य निषीदतुः क्षणं सिन्धुर्विदित्वाहर्णमाहरत्योः ॥३८॥  
तमाह भगवानाशु गुरुपुत्रः प्रदीयताम् । योऽसाविहत्वा ग्रस्तो बालको महतोर्मिणा ॥३९  
समुद्र उवाच

नैवाहार्षमहं देव दैत्यः पञ्चजनो महान् । अन्तर्जलचरः कृष्ण शङ्खरूपधरोऽसुरः ॥४०  
आस्ते तेनाहतो नूनं तच्छुत्वा सत्वरं प्रभुः । जलमाविश्य तं हत्वा नापश्यदुर्देर्भर्कम् ॥४१  
तदङ्गप्रभवं शङ्खमादाय रथमागमत् । ततः संयमनीं नाम यमस्य दयितां पुरीम् ॥४२

प्रसन्न थयेला उत्तम ध्रात्मण गुरुओ अंग अने उपनिषद् सहित सर्वे वेद  
भाषाव्या.<sup>३३</sup> मंत्र अने वेदोना ज्ञान सहित धनुर्वेद, धर्मशास्त्र, भीमांसादिक शास्त्र,  
तर्कशास्त्र अने छ प्रकारनी राजनीति पाण भाषावी.<sup>३४</sup> हे राजा ! सर्व विद्याना  
प्रवर्तक अने मनुष्योमां सर्वोत्तम ए बन्ने ज्ञाना गुरुना मात्र एक ज वार कहेवाथी  
ज सर्वे विद्या शीखी गया.<sup>३५</sup> जितेद्रियपाणाथी रहेला श्रीकृष्ण अने बण्डेवज्ञ  
योसठ दिवसमां योसठ कणा शीर्घ्या. पछी हे राजा ! गुरुने मनगमती गुरुदक्षिणा  
मागवानुं कह्युं.<sup>३६</sup> सांघीपिन गुरुओ मनुष्योमां न होय एवी भुद्धिरूप तेनो  
अद्भुत महिमा ज्ञेईने पोतानी स्त्रीनी साथे वियार करी, प्रभासना महासागरमां  
मरी गयेलो पोतानो पुत्र लावी आपवानुं तेओनी पासे माझ्युं.<sup>३७</sup> गुरुना वयननो  
स्वीकार करी अपार पराक्रमवाणा ए महारथी श्रीकृष्ण अने बण्डेव रथमां  
बेसी समुद्रने कांठे आवीने थोडीवार बिराजमान थया. तेने ईश्वर जाणी समुद्र  
पाण तेओ सारु पूजन लाव्यो.<sup>३८</sup> भगवाने समुद्रने कह्युं के अमारा गुरुनो पुत्र के  
जेने तमो अहीं मोटा तरंगथी लीधो छे ते तरत आपी हो.<sup>३९</sup> समुद्र बोल्या के हे  
देव ! ते बाणक्ने में लीधो नथी. पाण मारा जणनी अंदर फरनार अने शंखनुं रूप  
धरनार एक पंचजन नामनो मोटो देत्य छे तेषो लीधो हुशे, ए वात सांभणी  
भगवाने तरत जणमां ज्ञाने ते देत्यने मार्यो, पाण तेना पेटमां बाणक्ने ढीठो  
नहीं, एटले मात्र तेना अंगमांथी उत्पन्न थयेलो पांचजन्य नामनो शंख लह्यने

गत्वा जनार्दनः शङ्खं प्रदध्मौ सहलायुधः । शङ्खनिर्हादमाकर्ण्य प्रजासंयमनो यमः ॥४३  
तयोः सपर्यं महतीं चक्रे भक्त्युपबृंहिताम् । उवाचावनतः कृष्णं सर्वभूताशयालयम् ।

लीलामनुष्य हे विष्णो युवयोः करवाम किम् ॥४४  
श्रीभगवानुवाच

गुरुपुत्रमिहानीतं निजकर्मनिबन्धनम् । आनयस्व महाराज मच्छासनपुरस्कृतः ॥४५  
तथेति तेनोपानीतं गुरुपुत्रं यदूत्तमौ । दत्त्वा स्वगुरवे भूयो वृणीष्वेति तमूचतुः ॥४६  
गुरुरुवाच

सम्यक् संपादितो वत्स भवद्भ्यां गुरुनिष्क्रियः । को नु युष्मद्विधगुरोः कामानामवशिष्यते<sup>४७</sup>  
गच्छतं स्वगृहं वीरौ कीर्तिर्वामस्तु पावनी । छन्दांस्ययात्यामानि भवन्त्विह परत्र च ॥४८  
गुरुणैवमनुज्ञातौ रथेनानिलरंहसा । आयातौ स्वपुरं तात पर्जन्यनिनदेन वै ॥४९  
समनंदनं प्रजाः सर्वा दृष्ट्वा रामजनार्दनौ । अपश्यंत्यो बह्वहानि नष्टलब्ध्यना इव ॥५०

इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्थं

गुरुपुत्रानयनं नाम पञ्चत्वारिंशोऽद्यायः ॥४६॥

भगवान पाइ। रथमां आव्या. पछी यमराजानी संयमनी नामनी पुरीमां ज्ञाने  
बण्डेव सहित भगवाने शंखनाद कर्यो. प्रजाओने हंड आपनारा यम राजा ए ते  
शंखनाद सांभणी ए बन्नेनी भक्तिथी मोटी पूजा करी. पछी प्रशाम करी श्रीकृष्णने  
कह्युं के हे लीलाथी मनुष्य थयेला विष्णु ! हुं तमारुं शुं काम करुं ? त्यारे भगवाने  
कह्युं हे महाराज ! अमारा गुरुनो पुत्र के जेने तमे तेना कर्मबंधनने लीघे अहीं  
लाव्या छो, तेने मारी आज्ञाथी लावी आपो.<sup>४०-४५</sup> आ आज्ञा माथे यडावीने  
यमराजाए लावी आपेलो गुरुपुत्र पोताना गुरुने आपीने, फरीवार मागवानुं  
कह्युं.<sup>४६</sup> ते समये गुरु बोल्या- हे पुत्र ! तमोऽे गुरुदक्षिणा धणी ज सारी आपी,  
तम जेवाना गुरुनी कई ईरच्छा अपूर्ण रहे ?<sup>४०</sup> हे वीरपुरुषो ! तमे धेर जाओ  
तमारी पवित्र कीर्ति थजो. आलोक अने परलोकमां तमारा वेद सङ्ख थजो.<sup>४८</sup>  
आ प्रमाणे गुरुओ आज्ञा आपतां बन्ने भाईओ पवन सरभा वेगवाणा अने  
मेघ सरभा नादवाणा रथमां बेसीने पाइ। मथुरामां आव्या. सर्वे प्रजाजनो धणा  
दिवसथी श्रीकृष्ण तथा रामने नहीं ज्ञेवाथी, ए दिवसे ते बन्ने भाईओने ज्ञेईने  
गयेलुं धन पाइ उगतां जेम राज्ञ थाय तेम राज्ञ थया.<sup>४७-४८</sup>

इति श्रीमद्भागवतपुराणे भागवतना दशम स्कन्धनो पित्तालीशमो अद्याय  
संपूर्णः.

## अथ षट्चत्वारिंशोऽध्यायः (४६)

॥ श्रीशुक उवाच ॥

वृष्णीनां प्रवरो मंत्री कृष्णस्य दयितः सखा । शिष्यो बृहस्पते: साक्षादुद्ध्रवो बुद्धिसत्तमः ॥१  
तमाह भगवान् प्रेष्ट भक्तमेकान्तिनं क्रचित् । गृहीत्वा पाणिना पाणिं प्रपन्नार्तिहरो हरिः ॥२  
गच्छोद्ध्रव व्रजं सौम्य पित्रोनौ प्रीतिमावह । गोपीनां मद्वियोगार्थं मत्सन्देशैर्विमोचय ॥३  
ता मन्मनस्का मत्प्राणा पदर्थं त्यक्तदैहिकाः । मामेव दयितं प्रेष्टमात्मानं मनसा गताः ।

ये त्यक्तलोकधर्माश्च मदर्थं तान् बिभर्म्यहम् ॥४

मयि ताः प्रेयसां प्रेष्टे दूरस्थे गोकुलस्त्रियः । स्मरन्त्योऽङ्गं विमुह्यन्ति विरहौत्कण्ठयविह्वला ॥५  
धारयन्त्यतिकृच्छ्रेण प्रायः प्राणान् कथञ्चन । प्रत्यागमनसन्देशैर्बलव्यो मे मदात्मिकाः ॥६

श्रीशुक उवाच

इत्युक्त उद्ध्रवो राजन् संदेशं भर्तुरादृतः । आदाय रथमारुह्य प्रययौ नन्दगोकुलम् ॥७

## अध्याय ४६

**श्रीकृष्ण भगवाने उद्ध्रवशु द्वारा संदेशो भोक्तावीने  
नन्दयशोदानो शोक दूर कर्यो.**

शुकदेवज्ञ कहे छे- हे राजा ! आ प्रमाणे भगवाने आशा करतां तेमनो संदेशो लई रथमां बेसी उद्ध्रवशु गोकुण गया.<sup>१</sup> सूर्य आथभ्यो ते समये प्रजमां जती गायोनी खरीनी रजथी जेनो रथ ढंकाई गयो हतो, ऐवा उद्ध्रवशु प्रजमां पहोंच्या.<sup>२</sup> ए समये प्रजमां गायोने माटे लडता मदोन्मत्त आभला नाट करी रह्या हता. आउना भारवाणी गायो पोतानां वाइरडांओनी पासे दोडी जती हती.<sup>३</sup> धोणां वाइरडां ज्यां ने त्यां कूदतां शोभतां हतां, गायोने दोहवाने माटे छोडी लाव, पकड, ऐवा चारेकोर शब्दो थता संभणाता हता. अने वेणु वागी रह्या हता.<sup>४</sup> बलराम तथा श्रीकृष्णना शुभ कर्मानुं गायन करती अने शशगारेली गोपीओ तथा गोवाणो शोभी रह्या हता.<sup>५</sup> अग्नि, सूर्य, अतिथि, गायो, ब्रात्याणो, पितृ अने देवताओनां पूज्जन जेमां थतां हतां, ऐवा गोवाणोना धरोथी अने धूप, दीप तथा पुण्योथी मननुं हरण थतुं हतुं.<sup>६</sup> चारे बाजु वन प्रकुल्लित थई रह्यां हतां. पक्षीओ अने भ्रमरो नाट करी रह्या हता. हंस अने बतक पक्षीओथी व्याम थयेलां कुमणां वन शोभी रह्यां हतां.<sup>७</sup> नन्दराये प्रजमां आवेला ऐ भगवानना प्रिय अनुयर जे उद्ध्रवशु तेने भणी आदिंगन करी ईश्वर बुद्धिथी तेमनुं पूज्जन कर्यु.<sup>८</sup> दूधपाक जमाझ्यो, सारी शय्या उपर सुधेथी सुवाड्या अने पग चांपवा आदिथी तेमनो परिश्रम दूर कर्या पद्धी नन्दराये पूछयुं के- हे भाग्यशाणी उद्ध्रव ! कष्मांथी धूटेला पुत्रादिक्नो समागम पामेला अने संबंधीओथी वीटाएला अमारा सभा वसुदेव कुशण छे ने?<sup>९-१०</sup> जे पापी कंस साधु अने धर्मात्मा पादवोनो सर्वदा द्वेष करतो हतो, ते पोताना अनुयरो साथे पोताना पापथी मार्यो

प्रासो नन्दवर्जं श्रीमान् निम्लोचति विभावसौ । छन्नयानः प्रविशतां पश्नूनां खुररेणुभिः ॥८  
वासितार्थेऽभियुध्यद्विनार्दितं शुष्मिभिर्वैषः । धावन्तीभिश्च वास्ताभिरुद्धोभारैः स्ववत्सकान्  
इतस्तो विलङ्घद्विर्गोवत्सर्पमण्डितं सितैः । गोदोहशब्दाभिरवं वेणूनां निःस्वनेन च ॥९॥  
गायन्तीभिश्च कर्मणि शुभानि बलकृष्णायोः । स्वलङ्कृताभिर्गोपीभिर्गोपैश्च सुविराजितम् ॥१  
अग्न्यर्कातिथिगोविप्रिपतिदृवेवार्चनान्वितैः । धूपदीपैश्च मालैश्च गोपावासैर्मनोरमम् ॥१२  
सर्वतः पुष्पितवनं द्विजालिकुलनादितम् । हंसकारण्डवाकीर्णः पद्मषण्डैश्च मणिडतम् ॥१३  
तमागतं समागम्य कृष्णस्यानुचरं प्रियम् । नन्दः प्रीतः परिष्वज्य वासुदेवधियाऽऽर्चयत् ॥१४  
भोजितं परमानेन संविष्टं कशिष्ठौ सुखम् । गतश्रमं पर्यपृच्छत् पादसंवाहनादिभिः ॥१५  
कच्चिदङ्गं महाभाग सखा नः शूरनन्दनः । आस्ते कुशल्यपत्याद्यर्थुको मुक्तः सुहृदवृतः ॥१६  
दिष्ट्या कंसो हतः पापः सानुगः स्वेन पाप्मना । साधूनां धर्मशीलानां यदूनां द्वेषियः सदा ॥१७

शुकदेवज्ञ कहे छे- हे राजा ! आ प्रमाणे भगवाने आशा करतां तेमनो संदेशो लई रथमां बेसी उद्ध्रवशु गोकुण गया.<sup>१</sup> सूर्य आथभ्यो ते समये प्रजमां जती गायोनी खरीनी रजथी जेनो रथ ढंकाई गयो हतो, ऐवा उद्ध्रवशु प्रजमां पहोंच्या.<sup>२</sup> ए समये प्रजमां गायोने माटे लडता मदोन्मत्त आभला नाट करी रह्या हता. आउना भारवाणी गायो पोतानां वाइरडांओनी पासे दोडी जती हती.<sup>३</sup> धोणां वाइरडां ज्यां ने त्यां कूदतां शोभतां हतां, गायोने दोहवाने माटे छोडी लाव, पकड, ऐवा चारेकोर शब्दो थता संभणाता हता. अने वेणु वागी रह्या हता.<sup>४</sup> बलराम तथा श्रीकृष्णना शुभ कर्मानुं गायन करती अने शशगारेली गोपीओ तथा गोवाणो शोभी रह्या हता.<sup>५</sup> अग्नि, सूर्य, अतिथि, गायो, ब्रात्याणो, पितृ अने देवताओनां पूज्जन जेमां थतां हतां, ऐवा गोवाणोना धरोथी अने धूप, दीप तथा पुण्योथी मननुं हरण थतुं हतुं.<sup>६</sup> चारे बाजु वन प्रकुल्लित थई रह्यां हतां. पक्षीओ अने भ्रमरो नाट करी रह्या हता. हंस अने बतक पक्षीओथी व्याम थयेलां कुमणां वन शोभी रह्यां हतां.<sup>७</sup> नन्दराये प्रजमां आवेला ऐ भगवानना प्रिय अनुयर जे उद्ध्रवशु तेने भणी आदिंगन करी ईश्वर बुद्धिथी तेमनुं पूज्जन कर्यु.<sup>८</sup> दूधपाक जमाझ्यो, सारी शय्या उपर सुधेथी सुवाड्या अने पग चांपवा आदिथी तेमनो परिश्रम दूर कर्या पद्धी नन्दराये पूछयुं के- हे भाग्यशाणी उद्ध्रव ! कष्मांथी धूटेला पुत्रादिक्नो समागम पामेला अने संबंधीओथी वीटाएला अमारा सभा वसुदेव कुशण छे ने?<sup>९-१०</sup> जे पापी कंस साधु अने धर्मात्मा पादवोनो सर्वदा द्वेष करतो हतो, ते पोताना अनुयरो साथे पोताना पापथी मार्यो

अपि स्मरति नः कृष्णो मातरं सुहृदः सखीन् । गोपान् व्रजं चात्मनाथं गावो वृन्दावनं गिरिम् ॥८  
अप्यायास्यति गोविन्दः स्वजनान् सकृदीक्षितुम् । तर्हि द्रक्ष्याम तद्वक्त्रं सुनसं सुस्पितेक्षणम् ॥९  
दावानेर्वातवर्षाच्च वृषसर्पाच्च रक्षिताः । दुरत्येभ्यो मृत्युभ्यः कृष्णोन सुमहात्मना ॥१०  
स्मरतां कृष्णावीर्याणि लीलापाङ्गनिरक्षितम् । हसितं भाषितं चाङ्गसर्वानः शिथिलाः क्रियाः  
सरिच्छैलवनोद्देशान् मुकुन्दपदभूषितान् । आक्रीडानीक्षमाणानां मनो याति तदात्मताम् ॥११  
मन्ये कृष्णं च रामं च प्राप्नाविह सुरोत्तमौ । सुराणां महदर्थाय गर्गस्य वचनं यथा ॥१२  
कंसं नागयुतप्राणं मळौ गजपतिं तथा । अवधिष्ठानं लीलयैव पशूनिव मृगाधिपः ॥१३  
तालत्रयं महासारं धनुर्घट्टिमवेभराट् । बभजैकेन हस्तेन सप्ताहमद्याद् गिरिम् ॥१४  
प्रलम्बो धेनुकोऽरिष्टस्तृणावर्तो बकादयः । दैत्याः सुरासुरजितो हता येनेह लीलया ॥१५

## श्रीशुक उवाच

इति संस्मृत्य संस्मृत्य नन्दः कृष्णानुरक्तधीः । अत्युत्कण्ठोऽभवत्तूष्णी प्रेमप्रसरविह्वलः ॥१६

गयो ए भङ्गुज सारु थयुं.<sup>१७</sup> श्रीकृष्ण अमने, ऐमनी माने, संबंधीओने, भित्रोने,  
गोवाणोने, गायोने, वृद्धावनने, गोवर्धन पर्वतने अने पोते ज जेना नाथ छे एवा  
प्रज्ञने संभारे छे ?<sup>१८</sup> स्वजनोने जोवा सारु श्रीकृष्ण एकवार अहीं आवशे ? ज्यारे  
आवशे त्यारे नासिका, मंदहास्य अने नेत्र जेमनां सुंदर छे, एवा श्रीकृष्णने  
जोईशुं.<sup>१९</sup> दावानण, पवन सहित वरसाद, अरिष्टासुर, अधासुर अने एवा  
ज बीजा भयंकर त्रासोथी महात्मा श्रीकृष्णे अमारी रक्षा करी छे.<sup>२०</sup> कृष्णना  
पराकम, लीलापूर्वक नेत्रथी जोवुं, हास्य अने भाषणने संभारतां अमारी सर्वे  
क्रियाओ शिथिल थई जाय छे.<sup>२१</sup> श्रीकृष्णनां पगलांथी शोभी रहेली नदी, पर्वत,  
वनना प्रदेश अने बीजं पश तेमना रमवानां स्थानको जोतां अमारुं मन  
श्रीकृष्णरूप थई जाय छे.<sup>२२</sup> गर्गीचार्यना वचन प्रमाणे श्रीकृष्ण अने बण्टेवज्ञ  
देवताओनुं भोटुं काम करवाने माटे पृथ्वीमां कोई भोटा देव आव्या छे, तेम हुं  
मानुं छुं.<sup>२३</sup> सिंह जेम पशुने भारे तेम दशहजार हाथीना बणवाणा कंसने, मल्खने  
अने कुवलयापीड हाथीने लीला मात्रमां मारी नाख्या. तथा हाथी जेम लाकडीने  
भांगी नाखे तेम त्राण ताड जेटलुं लांबु अने अत्यंत दृढ धनुष तेने भांगी नाख्युं,  
सात दिवस सुधी एक हाथे पर्वतने धरी राख्यो अने प्रलंबासुर, धेनुकासुर,  
तृष्णावर्त, बकासुर अने एवा ज बीजा पश जगतने ज्ञाती लेनारा दैत्योने लीलाथी  
मारी नाख्या, ए जोवाथी पश श्रीकृष्ण तथा बलराम कोई भोटा देव छे, ऐम  
मानी शकाय छे.<sup>२४-२६</sup>

यशोदा वर्ण्यमानानि पुत्रस्य चरितानि च । शृणवन्त्यशूण्यवासाक्षीत् स्नेहस्तुपयोधरा ॥२८  
तयोरित्थं भगवति कृष्णे नन्दयशोदयोः । वीक्ष्यानुरागं परमं नन्दमाहोद्धवो मुदा ॥२९  
उद्धव उवाच

युवां श्लाघ्यतमौ नूनं देहिनामिह मानद । नारायणेऽखिलगुरौ यत् कृता मतिरीदृशी ॥३०

एतौ हि विश्वस्य च बीजयोनी रामो मुकुन्दः पुरुषः प्रधानम् ।

अन्वीय भूतेषु विलक्षणस्य ज्ञानस्य चेशात इमौ पुराणौ ॥३१॥

यस्मिज्जनः प्राणवियोगकाले क्षणं समावेश्य मनो विशुद्धम् ।

निर्हत्य कर्मशयमाशु याति परां गतिं ब्रह्ममयोऽर्कवर्णः ॥३२॥

तस्मिन् भवन्तावरिखिलात्महेतौ नारायणे कारणमत्यमूर्तौ ।

भावं विधत्तां नितरां महात्मन् किं वावशिष्टं युवयोः सुकृत्यम् ॥३३॥

आगमिष्ठ्यत्वीर्धेण कालेन ब्रजमच्युतः । प्रियं विधास्यते पित्रोभगवान् सात्वतां पतिः ३४  
हत्वा कंसं रङ्गमध्ये प्रतीपं सर्वसात्वताम् । यदाहवः समागत्य कृष्णः सत्यं करोति तत् ॥३५

शुक्लेवज्ञ कुहे छे- जेनी बुद्धि भगवानमां लागी रही हती एवा भङ्गुज  
उत्कंठा वाणा अने प्रेमथी विल्लृण थयेला नंदराय आ प्रमाणे संभारी संभारी  
पटी युप रह्या.<sup>२७</sup> नंदराये वर्षान करवा भांडेला पोताना पुत्रनां चरित्र सांझणीने  
स्नेहने लीधे जेना स्तनमांथी दूध झरवा लाग्युं, एवां यशोदाज्ञ आंसु पाडवा  
लाग्यां.<sup>२८</sup> आवी रीते श्रीकृष्ण भगवानमां ए नंद यशोदानो परम प्रेम जोई  
उद्धवज्ञ ए प्रीतिथी नंदरायने आ प्रमाणे कह्युं.<sup>२९</sup>

उद्धवज्ञ कुहे छे- हे मान आपनारा ! सर्वना गुरु नारायणमां तमो ए  
आवी रीतनी बुद्धि राखी छे, तेथी तमो भन्ने ज्ञानां आ लोकना सर्वे प्राणीओमां  
भङ्गुज वभाषावा योग्य छो.<sup>३०</sup> श्रीकृष्ण अने बलराम आ भन्ने विश्वना कारणाभूत  
पृथ्वी आदि तत्त्वोना पश कारणरूप छे, प्रकृतिपुरुषना पश कारणरूप छे, पुराण  
पुरुष छे, अने विलक्षण एवां सर्वे भूतोने विषे प्रवेश करीने तेमनुं नियमन करे  
छे.<sup>३१</sup> हे महात्मा ! माणस प्राण जवाना समयमां क्षण मात्र पश पोतानुं शुद्ध  
मन ए श्रीकृष्णमां राखे, तो तरत कर्मनी वासनानो त्याग करी, ज्ञानी अने शुद्ध  
सत्त्वमय थईने परम गतिने पामे छे, ते सर्वना आत्मा कारणरूप अने प्रयोजनथी  
जेणे मनुष्य देह धर्यु छे एवा भगवानमां तमो भन्ने सर्वदा भाव राखो छो, तो  
पटी हवे तमारे बीजुं क्युं कृत्य अवशेष रह्यु छे ?<sup>३२-३३</sup> यादवोना पति श्रीकृष्ण  
भगवान थोडा काणमां वृजमां पधारशे, अने तेनां मातापिता एवां जे तमो ते

મા ખિદ્યતં મહાભાગૌ દ્રક્ષ્યથ: કૃષ્ણમન્તિકે । અન્નર્હદિ સ ભૂતાનામાસ્તે જ્યોતિરિવૈધસિ ૩૬  
ન હૃસ્યાસ્તિ પ્રિય: કશ્ચિત્ત્રાપ્રિયો વાસ્ત્વમાનિન: । નોત્તમો નાથમો નાપિ સમાનસ્યાસમોડપિ વા  
ન માતા ન પિતા તસ્ય ન ભાર્યા ન સુતાદય: । નાત્તીયો ન પરશ્રાપિ ન દેહો જન્મ એવ ચ ॥૩૮  
ન ચાસ્ય કર્મ વા લોકે સદસમ્નિશ્રયોનિષુ । ક્રીડાર્થ: સોડપિ સાધૂનાં પરિત્રાણાય કલ્પતે ૩૯  
સત્ત્વં રજસ્તમ ઇતિ ભજતે નિર્ગુણો ગુણાન् । ક્રીડન્તીતોડત્ર ગુણૈ: સૃજત્યવતિ હન્ત્યાજ: ૪૦  
યથા ભ્રમરિકાદૃષ્ટ્યા ભ્રામ્યતીવ મહીયતે । ચિત્તે કર્તરિ તત્ત્રાત્મા કર્તેવાહંધિયા સ્મૃતઃ ॥૪૧  
યુવયોરેવ નૈવાયમાત્મજો ભગવાન્ હરિ: । સર્વેષામાત્મજો હ્રાત્મા પિતા માતા સ ઈશ્વર: ॥૪૨

દૃષ્ટં શ્રુતં ભૂતભવદ્ ભવિષ્યત્ સ્થાનુશ્રિષ્ટાર્થુર્મહદલ્પકં ચ ।  
વિનાચ્યુતાદ્ વસ્તુતરાં ન વાચ્યં સ એવ સર્વ પરમાર્થભૂત: ॥૪૩॥

તમારું પ્રિય કરશે.<sup>૩૪</sup> સર્વ યાદવોથી વિરુદ્ધ ચાલનારા કંસને અખાડાની વચમાં  
માર્યા પછી શ્રીકૃષ્ણો તમોને મળીને જે કહ્યું છે તે સાચું કરશે.<sup>૩૫</sup> હે મોટાં ભાગ્યવાળાં !  
ખેદ કરો મા. ભગવાનને તમે પાસે જ દેખશો, કેમકે, કાષ્ઠોમાં અજિની પેઢે તે  
સર્વ પ્રાણીઓની અંદર રહે છે.<sup>૩૬</sup> પોતાના ઘારા માબાપાદિને મૂકીને અહીં કેમ  
આવશો, એવી શંકા રાખશો નહીં; કેમકે નિરભિમાન અને સર્વના સમાન એ  
ભગવાનને કોઈ પ્રિય કે અપ્રિય નથી. કોઈ ઉત્તમ નથી અને કોઈ અધ્યમ પણ  
નથી.<sup>૩૭</sup> એ કૃષ્ણને માતા, પિતા, ભાર્યા, પુત્રાદિક, પોતાનો કે પારકો, દેહ કે  
જન્મ એ કંઈ પણ નથી.<sup>૩૮</sup> એમને જન્મ પણ નથી તો પણ લોકમાં કીડા કરવાને  
માટે અને સાધુ લોકોના રક્ષણને માટે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ યોનિઓમાં  
પ્રકટ થાય છે.<sup>૩૯</sup> એ અજન્મા ભગવાન પોતે નિર્ગુણ હોવા છિતાં પણ સત્ત્વ, ૨૪  
અને તમ એ માયાના ગુણોને ભજે છે અને તે ગુણોની સાથે કીડા કરી રહ્યા છે,  
છિતાં સૂચિ, સ્થિતિ તથા પ્રલય કરે છે.<sup>૪૦</sup> જેમ હુંદ્રી ફરનાર માણસની ફર્યા  
કરતી દસ્તિથી જાણે પૃથ્વી જ ફરતી હોય તેમ જણાય છે અને જેમ જીવ ઈન્દ્રિયો  
અંત: કરણ દ્વારા કર્તા હોવા છિતાં પણ દેહને વિષે અહંબુદ્ધિને લીધે દેહ જ કર્તા  
મનાએલો છે. તેમ સૂષ્ટ્યાદિકના કર્તા ઈશ્વર છે છિતાં માયા કર્તા હોય તેમ જણાય  
છે.<sup>૪૧</sup> એ શ્રીકૃષ્ણ ભગવાન કેવળ તમારા જ પુત્ર નથી પણ સર્વના પુત્ર છે; અને  
પુત્ર છે એટલું જ નહિં પણ સર્વના આત્મા, પિતા, માતા અને ઈશ્વર પણ એજ  
છે.<sup>૪૨</sup> જોએલી, સાંભળોલી, ભૂત, ભવિષ્ય, વર્તમાન, સ્થાવર, જંગમ, નાની કે  
મોટી કંઈ પણ વસ્તુ ભગવાન વિના પૃથ્વી સત્તાવાળી કહી શકતી જ નથી,  
સર્વરૂપ એ ભગવાન જ એક સત્ત્ય છે.<sup>૪૩</sup>

એવં નિશા સા બ્રુતોવ્ર્યતીતા નન્દસ્ય કૃષ્ણાનુચરસ્ય રાજન् ।  
ગોપ્ય: સમુત્થાય નિસ્સ્પય દીપાન્ વાસ્તૂન્ સમભ્યર્ચ્ય દધીન્યમન્થન્ ॥૪૪॥  
તા દીપદીસૈર્મિભિર્વેજૂ રજ્જૂર્વિકર્ષદ્ધુજકઙ્ગણસ્ત્રજઃ ।  
ચલન્તિતમ્બસ્તનહારકુણ્ડલત્વિષકપોલારુણકુઙ્ગમાનના: ॥૪૫॥  
ઉદ્ઘારીનામરવિન્દલોચનં વ્રજાઙ્નનાનાં દિવમસૃશદ્ ધ્વનિઃ ।  
દધનશ્ નિર્મન્થનશબ્દમિશ્રિતો નિરસ્યતે યેન દિશામઙ્ગલમ् ॥૪૬॥  
ભગવત્યુદિતે સૂર્યે નન્દદ્રારિ વ્રજીકસ: । દૃષ્ટા રથં શાતકૌમ્ભં કસ્યાયમિતિ ચાબુવન् ॥૪૭  
અન્નૂર આગત: કિ વા ય: કંસસ્યાર્થસાધક: । યેન નીતો મધુપુરી કૃષ્ણ: કમલલોચન: ૪૮  
કિં સાધયિષ્યત્યસમાભિર્ભર્તુ: પ્રેતસ્ય નિષ્કૃતિમ् । ઇતિ સ્ત્રીણા વદન્તીનામુદ્ધવોઝગાત્કૃતાહિક: ૪૯  
ઇતિ શ્રીમદ્બાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વાર્થ  
નન્દશોકાપનયનં નામ ષટ્ચત્વારિંશોડધ્યાય: ॥૪૬॥

શુકુદેવજી કહે છે- હે રાજા ! નંદરાય અને ભગવાનના અનુચર ઉદ્ધવજી  
આ પ્રમાણે વાતો કરતાં કરતાં તે રાત્રી વીતી ગઈ. ગોપીઓ ઊઠી દીવા કરી ધરને  
સ્વચ્છ કર્યા પછી ધાશ કરવા લાગી.<sup>૪૪</sup> એ ગોપીઓ કંકણવાળા હસ્તથી ધાશ  
કરવાનાં નેતરાંને બેંચતી હતી. નિતંબ, સ્તન અને હાર હાલતા હતા. કપોલ  
કુંડથી શોભી રહ્યા હતા. મોઢાં ઉપર રાતાં કેસર લગાવ્યાં હતાં અને આભૂષણના  
મણિઓ દીવાથી દીપી રહેતાં બહુ જ શોભતી હતી, આવા ભગવાનનું ગાયન  
કરતી વ્રજાંગનાઓનો શબ્દ કે જે દણીના મથનના શબ્દથી મિશ્રિત થયો હતો  
અને જેથી દિશાઓનું અમંગળ ટળી જતું હતું, એવો શબ્દ છેક આકાશ સુધી  
પહોંચતો હતો.<sup>૪૫-૪૬</sup> સૂર્યનારાયણ ઊગતાં પ્રજના દ્વારમાં સોનાનો રથ જોઈને  
ગોપીઓ પરસ્પરમાં વાતો કરવા લાગી કે- આ રથ કોનો છે ?<sup>૪૭</sup> કંસનો અર્થ  
સાધનાર અફૂર કે જે કુમળ સરખા નેત્રવાળા શ્રીકૃષ્ણને મથુરામાં લઈ ગયો છે,  
તે ફરીવાર આવ્યો છે કે શું ?<sup>૪૮</sup> એનો ધણી કંસ કે જે મરી ગયો છે, તેને આપણા  
માંસના પીડ દેવા આવ્યો છે કે શું ? આ પ્રમાણે સ્ત્રીઓ વાતો કરતી હતી ત્યાં  
યમુનાજીમાં પોતાના સ્નાનાદિક નિયમ પૂરા કરીને ઉદ્ધવજી આવ્યા.<sup>૪૯</sup>  
ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો છેતાલીશમો અદ્યાય  
સંપૂર્ણ.

## अथ समचत्वारिंशोऽध्यायः (४७)

॥ श्रीशुकउवाच ॥

तं वीक्ष्य कृष्णानुचरं व्रजस्त्रियः प्रलम्बबाहुं नवकञ्जलोचनम् ।  
 पीताम्बरं पुष्करमालिनं लसम्मुखारविन्दं मणिमृष्टकुण्डलम् ॥१॥  
 शुचिस्मिता: कोऽयमपीच्यदर्शनः कुतश्च कस्याच्युतवेषभूषणः ।  
 इति स्म सर्वाः परिवकुरुत्सुकास्तमुत्तमश्लोकपदाम्बुजाश्रयम् ॥२॥  
 तं प्रश्रयेणावनताः सुसत्कृतं सक्रीडहासेक्षणसूनृतादिभिः ।  
 रहस्यपृच्छन्नुपविष्टमासने विज्ञाय सन्देशहरं रमापतेः ॥३॥

जानीमस्त्वां यदुपतेः पार्षदं समुपागतम् । भर्त्रेह प्रेषितः पित्रोर्भवान् प्रियचिकीर्षया ॥४॥  
 अन्यथा गोव्रजे तस्य स्मरणीयं न चक्ष्महे । स्नेहानुबन्धो बन्धनां मुनेरपि सुदुस्त्यजः ॥५॥  
 अन्येष्वर्थकृता मैत्री यावदर्थविडम्बनम् । पुम्भः स्त्रीषु कृता यद्वत् सुमनस्विव घट्पदैः ६  
 निस्स्वं त्यजन्ति गणिका अकल्यं नृपतिं प्रजाः । अधीतविद्या आचार्यमृत्विजो दत्तदक्षिणम्

## अध्याय ४७

ઉद्धवशु गोपीओने संदेशो आपीने पाणा भथुरामां पद्धार्या.

शुकृदेवज्ञ कહे છે- એ ભગવानना અનુચર ઉદ્ધવજી કે જેના હાથ લાંબા હતા, નેત્ર કમળ સરખાં હતાં, પીળાં વખ ધારણ કર્યા હતાં, કમળની માળા પહેરવાથી મુખારવિંદ શોભતું હતું અને કુંડળ સ્વચ્છ હતાં.<sup>१</sup> તેમને જોઈ આ રૂપાળો અને ભગવાનના સરખા વેષ તથા આભૂષણવાળો કોણ છે ? ક્યાંથી આવ્યો છે ? અને કોનો છે ? એમ બોલતી અને સુંદર હાસ્ય કરતી સર્વ ગોપીઓ ભગવાનના ભક્ત એ ઉદ્ધવજીને ઉત્કંઠાથી ધેરીવળી.<sup>२</sup> વિશ્વાસથી નમન કરતી ગોપીઓ ઉદ્ધવજીને ભગવાનનો સંદેશો લાવેલા જાણી લાજ સહિત જોવા વડે તથા પ્રિય વચ્ચનોથી સત્કાર કરી એકાંતમાં આસન પર બેસાડી, આ પ્રમાણો કહેવા લાગી.<sup>३</sup>

ગોપીઓ કહે છે- તમે ભગવાનના પાર્ષદ અહીં આવેલા છો તે અમે જાણીએ છીએ. ભગવાને માબાપને રાજુ કરવા સારુ તમને અહીં મોકલ્યા છે; કેમકે બંધુઓનો રનેહ સંબંધ મુનિને પણ છોડવો બહુ કઠણ છે. એ શ્રીકૃષ્ણ આ વજમાં માબાપ વિના બીજા કોઈનું સ્મરણ કરે તે અમો ધારતી નથી.<sup>४-५</sup> સ્વાર્થને માટે બીજાઓની સાથે કેટલી મैત્રી ? એતો સ્વાર્થ સરે ત્યાં સુધીની નામમાત્રની અને પુરુષો જેમ સ્ત્રીઓની સાથે મૈત્રી કરે છે અને ભમરો જેવી પુષ્પની સાથે કરે છે

## श्रीમद्भागवतपुराणम्

खગा વીતफलં વृક्षं ભુક्त्वा ચાતિથયો ગૃહમ् । દગ्धं મृગસ્તથારણ્ય જારો ભુક्त्वા રતાં સ્ત્રીયમ्  
 ઇતિ ગોપ્યો હિ ગોવિન્દે ગતવાક્ષાયમાનસા: । કૃષ્ણદૂતે બ્રજં યાતે ઉદ્ધવે ત્યક્તલૌકિકા: ॥૧  
 ગાયન્યઃ પ્રિયકર્માણિ રૂદ્યત્વશ્ચ ગતહ્રિયઃ । તસ્ય સંસ્મૃત્ય સંસ્મૃત્ય યાનિ કૈશોરબાલ્યયો: ૧૦  
 કાચિન્મધુકરં દૃષ્ટા ધ્યાયન્તી કૃષ્ણસઙ્ગમમ् । પ્રિયપ્રસ્થાપિતં દૂતં કલ્પયિત્વે દમબ્રવીત् ॥૧૧  
 ગોપ્યુવુચા

મધુપ કિતવબન્ધો મા સ્પૃશાઙ્ગિં સપત્ન્યાઃ । કુચવિલુલિતમાલાકુઙ્કમશમશ્રુભિર્નિઃ ।  
 વહતુ મધુપતિસ્તનમાનિનીનાં પ્રસાદં યદુસદસિ વિડમ્બં યસ્ય દૂતસ્તવીદૃક् ॥૧૨॥  
 સકૃદધરમુધાં સ્વાં મોહિની પાયયિત્વા સુમનસ ઇવ સદ્યસત્તયજેઽસ્માન् ભવાદૃક् ।  
 પરિચરતિ કથં તત્પદપદં તુ પદ્મા હ્રાપિ બત હત્યેતા ઉત્તમશલોકજલ્યૈ: ॥૧૩॥  
 કિમિહ બહુ ઘડઙ્ગ્રે ગાયસિ ત્વં યદૂનામધિપતિમગૃહાણામગ્રતો નઃ પુરાણમ् ।  
 વિજયસખસખીનાં ગીયતાં તત્પસઙ્ગ: ક્ષપિતકુચરુજસ્તે કલ્પયત્તીષ્મિષ્ટા: ॥૧૪॥

એવી હોય છે. <sup>૬</sup> જેમ વેશ્યાઓ નિર્ધન પતિને છોડી દે, પ્રજા અશક્ત રાજાને છોડી દે, ભણી રહેલા શિષ્યો આચાર્યને છોડી દે, ઋત્વિજો દક્ષિણા લીધા પદ્ધી યજમાનને છોડી દે, પક્ષીઓ ફળ જતાં રહ્યા પદ્ધી વૃક્ષને છોડી દે, અતિથિઓ જમીને ઘરને છોડી દે અને મૃગો બણી ગયેલા વનને છોડી દે, તેમ અમોને શ્રીકૃષ્ણો છોડી મૂક્યાં છે. <sup>૭</sup>

શુકृદેવજી કહે છે- આ પ્રમાણો શ્રીકૃષ્ણના દૂત ઉદ્ધવજી વ્રજમાં આવતાં, જે કર્મો ભગવાને બાળ અને કિશોર અવસ્થામાં કર્યા હતાં, એ કર્મોને સંભારી લાજ મૂકીને રોતી અને જેનાં મન, વચ્ચન તથા કાયા ભગવાનમાં જ લાગી રહ્યાં હતાં, એવી ગોપીઓ લોક વ્યવહાર છોડીને પૂછી હતી. <sup>૮-૯</sup> ભગવાનના સમાગમનું ધ્યાન કરતી કોઈ ગોપી ભમરાને જોઈ તેને ભગવાને મોકલેલો દૂત કલ્પીને ઉદ્ધવજના ઉદ્દેશથી આ પ્રમાણો બોલી. <sup>૧૦</sup>

ગોપી ભમરાને કહે છે- હે ભમર ! હે ધુતારાના મિત્ર ! શોકયના સ્તનથી ચોળાએલી કૃષ્ણાની વનમાળાના કેસરથી ખરડાએલી મૂછોવડે મારા પગનો સ્પર્શ કર નહિ. જેનો તું દૂત છે તે ભગવાન મારી શોક્યોને જ ભલે મનાવે કે જે વાતની યાદવોની સભામાં હાંસી થતી હશે. <sup>૧૧</sup> તારા જેવા સ્વાર્થી ભગવાને અમોને પોતાનું મોહક અધરામૃત એકવાર પાઈને પદ્ધી ઝૂલની પેઠે તરત છોડી દીધી છે. અરે ! લક્ષ્મીજી, એવા સ્વાર્થી ભગવાનના ચરણારવિંદને કેમ સેવે છે ? હું ધારું છું કે ભગવાનની ખોટી વાતોથી લક્ષ્મીજીનું ચિત હરાઈ ગયું હશે તેથી તે સેવે છે, પણ

दिवि भुवि च रसायां का: स्त्रियस्तहुरापाः कपटरुचिरहासभूविजृभस्य याः स्युः ।  
चरणरज उपास्ते यस्य भूतिर्वयं का अपि च कृपणपक्षे ह्युत्तमश्लोकशब्दः ॥१५॥

विसृज शिरसि पादं वेदम्यहं चाटुकारैरनुनयिवदुष्टस्तेऽध्येत्य दौत्यैर्मुकुन्नात् ।  
स्वकृत इह विसृष्टापत्यपत्यन्यलोका व्यसृजदकृतचेताः किं नु सन्धेयमस्मिन् ॥१६॥

मृग्युरिव कपीन्द्रं विव्यधे लुब्धधर्मा स्त्रियमकृत विरूपां स्त्रीजितः कामयानाम् ।  
बलिमपि बलिमत्त्वावेष्टयद् ध्वाङ्गवद् यस्तदलमसितसख्यैरुस्त्यजस्तत्कथार्थः ॥१७॥

यदनुचरितलीलाकर्णपीयूषविप्रुद्सकृददनविधूतद्वन्द्वधर्मा विनष्टः ।  
सपदि गृहकुटुम्बं दीनमुत्सृज्य दीना बहव इह विहङ्गा भिक्षुचर्यां चरन्ति ॥१८॥

अમोने एवी भोणी समजवी नहीं.<sup>१३</sup> हे भ्रम ! जे अमो घर वगरनी छीअे तेओनी आगण वारंवार याएवोना पतिनुं गायन तुं शा माटे करे छे ? अमे तो ए कृष्णने बहु ज जोया छे. हमाणां जे स्त्रीओ ए कृष्णनी सभीओ थयेली छे, तेओनी पासे ते कृष्णना प्रसंगनुं गायन कर. जेना कामजवरने भगवान मटाडे छे, एवी भगवाननी घारीओ तने जे जोईतुं हशे ते आपशे.<sup>१४</sup> हे कपटी ! सुंदर हास अने भूकुटीना चाणा करनारा ते भगवानने स्वर्ग, पृथ्वी अने पाताणमांनी कट्ठ स्त्रीओ न मणे अमे छे ? लक्ष्मीज्ञ पाण तेमना चरणनी २४ने सेवे छे त्यारे अमे कोण ? तोपाण तारे भगवानने एटलुं कहेवुं के जे पुरुष दीन उपर दया करे ते ज महात्मा अने भोटी कीर्तिवाणो कहेवाय छे.<sup>१५</sup> मारा पगमां माथुं मूळ नहीं, भगवाननी पासेथी शीभी आवी, कालावाला करी, तुं अमारी प्रार्थना करे छे ते सर्वे हुं ज्ञाणुं छुं. जेमधो भगवानने माटे संतान, पति अने परलोको त्याग कर्यो छे, आवी अमोने पाण ए यंचण मनना भगवाने छोडी दीधी छे, तो हवे तेनी साथे शुं समाधान करवुं ?<sup>१६</sup> रामावतारमां ए भगवाने पाराधी जेवुं काम करीने वाली वानरने वींधी नाख्यो हतो अने सीताने परवश थईने जे तमोए कामनाथी आवेली एवी सुपणाखाना कान-नाक कापी नाख्या हता, तेम ज वामन अवतारमां कागडा जेवुं आचरण करी, बणि राजानुं सर्व खाई जतां पाणो तेने बांधी लीधो हतो, तो आवी वातो संभारीने हुं भगवानथी बीउ छुं, माटे हवे अेमनी साथे मैत्री करवानुं कशुं काम नथी, तोपाण तेमनी वात करवानुं छोडी शकाय तेम नथी.<sup>१७</sup> ए भगवानना चरित्रुपी कर्णामृतनी कण्ठी एकवार सेवाई गयाथी पाण रागदेखादिक मटी जतां, धरनां रांक कुटुंबने तरत छोडी दृ, कंगाल तथा ज्ञवते मुवा जेवा थई अने पक्षीओनी पेठे केवળ आहारनी ज आवश्यकता राखी, आ

वयमृतमिव जिह्वाहृतं श्रद्धानाः कुलिकरुतमिवाज्ञा: कृष्णवध्वो हरिण्यः ।  
ददृशुरसकृदेतत्त्रखस्पर्शतीवस्मररुज उपमन्त्रिन् भण्यतामन्यवार्ता ॥१९॥

प्रियसख पुनरागा: प्रेयसा प्रेषितः किं वरय किमनुरुचे माननीयोऽसि मेऽङ्ग ।  
नयसि कथमिहास्मान् दुस्त्यजद्वन्द्वपार्श्वं सततमुरसि सौम्य श्रीवर्धूः साकमास्ते ॥२०॥

अपि बत मधुपुर्यामार्यपुरोऽधुनाऽऽस्ते स्मरति स पितृगेहान् सौम्य बन्धूंश्च गोपान् ।  
क्रचिदपि स कथा नः किङ्करीणां गृणीते भुजमगुरुसुगन्धं मूर्ध्यधास्यत् कदा नु ॥२१॥

## श्रीशुक उवाच

अथोऽद्वद्वो निशम्यैवं कृष्णदर्शनलालसाः । सान्त्वयन् प्रियसन्देशौर्गोपीरिदमभाषत ॥२२  
उद्दव उवाच

अहो यूयं स्म पूर्णार्था भवत्यो लोकपूजिताः । वासुदेवे भगवति यासामित्यर्पितं मनः ॥२३  
दानवतपोहोमजपस्वाध्यायसंयमैः । श्रेयोभिर्विविधैश्चान्यैः कृष्णे भक्तिर्हि साध्यते ॥२४

जगतमां धशा जशा भीम भागता थया छे, तोपाण ए भगवाननी वात करवानुं अमाराथी छोडी शकातुं नथी.<sup>१८</sup> जेम काणियारनी स्त्री भोणी मृगलीओ पाराधीना गायनने निष्कपट मानवाथी, बाणीथी धवाईने पीडा ज देखे छे, तेम अमे पाण ए कपटी भगवानना वयनने साचुं मानी, नभना घाथी धवाईने, हवे कामटेव तेमना नभना स्पर्शथी बहु ज वध्यो छे, ते काम संबंधी पीडाने वारंवार देखीये छीअे, माटे हे दूत ! ए विना भीज्ञ वात कर.<sup>१९</sup> हे घारा भित्र ! तुं एकवार अहींथी जईने पाछो आव्यो ते घाराना मोक्लवाथी आव्यो ? तारे शुं जोईये छे ? माणी ले, केमके तुं मारे पूज्य छे. जेनो समागम छोडवो कठाण पडे, एवा भगवाननी पासे तुं अमने लई जवा मागे छे ? हे सौम्य ! लक्ष्मी वहु तो सर्वदा तेमनी साथे ज रहे छे, माटे ए कृष्णने अमारुं शुं प्रयोजन छे ?<sup>२०</sup> हे सौम्य ! श्रीकृष्ण गुरुने घेरथी आवीने अत्यारे मथुरामां छे ? माबापना धरने अने पोताना भित्रो गोवाणोने संभारे छे ? कोई समये अमो दासीओनी वात करे छे ? पोताना सुगंधीमान हाथने अमारा भस्तक उपर क्यारे धरशे ?<sup>२१</sup>

शुकदेवज्ञ कहे छे- आ सर्वे सांभणी उद्धवज्ञाए भगवानना दर्शननी घासी, ए गोपीओने भगवानना संदेशाथी सांत्वना कर्या पहेलां आ प्रमाणे कह्युं.<sup>२२</sup>

उद्धवज्ञ कहे छे- अहो ! तमारुं मन वासुदेव भगवानमां लागी रह्युं छे तेथी कृतार्थ अने जगतमां सत्कार पामनारी छो.<sup>२३</sup> दान, प्रत, तप, होम, जप,

ભગવત્યુત્તમશ્લોકે ભવતીભિરનુત્તમા । ભક્તિઃ પ્રવર્તિતા દિષ્ટચા મુનિનામપિ દુર્લભા ॥૨૫  
દિષ્ટચા પુત્રાન् પતીન् દેહાન् સ્વજનાન્ ભવનાનિ ચ । હિત્વા વૃણીત યૂયં યત્ કૃષ્ણાખ્યં પુરુષં પરમ  
સર્વાત્મભાવોઽધિકૃતો ભવતીનામધોક્ષજે । વિરહેણ મહાભાગા મહાન્ મેનુગ્રહઃ કૃતઃ ॥૨૭  
શ્રૂયતાં પ્રિયસન્દેશો ભવતીનાં સુખાવહઃ । યમાદાયાગતો ભદ્રા અહં ભર્તૂ રહસ્કરઃ ॥૨૮

## શ્રીભગવાનુવાચ

ભવતીનાં વિયોગો મે ન હિ સર્વાત્મના ક્રચિત् । યથા ભૂતાનિ ભૂતેષુ ખં વાખ્વગિર્જલં મહી ।  
તથાહં ચ મનઃપ્રાણભૂતેન્દ્રિયગુણાશ્રયઃ ॥૨૯

આત્મન્યેવાત્મનાઽજ્તમાનં સૃજે હન્મયનુપાલયે । આત્મમાયાનુભાવેન ભૂતેન્દ્રિયગુણાત્મના ॥૩૦  
આત્મા જ્ઞાનમય: શુદ્ધો વ્યતિરિક્તોઽગુણાશ્રયઃ । સુષુપ્તિસ્વજનજાગ્રદ્ધર્માયાવૃત્તિભરીયતે ૩૧  
યેનેન્દ્રિયાર્થાન્ ધ્યાયેત મૃષા સ્વજનવુત્થિતઃ । તત્ત્વિસ્મરન્ધ્યાદિન્દ્રિયાણિ વિનિદ્રઃ પ્રત્યપદ્યત ॥૩૨  
એતદન્તઃ સમાનાયો યોગઃ સાંખ્યં મનીષિણામ् । ત્યાગસ્તપો દમઃ સત્ય સમુદ્રાના ઇવાપગા: ।

વેદાધ્યયન, નિયમો, અને બીજાં પણ અનેક શુભ સાધનોથી ભગવાનમાં ભક્તિ પ્રાપ્ત થાય છે.<sup>૨૪</sup> મોટી કીર્તિવાળા ભગવાનની ઉત્તમ ભક્તિ તમે કરો છો એ ઘણું યોગ્ય છે. પતિ, પુત્ર, દેહ, સ્વજન અને ધરને છોડી દઈ તમો શ્રીકૃષ્ણ નામના પરમ પુરુષને વરી એ ઘણું સારું કર્યું છે.<sup>૨૫-૨૬</sup> હે ભાગ્યશાળી ગોપીઓ ! તમને વિરહથી ભગવાનની સાચી ભક્તિ મળી છે અને એ ભક્તિ દેખાડીને મારા ઉપર મોટો અનુગ્રહ કર્યો છે.<sup>૨૭</sup> હે ભલી સ્ત્રીઓ ! હવે તમને સુખ આપનાર ભગવાનનો પ્યારો સંદેશો સાંભળો, જે સંદેશો લઈને ભગવાનનાં રહસ્ય કામ કરનારો હું આવેલો છું.<sup>૨૮</sup>

ભગવાને કહું છે કે તમોને મારો વિયોગ કોઈ સમયે પણ સર્વથા નથી. કેમકે આકાશ, વાયુ, અભિની, જળ અને પૃથ્વી એ પાંચ મહાભૂતો જેમ સ્થાવર જીગમ સર્વે પદાર્થોમાં રહ્યાં છે તેવી રીતે હું પણ ભૂત, મન, જીવ, પ્રાણ, ઈન્દ્રિય અને ગુણના અધિકાનપણાથી સર્વમાં રહ્યો છું. હું પોતાના શરીરભૂત પ્રકૃતિને વિષે જ ભૂતો ઈન્દ્રિયો અને ગુણરૂપે પોતાના સંકલ્પના પ્રભાવથી, હું પોતે જ મારા શરીરભૂત એવા સૃજ્ય વર્ગને ઉત્પન્ન, પાલન અને પ્રલય કરું છું. કેમ કે આત્મા તો શુદ્ધ છે, કોઈ ગુણમાં સંબંધ પામતો નથી, સર્વ ગુણોથી જુદો છે અને શાનસ્વરૂપ છે. માયાથી થયેલા મનની વૃત્તિરૂપ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ નામની અવસ્થાઓને લીધે વિશ્વ, તેજસ અને પ્રાણરૂપે જણાય છે, જીવ સર્વ પ્રકારે દેહ, ઈન્દ્રિયો, મન, પ્રાણાદિકથી વિલક્ષણ છે.<sup>૨૯-૩૨</sup> જ્ઞાગેલો પુરુષ જેમ સ્વપ્નને ખોટું

યત્ત્વહં ભવતીનાં વૈ દૂરે વર્તે પ્રિયો દૂશામ् । મનસ: સત્ત્રિકર્ષાર્થ મદનુધ્યાનકામ્યયા ॥૩૪  
યથા દૂરચરે પ્રેષે મન આવિશ્ય વર્તતે । સ્ત્રીણાં ચ ન તથા ચેત: સત્ત્રિકૃષ્ટેક્ષિગોચરે ॥૩૫  
મય્યાવેશ્ય મન: કૃત્ત્વ વિમુક્તાશેવૃત્તિ યત્ । અનુસ્મરન્યો માં નિત્યમચિરાન્મામુપૈષ્યથ ॥  
યા મયા ક્રીડતા રાત્રાં વનેઽસ્મિન્ન્વજ આસ્થિતા: । અલબ્ધરાસા: કલ્યાણ્યો માઽપુર્મદ્વીર્યચિન્તયા  
શ્રીશુક ઉવાચ

એવં પ્રિયતમાદિષ્ટમાકર્ણ્ય વ્રજયોષિતઃ । તા ઊચુરુદ્ધવં પ્રીતાસ્તસન્દેશાગતસ્મૃતીઃ ॥૩૮  
ગોપ્ય: ઊચુ:

દિષ્ટચાહિતો હત: કંસો યદૂનાં સાનુગોઽઘકૃત । દિષ્ટચાઽસૈલબ્ધસર્વાથૈઃ: કુશલ્યાસ્તેઽચ્યુતોઽધુના  
કચ્ચિદ્ગદગાગ્રજઃ: સૌષ્ય કરોતિ પુર્યોષિતામ् । પ્રીતિંન: સ્નિગ્ધસત્રીડહાસોદારેક્ષાર્ચિતઃ ૪૦  
જ જાણે છે, તેમ વિદ્વાનો જેને ખોટા જ ગણે છે, એવા વિષયોનું જે મનથી ચિંતવન  
થાય છે અને ચિંતન કરતાં કરતાં ઈન્દ્રિયોને પ્રામ થાય છે, તે મનનો આણસ મૂકીને  
મારે વિષે નિરોધ કરવો જોઈએ.<sup>૩૩</sup> વેદ, આષાંગયોગ, આત્મા અનાત્માનો વિવેક,  
સંન્યાસ, સ્વધર્મ, ઈન્દ્રિયોનું છેલ્યું પ્રામિ સ્થાન સમુદ્ર છે, તેમ વિદ્વાનોએ ઠરાવેલાં સર્વે  
સાધનોનું ફણ તો એક જ મારે વિષે મનનો નિરોધ જ છે.<sup>૩૪</sup> તમોને ખારો હું  
તમારી ઈષ્ટિઓથી દૂર રહું છું, તે તમોને મારું ધ્યાન કરાવવાની ઈચ્છાથી અને  
ધ્યાન કરાવીને તમારા મનને મારી પાસે રાખવાને માટે રહું છું.<sup>૩૫</sup> દૂર રહેલા  
ખારામાં સ્ત્રીઓનું મન જેવું લાગી રહે છે, તેવું પ્રત્યક્ષ રીતે પાસે રહેલો હોય  
તેમાં લાગતું નથી.<sup>૩૬</sup> સર્વે વૃત્તિઓને છોડી દેતાં મન મારામાં રાખી નિરંતર મારું  
સ્મરણ કરવાને લીધે તમો થોડા કાળમાં મને પામશો.<sup>૩૭</sup> હે ભલી સ્ત્રીઓ ! હું જે  
સમયમાં વૃદ્ધાવનમાં રાત્રીએ કીડા કરતો હતો તે સમયે પોતાના પતિએ રોકી  
રાખવાને લીધે જે સ્ત્રીને મારી સાથે રાસ રમવાનું ન મળ્યું, તે સ્ત્રીઓ મારા  
પરાકમોના ચિંતનથી જ મને પામી ગઈ છે.<sup>૩૮</sup>

શુકદેવજી કહે છે- આ પ્રમાણે પ્રાણપ્રિય ભગવાનના સંદેશા સાંભળી રાજુ  
થયેલી અને તેમના સંદેશાથી જેને સ્મરણ પ્રામ થયું, એવી ગોપીઓ ઉદ્ધવજીને  
આ પ્રમાણે કહેવા લાગી.<sup>૩૯</sup>

ગોપીઓ કહે છે યાદવોના શત્રુ અને દુઃખદાયી કંસને તેના અનુચ્ચરો સહિત  
માર્યો એ ઘણું સારું કર્યું અને જેના સર્વ મનોરથ પૂરા થયા છે. એવા સંબંધીઓની  
સાથે હમણાં ભગવાન આનંદથી વર્તે છે એપણા ઘણું સારું છે.<sup>૪૦</sup> હે સૌષ્ય ! સ્નેહ

કથં રતિવિશેષજ્ઞ: પ્રિયશ્રી વરયોષિતામ् । નાનુબધ્યેત તદ્વાક્યૈર્વિભ્રમૈશ્નાનુભાજિત: ॥૪૧  
અપિ સ્મરતિ ન: સાથો ગોવિન્દ: પ્રસ્તુતે ક્રચિત् । ગોષ્ઠીમધ્યે પુરસ્ત્રીણાં ગ્રામ્યાઃ સ્વૈરકથાન્તરે  
તાઃ કિં નિશાઃ સ્મરત યાસુ તદા પ્રિયાભિર્વન્દવાને કુમુદકુન્દશશાઙ્કરમયે ।

રેમે ક્રણચ્વરણનુપુરાસગોષ્ઠ્યામસ્માભિરીડિતમનોજકથ: કવાચિત् ॥૪૩॥

અધ્યેષ્ટ્યતીહ દાશાર્હસ્તમાઃ સ્વકૃતયા શુચા । સજ્જીવયન્ નુ નો ગાત્રૈયથેન્નો વનમખ્યુદૈ: ॥૪૪  
કસ્માત् કૃષ્ણ ઇહાયાતિ પ્રાસરાજ્યો હતાહિત: । નેન્દ્રકન્યા ઉદ્વાહ્ પ્રીતઃ સર્વસુહૃત્તતઃ ॥૪૫  
કિમસ્માભિર્વન્નૌકોભિરન્યાભિર્વા મહાત્મનઃ । શ્રીપતેરાસકામસ્ય ક્રિયેતાર્થ: કૃતાત્મન: ॥૪૬  
પરં સૌછ્યં હિનૈરાશં સ્વૈરિણ્યાહપિઙ્લા । તજ્જાનીતીનાં નઃ કૃષ્ણો તથાયાશા દુરત્વયા ॥  
ક ઉત્સહેત સન્યકુમુતમશલોકસંવિદમ् । અનિછ્છોऽપિ યસ્ય શ્રીરઙ્ગાન્ન્યવતે ક્રચિત् ॥૪૮  
સરિછૈલવનોદેશા ગાવો વેણુરવા ઇમે । સઙ્કૂર્ષણસહાયેન કૃષ્ણનાચરિતાઃ પ્રભો ॥૪૯

અને લાજ સહિત હાસ્ય કરીને અને ઉદાર દાખિથી અમોએ પૂજેલા ભગવાન  
અમારી ઉપર જે પ્રીતિ કરવી જોઈએ તે પ્રીતિ મથુરાની સ્ત્રીઓ ઉપર કરે છે ? ૪૧  
બીજી ગોપી બોલી રતિના પ્રકારો જાણનાર ઉત્તમ સ્ત્રીઓને ઘ્યારા લાગે એવા  
અને ઉત્તમ સ્ત્રીઓએ પોતાના વાક્ય તથા વિલાસથી સત્કાર કરેલા ભગવાન તે  
સ્ત્રીઓમાં કેમ ન બંધાય ? ૪૨ હે સૌભ્ય ! નગરની સ્ત્રીઓની સભામાં યથેષ્ટ વાતો  
કરતાં કોઈ પ્રસંગે ભગવાન અમને સંભારે છે ? ૪૩ કુમુદ, કુન્દ પુષ્પ અને ચંદ્રમાથી  
શોભી રહેલા વૃન્દાવનમાં ઝાંઝરના ઝમકારાવાળી રાસમંડળીમાં અમારી સાથે  
ભગવાન જે રાત્રીઓમાં રમ્યા હતા અને અમો તેમની મનોહર કથાની સ્તુતિ કરી  
હતી, તે રાત્રીને ભગવાન કોઈ સમયે સંભારે છે ? ૪૪ જેમ ઈંડ મેઘથી વનને  
જિવાડે તેમ પોતે આપેલા શોકથી તપી રહેલી અમોને, પોતાના ગાત્રનો સ્પર્શ  
આપી જિવાડવા સારુ શ્રીકૃષ્ણ અહીં આવશે ? ૪૫ બીજી ગોપી બોલી, પણ હવે  
કૃષ્ણ અહીં શા માટે આવે ? શ્રીકૃષ્ણને રાજ્ય મળ્યું, શત્રુ મરી ગયા, સર્વ  
સંબંધીઓનો સમાગમ થયો અને રાજાઓની કન્યાઓને પરણી, પ્રીતિ પામ્યા તે  
અહીં શા માટે આવે ? ૪૬ અને વળી બીજી બોલી શ્રીકૃષ્ણને સર્વ મનોરથ પ્રામ છે  
અને પોતે પૂર્ણ છે. તેમને વગડામાં રહેનારી અમો અથવા બીજીઓ પણ શું કરી  
આપે એમ છે ? ૪૭ પિંગલા વેશ્યાએ પણ કહ્યું છે કે “આશા ન રાખવી એજ મોટું  
સુખ છે.” એ વાતને અમે જાણીએ છીએ તોપણ શ્રીકૃષ્ણની આશા છૂટી નથી.  
૪૮ ઉત્તમ ક્રીતિવાળા ભગવાન પોતે લક્ષ્મીને ઈચ્છતા નથી, તોપણ તેમના  
અંગમાંથી લક્ષ્મી કઢી પણ ખસતી નથી, એવા ભગવાનની એકાંતની વાતોને

પુન: પુન: સ્મારયન્તિ નન્દગોપસુતં બત । શ્રીનિકેતસ્તત્યદક્રીવિસ્મર્તુ નેવ શકનુમઃ ॥૫૦  
ગત્યા લલિતયોદારહાસલીલાવલોકનૈ: । માધ્વા ગિરા હૃતધિય: કથં તં વિસ્મરામહે ॥૫૧  
હે નાથ હે રમાનાથ વ્રજનાર્થાર્તિનાશન । મગનમુદ્ર ગોવિન્દ ગોકુલં વૃજિનાર્થવાત् ॥૫૨  
શ્રીશુક ઉવાચ

તતસ્તા: કૃષ્ણસદેશૈર્વ્યપેતવિરહજવા: । ઉદ્વદ્વં પૂજયાશ્રુર્જાત્વાઽત્માનમધોક્ષજમ ॥૫૩  
ઉવાસ કતિચિન્માસાન્ ગોપીનાં વિનુદજ્યુચ: । કૃષ્ણલીલાકથાં ગાયન્ રમયામાસ ગોકુલમ् ૫૪  
યાવન્યહાનિ નન્દસ્ય વ્રજેઽવાત્પીત્ સ ઉદ્વદ્વ: । વ્રજૌકસાં ક્ષણપ્રાયાણ્યાસન્ કૃષ્ણસ્ય વાર્તયા  
સરિદ્વનગિરિદ્રોણીવીક્ષણન્ કુસુમિતાન દ્રુમાન । કૃષ્ણ સંસારયન્ રેમે હરિદાસો વ્રજૌકસામ્ ૫૬  
દૂષ્ટૈવમાદિ ગોપીનાં કૃષ્ણાવેશાત્મવિકલ્પમ् । ઉદ્વદ્વ: પરમપ્રીતસ્તા નમસ્યન્નિદં જગો ॥૫૭

એતા: પરં તનુભૂતો ભૂવિ ગોપવધો ગોવિન્દ એવ નિખિલાત્મનિ રૂઢભાવાઃ ।  
વાજ્ઞાન્તિ યદ્ ભવભિયો મુનયો વય ચ કિ બ્રહ્મજન્મભિરનન્તકથારસસ્ય ॥૫૮॥

કોણ છોડી શકે ? ૪૯ હે ઉદ્વદ્વ ! બલરામ સહિત શ્રીકૃષ્ણ જ્યાં ફર્યા હતા તે આ  
નદી, પર્વત અને વનના પ્રદેશો તથા વેણુના શબ્દો વારંવાર એ નંદકુમારોનું અમને  
સ્મરણ આપે છે. લક્ષ્મીના સ્થાનકરૂપ તેમનાં પગલાં જોઈને અમો વિસ્મરણ પણ  
કરી શકતી નથી. ૫૦-૫૧ તેમની સુંદર ગતિ, ઉદાર હાસ્ય, લીલા પૂર્વક જોવું અને  
મધુર વાણીથી જેઓનાં મન હરાઈ ગયાં છે એવી અમે શી રીતે ભૂલી જઈએ ? ૫૨  
હે નાથ ! હે લક્ષ્મીના પતિ ! હે વ્રજના નાથ ! હે પીડાના નાશ કરનાર ! હે ગોવિંદ !  
દુઃખરૂપી સમુદ્રમાં દૂબેલા ગોકુળને તેમાંથી બહાર કાઢો. ૫૩

શુકદેવજી કહે છે- પદી ભગવાનના સંદેશાથી જેનો વિરહ તાપ મટી ગયો  
છે. એવી ગોપીઓએ ભગવાનને પરમાત્મા જાણી અને પરમાત્માને પોતાના  
અંતર્યામી જાણી ઉદ્વદ્વજીની પૂજા કરી. ૫૪ ગોપીઓનો શોક મટાડતા ઉદ્વદ્વજીએ  
કેટલાક મહિના સુધી ત્યાં રહીને ભગવાનની લીલાની કથાનું ગાયન કરી ગોકુળને  
આનંદ આપ્યો. ૫૫ ઉદ્વદ્વજી જેટલા દિવસ વ્રજમાં રહ્યા તેટલા દિવસ ભગવાનની  
વાતો ચાલવાને લીધે વ્રજવાસીઓને એક ક્ષણ જેટલા લાગ્યા. ૫૬ નદી, વન, પર્વતની  
ગુફાઓ અને ફૂલવાળાં વૃક્ષોને જોતા અને તે દરેક સ્થળમાં ભગવાનની લીલાના  
પ્રશ્નોના બહાને ભગવાનનું સ્મરણ કરાવતા, એ ભગવાનના દાસ ઉદ્વદ્વજી  
વ્રજમાં આનંદથી રહ્યા. ૫૭ ભગવાનમાં જ પ્રવેશ કરાવેલ ગોપીઓના મનની  
વિન્દળતા જોઈને બહુ જ રાજુ થયેલા ઉદ્વદ્વજ ગોપીઓને પ્રણામ કરવાનું ધારી,  
મનમાં આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા. ૫૮

ક્રેમા: સ્ત્ર્યો વનચરીવ્યભિચારદુષ્ટઃ કૃષ્ણો ક્રચૈષ પરમાત્મનિ રૂઢભાવઃ ।  
નન્વીશ્વરોऽનુભજતોऽવિદુષોऽપિ સાક્ષાચ્છ્રેયસ્તનોત્યગદરાજ ઇવોપ્યુક્તઃ ॥૫૧॥  
નાયં શ્રિયોऽઙ્ગું ઉનિતાન્તરતે: પ્રસાદ: સ્વર્યોષિતાં નલિનગન્થરુચાં કુતોઽન્યા: ।  
રાસોત્સવેઽસ્ય ભુજદણગૃહીતકણઠલબ્ધાશિષાં ય ઉદગાદ બ્રજવલ્લબીનામ् ॥૫૦॥  
આસામહો ચરણેણુષામહં સ્યાં વૃન્દાવને કિમિપ ગુલ્મલતૌષધીનામ् ।  
યા દુસ્ત્યજં સ્વજનમાર્યપથં ચ હિત્વા ભેજુમુકુન્દપદવી શ્રુતિભર્વિમૃગ્યામ् ॥૫૧॥  
યા વૈ શ્રિયાર્ચિતમજાદિભિરાસકામૈર્યોગેશ્વરરપિ યદાત્મનિ રાસગોષ્યામ् ।  
કૃષ્ણસ્ય તદ્ભગવતશ્રરણારવિન્દં ન્યસ્તં સ્તનેષુ વિજુઃ પરિરસ્મ તાપમ् ॥૫૨॥  
વન્દે નન્દવજસ્ત્રીણાં પાદરેણુમભીક્ષણાઃ । યાસાં હરિકથોદ્ગીતં પુનાતિ ભુવનત્રયમ् ॥૫૩

### શ્રીશુક ઉવાચ

અથ ગોપીરનુજ્ઞાય્ યશોદાં નન્દમેવ ચ । ગોપાનામન્ય દાશાર્હો યાસ્યન્નારુહે રથમ् ॥૫૪

ઉદ્ઘવજુ મનમાં વિચાર કરે છે પૃથ્વીમાં કેવળ આ ગોપીઓનો જ જન્મ સફળ છે, કેમકે સંસારથી ભય પામતા મુનિઓ અને અમો શ્રીકૃષ્ણમાં જેવો ભાવ રાખવાને ઈચ્છાએ છીએ તેવો ભાવ આ ગોપીઓને દૃઢ થઈ ગયો છે. ભગવાનની કથામાં રંગ લાગે તો પછી બ્રાહ્મણના જન્મ અને કર્માનું શું પ્રયોજન છે ?<sup>૫૫</sup> વનમાં ફરનારી અને વ્યભિચારના દોષવાળી આ સ્ત્રીઓ ક્યાં ? અને પરમાત્મા શ્રીકૃષ્ણમાં આવો દૃઢ થયેલો ભાવ ક્યાં ? પોતાને ભજનારા અજ્ઞાની લોકોને પણ ઈશ્વર ભજે છે અને પીધેલા અમૃતની પેઠે સાક્ષાત્ કલ્યાણ કરે છે.<sup>૫૦</sup> રાસોત્સવમાં ભગવાન પોતાની ભુજાથી કંઠનું આલિંગન કરી, બ્રજની ગોપીઓ ઉપર જેવી કૃપા કરી, તેવી કૃપા નિરંતર પ્રીતિ રાખનાર લક્ષ્મીજી ઉપર પણ નથી કરી, અને અપ્સરાઓની ઉપર પણ નથી કરી, ત્યારે બીજી સ્ત્રીઓની શી વાત કરવી ?<sup>૫૧</sup>

અહો ! ! ! આ ગોપીઓ ત્યાગ કરવાને અશક્ય એવાં પોતાના સંબંધી અને ધર્મ માર્ગનો ત્યાગ કરી, શ્રુતિઓ પણ જેને શોધે છે એવી પરમ પદવીને પામી છે, ગોપીઓના ચરણની રજ જેના ઉપર પડે છે એવા ગુચ્છ, લતા અને ઔષધિની જાતમાં વૃંદાવનની અંદર મારો કોઈ પણ અવતાર થાય તો ઠીક.<sup>૫૨</sup> લક્ષ્મીએ પૂજેલું અને પૂર્ણકામનાવાળા બ્રહ્માદિક તથા યોગેશ્વરો પણ હૃદયમાં જ પૂજેલું ભગવાનનું ચરણારવિંદ પોતાના સ્તન ઉપર મૂકી તેનું આલિંગન કરી, જેઓ

તં નિર્ગતં સમાસાદ્ય નાનોપાયનપાણય: । નન્દદયોઽનુરાગેણ પ્રાવોચન્નશુલોચનાઃ ॥૬૫  
મનસો વૃત્તયો નઃ સ્યુ: કૃષ્ણપાદામ્બુજાશ્રયાઃ । વાચોઽભિધાયિનીર્નામાં કાયસ્તત્રહૃણાદિષુ  
કર્મભર્માસ્યમાણાનાં યત્ર ક્રાપીશ્વરેચ્છયા । મઙ્ગલાચરિતૈર્દાનૈ રતિનઃ કૃષ્ણ ઇશ્વરે ॥૬૭  
એવં સભાજિતો ગોપૈ: કૃષ્ણ ભક્ત્વા નરાધિપ યદ્દ્વાબ: પુનરાગચ્છમથુરાં કૃષ્ણપાલિતામ्  
કૃષ્ણાય પ્રણિપત્યાહ ભક્ત્વદ્રેકેં બ્રજૌકસામ् । વસુદેવાય રામાય રાજે ચોપાયનાન્યદાત ॥૬૯

ઇતિ શ્રીમદ્બાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વાર્ધ

ઉદ્ઘવપ્રતિયાને સપ્તચત્વારિંશોઽદયાય: ॥૪૭॥

પોતાના તાપનો ત્યાગ કર્યો હતો, એવી ગોપીઓના ચરણની રજ મારે માથે પડે એવી હું આશા રાખ્યું છું.<sup>૫૩</sup> બ્રજની સ્ત્રીઓએ કરેલું ભગવાનની કથાનું ઊંચું ગાયન ચ્રણ લોકને પવિત્ર કરે છે, તેની ચરણ રજને હું વારંવાર વંદન કરું છું.<sup>૫૪</sup>

શુકુદેવજુ કહે છે- પછી ઉદ્ઘવજુ ગોપીઓની, નંદરાયની અને યશોદાની આજ્ઞા લઈ, ગોવાળોને પૂછી જવા માટે રથમાં બેઠા.<sup>૫૫</sup> નીકળેલા ઉદ્ઘવજુની પાસે અનેક પ્રકારની ભેટો લઈ આવેલા અને સ્નેહથી જેઓના નેત્રમાં આંસુ આવી ગયાં હતાં, એવા નંદાદિક ગોવાળો બોલ્યા કે- અમારા મનની વૃત્તિઓ કૃષ્ણના ચરણારવિંદમાં રહેજો, વાણી ભગવાનના ચરણનું ઉચ્ચારણ કર્યા કરજો, અને શરીર તેમને પ્રણામ કરવા આદિ કર્મમાં તત્પર રહેજો.<sup>૫૬-૫૭</sup> ઈશ્વરની ઈચ્છાથી કોઈ કર્મથી અમો કોઈ પણ યોનિમાં ભટકીએ ત્યાં પણ હમેશાં ભગવાન કૃષ્ણમાં અમારી આસક્તિ રહેજો.<sup>૫૮</sup> હે રાજી ! આવી રીતે ભગવાનની ભક્તિને લીધે ગોવાળોએ સત્કાર કરેલા ઉદ્ઘવજુ ભગવાને રક્ષેલી મથુરાપુરીમાં ફરીવાર આવ્યા.<sup>૫૯</sup> શ્રીકૃષ્ણને પ્રણામ કરી બ્રજવાસીઓની ભક્તિના ઉત્કર્ષની વાત કહી સંભળાવી, અને શ્રીકૃષ્ણને, વસુદેવને, બળદેવજુને તથા રાજાને ત્યાંથી મળેલી ભેટની ઉત્તમ વસ્તુઓ આપી.<sup>૬૦</sup>

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંદના સુડતાળીશમાં અદ્યાય સંપૂર્ણ.

## अथ अष्टवत्त्वारिंशोऽध्यायः (४८)

॥ श्रीशुक उवाच ॥

अथ विज्ञाय भगवान् सर्वात्मा सर्वदर्शनः । सैरस्त्वाः कामतमायाः प्रियमिच्छन् गृहं ययौ १  
महार्होपस्करैराद्यं कामोपायोपबृहितम् । मुक्तादामपताकाभिर्वितानशयनासनैः ।

धूपैः सुरभिभिर्दीपैः स्त्रगच्छैरपि मणिडतम् ॥२॥

गृहं तमायान्तमवेक्ष्य साऽऽसनात् सद्यः समुत्थाय हि जातसम्भ्रमा ।

यथोपसङ्गम्य सखीभिरच्युतं सभाजयामास सदासनादिभिः ॥३॥

तथोद्धवः साधु तयाभिपूजितो न्यौषददुर्व्यामभिमृश्य चासनम् ।

कृष्णोऽपि तूर्णं शयनं महाधनं विवेश लोकाचरितान्यनुव्रतः ॥४॥

सा मज्जनालेपदुक्ललभूषणस्त्रगच्छतम्बूलसुधासवादिभिः ।

प्रसाधितात्मोपससार माधवं सद्रीडलीलोत्स्मतिविभ्रमेक्षितैः ॥५॥

आहूय कान्तां नवसङ्गमहिया विशङ्कितां कङ्कणभूषिते करे ।

प्रगृह्ण शश्यामधिवेश्य रामया रेमेऽनुलेपार्पणपुण्यलेशया ॥६॥

## अध्याय ४८

**श्रीकृष्ण भगवान् कुञ्जनी साथे विहार कर्यो अने अकूरज्ञने  
हस्तिनापुर भोक्त्या.**

शुकदेवज्ञ कुडे छे- पछी सर्वना आत्मा अने सर्वने जाणनारा भगवान्  
कामनाथी तपी गयेली कुञ्जने पोते आपेलुं वयन संभारी तेने राज्ञ करवा सारु  
तेने घेर गया.<sup>१</sup> ए कुञ्जना घरमां भूत्यवान् सामान भरपर हतो. कामदेवने  
प्रदीप करनारां रति संबंधी यित्रो आलेखेलां हतां. भोतीनी भाणाओ, पताका,  
यंदरवा, शयनादिक, सुगंधी धूप, दीप, फूलनी भाणाओ अने यंदनादिक सुगंधी  
शोभी रह्युं हतुं.<sup>२</sup> कृष्ण पोताने घेर आवता जोई, कुञ्जा भोटा संभ्रमथी तरत  
आसन परथी उठी, सभीओनी साथे यथायोग्य रीते भगवानने मणी. उतम  
आसनादि आपी तेमनुं सन्मान कर्युं.<sup>३</sup> कुञ्जाए सारी रीते मान आपेला उद्धवज्ञ  
आसननो स्पर्श करीने धरती उपर बेसी गया. पछी लोकना आचरणने  
अनुसरेला भगवान् तरत ज भूत्यवान् ते कुञ्जना शयनमां पधार्या.<sup>४</sup> स्नान,  
लेपन, वश, भूषण, भाणा, सुगंध, तांबुल अने अमृत सरभां पीवाना मादक  
पदार्थोंथी पोताना शरीरने करेलो छे अलंकृत जेमणे, ऐवी कुञ्जा लाजभरेली  
लीलाथी हसती, विलास करती अने जोती जोती भगवाननी पासे गई.<sup>५</sup> भगवान्

सानङ्गतमकुचयोरुरसस्तथाक्षणोर्जिग्रन्त्यनन्तचरणेन रुजो मृजन्ती ।

दोर्भ्या स्तनान्तरगतं परिरभ्य कान्तमानन्दमूर्तिमजहादतिदीर्घतापम् ॥७॥

सैवं कैवल्यनाथं तं प्राप्य दुष्प्राप्यमीश्वरम् । अङ्गरागार्पणेनाहो दुर्भगेदमयाचत ॥८

आहोष्यतामिह प्रेष्ठ दिनानि कतिचिन्मया । रमस्व नोत्सहे त्यक्तुं सङ्गं तेऽम्बुरुहेक्षण ॥९

तस्यै कामवरं दत्ता मानयित्वा च मानदः । सहोद्धवेन सर्वेषाः स्वधामागमर्द्धचित्तम् ॥१०

दुराराध्यं समाराध्य विष्णुं सर्वेश्वरेश्वरम् । यो वृणीते मनोग्राह्यमसत्त्वात् कुमनीष्यसौ ॥११

अकूरभवनं कृष्णः सहरामोद्धवः प्रभुः । किञ्चिच्चिकीर्थयन् प्रागादकूरप्रियकाम्यया ॥१२

स तान् नरवरश्रेष्ठानाराद् वीक्ष्य स्वबास्यवान् । प्रत्युत्थाय प्रमुदितः परिष्वज्याभ्यनन्दत ॥१३

ननाम कृष्णं रामं च स तैरप्यभिवादितः । पूजयामास विधिवत् कृतासनपरिग्रहान् ॥१४

पादावनेजनीरापो धारयज्ञिष्ठसा नृप । अर्हेनाम्बरैर्दिव्यैर्गन्धस्त्राभूषणोत्तमैः ॥१५

अर्चित्वा शिरसाऽऽनम्य पादावङ्गातौ मृजन् । प्रश्रयावनतोऽकूरः कृष्णरामावभाषत ॥१६

नवा समागमनी लाजथी संकोचने पामती ते कुञ्जने बोलावी के जे कुञ्जनुं

यंदन आपवा उपरांत कांઈ पुण्य न हतुं, आवी कुञ्जनो कंकणथी शोभतो हाथ

पक्कीने शयनमां सुवाडीने तेनी साथे रमवा लाग्या.<sup>६</sup> भगवानना यरणने जाणे

सूंघती होय तेम ते यरणने पोताना स्तन उपर, छाती उपर अने आंखो उपर

मूँकी मूँकीने कामनी पीडाने शांत करती, ते कुञ्जाए घ्यारा अने आनंदमय

भगवानने स्तनना भीडामां लई बाथथी आलिंगन करीने पोताना कामज्वरने

टाण्यो.<sup>७</sup> मोक्षना नाथ अने बीजने हुर्लभ प्रभुने केवण यंदन आपवारुप पुण्यथी

ज पामीने जेने गोपीओना जेवी एक निष्ठा हती नहीं आवी कुञ्जाए माझुं के-

हे घ्यारा ! हे कमण सरभा नेत्रवाणा ! अहीं ज घण्णा दिवस रही मारी साथे

रमण करो. तमारा संगने हुं छोडी शक्ती नथी.<sup>८</sup> पछी मान आपनारा अने

कुञ्जाए पूजेला भगवान् ते कुञ्जने आलूषणादिक तथा वरदान आपी

उद्धवज्ञनी साथे पोताने घेर पधार्या.<sup>९</sup> ईश्वरना ईश्वर अने घण्णा प्रयत्नथी

प्रसन्न थाय एवा भगवानने प्रसन्न करी विषयना तुच्छ सुभने मागे तेनी अत्य

बुद्धि समज्वी.<sup>१०</sup> पछी श्रीकृष्ण अकूरज्ञने राज्ञ करवा सारु अने तेमनी पासेकांઈ काम कराववा सारु भलराम अने उद्धवज्ञनी साथे अकूरज्ञने घेर पधार्या.<sup>११</sup>

अकूरज्ञ पुरुषोत्तमने दूरथी ज जोई सामा उठाया, पछी आनंदथी आलिंगन

तथा अभिनंदन आपी श्रीकृष्ण तथा भलभद्रने पगे लाग्या, अने तेओ पण

अकूरज्ञने पगे लाग्या. हे राजा ! पछी अकूरज्ञाए कृष्णने आसनपर बेसाडी,

દિષ્ટચા પાપો હતઃ કંસઃ સાનુગો વામિદં કુલમ् । ભવદ્ભ્યામુદ્ધૂતં કૃચ્છર્દ દુરન્તાચ્ચ સમેધિતમ्  
યુવાં પ્રથાનપુરુષૌ જગઢેતૂ જગન્મયૌ । ભવદ્ભ્યાં ન વિના કિશ્ચિત્ પરમસ્તિ ન ચાપરમ् ॥૧૮  
આત્મસૃષ્ટિમિદં વિશ્વમન્વાવિશ્ય સ્વશક્તિભિઃ । ઈયતે બહુધા બ્રહ્માન् શ્રુતપ્રત્યક્ષગોચરમ् ॥૧૯

યથા હિ ભૂતેષુ ચરાચરેષુ મહાદયો યોનિષુ ભાન્તિ નાના ।

એવં ભવાન્ કેવલ આત્મયોનિષ્વાત્માડત્મતન્નો બહુધા વિભાતિ ॥૨૦॥

સૃજસ્યથો લુલ્પસિ પાસિ વિશ્વં રજસ્તમઃસત્ત્વગુણૈઃ સ્વશક્તિભિઃ ।

ન બધ્યસે તદ્દુણકર્મભર્વા જ્ઞાનાત્મનસે ક્રચ બન્ધહેતુઃ ॥૨૧॥

વિધિ સહિત પૂજા કરી, તેમના ચરણ ધોવાના જળને પોતાને માથે ચઢાવ્યું, દિવ્ય  
વસ્ત્રો અને સુગંધી માળા તથા આભૂષણોથી પૂજન કરી, મસ્તકથી પ્રાણામ કરી,  
ખોળામાં ચરણારવિંદ લઈને ચાંપતા અને પ્રેમથી નમેલા અફૂરજુ આપ્રમાણો  
કહેવા લાગ્યા. ૧૩-૧૬

અફૂરજુ કહે છે- તમે પાપી કંસને તેના પરિવાર સહિત માર્યો અને તમારા  
આ કુળને અપાર કષ્ટમાંથી બચાવ્યું તથા વધાર્યું એ ધાણું સારું કર્યું. ૧૦ તમો  
બત્તેપ્રકૃતિ પુરુષના શરીરી છો, અને તેથી જ જગતના ઉપાદાન અને નિમિત્ત  
કારણ છો, (અર્થાત્ કાર્ય અને કારણ તમામ વસ્તુ તમોને આધીન છે.) કાંઈ  
કારણ અને કાર્ય તમારા વિના છે જ નહિં. ૧૧ હે પરમેશ્વર ! પ્રકૃતિ, પુરુષ, કાળ  
એ આદિ પોતાની શક્તિઓથી પોતે જ સર્જેલા આ વિશ્વની અંદર અંતરાત્માપણો  
(નિયંતાપણો) પ્રવેશ કરીને રહેલા, આપ શ્રુતિ પ્રમાણથી પ્રત્યક્ષ રીતે  
દેવમનુષ્યાદિકરૂપે બહુ પ્રકારે જણાઓ છો, અર્થાત્ શ્રુતિઓ પ્રત્યક્ષરૂપે જણાતાં  
દેવ મનુષ્યાદિક પદાર્થોરૂપે આપનું જ પ્રતિપાદન કરે છે. કારણ કે દેવ મનુષ્યાદિક  
પદાર્થો આપનું શરીર છે. અને આપ શરીરી આત્મા છો. અને જે જે શરીર વાચક  
શબ્દો હોય એ અભેદપણાથી શરીરી એવા આત્માના વાચક બને છે. તેથી જ તે તે  
પદાર્થોરૂપે શ્રુતિઓ આપને જ કહે છે. ૧૨ જેમ કારણરૂપે રહેલાં પૃથ્વી આદિક  
ભૂતો એક એક તત્ત્વરૂપે રહેલાં છે, છતાં કાર્યરૂપે પરિણામ પામીને અનેક  
પદાર્થોરૂપે જણાય છે. તેમ સર્વના શરીરી સ્વતંત્ર એવા એક જ આપ સર્વના  
કારણ હોવાથી, સર્વના શરીરી હોવાથી શરીરભૂત સર્વે પદાર્થોમાં બહુ પ્રકારે  
જણાઓ છો. ૧૩ પોતાની શક્તિરૂપ રજોગુણ, તમોગુણ અને સત્ત્વગુણથી તમે  
જગતને ઝર્ઝો છો, પ્રલય કરો છો અને રક્ષણ કરો છો. છતાં તે ગુણોથી અને  
કર્મથી બંધાતા નથી. કારણ કે જ્ઞાનસ્વરૂપ આપમાં ક્યારેય પણ બંધન કરનારી

દેહાદ્યુપાધેરનિરૂપિતવાદ્ ભવો ન સાક્ષાત્ત્ ભિદાડત્મનઃ સ્યાત् ।

અતો ન બધ્યસ્તવ નૈવ મોક્ષ: સ્યાતાં નિકામસ્ત્વયિ નોડવિવેક: ॥૨૨॥

ત્વયોદિતોડયં જગતો હિતાય યદા યદા વેદપથ: પુરાણઃ ।

બાધ્યેત પાખણ્ડપથૈરસદ્બસ્તવદા ભવાન્ સત્ત્વગુણં બિભર્તિ ॥૨૩॥

સ ત્વં પ્રભોડ્ય વસુદેવગૃહેવતીર્ણ: સ્વાંશેન ભારમપનેતુમિહાસિ ભૂમે: ।

અક્ષૌહિણીશતવધેન સુરેતરાંશરાજામમુષ્ય ચ કુલસ્ય યશો વિતન્વન् ॥૨૪॥

અદ્યેશ નો વસતય: ખલુ ભૂરિભાગા ય: સર્વદેવપિતૃભૂતનૃદેવમૂર્તિ: ।

યત્યાદશૌચસલિલાં ત્રિજગત્ પુનાતિ સ ત્વં જગદુરુધ્યોક્ષજ યા: પ્રવિષ્ટ: ॥૨૫॥

ક: પણ્ડતસ્ત્વદપરં શરણં સમીયાદ્ ભક્તપ્રિયાદૃતગિરઃ સુહ્દઃ કૃતજ્ઞાત् ।

સર્વાન્ દદાતિ સુહ્દો ભજતોડભિકામાનાત્માનમપ્યુપચયાપચયૌ ન યસ્ય ॥૨૬॥

દિષ્ટચા જનાર્દન ભવાનિહ ન: પ્રતીતો યોગેશ્વરૈરપિ દુરાપગતિઃ સુરેશો: ।

છિન્ધ્યાશુ ન: સુતકલત્રધનાસગેહદેહાદિમોહરશનાં ભવદીયમાયામ् ॥૨૭॥

અવિદ્યા હોતી જ નથી. ૧૧ હે પ્રભુ ! આપ વાસ્તવિક સ્વરૂપે કરીને તો દેહાદિક  
ઉપાધિથી રહિત છો, તેથી જ્ઞાનસ્વરૂપ એવા જે તમો તે તમારી અંદર સાક્ષાત્  
સંસાર નથી. તમે તો સર્વના શરીરી છો, તેથી શરીરની અંદર રહેલા જે ધર્મો હોય  
એ શરીરીની અંદર પ્રસક્ત થતા નથી. માટે જ તમો બંધ અને મોક્ષથી રહિત છો,  
છતાં તમારે વિષે જે બંધ અને મોક્ષ દેખાય છે, એ કેવળ અમારું અજ્ઞાન જ છે. ૧૨  
જગતના કલ્યાણને માટે આપે કહેલો પ્રાચીન વેદમાર્ગ જ્યારે દુષ્ટ પાખંડ માર્ગોથી  
તૂટવા લાગે ત્યારે આપ સત્ત્વગુણથી અવતાર ધરો છો. ૧૩ હે પ્રભુ ! તે આપ  
દેયોના અંશોરૂપ રાજાઓની સેંકડો અક્ષૌહિણીઓને મારી, પૃથ્વીનો ભાર ઉતારવા  
સારુ અને લોકમાં કીર્તિ વધારવા સારુ, હમણાં બળદેવજીની સાથે વસુદેવના  
ધરમાં અવતર્યા છો. ૧૪ હે ઈશ્વર ! આજ અમારાં ધર તપોવન કરતાં પણ વધારે  
પવિત્ર થયાં છે, કેમકે સર્વે દેવ, પિતૃ, ભૂત અને રાજાઓ જેના સ્વરૂપમાં છે એવા  
અને જેના ચરણ ધોવાનું જળ (ગંગાજ) ત્રિલોકીને પવિત્ર કરે છે, એવા જગદીશ્વર  
આપ આ ધરમાં પધાર્યા છો. ૧૫ હે પ્રભુ ! આપ ભક્તોપર પ્રેમ રાખનાર,  
સત્યવક્તા, સર્વના સ્નેહી અને કૃતજ્ઞ છો, તેથી કયો સમજુ માણસ બીજાને શરણે  
જાય ? કારણ કે આપ જ ભક્તિ કરનારા લોકોને સર્વે, અભિલાષાઓ અને પોતાના  
સ્વરૂપને આપો છો. ૧૬ હે વિષ્ણુ ! દેવતા અને યોગેશ્વરો પણ જેના સ્વરૂપને ઘણા  
પ્રયત્નથી પામે છે, એવા આપે અહીં આજ અમને દર્શન દીધું એ બહુ જ સારુ

## શ્રીશુક ઉવાચ

ઇત्यर्चितः संस्तुतश्च ભक्तेन ભગવान् हरिः । अक्रूरं समितं प्राह गीर्भिः सम्मोहयन्निव ॥२८॥  
श્રીભગવानुવाच

त्वं नो गुरुः पितृव्यश्च श्लाघ्यो बन्धुश्च नित्यदा । वयं तु रक्ष्याः पोष्याश्च अनुकम्प्याः प्रजा हिवः  
भवद्विधा महाभागा निवेद्या अर्हसत्तमाः । श्रेयस्कामैर्नैर्भिर्नित्यं देवाः स्वार्थां न साधवः ३०  
न ह्यमयानि तीर्थानि न देवा मृच्छलामयाः । ते पुनन्त्युरुकालेन दर्शनादेव साधवः ॥३१  
स भवान् सुहृदां वै नः श्रेयाज्ज्हेयश्चिकीर्षया । जिज्ञासार्थं पाण्डवानां गच्छस्व त्वं गजाह्यम्  
पितर्युपरते बालाः सह मात्रा सुदुःखिताः । आनीताः स्वपुरं राजा वसन्त इति शुश्रुम ॥३२  
तेषु राजाम्बिकापुत्रो भ्रातृपुत्रेषु दीनधीः । समो न वर्तते नूनं दुष्प्रत्रवशगोऽथदृक् ॥३४  
गच्छ जानीहि तद्वृत्तमधुना साध्वसाधु वा । विज्ञाय तद् विधास्यामो यथा शं सुहृदां भवेत् ३५

કर्यु, पुत्र, स्त्री, धन, सगां, धर अने देहादिकमां मोह थवारूप बेडी जे तમारी  
મायारूप छे तेने तरत कापो.<sup>२७</sup>

शुकदेवज्ञ कહे छे आ प्रमाणे भक्त अक्षरज्ञ द्वारा पूजन अने सुति करायेला  
श्रीकृष्ण भगवान जाणे वाणीथी मोह पमाडता होय, तेम हसीने अक्षरज्ञने आ  
प्रमाणे कहेवा लाग्या.<sup>२८</sup>

भगवान कહे छे तमे अमारा गुरु, काका अने सर्वदा वभाषावा जेवा बंधु  
छो अने अमे तो तमारा द्यापात्र पुत्रो छीअे, माटे तमारे अमारी रक्षा करवी  
जोઈअे अने पोषण करवुं जोઈअे.<sup>२९</sup> कल्याणनी ईच्छा राखनार मनुष्यो अे तमारा  
जेवा भाग्यशाणी उत्तम साधुओनुं सेवन करवुं जोઈअे. देवताओ पोतानुं कार्य  
साधवामां तत्पर होय छे अने साधुपुरुषो तो बीजाओनी उपर अनुग्रह करवामां  
ज तत्पर होय छे, माटे वास्तविक रीते साधु पुरुषो ज देव होवाथी तेनुं ज सेवन  
करवुं जोઈअे.<sup>३०</sup> तीर्थो मात्र पाणी ज छे अने देवताओ माटी तथा शिलारूप ज  
छे एवुं नथी; केमके तेमां यमत्कार रह्यो छे, परंतु तेओ धणा काणनी सेवाथी  
पवित्र करे छे अने साधुपुरुषो तो दर्शन मात्रथी ज पवित्र करे छे.<sup>३१</sup> तमे अमारा  
संबंधीओमां श्रेष्ठ छो, माटे पांडवोनुं वृतांत ज्ञाषावा सारु अने तेनुं कल्याण  
करवानी ईच्छाथी हस्तिनापुर जाओ.<sup>३२</sup> पांडु राजा मृत्यु पामतां पिता वगरना  
बहु ज हुःभिया पांडवोने तेनी मा कुंतीनी साथे धृतराष्ट्र राजा ए हस्तिनापुरमां  
तेजाव्या छे अने तेओ अत्यारे त्यां रहे छे, एवुं अमे सांभण्युं छे.<sup>३३</sup> परंतु पोताना  
दुष्ट पुत्रोने आधीन रहेनार अने कुंगाल मननो आंधणो धृतराष्ट्र राजा पोताना

इत्यक्रूरं समादिश्य भगवान् हरिरीश्वरः । संकर्षणोद्भवाभ्यां वै ततः स्वभवनं ययौ ॥३६

इति श्रीमद્બાગવતे મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્દ્યે પૂર્વાર्थી  
અષ્ટચત્વારિંશોઽધ્યાય: ॥४८॥

## अથેકોનપञ્ચાશતમોऽધ્યાય: (४९)

## ॥ श્રીશુકउવાચ ॥

स गत्वा हास्तिनपुरं पौरवेन्द्रयशोऽङ्गितम् । दर्शनं तत्रांबिकेयं सभीष्मं विदुरं पृथाम् ॥१  
सहपुत्रं च बाह्यीकं भारद्वाजं सगौतमम् । कर्णं सुयोधनं द्रौणिं पाण्डवान् सुहृदोऽपरान् ॥२  
यथावदुपसङ्गम्य बन्धुभिर्निन्दनीसुतः । सम्पृष्टतैः सुहृदार्ता स्वयं चापृच्छदव्ययम् ॥३  
उवास कतिचिन्मासान् राजो वृत्तविवित्सया । दुष्प्रजस्याल्पसारस्य खलच्छन्दानुर्वर्तनः ॥४

ભાઈના પુત્ર પાંડવોની સાથે સમદાસિથી વર્તતો નથી.<sup>३४</sup> માટે તમે હસ્તિનાપુર  
જાઓ અને હમણાં તેની સારી અને નરસી જે વર્તણૂક હોય તેનો નિશ્ચય કરો.  
આપણે બધી વાતનો નિશ્ચય કરી જેવી રીતે સંબંધીઓનું કલ્યાણ થશે તેવી યોજના  
કરીશું.<sup>३५</sup>

शુકदेवज्ञ કહे छे सર्वना ईश्वર भगवान आवी रीते अक्षरज्ञने आજ्ञा  
કરી पઢી રામ અને ઉદ્ધવજીની સાથે ઘેર પધાર્યा.<sup>३६</sup>

ઇति श्रीमद् मહापुराणा भागવतना દશમ સ્કંદનો અડતાલીશમો  
અધ્યાય સંપૂર્ણ.

## અધ્યાય ४८

धृતરाष्ट्रનો પોતાના પુત્રો તથા પાંડવો પ્રત્યેનો ભેદભાવ  
જાહીને મથુરામાં આવતા અફૂરણુ.

शુકदेवज्ञ કહે છે- પુરુ વંશના મોટા રાજાએ કરાવેલાં દેવાલયાદિકનાં  
ચિહ્નવાળા હસ્તિનાપુરમાં જઈને અક્ષરજીએ ત્યાં ધૃતરાષ્ટ્ર, ભીષ્મ, વિદુર, કુંતી,  
સોમદાત, બાહ્યિક, દ્રોષા, કૃપાચાર્ય, કર્ણ, દુર્યોધન, અશ્વત્થામા અને બીજા  
સંબંધીઓને પણ મળ્યા.<sup>१-२</sup> અક્ષરજી બંધુઓની સાથે યથાયોગ્ય રીતે મળ્યા પઢી  
ધૃતરાષ્ટ્રાદિકોએ સંબંધીઓની વાત પૂછી અને પોતે પણ સર્વને કુશળ પૂછ્યું.<sup>३</sup>  
થોડી ધીરજવાળો અને ખળપુરુષોની ઈચ્છા પ્રમાણે યાલનાર ધૃતરાષ્ટ્ર રાજા, કે

तेज ओजो बलं वीर्यं प्रश्रयादीश्च सदृष्टान् । प्रजानुरागं पार्थेषु न सहद्विश्विकीर्षितम् ॥५  
कृतं च धार्तराष्ट्रैर्यद् गरदानाद्यपेशलम् । आचर्ख्यौ सर्वमेवास्मै पृथा विदुर एव च ॥६  
पृथा तु भ्रातरं प्रासमकूरमुपसृत्य तम् । उवाच जन्मनिलयं स्मरन्त्यश्रुकलेक्षणा ॥७  
अपि स्मरन्ति नः सौम्य पितरौ भ्रातरश्च मे । भगिन्यो भ्रातृपुत्राश्च जामयः सख्य एव च ॥८  
भ्रात्रेयो भगवान् कृष्णः शरण्यो भक्तवत्सलः । पैतृष्वसेयान् स्मरति रामश्चाम्बुहेक्षणः ९  
सापलमध्ये शोचन्ती वृकाणां हरिणीमिव । सान्त्वयिष्वति मां वाक्यैः पितृहीनांश्च बालकान् १०  
कृष्ण कृष्ण महायोगेन् विश्वात्मन् विश्वभावन । प्रपन्नां पाहि गोविन्द शिशुभिश्वावसीदतीम्  
नान्यत्वं पदाभ्योजात् पश्यामि शरणं नृणाम् । विभ्यतां मृत्युसंसारादीश्वरस्यापवर्गिकात् १२  
नमः कृष्णाय शुद्धाय ब्रह्मणे परमात्मने । योगेश्वराय योगाय त्वामहं शरणं गता ॥१३

## श्रीशुक उवाच

जेना पुत्रो हुध्य हता, तेना स्वभाव प्रकृति जाणवानी ईर्यणाथी अकूरज्ञ केटलाङ्क  
महिना सुधी हस्तिनापुर रह्या ॥४ त्यां पांडवोमां प्रभाव, शास्त्रादिकमां निपुणता,  
बण, शूरवीरपणुं, नम्रता आदि शुभगुणो, पांडवो प्रत्ये प्रजानो जे स्नेह तेने  
सहन न करी शक्ता धृतराष्ट्रना पुत्रोअे जे कांઈ पांडवो विषे धार्यु हतुं तथा झेर  
देवा आदि जेटला अन्याय कर्या हता ते विषेनी सर्वे वात कुंतीअे तथा विद्वरज्ञाअे  
अकूरज्ञनी पासे कही देखाई ॥५-६ पोताना भाई अकूरज्ञ त्यां आव्या तेमनी  
पासे जै जन्मभूमिने संभारतां अने आंसुनां बिंदुओ जेना नेत्रमांथी झरतां  
हतां, ऐवां कुंतीअे उपरनी वात कह्या पहेलां अकूरज्ञने आ प्रमाणे कह्युं ॥७

कुंती कहे छे- हे सौम्य ! मारां माबाप, भाईओ, बहेनो, भाईना दीकरा,  
कुणनी स्त्रीओ अने सभीओ अमने संभारे छे ? ॥८ मारा भाईना पुत्र शरणागतनुं  
रक्षण करनार अने भक्तवत्सल श्रीकृष्ण तथा कमण सरभा नेत्रवाणा बलराम  
ऐमनी ईर्हना दीकराओने संभारे छे ? ॥९ हुं वरुओनी वय्यमां मृगलीनी जेम  
शत्रुओनी वयमां शोक कर्या करुं छुं आवी मने अने बाप वगरना मारा भाणकोने  
श्रीकृष्ण वयनथी धीरज आपशे ? ॥१० हे कृष्ण ! हे कृष्ण ! हे मोटायोगी ! हे  
जगतना आत्मा ! हे जगतने पाणनार ! हे गोविंद ! शरणागत ऐवी हुं भाणकोनी  
साथे पीडा पामुं छुं, तेनी रक्षा करो ॥११ मृत्युरुप संसारथी भय पामता माणसोने  
आप ईश्वरना मोक्ष आपनारा चरणारविंद विना बीजुं कोई शरण हुं देखती  
नथी ॥१२ शुद्ध, परब्रह्म, परमात्मा, योगेश्वर अने शानस्वरुप आप श्रीकृष्णने  
प्रणाम करुं छुं. अने आपने शरणे आवी छुं ॥१३

इत्यनुस्मृत्य स्वजनं कृष्णं च जगदीश्वरम् । प्रारुद्ददुःखिता राजन् भवतां प्रपितामही ॥१४  
समदुःखसुखोऽक्रूरो विदुरश्च महायशा । सान्त्वयामासतुः कुन्ती तत्पुत्रोत्पत्तिहेतुभिः ॥१५  
यास्यन् राजानमध्येत्य विषमं पुत्रलालसम् । अवदत् सुहृदां मध्ये बन्धुभिः सौहृदेवितम् ॥१६  
अकूर उवाच

भो भो वैचित्रवीर्यं त्वं कुरुणां कीर्तिवर्धन । भ्रातर्युपरते पाण्डवधुनाऽऽसनमास्थितः १७  
धर्मेण पालयन्नुर्वी प्रजाः शीलेन रज्यन् । वर्तमानः समः स्वेषु श्रेयः कीर्तिमवाप्यसि ॥१८  
अन्यथा त्वाचरङ्ग्लोके गर्हितो यास्यसे तमः । तस्मात् समत्वे वर्तस्व पाण्डवेष्वात्मजेषु च ॥१९  
नेह चात्यन्तसंवासः कर्त्तिचित् केनचित् सह । राजन् स्वेनापि देहेन किमु जायात्मजादिभिः २०  
एकः प्रसूयते जन्मुरेक एव प्रलीयते । एकोऽनुभुदिक्ते सुकृतमेक एव च दुष्कृतम् ॥२१  
अधर्मोपचितं वित्तं हरन्त्यन्येऽत्यमेधसः । सम्भोजनीयापदेशैर्जलानीव जलौकसः ॥२२  
पुष्णाति यानधर्मेण स्वबुद्ध्या तमपणिडतम् । तेऽकृतार्थं प्रहिणवन्ति प्राणा रायः सुतादयः ॥२३

शुकृदेवज्ञ कहे छे- हे राजा ! आ प्रमाणे स्वजनने अने ईश्वर श्रीकृष्णने  
संभारी हुःभ पामेलां तमारी परदादी (कुंती) रोवा लाभ्यां ॥४ जेने सुभ हुःभ  
समान हतां ऐवा अने भोटी कीर्तिवाणा अकूरज्ञाअे तथा विद्वरज्ञाअे, ऐ कुंतीने  
तेना पुत्रोना जन्मनां कारणो कहीने सांत्वना करी ॥५ पछी अकूरज्ञ हस्तिनापुर-  
मांथी रवाना थया त्यारे धृतराष्ट्र राजा, के जे विषम रीते वर्तनार अने प्रेमथी  
कुपुत्रोने अनुसरतो हतो तेने श्रीकृष्ण तथा बणदेवज्ञ आदि बंधुओअे जे स्नेहथी  
कहेवानुं कह्युं हतुं ते अकूरज्ञाअे सर्वे संबंधीओना सांभणतां आप्रमाणे कह्युं ॥६

अकूरज्ञ कहे छे- हे विचित्रवीर्यना पुत्र ! हे कुरुकुणी कीर्तिने वधारनार !  
तमारा भाई पांडु राजा भरण पामतां तेना पुत्रो होवा छतां पाण तमे अत्यारे  
राज्यासन उपर बेठा छो ॥७ आम कर्या छतां पाण जो तमे धर्ममार्गथी पृथ्वीनुं  
पालन करशो, प्रजाओने सदाचारथी राज राखशो अने संबंधीओमां समदेष्टिथी  
वर्तशो तो तमने कल्याण अने कीर्ति प्राप्त थशे ॥८ पाण ऐथी उलटी रीते चालशो  
तो जगतमां निंदाना पात्र बनीने अंते नरकमां पडशो. माटे पांडवोमां अने पोताना  
पुत्रोमां समदेष्टिथी वर्तजो ॥९ हे राजा ! आ जगतमां कही पाण कोईनी साथे  
निरंतर सहवास रहेतो नथी. पोताना देहनी साथे पाण सहवास रहेतो नथी  
त्यारे बीजां स्त्री अने पुत्रादिकनी साथे न रहे तेमां कहेवुं शु? ॥१० ज्ञव एकलो ज  
जन्मे छे अने एकलो ज पाप अने पुण्य भोगवे छे ॥११ जेम बीजां जगयर प्राणीओ  
माधवानां ज्ञवनरुप ज्ञने लई जाय छे, तेम अत्य भुद्धिवाणा माणसे अधर्मथी

સ્વયં કિલ્બિષમાદાય તૈસ્ત્યકો નાર્થકોવિદઃ । અસિદ્ધાર્થો વિશત્યન્યં સ્વધર્મવિમુહસ્તમઃ  
તસ્માલોકમિમં રાજન् સ્વન્માયામનોરથમ् । વીક્ષ્યાયમ્યાત્મનાઽત્માનં સમઃ શાન્તો ભવ પ્રભો  
ધૃતરાષ્ટ્ર ઉવાચ

યથા વદતિ કલ્યાણી વાચં દાનપતે ભવાન् । તથાનયા ન તૃપ્યામિ મર્ત્યઃ પ્રાણ્ય યથામૃતમ્ ૨૬  
તથાપિ સૂન્તા સૌમ્ય હ્વદિ ન સ્થીયતે ચલે । પુત્રાનુરાગવિષમે વિદ્યુત્ સૌદામની યથા ॥૨૭  
ઇશ્વરસ્ય વિધિ કો નુ વિધુનોત્યન્યથા પુમાન् । ભૂમેર્ભારાવતારાય યોજવતીર્ણો યદે: કુલે ૨૮  
યો દુર્વિર્મશર્પથયા નિજમાયયેદં સૃષ્ટા ગુણાન્ વિભજતે તદનુપ્રવિષ્ટઃ ।

તર્સૈ નમો દુરવબોધવિહારતન્ત્રસંસારચક્રગતયે પરમેશ્વરાય ॥૨૯

શ્રીશુક ઉવાચ

ઇત્યભિપ્રેત્ય નૃપતેરભિપ્રાયં સ યાદવઃ । સુહુદ્ધિ: સમનુજ્ઞાતઃ પુનર્યદુપુરીમગાત् ॥૩૦  
શાંસસ રામકૃષ્ણાભ્યાં ધૃતરાષ્ટ્રવિચેષિત્તમ् । પાણ્ડવાન્ પ્રતિ કૌરવ્ય યદર્થ્ પ્રેષિતઃ સ્વયમ् ૩૧

ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યમણ્ઠાદશસાહસ્રચાં પારમહંસ્યાં સંહિતાયાં  
દશમસ્કન્ધે પૂર્વાર્ધે એકોનપઞ્ચાશત્તમોઽધ્યાય: ॥૪૯॥

સમાપ્તિમિદં દશમસ્કન્ધસ્ય પૂર્વાર્ધમ्

શ્રીકૃષ્ણાર્પણમસ્તુ

ભેગા કરેલા ધનને તેના પુત્રાદિક લોકો અમો પોષણ કરવા યોગ્ય છીએ, આવા  
બહાનાથી હરી જાય છે. ૨૨ જેઓને પોતાના સમજી અધર્મથી પોષણ કરે છે તે  
પ્રાણ, ધન અને પુત્રાદિક લોકો તે પોષણ કરનારા મૂર્ખ માણસને ભોગનું સુખ ન  
મળ્યું હોય તે પહેલાં જ છોડી દે છે. ૨૩ પ્રાણ, ધન અને પુત્રાદિકે છોડી દીધેલો  
પોતાના સાચા સ્વાર્થને નહીં સમજનાર, સ્વધર્મથી વિમુખ અને જેનું પ્રયોજન  
સિદ્ધ થયું નથી એવો તે માણસ પોતે કરેલા પાપને જ સાથે લઈને નરકમાં પડે  
છે. ૨૪ માટે હે રાજા ! આ દેહને તથા લોકને સ્વપ્નની પેઠે અનિત્ય જાણીને બુદ્ધિથી  
મનને વશ રાખતાં શાંતિ ધરી સમદાચિ રાખો. ૨૫

ધૃતરાષ્ટ્ર કહે- હે અફૂરજુ ! મનુષ્ય જેમ અમૃત પીવાથી તૃપ્તિ ન પામે તેમ  
હું તમે કહેલી આ શુભ વાણીથી તૃપ્ત થતો નથી. ૨૬ હે સૌમ્ય ! તમારી વાણી મને  
બહુ જ સારી લાગે છે, તોપણ પુત્રો ઉપર સ્નેહથી વિષમ થયેલા મારા ચંચલ  
હદ્યમાં સુદામા પર્વતની દિશામાં થઅેલી વીજળીની પેઠે સ્થિર રહેતી નથી. ૨૭  
જે ઈશ્વર પૃથ્વીનો ભાર ઉતારવા સારુ યદુકુળમાં જન્મ્યા છે, તેમણે જે ધાર્યું હશે  
તેને ફેરવી નાખવાને કયો પુરુષ સમર્થ છે ? ૨૮ સમજવામાં ન આવે એવી લીલાથી

જ બનાવેલા સંસારરૂપ ચક્ને ગતિ આપનાર જે ઈશ્વર, તર્કમાં ન આવે એવા  
માર્ગવાળી પોતાની માયાથી આ જગતને જ્ઞ તેમાં પ્રવેશ કરીને કર્મોના ફળને  
વિભાગ પૂર્વક આપે છે, તે પરમેશ્વરને પ્રાણમ કરું છું. ૨૯

શુકુદેવજી કહે છે- હે રાજા ! અફૂરજુ આ પ્રમાણે ધૃતરાષ્ટ્ર રાજાનો  
અભિપ્રાય જાણી સંબંધીઓની અનુજ્ઞા લઈને પાછા મથુરામાં આવ્યા અને પાંડવો  
વિષે ધૃતરાષ્ટ્રની જે વર્તનકથા તે જાણવાને માટે પોતાને મોકલ્યા હતા, તે પાંડવોની  
સર્વે વાત બણદેવજી અને કૃષ્ણાની આગળ કહી દેખાડી. ૩૦-૩૧

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમસ્કંદનો અ૦ગણપચાશમી  
અદ્યાય સંપૂર્ણ.

# પૂર્વાર્ધ સંપૂર્ણ